

॥ હરિ:ॐ ॥

# જીવનપરાગ



પૂજય શ્રીમોટાના સાધકોને પત્રોનો સારસંચય

: સંપાદકો :

શ્રી હેમંતભાઈ નીલકંઠ / શ્રી નંદુભાઈ શાહ



॥ હરિ:ॐ ॥

# જીવનપરાગ

પૂજ્ય શ્રીમોટાના  
સાધકોને પત્રોનો સારસંચય

: સંપાદકો :

શ્રી હેમંતભાઈ નીલકંઠ  
શ્રી નંદુભાઈ શાહ

હરિ:ॐ આશ્રમ પ્રકાશન, સુરત

- प्रकाशक : ट्रस्टीभंडण,  
હरिःअँ आश्रम,  
કुरुक्षेत्र महादेवना मंदिरनी बाजुमां,  
જहांगीरपुरा, सुरत-३८५००४.  
फोन : (०૨૬૧) २७६५५६४
- હરિઃઅઁ આશ્રમ, સુરત, નડિયાદ.
- | આવૃત્તિ | વર્ષ | પ્રત | આવૃત્તિ | વર્ષ | પ્રત |
|---------|------|------|---------|------|------|
| પ્રથમ   | ૧૯૬૩ | ૨૨૫૦ | ચોથી    | ૧૯૮૮ | ૧૦૦૦ |
| બીજી    | ૧૯૭૩ | ૧૨૫૦ | પાંચમી  | ૧૯૯૫ | ૧૦૦૦ |
| ત્રીજી  | ૧૯૮૩ | ૧૦૦૦ | છઠી     | ૨૦૦૮ | ૧૦૦૦ |
- પૂછ : ૪૦+૬૦૮=૬૪૮
- પડતર કિંમત : રૂ. ૭૫/-
- વેચાણ કિંમત : રૂ. ૫૦/-
- પ્રાપ્તિસ્થાન : હરિઃઅઁ આશ્રમ, સુરત-૩૮૫ ૦૦૪  
હરિઃઅઁ આશ્રમ, નડિયાદ-૩૮૭ ૦૦૧
- ડિઝાઇનર : મધૂર જાની  
બી/૮, રીપલ એપાર્ટમેન્ટ, નારાયણનગર, પાલડી,  
અમદાવાદ-૩૮૦૦૦૭. મો. : ૯૪૨૮૪૦૪૪૪૩
- ટાઈપસેટિંગ : અર્થ કોમ્પ્યુટર,  
૨૦૩, મૌર્ય કોમ્પ્લેક્સ, સી. યુ. શાહ કોલેજ સામે,  
ઇન્કમટેક્સ, અમદાવાદ-૧૪, ફોન : (૦૭૯) ૨૭૫૪૩૬૮૮
- મુદ્રક : સાહિત્ય મુદ્રણાલય પ્રા. લિ.  
સિટી મિલ કંપાઉન્ડ, કાંકરિયા રોડ, અમદાવાદ-૩૮૦૦૨૨  
ફોન : (૦૭૯) ૨૫૪૬૮૧૦૧

॥ હરિ:ॐ ॥  
**સમર્પણાંજલિ**  
(છષ્ટી આવૃત્તિ)

ચૈત્ર સુદ ૮ સંવત ૧૯૯૫, રામનવમી (તા. ૨૯-૩-૧૯૭૮)ના રોજ બનારસમાં પૂજ્ય શ્રીમોટાને પરમાત્માની અનંત બ્રહ્માંડવ્યાપી ચેતનાનો સાક્ષાત્કાર થયો અને તે ઘડીથી ‘હું સર્વત્ર વિદ્યમાન છું’ એવી ચેતના ભાવનાનું સર્વપ્રકારે પ્રાગટ્ય થયું.

સ્વજનોને પૂજ્ય શ્રીમોટાની હાજરીનો પળેપળ અનુભવ થતો રહે છે. પૂજ્ય શ્રીમોટાના ૭૧મા સાક્ષાત્કાર દિન રામનવમી ચૈત્ર સુદ ૮ સંવત ૨૦૬૫ તા. ૩-૪-૨૦૦૮ ઉત્સવના યજમાન-

સ્વ. દિનેશચંદ્ર ઈશ્વરલાલ મહેતા

ઈશ્વરલાલ છબીલદાસ મગજવાળા

કિરીટકુમાર બાબુભાઈ તમાકુવાળા

ભરતકુમાર બચ્યુભાઈ ભાવનગરી (જેકી)

અશોકકુમાર સાકરલાલ મગજવાળા

તથા તેમના સમગ્ર પરિવારને ‘જીવનપરાગ’ની આ છષ્ટી આવૃત્તિ પ્રેમભાવથી અર્પણ કરતાં ટ્રસ્ટીમંડળ આભારની લાગણી વ્યક્ત કરે છે.

તા. ૩-૪-૨૦૦૮  
રામનવમી, સં. ૨૦૬૫

ટ્રસ્ટીમંડળ,  
હરિ:ॐ આશ્રમ, સુરત

॥ હરિઃॐ ॥

શ્રી કાંતિલાલ જગજીવનદાસ પટેલ (બાવળા)ને  
તથા

શ્રીમતી સવિતાબહેનને  
સપ્રેમ સમર્પણાંજલિ

(પ્રથમ આવૃત્તિ)

(અનુષ્ઠાપ)

કાંતિ જીવનની પૂર્ણી, કાંતિ સંપૂર્ણી જીવને  
થયા વિના, કદી ખાલી ખીલી કદી ન તે ઉઠે. ૧

ઘણા વેપારી તો જોયા, તેમાં શા અપવાદ છો !  
ઉચ્ચ પ્રકારના કેવા જીવને રસ, શોખ સૌ ! ૨

કેળવ્યાં જ કરેલી છે, કળા શી કેટકેટલી !  
ઉચ્ચ તે અભિલાષામાં રાચતા, ઓર ભાવથી. ૩

કેવી તે જાતના શોખ-રસ જીવન હોય છે !  
તેમ જીવન તેવાનું મેળે શું પરખાય છે ! ૪

હળીમળી જતા કેવા ! યોગ્ય મિલનસાર છો,  
ગુલાબી છો સ્વભાવે શા ! વ્યવહારેય દક્ષ છો. ૫

આધિભૌતિક ને દૈવી ને આધ્યાત્મિક જીવને  
-મહત્ત્વાકંક્ષી કેવા છો ! પરખાયે પરિચયે. ૬

અનોખી છાપ સંસારે, તમારી મસ્ત ઓર છે,  
નોખા શા તરી આવો છો ! સંસારી માનવીથી તે. ૭

જીવને ભાવના ઉચ્ચ શી તરવરતી હોય છે !  
 છતાં એને ન કોઈએ પરખી શકતા જ છે. ૮  
 છુપાયેલું શું સંસારે શા આશમોલ રત્ન છો !  
 પરખાવા ન તેવું તે દીધું છે કોઈને જ તો. ૯  
 મારા ગરીબ જેવાને પ્રોત્સાહન દઈ તમે,  
 ઊભો રાખ્યો ટટારીથી શી તમ દેણગી જ તે ! ૧૦  
 ભાવ, ઉમળકો હૈયે તમારા પર ઊછળી  
 -વહેવા દિલ માંડ્યાથી લખાયું આ શું દિલથી ! ૧૧  
 કેટકેટલું આપ્યું છે, દિલ, મનથી, લક્ષ્મીથી,  
 નવાજ્યા જે રીતે ભાવે, તેને શું અર્પું દિલથી ! ૧૨  
 મારી પાસે કશું ના છે, કિંતુ દઉં હું ભાવથી,  
 અર્પું તે પ્રેમના ભાવે સૌરભ આ ‘પરાગ’ની. ૧૩  
 હરિ:ઊં આશ્રમ, નાનિયાદ  
 તા. ૧૧-૧૧-૧૯૭૨

— મોટા

॥ હરિઃઅঁ ॥

## પ્રરોચના

લેખક : અનુપરામ ગોવિંદરામ ભણ (એમ.એ.)

અધ્યક્ષ : સંસ્કૃત વિભાગ, એલ.ડી. આર્ટ્સ કોલેજ, અમદાવાદ  
(પ્રથમ આવૃત્તિ)

ઘણાં વર્ષો પૂર્વની વાત છે. યોગસૂત્રો અને તેના પરનાં ભાષ્યોનું અધ્યયન-અધ્યાપન ચાલતું હતું. મહર્ષિ પતંજલિનાં સૂત્રોનો ગંભીર આશય પ્રકાશિત થતાં મન આનંદમાં દૂબી જતું. ચિત્તમાં ઉક્તિ વૃત્તિઓનો લય થતાં સ્વરૂપના અનુસંધાનની એ ધન્ય સ્થિતિ કેવી હશે એવા વિચારો આવતા. પ્રસ્તુત અભ્યાસ જેમ વધવા લાગ્યો તેમ યોગસાધનાના માર્ગમાં વિઘનરૂપે આવતી અનેક લોભાવનારી સિદ્ધિઓમાં અટવાઈ ન જતાં જે સાધક અડગ નિર્ધાર સાથે પોતાની મંજિલ પર આગળ વધતો જ જાય છે, તેનું ધ્યેય અવશ્ય સિદ્ધ થાય છે, તે રહસ્ય યથાર્થપણે સમજાવા લાગ્યું, પરંતુ એક વાત મનમાં સતત ઘોળાવા લાગી કે યોગમાર્ગમાં આવતી સિદ્ધિઓ, પ્રગટ થતા ચમત્કારો વગેરે ભલે વિઘનરૂપ હોય, પણ તેવા ચમત્કારો જેને થયા હોય, તેવા કોઈ યોગસિદ્ધ પુરુષે પોતાના અનુભવો વર્ણવ્યા હોય, તો તે સાચા જિજ્ઞાસુ તેમ જ સાધકને પ્રેરક અને પ્રોત્સાહક બને ખરા ? અધ્યાત્મમાર્ગના પથિકને માટે યોગારૂઢ પુરુષોના જીવનવિકાસ દરમિયાન થયેલા આધ્યાત્મિક અનુભવો, તેમણે આપેલું માર્ગદર્શન અને તેમના સદ્ગુપદેશો અત્યંત ઉપકારક બને છે, તેમ જ તેને સાધનાના ઉચ્ચ શિખર પર પ્રતિષ્ઠિત કરી, તેના આંતરજીવનને અર્થસભર અને સમૃદ્ધ કરે છે, તેમાં શંકા નથી. આવા વિચારોથી પ્રેરાઈ અને સંતો, યોગીઓ અને

મહાત્માઓનાં જીવનવૃત્તાંત તથા ઉપદેશો વાંચવામાં મને ભારે રસ પડવા લાગ્યો.

જેમ જેમ ઉપર દર્શાવ્યા પ્રમાણે વાંચવામાં દિવસો પસાર થતા ગયા, તેમ તેમ મારી જિજ્ઞાસા અને રસવૃત્તિને પોષે તેવાં નવાં નવાં પુસ્તકો મને ઈશ્વરકૃપાથી અનાયાસે પ્રાપ્ત થવાં લાગ્યાં, અને ‘યાદશી ભાવના યસ્ય સિદ્ધર્ભવતિ તાદૃશી’, ‘જેવી જેની ભાવના તેવી તેને સિદ્ધિ થાય છે’—તે કથનના સત્યનો મને અનુભવ થવા લાગ્યો. જેમ જેમ નવા નવા ગ્રંથો વાંચવાની તક મળતી ગઈ, તેમ તેમ સંતો અને યોગીજનો વિશે જાણવાની ઈચ્છા પણ વધારે ને વધારે સતેજ થતી ગઈ અને વર્તમાન સમયમાં અસ્તિત્વ ધરાવતા સંતો સંબંધી જિજ્ઞાસા તથા તેમને મળવાની ઈચ્છા પણ વૃદ્ધિ પામતી ગઈ.

આ અરસામાં મારા એક મિત્ર પ્રા. શ્રી ઈંદ્રભાઈ દેસાઈએ પૂજ્ય શ્રીમોટાના વિવિધ લેખોમાંથી આકલન કરેલાં અનુભવવાક્યો અને ઉપદેશોના સંગ્રહરૂપે પ્રસિદ્ધ થયેલો ‘જીવનપરાગ’ નામનો ગ્રંથ વાંચવાની મને ભલામણ કરી. તે ગ્રંથ મને જીવનવિકાસની ઉત્તમ માર્ગદર્શિની સમો લાગ્યો. આ પુસ્તક જેમ જેમ હું વાંચતો ગયો, તેમ તેમ સાધનાની કેરી પર પ્રયાણ કરતા પથિકને જીવનમાં ઉતારવા જેવું અત્યંત ઉપયોગી માર્ગદર્શન તેમાં થયું છે, એવી મને પ્રતીતિ થઈ. ‘જીવનપરાગ’માં સંગૃહીત થયેલી પૂજ્ય શ્રીમોટાની વાણીથી હું પ્રભાવિત થયો.

ગધમાં લખેલાં પૂજ્ય શ્રીમોટાનાં ઘણાંખરાં પુસ્તકોનાં શીર્ષકનો પ્રારંભ ‘જીવન’ શબ્દથી થાય છે. પ્રત્યેક પુસ્તક એક અનોખું પુષ્પ છે. ‘સર્વતઃ સારભાદ્યાત્પુષ્પેભ્ય ઇવ ષટ્પદઃ ।’ ‘પુષ્પોમાંથી જેમ ભમરો સારભાગનું ગ્રહણ કરે છે, તેમ સર્વમાંથી સાર એકત્રિત કરવો’—એ કથન અનુસાર તેઓશ્રીના વિવિધ ગ્રંથોમાંથી ઉત્કૃષ્ટ તત્ત્વાંશો આ ગ્રંથમાં એકત્રિત કરવામાં આવ્યા છે. પૂજ્ય શ્રીમોટાના

અનુભવોનો નિર્જર્ખ તેમાં સમાયેલો છે. જીવનને ઉર્ધ્વમુખી કરવાનું અલોકિક સામર્થ્ય તેમાં રહેલું છે. સન્માર્ગના જિજ્ઞાસુને આ ગ્રંથમાંથી અચૂક માર્ગદર્શન મળ્યા વિના રહે તેમ નથી. સંતપુરુષો મનુષ્ય- જીવનના સાચા શિલ્પકાર છે, એવી પ્રતીતિ આવા ગ્રંથોના સહદ્ય વાચકને નિરંતર થયા કરશે.

‘જીવનપરાગ’માં સંગૃહીત થયેલાં કેટલાંય વિચારમૌક્તિકોમાં અનુભવી સંતની મૌલિક સૂજ, ઊંડી અંતર્દૃષ્ટિ અને લોકોત્તર અનુભૂતિનાં દર્શન થાય છે. આધ્યાત્મિક વિકાસ અને યથાર્થ જીવનદૃષ્ટિ પ્રાપ્ત કરવાની અદ્ભુત મહેચ્છા સેવતા સાધકને અત્યંત ઉપયોગી થાય તેવા કેટલાક મુદ્દાઓ અને અવતરણો ઘણાં મનનીય જણાવવાથી અત્રે રજૂ કરવાની તક લઈ છું.

મુક્તાત્મા અને તેનાં દુર્ગમ ગૂઢ વર્તનો વિશે જે ઉદ્ધરણો ‘જીવનપરાગ’માં રજૂ થયાં છે, તે મુક્તાત્મા વિશેની સમજ કેળવવામાં ઘણાં સહાયક થાય તેમ છે. ત્રિગુણાતીત પુરુષની જીવન-પદ્ધતિ અનોખી હોય છે. તેનાં વર્તનનાં ધારાધોરણો, રીતરસમો વગેરે સંસારી જીવોને ન સમજાય તેવાં હોય છે. લોકોત્તર સિદ્ધ પુરુષોનો વ્યવહાર બાળક, મૂઢ, ઉન્મત્ત કે પિશાચ સમાન હોઈ શકે છે.

ઉન્મત્તવદ् વાપિ ચ બાલવદ् વા  
પિશાચવદ् વાપિ ચરત્વવન્યામ् ॥

તેમનાં બાધ્ય આચરણો વિધિનિષેધથી પર હોય છે. આથી સંસારમાં પ્રવર્તમાન નીતિ-અનીતિનાં ધારાધોરણો લગાડી, તેઓ વિશે કોઈ પણ નિર્ણય બાંધવા જનાર વ્યક્તિ ભ્રમમાં પડી આત્મલાભથી વંચિત રહી, પોતાને જ નુકસાન પહોંચાડે છે. શાસ્ત્રોમાં આ બધી હકીકતો દર્શાવવામાં આવી છે, પરંતુ પૂજ્ય શ્રીમોટાએ મુક્તાત્માની વર્તનપદ્ધતિ વિશે જે સ્પષ્ટીકરણ કર્યું છે,

તેમાં શાસ્ત્રના મર્મને બૌદ્ધિક ધોરણે સમજવા મથતા સાચા જિજ્ઞાસુને પોતાના પ્રશ્નોનું સંતર્પક અને ન્યાયસંગત નિરાકરણ મળી જાય છે. અધ્યાત્મશાસ્ત્રના કેટલાય દુર્ગમ કોચડાઓનો ઉકેલ આ સંતાત્માની તર્કસંગત, હૃદયંગમ અને મૌલિક નિરૂપણપદ્ધતિ દ્વારા મળી જાય છે તથા અંતરની સૂજ કેળવાય છે.

ગીતામાં દર્શાવ્યું છે કે જ્ઞાની પણ પોતાની પ્રકૃતિને અનુસાર વર્તે છે. પ્રકૃતિથી પર થયેલો જ્ઞાની સ્વપ્રકૃતિને અનુસાર વર્તે, તો જ્ઞાની અને અજ્ઞાનીમાં શો ફરક રહે ? એવો પ્રશ્ન સ્વાભાવિક રીતે ઉદ્ભબે છે. આનું સમાધાન પૂજ્ય શ્રીમોટાએ મુક્તાત્માના વર્તન સંબંધી કરેલા કથનમાંથી પ્રાપ્ત થતાં આનંદ થાય છે. સંસારનાં બંધનમાં પડેલો દરેક જીવાત્મા પ્રકૃતિને તાબે રહીને વર્તે છે. પરંતુ મુક્તાત્મા પ્રકૃતિનો સ્વામી હોવાથી એ તેને પોતાના અંકુશમાં રાખી પ્રવર્તે છે. પ્રકૃતિનાં વિવિધ પરિણામોનો પોતાનાં સાધન તરીકે ઉપયોગ કરે છે. એવી સમજ ધારણા કરી પૂજ્યશ્રીનું નીચે દર્શાવિલું લખાણ વાંચતાં મુક્તાત્માના અતકર્ય અને દુર્ગમ વર્તન તથા તેનાં કારણો સંબંધી સૂક્ષ્મ રહસ્ય ધ્યાનમાં આવશે.

‘જીવ જ્યારે ચેતનામાં નિષા પામે છે, ત્યારે તેનામાં રહેલો પુરુષ જગ્રત બની જાય છે. પુરુષના આધાર વડે જ એની અનુમતિથી પછી પ્રકૃતિ બધાં કામ કરતી થાય છે.’

‘કોઈ જ્ઞાની કે અનુભવી ભગવાનનો પ્રેમી ભક્ત જગત સાથેના વ્યવહારમાં તો જગતના સામાન્ય માનવી જેવો જ લાગ્યા કરવાનો. એને દ્વંદ્વાદિક વૃત્તિ, જેમ કે કામ, કોધ, લોભ, મોહ, મદ, મત્સર વગેરે તેના મૂળ સ્વરૂપે તેનામાં નહિ હોય, પરંતુ તેવા પ્રકારની રૂપાંતરિત ભાવના તેના જીવનમાં પ્રગટેલી રહે છે ખરી. પહેલાં જેમ જીવદશાની પ્રકૃતિની વૃત્તિઓ તેમ તે વેળા બીજા જીવોની સાથે ઉપભોગમાં ખપમાં આવતી હતી, તેમ હવે તે તે વૃત્તિની

પેલી રૂપાંતરિત થયેલી ભાવના ભાગવત હેતુ અર્થે બીજા જીવના જીવન પરતે ઉપયોગમાં પ્રવર્તે છે. વિષ, ઝેર આમ તો પ્રાણનાશક છે, પરંતુ યોગ્ય રીતે મારેલું ઝેર દવા તરીકે ઘણું જ પ્રાણવાળું અને જીવન ઉગારનારું નીવડે છે.’

અધ્યાત્મનાં સૂક્ષ્મ રહસ્યો પૂજ્ય શ્રીમોટાએ શિષ્ટ પ્રૌઢિયુક્ત છતાં પ્રાસાદિક ભાષામાં રજૂ કર્યું છે, એ વાત ‘જીવનપરાગ’ના અભ્યાસીને સહેજે સમજાય તેવી છે—જો તે અભ્યાસી પ્રેમપૂર્વક અને એકાગ્રતાથી તેનું અધ્યયન કરે તો. ઘણા ઓછા મુક્તાત્માઓની વાણી પૂજ્ય શ્રીમોટાની શૈલી જેવી શૈલીમાં પ્રગટ થવા પામી છે. આવું લખાણ પ્રગટ થવામાં ભવિષ્યના સમાજના ઉત્થાન માટે વિશ્વાત્માનો કોઈ નિગૂઢ હેતુ કાર્ય કરી રહ્યો હોય તેમ જણાય છે. ‘જીવનપરાગ’ વાંચતાં એવો ભાવ જાગે છે કે પૂજ્ય શ્રીમોટાનાં પુસ્તકો શાંત ચિત્તે ઉતાવળ વિના, સમજપૂર્વક વારંવાર વાંચવાં જરૂરી છે. જો તેમ થાય તો જ તેમનું હાઈ પમાય અને શાસ્ત્રોનાં કેટલાંય કથનોનું—ગીતા, ઉપનિષદો વગેરેનાં દુર્ગમ વાક્યોનું ઊંદું રહસ્ય સમજાય.

પ્રસ્તુત ગ્રંથમાં ‘સદ્ગુરુની પરખ’, ‘ગુરુથી થતું સાધકનું ઘડતર’, ‘ગુરુ અને સાધક’, ‘ગુરુ પ્રત્યે સાધકો ને શ્રેયાર્થાનો ધર્મ’, ‘ચમતકાર’, ‘આધાત અને પ્રત્યાધાત’, ‘નિરાશા, વિષાદ, સાધનાપથ’ વગેરે સંબધી જે સૂક્ષ્મ છણાવટભર્યા મુદ્દાઓ એકત્રિત કરી રજૂ કરવામાં આવ્યા છે, તે મુમુક્ષુ સાધકે વારંવાર મનન કરવા યોગ્ય છે.

‘જીવનપરાગ’માં અધ્યાત્મક્ષેત્રમાં જ માત્ર ઉપયોગી થાય તેવી સામગ્રી છે તેવું નથી, પરંતુ સંસારી જનોને વ્યવહારક્ષેત્રમાંય સાચા જીવન માટે ઉપકારક થાય, તેવી વિપુલ સાધનસંપત્તિની પણ પ્રાપ્તિ તેમાંથી થયા વિના રહે તેમ નથી. અનુભવી પુરુષ તો સંસારને

પણ હરિના લીલાક્ષેત્ર તરીકે જ જુઓ છે. આ લીલાક્ષેત્રમાં હરિનાં જ જીવરૂપી પ્રતિબિંબો વિહરી રહ્યાં કરે છે એવું અપરોક્ષ દર્શન તેને રહ્યાં કરે છે. આથી સંસારક્ષેત્રે પણ જીવોને શાંતિમય સહઅસ્તિત્વનું જીવન ગાળવામાં ઉપકારક બની, તેમની હરિ પ્રત્યે અભિમુખતા થવામાં સહાયક બને, તેવું માર્ગદર્શન તે આખ્યાં કરે છે. જેને આત્માનો અપરોક્ષ અનુભવ છે, તેવા વિજ્ઞાનીને જટિલ વ્યવહારની ગૂંચો, જીવનમાં આવતી સમસ્યાઓ અને તેના ઉકેલની સાચી સૂજ પણ પ્રગટેલી હોય છે. તેનું જ્ઞાન અભાધિત હોય છે. ‘જીવનપરાગ’માં સમાવેશ પામેલાં કેટલાંય સૂત્રાત્મક વિચારરત્નોમાં ‘લગ્નભાવનાનો હેતુ’, ‘લક્ષ્મી તરફની દણ્ઠિ’, ‘વાણીનો સંયમ’, ‘સદ્ભાવનાની કેળવણી’, ‘સંતાનો અને માબાપનો ધર્મ’, ‘વિઘો-મુશ્કેલીઓ’, ‘સુમેળ’, ‘ઉદાર માનસ’, ‘નવદંપતી’, ‘દોષોનો સ્વીકાર ને વેદના’, ‘બહેનો સાથેનો વર્તાવ’ વગેરે વિષયોને ઉદ્દેશીને જે વક્તવ્ય રજૂ થયું છે, તેમાં મનુષ્યજીવન પાંગરે તેવું વ્યવહારોપયોગી માર્ગદર્શન થયું છે, તે આ ગ્રંથની વિશેષતા હોઈ તેનું મૂલ્ય અનેકગાણું વધી જાય છે.

પૂજ્ય શ્રીમોટા કર્મ કરતાં ભાવને વધારે મહત્વ આપે છે. દેહધારીને કર્મ કર્યા વિના ચાલે તેમ નથી જ. પ્રાપ્ત કર્તવ્યમાંથી કદીપણ ભાગી ધૂટવાનું ન હોય, પરંતુ તે તે કર્મ માત્ર યાંત્રિક રીતે થયા કરતું હોય, તો તેમાં પ્રાણ પ્રગટ્યો નથી. મંત્રજ્ય, નામસ્મરણ, ધ્યાન વગેરે ક્રિયાઓ ભાવપૂર્વક કરવામાં આવતાં, સાધકને ઈશ્વરની સહાયનો નક્કર અનુભવ થયા વિના રહેતો નથી. આવાં કર્મથી અંતરમાં સામર્થ્ય પ્રગટે છે, અને પ્રગતિના પંથમાં અસ્વય વિઘો આવતાં હોય, ગમે તેવી મુશ્કેલીઓ આવતી હોય છતાં તેમાંથી પાર પડી આગેકૂચ થયા વિના રહેતી નથી. આમ થતાં તે સાધકને ધ્યેયસિદ્ધિ અવશ્ય વરે છે. ભાવપૂર્વક કર્મની

આવશ્યકતા વિશે તેઓ લખે છે, ‘જેમાં ને તેમાં ભાવ એ જ મુખ્ય વસ્તુ છે. ભાવ વિનાનું કર્મ, ને તે પણ જીવનવિકાસ પરત્વેના લક્ષ્યવાળું ન હોય તો તે કર્મ, ભલેને ઉત્તમ હોય, છતાં બંધન જ થાય.’

ગમે તેવી આપત્તિમાં ઈશ્વરને હૃદયથી કરેલો પોકાર કદી નકામો જતો નથી. ઉત્કટ શ્રદ્ધા ને ભાવથી કરેલો આર્તનાદ સર્વજ્ઞ, સર્વવ્યાપક અને કૃપાળું ઈશ્વર સાંભળ્યા વિના રહેતો નથી. આ સંદર્ભમાં પૂજ્ય શ્રીમોટાની અનુભવવાણી દુઃખી મનુષ્યના અંતરમાં ઉત્સાહ, પ્રેરણા અને આશાનાં ઉજ્જ્વળ કિરણો પ્રગટાવી, તાજગી અને નવું જોમ જન્માવે છે. પ્રેરણાનાં અમૃત વર્ષાવતી તે અનુભવવાણીનું આપણે પાન કરીએ. ‘અઢળક કામ હોય, ગમે તેવો વિષમ પ્રસંગ હોય, ગમે તેવું કારમું દઈ હોય, ગમે તેવું ભલેને આદુંતેડુ હોય, તે તે વેળા જો આપણે હૃદયથી પ્રેમભક્તિપૂર્વક સાદ પાડીશું, તો તેવી વેળા તે હૃદયમાં પ્રગટે છે, એવો અનુભવ થાય છે.’

‘જીવનપરાગ’માં પ્રાર્થના વિશેના વિચારો મનુષ્યના ક્ષુદ્ર જીવનનો પ્રવાહ પલટાવી નાખી, તેનું દિવ્ય રૂપાંતર થવામાં ભારે ઉપકારક થાય તેવા છે. તેમાં વ્યક્ત થયેલા વિચારોમાં નિરાશાનો સંદર્ભ નાશ કરી, જીવનને ઊર્ધ્વગામી બનાવવાની અપૂર્વ તાકાત રહેલી છે. પ્રાર્થનાનું બળ કલ્પી શકાય તેવું નથી. પ્રાર્થના એ ભવરોગનું અચૂક ઔષધ છે, મનના મળની તે ઉત્તમ ચિકિત્સા છે. સાચી પ્રાર્થના કદી નિષ્ફળ જતી નથી. મુમુક્ષુને માટે તે મોકશનો રાજમાર્ગ છે.

સાંસારિક જીવનમાં જકડાઈ ગયેલો હોવા છતાં અધ્યાત્મપરાયણ જીવન જીવવા માટે ઉત્કટતાપૂર્વક મથતા જીવને નિરાશ થવાનું કોઈ કારણ નથી. આવા જીવના અંતરમાં પૂજ્યશ્રીની આ ઉક્તિ

આશાનો સંચાર કરી માર્ગદર્શક બને છે, ‘સાંસારિક જીવનની સાંકળથી મુક્ત થઈ જ ન શકતું હોય, ને બીજી બાજુથી માનવીની મહેચ્છા આધ્યાત્મિક જીવન પરત્વેની થોડી ઘણી પણ હોય, તો તેવા જીવે પ્રાર્થના કરી ભગવાનની મદદ માગવી રહી.’

પ્રાર્થના વિશે શ્રીમોટા લખે છે : ‘પ્રાર્થના એ તો જીવનનો પ્રત્યક્ષ સહારો છે. જીવનને યોગ્ય બળ, પ્રેરણા, સહાનુભૂતિ, ધીરજ, હિંમત અનું પ્રાર્થનામાંથી મળી રહે છે—જો પ્રાર્થનાની કળા સાંપડી હોય તો.’

પ્રાર્થનાના અભ્યાસથી મનાદિ કરણોમાં શુદ્ધિ થાય છે. જીવન-વિકાસમાં પ્રાર્થનાનું મહત્વ અમાપ છે. પુરુષાર્થથી બનવા કાજે ઘણો કાજ લાગે અને કોઈક વાર તો અશક્ય જેવું લાગે, તેમ છતાં પ્રાર્થનાના બળથી તેવું તેવું થઈ જતાં ઘણાંએ અનુભવેલું છે.

પ્રાર્થના જેવું ચેતનવંતું ને બળવાળું કોઈ સાધન નથી. હૃદયમાં હૃદયના સાચા ભાવથી આર્તનાદ અને આર્દ્ધભાવે જે જીવ એનો આશરો લે છે, અને એની પ્રાર્થના કદી નિરાશ કરતી નથી. એવી છે પ્રાર્થનાની અંતરતમ શક્તિ.

સાધનાનાં કાર્યોને સર્વોપરી મહત્વ આપવાથી જ લક્ષ્યસિદ્ધિ થાય છે, તે મુદ્દાને તેઓશ્રી આ રીતે રજૂ કરે છે : ‘જ્યારે આપણે આપણા જીવનમાં આપણા આ સાધનનાં કાર્યને જ સર્વોપરી લેખીશું અને એને જ વધુમાં વધુ મહત્વ આપતાં રહીશું, ત્યારે જ સાધનાને યથાર્થ સ્વરૂપમાં ફળતી અનુભવીશું.’

ધ્યાન અને જ્યુ—એ સાધનાના અતિ મહત્વનાં અંગો વિશે તેઓશ્રીએ વ્યક્ત કરેલા વિચારો ઘણા મનનીય છે. તે સંબંધી તેમણે કરેલું માર્ગદર્શન મુમુક્ષુ સાધકને તેની આધ્યાત્મિક પ્રગતિના માર્ગમાં અત્યંત ઉપકારક નીવડે તેવું છે. ધ્યાનની પ્રક્રિયાને અનુલક્ષીને તેઓ લખે છે : ‘ધ્યાનમાં આપોઆપ સ્વાભાવિકપણે

શાસોચ્છ્વાસ ધીમા પડતા જશે, ને અંતે તો તદ્દન શાંતપણે ચાલશે. તેમાં પ્રાણાયમના નિયમો સ્વતઃ પળાયા જશે—જો ધ્યાન યોગ્યપણે કરાતું હશે તો—ને તદ્દન છેવટે તો શાસોચ્છ્વાસ લય પણ પામ્યા જેવી સ્થિતિ થશે.’

‘ધ્યાન વખતે ધ્યાન જ. પ્રાર્થના વખતે પ્રાર્થના જ. જે કરતા હોઈએ એના ભાવને જ પ્રધાનપણે વળગી રહેવું. ધ્યાનને છોડવાની હચ્છા ન થાય તો તેમ રાખવું. સમય પૂરો થયો માટે છોડી દેવું તેમ ન કરવું.’

‘ધ્યાનમાં અમુક અમુક થાય તો સારું એવી લાગણી ન રાખવી. જે કાંઈ ત્યારે થાય તેમાં મન ભળી ન જાય તેની ખબરદારી રાખવી ઘટે. લીન અને એકાગ્ર થવામાં ઊંઠું ઊંઠું ઉત્તરતા જવું અને જ્યાં સુધી ઝ્યાલ રહ્યા કરે ત્યાં સુધી ભગવાનના ભાવનો ઝ્યાલ રાખવો, એ પણ ઊંડા ઊંડા જતાં તેને ઊડી જવા દેવો અને તટસ્થપણે જોયા કરવું.’

ઉપરોક્ત સૂચનો વૃત્તિઓનો નિરોધ કરી, ચિત્તને નિસ્તરંગ અવસ્થામાં લાવી સમાધિની સ્થિતિ પ્રાપ્ત કરવામાં સાધકને કેટલા બધા સહાયક થાય તે સ્વાભાવિકપણે સમજાય તેમ છે.

શાસ્ત્રોમાં નામસ્મરણનો અપાર મહિમા ગાયો છે. ભગવદ્-ગીતામાં શ્રીકૃષ્ણ ‘યજ્ઞાનાં જપયજ્ઞોરસ્મિ’ ‘યજ્ઞોમાં જપયજ્ઞ હું છું’ એ વાક્યમાં જપને પોતાની વિભૂતિ તરીકે દર્શાવી યજ્ઞોમાં જપયજ્ઞનું અતિ મહત્વનું સ્થાન દર્શાવે છે.

પૂજ્ય શ્રીમોટાનો જપ અને નામસ્મરણ વિશેનો લેખ ધણો મનનીય હોઈ જપ તથા નામસ્મરણરૂપી રાજમાર્ગના પથિકને તેમાં કરેલા માર્ગદર્શનથી અલભ્ય લાભ થવાનો પૂરો સંભવ છે. જપને યજ્ઞ શા માટે ગણવામાં આવ્યો છે અને કેવા પ્રકારની જપસાધના ઉત્તમ ગણાય તે વિશેના પૂજ્ય શ્રીમોટાના લેખમાંથી કરેલું નીચેનું

અવતરણ ધ્યાનમાં રાખવા જેવું છે. ‘જપને યજ્ઞમાં ગણેલો છે. એ એક મોટું સહજ ને સરળ સાધન છે. સામાન્યપણે જપ ટૂંકામાં ટૂંકો હોય તો ઉત્તમ. એ જપવામાં કિલિએ ન હોવો જોઈએ, સરળ હોવો જોઈએ. હ્રસ્વ અને મૂદુ તથા કઠણ નહિ એવો (ધોષ વંજન) હોય તો વધુ સારું. શબ્દનાં ત્રાણ સ્થળ છે, નાભિ, કંઠ અને બ્રહ્માંધ. જપ એવો હોવો ઘટે કે એ ત્રણને સ્પર્શી શકે—જપને યજ્ઞ કહેવાનું કારણ એ છે કે યજ્ઞમાં જે તે બધું હોમવાનું હોય છે, એટલે આપણે પણ મનાદિકરણનું જે જે બધું ઊભળે, તે બધું તેમાં પ્રાર્થના સાથે જ્ઞાનભક્તિપૂર્વક હોયાં કરવાનું છે.’

‘પ્રભુ સાથે અભેદ સંબંધ જોડવા માટે, એકતાર થવા માટે, તેનું નિરંતર અનુસંધાન થવા માટે નામસ્મરણ એ અમોઘ અને સમર્થ સાધન છે.’ આ સંબંધી ‘જીવનપરાગ’માંના નીચેના કથનનો ઉત્ત્વેખ કરવા જેવો છે : ‘સ્થૂળ રીતે, દેખીતી રીતે નામસ્મરણ વિના સ્થૂળજીવન નભી શકે છે; પણ પ્રભુમય જીવન માટે નામસ્મરણ પ્રાણ સમાન છે. એ ન હોય તો કશું નથી. એટલે ધ્યાન આદિ બીજાં સાધનો કરતાં પણ એનું સવિશેષ ધ્યાન રાખવાનું છે. નામી કરતાંયે નામ ચઢી જાય છે. દિવસોભર જયા વિના જીવી શકાય, પણ જેને ભગવાનને શરણે જવું છે, તેને નામસ્મરણ વિના એક ક્ષણ પણ ન ચાલવું જોઈએ. નામસ્મરણ એ આપણું એક રીતનું જીવન છે.’

કૃપા અને પુરુષાર્થ સંબંધી પંડિતોમાં વાદવિવાદ ચાલ્યા કરે છે. કેટલાક ઈશ્વરકૃપાથી બધું થતું હોય તો પુરુષાર્થનું કાંઈ પ્રયોજન નથી એવી દલીલ કરે છે, જ્યારે બીજાઓ પુરુષાર્થ નિરર્થક નથી, કર્મ કરવાનું સ્વાતંત્ર્ય ન હોય તો ગીતા વગેરે ગ્રંથોમાં કર્મ કરવાનો ઉપદેશ શા માટે આપવામાં આવ્યો છે, અને સારું-નરસું, કર્મ-અકર્મ, નીતિ-અનીતિ વગેરેને નિર્ણય કરવાની બુદ્ધિ મનુષ્યને શા

માટે આપવામાં આવી છે એવી દલીલ કરી પુરુષાર્થ જરૂરી છે અને તેના વિના પ્રગતિ શક્ય નથી એવું પ્રતિપાદન કરે છે. આ સંબંધી પૂજ્ય શ્રીમોટાએ જે નિર્ણય વ્યક્ત કર્યો છે, તે શાસ્ત્રસંમત અને શાસ્ત્રસંગત છે. તેઓ જણાવે છે કે, ‘પુરુષાર્થ અને કૃપાના જગડા કે ચર્ચા નકામા છે. પુરુષાર્થ પણ છે અને કૃપા પણ છે.’

‘કૃપાના આધાર પર જે જીવ પુરુષાર્થ કરે છે, તેને અભિમાન જાગવાનો કશો ડર નથી હોઈ શકતો. પુરુષાર્થ ને કૃપા એકબીજામાં સંકળાયેલાં જ છે. કૃપામાં પુરુષાર્થ છે, પુરુષાર્થમાં કૃપા છે.’

‘શરૂઆતના સાધક કાજે પ્રથમ પ્રયંડ પુરુષાર્થની જરૂર રહે છે. પુરુષાર્થ થતો રહે ને તે કૃપાની પ્રાર્થના પણ કરતો રહે, કૃપાની મદદ હૃદયથી યાચ્યા કરે તે મહત્વનું છે. પોતાના ખંત અને ધગશાના પુરુષાર્થ સાથે સદ્ગુરુના આશીર્વાદ અને કૃપા જરૂરનાં છે તેની ના નથી, પરંતુ પોતે પણ કાંઈ પણ કર્યા કારબ્યા વિના એની કૃપા પર જ આધાર રાખવાનું કરશે, તો તેવી કૃપા મળવી શક્ય નથી.’

આ રીતે માનવજીવનના ઊર્ધ્વકરણમાં સંપૂર્ણપણે સહાયક નીવડે તેવી અનુભવી સંતાત્માના હૃદયમાંથી ફૂટેલી પાવનકારી વાણીની સરવાણીનું જળ ‘જીવનપરાગ’માં સંગૃહીત થયેલું છે.

શ્રેયસ્કામ જીવ સદ્ગુરુનું માર્ગદર્શન મેળવવા સતત ઝંખતો હોય છે. પ્રથમ તો સદ્ગુરુના સંબંધમાં આવવું જ સહેલું નથી, અને કદાચ સંબંધમાં આવવાનું થાય તોપણ તેને ઓળખવાનું કાર્ય ઘણું જ મુશ્કેલ છે. જેમ જેમ પૂર્વ સુકૃતના પ્રતાપે તેનો પરિચય કેળવાતો જાય છે તેમ તેમ આ ગ્રંથમાં દર્શાવેલાં તેનાં લક્ષણોનું તેનામાં દર્શન થતાં, તેની સાચા માર્ગદર્શક તરીકે નિઃશક પ્રતીતિ થતી જાય છે. સદ્ગુરુને પોતાના પરિચયમાં આવતી વ્યક્તિઓની પ્રકૃતિની યથાર્થ સમજ પ્રગટેલી હોય છે. તેવો પુરુષ નિરહંકારી અને નિર્ભમ હોય છે. અત્યંત નિઃસ્પૃહ અને વિરાગી હોવા છતાં

તેનામાં અધિકારી સાધક પ્રત્યે એક પ્રકારનું રાગભર્યું વલાણ તથા તેનું જીવન ઉન્નત કરી ઈશ્વર પ્રત્યે અભિમુખ કરવાની સ્પૃહા જોવામાં આવે છે. તેનો સંપર્ક ધનિષ્ઠ થતો જતાં સાધકને પોતાની પ્રકૃતિમાં રૂપાંતર થતું અને જીવન ઉર્ધ્વમુખી થતું અનુભવાય છે. કેટલીક વાર સદ્ગુરુ તેની સાથે ભાવપૂર્વક સંપર્કમાં આવેલા જીવના શરીર સાથે તાદાત્મ્ય સાધી તેના રોગો દૂર કરે અથવા હળવા કરે તેવા અનુભવો થાય છે. સદ્ગુરુનો પ્રેમ જેના પર ઉમટે છે, તેને તે પોતાના જેવી ઉન્નત કક્ષામાં પ્રતિષ્ઠિત કરે છે.

‘જેના પર રીજે પ્રેમ એને તો નિજનો કરે,  
પોતા જેવો બનાવીને પોતાનામાં રમાડશે.  
કરાવે પ્રેમ પ્રત્યક્ષ ગૂઢમાં ગૂઢ તત્ત્વ જે,  
કિંતુ પાવકમાંથી ત્યાં શું પસાર થવું પડે !’

આ સંદર્ભમાં શ્રીશંકરાચાર્યની શતશ્લોકીનો નિભાલિભિત શ્લોક ઉલ્લેખપાત્ર છે :

દૃષ્ટાન્તો નैવ દૃષ્ટાસ્તિભુવનજઠરે સદગુરોર્જાનિદાતુ:  
સ્પર્શશ્રેત્તત્ત્ર કલ્પઃ સ નયતિ યદહો સ્વર્ણતામશમસારમ् ।  
ન સ્પર્શત્વં તથાપિ શ્રિતચરણયુગે સદગુરુઃ સ્વીયશિષ્યે  
સ્વીયં સામ્યં વિધત્તે ભવતિ નિરૂપમસ્તેન વાલૌકિકોર્પિ ॥  
(આત્મજ્ઞાનનો યથાર્થ ઉપદેશ કરી તેનો અનુભવ કરાવનારા સદ્ગુરુનું દાખાંત ત્રણે લોકમાં ક્યાંય જોવામાં આવતું જ નથી. તેઓશ્રીને ઉદેશીને પારસમણિનું દાખાંત આપીએ તો તે પણ બરાબર નથી, કારણ કે પારસમણિ લોખંડનું સોનું બનાવે છે, તે આશ્રયકારક છે, પણ તેને પારસમણિ બનાવતો નથી. પરંતુ સદ્ગુરુ જે તેમનાં ચરણકમળનો આશ્રય કરે છે, તેને પોતાના જેવો બનાવે છે. આથી સદ્ગુરુ અનુપમ અને અલૌકિક જ છે.)

ગુરુના કાર્યપ્રદેશ અને કાર્યપ્રાણાલી વિશે આપેલી માહિતી ઘણી ઉપયોગી અને રસપ્રદ છે. સાધકના સ્વભાવનું દિવ્ય રૂપાંતર કરી, તેનો આધ્યાત્મિક વિકાસ સાધવાનું કાર્ય ગુરુ દ્વારા થતું હોય છે. સાધકની સુષુપ્ત શક્તિઓ જગાડવા તે અત્યંત સૂક્ષ્મ સાધનનો ઉપયોગ કરે છે. તે સાધનની પ્રવર્તમાન ગુપ્ત અસરનો ખ્યાલ શરૂ શરૂમાં તો સાધકને આવતો પણ નથી. આ કાર્યમાં વાળીનો તે ઘણો જ ઓછો ઉપયોગ કરે છે. અને નિરંતર આધ્યાત્મિક આંદોલનો મોકલી સાધકની સુષુપ્ત ચેતના જગાડી, તેના જીવનનું સાચું ઘડતર થવામાં સહાયક બને છે. સાધકની નિદ્રાવસ્થામાં તેના આંતરરસત્ત્વ સુધી સુગમતાથી પહોંચી જઈને પણ તે આ કાર્ય સિદ્ધ કરે છે.

ગુરુ અનેક ચમત્કારો દ્વારા પણ સાધકના મનને પોતા પ્રત્યે આકર્ષી લઈ તેને સહાયક બને છે. સર્વ ચમત્કારોમાં સાધકની પ્રકૃતિનું રૂપાંતર કરવાનો ચમત્કાર સર્વોપરી મહત્વનો અસાધારણ ચમત્કાર છે. દરેક સાધકની પ્રકૃતિને યથાર્થ સ્વરૂપે જાણી તદ્દનુસાર માર્ગદર્શન આપવાની આધ્યાત્મિક ક્ષેત્રના સદ્ગુરુની શિક્ષણકળા અન્ય સર્વ ક્ષેત્રોના શિક્ષકોની શિક્ષણકળા કરતાં ક્યાંય ચઢિયાતી છે. શાળા-મહાશાળાઓમાં વિભિન્ન પ્રકારની પ્રકૃતિના વિદ્યાર્થીઓમાંથી દરેક પ્રકૃતિની વિશિષ્ટતાઓ લક્ષ્યમાં રાખી તદ્દનુસાર તેને શિક્ષણ આપવાનું અશક્યપ્રાય હોવાથી શિક્ષણનું કાર્ય કેવું અપૂર્ણ, અધકચર્ચા અને ઘણીવાર હતાશ કરનારું નીવડે છે તે સુવિદિત છે. પરંતુ અધ્યાત્મક્ષેત્રે સદ્ગુરુ દ્વારા અપાંતું શિક્ષણ પરિપૂર્ણ, આદર્શ અને યથાર્થ શિક્ષણ છે, તે ઉપર દર્શાવેલી હકીકતથી સહેજે સમજાય છે.

મનુષ્યજીવનનાં રહસ્ય અને હેતુની સમજણ પ્રગટાવનારી ચેતનાશક્તિ એ જ ગુરુ. અનેક પ્રકારનાં સંઘરી રાખેલાં મંતવ્યો,

આગહો અને મહાગાંઠોમાંથી મુક્ત કરવાના સૂક્ષ્મ પ્રયત્ન દ્વારા—  
—આધાત આપવાની પ્રક્રિયા દ્વારા પણ—ગુરુ સાધકની આધ્યાત્મિક  
પ્રગતિમાં સહાયક નીવડે છે. તેની સાથે ઘનિષ્ઠ સંબંધ સ્થપાતાં  
ગમે તેવા નિભન સ્તરના સાધકનું જીવન પણ તેની અદૃશ્ય અને  
અકલ્ય અસર દ્વારા ઉન્નત થતું જાય છે. ગમે તેવી ગ્રંચવજાભરી  
પરિસ્થિતિમાં ગુરુરૂપી ચેતનાશક્તિ સ્વર્ધર્મનું ભાન પ્રગટાવે છે.  
ગુરુ કોઈને પણ પરાધીન રાખવા ઈચ્છતો નથી. તે માગે છે પ્રેમ.  
જે તેની અને પોતાની વચ્ચે કાંઈ પણ સંકોચ કે અંતર ન રાખતાં  
સાચા દિલથી પ્રેમ કરે છે, તેનું શ્રેય થયા વિના રહેતું નથી.  
'ભાવ ભાવને બેંચે છે, ને ભાવને પ્રગટાવે છે. હૃદયના ભાવનું  
બળ જેવું તેવું નથી. ગુરુનું ભાવભર્યું પુણ્યસ્મરણ તો પ્રત્યક્ષ  
સંજીવની છે.' નિરાશા, પ્રમાદ, અશાંતિ, ભયંકર સંધર્ષ, કંકાસ  
વગેરેથી ત્રાસી ગયેલા જીવોને માટે ગુરુનું ઉત્કટ ભાવભર્યું સ્મરણ  
જડિબુદ્ધી સમાન નવું જીવનબળ અને ઉત્સાહ પ્રેરનારું નીવડે છે.

'વ્યોમવવ્યાસદેહાય દક્ષિણામૂર્તિયે નમઃ ।' 'આકાશની પેઠે સર્વત્ર<sup>૧</sup>  
વ્યાપ્ત શરીરવાળા દક્ષિણામૂર્તિને હું નમું છું.' —એ ઉક્તિ અનુસાર  
સર્વત્ર વ્યાપ્ત એવા સદ્ગુરુનું અંતરના ભાવપૂર્વક તેમને કરેલું  
સ્મરણ ઘણી મુશ્કેલ અને જટિલ પરિસ્થિતિમાં તેમને અવશ્ય  
સહાયક થવા પ્રેરે છે.

૦૦૦

'જીવનપરાગ'ના વાચને મારા જીવનમાં નવો ચિરાગ  
પ્રગટાવ્યો, નવી તાજગી અને જોમથી અંતરને ભરી દીધું. આથી  
પૂજ્ય શ્રીમોટાનું જીવનચરિત્ર અથવા તેઓશ્રીના અધ્યાત્મક્ષેત્રમાં  
પ્રગટ થયેલા અનુભવો સંબંધી જાણવાની મારા મનમાં ઉત્કટ ઈચ્છા  
થઈ. મારો આ મનોરથ અનાયાસે જ સિદ્ધ થયો અને તેમનાં

‘નર્મદાપદે’ એ કાવ્ય તેમ જ ‘જીવનદર્શન’ એ બંને પુસ્તકો મારા વાંચવામાં આવતાં જે અપૂર્વ આનંદ થયો, તે વર્ણવી શકાય તેવો નથી.

હિસ્ટીરિયાના રોગથી કંટાળી જઈ ગરુડેશ્વરની ટેકરી પરથી નર્મદામાં શ્રીમોટાએ જંપલાયું. પરંતુ તેમાંથી તેમનું અદ્ભુત રીતે રક્ષણ થયું અને નર્મદામાંથી જ પ્રગટ થયેલી કોઈ દિવ્ય શક્તિએ તેમને ફરી પાછા ટેકરી પર કાંઈ પણ ઈજા થયા વિના સહિસલામત મૂકી દીધા, એ પ્રસંગ મારા વાંચવામાં આવ્યો. સર્વાત્યર્ભમી, સર્વવ્યાપક ઈશ્વર તેના ભક્તો પ્રત્યેની અપાર કરુણાથી પ્રેરાઈ કોઈ પણ સમયે ચમત્કાર કરે છે. જે તેને આર્તસ્વરે પોકારે છે તેવા નિજજનને માટે તેનું અંતર પ્રેમથી પલળી જાય છે, અને પોતે પ્રકાશ પામીને ભવિષ્યમાં જે અન્યને પ્રકાશ તરફ દોરી જવા જન્મ્યા છે, તેવા પુરુષોના જીવનનું હરકોઈ ક્ષાણે અવશ્ય રક્ષણ કરે છે, એવી શ્રદ્ધાને પુષ્ટિ મળતાં મને શબ્દાતીત આનંદ થયો. જો સાધક પૂરેપૂરો સાવધાન ન રહે, તો સાધનાપથમાં પ્રગતિ થતાં સર્જાતા ચમત્કારો, સિદ્ધિઓ વગેરે તેને ગંતવ્ય સ્થાને પહોંચાડવામાં જરૂર વિઘ્નરૂપ બને છે. પરંતુ સાક્ષાત્કારસંપન્ન પુરુષે કરેલું, સ્વાનુભવમાં આવેલા ચમત્કારો, સિદ્ધિઓ વગેરેનું વર્ણન પ્રતીતિજ્ઞનક હોવાથી જિજ્ઞાસુ સાધકને પ્રેરણા અને પ્રોત્સાહન આપી, તેની શ્રદ્ધાને પુષ્ટ કરી પ્રગતિકારક થાય તેવો પૂરેપૂરો સંભવ છે. આ દસ્તિએ પૂજ્ય શ્રીમોટા દ્વારા તેઓશ્રીના જીવનમાં થયેલા પ્રસંગોનું વર્ણન ધણું મૂલ્યવાન અને મહત્વનું છે.

ઉપર દર્શાવ્યા પ્રમાણે ‘જીવનપરાગ’ના વાચને મને પૂજ્ય શ્રીમોટાનું ‘જીવનદર્શન’ વાંચવા પ્રેર્યો. તેઓશ્રીના અદ્ભુત જીવન-પ્રસંગોથી પ્રભાવિત અને લાભાન્વિત થઈ હું તેમના અન્ય ગ્રંથોનું

વાચન કરવા પ્રેરાયો. તેઓશ્રીના આ સર્વ ગ્રંથોમાં વ્યાવહારિક તેમ જ આધ્યાત્મિક ક્ષેત્રે ઉપસ્થિત થતા અનેક મહત્વના પ્રશ્નો અને સમસ્યાઓને હલ કરતા જીણવટભર્યા મુદ્દાઓની રજૂઆત કરવામાં આવી છે. એક મહાન સંતાત્માના અનુભવનું હાઈ તેમાં સમાપેલું છે. જેમ ભગવદ્ગીતા બ્રહ્મવિદ્યા પર આધ્યારિત યોગશાસ્ત્ર પ્રતિષ્ઠિત થયેલું છે. જેમને તેમના સર્વ ગ્રંથો વાંચવાનો સમય ન હોય, તેઓ માત્ર ‘જીવનપરાગ’નું જ નિરંતર અનુશીલન-પરિશીલન કરશે, તોપણ તેમને તમસ્સુને ભેદી પ્રકાશ પ્રત્યે મીટ માંડતી જીવનદિષ્ટ પ્રાપ્ત થયા વિના રહેશે નહિ. અંતે મુમુક્ષુ સાધક ‘જીવનપરાગ’ના સંચય પ્રત્યે અભિમુખ થાય એ હેતુથી આરંભેલો આ ‘પ્રરોચના’નો વિધિ સમાપ્ત કરી હું વિરમું છું.

૦૦૦

॥ હરિઃઅঁ ॥

## પ્રસ્તાવના

(શ્રી ‘સોપાન’)

(પ્રથમ આવૃત્તિ)

## સાધકની અનુભવવાણી

‘જીવનપરાગ’ને પરિચય કે પ્રવેશકની જરૂર નથી અને જરૂર હોય તો તે લખવાના મારા અધિકાર વિશે હું સાંશક છું, ઇતાં જેમને હું શ્રી ચૂનીભાઈ ભક્ત તરીકે ઓળખું છું અને જેઓ અત્યારે ‘પૂજ્ય શ્રીમોટા’ તરીકે અનેક કુટુંબો અને વ્યક્તિઓનાં હૃદયમાં શ્રદ્ધાભર્યું સ્થાન ધરાવે છે, તેમની સાથેની જૂની ઓળખાણ તથા તેમના અંતેવાસી શ્રી નંદુભાઈનો પ્રેમભર્યો આગ્રહ મારી પાસે આ લખાવવા માટે કારણભૂત બન્યાં છે.

આ પુસ્તકના વાચનથી મારા મન પર પહેલી છાપ એ પડી કે શ્રીમોટાએ કોઈ સિદ્ધાંત, વાદ કે વિચારનું પ્રતિપાદન કરવા અથવા તો કોઈ નવો સિદ્ધાંત વહેતો મૂકવા માટે આ પુસ્તક લખ્યું નથી. કોઈ મધ્યવર્તી વિચારની આસપાસ બુદ્ધિયુક્ત અને હૃદયસ્પર્શી દલીલો ગોઠવાય અથવા તો સંશોધન કે ગણિતની પદ્ધતિથી ચોક્કસ દિશામાં ગતિ કરતાં કરતાં એક નિશ્ચિત વિચાર પર પહોંચાય એવું આ પુસ્તકમાં નથી. શ્રીમોટાનો કે આ પુસ્તકનું પ્રકાશન કરનારાઓનો એવો હેતુ પણ નથી. આ પુસ્તક તો સાચા અર્થમાં એક સાધક વિચારકનાં અનુભવમોતી છે. સંપાદકોએ એ મોતીને નાની મોટી માળાઓમાં પરોવવાનો સફળ પ્રયત્ન કર્યો છે. ‘સાધક વિચારક’ એમ કહીને હું સાધક અને વિચારક એમ કહેવા નથી માગતો. આ પુસ્તકમાં શ્રીમોટાની વાણી વાંચીને એમને

ઉત્તમ કક્ષાના એક વિચારક માનવાનું મન થઈ જાય એમ છે, પરંતુ જે સત્ય હકીકત છે તે તો એ છે સવિશેષ અભ્યાસ, અવલોકન અને ચિંતન તથા થોડોક અનુભવ લઈને આ વિચારો વક્ત કરવામાં નથી આવ્યા, પરંતુ સાધનાની અભિપ્રેક્ષામાં વિશુદ્ધ કર્યા પછી તેને અભિવ્યક્તિ મળી છે અને તેથી જ તેમને વિચારક કહેવાની સાથે મેં સાધક વિશેષજ્ઞપુરે વાપરવાનું યોગ્ય માન્યું છે. અલબત્તા, અનુભવની સાથે અભ્યાસ, અવલોકન અને ચિંતનનું બળ એમાં ભણેલું છે.

આ પુસ્તક સંબંધમાં બીજી એક બાબત પણ નોંધવા જેવી છે. શ્રીમોટાનાં આ વિચારમોતી અથવા તો સાધનાની કસોટીમાંથી પાર ઉત્તેલાં સત્યોનું ઉચ્ચારણ સહજ એવાં કોઈ પ્રવચનો કે લેખોનું પરિણામ નથી. જો એવું હોત તો સર્વ સામાન્ય ધોરણ અથવા તો આદર્શનો કોઈ માપદંડ નક્કી કરીને એમણે પોતાના વિચારો રજૂ કર્યા હોત. અહીં જે વિચારમોતી વેરાયેલાં અને પરોવાયેલાં છે, તે એવી પ્રતીતિ તો કરાવે જ છે કે શ્રીમોટા સર્વસાધારણ ધોરણે તથા ચોક્કસ વર્ગને અનુલક્ષીને પણ સુયુવસ્થિત રજૂઆત કરવાને સમર્થ છે, પરંતુ હકીકત એ છે કે ‘જીવનપરાગ’માં સંકલિત કરવામાં આવેલા વિચારો બહુધા તો એમનાં કેટલાંક પુસ્તકોનું દોહન છે અને આ પુસ્તકો એમણે કોઈ સાધકને, મુમુક્ષુને, જિજ્ઞાસુને એની આધ્યાત્મિક, સાંસારિક કે વૈચારિક મૂંજવણમાં માર્ગદર્શન આપવાના હેતુથી લખાયેલા પત્રોના સંગ્રહરૂપે પ્રગટ થયેલાં છે. પુસ્તકોમાંથી ન લીધા હોય એવા વિચારો પણ કોઈ જિજ્ઞાસુને લાખેલા પત્રનાં જ અવતરણો છે.

આ માહિતી અહીં રજૂ કરવાનો હેતુ એ છે કે વાયકને આ પુસ્તકની વિશેષતા તથા મર્યાદા અને એ વિશેષતા-મર્યાદાના સંયોજનથી પ્રગટતી વિશિષ્ટતા ધ્યાનમાં રહે. કુદરતની રચનામાં

વैविध्यनો પાર નથી. ઘાસનાં બે તણખલાં કે બે ૨૭કષા પણ એકસરખાં નહિ મળે. અનંત વૃક્ષોનાં અનંત પણો આકારમાં અને બીજી રીતે એકબીજાંથી નિરાળાં હોય તે ખરેખર અદ્ભુત લાગે છે. આની સરખામણીમાં આજની દુનિયાના ગ્રણેક અબજ માણસો આકૃતિ અને પ્રકૃતિથી એકબીજાંથી જુદાં હોય તેનું આશ્રય ન થવું જોઈએ. આમ છતાં જાણવા જેવું એ છે કે આવી વિશિષ્ટતાની વચ્ચે એકતાનું-સમાનતાનું પ્રમાણ પણ કેટલું બધું છે ! દરેક ૪૩-ચેતન વાસ્તવમાં તો ૪૩ જેવું કંઈ છે ૪ નહિ, સર્વત્ર પ્રગટ, અપ્રગટ, અલ્યપ્રગટ ચેતન ૪ વિલસે છે. છતાં સામાન્ય નજરે જેને આપણો ૪૩ કહીએ છીએ તે અને જેને આપણો ચેતન તરીકે સ્વીકારીએ છીએ, તે એકબીજા સાથે કેટલાં બધાં સંકળાયેલાં છે ! એક બાજુ ભિન્નતા અને બીજી બાજુ એકતાનો આ અનુભવ જીવનમાં પણ દરરોજ થાય છે.

આ દસ્તિએ વિચારતાં વ્યક્તિને લખેલા પત્રો ઘણો અંશો સમાચિને પણ ઉપયોગી થાય એ સમજાય એવું છે. ચોક્કસ પરિસ્થિતિમાં જીવતા માનવીઓ વચ્ચે સમાનતાનું પ્રમાણ વિશેષ હોય છે. જીવનને ઉન્નત અને મુક્ત કરવાની ગંભના ધરાવતા માનવીઓની મૂંજવણો, સમસ્યાઓ તથા સંઘર્ષોમાં સામ્ય હોય અને એથી એકને અપાયેલું માર્ગદર્શન અનેકને ઉપયોગી થાય એ સ્વાભાવિક છે. આ પુસ્તકનાં લગભગ પાંચસો પાનાંઓમાં પથરાયેલું જ્ઞાન એ દસ્તિએ સર્વોપયોગી બની શકે એવું લાગ્યું છે. આ જ્ઞાન ૨૪૨ કરવાની પદ્ધતિમાં આત્મીયતાનો અનુભવ થાય છે. કોઈ ઉપદેશક દૂર બેસીને નિર્લેંપ ભાવે ઉપદેશ આપતો હોય એવું દેખાતું નથી, પરંતુ કોઈ સ્વજન સ્નેહપૂર્વક માર્ગદર્શન કરાવતો હોય એમ લાગે છે. એ જ રીતે આકાશમાંથી વરસતો વરસાદ જેમ સર્વત્ર, જ્યાં ૪૩૨ ન હોય ત્યાં પણ વરસે છે તેવું આમાં બન્યું નથી. વાસ્તવમાં

આ વર્ષાજળ સંઘરાયેલું અને શુદ્ધ થયેલું છે અને તે જ્યાં ઉપયોગ છે ત્યાં જ વહે છે. જો પ્રકાશની ઉપમા આપીએ તો આ પુસ્તક માર્ગદર્શક દીવાની ગરજ સારે તે પ્રકારનું છે.

શ્રીમોટાએ રજૂ કરેલા વિચારો અનુભવની કસોટીએ ચેદેલા છે અને તેથી તેનું મૂલ્ય વધી જાય છે. આ વિચારો ધર્મગ્રંથોમાં, તત્ત્વજ્ઞોની વાણીમાં, અન્ય સંત-સાધુઓના ઉપદેશોમાં આપણને જોવા, વાંચવા, સાંભળવા, અનુભવવા મળે છે, છતાં અહીં તે વાંચતાં કશાકનું પ્રતિબિંબ પડ્યું હોય એવો ભાવ થતો નથી. કારણ કે મૂળ સત્યને પ્રગટ કરવામાં શ્રીમોટાના અનુભવ, રજૂઆતની શૈલી તથા પદ્ધતિની મૌલિકતા ભળેલી છે અને તેથી તે વેધક અને અસરકારક બન્યા છે. વિચારો સંબંધમાં સમગ્ર રીતે મન પર એવી છાપ પડી છે કે શ્રીમોટા કોઈ જ બાબતમાં અંતિમમાર્ગી નથી. જીવનમાં જેમ સમત્વનું મહત્વ એમણે પ્રીધ્યું છે, તેમ સિદ્ધાંત અને વ્યવહારના પ્રતિપાદનમાં સમજ્વયની દાખિ રાખી છે. પત્રોના ઉત્તરો પરથી એમ સમજાય છે કે પત્રલેખકના હેયામાં શિષ્યભાવ છે અને ક્યાંક તે ભાવનો વિકાસ શરણાગતિ સુધી થયેલો છે, પરંતુ શ્રીમોટાએ ગુરુભાવને બદલે બંધુભાવ રાખ્યો હોય એવી નમ્રતા, આર્દ્રતા અને મમતા અનુભવાય છે. જીવનવિકાસમાં ગુરુના સ્થાન વિશેના એમના વિચારોને જુદે જુદે પાને જો ઉપલક નજરે જોવામાં આવે તો ક્યાંક વિરોધ દેખાય, પરંતુ સમગ્ર દાખિએ તેને મૂલવતાં એવી જ છાપ પડે છે કે શ્રી મોટા જાગ્રત અને ચેતનમય આત્મદેવને જ ગુરુપદે સ્થાપે છે ને પોતે કેવળ અંગૂલિનિર્દ્દશથી સંતોષ માને છે.

આ પુસ્તકના ગુણ અને સૌંદર્યનો પરિચય આપવા માટે કેટલાંક અવતરણો મૂકવાનું મન થઈ જાય છે. એ દાખિએ શરૂઆતમાં પુસ્તકનાં પાનાંઓમાં નિશાનો પણ કરવા માંડ્યાં હતાં, પરંતુ

સમગ્ર પુસ્તક પર વ્યાપક નજર ફેરવી ગયા પછી એમ લાગ્યું કે વાચક એને પૂર્ણપણે આસ્વાહે એ જ યોગ્ય છે. વાસ્તવમાં એક વખત વાંચીને બાજુમાં મૂકી દેવાનું મન થાય એ પ્રકારનું આ પુસ્તક નથી. જિજાસુઓ માટે આ પુસ્તક નિત્ય મનનનો ગ્રંથ બની શકે એ પ્રકારનું છે. એમાં છૂટાં વેરાયેલાં વિચારમોતીનું પ્રમાણ પણ એટલું બધું છે કે ગમે તે પાનું ઉધારી ભાવનાનો ઝુલિંગ પ્રગટાવી શકાય અને જો સાધનાની દાષ્ટ હોય તો બિન્ન બિન્ન વિષયો પરત્વે સુવિચારિત માર્ગદર્શન મળી રહે એવાં નાનાં પ્રકરણોને સાધંત વાંચી શકાય.

આ પુસ્તકને સાહિત્ય દાસ્તિએ મૂલવવાનો પ્રયાસ મેં કર્યો નથી. એમ કરવું જરૂરી પણ લાગ્યું નથી. લેખકનો, સંપાદકોનો કે પ્રકાશકનો હેતુ કોઈ સાહિત્યકૃતિ નિર્માણ કરવાનો નથી, પરંતુ અનંતના યાત્રીને જે પાથેયની જરૂર છે, તે અલ્ય પ્રમાણમાં પણ આમાંથી મળી રહે તે ઉદેશ છે. આ દાસ્તિએ પુસ્તકમાં વેરાયેલાં કાવ્યો પણ વિચારોનાં જ ઘોતક છે એમ સમજવું જોઈએ. છંદ રચનાનો લાભ એ કે એ વિચારોને સ્મૃતિમાં સંધરવાનું સહેલું બને. એથી વિશેષ એનો અર્થ ઘટાવવાનું યોગ્ય નથી.

આ પુસ્તકની બીજી વિશેષતા મને એ ભાસી છે કે એમાં ઊંડા તત્ત્વજ્ઞાનની જાંખી સાથે વ્યવહારુ માર્ગદર્શન પણ ઠીક પ્રમાણમાં આપવામાં આવ્યું છે. આહાર, નિદ્રા, સ્ત્રી-પુરુષના સંબંધો, સાંસારિક સંઘર્ષોથી માંડીને યોગની સાદી કિયાઓ, પ્રાર્થના, જપતપ, ગુરુભક્તિ, પ્રભુભક્તિ, સાક્ષાત્કાર વગેરેનો સમાવેશ થયો છે. આવાં પુસ્તકોમાં પુનરુક્તિ અનિવાર્ય હોય, કારણ કે મૂળભૂત રીતે તો એક જ વાત જુદી જુદી કક્ષાએ, જુદા જુદા સંદર્ભમાં અને જુદી જુદી પદ્ધતિએ કહેવાની હોય છે. આમ છતાં પુનરુક્તિની સાથે ભાવની, વિચારની, દલીલની કે પદ્ધતિની કંઈ ને કંઈ નવીનતા ઉમેરાઈ છે ને તેથી તેનો ભાર લાગતો નથી.

સમગ્ર ગ્રંથનું અને વિચારનું દ્વારસૂત્ર પ્રભુને પામવાનું—આત્માને ઓળખવાનું છે. આ માટે સંયમ-નિયમને આવશ્યક ગણ્યા છે, પરંતુ દમનનો વિરોધ કરવામાં આવ્યો છે અને અંતિમ અવસ્થાએ તો જીવન્મુક્ત દશાની જ કલ્પના થયેલી છે. આ ઉન્નત સ્થિતિને પામવા માટે જે માર્ગો સૂચવાયા છે અને ઉપાયો બતાવવામાં આવ્યા છે, તે જીવનના પ્રવાહને જડતાથી બાંધી રાખનારા નથી. જીવનના કોઈ પણ ક્ષેત્રમાં પ્રવૃત્તિ કરતો માનવી ઉચ્ચ દશાને પ્રાપ્ત કરી શકે, જો એની વૃત્તિ, દસ્તિ ને સાધના એ પ્રકારનાં હોય. વેશ ગૃહસ્થનો છે, સાધુનો છે કે સંન્યાસીનો છે તેનું શ્રીમોટાને મન મહત્વ નથી, તેઓ તો આંતરબાધ્ય વ્યવહારમાં જ્ઞાન, શુદ્ધિ ને સાધના જ વાંछે છે. પ્રવૃત્તિ સંસારની હોય, સેવાની હોય કે સર્વ સંબંધોથી પરની હોય, પરંતુ મૂળ તત્ત્વને આધારે જીવન વહેતું હોય તો બાધ્ય સ્વરૂપની તેઓ ચિંતા રાખતા નથી. સાધકની અવસ્થા અનુસાર સંયમ, નિયમ, શ્રદ્ધા, ભાવના, ભક્તિનું મહત્વ એમણે સ્વીકાર્ય છે, પરંતુ એમાંનું કંઈ જડ કે ઔપચારિક ન બની જાય અને અંતરના પ્રકાશ આડે કોઈ પડ્ઢો ન મુકાઈ જાય તેની એમણે કાળજી રાખી છે. આ વિચારો જિજ્ઞાસુઓને લખાયેલા પત્રોની કંડિકાઓ છે, એમ સમજીને વાચક વિવેકબુદ્ધિ અનુસાર પોતાની કક્ષા લક્ષમાં લઈ એનું વાચન કરશે તો ઉત્તમ માર્ગદર્શન પામશે એમાં સંશય નથી.

મુંબઈ

તા. ૨૭-૬-૧૯૬૩

‘સોપાન’

॥ હરિઃઓ ॥

## પૂજ્ય શ્રીમોટાનું કથન

(પહેલી આવૃત્તિ)

મદ્રાસના મારા એક સ્વજને એક વાર મને સૂચવ્યું કે 'તમારાં બધાં છપાયેલાં પુસ્તકોમાંથી જે જે સ્વત્ત્નાત્મક વચ્ચનો હોય, તેને તથા તે પુસ્તકોમાંથી જુદા જુદા વિષયના મુખ્ય મુખ્ય મુદ્દાઓ તારવીને, ટૂંકાવીને, તે બધાંનું જો એક જુદું પુસ્તક છપાવાય, તો શ્રેયાર્થને તથા વાચકને તે તે બધું જ્ઞાણવું વધું સુલભ થઈ પડે. આ હકીકતને તો ઘણાં વર્ણો થઈ ગયાં. તે પછી ભાઈ નંદુભાઈને પોતાને જ આવું કંઈક તારવવાનો સભાન જ્યાલ જગ્યો ને તેઓએ મૌનએકાંત મંદિરમાં પુરાઈ જઈને, તદ્દન એકાંતવાસ સેવીને, બધાં પુસ્તકોનો અભ્યાસ કરીને આ બધું તારવ્યું છે, જેને વાચક આગળ આજે રજૂ થવાની તક સાંપડી છે. તેનું નિમિત્તકારણ તો એવા જ એક સ્વજન ભાઈ ચીમનભાઈ મહાજન છે. તેમણે લેખકનું કંઈક છપાવવા, યોગ્ય લખાણ તૈયાર હોય તો છપાવવાનું, બહુ જ દિલ કર્યા કરેલું, ને તેવું લખાણ તો તૈયાર જ હતું. આ થઈ એની પ્રકાશન-કથા.

લેખકને જે જે કંઈક કહેવાનું હોય છે, જે જે તેના દિલમાં હોય છે, તે બધું જ કંઈ કહેવાઈ જતું હોતું નથી. તે તો જેને જેને કહેવાનું કે લખવાનું બન્યું હોય, તેની તેની ભૂમિકા પરત્વેના લક્ષાનુસંધાનથી પ્રેરાઈને લખેલું હોવાથી તે તે વિષયની સંપૂર્ણ હકીકત તેમાં આવી જતી નથી હોતી. તેમાંય વળી આ તો બધું તારવેલું છે, એટલે તે લખાયેલાના સારરૂપે તે છે, તેથી તેમાં અધૂર્ય પણ હોવાની જ.

જીવનવિકાસનાં દસ્તિ, વૃત્તિ અને વલણ જ્યાં સુધી એકાગ્ર ને કંદ્રિત, જીવતાંજગતાં, એકધારાં પ્રગટેલાં હોતાં નથી, ત્યાં સુધી

શ્રેયાર્�ીની ભૂમિકા Receptive and Responsive -સ્વીકારાત્મક, સંગ્રહક અને તેને અનુલક્ષીને તેનો હેતુલક્ષી ભાવનાથી પ્રત્યુત્તરાત્મક સામો જવાબ પ્રેમથી, હૈયાના ઉમળકાથી વાળી શકે એવી ભૂમિકા બની ગયેલી, હોઈ શકેલી, ન હોવાથી, તેનું દિલ તે તે બધું પૂરું પચાવી શકે એવું નથી હોતું. તેનો આધાર તો તેનું દિલ જીવનવિકાસના ધ્યેય પરત્વે કેટલું ને કેવું ધગધગતા તલસાટ્યુક્ત ને સતત ઉન્મુખી પ્રગટેલું છે તેના પર હોય છે. એવા દિલનો દિલમાં દિલથી પ્રગટેલો એવો તલસાટ એ જ સાચી રીતે તો એના જીવનને ઘડનારો સાચો ગુરુ છે, ને ત્યારે જ નિમિત્તગુરુ અને પ્રભુકૃપાથી આકાર દેવામાં પ્રેરણાત્મક સૂક્ષ્મ મદદ પ્રેરાવી શકતો હોય છે. એવો દિલનો ઉત્કટ તલસાટ, પ્રચંડ ધગશ, ઉત્સાહ, ઉમંગ, ન્યોછાવરી, સાહસ, હિંમત, ધીરજ, ત્યાગ, સમર્પણ વગેરે જીવનમાં જ્યારે એક અંગભૂત વણાઈ જઈને તેના તેવા સ્વરૂપની કાયા ઘડાયેલી હોય છે, ત્યારે જ એવો શ્રેયાર્થી વારી વારી જઈને એમાં સર્વ ભાવે ને સર્વ રીતે પોતે ફનાગીરીનો આનંદ સેવી સેવી ફલંગો પર ફલંગો કૂદી કૂદી આગેકદમ ભરતો જતો હોય છે ને એવાના દિલની ને જીવનની એવી મસ્તીમાંથી જ જીવનનું પુનર્જીવન ને નવસર્જન થતું રહેતું હોય છે.

જીવનનાં અનેક પાસાંઓમાં, ક્ષેત્રોમાં ને જીવનના જુદા જુદા સંજોગોમાં, પરિસ્થિતિમાં, જુદાં જુદાં કર્મોમાં તેવો જીવ ભલે જુદો જુદો વર્તતો લાગે, પરંતુ તેનાં દસ્તિ, વૃત્તિ અને વલણ તો ધ્યેય પરત્વેના હેતુથી એકધારાં પ્રેરાઈને ધ્યેયના હેતુની સફળતા પરત્વેની એના દિલની સચોટ મીટ મંડાયેલી ત્યારે રહ્યાં કરતી હોય છે, ને એમાંથી જ તે પોતાના જીવનને તારવતો તારવતો આગળ ધાર્યો જતો હોય છે.

જીવનમાં અનેક પ્રકારનાં ધમસાણ ને પ્રલયો એને પ્રગટે છે, પરંતુ તેના દિલની મસ્તીનો પારો ત્યારે પણ નીચે કદી ઉત્તરી શકતો નથી. એવા એવા પ્રસંગોથી તો એના દિલની ખુમારી ત્યારે વધારે

પ્રકાશી કેવી મદમસ્ત ટણારી અનુભવે છે, એની કથા તો કોઈક એવો ન્યારો વિરલ વીર જ અનુભવી શકે છે.

જીવનવિકાસનો માર્ગ તો છે જીવનની મસ્તીનો, ખુમારીનો ને જીવનને હૈયાના ઉમળકાથી સ્વાર્પણ કર્યા જવાનો છે. જીવનવિકાસની કથા એવાં સ્વાર્પણનાં એક પદ્ધી એક પગલાં ભરાયાં જવાયામાંથી નવા નવા ભાવે ને નવા નવા રૂપે કોઈક ભવ્ય, રમ્ય, દિવ્ય કળામાં પરિણમતી જતી જ્યારે પોતે અનુભવે છે, ત્યારે જીવનની ધન્યતા, ફૂતાર્થતા અનુભવતો તે શ્રેયાર્થી એવી જ્ઞાનભક્તિયુક્ત દિલની કુરબાનીઓ ને આહૃતિઓ આપતાં આપતાં એના દિલનો ભાવ દરિયાનાં ભરતીનાં મોઝાંઓથી પણ અનેકગણો વધુ ઉછળતો તે પોતે અનુભવે છે ને જીવન એક પરમ આનંદનો લહાવો છે, એવી એને દિલમાં દિલથી સભાનતા પ્રગટે છે. એવાને ત્યારે દિલમાં મસ્તીની, જીવનઘડતરની એકધારી સતત ભાવના પ્રગટેલી રહ્યાં કરે છે. તેવી ભાવના વડે કરીને હાર ને નિરાશાના વમળમાં તે કદી પણ ગર્ત થઈ જઈ શકતો નથી, કારણ કે દિલમાં એવી પ્રગટેલી પ્રચંડ ઉત્સાહ, તલસાટવાળી ભાવના એનામાં એવી તો એક હૈયાસૂજ પ્રગટાવે છે કે તે તેવી તેવી વેળા તટસ્થતા ને સમતાથી એનું આકલન કરી કરી, તેને તેને પાર કરી જતો હોય છે, ને ત્યારે તે તેના વહાલા પ્રભુની પરમ મંગળમયી કૃપાનો સહારો અનુભવે છે કે જેના આધારે તે પોતાના જીવનનું સુકાન ધ્યેયના હેતુને હૃદયમાં હૃદયથી અનુલક્ષીને પ્રભુકૃપાથી દોરવ્યાં કરતો હોય છે.

જે જે સ્વજનોને આ બધું સંબોધાઈને પ્રભુકૃપાથી જે લખાયેલું છે, તે તે તેમને જીવન પરત્યે સભાન ને સજાગ રખાવ્યાં કરો એ જ પ્રાર્થના.

હરિ:ઊં આશ્રમ,  
કુરુક્ષેત્ર, રાંદેર (વાયા સુરત)  
તા. ૧-૬-૧૯૬૩

— મોટા

॥ હરિઃॐ ॥

## સંપાદકના બે બોલ

(બીજી આવૃત્તિ)

અમને તથા અમારા જેવાં સ્વજનોને પૂજ્ય શ્રીમોટાએ જે પત્રો ગઘમાં અને પદમાં લખેલા તે બધાંનું પુસ્તકરૂપે પ્રકાશન પામી તે તે પુસ્તકો બહાર પડ્યાં. તેમાંથી દરેક વિષય અનુક્રમણિકા પ્રમાણે ગોઠવાય અને સૂત્રાત્મક રીતે જે જે વચ્ચનો તેમાં છપાયેલાં છે, તેને તારવીને જો જુદાં છપાવાય તો તે અવારનવાર જોઈ જવાનો લાભ ઢીક મળે એવું મને મારા પોતાના ખાતર લાગવાથી દક્ષિણ હિંદના કુંભકોણમના ‘હરિઃॐ આશ્રમ’ના મૌનમંદિરમાં લાગલગાટ બાવીસ દિવસ મૌનએકાંતમાં બેસીને ને રોજના એકધારા સોળથી સતત કલાક આ જ કાર્યમાં લગાતાર તારવવાનું પ્રભુકૃપાથી બન્યું, અને તેનું ફળ વાચક જગત સમક્ષ મૂકવાનું બને છે, તેથી આનંદ અનુભવું છું.

પૂજ્ય શ્રીમોટાએ જીવનને જીવનવિકાસક હેતુના જ્ઞાનભક્તિભાવે સ્વીકારેલું હોઈ જીવનના જુદા જુદા સાધનાના તબક્કાઓમાં તથા જીવનના અનેક પ્રકારના જુદા જુદા સંજોગોમાં ને પરિસ્થિતિમાં જે રીતે ધ્યેયને એકધારું સતત અનુલક્ષીને તેઓ જીવન જીવ્યા ને તેમાંથી તેમને જે લાધ્યં, તે સમજવાનું તેમનાં લખાણોમાંથી અમને મળ્યું. ધારણાઓને કહેતાં સાંભળ્યાં છે કે ‘આ માર્ગ તો અધરો છે.’ પરંતુ જેને જીવનવિકાસના ધ્યેય પરત્વેની ઉત્કટમાં ઉત્કટ ધગશ પ્રગટેલી છે, એવાને તો અધરું નથી લાગતું. એના દિલની એવી ધગશ ને ધ્યેયને સાકાર પમાડવાનો એના દિલનો તલસાટ એને તેવી પળે ધ્યેય પરત્વેની એના દિલની ઝંખનાને વધુ ને વધુ પ્રદીપ્ત કરાવીને એનામાં ધ્યેય-આકાશ

પરત્વેની એની મીટને અફાટ પ્રગટાવે છે, કારણ કે ધ્યેય પરત્વેની એની એવી અદમ્ય ઉત્કટ જલતી જંખના એને ઉપર તરતો રખાવ્યા કરતી હોય છે. શ્રેયાર્થીના દિલની ધ્યેય પરત્વેની જંખના કેટલી ને કેવી પ્રગટેલી છે, એના ઉપર જ જે તે બધો આધાર છે.

એવી ધ્યેય પરત્વેની દિલની જંખનાને વધારે પ્રકાશિત થવા દેવા કાજેનો આ મારો યત્કિચિત પ્રયત્ન હતો ને છે, ને એવા હેતુથી પ્રેરાઈને આ બધું તારણ પ્રભુકૃપાથી બન્યું છે. તેમાં બધાં પુસ્તકોનું પૂરેપૂરું તારણ કદાચ ન પણ બન્યું હોય ને તેથી લેખકને યથાયોગ્ય ન્યાય ન પણ આપી શક્યો હોઉં એવું પણ બને. તે તો જે હો તે, પરંતુ એટલું ચોક્કસ કે મને તો લાભ થયો જ છે, ને તે લાભ વાચક આગળ મૂકી દિલની ભાવનાને સતેજ થવાનો જે પ્રસંગ સાંપડ્યો તેની હકીકત તો ન્યારી જ છે.

હરિ:ઓં આશ્રમ,  
નાનિયાદ

તા. ૧૫-૧૨-૧૯૭૨

નંદુભાઈ ભોગીલાલ શાહ

॥ હરિ:ॐ ॥

## નિવેદન

(બીજુ આવૃત્તિ)

પૂજ્યશ્રીના સાહિત્યનું જેઓ વાચન-મનન કરશે, તેમને એટલું તો જરૂર સમજાશે કે આધ્યાત્મિક જેવા ગહન વિષયને એમણે સર્વને સમજાય તેવી સરળ વાણીમાં અને તેમ છતાં સચોટ દર્શન કરાવ્યું છે. વિદ્વદ્વર્ગ પણ કબૂલ કરશે કે જ્યારે કોઈ પણ કણ સંપૂર્ણ રીતે હસ્તગત થાય છે, ત્યારે તેને આવી રીતે સહજપણે અને સરળપણે વ્યક્ત કરવાનું બની શકે છે. સર્જનકારને ત્યારે સર્જનની ખોજ કરવી પડતી નથી પણ આપોઆપ હદ્ય દ્વારા તે વ્યક્ત થાય છે.

વધુ આનંદની વાત તો એ છે કે પૂજ્યશ્રીનાં એક પછી એક પુસ્તકો જેમ જેમ તૈયાર થતાં ગયાં તથા પહેલાં છપાઈ ચૂકેલાં પુસ્તકોની પ્રતો ખલાસ થતી ગઈ તેમ તેમ તે બધાંને પ્રસિદ્ધ કરનાર સ્વજનો પણ મળતાં ગયાં.

આ ‘જીવનપરાગ’ પુસ્તકની દ્વિતીય આવૃત્તિના પ્રકાશનનું તમામ ખર્ચ ચીખોદરા નિવાસી સ્વજન શ્રી બહેચરભાઈ સોમાભાઈ પટેલે એમની સહજસ્કૃતિ ઉદારતાથી આપ્યું છે, જે માટે અમે તેઓશ્રીના ઘણા ઘણા આભારી છીએ. (અને પ્રથમ આવૃત્તિની ૨૨૫૦ પ્રતોનું તમામ ખર્ચ એવી જ હદ્યની ઉદારતાથી સ્વજન શ્રી ચીમનભાઈ મહાજને ત્યારે આપ્યું હતું, જે માટે અમો ફરીથી તેમનો ઘણો આભાર માનવાની તક લઈએ છીએ.)

પૂજ્યશ્રીનાં પુસ્તકોની તમામ આવક પૂરેપૂરી, પરમાર્થના કાર્યમાં જ વપરાય છે. એટલે ગુજરાતનાં ભાઈબહેનો આ પુસ્તકના વેચાણમાં જે કાંઈ મદદ કરશે તે પરમાર્થને જ મદદ કરી ગણાશે.

અંતમાં મે. એલેમ્બિક તરફથી આ ‘જીવનપરાગ’ છાપવાનું  
કામ તાત્કાલિક હાથ ધરીને, ખૂબ જ કાળજ અને ચીવટપૂર્વક  
સુધૃ અને સુંદર છાપકામ કરી આપ્યું છે, તે માટે અમે તેમના  
ખાસ આભારી છીએ.

નડિયાદ

તા. ૧૫-૧૨-૧૯૭૨

- નંદુભાઈ

મેનેજિંગ ટ્રસ્ટી,  
હરિઃઉં આશ્રમ, નડિયાદ

॥ હરિ:અં ॥

## નિવેદન

(છઢી આવૃત્તિ)

‘જીવનપરાગ’ની છઢી આવૃત્તિનું પ્રકાશન ૧૪ વર્ષ પછી થઈ રહ્યું છે, તે અનેરા આનંદનો અવસર છે. શ્રી નંદુભાઈએ પૂજ્ય શ્રીમોટાનાં સુવાક્યોને જીવનસાધનાની પ્રગતિના કમાનુસાર ગોઠવીને આ પુસ્તકનું સંકલન કર્યું છે. આપણે સંસારમાં રહીને સાધનામય જીવન કરી રીતે જીવનું તેની રૂપરેખા ઘડી આપી છે. શ્રી નંદુભાઈનો જેટલો પણ આભાર માનીએ તેટલો ઓછો છે.

ટ્રસ્ટી શ્રી રજનીભાઈએ આ પુસ્તકની મુદ્રણશુદ્ધિ તેમ જ શક્ય એટલાં લખાણોનાં પુસ્તકોનાં નામ અને પાનાં નંબર આપવાં તથા નવેસરથી સૂચિ તૈયાર કરવી વગેરે ભારે પરિશ્રમ માંગી લેતાં જટિલ કાર્યો ઘણી ચીવટાઈથી ટ્રસ્ટ પ્રત્યેની ફરજ રૂપે કર્યા હોઈ તેમનો આભાર માનવાનો હોય નહિ. પુસ્તકની ટાઈટલ ડિઝાઇન હરિ:અં કોમ્યુનિકેશનના શ્રી મયૂરભાઈ જાનીએ કરી છે અને કંપોઝિંગનું કાર્ય અર્થ કોમ્યૂટરના શ્રી કનુભાઈ પટેલે કર્યું છે. સાહિત્ય મુદ્રણાલય, અમદાવાદના શ્રી શ્રેયસકુમાર વિષ્ણુભાઈ પંડ્યાએ આ પુસ્તકનું ચતુરંગી મુખપૃષ્ઠ અને પ્રિન્ટિંગનું કાર્ય પૂજ્ય શ્રીમોટા પ્રત્યેના ભક્તિભાવથી કરી આપ્યું છે, તે બદલ તેમનો ઘણો ઘણો આભાર માનીએ છીએ.

આ પ્રકાશનને ક્ષતિરહિત બનાવવા શક્ય એટલા તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે, છતાં કોઈ ક્ષતિ પ્રત્યે અમારું ધ્યાન દોરવામાં આવશે તો તેની સાભાર નોંધ લેવામાં આવશે. અંતમાં શ્રેયાર્થીઓના જીવનવિકાસ માટે આ પુસ્તક પથદર્શક બની રહે એવી પૂજ્ય શ્રીમોટાને પ્રાર્થના સાથે વિરભીએ છીએ.

તા. ૩-૪-૨૦૦૯  
રામનવમી, સં. ૨૦૬૪

ટ્રસ્ટીમંડળ,  
હરિ:અં આશ્રમ, સુરત

## વિષયસૂચિ

સૂત્રાત્મક વિચારરત્નો (ગદ્યમાં) પા. ૧ થી ૨૧૮

સૂત્રાત્મક રલનકણિકાઓ (પદ્યમાં) પા. ૨૧૮ થી ૨૩૪

વિષયવાર લખાણો (ગદ્ય અને પદ્યમાં) પા. ૨૩૫ થી ૫૨૮

અનુભવ અને તેનો લાભ	૨૬૫	ગંગાચરણે (દ્વિઅર્થી શ્લોક)	૩૦૮
અભિપ્રાય ન બાંધો (કાવ્ય)	૨૬૭	ગુણો-તમસ, રજસ, સત્ત્વ	૩૧૧
અશ્વુ (હદ્યનાં) (કાવ્ય)	૨૬૮	ગુણ-વિકાસની સરળ રીત	૩૧૫
એક્ષ્ય, હાર્દિક (કાવ્ય)	૨૭૦	ગુણોની રમત(કાવ્ય)	૩૧૬
અહ્મ્ય (કાવ્ય)	૨૭૧	ગુણોની આવશ્યકતા	૩૧૭
આધાત-પ્રત્યાધાત	૨૭૨	ગુરુ સૂક્ષ્મ ભાવરૂપે	૩૧૮
આત્મનિવેદન	૨૭૮	ગુરુ-માહાત્મ્ય (કાવ્ય)	૩૧૯
આધાર	૨૭૯	ગુરુની પરખ	૩૨૦
એક અને શૂન્ય (કાવ્ય)	૨૮૧	ગુરુનો સાધક સાથે વર્તાવ	૩૨૧
એકાશ્રય	૨૮૨	ગુરુથી થતું જીવનઘડતરે	૩૨૬
‘ઈશ્વર સર્વ કંઈ		ગુરુ અને સાધક	૩૩૩
કરાવે છે ?’	૨૮૩	ગુરુ અને સાધક (કાવ્ય)	૩૪૦
ઈશ્વર જ બધું સંભાળો છે ?	૨૮૪	ચ્યામતકાર	૩૪૪
ઉદાર માનસ	૨૮૯	ચૈતન્ય, કર્માના મૂળમાં	૩૪૫
ગુર્ભિનો સદ્ગુપ્ત્યોગ(કાવ્ય)	૨૯૧	જ્ય	૩૪૭
ગુંધ-નિદ્રા	૨૯૨	જીન્મ-મૃત્યુના રાસ (કાવ્ય)	૩૪૨
કર્મસાધનાના મુદ્દાઓ	૨૯૪	જીવનના ફિરસ્તા (કાવ્ય)	૩૪૩
કર્મ-મહિમા (કાવ્ય)	૨૯૭	પ્રકૃતિમાં પ્રયજ્ઞન પ્રભુ	૩૪૩
કર્મ-સાધના	૨૯૮	જીવન છતાં નથી ત્યાંયે	
કર્મમાં સારાનરસાપણું	૩૦૩	(કાવ્ય)	૩૪૪
ક્ષેત્ર ભલે ગમે તે હો(કાવ્ય)	૩૦૪	જીવન-સોદો (કાવ્ય)	૩૪૫
ક્ષોટીનો મહિમા	૩૦૬	જીવન-વ્યાપ્તિ પ્રભુમાં	
કાવ્ય, આત્માનું કથન (કાવ્ય)	૩૦૮	(કાવ્ય)	૩૪૬
		જોબનિયે જીવન-સિદ્ધિ	
		(કાવ્ય)	૩૪૮

શાનેન્દ્રિયો અને આસક્તિ	૩૫૮	પ્રારબ્ધવાદ-પુરુષાર્થ	૪૧૩
જ્ઞાની-અજ્ઞાની વચ્ચેનો ફેર	૩૬૦	પ્રારબ્ધ અને આત્મશક્તિ	
જ્ઞાન-ભક્તિ-ધ્યાન-સમન્વય	૩૬૨	(કાવ્ય)	૪૧૫
જંખના-અજિન (કાવ્ય)	૩૬૩	પ્રેમ	૪૧૭
તમના (કાવ્ય)	૩૬૪	પ્રેમ સમર્પણ (કાવ્ય)	૪૨૩
તાટસ્થ્ય (કાવ્ય)	૩૬૫	પ્રેમ દ્વંદ્વતીત (કાવ્ય)	૪૨૪
તીર્થોનો-યાત્રાનો લાભ	૩૬૭	પ્રેમ સંબંધ કોની સાથે	
ત્યાગ અને ભોગ	૩૭૦	(કાવ્ય)	૪૨૫
ત્રાટક	૩૭૧	ગૃહ્ણતા (કાવ્ય)	૪૨૬
દંભ	૩૭૫	પ્રેરણા	૪૨૮
દાન	૩૭૬	ફનાગીરી (કાવ્ય)	૪૩૧
દિલદારનું દર્શન (કાવ્ય)	૩૭૭	બધું એનું બાકી છે (કાવ્ય)	૪૩૨
દુઃખ, જીવન-દાતા (કાવ્ય)	૩૭૮	બહેનો સાથેનો વર્તાવ	૪૩૩
દોષોનો સ્વીકાર ને વેદના	૩૭૯	બહેનો પ્રત્યેનું વલણ	૪૮૬
દોષ-નિરીક્ષણ (કાવ્ય)	૩૮૧	બહેનોને ચરણો (કાવ્ય)	૪૩૬
નિરાશા-વિષાદ(સાધનામાં)	૩૮૧	બુદ્ધિ (ગંધ અને પંધ)	૪૩૮
નિરાશા-હાર (કાવ્ય)	૩૮૩	ભગવાનનાં દર્શન	
પત્રવ્યવહાર, સાધનરૂપે	૩૮૪	એટલે શું ?	૪૪૨
પરિસ્થિતિ પ્રસંગો	૩૮૬	ભાવનું મહત્વ (કાવ્ય)	૪૫૦
પૂજા-અર્ચન-આચાર (કાવ્ય)	૩૮૭	ભૂલો, સાધનામાં	૪૫૪
પુરુષાર્થ અને કૂપા	૩૮૮	મન	૪૫૪
પુરુષાર્થ (કાવ્ય)	૪૦૧	માયાના ખેલમાં પ્રભુ	
પ્રકૃતિની ચાલબાળ (કાવ્ય)	૪૦૨	(કાવ્ય)	૪૫૮
પ્રકૃતિની ચાલબાળ (કાવ્ય)	૪૦૪	માંગલ્ય પ્રેમ (કાવ્ય)	૪૬૧
પ્રકૃતિજ્ઞન્ય પ્રવાહો (કાવ્ય)	૪૦૬	મુક્તાત્માનાં ગૂઢ વર્તનો	૪૬૩
પ્રસંગો (કાવ્ય)	૪૦૮	મુક્તનો સ્વભાવ (કાવ્ય)	૪૭૩
પ્રાર્થના	૪૧૦	મોહ	૪૭૮
પ્રાર્થના ભાવે પ્રવૃત્તિઓ	૪૧૨	યુદ્ધની અનિવાર્યતા	૪૭૯
		લગ્નભાવનાનો હેતુ	૪૮૨

નવદંપતીને (કાવ્ય)	૪૮૫	સહેવાની સાધના (કાવ્ય)	૫૨૬
લક્ષ્મી તરફની દાઢિ	૪૮૭	સત્સંગનો સ્પર્શ	૫૨૭
વાતાવરણની અસર	૪૮૮	સંત-સમાગમ	૫૨૮
વાડીનો સંયમ	૪૮૯	સંતોની સરખામણી ન કરો	૫૩૨
વિઘ્નો-મુશ્કેલીઓ	૪૯૨	સંસાર, પાઠશાળા	૫૩૩
વિચારો	૪૯૩	સંયમ	૫૩૪
વિવેકશક્તિ	૪૯૫	સર્વ કંઈનો ઉપયોગ	
વિશ્વમાં અલિપ્ત વિશ્વેશ્વર	૪૯૬	(કાવ્ય)	૫૩૮
વૈરાગ્ય અને સંન્યસ્ત	૪૯૮	સંધર્ષણોની આવશ્યકતા	૫૩૮
વૃત્તિઓ	૫૦૦	સંતાનો અને	
વૃત્તિનો ઉપયોગ (કાવ્ય)	૫૦૧	માબાપનો ધર્મ	૫૩૯
વ્યક્ત-અવ્યક્ત (કાવ્ય)	૫૦૨	સાધનામાં રસ ક્યારે પડે?	૫૪૧
વિષ્ણિમાં સમાધિનો ઉકેલ	૫૦૩	સાધના અનિવાર્ય (કાવ્ય)	૫૪૨
શક્તિનાં રમકડાં (કાવ્ય)	૫૦૪	સાધના એકાંતિક	૫૪૩
શરીરનું મહાત્વ	૫૦૭	સાધકનું સ્વજન પ્રતિ વલણ	૫૪૫
માનવ-દેહ (કાવ્ય)	૫૦૭	સાધક અને સંસારી સંબંધો	૫૪૮
શરણભાવ	૫૧૦	સાધક અને ઘરનોકર	૫૫૦
શ્રેષ્ઠ ખલાસી-ભરોસે (કાવ્ય)	૫૧૨	સાધકોનું માંહોમાંહે વર્તન	૫૫૩
શંકા	૫૧૩	સાધનારહસ્ય (કાવ્ય)	૫૫૯
શંકા સમાધાન (કાવ્ય)	૫૧૪	સુમેળ (કાવ્ય)	૫૬૫
સમર્પણ (કાવ્ય)	૫૧૭	શ્રીજીવનની મહત્તા	૫૬૬
સમર્પણ યજ્ઞ, જાડ્યે	૫૧૭	સ્મृતિ	૫૬૮
અજાડ્યે	૫૧૮	શ્રદ્ધા	૫૭૦
સમર્પણ યજ્ઞ, પ્રકૃતિજ્ઞય	૫૧૯	શ્રદ્ધા, પ્રભુમાં	૫૭૨
સદ્ગ્ભાવની કેળવણી	૫૨૦	સ્વખાં અને સ્વખમાં	૫૭૩
સલામત સ્થિતિ	૫૨૨	સાધના	
		સ્વખમાં સાધના (કાવ્ય)	૫૮૦



જીવનપરાગ



પૂજ્ય શ્રીમોટા

‘લું સર્વત્ર વિદ્યમાન છું.’

- મોટા

‘જ્વનદર્શન’, ૧૦મી આ., પૃ. ૩૮૨

## જીવનપરાગ

અભિપ્રાય કશાયનો બાંધી લેવો ઘટે નહિ

આપણો આપણનું કહ્યું કરવાનું છે, મનનું કહ્યું નહિ. મન કહે  
તે પ્રમાણે કરવાનું હોય તોપણ, તે વેળા તરત તો નહિ જ; પણ  
થોડીવાર પછી જાણો આપણો જ કરતા હોઈએ એમ કરીને તે  
કરવાનું રાખો.

('જીવનપગરણ', આ.૩, પૃ. ૧૧૦)

\* \* \*

વ્યક્તિઓના નવા પરિચયો અને સંબંધો કરવાનું આપણો  
મન રાખવાનું નથી; પરંતુ કંઈક આવી જ પડે તો કોઈ જાતની  
અવગણનાની વૃત્તિ ન રાખવી.

('જીવનપગરણ', આ.૩, પૃ. ૮૫)

\* \* \*

સાધનાકાળના શરૂ શરૂના તબક્કે જે જુદું જુદું વાંચવામાં  
પડી જાય છે તે ગુંચવાડામાં પડશે—એ રીતે એનો માર્ગ ખુલ્લો  
રહેવામાં અડચણો આવશે. એનું મન એને હજારો પરસ્પર વિરોધી  
દિશાઓમાં તાણી જશે. અનેક તર્કવિતર્ક જાગશે. સૌથી ઉત્તમ  
તો એ છે કે સાધનામાર્ગનું વાંચવાની તે વેળા જરૂર નથી. જે  
સૂચવાયું હોય તે જ પ્રેમભાવે, સમર્પણભાવે, શરણાગત રહીને  
ઉત્કટભાવે કર્યા કરીશું ને એમાં જ્યારે સ્થિત થતા જઈશું ને  
ભગવાનનો ભાવ આપણામાં સ્થિર થવા માંડે, ત્યાર પછી જે  
કંઈ વાંચવું હોય તે વાંચવું.

('જીવનપગરણ', આ.૩, પૃ. ૧૨૩)

\* \* \*

ઉર્મિ-લાગણી આપણનું આણમોલું ધન છે. ધૂળધોયો જેમ  
સોનું ભણેલી ધૂળમાંથી ધૂળ ધૂળ કાઢી નાંખી સોનું તારવી લે છે,

તેમ લાગણીમાંથી આપણે તેવું તારવી લઈ શકીએ છીએ, તેનો ઉપયોગ કરી શકીએ છીએ, પરંતુ તેમાં લાગણી સાથે રમત કરવા જરૂર ને એને નોતરવી ન ઘટે કે આપણે સામે જરૂર ને એને ખેંચી લાવવાની કે ઉતારવાની ન હોય, કારણ કે તેમાં ખોવાઈ જવાવાનો પૂરો સંભવ છે.

(‘જીવનપગરણ’, આ.ડ, પૃ. ૧૩૨)

\*

\*

ઉર્મિને, લાગણીને દબાવવી એ ઠીક નથી; પરંતુ તે સાથે, એ ઉર્મિવાળી લાગણીની સાથે, વધ્યાં જવું એ પણ ઈષ્ટ નથી. બન્ને વચ્ચેનો આપણાથી લાભપ્રદ રસ્તો ખોળી લેવાવો ઘટે.

(‘જીવનપગરણ’, આ.ડ, પૃ. ૧૭૮)

\*

\*

કોઈ પણ કામ કરતાં પહેલાં આપણે વિચારવાનું રાખવાનું છે; કરતી વખતે કે પછી એ વિષે કશું જ વિચારવું નહિ.

(‘જીવનપગરણ’, આ.ડ, પૃ. ૧૭૧)

\*

\*

કશું દબાવવાનું નથી. દબાયેલું હશે, તે મનમાં કચરા તરીકે પડી રહેશે ને વખતોવખત ઉપર તરી આવશે.

(‘જીવનપગરણ’, આ.ડ, પૃ. ૧૭૮)

\*

\*

આખા દિવસની માનસિક ભૂમિકાનું સ્થાન ફેરવીને, હદ્ય પર લાવીને વર્તવાનું રહેશે; એટલે ભાવથી પ્રેરાઈને આપણે બધું કામ કરવાનું છે.

\*

\*

મનને તદ્દન ખાલી રાખ્યા કરવાનું છે. જે કંઈ વિચારો, ગડમથલો ઉપજે એનો તુરત ઉકેલ કરી દેવાનું આપણે રાખવું.

(‘જીવનપગથી’, આ.ડ, પૃ. ૧૬)

\*

\*

બધો ઝોક-આગ્રહ માત્ર સાધના ઉપર જ મૂકો.

(‘જીવનપગથી’, આ.૩, પૃ. ૧૮)

\*

\*

સત્ત્વગુણના પણ ગુલામ થવાનું નથી.

(‘જીવનપગથી’, આ.૩, પૃ. ૧)

\*

\*

પહેલાંનું ભણેલું ભૂલવું પડશે.

(‘જીવનપગથી’, આ.૩, પૃ. ૨)

\*

\*

એક વાર તો ‘સારા’ સ્વભાવની પણ પર થાઓ.

(‘જીવનપગથી’, આ.૩, પૃ. ૩)

\*

\*

જે કંઈ કરતા રહીએ તેમાં દિલ હોય, પ્રેમ હોય, રસ હોય  
અથવા એ બધાં ના હોય તોયે એ બધાં જન્મવાનાં જ છે એવી  
શ્રદ્ધાથી, વિશ્વાસથી ને ધગશથી સર્વ કંઈ કર્યા કરીએ, એનો તંત  
પકડી રાખીએ, એટલી જગૂતિ આપણે રાખવી જ જોઈએ.

(‘જીવનપગથી’, આ.૩, પૃ. ૧૯)

\*

\*

સાધકનું પ્રત્યેક કાર્ય સહેતુક થવું ઘટેછે ને તે ઊર્ધ્વ હેતુ પૂર્ણ  
થવો જોઈએ. (‘જીવનપગથી’, આ.૩, પૃ. ૨૭)

\*

\*

ભક્તિ કોઈના જેવી આપણે માગવાની હોય જ નહિ;  
કારણ કે પ્રત્યેક વ્યક્તિની વૃત્તિના પ્રકાર નોખા નોખા હોય છે.  
એકના પ્રમાણનું ખોખું બીજાને બંધબેસતું ન પણ આવે.

(‘જીવનપગથી’, આ.૩, પૃ. ૪૬)

\*

\*

જ્યારે આપણે આપણા જીવનમાં આપણા આ સાધનાના કાર્યને જ સર્વોપરી લેખીશું ને એને જ વધુમાં વધુ મહત્વ આપતાં રહીશું, ત્યારે જ સાધનાને યથાર્થ સ્વરૂપમાં ફળતી અનુભવી શકીશું.  
(‘જીવનપગથી’, આ.૩, પૃ. ૫૩)

\*

\*

સ્વજનોને કે કોઈને પણ પત્રો લખો ત્યારે માત્ર કોરી હકીકતવાળા જ કાગળો ન લખતાં એમાં લાગણી, ભાવ, વ્યક્તિગત પ્રેમસ્પર્શ વગેરે પ્રગટવા દેવાં. તે લખતી વેળા આપણે જાણે તેમના દિલની પાસે હોઈએ, આપણી ચેતના જગ્રતપણે ત્યારે આપણામાં જ સમાયેલી રહે, એવું થઈને લખવું. પત્રલેખનને પણ સાધનાનું અંગ ગણવું પડશે ને બનાવવું જોઈશે. આપણા હૃદયના પ્રેમભાવને વધારે વેગ આપવાને માટે આપણા પ્રેમીની સાકાર ચેતના અથવા વધુ સારું તો ભાવાત્મક ચેતના આપણી સામે સાધન તરીકે આપણે જગાડવાની છે.

(‘જીવનપગથી’, આ.૩, પૃ. ૮૬, ૮૭)

\*

\*

આપણા આગ્રહો, વિચારો, મંતવ્યો, ઘ્યાલો વગેરેને આપણે બીજાઓ ઉપર ન લાદીએ ને કંઈ કહેવાનું હોય તે એક વખત પ્રેમપૂર્વક કહીએ અને તે પણ જરાકે ભાર દીધા વિના; ને પછીથી એનો સમૂળગો વિચાર પણ કાઢી નાખીએ. સૌ કોઈને એમની રીતે એમના જ વાતાવરણમાં સ્વતંત્રપણે વિકસવા દઈએ.  
(‘જીવનપગથી’, આ.૩, પૃ. ૮૫)

\*

\*

આપણે બીજી સકળ વૃત્તિઓનું જોશ ને એનું સ્વચ્છંદીપણું મિટાવવું હોય તો આપણા કામની ભાવનામાં ખૂબ એકાગ્રપણે, ઉત્કટ ભાવથી વળગ્યા રહેવું જોઈશે; તે સિવાય આ વસ્તુ થવી

શક્ય નથી, અને આવું કરીશું તો જ બીજી વસ્તુઓને આપણે ગૌણપણે હાથમાં કે મનમાં લઈ શકીશું.

(‘જીવનપગથી’, આ.ડ, પૃ. ૧૦૧)

\*

\*

સાધન મુખ્ય નથી-જેમ કામ મહત્વનું નથી. પણ કામની ભાવના મહત્વની છે. તેમ સાધનથી જો ભાવનાના પરિણામ પર ને તેનાં સૂક્ષ્મ પરિવર્તનોમાં ઉત્તરોત્તર ફરક પડતો રહેતો ન હોય, તો આપણું સાધન માત્ર જડ યંત્રની રીતે થાય છે એમ સમજવું. સાધન યાંત્રિક થતાં તે વર્થ ઠરે છે.

(‘જીવનપગથી’, આ.ડ, પૃ. ૧૦૪)

\*

\*

સાધનાનું કાર્ય ઘણું જ abstract(ભાવાત્મક કે અપ્રત્યક્ષ) હોવાથી એમાં રસ જમાવવાનું અધુરું હોય છે, કારણ કે એ રસને પકડનાર ને સમજનાર ઈન્દ્રિયો નથી; ઈન્દ્રિયોનો એ વિષય જ નથી. જાગૃત થયેલું હૃદય જ અને અનુભવી શકે છે.

(‘જીવનપગથી’, આ.ડ, પૃ. ૧૦૬)

\*

\*

જે જળાવવાની હરકત ન હોય તેવાં બધાં મુખ્ય કામો આપણે સૌ સ્વજનોને કહીએ; તેમની સલાહ લઈએ; ને તેઓને તે પણ તેમનું જ કામ છે એમ લાગવા દઈએ; જેથી બધાં આપણા કામમાં રસ લેતાં થશે અને તેમ થતાં આપણું કામ કેટલેક અંશે હળવું પણ થશે.

(‘જીવનપગથી’, આ.ડ, પૃ. ૧૧૨)

\*

\*

કશાયમાં સગડગ થવાપણું ન હોય.

(‘જીવનપગથી’, આ.ડ, પૃ. ૧૧૨)

\*

\*

કોઈ પણ આપણું કશુંક પ્રેમથી કરે, તો આપણે તેની ખૂબ કદર કરવી. એવી કદરભાવના આપણે સરળતાથી અને સહદ્યતાથી રાખવાની છે. એથી સામાના દિલ પર પણ અસર થાય છે, ને તેને આપણી તરફ લાગણી રાખવાને ઉતેજન મળે છે. વળી આપણામાંનું અક્કડપણું પણ ઓછું થાય છે.

(‘જીવનપગથી’, આ.૩, પૃ. ૧૧૩)

\*

આપણાથી થતાં બધાં જ કામોમાં કર્દી લાભ મેળવાની કે ગેરલાભ થવાની કશીયે ઈચ્છા કે ભય આપણે રાખવાનાં નથી. એનું સ્વાભાવિક પરિણામ લાભમાં કે ગેરલાભમાં ભલે આવતું હોય; પરંતુ આપણી માનસિક ભૂમિકામાં તેવી ઈચ્છાને ક્યાંયે સ્થાન ન હોય એટલું આપણે સતત જોવું ધટે.

(‘જીવનપગથી’, આ.૩, પૃ. ૧૧૪)

\*

કામ કરીયે આપણને વિઘ્નકર્તા થશે નહિ. તે તો એક રીતે આપણી ધારણામાં આપણને વધારે મક્કમ બનાવવાને માટે અને દઢ રહેવાને માટે, કસોટી કરવાને માટે મળેલી તક છે.

(‘જીવનપગથી’, આ.૩, પૃ. ૧૧૪)

\*

પોતાનાં આપ્તજનોને પણ પોતાની ધૂનમાં વાળવાને માટે આપણામાં કશોયે આગ્રહ ન રહેવો ધટે.

(‘જીવનપગથી’, આ.૩, પૃ. ૧૧૮)

\*

ગુરુની સાથેના સ્થૂળ પરિચય કરતાં માનસિક અને શુદ્ધ તત્ત્વવાળી ભાવનાથી આપણો સંપર્ક વધે તે બહુ જરૂરનું છે.

(‘જીવનપગથી’, આ.૩, પૃ. ૧૫૬)

\*

સાધકે પોતાનું, જાતનું, વિચારોનું, વૃત્તિઓનું, લાગણીઓનું, ભાવનાઓનું ને ચેતનાનું ઉંદું પૃથક્કરણ કરતા રહેવું પડશે; ને તે દરેકને તેના યથાર્થ સ્વરૂપમાં સમજુને આપણા વિકાસમાં તેમનો કેવી રીતે શ્રેષ્ઠ ઉપયોગ યોજ શકાય તે સમજ લેવું પડશે.

(‘જીવનપગથી’, આ.૩, પૃ. ૧૬૬)

\*

\*

કોઈ પણ લાગણી કે ઊર્મિનો ઊભરો આવે, ત્યારે તેનો ઉપયોગ નામસ્મરણના વેગમાં કરી લેવાનું ચૂકવું નહિ.

(‘જીવનપગથી’, આ.૩, પૃ. ૧૬૭)

\*

\*

સમજણથી આગળ વધ્યા કરવાનું રાખવું; અંધશ્રદ્ધાથી નહિ.

(‘જીવનપગથી’, આ.૩, પૃ. ૧૬૭)

\*

\*

જાતીય વિષયવાસનાનો ઉપયોગ તો સાધક માટે ઊર્ડી ખીણમાં ફેંકાઈ જવા જેવું છે.

(‘જીવનપગથી’, આ.૩, પૃ. ૧૮૧)

\*

\*

આપણી ચેતનાની સાંકળ આપણા પ્રત્યેક પ્રિયજનમાં જોડાયેલી રાખવાનું કર્યા જઈશું તો એનું જોર વહેંચાઈને વેડફાઈ જવાનું છે. જ્યાં સુધી આપણામાં એટલી શક્તિ પ્રગટી નથી કે તે બધાં સાથે એકધારું સંધારણ રાખી શકીએ, ત્યાં સુધી તો એકમાં જ ચેતનાની સાંકળ રહ્યા કરે એ જરૂરનું છે.

(‘જીવનપગથી’, આ.૩, પૃ. ૨૧૬)

\*

\*

તાવ આવતો હોય ત્યારે એક પ્રકારનો જુસ્સો હોય છે. તેવે વખતે ભગવાનનું નામસ્મરણ કરીને તાવના વેગનો

ઉપયોગ કરી શકાય છે. ('જવનપગથી', આ.૩, પૃ. ૧૬૭)

\*

\*

પ્રામાણિક અને સાચા મથવામાંથી એક દિન સાચો પ્રાણ પ્રગટી જવાનો જ છે. મથે છે તે મેળવવાને માર્ગ છે.

\*

\*

અભ્યાસ વધતાં વધતાં જ વૈરાગ્ય જાગવાનો છે.

\*

\*

સાધકનું મહત્વનું એક લક્ષણ પ્રસન્નચિત્તતા છે.

('જવનપોકાર', આ.૪, પૃ. ૩૨)

('જવનમંડાણ', આ.૫, પૃ. ૮૩)

\*

\*

ત્રાટક, ધ્યાન, જાપ, ધારણા એ બધાં સાધનોથી તાત્કાલિક પરિણામ દેખાતું નથી, તેમ છતાં મનને ઊંચી ગતિએ લઈ જનારાં તે સાધનો છે—જો તે પરત્વેની આપણા હદ્યની આંખ ને ભાવના ખૂલ્લી ગયાં હોય તો.

\*

\*

આપણો વારંવાર આપણને નીરખ્યાં કરવાનું છે ને મનથી અલગ પડતાં કે થતાં પણ શીખવાનું છે.

\*

\*

ઈન્દ્રિયોના સ્પર્શ તથા વિષયોને મન ન સ્વીકારી શકે તે કાજે નિઃસ્પંદતા તથા નીરવતા સ્થાપવી જોઈશે. સમતા કેળવવાની પણ એટલી જ જરૂર છે. સમતા વિના શાન્તિ ન સંભવે.

('જવનસોપાન', આ.૩, પૃ. ૧૩૪)

\*

\*

મનને તો હજુ બુદ્ધિની મદદ વડે અના આડાઅવળાપણાને સમજુને કંઈક અંશે કાબૂમાં પણ લાવી શકાય, પરંતુ બુદ્ધિનું તેવું

નથી હોતું. બુદ્ધિ એ પ્રકાશ રૂપે છે; એ હાઈને પ્રગટ કરે છે;  
સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે, તેથી બુદ્ધિની શુદ્ધિ પણ તેટલી જ જરૂરી છે.

(‘જીવનસોપાન’, આ.પ, પૃ. ૧૪૨)

\*

\*

પ્રાણમાંથી ઉત્પન્ન થતા આવેશો, આવેગો,  
આતુરતાપૂર્વકનાં શોક, મોહ, રાગ, દિલગીરી, તલસાટ આદિ  
જે ઊઠે છે, તે બધાંનો ઉપયોગ સાધનાનો ભાવ પ્રગટાવવામાં  
કરી લેવો રહે છે. તેમ કરવાથી તેમની તેમની રીતે તે વપરાતું  
અટકી જશે ને તેમ થતાં એમની શુદ્ધિ આપોઆપ થશે.

(‘જીવનસોપાન’, આ.પ, પૃ. ૧૪૩)

\*

\*

આ બધું થવાવા માટેની શક્તિ સંકલ્પબળમાં રહેલી છે.  
સંકલ્પબળની શક્તિ સર્વોપરી છે. જે તે કંઈ થયા કરતું હોય છે,  
તેની પાછળ સંકલ્પનાં બળ કરી રહેલું હોય છે.

(‘જીવનસોપાન’, આ.પ, પૃ. ૧૩૪-૩૫)

\*

\*

જે જે કંઈ બને કરે—મનમાં પણ—તે તે બધું શ્રીભગવાનને  
ચરણકમળે સમર્પ્યા કરીએ. એમ સમર્પ્યા કરવામાંથી એની સાથે  
હદ્યનો સંબંધ બંધાયે જાય છે.

(‘જીવનસોપાન’, આ.પ, પૃ. ૧૫૭)

\*

\*

જેની અહંતા ગળી ગયેલી છે, તેને મન કે પ્રાણ અપરા  
પ્રકૃતિમાં રગદોળાવી શકતાં નથી.

(‘જીવનસોપાન’, આ.પ, પૃ. ૧૬૧)

\*

\*

અહંકારને હજારો માથાં છે. એનાં માથાં કપાઈ જાય, છતાં  
નવાં નવાં જન્મતાં હોય છે. ('જીવનસોપાન', આ.પ, પૃ. ૧૬૧)

\* \* \*

'હે ભગવાન ! આ તને સોષ્યું' એમ ખાલી ખાલી બોલ્યે  
નહિ ચાલી શકે. એમાં સાચેસાચી, ખરેખરી દર્દભરી હૈયાની  
દાનત તે કાજેની ને તે પરત્વેની પૂરી પ્રકટેલી હોવી જોઈશે.

('જીવનસોપાન', આ.પ, પૃ. ૧૬૨)

\* \* \*

સાધકે એકાકી રહેવાનું છે, છતાં તે એકલોઅટૂલો નથી,  
નોધારો નથી,—જો તેણે શ્રદ્ધાના મૂળમાં ને શ્રદ્ધાના વિષયમાં  
પોતાનું હૃદય પરોવી દીધું હશે તો.

('જીવનસોપાન', આ.પ, પૃ. ૧૭૦-૧૭૧)

\* \* \*

સાધક જ્યારે એકાગ્રપણે, કેન્દ્રિતપણે, સમગ્રપણે શ્રીપ્રભુને  
અંતઃકરણથી સર્વ રીતે ને સર્વ ભાવે એકેએક કરણથી સંપૂર્ણ  
શરણાગતિ પામે છે, ત્યાર પછી શ્રીભગવાન એની સાધનાનો  
ભાર પોતાના હસ્તક લેતા હોય છે.

('જીવનસોપાન', આ.પ, પૃ. ૧૭૨)

\* \* \*

પ્રભુપ્રાપ્તિનો હેતુ કોઈ સ્થૂળ કે સૂક્ષ્મ લાભ મેળવવાનો ન  
હોવો ઘટે. પ્રભુને ખાતર જ પ્રભુને પ્રાપ્ત કરવાનો છે.

('જીવનસોપાન', આ.પ, પૃ. ૧૭૮)

\* \* \*

સાધકનું હૃદય ને સદ્ગુરુનું હૃદય એ બન્નોનો તદ્દન એકરાગ  
ને એકમેળ—એ આ સાધનામાર્ગમાં ફેદ્દની એક સૂક્ષ્મ ચાવી છે.

('જીવનસોપાન', આ.પ, પૃ. ૧૮૪)

\* \* \*

સાધકની જેટલા પ્રમાણમાં પોતાના જીવનવિકાસ પ્રતિની એકાગ્ર ને કેન્દ્રિત સક્રિય ચાહના સવિશેષ, તેટલા પ્રમાણમાં તેના સદ્ગુરુની ચાહના તેના પ્રતિ સવિશેષ.

\* \* \*

મનનાં દૃષ્ટિ, વૃત્તિ ને વલણ બહિર્મુખ થતાં એમને ટકોરવાં, સંકેલવાં ને સંકોરવાં. આ ગ્રંથે પ્રક્રિયા સાધકને કાજે ઘણી જરૂરની છે, પણ તે સચેતન જાગૃતિ પ્રગટ્યા વિના નહીં બની શકે. સદ્ગવસ્તુની કેવળ વાતોથી, ચર્ચાથી કે તેવા કશાથી કાર્ય નહિ સાધી શકાય; તેને માટે તો જોઈશે પ્રભર અને પ્રચંડ સાધનાભર્યો પુરુષાર્થ.

(‘જીવનસોપાન’, આ.પ, પૃ. ૨૧૬)

\* \* \*

જીવનને કચરાઈ જવાપણું જે બનેછે ને તેનું વિકૃત થવાપણું જે પ્રગટે છે, તે આપણા મનના નકારાત્મક વલણ વડે કરીને.

\* \* \*

કોઈનુંયે દિલ જીતવું તે સંપૂર્ણ નમ્રતા પ્રગટ્યા વિના બની શકતું નથી.

\* \* \*

સદ્ભાવ મેળવવા સદ્ભાવ પ્રગટાવવો પડે છે.

\* \* \*

પોતાના વર્તન વિષે કોઈ શું કહેશે ને માનશે એની દરકાર રાખ્યે સાધકને પાલવી ન શકે. ધર્મનું વર્તન કરવું એને તુલાની સાથે સરખાવેલું છે. એનો કાંઠો જોનાર આપણો પોતે, બીજાં નહિ.

\* \* \*

સાધન કરવા પાઇળની જ્ઞાનાત્મક તમન્ના ને વિકાસની

ભાવના જીવતીજાગતી હોવી જોઈશે. તો જ સાધનના ભાવનાપૂર્વકના અભ્યાસથી થતી પ્રક્રિયામાંથી પ્રાણચેતના પ્રગટી શકે છે.

\*

\*

કેટલાક જીવ તો એમ માનતા હોય છે કે સાધકમાં આવશ્યક હૃદયની સાચી દાનત અથવા જીવનવિકાસ પરતવેની ઉત્કટ જિજ્ઞાસા પણ ભગવાન જ કરી દેશે, કારણ કે જે તે કંઈ સધળું ભગવાન કરે છે; માટે આપણી સાધના પણ તે જ કરાવશે. આ સાવ, તદન અજ્ઞાન ભરેલી માન્યતા છે ને સાધનાપંથે અવરોધકર્તા છે.

\*

\*

જીવનઆદર્શને વિરોધી એવી સર્વ કોઈ પરિસ્થિતિને સાધક શક્તિમત્તા મેળવવાની સ્થિતિ સમજે છે, ત્યારે તે પ્રભુકૃપાબળને હૃદયથી નોતરીને વધારે સતેજ બને છે.

\*

\*

જીવનવિકાસના હેતુ કાજે બધાં મળેલાં સ્વજનોમાં શ્રદ્ધા કે વિશ્વાસ, પ્રેમભક્તિ અને જીવનવિકાસ કાજેની તમન્ના હૃદયમાં પ્રગટ્યા વિના સદ્ગુરુનું તેવાં બધાં મળેલાં સ્વજનનાં જીવનમાં ને તેમનાં મન, ભતી, ચિત્ત, પ્રાણ, અહમ્ આદિમાં પ્રવેશવાનું ને જીવનવિકાસ કાજે કામ કરવાનું અશક્ય બનતું હોય છે.

(‘જીવનસોપાન’, આ.ડ, પૃ. ૩૧૬-૩૭)

\*

\*

સદ્ગુરુને પારખવાની કે સમજવાની ખટપટમાં પડવા કરતાં એની સાથે હૃદયની પ્રેમભક્તિથી જેટલો રાગ કરી શકાય, તેટલો રાગ હૃદયથી કર્યા કરવામાં સાર છે.

(‘જીવનસોપાન’, આ.ડ, પૃ. ૩૧૭)

\*

\*

સાધનામાં ભાવ મુખ્ય ને મહત્વપણે ભાગ ભજવે છે.  
સાધનાનું હદ્ય જ ભાવ છે. ('જીવનપ્રવેશ', આ.૨, પૃ. ૧૨)  
\* \* \*

જગતની ને સંસારની નજરે ને રીતે જે તે બધું જોવાનું, જાણવાનું,  
અનુભવવાનું ને મૂલ્યાંકન કરવાનું આપણે મૂકી જ દેવું પડશે.  
('જીવનપ્રવેશ', આ.૨, પૃ. ૨૫)

જ્યાં જ્યાં જે જે ઉત્તમ, ત્યાં ત્યાં સાધકનું ભાવાત્મક આકર્ષણ  
થયાં જ કરવાનું ને તેમ થાય તે ઈષ્ટ છે.

\* \* \*

('જીવનપ્રવેશ', આ.૨, પૃ. ૨૬)

\* \* \*

ગુરુપૂર્ણિમાનો દિવસ સતત ભાવનાપૂર્વક સ્મરણમાં પસાર  
થાય તેમ ઊજવવાનો હોય. એમાં મૂર્તિપૂજાને સ્થાન નથી,  
ભાવનાને સ્થાન છે. જેવો ભાવ તેવી વૃત્તિ પ્રવર્તે.

('જીવનપ્રવેશ', આ.૨, પૃ. ૩૭)

\* \* \*

સાધકે એકલા સાધનને પકડી રહેવાથી કશું વળવાનું નથી.  
તેમાં હદ્યનો ભાવ પ્રગટવો ઘટે અને તે ભાવ પાછો કર્મના  
હાઈમાં જીવતો થવો જોઈએ. તેવું થાય તો સાધકના હદ્યનો  
વિકાસ આપમેળે થયા કરે.

\* \* \*

સાધકે સાધનાના ભાવમાં જ આગ્રહ રાખીને, બીજી બધી  
બાબતમાં પૂરતો યોગ્ય વિવેક રાખીને જ્ઞાનપૂર્વક નિરાગ્રહી રહ્યા  
કરવું ઘટે.

\* \* \*

સાધક જ્યારે જીવનને ભગવાનની ભાવનામાં પ્રવર્તિવવાની

શરૂઆત કરતો હોય છે, તે વેળા એકદમ કંઈ એનું સંપૂર્ણપણે જ્ઞાનભક્તિયુક્ત સમર્પણ થઈ શકવું શક્ય હોતું નથી; એ તો જેમ જેમ ભગવાનના પ્રેમભાવથી જીવન રંગાતું જ્યા તેમ તેમ કમશા: તે થયે જતું હોય છે.

\*

\*

સાધકે વૈરાગ્યની ભૂમિકા ઉપર અભ્યાસનો ચીલો પાડ્યા કરવાનો છે.

\*

\*

ખરો સાધક જેટલી જેટલી વાર ભૂલ કરે છે, તેટલી તેટલી વાર તે તેમાંથી ફરી વાર વધુ તેજસ્વી ને વધુ જાગૃત દશાનો થવાને, બેઠો થઈને ઉધત થવાને, ચેતનવંતો બને છે.

\*

\*

ગુરુ જ્યારે જુએ છે કે સાધકના જીવનમાં એનો કોઈ રીતનો કશો ઉપયોગ થતો નથી, તે વેળા એ એવાના જીવનમાં રહેતો હોવા છતાં નથી રહી શકતો એવું બની શકે.

\*

\*

સાધનાપથમાં આવતી કઠિનાઈઓ વેળા તેમાં તપની જીવંત ભાવના જો તે સમયે જ્ઞાનાત્મક ભાવે હદ્યમાં જગાડવાનું બની શકે તો તેવો શ્રમ, તેવી કઠિનાઈઓ પણ, એક પ્રકારના તપ તરીકે જીવનવિકાસયજ્ઞમાં ઉપયોગી નીવડી શકે છે.

\*

\*

સાધકનો નિશ્ચય માત્ર જીવનવિકાસની ભાવનામાં જ મક્કમપણે પ્રવર્ત્યા કરતો રહેવો ઘટે; બીજાં બધાં ક્ષેત્રોમાં તો તે સાવ માટીના લોંદા જેવો મુલાયમ એટલે સંપૂર્ણ નિરાગ્રહી પ્રવર્ત્યા કરશે.

\*

\*

નિરાગહ (થવાપણું) એટલે ઢીલાપોચાપણું નહિ.

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૨૫૮)

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૧૫૭)

\*

\*

પ્રકૃતિના સ્વભાવથી નિરાગહીપણું પ્રવર્તતું જણાય, તો તેવા નિરાગહીપણાથી તો જીવનવિકાસની ભાવના જીવતી કરાવવાને, પ્રગટાવવાને કશો જ લાભ થતો હોતો નથી. પ્રકૃતિના કે પરિસ્થિતિના પ્રેરાવ્યા નહિ, પરંતુ જ્ઞાનભાવે પ્રકૃતિને પલટાવવાના હેતુએ નિરાગહીપણું કેળવવાનું છે.

(‘જીવનમંથન’, આ.૪, પૃ. ૧૫૭)

\*

\*

નમ્રતા પણ દાખવવાની છે ને સદ્ગ્રાવના પણ રાખવાની છે; પરંતુ તેનો અર્થ એવો નથી કે પોતાના જીવનધ્યેયની ભાવનાને કચડી કચડીને તેમ થયા જાય. એમાં તો જીવનનું મૃત્યુ છે.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૧૫૭)

\*

\*

ગુરુના વચનનું પાલન કરવામાં આપણે ઘણો વિવેક જળવવાનો રહેછે. તેમના એવા વચનપાલનમાં તેનો જ્ઞાનપૂર્વકનો હેતુ તે અમલ કરતી વેળા પૂરેપૂરો જીવંત રહેવો ઘટે. તે સાથે તે પાલનના હાઈમાં આપણાં પ્રેમભક્તિ હૈયાના ઉમળકાભેર જીવતાં હોવાં જોઈએ. તે વચનના પાલનકાળે જો તેના વિષે શંકા ઉઠે, તો તેનું યથાર્થ પરિણામ નથી નીપજી શકતું. તેમના વચનપાલનમાં આપણું આંતરિક વલણ સમાધાનપૂર્વકનું હોય એટલું બસ નથી, પરંતુ તે વચન આપણા જીવનકલ્યાણ કાજેનું જ છે એવી હૃદયની નિષા પ્રગટેલી હોવી જોઈશે.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૧૮૨-૮૩)

\*

\*

સાધકના પ્રયત્નોમાં ઉત્સાહ તો ઘણો ઘણો જરૂરનો છે.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૧૮૫)

\*

\*

સાધનામાં બહુ ખેંચી પકડીએ ને બહુ ઢીલું મૂકીએ, તે બન્ને દશા અયોગ્ય છે. ‘બહુ ખેંચ પકડીએ’ એટલે પુરુષાર્થથી કરી તંગ ને તંગ રહ્યા કરીએ તે, ને ‘બહુ ઢીલું મૂકીએ’ એટલે પ્રમાદ, આણસ ને તામસમાં જ પડ્યા રહ્યીએ તેવી દશા. આપણે તો તે પણ નથી થવાનું ને આ પણ નથી થવાનું. આપણે તો તે જ્ઞાનભક્તિપૂર્વક માટીના લોંદા જેવા મુલાયમ બન્યાં કરવાનું છે.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૨૧૮)

\*

\*

શરૂશરુનો સાધક એકલી કૃપાના સાધનને વળગી શકે તેવો તે સાધારણતઃ હોઈ ન શકે તે વાત પણ હકીકતપણાની છે.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૨૨૮)

\*

\*

જે સાધન કરીએ કે કરતાં હોઈએ, તેમાં પણ તે તે વેળા હદ્યમાં સદ્ગુરુની ભાવનાની ચેતનાત્મક ધારણા જીવતી રખાયાં કરાય તો સાધનના અત્યાસમાં પ્રાણ વહેલા પ્રગટતા હોય છે.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૨૬૮)

\*

\*

કશુંયે યંત્રવત્ત નકારવાથી સાચો ઈન્કાર નહિ થઈ શકે; પરંતુ તે તે બધું ટાળવા કરવાની પાછળ પ્રત્યક્ષતે તે પણ જીવનના ધ્યેય પરત્વેના હેતુનું જીવતુંજાગતું જ્ઞાન, તેની સમજજ્ઞા ને તે કર્મના હાઈમાં તેવા પ્રકારની તે તે આચરતી પણ સમજજ્ઞાની ભાવના પ્રગટવાં ઘટે; તે પ્રકારની ભાવનામાંથી જીવનની વર્તનકળા પ્રગટવી ઘટે; ને તે રીતે તે બધું જો બહાર ફેંકતું જાય, તો યોગ્ય અર્થ સરે.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૩૩૨)

\*

\*

ઉત્કટ સાધક હારતો ભલે દેખાય, પણ એની ધ્યેય પરત્વેની શ્રદ્ધા તો આણનમ જ રહ્યા કરે છે; તેથી તો વારંવાર પડતાં, પછિયાતાં છતાં અનેક વાર પાછો તેવી દશામાં ઉન્નત મસ્તકે તે ઊભો થાય છે. (‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૩૩૬)

\*

\*

સાધનાની ઉત્તરોત્તર કક્ષાઓમાં ‘ગુણ’ નો પણ વિલય થયા કરે છે. આપણી જીવકોટિમાં સત્ત્વગુણ જેવો હોય છે, તેવો ને તેવો કંઈ તે ચેતનપણાની કક્ષામાં નથી રહેતો. એની ભૂમિકા હોવા છતાં તેનાં પ્રકાર અને કક્ષા તો તદ્દન જુદી જ રીતનાં હોય છે. સાધનાની પરિપક્વ ભાવનાથી પ્રગટેલો સત્ત્વગુણ જ્ઞાનના અનુભવપણમાં પ્રગટ્યો રહ્યા કરે છે. રજસ તેવી કક્ષામાં જીવનમાં શક્તિના સ્વરૂપમાં પ્રગટ્યો રહ્યા કરે છે, ને તમસ તે ગુણ કોઈ પરમ શાંતિમાં, કોઈ અવર્ણનીય શાંતિમાં, કોઈ પરમ વિમલ એવી સ્થિરતામાં પરિણામ પામતો જતો અનુભવાય છે.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૪૨૪)

\*

\*

સાધનાના માર્ગમાં જાગૃતિ એ તો મોટામાં મોટું સાધન ને લક્ષણ છે. જેવી ને જેટલી જાગૃતિ તેટલું ને તેવું કામ પાકવાનું. આધ્યાત્મિક માર્ગનું પણ ચોક્કસ વૈજ્ઞાનિક શાખ છે. એમાં કશું યદ્વાતદ્વાપણું નથી. (‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૪૧૮)

\*

\*

નામસ્મરણનો હેતુ જ્ઞાનપૂર્વક હૃદયમાં હૃદયથી જીવતો રહ્યા કરે તો જ તેનો અર્થ સરી શકે. બાકી ખાલી નામ લીધાં કર્યે ને ભજન, કીર્તન ગાયાં કર્યે ખાસ કશો દહાડો ન વળે. મનમાં મનથી તો આપણે સંસારમાં રમ્યા કરતા હોઈએ, ને સંસારના

વિચારોમાં રસ પ્રગટાવતા રહીએ, તો તે નહિ ચાલી શકે.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૪૨૨)

\*

\*

જીવનનું આમૂલાગ્ર પરિવર્તન સાધનાની ભૂમિકા ઊપર્જ્યા વિના થવું શક્ય નથી. કે કંઈ મેળવવાનું છે, તે સાધનાથી મેળવી શકાય છે. મેળવવા માટે પુરુષાર્થ અનિવાર્ય છે.

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૮૪-૮૫)

\*

\*

મનની સાથે ઝગડ્યા વિના સાધકનો કદી આરો નથી આવવાનો. સ્વભાવને પલટાવવાનો છે અને તેમ કર્યા વિના યમુનાની ગતિ ઊલટી થઈ શકવાની નથી.

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૮૫)

\*

\*

સાધકના જીવનમાં દૃઢ મક્કમતાની ધારણા સૂર્યના તાપની પેઠે પ્રગટી ગયેલી હોવી જોઈશે. મક્કમતા એટલે અડગપણું તથા ધારણા એટલે એની પાછળના જ્ઞાનની સમજ—અને તે પણ સતત, એકધારી કાર્યસાધકતાયુક્ત સમજ. આવું જીવન-સાધનાનું સ્વરૂપ થઈ જવું ધટે. એ તો જ્ઞાનભક્તિયુક્ત વર્તન કર્યા કરવાથી તેનામાં જીવનચેતન પ્રગટે છે.

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૮૬)

\*

\*

સાધનામય જીવનમાં પ્રવેશ થતાં સાત્ત્વિક ગુણો કેળવતા જતા, વિકસતા જતા જણાય, ત્યારે જાણવું કે સાધનાનું મુખ સાચી દિશામાં છે.

\*

\*

સાચો સ્વીકાર એનું નામ કે તે સ્વીકાર થયા બાદ તેમાંથી

પાછું પગલું ભરવાનું કદી ન બને.

(‘જીવનમંડાણ’, આ.૫, પૃ. ૮૨)

\*

\*

સાધકે સમયનું મૂલ્ય ને તેની ઉપયોગિતા સાચી રીતે  
પારખતાં શીખવાનું છે. એક પળ પણ નકામી ન ગાળી શકાય.  
આણસ, તામસ અને પ્રમાદને એણે ખંખેરી નાંખવાં જોઈએ.

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૧૬૪)

\*

\*

જે જે વૃત્તિ, વિચાર, લાગણી, પરસ્પરના વર્તનથી પ્રગટતી  
વૃત્તિ, કર્મ-પ્રસંગ ને વર્તનમાં જાગતાં વલણો, ને તેમાં તેમાં  
પોતાની પ્રગટતી જતી સ્થિતિ, તે બધાંનો હૃદયનો ખુલ્લો એકરાર  
પૂરેપૂરો થયા વિના સાધકથી ખુલ્લું થઈ શકાવાનું નથી.

\*

\*

‘સાધકને કંઈ કશાનું બંધન ન હોય’, આવી માન્યતા તે  
અજ્ઞાનભરી સમજણ છે. ગમે તેમ વર્તવાથી કદી પણ જીવનમાં  
વ્યવસ્થિતિ અને વિકાસ સંભવી શકતો નથી. જીવન પણ એક  
કળા છે અને તે ઉત્તમમાં ઉત્તમ કળા છે; ગમે તેમ પીંછી  
ચલાવવાથી કંઈ ચિત્રકળા પ્રગટતી નથી.

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૨૫૧)

\*

\*

સાધનામાં નિશ્ચિતતા, નિયમિતતા અને નિરંતરતા  
પ્રગટાવવી જોઈશે, હોવી જોઈશે.

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૨૫૧)

\*

\*

સાધનાથી ઉપજતી જતી સમજણને માત્ર વાગોળ્યા કરવાથી  
કશું નહિ બને. આંધળું અનુકરણ કર્યે પણ નહિ ચાલે; એમાંથી

દેખાતી કે અનુભવાતી પ્રતિભાથી અંજાઈ ગયે પણ કશું નહિ વળે; પરંતુ એમાંથી જે ચેતન જાગે તેને, નવા પ્રકારે સર્જન થવા હૃદ્યતા તત્ત્વને, સ્વીકારીને કામે લગાડવું પડશે; તો જ નવું નવું જીવનમાં મળ્યાં કરવાનું છે. સાધનામાંથી રસ્કણ દસ્તિ, શક્તિ ખીલતી જવી જોઈશે; જેથી પ્રત્યેક કર્મમાં એનો આગળપાછળનો હેતુ અને તેનું જ્ઞાન મળ્યા કરશે.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૨૮૪)

\* \* \*

સાધકની પ્રત્યેક ભૂમિકા નક્કર અનુભવની સમજણ અને પરિણામ ઉપર રચાયેલી હોવી ઘટે. અનુભવને માત્ર કલપનાના બળે બેણેબેણે ખેંચી લાવવાનું ન થઈ જાય તેની તકેદારી રાખવી જોઈશે.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૩૪૨)

\* \* \*

સાધનાના ભાવ પ્રમાણેનો વિચાર, તે પ્રમાણેની તેની વાણી અને તે પ્રમાણેનું તેનું વર્તન, એ ત્રણેમાં સાધકે સમજી સમજીને સુભેણ પ્રગટાવવાનો છે. (‘જીવનમંથન’, આ.ર, પૃ. ૩૪૩)

\* \* \*

એવું થતાં પોતે દઢ સ્થિતિવાળો સાધક થયો છે એમ માનવાનું છે. પછી તો આકાશવૃત્તિ ઉત્પન્ન થયેલા એવા સાધકના હૃદયમાં રાગદ્વૈષવાળા વિચારો માઠાં ફળ નીપજાવે છે. ઉપલા દોષવાળાં આંદોલનો ચિદાકાશમાં મળી, પોતાનાં સ્વજાતીય દોષવાળાં આંદોલનોને આકર્ષણે તે વિચારનાં આંદોલનોનું ફળ સમાચિત્તમાં ઉત્પન્ન કરાવે છે. આમ તે જગતમાં શાંતિને બદલે અશાંતિ જન્માવવાનું કારણ બની જાય છે.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૩૪૩)

\* \* \*

કામ કરતાં કરતાં વચ્ચે વચ્ચે પાંચ દસ મિનિટ કામ બાજુ

પર મૂકીને પણ અંતરમાં એકભાવથી દુબકી મારી લેવાનો જીવતોજાગતો અભ્યાસ કેળવવા જેવો છે.

\* \* \*

સદ્ગુરુના જીવનના જે જે પ્રસંગો એવા બન્યા હોય કે જેથી કરી જીવનમાં પ્રેમ, શ્રદ્ધા, ભક્તિ પ્રગટે ને વધે, તેવા પ્રસંગોને વારંવાર હદ્યમાં પ્રગટાવી પ્રગટાવીને, સદ્ગુરુની હદ્યમાં પ્રાણપ્રતિષ્ઠા કરીને, તેમનામાં આપણાં મન, હદ્ય વગેરેને પરોવવાને જો આપણે દિલથી મથ્યાં કરીશું તો પણ ભાવનું પરિશીલન થતું અનુભવી શકીશું. કોઈ પણ રીતે હદ્યમાં ભાવનો લગાતાર સંગ રહ્યા કરે એ જરૂરી છે.

('જીવનસંશોધન', આ.૧, પૃ. ૮૫)

\* \* \*

કર્મનું મૂલ્યાંકન કર્મના સ્થૂળ પરિણામની નજરે નહિ, પરંતુ તેમાં રહેલા અને પરિણામે તેમાંથી નીતરતા ભાવની નજરે મુખ્યપણે કરવાથી પણ એવો ગુણ વિકસે છે.

('જીવનમંથન', આ.૨, પૃ. ૮૫)

\* \* \*

કોઈ પણ જાતની જીવનવિકાસની સાધનાનો પાયો જ શ્રદ્ધાછે.

('જીવનસંશોધન', આ.૧, પૃ. ૮૫)

\* \* \*

શ્રદ્ધા પણ તે કે જે જીવનમાં પ્રાગટ્ય પામે અને જીવનના પ્રવાહને તેના ભાવના પ્રવાહમાં વહન કરાવે. સદ્ગુરુ પરત્વે એક જાતનો માનસિક અહોભાવ પ્રગટવો તે તો બહુ પ્રાથમિક પ્રકારની શ્રદ્ધા ગણાય. તેથી જાણું કશું નથી નીપજતું એવા અનુભવ થાય છે, જોકે છેક નકામું તો આવું કશું હોતું નથી.

('જીવનમંથન', આ.૨, પૃ. ૮૨)

\* \* \*

સાધનામાં આગળ જતાં એક એવો તબક્કો પ્રગટે છે કે જ્યારે સાધના એક નિર્બધ રીતે સર્વાન્તર્યામી અને સર્વજ્ઞ આપણને દોરે તે રીતે દોરાવાની જ્ઞાનભક્તિપૂર્વકની, જીવંત, ચેતનાત્મક, મુલાયમતાવાળી આંતરિક પ્રક્રિયા.

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૧૦૧)

\* \* \*

બ્રહ્મચર્યપાલન કરવાની આવશ્યકતા આ માર્ગ માટે કેટલી બધી જરૂરની છે અનું મહત્ત્વ ને જ્ઞાન હોવું જોઈશે, એટલું જ નહિ પરંતુ સાથે સાથે સાધકનો પ્રાણ, સૂક્ષ્મપણો કે સૂક્ષ્મ રીતે પણ, જીતીય વિષયવાસનામાં રસ મુદ્દલે ન સેવે, ન લે ને જે જે કંઈ કામવાસનાને પોષક હોય, તેવી લાગણીઓને અને વૃત્તિઓને ઉશ્કેરે તેવું હોય, તે સકળમાંથી પોતાની જાતને સાધક પૂર્ણપણે પાછી ખેંચી લેશે ને તે બાબતની હંમેશાં ખૂબ ખૂબ જાગૃતિ ને ચોક્સાઈ રાખશે. (‘જીવનસંશોધન’, આ.૧, પૃ. ૧૨૩-૨૪)

\* \* \*

નભ્રતા એટલે કાયરપણું નહિ. નભ્રતા એટલે કંઈ કશામાંથી ભાગવાપણું પણ નહિ; નભ્રતા એટલે આચારવિચારના નિયમોનું શુષ્ણ પાલન અને દરેક પ્રકારનાં માન-આદર આપવાની નીતિરીતિ પણ નહિ. તેવું બધું નભ્રતાનું સ્વરૂપ નથી. નભ્રતા તો આત્માનો એક ગુણ ગણાય. તેમ છતાં સાધક જ્ઞાનપૂર્વક નભ્રતાના ગુણને જીવનમાં પ્રગટાવી શકે છે, ને તેણે તે પ્રગટાવવો જોઈએ પણ ખરો.

(‘જીવનસંશોધન’, આ.૨, પૃ. ૧૨૬)

\* \* \*

નભ્રતા પ્રગટાવવા કાજે નિરાગ્રહી, નિરાસક્ત બનવું ઘણું જરૂરી છે. (‘જીવનસંશોધન’, આ.૨, પૃ. ૧૩૦)

\* \* \*

કેવળ સમાજનાં રૂઢિબંધનો તોડી નાખવા ખાતર એટલે કે સમાજસુધારાના હેતુથી જ કશી કોઈ પ્રવૃત્તિ સાધકે ન કરવી ઘટે. આપમેળે તેવો પ્રસંગ માથે આવી પડે તો રૂઢિનાં બંધન તોડતાં અચકાવું પણ નહિ, કે ગભરાવું પણ નહિ.

(‘જીવનસંશોધન’, આ.ર, પૃ. ૧૬૨-૬૩)

\*

\*

સાધન તે સાધન છે, નહિ કે સાધ્ય. ધ્યેયની સિદ્ધિને માટે સાધન છે. સાધન જો ઘરેડરૂપ બની ગયું તો તે વર્થ છે. સાધનને ભાવનાથી પરિપૂર્ણપણે તેવા યોગ્ય વર્તનમાં પ્રગતાવ્યા વિના ધ્યેયને પામી શકતું નથી. (‘જીવનસંશોધન’, આ.ર, પૃ. ૧૮૮)

\*

\*

ધ્યાનમાં ત્રાણ કલાક કે ચાર કલાક બેસાયું કે અમુક સાધન આમ થયું કે તેમ થયું અથવા અમુક રીતે દઢ રહેવાયું કે મક્કમપણે વર્તાયું, વ્યવસ્થા જળવાઈ, નિયમબદ્ધ ચલાયું—આ બધું ખાસ મહત્વનું થી. પરંતુ એ બધાના પરિણામે રોજિંદા કર્મવ્યવહારમાં ભાવના જીવતીજીગતી કેટલી રહે છે, એકમાં જ રમમાણ કેટલી રહ્યા કરે છે, ભાવનામાં ઉત્કટતાની માત્રા કેટલી વધે છે, સદ્ગુરુમાં કેટલી પ્રીત વધે છે, તે બધું સાચું પ્રમાણ છે અને તે તરફ આપણું લક્ષ ને મહત્વ રહેવાં ઘટે છે. એનું નામ સાચું ધ્યાન છે. ભલેને આપણે ધ્યાનમાં ન બેસી શકતા હોઈએ, તોપણ ભાવના લક્ષ્યબિંદુ પરતે આપણી વૃત્તિ અવ્યભિચારિણી રહેતી હોય, તો પેલું ધ્યાન કરવાની જરૂર ન પડે. પરંતુ સાથે સાથે એટલું ધ્યાલમાં રાખવાની જરૂર છે કે ઉપર કહી તેવી સ્થિતિ આપણી થાય તેને માટે એકધારી આંતરિક તેમ જ બહિરૂ

સાધનયુક્ત, (ભાવપ્રેરક, ચેતનવંતી) સાધના કરવાની આપણા જેવા માટે ઘણી જરૂર છે.

(‘જીવનસંશોધન’, આ.૧, પૃ. ૨૦૯-૧૦)

\*

આપણા સ્વભાવના વિકૃત વળાંકો આપણાને ઘણા ઘણા ઉંખવા જોઈશે. તે આપણી નબળાઈ છે, દોષ છે અને આધ્યાત્મિક જીવનવિકાસની સાધનાને માટે તે ભારે અંતરાયરૂપ છે. આ બધું જ્યાં સુધી ઉંખશે નહિ, ત્યાં સુધી તેમાંથી મુક્તિ મળી શકશે નહિ. માત્ર નામસ્મરણ કર્યા કરીશું તો એની મેળે બધું રાગે પડી જશે એવી જે માન્યતા છે તે બરાબર નથી; જો કે નામસ્મરણ પણ પૂરેપૂરું સતત એકધારું કરી શકાવું સહેલું નથી અને સ્વભાવના પેલો વિકૃત વળાંકો તો એમ ને એમ કાયમ રહ્યા કરે છે.

(‘જીવનસંશોધન’, આ.૧, પૃ. ૨૪૮)

\*

સાધકમાં જો ભાવના પ્રકટેલી ન રહ્યાં કરતી હોય તો સદ્ગુરુના ભાવનો સ્વીકાર અને પ્રાકટ્ય સાધકમાં થતાં વાર લાગવાની, કારણ કે તો તો સદ્ગુરુના ભાવને પથ્થરનાં આવરણો કોરી કોરીને, ભેદીને ઉંહું ઉત્તરવાપણું રહેશે. કેટલીક વાર એ ભાવ ત્યાંનો ત્યાં સ્થિર પણ પડી રહે. એમ પણ બને કે એ ભાવ પોતાની અસરનો જોઈએ તેટલો ને તેવો ઉપયોગ કરાતો ન લાગતાં પાછો પણ વળી જાય.

(‘જીવનસંશોધન’, આ.૨, પૃ. ૨૮૧)

\*

સાધકના જીવનની ભૂમિકાનું જેમ પરિવ્રતન થતું જશે તેમ તેમ તેનો સત્યનો અનુભવ વધુ ઊંડો, વિસ્તૃત, ઉદાર, શુદ્ધ અને અંતરતમ થતો જવાનો.

\*

સાધક ભૂલો તો કરશે, પરંતુ જો એમાં પણ સાધનાની ભાવના એ સતત રાખ્યા કરતો હશે, તો એને એની ભૂલો સમજાઈ જવાની છે ને તેમાંથી પાછો વળી શકનાર છે.

(‘જીવનપાથેય’, આ.૩, પૃ. ૮૪)

\*

\*

આપણે વિચારેલું ને આપણું જ માનેલું બધાં માટે ઉપકારક છે, એવી માન્યતાના મૂળમાં સંકુચિતતાનું જેર રહેલું છે.

(‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૮)

\*

\*

સ્વધર્મના યર્થાથ પાલનમાંથી સાચી વિશાળતા જન્મે છે.

(‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૮)

\*

\*

આપણે આપણું જ જોવું ને આંતરવિકાસ પ્રતિ અભિમુખ રહ્યાં કરવું એમાં ડાપણ અને ચતુરાઈ છે. આનો અર્થ એમ નથી કે આમાં જેને આપણે સ્વાર્થી કે આપ-મતલબી કહીએ છીએ તેવા થવાની સલાહ આછે. (‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૮)

\*

\*

જે સહિષ્ણુ અને સર્વગ્રાહી છે, તે તો બધાંને વિનયપૂર્વક સમજવાનો પ્રયત્ન કરે છે ને પરિણામે એનું હૃદય ને બુદ્ધિ વિશાળ બને છે.

(‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૧૦)

\*

\*

વિશાળ દાણિ વિનાની સાધુતા નિરર્થક છે, એ સાધુતા જ નથી.

(‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૧૦)

\*

\*

સાચી શ્રદ્ધાની પારશીશી એ પોતાનો જ આંતરવિકાસ.

\*

\*

કોઈ પણ બાબત પર અતિશય વિચાર થાય ને તેમાંનું કંઈ પણ આચરણમાં ઉતરે તેવું ન હોય કે ન બને તો તે આખી વિચારસરણી જ ધાતક છે. ('જીવનપ્રેરણા', આ.૧, પૃ. ૧૩)

\*

ભાવનાનું પ્રાબળ્ય એટલું ભારે છે કે તેથી સંસ્કારો પોષાય છે ને જે સંસ્કારોને ભાવના પોષે છે, તેનાથી માનવીનું આખું જીવન ધડાતું જાય છે. ('જીવનપ્રેરણા', આ.૧, પૃ. ૧૪)

\*

કોઈ પણ વાતને અંતરના ખૂબ ઊંડાણમાં સ્થિર કરી મૂકવાનો એક સાચો માર્ગ તે ભાવનાનું સાતત્ય છે.

('જીવનપ્રેરણા', આ.૧, પૃ. ૧૫)

\*

જીવનમાં સાત્ત્વિક સંઘર્ષણ ઊભું થાય છે, ત્યારે હૃદયમંથન થાય છે; એવા મંથનમાંથી નવનીત તારવી લેવાની કળા જાણવી અનિવાર્ય છે, ને એ સાચી રીતે મથનારને આપોઆપ સૂર્જે છે.

('જીવનપ્રેરણા', આ.૧, પૃ. ૧૬)

\*

કર્મના સંસ્કાર ચિત્તમાં સતત પડ્યા કરતા હોય છે ને પડેલા રહ્યા કરે છે; તે ક્યારે ઊગી નીકળશે તે ચોક્કસપણે કહી શકાય નહિ. ('જીવનપ્રેરણા', આ.૧, પૃ. ૧૭)

\*

કોઈ પણ વૃત્તિ મનમાં ઊઠે છે, તો તે એનો ભાગ ભજવ્યા વિના રહી શકતી નથી. ('જીવનપ્રેરણા', આ.૧, પૃ. ૧૭)

\*

કોઈ પણ પ્રકારની મડાગાંઠ વાળીને બેસવું એટલે જીવનના વિકાસને રૂધવો. ('જીવનપ્રેરણા', આ.૧, પૃ. ૧૮)

\*

જીવનના એકેએક પ્રવર્તતા ક્ષેત્રની સર્વ પ્રકારે અને સર્વ ભાવે પૂરેપૂરી આંતરબાધ્ય શુદ્ધિ થયા વિના ખરેખરી અને પૂરી સાધના થવી કદાપિ પણ શક્ય નથી.

(‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૧૮)

\*

\*

બધો આધાર મનને રસ પડાવવા વિષે રહેલો છે. જેમાં મનને રસ છે, જે મનને ગમે છે, તેવું કામ કરવાને માનવી સર્વ કંઈ કરી ચૂકતો હોય છે. (‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૧૮)

\*

\*

આપણાથી તદ્દન વિરુદ્ધ વિચાર કે આચારવાળાઓ પ્રત્યે પણ સહિષ્ણુ રહીએ કે રહેવાનો સતત પ્રયત્ન કર્યા કરતા હોઈએ તો આપણી તટસ્થતા વધે. (‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૮)

\*

\*

સંતલોક જેને આપણે ગણીએ છીએ તે તો સૂક્કાં લાકડાં જેવા હોય છે. એને આપણા વિષે રસમય, ભીના રખાવવા તે કામ આપણું છે.

\*

\*

ભાવ એ વિચારનું અવ્યક્ત મૂળ અને વિચાર એ ભાવનું વ્યક્ત સ્વરૂપ છે. (‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૨૧)

\*

\*

કર્મને મહત્વ આપવા છતાં તેનાથીયે સવિશેષ મહત્વ સાધકે કર્મનાં આદિ, મધ્ય ને અંતમાં સતત એકધારો ગંગાના પ્રવાહના જેવો હૃદયનો ભાવ પ્રેરવવાનો અભ્યાસ જીવતાં કર્મો કરવામાં જ સણંગ, સમગ્ર લક્ષ્યી રાખ્યા કરવાનો છે.

(‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૨૧)

\*

\*

પ્રત્યેક કર્મમાં જેની શ્રદ્ધા અને ભાવ જ્ઞાનભક્તિપૂર્વક રહ્યાં કરતાં હશે, એને ક્યાંયે છેતરાવાપણું નથી. એવાનો રક્ષક એનો ભાવ જ બન્યા કરે છે. જે માનવી પોતાની ભાવના કેળવવાના એકમાત્ર કર્તવ્યમાં જ નિર્ભય અને નિર્ભર, મસ્તપણે રહ્યા કરે છે, તેનું તેના હૃદયની જીવતી થયેલી ભાવનાથી અતિરિક્તપણે કશું પણ અકલ્યાણ કરવાને કોઈ પણ શક્તિમાન થઈ શકતું નથી.

(‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૨૧-૨૨)

\*

જેવું શુદ્ધ પાણીમાં મેલું પાણી ભળતાં થાયછે, તેવું સદ્ગુરૂભાવના સાથે જે જે બધું પોતાનામાંનું નિર્ભયાં કરે છે, તેથી તેવું થાય છે ને પેલી સદ્ગુરૂભાવનાની અસર કે મહત્વ મોણાં પડતાં જાય છે.

(‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૨૨)

\*

શ્રીભગવાનની સ્મરણભાવના ને ધારણા સાથે પ્રત્યેક થતા જતા કર્મમાં જો જીવ તેવાં તેવાં સાધનોથી સતત એકધારું હૃદયથી મચ્યી રહેવાનું કરશે ને પોતાને ભળતી જતી સર્વ પ્રવૃત્તિ ને પરિસ્થિતિમાં એકમાત્ર હૃદયસ્થ ભાવને કેળવ્યા કરવાની, તેમ જ તે જીવતા આદર્શને ચેતનાસ્વરૂપે મૂર્તિમંત કર્યા કરવાની ધારણા તે સેવતો જશે તો તે જીવાત્મા તેવો થવાનો જ તે નિર્વિવાદ વાત છે.

(‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૨૪)

\*

સાધનાના માર્ગમાં જીવનું જે તે કંઈ બીજી તરફનું (નિર્ભય પ્રકારનું) ગુમાવવાપણું બનતાં જો અકળામણ, ભાર કે એવું લાગે તો સાધના માટે તે જીવની યોગ્ય તૈયારી થયેલી નથી તેમ જાણવું.

(‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૨૪)

\*

સંસ્કારગત પરંપરાયુક્ત માન, આદર દેવાની પ્રણાલિકામાં જ્યારે જીવનું જીગનું જ્ઞાનપૂર્વકનું ચેતન નથી હોતું, ત્યારે તેવી માન આદર દેવાની સ્થળ, જડ પ્રણાલિકા દેનાર અને લેનાર બન્નેને ગેરલાભ પહોંચાડનાર નીવડે છે.

(‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૨૬)

\*

\*

પોતાનાથી ચઢિયાતી કક્ષાના જીવ પરત્વે હૃદયથી જે માન, આદર દેવાનાં છે, તે પોતાનામાં જીવનવિકાસની તેવી ભાવનાનો ઉદ્ય થવાને કાજે છે, તેવી ભાવના સેવીને દેવાનાં છે.

(‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૨૭)

\*

\*

જગતમાં પૈસો તો ઘણા પાસે હોય છે; એની દુર્ગધ વિશેષપણો છે, પણ એની ફોરમ તો કોઈક ભાગ્યશાળીનામાં પ્રગટેલી અનુભવાય છે. (‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૨૮)

\*

\*

જીવનમાં સંગ્રામ સર્વ સ્થળે ને સર્વ ભૂમિકા પર રહેલો જ છે. જે જીવ એવા સંગ્રામનો જ્ઞાનપૂર્વક સહર્ષ સ્વીકાર કરે છે, તેવો જીવ જીવનનો યોગ્ય વિકાસ કરી શકે છે.

(‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૩૦)

\*

\*

જીવનના ધર્મથી અતિરિક્તપણે-અલગપણે કશી સાધના ન હોઈ શકે. (‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૩૦)

\*

\*

સંસાર એ તો જીવનની પ્રત્યક્ષ પાઠશાળા છે.

(‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૩૪)

\*

\*

સંસાર એ તો માનવીના અંતરમાં સુભેળ પેદા કરવા, અનેકમાં પ્રસરાયેલો હોવાઇતાં એકરૂપે જીવવા, વર્તવા ને રહેવાના બોધપાઠરૂપે તથા બધાંનામાં પોતાને જ અનુભવવા મળેલો છે.

(‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૩૪-૩૫)

\*

\*

સંસાર મળેલો છે તે શક્તિનો વિકાસ કરવા ને શક્તિના જ્ઞાનના અનુભવ કાજે. (‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૩૬)

\*

\*

જીવનમાં આવી મળતા સંગ્રામનો હેતુ જીવને શક્તિની પિછાણ થવાનો તથા તેથી કરી શક્તિનો ઉદ્ઘગમ થવાનો ને જ્ઞાનનો અનુભવ થવા કાજેનો છે. સંગ્રામ એ તો પ્રકૃતિના સ્વભાવનું એક સહજ લક્ષણ છે.

(‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૩૭)

\*

\*

સંસારમાં જે જે કંઈ આપણને આવી મળે છે, બને છે, તેની ભૂમિકા તો આપણામાં જ રહેલી છે. બીજાનામાંની ભૂમિકાને પરિણામે તે નથી. બીજાં તો માત્ર ખાલી નિમિત્તરૂપે છે. તેથી બીજાંથી એવું કંઈ થતાં મનને કલેશ, સંતાપ કે દુઃખ થવા ન દેતાં બીજાંને નિમિત્તકારણ સમજુને તેઓ વિષે મનને કદી પણ ડહોળાવા ન દેવું. (‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૩૭)

\*

\*

સંસારને મૂકી દેવાથી કાંઈ સંસારથી અલગ થઈ શકતું નથી. સંસારનો હેતુ તો જીવનના ફિલિતાર્થ છે. સંસારથી અલગ થયે સંસારી મન એના વિચાર કરતું અટકી જઈ શકતું નથી.

(‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૩૮)

\*

\*

સંસાર તો ભગવાનનો જ વ્યક્ત ભાવ છે; એટલે એમાં (સંસારમાં) મનના દણિકોણને બદલાવવાનું આપણે શક્ય બનાવવાનું છે. ('જીવનપ્રેરણા', આ. ૧, પૃ. ૩૮)

\* \* \*

જગેલી સદ્ગુર્ભાવના જો જીવનના સર્વ ક્ષેત્રોમાં પોતાનો વિસ્તાર કરી શકતી ન અનુભવી શકાય તો જાણવું કે વચ્ચે ક્યાંક વિક્ષેપ છે. એવા વિક્ષેપને દરેક જિજ્ઞાસુએ આત્મનિરીક્ષણ તથા પોતાનાં કરણોનું પૃથક્કરણ કરી કરીને, ખોળી કાઢીને દૂર કરવો જોઈશે. ('જીવનપ્રેરણા', આ. ૧, પૃ. ૪૨)

\* \* \*

હદ્યની જગેલી સદ્ગ્રાવના બીજાનું જેમ સારું જોવા કે એનામાં પ્રેમભાવ રખાવવા આપણને પ્રેરે છે, તેમ તેવી ભાવનાનો વિસ્તાર થતાં થતાં બધાંનામાં તે તેવી જ રીતે આપણને-મનને—પ્રવર્તાવશે. ('જીવનપ્રેરણા', આ.૧, પૃ. ૪૩)

\* \* \*

જે જે કંઈ છે તે તે તેના તેના યથાસ્થાને, યથાયોગ્યપણે છે અને તે તે જે બધું મળેલું છે, મળે છે ને મળ્યાં કરશે, તે તે બધું જ્ઞાનની અનુભૂતિ કાજે સાધન તરીકે મળેલું હોય છે.

(‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૪૪)

\* \* \*

વृत्ति એટલે ૪ ગતિ. ('જીવનપ્રેરણા', આ.૧, પૃ. ૪૭)

\* \* \*

વृत्ति थतां मनने ते तेमां प्रेराव्या विना रही शक्ती नथी.  
भावना जगाडवानो ने जगाडवामां पश्च प्रयत्न होय छे—होई  
शक्के दै. (‘ज्ञवनप्रेरणा’, आ.१, ५, ४६)

(‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૪૮)

\* \* \*

માનવી પોતે જ પોતાનો ઉદ્ધાર કરી શકે છે.

(‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૪૮)

\*

\*

જીવ વિકાસની દષ્ટિએ જોતાં બહેનોના જીવને પુરુષ જીવ કરતાં વધુ ઉંચી કક્ષાનો હું માનું છું.

(‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૫૦)

\*

\*

જ્ઞાનભક્તિ એટલે માત્ર નામસ્મરણ લીધાં કરવું તે નથી. ભજન કર્યા કરવું કે ભજનમાં મસ્ત થઈ જવું તે પણ બસ નથી.

(‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૫૧)

\*

\*

જ્યાં જ્યાં સદ્ગુણ કે એવી દૈવી સંપત્તિનાં અનુભવદર્શન થાય ત્યાં ત્યાં કદર-ભક્તિભાવે અને જ્ઞાનપૂર્વક પોતાનું માથું નમાવવાનું રહે છે. (‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૫૨)

\*

\*

સંતોને માત્ર જાણ્યાથી કે તેમની સાથે માત્ર રહેવાથી આપણું કશું દળદર ઝીઠી શકતું નથી. જ્યાં લગી આપણા જીવનનું અને મનના વલાણનું પૂરેપૂરું ‘ઉન્નયન’ થતું ન અનુભવી શકીએ, ત્યાં લગી કશામાં સંતોષ માનવો નહિ.

(‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૫૩)

\*

\*

ગુરુ કે સંતની કૃપા-મદદ ત્યારે જ મળે કે જ્યારે આપણામાં તેવાં દષ્ટિ, વૃત્તિ ને વલાણ જીવતાં થયેલાં હોય, ખરી રીતે તો આપણા પોતા વિના બીજો કોઈ ગુરુ નથી. ગુરુ તો સર્વત્ર અને સર્વમાં વ્યાપેલો છે. (‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૫૩)

\*

\*

પ્રત્યેક સંતાત્માની જીવનસરણી નોખી નોખી રહ્યાં કરે છે;  
પ્રત્યેકની એકબીજા સાથે સરખામણી કરવી એ જરાકે યોગ્ય નથી.

(‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૫૪)

\*

\*

જીવનના આધ્યાત્મિક માર્ગને અનુસરવું એ અતિ દોષલું  
છે. માણસો ધારે છે તેટલું તે સહેલું નથી. આ માર્ગમાં આપણે  
અનેક પ્રકારનાં અનેક સ્વજનોને હણવાનાં આવે છે.

(‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૫૫)

\*

\*

જીવનને સહેલગાહે ભોગવવા લઈ જતા હોઈએ એવો જ  
ખ્યાલ લોક જીત્રામાં રાખે છે. લોક માત્ર ફરવા જતા હોય છે.

(‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૫૬)

\*

\*

જીવનના ધ્યેય-આદર્શની ભાવના અને તેની ધારણા પ્રત્યેક  
થતા જતા કર્મમાં તે તે પળે જ જેટલી જેટલી જીવતી રાખ્યાં  
કરવાને આપણાથી મથવાનું બનશે, તેટલા પ્રમાણમાં આપણે  
જીવનના ધ્યેય-આદર્શને મૂર્તિમંત કરી શકવાના છીએ.

(‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૬૦)

\*

\*

કસોટી અને મંથન તે જીવનવિકાસને કાજે ઘણાં ઘણાં  
મહત્વનાં અંગો છે; તેના વિના જીવનનું સાચું હીર જાણી, પારખી  
કે પરખી શકતું નથી.

(‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૬૦)

\*

\*

વિસંવાદ દેખાય છે ખરો, પરંતુ સુમેળ કે સંવાદ એ જ  
સારાયે સંસારનો ને જગતનો પાયો છે.

(‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૬૧)

\*

\*

આપણું ક્ષેત્ર સંસાર છે, પરંતુ સંસારમાં સંસારની ભાવના  
રાખવાની નથી. (‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૬૨)

\*

\*

મનને એના મનગમતા વિષયમાં મહાલવાનું અટકાવવા  
આપણે એને જીવનધ્યેયના વિષયનું કોઈ બીજું કામ સાથે સાથે  
આપવું જોઈશે અને તે છે પ્રેમભક્તિપૂર્વકનું પ્રભુનું નામસ્મરણ.

(‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૬૫)

\*

\*

મનને સંકેલવાને-સંકોરવાને, એવું જીવતુંજાગતું આંતરિક  
બળ પ્રામ કરવાને માટે સાધના કરવાની જરૂર રહે છે.

(‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૬૫)

\*

\*

મનરૂપી ઊમરાને ઓળંગ્યા વિના જીવનના ચેતનના ઘરમાં  
આપણે દાખલ થઈ શકતા નથી.

(‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૬૬)

\*

\*

પ્રત્યેક માનવી કોઈ ને કોઈ પ્રકારના આનંદની આશા સેવીને  
જ દુઃખ વેઠતો હોય છે. જીવનમાં આનંદ ન હોય તો જીવન ટકી  
શકે નાણિ. (‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૬૭)

\*

\*

જગત એ આપણી નજરે જુદું જુદું લાગે છે, કારણ કે આપણે જ જુદા જુદા થબેલા અને જુદા જુદા રહેલા છીએ.

(‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૬૮)

\*

\*

સંસારને છોડ્યો છોડી શકતો નથી. સંસાર આપણાને વળગેલો નથી, કિંતુ આપણે સંસારને વળગેલા છીએ અને તેથી કરીને મનની સ્થિતિને જ માત્ર ત્યાં પલટાવવાની રહે છે. મન એની મેળે પલટી જઈ શકતું નથી. એટલા કાજે જ સાધનાની જરૂર છે.

(‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૭૦)

\*

\*

જગતમાં સમજુને જ વધારે સહેવાનું આવે છે ને વધારે સહેવું પડતું હોય છે. એ જ મારે મન તો તપશ્ચર્યા છે. સંસારમાં જે સહેવાનું આવે છે, તે જીવનની કેળવણી કાજે છે, જીવનના વિકાસ કાજે છે.

(‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૭૮)

\*

\*

પ્રભુમય જીવન એટલે પહેલાં તો સાત્ત્વિક જીવનનો વિકાસ.

(‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૮૦)

\*

\*

સંસાર એ બીજું કશું નથી પણ વૃત્તિ કે ભાવનાનો વિસ્તાર છે.

(‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૮૧)

\*

\*

સંસાર એ તો પ્રત્યક્ષ જીવનનો બોધપાઠ શીખવાની પાઠશાળા છે અને જીવનવિકાસ કાજેની પ્રયોગશાળા છે. એના જેવો બીજો કોઈ જીવતો ગુરુ નથી.

(‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૮૨)

\*

\*

અંતરમાં અંતમુખ રહી શકાવું એ સતત તેવા પ્રકારના  
એકધારા અભ્યાસ વિના કદી પણ શક્ય નથી થતું.

(‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૮૨)

\*

\*

કશાથી ક્યાંયે ભાગી છુટાય નહિ. તે તો નરી કાયરતા છે.

(‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૮૨)

\*

\*

સર્વ જે કંઈ બન્યાં કરે છે, તેનું મૂળ તો આપણા પોતાનામાં  
જ રહેલું છે. આપણા પોતાનામાં તેવી જાતની ભૂમિકા હોયા  
વિના તેવું કશું આપણને સ્પર્શી શકવાની તાકાત કે પ્રાણવાળું  
બની શકતું નથી. (‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૮૩)

\*

\*

જગતમાં પારકાંનું-બીજાંઓનું સહી લેવાય છે ને તેમનું  
ગળી પણ જવાય છે; તેવી રીતે પોતાનાં છોકરાંનું ને પોતાનાંઓનું  
તેવું સહેવાવું કે સમજણપૂર્વકનું ગળી જવાનું માબાપને કાજે ને  
વડીલોને કાજે તેટલું જ યોગ્યતાવાળું છે.

(‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૮૪)

\*

\*

માનવીના શરીરનું માહાત્મ્ય અને રહસ્ય સમજવા કાજે જ  
જન્મદિવસને આપણામાં મહત્વનું સ્થાન છે.

(‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૮૬)

\*

\*

અવ્યક્તમાંથી વ્યક્ત થવું તે જન્મ. એવા જન્મના પણ  
અનેક પ્રકાર હોય છે. (‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૮૮)

\*

\*

(કોઈ પવિત્ર સ્થળની) દિવ્યતા કહો, રમ્યતા કહો કે  
પ્રભુમયતા કહો, એ બધું મનને લીધેછે; મન ન ફરે, ન પલટાય,  
ત્યાં સુધી બીજે ક્યાંય કાયમી સુખ, ચેન, જંપ ના વળી શકે.

(‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૮૮)

\*

\*

સ્વર્ધમ્ય-આચરણ એ તો જીવનું શીવ થવાપણાના માર્ગનું  
પ્રથમ પગથિયું છે. (‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૮૦)

\*

\*

નામની પ્રતિષ્ઠા ભારેછે. નામી કરતાં પણ નામ ચઢી જાયછે.

(‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૮૧)

\*

\*

ઉચ્ચાત્માના પ્રેમભાવનું ભાજન આપણે હોઈએ તે  
કલ્યાણનું કારણ છે. (‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૮૧)

\*

\*

સાધક હંમેશાં પોતાનું જ જોવામાં ને પોતાને જ યોગ્ય રીતે  
મઠારવાને લક્ષ્યવાન રહેતો હોય છે. એને બીજાની ઝડી પડી  
હોતી નથી. તે જેટલો એકલો પોતાનામાં કેન્દ્રિતપણે એકાગ્રતાથી  
વર્ત્યો જશે, તેટલા પ્રમાણમાં તે સમાચિના મધ્યબિંદુને પણ સ્પર્શતો  
હોય છે. પોતાના જીવનની સર્વ પ્રકારે જે જીવ પૂરેપૂરી શુદ્ધિ કર્યા  
કરતો રહે છે, તે જ જીવ જગતની સાચી સેવા કરતો હોય છે.

(‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૮૩)

\*

\*

એ ઘેલણા અને ધૂન તો છે પણ એમાં આંધળાપણું ક્યાંય  
નથી. ઝંપલાવવા કાજે કે યાહોમ થવા કાજે ઊલટાં એ તો  
જડુરનાં અંગ પણ છે. (‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૮૪)

\*

\*

નમ્રમાં નમ્ર અને ધૂળથી પણ ધૂળ છીએ એવો નિશ્ચય  
પ્રગટ્યા વિના અને તેવા આપણે બન્યા વિના કશું આપણે કરી  
શકવાના નથી. (‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૮૮)

\*

\*

જે જે કંઈ થયાં કરે તે આપણાં મન-હૃદયના જીવતા ભાન સાથે પ્રભુને સમર્પણ કર્યા કરો.

(‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૧૦૨)

\*

\*

કોઈને જીવ-સ્વભાવે કરીને અન્યથાપણે મનમાં લવાઈ જવાતાં, ‘અરેરે ! આ તો આપણા વહાલા ભગવાનનો દ્રોહ થઈ રહેલો છે’, એમ થાય અને તેથી કરી પારાવાર પસ્તાવો ને દુઃખ થાય, તો જાણવું કે આપણે શ્રીભગવાનનાં ચરણકમળમાં શરણભાવ કેળવવાને સમર્થ થઈ શકવાના છીએ.

(‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૧૦૩)

\*

\*

जीवनी शुद्ध सात्त्विक भूमिका थया विना श्रीभगवाननो  
कृपासंपर्क होवा छतां जीव ते कदापि पशु अनुभवी शक्नार  
नथी. ('श्रवनप्रेरणा', आ.१, प. १०३)

(‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૧૦૩)

\*

\*

ગુરુ કરીને જો જીવનનો વિકાસ સાધી ન શકાયો તો તેવા  
ગુરુ કરવા તે વ્યર્થ છે. ('જીવનપ્રેરણા', આ.૧, પૃ. ૧૦૫)

\*

\*

ગુરુ એ કંઈ સ્થળ નથી. “ગુરુહમ્” એ પણ એક બંધિયાર ખાનું છે. (‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૧૦૫-૧૦૬)

(‘જીવનપ્રેરણા’, આ. ૧, પ. ૧૦૫-૧૦૬)

\*

\*

ગુરુથી જો આપણાને લાભ ન મળે અને આપણે જો ગુરુથી  
લાભ મેળવવાની ઉત્કટ ખેવના હૃદયથી ભાવનાપૂર્વક જીવતી ન  
રાજ્યાં કરીએ તો “ગુરુ” એ પણ અંધારો કૂવો જ છે.

(‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૧૦૬)

\*

સાધકનો મૌનએકાંતનો કાળ એક મોંઘામૂલો અને  
સહેલાઈથી ન સાંપડી શકે એવો અમૂલ્ય કાળ છે.

(‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૧૧૨)

\*

જ્ઞાની અને અજ્ઞાની બન્ને ભોગવે તો છે; (ઉપભોગ પણ  
કરે છે) જ્ઞાની ઉપયોગની દાઢિએ ભોગવે છે ને તેવાં જ્ઞાન,  
ભાન સાથે ભોગવે છે અને અજ્ઞાની માત્ર ભોગવવાનું જ  
કર્યો કરે છે. જ્ઞાનીને ભોગવવું ઉપાધિરૂપ નથી, જ્યારે  
અજ્ઞાનીએ ભોગવેલું ઉપાધિરૂપ જ નીવડે છે.

(‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૧૧૭)

\*

માનવીને પોતાની આફિતને ટાણે, વિષમ સ્થિતિને સમયે,  
જે કોઈની હૃદયની સહાનુભૂતિ મળે છે, તેની અસર લાંબા વખત  
સુધી એના દિલમાં વાસો કરીને રહેતી હોય છે.

(‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૧૧૮)

\*

જે જીવનું ભગવાનના નામનું રટણ ભલેને ઘરેડની રીતે  
થાય અને એવા રટણની અખંડ ધારા સતત એકધારી-ગંગધારાવત્ત  
જો પ્રભુકૃપાથી બની શકી, તો એવી પ્રવૃત્તિમાં પણ ચેતન પ્રગટ્યા  
વિના રહી શકવાનું નથી.      (‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૧૨૦)

\*

ગુણનો પણ અતિરેક થતાં ગુણનું ગુણપણું મટી જતું હોય છે, તેમ ગુરુને તાવી જોવાની પણ મર્યાદા વટાવી જવાનું બનતાં તેમાંનો ગુણ અને ગુણની શક્તિ માર્યા જતાં હોય છે.

(‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૧૨૬)

\*

\*

ગુરુની ભાવના આપણામાં સર્વપણે, સર્વપર્ણભાવે ને સમર્પણભાવે ને તે પણ સંંગ, સમગ્ર તથા કેન્દ્રિતપણે જીવતીજાગતી આરાધનાં સર્વ કરણોમાં ન બની શકે, ત્યાં સુધી ગુરુ પણ લૂલોપાંગળો હોય છે.

(‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૧૨૬)

\*

\*

જે જે કોઈ મળે તેનામાંથી જો જીવ તેના સદ્ગુણની ભાવના જોવાનું કેળવ્યા કરે, તો જીવમાં સદ્ગુણભાવના જીવતી બનવાની શક્યતા ઉભી થઈ શકતી હોય છે. સર્વ કોઈ જીવના સદ્ગુણ જોવાની અને તેને પોતામાં ઉતારવાનું મન કરવાની કેળવણી તે પણ સાધનાનું અંગ જ છે. (‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૧૨૮)

\*

\*

આપણી ઉત્તમ રહેણીકરણીનું અનુસરણ કરીને બીજા જીવો પણ તેમ કરવા જરૂર પ્રેરાશે જ તેવું માનવામાં તર્કદોષ રહેલો છે.

(‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૧૩૧)

\*

\*

હૃદયમાં સદ્ગુણભાવના જીવતી થયે હૃદયને જ્યાં-ત્યાંથી બહારથી સદ્ગુણભાવના જ સાંપડવાની છે, એવું નિશ્ચિતપણે ન કહી શકાય. (‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૧૩૨)

\*

\*

માનવીને જેવા પ્રકારની ને જેટલી શ્રદ્ધા હોય છે, તેનાથી  
બીજી રીતે કશું કાંઈ બીજી રીતનું થઈ શકવાનું શક્ય બનતું હોતું  
નથી. આખરે તો પોતાની શ્રદ્ધાનું જ સાચું મૂલ્યાંકન રહેલું છે.

(‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૧૩૫)

\*

\*

અમુક જ સંપૂર્ણ યોગ્ય છે અને સર્વસમર્થ અને સર્વશ્રેષ્ઠ છે  
એવું આધ્યાત્મિક ક્ષેત્રના જીવનમાં હોઈ શકતું નથી.

(‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૧૪૧-૪૨)

\*

\*

જગતમાં અને જીવનમાં પ્રેમભાવે કરેલું હો કે કંઈક  
અન્યભાવે કરેલું હો-જેટલું કાંઈ જે રીતે કરેલું હો તે ભાવે ને તે  
રીતે તે જીવનમાં ઉગતું જ હોય છે.

(‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૧૪૩)

\*

\*

કોઈ પણ માર્ગ પરત્વેની જેટલી ઉત્કટમાં ઉત્કટ વ્યાકુળતા  
પ્રગટે, ત્યારે તે માર્ગ પરત્વેનો પ્રયત્ન પણ સહજ ને સરળ બની  
જતો હોય છે. એવા પ્રકારની સહજ વ્યાકુળતા પ્રાપ્ત થતાં, પછી  
પ્રયત્ન કરવા પડતા નથી. એ તો થયાં જ કરે છે.

(‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૧૪૩)

\*

\*

જ્યાં સુધી હૃદયની ઈંદ્રિય કેળવાઈ ગયેલી નથી, ત્યાં સુધી  
આધ્યાત્મિક જીવનની ચેતનાશક્તિના કંઈક પુરાવા ભલેને મળ્યા  
હોય તેમ છતાં બુદ્ધિ તે સ્વીકારી શકે તેમ હોતું નથી.

હૃદયની વાત હૃદય સ્વીકાર કરી શકે એવી સહૃદયતા  
કેળવાયા વિના ખાલી એકલી બુદ્ધિના કોરાપણાથી આધ્યાત્મિક  
જીવનનું ખરું હાઈ ને તેનું મહત્ત્વ કદી પામી શકતું નથી.

બુદ્ધિમાં શંકારૂપી વૃત્તિ કુદરતે મૂકેલી છે, તે એટલા માટે કે સત્યની શોધમાં પ્રવેશ કરાવવા આપણાને તે સતત મથાવ્યાં કરે.

(‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૧૪૫)

\*

\*

એકલું પ્રારબ્ધ પણ નથી ને એકલો પુરુષાર્થ પણ નથી; બન્ને એકબીજાને સંકળાઈને રહેલાં છે. તેમને એકબીજાથી અલગ પાડી શકાય તેમ નથી. (‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૧૪૮)

\*

\*

જગતમાં જેમ સુખ અને દુઃખ બંને છે, ને બંનેનો હેતુ ઘડતરનો છે, તેમ જગતમાં અશુભ, અન્યાય આદિ જે કંઈ છે તે પણ સહેતુક છે. (‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૧૪૮)

આ જગતમાં ને જગતની રચનામાં સહૃ કોઈ તેને તેને ઠેકાણો યોગ્ય છે ને તેની તેની યોગ્યતાના પ્રમાણમાં જ છે; કશું વધારે નથી કે કશું ઓછું પણ નથી. ને જે તે બધું ભગવાનના જ અંશરૂપે છે. (‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૧૪૮)

\*

\*

આ ભવમાં જે જીવ જે પ્રકારની મનોવૃત્તિ, ભાવના, વિચારણા, કલ્પના, માન્યતા ને ક્ષેત્રની જેવી જેવી પ્રવૃત્તિ કર્યા કરતો હોય છે, તે પ્રમાણો તે પોતાની સૂચિ પોતાને માટે જન્માવતો હોય છે. (‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૧૪૯)

\*

\*

રાગદ્વેષાદિ એવા જુદા જુદા દ્વંદ્વની ભૂમિકાથી રંગાયેલા અહૃમ્ભૂત્યાર્થી મનની ભૂમિકામાંથી થતું રહેતું કર્મ સત્યની ભૂમિકાવાળું કેવી રીતે હોઈ શકે એનો માનવી કદી પણ વિચાર કરતો હોતો નથી. (‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૧૫૨)

\*

\*

વृत्ति थतां ते गति करावे ज. वृत्तिनो अर्थ ज ते प्रमाणेनी  
गतिनुं उत्पन्न थवुं. ('જીવનપ્રેરણા', આ.૧, પૃ. ૧૫૩)  
\* \* \*

કર्मમां જ्यां સુધી અહમ् પ્રવર्तે છે, ત्यां સુધી જીવને કદી  
મુક્તિ નથી. ('જીવનપ્રેરણા', આ.૧, પૃ. ૧૫૪)  
\* \* \*

માનવી સાધારણપણે મળેલું કે કમાયેલું ધન યદ્વાતદ્વાપણે  
વેડઝી દેતો હોતો નથી; પરંતુ જીવને નૈસર્જિકપણે મળેલી  
કામવૃત્તિ આદિની મૂડી કે શક્તિ, એને તો તે બેફામપણે નશાના  
ઘેનથી ઘેરાઈને સ્વચ્છંદતાપૂર્વક ગમે તેમ ને ગમે તેટલી વેડઝચા  
કરે છે, ને તેમ કરવાથી તે તે વૃત્તિ આદિનું સ્વરૂપ વિકૃત થતું  
જશે, એવું ભાન પણ એને રહેતું નથી.

('જીવનપ્રેરણા', આ.૧, પૃ. ૧૫૫)  
\* \* \*

કાર્ય ગમે તે અને ગમે તેવું હોય; તે કરતી વેળા માનવીની  
ચિંત્વનભાવની ભૂમિકા જેવા પ્રકારની રહે છે, તેવા ભાવ પ્રમાણે  
કર્મનું પરિણામ નીપજતું રહે છે.

('જીવનપ્રેરણા', આ.૧, પૃ. ૧૫૮)  
\* \* \*

વ્યવહારમાં પુરુષાર્થ જેટલો નથી શોભતો તેટલો તે  
પરમાર્થમાં શોભે છે. ('જીવનપ્રેરણા', આ.૧, પૃ. ૧૬૦)  
\* \* \*

સંકાન્તિકાળ એ જૂના અને નવા કાળ વચ્ચેનો ભારેમાં  
ભારે મંથનકાળ છે. ('જીવનપ્રેરણા', આ.૪, પૃ. ૧૪૮)  
\* \* \*

ઉથલપાથલ થયા વિના નવસર્જનને યોગ્ય વ્યવસ્થા ઉભી

થઈ શકતી નથી.

(‘જીવનપ્રેરણા’, આ.૪, પૃ. ૧૪૮)

\*

\*

દુઃખમાં પણ સૂક્ષ્મપણે સુખ રહેલું છે.

(‘જીવનપ્રેરણા’, આ.૪, પૃ. ૧૪૯)

\*

\*

જ્ઞાનપૂર્વકની જાગેલી મહત્તમાનું સ્થાન ચિરંજવી છે; જ્યારે મહત્તમાથી અંજાઈ જવું એ તો જડ દશા પણ હોય. તેવી દશામાં વિકાસની ગતિ થવી શક્ય નથી.

(‘જીવનપ્રેરણા’, આ.૪, પૃ. ૧૫૨)

\*

\*

પ્રત્યેક મથતા જીવને પોતાના જીવનવિકાસને માપવા કાજેનો કોઈ એક પ્રકારનો ગજ તેના પોતાનામાં ઊગી જવો જોઈએ.

(‘જીવનસંદેશ’, આ.૨, પૃ. ૫૩)

\*

\*

લગાની વિના રસ ઉત્પન્ન થઈ શકતો નથી અને રસ વિના મન ઠરી શકતું નથી.

\*

\*

માનવીજીવનનો પ્રત્યેક બ્યવહાર વિશ્વાસના મૂળ પાયા પર જ નભતો જતો હોય છે.

\*

\*

જ્યાં વિશેષ ગરજ છે, ત્યાં જીવને જાગી શંકા થતી નથી.

\*

\*

પ્રત્યેક માનવીમાં પ્રભુ પાસે જવાની શક્તિ છે એટલું જ નહિ, પણ ભગવાન તો સદાય સાદ પાડતા જ હોય છે; આપણે માનવી જ એની પાસે જતાં નથી.

(‘જીવનપગરણ’, આ.૩, પૃ. ૧૫)

\*

\*

સાધનાપથે સર્વ રીતે અને સર્વ ભાવે તિભારી થયું પડશે.  
ત્યાં નર્ધું સુખ નથી, રાતદિન જહેમત ઉઠાવ્યા કરવાની રહે છે.

(‘જીવનપગરણ’, આ.૩, પૃ. ૨૮)

\*

\*

મનથી જેટલું અન્યથા આપણે ભટકવાનું રાખ્યું, તેટલું  
પારાવાર નુકસાન થવાનું છે. (‘જીવનપગરણ’, આ.૩, પૃ. ૨૮)

\*

\*

ચર્ચાથી મતાગ્રહ વધે છે ને અહ્મું પણ.

(‘જીવનપગરણ’, આ.૩, પૃ. ૩૭)

\*

\*

જ્યાં રસ છે ત્યાં એની સાથેની હારમાળા પણ હોવાની કે  
આવવાની જ. (‘જીવનપગરણ’, આ.૩, પૃ. ૪૦)

\*

\*

દાનવૃત્તિ કરુણાવૃત્તિમાંથી નીપજે છે. કરુણાવૃત્તિનો પણ  
આપણે આપણામાં ને આપણા માટે ઉપયોગ કરવાનો છે.

(‘જીવનપગરણ’, આ.૩, પૃ. ૪૮)

\*

\*

જે કંઈ સાધન કર્યા કરીએ એ સાધનાના મૂળમાં ભાવ-ના  
ઉંડાણને વધાર્યા કરવાનું છે. (‘જીવનપગરણ’, આ.૩, પૃ. ૭૩)

\*

\*

ચીવટાઈ-ચોકસાઈ હોય તે સારું છે, પરંતુ તેમાં ચીકણાઈ  
ન હોવી ધટે. (‘જીવનપગરણ’, આ.૩, પૃ. ૮૬)

\*

\*

કરકસર પણ સારી વાત છે, પરંતુ પાંચ, પચાસ, પાંચસો  
કે પાંચ હજાર ખર્ચ નાંખવા પડે તો મનમાં ખૂંચ કે ખેંચ ન  
જગવી જોઈએ. (‘જીવનપગરણ’, આ.૩, પૃ. ૮૬)

\*

\*

વ્યવસ્થા ઈચ્છનીય છે, પરંતુ ગોરબ્યવસ્થા થાય તોયે કદી  
આપણી વૃત્તિ ડહોળાઈ જવી ન ઘટે.

(‘જીવનપગરણ’, આ.૨, પૃ. ૭૭)

\*

\*

સ્વચ્છતા આવકારલાયક છે, પરંતુ સાથે સાથે એટલી જ  
ગંદકીવાળી જગામાં રહેવાનું આવે તોપણ ચિત્ત સ્થિર રહી શકે  
એવી તૈયારી હોવી જોઈએ. (‘જીવનપગરણ’, આ.૨, પૃ. ૭૭)

\*

\*

સર્વ પ્રકારના સંકોચો ને શરમને સાધકે દૂર દૂર ફગાવી  
દેવાં જોઈશો—તેના હેતુના જ્ઞાનભાન સાથે.

(‘જીવનપગરણ’, આ.૩, પૃ. ૧૦૦)

\*

\*

બીજાંના ગજે જે પોતાને માપવા ને મપાવા ઈચ્છે છે,  
એનામાં જાહેર હિંમત ને સાહસ કેળવાઈ શકાવાનાં જ નથી.

(‘જીવનપગરણ’, આ.૩, પૃ. ૧૦૧)

\*

\*

આપણે માની લીધેલી રીતભાતો-રિવાજો-ટેવો વગેરેને છોડી  
દેવાને માટે આપણે મનને, પ્રાણને, શરીરને આધાતો આપવા  
પડશે ને ટેવો વગેરેથી કેટલીક વાર ઊંધું પણ ચાલવાનું આવશે.  
આ બધાનો અર્થ પાછો એવો નથી કે આપણે સત્યને રસ્તે ન  
ચાલવું.

(‘જીવનપગરણ’, આ.૩, પૃ. ૧૦૩)

\*

\*

આપણાં કરણો જેટલાં પ્રમાણમાં વિશુદ્ધ થયાં હશે તેટલાં  
જ પ્રમાણમાં આપણું સત્ય પણ સત્ય હશે.

(‘જીવનપગરણ’, આ.૩, પૃ. ૧૦૩)

\*

\*

બુદ્ધિથી સૂઝેલા સત્યની શ્રદ્ધાએ અનુભવથી નક્કર  
 હકીકતનું સ્વરૂપ જ્યાં સુધી લીધું નથી, ત્યાં સુધી એ સત્ય પચ્યું  
 છે એમ ન ગણાય; આખરે તો શ્રદ્ધા જ્યારે વાસ્તવિક બને ત્યારે  
 કામ પાકવા માંડે.      ('જીવનપગરણ', આ.૩, પૃ. ૧૧૪-૧૫)

\*                             \*      

નમ્રતા એક વસ્તુ છે ને લાઘવ-ગ્રંથિ (inferiority complex) જુદી વસ્તુ છે.    ('જીવનપગરણ', આ.૩, પૃ. ૧૧૫)

\*                             \*      

શાસ્ત્રો વગેરે બધું આપણામાં જ છે, એ દરેક સંતપુરુષ  
 અને ભક્તજનના અનુભવનું નવનીત છે.

('જીવનપગરણ', આ.૩, પૃ. ૧૨૭)

\*                             \*      

સંતોએ અને ભક્તોએ ભગવાનની આગળ પોતાની જાતને  
 અત્યંત પાપી, નીચ, પામર વગેરે અનેક વિશેષણોથી નવાજી  
 છે. તે વખતે એમનું માપ દુનિયાદારીના લોકોના જીવન સાથેની  
 સરખામણીનું નથી હોતું. એમનું એ માપ તો એમની અને પ્રભુની  
 વચ્ચે જે અંતર પડેલું છે, તેનું છે; ને જે દર્દ આર્ડ્ર હૃદયથી પોકાર  
 ઉઠાવ્યા, પાડ્યા કરે છે એ એમને એવું બોલાવે છે.

('જીવનપગરણ', આ.૩, પૃ. ૧૨૮)

\*                             \*      

ગમે તે ક્ષેત્રમાં એકાગ્રપણે, ઉમંગથી, ખંતથી વળજ્યાં રહીને  
 અવિશ્રાંતપણે કામ આપણે કર્યું હશે તો એનાથી જે મનોવિકાસ  
 થાય છે, તે બીજાં ક્ષેત્રોમાં પણ ઉપયોગમાં આવે છે જ.

('જીવનપગરણ', આ.૩, પૃ. ૧૪૪)

\*                             \*

હૃદયમાં જો એક વાર શુદ્ધ પ્રેમ ઉદ્ભવી શક્યો, તો એ પ્રેમ એકીસાથે કેટલાંયને એટલા જ પ્રમાણમાં ઉંડા અંતરથી ચાહી શકે છે. એવા પ્રેમને કોઈ મર્યાદા નથી, જાત નથી. એ પ્રેમમાં કોઈનું નડતર ન હોઈ શકે, તેમ જ એ પ્રેમ કોઈને નડતરરૂપ પણ ન બની શકે.

(‘જીવનપગરણ’, આ.રૂ, પૃ. ૧૫૩)

\* \* \*

તીવ્રતાના વેગથી જો આપણી શક્તિ રૂંધાઈ જતી લાગે, તો એ તીવ્રતા સાચી તીવ્રતા નથી પણ વલવલાટ છે.

(‘જીવનપગરણ’, આ.રૂ, પૃ. ૧૭૩-૭૪)

\* \* \*

આપણે આપણી મરજી પ્રમાણે ઘડાવાનું નથી; ભગવાનની મરજી પ્રમાણે ઘડાવાનું છે. (‘જીવનપગરણ’, આ.રૂ, પૃ. ૧૮૫)

\* \* \*

અસંતોષ ભલે રહે, ભલે તલસાટ રહે, પણ કોઈ જાતની અકળામણ તો ન જ રહેવી જોઈએ.

(‘જીવનપગરણ’, આ.રૂ, પૃ. ૧૮૬)

\* \* \*

ભગવાનનો ભાવ આપણામાં ત્યારે જ ઊતરશે કે જ્યારે આપણે સર્વતોમુખી રહેવા છતાં પ્રાધાન્યતઃ એકાગ્રપણે કુન્દિતતાથી હૃદયમાં રહેવાનું રાખીશું.

(‘જીવનપગરણ’, આ.રૂ, પૃ. ૧૯૨)

\* \* \*

પ્રત્યેક પળના કાર્યની ગતિ આપણી અંદરની આધ્યાત્મિક

કે દૈવી ચેતનાને આપણાથી મદદ થતી રહે છે કે નહિ એ વિશે  
ખબરદારી રખાય એનું નામ જાગૃતિ.

(‘જીવનપગરણ’, આ.ડ, પૃ. ૨૦૮)

\*

\*

જગતમાં પ્રકૃતિની રમત પણ આપણે જ રમીએ છીએ  
અથવા એના મૂળમાં કે વચ્ચે આપણે છીએ; જેમ પૈડાંમાં વચ્ચે  
લોઢાની ધરી હોય છે ને એનાથી પૈડાં ચાલ્યાં કરે છે તેમ.

(‘જીવનપગરણ’, આ.ડ, પૃ. ૨૧૪-૧૫)

\*

\*

જેમ સેવાના ક્ષેત્રમાં પડતાં એમાંથી આપણને વેગ મળશે  
એમ કલ્પીએ છીએ, તેમ આપણા ઘરના ક્ષેત્રમાંથી પણ તેવું જ  
ચેતન સાંપડવું ઘટે છે; ને સાંપડી પણ શકે. જો બહારના સેવાના  
ક્ષેત્રમાંથી આપણને મદદ મળે તો ઘરમાંથી શા માટે નહિ? ઊલટું  
બહારની સેવામાં, ઘરનાંઓનાં કરતાં, સેવા લેનારની પ્રેમવૃત્તિ  
ઓછી હોય છે, એટલે ઘરના કરતાં ત્યાંથી તો મદદ ઓછી  
મળવા સંભવ રહે છે. (‘જીવનપગરણ’, આ.ડ, પૃ. ૨૪૦)

\*

\*

સાધના ઘરેડ થતાં નિષ્ઠાણ બની જાય છે. આજમાં ગઈ  
કાલ અને આવતી કાલ સમાયેલી છે. ને આવતી કાલ કેવી  
બનવાની છે એની ચાવી આજના વર્તમાન વિષે જીવવાની કળામાં  
રહેલી છે.

\*

\*

આપણાં કાર્યો આપણા સ્વભાવની ઉપરવટ રહીને કરવાનાં  
છે. સદ્ગ તેમ જ અસદ્ગ બન્નેમાં સ્વભાવના-પ્રકૃતિના પ્રેરાવ્યા  
આપણે ન વર્તીએ એવી આપણી ચેતના પ્રગટેલી હોવી ઘટે.

\*

\*

જેમ યોગ એટલે સ્વચ્છંદતા નથી તેમ યોગને કશાં બંધનો  
પણ હોઈ શકતાં નથી. યોગીને કશા વિધિનિષેધ નથી. યોગમાં  
સ્વચ્છંદતા કે વિલાસિતા શક્ય નથી.

(‘જીવનપગથી’, આ.૩, પૃ. ૪)

\*

\*

અપરિગ્રહનો એક ઉત્તમ અર્થ મનમાં કોઈ પણ વાતને,  
અભિપ્રાયને-મંતવ્યને જકડીને સંગ્રહી ન રાખવો એ પણ છે.

(‘જીવનપગથી’, આ.૩, પૃ. ૪)

\*

\*

વિચારો કર્યા કરવાની આદત સાધનામાં હરકતરૂપ છે.

(‘જીવનપગથી’, આ.૩, પૃ. ૫)

\*

\*

કરકસર એ સારી વસ્તુ છે, પરંતુ તે કરવાની વૃત્તિ શેમાંથી  
ઉદ્ભવે છે તે જોવું જોઈશે. તેવી વૃત્તિ કેટલીકવાર ધનસંપત્તિ  
ઉપર માલિકીની ને સંઘરો કરવાની વૃત્તિમાંથી પણ જન્મે છે.  
લાખો રૂપિયાનું ધર્માદા ટ્રસ્ટ કર્યું હોય, એવા માણસો પણ પૈસાને  
જકડીને પકડી રાખતા જોયા છે. વળી કરકસરનાં આપણાં ધોરણો  
સેળભેળવાળાં હોય છે. આથી પ્રથમ તો એનાથી ઉપર જવાનું  
એક વાર કરવાનું છે. (‘જીવનપગથી’, આ.૩, પૃ. ૫)

\*

\*

સાધકનો આધાર નૈતિક ભૂમિકાનો મટી જઈને યૌગિક  
ભૂમિકાનો જન્મેલો હોવો જોઈશે.

(‘જીવનપગથી’, આ.૩, પૃ. ૫-૬)

\*

\*

પ્રકૃતિનો સંદર્ભ ત્યાગ કરવો એ આપણી દુનિયાની  
ઉત્પત્તિનો હેતુ હોય અને જણાતું નથી. (‘જીવનપગથી’, આ.૩, પૃ. ૬)

\*

\*

આપણી મુક્તિ કંઈ જન્મ-મરણનો ફેરો ટાળવા માટે નથી. એ મુક્તિ એટલે પુરુષની પોતાની સાહજિક, સ્વતંત્ર, ચેતનાત્મક શક્તિ, પોતાની પ્રકૃતિમાં સિદ્ધ કરવી તે.

(‘જીવનપગથી’, આ.૩, પૃ. ૯)

\*

\*

માનવી જેવા વિચારોનું સેવન કરતો હોય તેવા વિચારનાં આંદોલનો સ્વાભાવિક રીતે એની આજુબાજુના વાતાવરણમાં પ્રસરતાં જાય છે. (‘જીવનપગથી’, આ.૩, પૃ. ૧૧)

\*

\*

વખત આવ્યે જ સાધન કર્યા કરતા હોઈશું એને પણ છોડી દેવું પડશે. એટલે સાધન પણ એટલું વહાલું નથી, જેટલું ધ્યેય, સાધ્ય.

બહુશાખાપણામાંથી એકાત્મભાવમાં પરિણમવું જ પડશે.

(‘જીવનપગથી’, આ.૩, પૃ. ૧૪)

\*

\*

વિશેષ વ્યક્તિઓનું મૌન તેમની વાણી કરતાં પણ ઘણી વાર વધુ અસરકારક નીવડે છે. (‘જીવનપગથી’, આ.૩, પૃ. ૧૧)

\*

\*

જિજ્ઞાસાને પકવવા માટે મહેનત કરવી જ પડશે. એ મહેનતમાં જેટલા પ્રમાણમાં પ્રેમ-રસ રેલાશે તેટલા પ્રમાણમાં આપણામાં સ્વયંસ્કૃતિત ભાવ જાગવાનો છે.

(‘જીવનપગથી’, આ.૩, પૃ. ૨૨)

\*

\*

જન્મસિદ્ધો પણ પુરુષાર્થ કરે છે. મુક્તાવસ્થા પામતાં પહેલાં કે અવતાર સ્વરૂપે પ્રગટ થતાં પહેલાં એમને પણ પ્રબળ વેગ કરવો પડેલો હોય છે. (‘જીવનપગથી’, આ.૩, પૃ. ૨૩-૨૪)

\*

\*

જિજ્ઞાસા થવી એ એક વાત છે ને તેમાંથી ભાવ જન્મવો એ  
બીજી વાત છે, ને તે ભાવ કર્મમાં અવતરતો થવો એ વળી જુદી  
હકીકત છે. (‘જીવનપગથી’, આ.૩, પૃ. ૨૩)

\* \* \*

ભૂલ થયા પછી એની ચિંતા કર્યા કરવી એ તો ‘ખાતરના  
ઉપર દિવેલ’ના જેવું છે. એ તો ઉલ્લટું અંધારામાં અથડાવા જેવું  
છે. (‘જીવનપગથી’, આ.૩, પૃ. ૨૪)

\* \* \*

સાધનામાં પણ દૂબી જવાનું ન હોય. મહાપુરુષોનાં  
જીવનચરિત્રો બાગમાં ખીલેલાં ગુલાબનાં ફૂલો જેવાં છે.

(‘જીવનપગથી’, આ.૩, પૃ. ૨૬)

\* \* \*

જ્યાં મંથન થાય છે ત્યાં કાળજૂટ વિષ પણ ઉપર આવવાનો  
સંભવ રહે છે; પરંતુ એને પી જવા જેટલાં હિંમત ને સાહસ  
આપણે કેળવવાનાં છે. (‘જીવનપગથી’, આ.૩, પૃ. ૨૮)

\* \* \*

આપણે પોતે આપણી જીતને જ આપણું પૂરું મનાવી શકતા  
નથી, તો બીજું કોઈ આપણું માને એવો અમ રાખવો એ બેહૃદું છે !

(‘જીવનપગથી’, આ.૩, પૃ. ૨૮)

\* \* \*

આપણે જો વર્ષાંત્રતુ બેસતાં પહેલાં સાફસૂજી કરીને, ખેડીને,  
જમીન પોચી કરીને, ખાતર વગેરે નાંખીને તૈયાર રાખીશું તો  
ઈશ્વરકૃપાથી વરસાદ પડતાં એમાંથી બીજના (આપણામાં બીજ  
તો વવાયેલું જ છે) ફણગા ફૂટી નીકળશે. માટે આપણું કામ તો  
ખેતરને ખેડીને, વાડો વગેરે મજબૂત કરીને, ખાતર નાખીને  
તૈયાર કરવાનું છે ને પછી વરસાદની રાહ જોયાં કરવાની છે.

(‘જીવનપગથી’, આ.૩, પૃ. ૩૧)

\* \* \*

આપણે જેમ વધુ એકાગ્ર થઈએ છીએ તેમ સામેના બળનું  
જોશ પણ વધે છે, માટે આપણે એનાં સક્ંજામાં ન સપડાઈ જઈએ  
તે બાબતમાં વધુ સાવધાન રહેવાનું છે.

(‘જીવનપગથી’, આ.૩, પૃ. ૩૨)

\*

આપણા વિચારોની અસર તથા આપણી વાસનાઓની અસર  
પણ આપણામાં તો બધે ફેલાય જછે, તેમ બીજે પણ ફેલાય છે. આમ  
આપણાં વિચારો આપણને તેમ જ વિશ્વને ઘડતા હોય છે.

(‘જીવનપગથી’, આ.૩, પૃ. ૩૫)

\*

સંકલ્પશુદ્ધિ એ પણ સાધનાનું એક મહત્વનું અંગ છે. તે  
માત્ર વિચાર અટકાવ્યાથી શક્ય નથી. જ્યાં સુધી આપણામાં  
સંસ્કાર પડેલા છે, ત્યાં સુધી સંકલ્પશુદ્ધિ થવી શક્ય નથી.

(‘જીવનપગથી’, આ.૩, પૃ. ૩૫)

\*

સંસ્કાર પણ ત્યારે જ લય પામશે કે જ્યારે આપણે પ્રભુમાં  
એકરાગ-તલ્લીન થઈ ગયાં હોઈશું.

(‘જીવનપગથી’, આ.૩, પૃ. ૩૫)

\*

સૂરજ કરોડો માઈલ દૂર છે. છતાં એની ઉખા આપણને  
લાગે છે જ; તો જે તત્ત્વ એનાથી તો ક્યાંય જબરું છે ને એનાથી  
નજીક પણ છે એની ઉખા આપણને કાં ન લાગે?

(‘જીવનપગથી’, આ.૩, પૃ. ૩૮)

\*

આપણી થતી ભૂલોમાંથી આપણને આપણા સત્યનો રસ્તો  
સૂજવાનો છે—પણ જો તે થતી ભૂલોનું તીવ્ર સંવેદનપૂર્વકનું

યथાર્થ ભાન થતું હશે તો જ. ('જીવનપગથી', આ.૩, પૃ. ૩૮)  
\* \* \*

આપણે લાકડાં જેવાં શુષ્ણ થવાનું નથી.

('જીવનપગથી', આ.૩, પૃ. ૪૦)  
\* \* \*

આપણાં સર્જનથી જ આપણાને આગળ જતાં મદદ મળ્યાં  
કરે તેવી રીતે આપણે વ્યક્ત થતાં જવાનું છે.

('જીવનપગથી', આ.૩, પૃ. ૪૦)  
\* \* \*

લોગાની મોટી લાટને કાપવાની હોય છે, ત્યારે નાની કરવતી  
વડે કામ લે છે, ને તે ઉપરાંત એની ઉપર ટીપે ટીપે પાણી પડ્યાં  
કરે છે, તેમ આપણે મન સાથે વર્તવાનું છે.

('જીવનપગથી', આ.૩, પૃ. ૪૧)  
\* \* \*

મન નકામું નથી, બુદ્ધિ નકામી નથી; બન્ને આપણાં  
મિત્ર બની શકે છે. ('જીવનપગથી', આ.૩, પૃ. ૪૨)

\* \* \*

જ્યાં સુધી દુનિયાના વિષયોમાં કે બીજા ગમે તે કશામાં  
આપણું મન રહ્યાં કરશે, ત્યાં સુધી આપણા મૂળ કામમાં કદી  
તમન્ના જન્મવાની નથી. ('જીવનપગથી', આ.૩, પૃ. ૪૩)

\* \* \*

વાતાવરણમાંથી પણ કંઈ કંઈ ભાવનાઓનાં દર્શન થયાં  
કરતાં હોય છે ને શીખવાનું મળી શકે તેમ હોય છે, જો આપણામાં  
એવી જાતની જાગૃતિ કહો કે ચેતના ચૂસી લેવાની ભૂમિકા (જેમ  
શાહીચૂસ શાહી ચૂસી લે છે તેમ) કે તેવી કળા હોય તો.

('જીવનપગથી', આ.૩, પૃ. ૪૫)  
\* \* \*

જેમ લોહચુંબક તો એની હદમાં આવી જતાં બધાં લોગાને  
પોતાના સ્વભાવથી ખેંચતું જ રહેલું હોય છે, તેમ ભગવાન  
આપણાને ખેંચવા તૈયાર જ છે; પરંતુ એ આપણાને ખેંચે તેવી  
હદમાં આવી જવાનું આપણે શિરે રહે છે.

(‘જીવનપગથી’, આ.૩, પૃ. ૪૫)

\*

\*

અંતરમાં બીજને અંકુરિત કરવા માટે દિલમાં સતત પ્રેમરૂપી  
પાણીનું સિંચન કર્યો જ કરવું પડશે.

(‘જીવનપગથી’, આ.૩, પૃ. ૪૭)

\*

\*

સમુક્રના પેટાળમાં કે તળિયે જેમ મોતી જેવાં મૂલ્યવાન  
રત્નો છે, તેમ હૃદયમાંથે તેવાં રત્નો છે. જેટલા પ્રમાણમાં આપણી  
દાણ અંતરમુખી થશે એટલા પ્રમાણમાં બહારની દાણિમાં પણ  
ફરક પડવાનો જ છે. (‘જીવનપગથી’, આ.૩, પૃ. ૫૦, ૫૨)

\*

\*

આપણી કાન્તિ જેટલા પ્રમાણમાં આપણામાં થશે એટલા  
પ્રમાણમાં બહાર પણ થશે જ. (‘જીવનપગથી’, આ.૩, પૃ. ૫૨)

\*

\*

જીવનઆદર્શને સતત સામે રાખીશું તો આપણે કશાથી  
સંતોષાર્થ જઈશું નહિ, તેમ જ એ હેતુની ઉત્કટ જિજ્ઞાસા ને  
તમન્ના રહેશે, તો કશામાં લપટાર્થ પણ જઈશું નહિ.

(‘જીવનપગથી’, આ.૩, પૃ. ૫૪)

\*

\*

ગમે તેવું અસત્ય હોય કે કચરા જેવું હોય પણ એ દરેકમાંથી  
જો આપણનું મન સત્ત્વ જીલનારું થઈ શક્યું હશે તો ગમે ત્યાંથી

તેને જીવનવિકાસક ખોરાક મળી જ રહેશે.

(‘જીવનપગથી’, આ.૩, પૃ. ૫૪)

\*

\*

કોઈનાય કામમાં મદદ કરવી એમાં કશું ખોટું નથી, પણ આપણે કોઈના મૂક હથિયાર બનીને તે કરવાનું નથી.

(‘જીવનપગથી’, આ.૩, પૃ. ૫૮)

\*

\*

આપણે જે ઉપજાવીએ તે જો આપણામાં સમન્વય ન ઉપજાવી શકે તો તે બાધક છે. (‘જીવનપગથી’, આ.૩, પૃ. ૬૧)

\*

\*

આપણે જન્માવેલાં ભૂતો આપણાને જ ગુંગળાવે છે ને એમાં દુબાવી દે છે. (‘જીવનપગથી’, આ.૩, પૃ. ૬૧)

\*

\*

આપણી જાતને સતત આપણે ટોક્ક્યાં કરીશું તો આપણે દીવાની દિવેટની જેમ બધ્યાં કરીશું ને આપણા પર મોગરા નહિ બાજ્યા કરે. મોગરા બાજશે તો આપણું તેજ ઘટવાનું છે ને એક વખત એવો આવે કે જ્યારે આપણે પૂરા હોલવાઈ પણ જઈએ.

(‘જીવનપગથી’, આ.૩, પૃ. ૬૪)

\*

\*

જો આપવાથી કરીને આપણા દિલની ભાવના ન વધે, આપણું મન ઉદાત ન થાય, આપણી સંકુચિતતા દૂર ન હઠે તો તેવું આપવું વર્થ છે. ઉલદું તેવું આપવું તો રુંધનારું પણ નીવડે.

(‘જીવનપગથી’, આ.૩, પૃ. ૬૪)

\*

\*

નિઃસંગ એટલે માણસોથી અલગ એમ નહિ; પણ વૃત્તિ, વિચાર, લાગણી, સુખ, દુઃખ આદિ કોઈ પણ જાતની લાગણી

ને આંતરિક મનાદિકરણોની પ્રવૃત્તિથી અલિપ્ત.

(‘જીવનપગથી’, આ.૩, પૃ. ૬૭)

\*

\*

આપણો માર્ગ કે યોગ એ કંઈ માત્ર ચારપાંચ કલાકનો  
નથી પરંતુ હરેક પળ માટેનો છે. (‘જીવનપગથી’, આ.૩, પૃ. ૭૦)

\*

\*

આપણો આપણા ગમા-આણગમા, પસંદગી-નાપસંદગી,  
સારું-નરસું—આદિ વૃત્તિઓને બદલાવી દેવી પડશે.

(‘જીવનપગથી’, આ.૩, પૃ. ૭૦)

\*

\*

આપણને જેની સૂગ કે જેનો દ્રેષ હોય તેને પહેલું ભેટવું,  
ને તે પણ અંતઃકરણના ઉમળકાથી.

(‘જીવનપગથી’, આ.૩, પૃ. ૭૦)

\*

\*

આપણને કોઈએ એક વસ્તુ ભેટ આપી હોય, તો એને  
કેટલા આદરપૂર્વક સંભાળીને કબાટમાં સારે ઠેકાણો ગોઠવીને શોભે  
ને સારું દેખાય એવી રીતે આપણે રાખીએ છીએ ! તો પ્રભુએ  
આપણને આ જીવન ભેટ આપેલું છે એનું મૂલ્ય પેલી ભેટ જેટલુંયે  
શું આપણે નહિ આંકીએ ?

(‘જીવનપગથી’, આ.૩, પૃ. ૭૧)

\*

\*

જ્યાં લગી આપણામાં Standards(મંતવ્યો કે ધારાધોરણ  
પ્રમાણે જ મૂલ્યાંકન કરવાની ટેવ) છે, ત્યાં લગી આપણી દાઢિ  
અને વૃત્તિ તેટલા પ્રમાણમાં સંકુચિત રહેશે.

(‘જીવનપગથી’, આ.૩, પૃ. ૭૨)

\*

\*

જીવનનો નિયોડ અનુભવમાં છે, પણ ‘અનુભવ’ તો ત્યારે જ થાય કે જ્યારે એની પાછળ આપણો આપણા હેતુને પ્રત્યેક કાર્યમાં જીવતો જગતો રાખી શકતા હોઈએ.

(‘જીવનપગથી’, આ.૩, પૃ. ૭૪)

\*

આપણે ભગવાનમાં સતત યુક્ત રહેવાનો જીવલેણ પ્રયત્ન જ્ઞાનભક્તિભાવે કર્યા કરીશું ને એવો યજ્ઞ અવિરત અને દીર્ઘ કાળ સુધી સદ્ગ્ભાવથી ચાલતો રહેશે તો આપણામાં એવી આંતરિક ભાવના ખીલી ઊઠશે કે જેના પ્રતાપે સર્વ કંઈ થવું શક્ય છે.

(‘જીવનપગથી’, આ.૩, પૃ. ૭૫)

\*

જગતમાં જો કોઈ ભારેમાં ભારે મોટો ચમત્કાર હોય તો તે પ્રેમની શક્તિનો છે. (‘જીવનપગથી’, આ.૩, પૃ. ૭૬)

\*

આપણે જે રીતે વિચાર કરીએ છીએ, તે જ રીતે તે ફરીને પાછા આપણામાં પેસતા હોય છે; એટલે નકારાત્મક વિચારો જેટલા ઓછા થાય તેટલું વધુ સારું; ને આખરે તો તે સપૂચા બંધ થવા જોઈશે; નહિ તો પાછા એ વિચારો બેવડા જોરથી, બેવડી ગતિથી, આપણામાં પેસવાના છે ને જીવનને નુકસાન કરવાના છે. વિચાર માત્ર અટકે તો તો સર્વથી ઉત્તમ.

(‘જીવનપગથી’, આ.૩, પૃ. ૮૩)

\*

બહિરૂમાં એક દણ્ણિ રહી શકે તે માટે ભક્તિની જરૂર છે ને અંતરમાં એક થવાને માટે ધ્યાનની જરૂર છે.

(‘જીવનપગથી’, આ.૩, પૃ. ૮૪)

\*

મનમાં ને મનમાં ધૂંધવાયા કરતાં ભડકો થવું વધુ સારું.  
બની શકે ત્યાં સુધી તો ધૂંધવાવાનું જ ન થાય તે ઉત્તમ વાત છે.  
ધૂંધવાયાં કરવાથી જેટલું નુકસાન થાય છે, એના કરતાં ધણું  
ઓછું ભડકો થવાથી થાય છે. ('જીવનપગથી', આ.૩, પૃ. ૧૦૦)

\* \* \*

ભાવનાની કોઈ ઊર્મિ તેના સઘન અને તેજસ્વી સ્વરૂપમાં  
જમેલી થઈ ગઈ હોય, ત્યારે કહેલા બોલ ઝટ હૃદયમાં ઊતરી  
જાય છે. ('જીવનપગથી', આ.૩, પૃ. ૧૦૨)

\* \* \*

વડ મોટો થતાં તેમાંથી વડવાઈઓ ફૂટીને પાછી જમીનમાં  
મૂળરૂપે ચોટે છે, પાકી જડ ઘાલે છે, ને તેમાંથી બીજો વડ પાછો  
ઉત્પન્ન થાય છે; એમ એક વડના અનેક વડ થઈ જાય છે. તેવી  
રીતે આપણી આંતરિક ભાવના ખીલીને હકીકતના રૂપમાં ખૂબ  
સઘન બને છે, ત્યારે બધી દિશાઓમાં તેના ફણગાઓ ફેલાઈને  
કામ કરવા માંડે છે; એવી રીતે તે પણ મહાન કબીરવડ જેવી  
ફાલે છે ને ફૂલે છે. તે પછી એ કેવી શીતળ છાયા આપે છે!

('જીવનપગથી', આ.૩, પૃ. ૧૦૭-૦૮)

\* \* \*

કર્મના સંસ્કારોને લીધે જે જે કંઈ વિચાર ઉઠે, તે વિચારોના  
અંકોડા આપણે જોડવાના નથી. યોગની આ એક મોટી કિયા છે.  
જેટલે અંશે જાગૃત રહીને આપણે આ વિચારપરંપરાને લય  
પમાડવાની કિયા કરતા જ રહીશું, તેટલે અંશે ચિત્તનાં દુંદ ને  
ગુણના સંસ્કારોની અસર આપોઆપ વિલય થવાની છે.

('જીવનપગથી', આ.૩, પૃ. ૧૧૧)

\* \* \*

જગતની શેહથી આપણે મુક્ત થવાનું છે. બધાંનાં દેખતાં

કે બધાં વચ્ચે અમુક તો આપણાથી ન થાય એવી વૃત્તિ પણ કાઢી નાંખવાની છે. અલબત્ત એમાં કેટલેક અંશે સદ્-અસદ્ધનો વિવેક જળવવાનો રહેશે ખરો, પરંતુ તે તો ત્યારે આપણને આપોઆપ સૂજી જશે. (‘જીવનપગથી’, આ.૩, પૃ. ૧૧૫)

\* \* \*

બાહ્ય જગતમાં જ્યારે આપણને સુમેળ સધાતો લાગ્યા કરશે, ત્યારે આપણે સમજ જવું કે અંદર પણ સુમેળ સધાતો જાય છે.

(‘જીવનપગથી’, આ.૩, પૃ. ૧૧૫)

\* \* \*

સમાજના કોઈ પણ અંગને તુચ્છકારીને આપણે કદી આગળ વધી શકવાનાં નથી. (‘જીવનપગથી’, આ.૩, પૃ. ૧૧૮)

\* \* \*

આપણી દસ્તિ આત્મલક્ષી હોવાની સાથે સાથે સર્વલક્ષી પણ હોવી ઘટે છે. કદરમાં કદર વિરોધી પ્રત્યે પણ પ્રેમ, સહાનુભૂતિ ને કદરની લાગણી હોવી ઘટે; એનું દસ્તિબિંદુ પણ સમજવાને મથવું જોઈએ. (‘જીવનપગથી’, આ.૩, પૃ. ૧૧૮)

\* \* \*

જ્યારે આપોઆપ કશું થઈ રહ્યું હોય, ત્યારે કોઈ પણ જાતનું આપણું ડહાપણ તેમાં ડહોળવું ન ઘટે.

(‘જીવનપગથી’, આ.૩, પૃ. ૧૨૦)

\* \* \*

કોઈનો મત ફેરવવા માટે આપણું દસ્તિબિંદુ ઠસાવવા જતાં તે દૂર થવાને બદલે કેટલીકવાર વધારે દઢ થાય છે.

(‘જીવનપગથી’, આ.૩, પૃ. ૧૨૧)

\* \* \*

આપણો પ્રેમ ક્યાંયે આપણને એકબીજાને માટે રાગમાં કે

આસક્તિમાં ન પ્રેરાવે એવો હોવો જોઈશે.

(‘જીવનપગથી’, આ.ડ, પૃ. ૧૨૨)

\*

\*

આપણે જો ભગવાનના થવું હશે કે તેની પાસે જવું હશે તો  
અની શરતોએ જ તેમ થઈ શકશે.

(‘જીવનપગથી’, આ.ડ, પૃ. ૧૨૩)

\*

\*

જેમ જેમ આપણી સ્વીકારાત્મક, ગ્રહણાત્મક શક્તિ ને  
ભાવના વધે છે અને તે વિષયના ચિંત્વનમાં ઉંડા ઉત્તરતા જઈએ  
છીએ, તેમ તેમ, જેમ વધારે સૂક્ષ્મ રીતે કહેવામાં આવે છે તેમ,  
વધારે સૂક્ષ્મ રીતે આપણે તે સમજવાને તૈયાર થતા રહીએ છીએ.

(‘જીવનપગથી’, આ.ડ, પૃ. ૧૨૪-૨૫)

\*

\*

જ માનવીને પોતાને પોતાની ભૂલ જગાતી નથી, તેને  
તેની ભૂલ બીજાના કલ્યાથી કે બતાવ્યાથી ગળે ઉત્તરી શકવાની  
નથી. કદાચ સમજાશે તો તે એટલી મર્મવેધક નહિ હોય.  
એટલે આપણે પોતાની ભૂલ આપણી પોતાની મેળે જ શોધી  
લેવાને મથ્યાં કરવું જોઈએ. (‘જીવનપગથી’, આ.ડ, પૃ. ૧૨૬-૨૭)

\*

\*

આપણી જાત પ્રત્યે આપણે જેટલા વફાદાર રહીશું, તેટલા  
પ્રમાણમાં આપણે બીજાં પ્રત્યે પ્રામાણિક થઈ શકવાનાં છીએ.

(‘જીવનપગથી’, આ.ડ, પૃ. ૧૨૭)

\*

\*

પ્રેમ કાળને ને સ્થળને લંબાવી શકે છે તેમ ટૂંકાવી પણ શકે છે.

(‘જીવનપગથી’, આ.ડ, પૃ. ૧૨૮)

\*

\*

આધ્યાત્મિક જીવનમાં વ્યવહારુ અને આધ્યાત્મિક એમ બે  
અલગ અલગ ભાગ જીવનના પાડી શકતા નથી.

(‘જીવનપગથી’, આ.૩, પૃ. ૧૪૬)

\*

“વાડ વિના વેલો ચઢે નહિ” એવી કહેવત છે; પરંતુ  
વેલાએ જો ચઢવું હોય તો તેણે ઊગવું રહે છે. એને ચઢવાનો  
આધાર વાડરૂપે નિર્માણ થઈ ચૂકેલો જ છે.

(‘જીવનપગથી’, આ.૩, પૃ. ૧૫૫-૫૬)

\*

સમજણ કોઈના સમજાવ્યાથી મળવી અને અનુભવમાંથી  
ઊગવી, એ બે વચ્ચે ઘણો ફરક છે. પોતાની મેળે કે સમજાય,  
તે જ ઊંડું ઊતરે છે. (‘જીવનપગથી’, આ.૩, પૃ. ૧૫૮)

\*

જ્યાં સુધી અનુભવોનો યોગ્યપણો લાભ લેવાની શક્તિ,  
દાણિ ને તેવી અભિલાષા પ્રગટી નથી, ત્યાં સુધી તે અનુભવ  
ઉપર ઉપરથી ચાલ્યો જાય છે.

(‘જીવનપગથી’, આ.૩, પૃ. ૧૫૯)

\*

જે વસ્તુ કરવાની હોય તે તો ત્યારે તુરતોતુરત ને હંદયના  
સહજ ને સરળ ઉમળકાથી કરવી ઘટે.

(‘જીવનપગથી’, આ.૩, પૃ. ૧૬૦)

\*

ભગવાન અને માયા એ બન્નેને એકીસાથે ભજી શકાશે  
નહિ. ભગવાનનાં દર્શન થતાં આંતરિક કિયાઓમાં સહજપણે  
રૂપાંતર થયે જતું હોય છે. (‘જીવનપગથી’, આ.૩, પૃ. ૧૬૧)

\*

જે જે બાબતોમાં જે જે અનુભવો થાય, તે અનુભવ-જ્ઞાનની સમજણ કે નક્કરપણું આપણા જીવનમાં પૂરેપૂરું ના ઉતરે, ત્યાં સુધી અનુભવ પૂરેપૂરો થયો છે કે કેમ તે ચોક્કસપણે કહી શકાય નહિ.                                 ('જીવનપગથી', આ.ગી. પૃ. ૧૬૪)

\*

\*

ભગવાનનો ભાવ અત્યંત સૂક્ષ્મ હોવાથી આધાર વિના પકડી શકવો ઘણો દુર્લભ છે. એટલા માટે આપણા જીવનવિધાયક સાથેનો હૃદયનો જ્ઞાનભક્તિભર્યો જીવતો સંપર્ક એ સાધનાનું બહુ જરૂરી અંગ છે.                                 ('જીવનપગથી', આ.ગી. પૃ. ૧૬૬)

\*

\*

ખરા શ્રદ્ધાળુને ને જિજ્ઞાસુને જીવનમાં કશાયથીયે અને ક્યાંયે પણ ગેરલાભ થવાનો સંભવ નથી. એની શ્રદ્ધા અને એનો હૃદયનો જિજ્ઞાસુભાવ એને જ્યાં ત્યાંથી ઉગારી લેશે. એવાને કોઈ છેતરી શકનાર નથી.                                 ('જીવનપગથી', આ.ગી. પૃ. ૧૬૭)

\*

\*

આપણા જીવનના ધ્યેય વિષે આપણે આપણી જાતને વારંવાર સમજાવ્યા કરવાની રહે છે.

(‘જીવનપગથી’, આ.ગી. પૃ. ૧૬૮)

\*

\*

વિજ્ઞતીય પરિયયો (ભાઈઓએ બહેનો સાથેનો અને બહેનોએ ભાઈઓ સાથેનો) પોતાની ભાવનાની દણ્ણિનો વિકાસ થયે જાય એવી રીતે સાધનાની દણ્ણિએ કેળવવાનો છે. સાધકને તે સિવાય બીજી દણ્ણિ ને વૃત્તિ હોઈ શકે નહિ.

(‘જીવનપગથી’, આ.ગી. પૃ. ૧૭૨)

\*

\*

હરેક કાર્યમાં ને તે થતી વેળા ભગવાનની દણ્ણિ રહે અને

આપણી ભાવનાના વિકાસની દણ્ઠિએ તેને આપણી સમજણમાં  
ને વર્તનમાં ઉતારવું જોઈશે. ('જવનપગથી', આ.ડ, પૃ. ૧૭૩)  
\* \* \*

જવનનો સૂક્ષ્મની ભાવનામાં વિકાસ સાધવા માટે આપણે  
સ્થૂળ અનુભવોમાં સૂક્ષ્મ ભાવ સમજવાનો પ્રયત્ન કરવો પડશે.

('જવનપગથી', આ.ડ, પૃ. ૧૭૬)

\* \* \*

સ્વખનમાં વાસનાનો કંઈ એક પ્રકાર નથી. તેનું જોર જ્યારે  
પ્રબળ હોય છે, અને બાધ્યપણે બધી ઈંદ્રિયો જ્યારે નિશ્ચેષ અને  
નિર્જિય બનેલી હોય છે, ત્યારે તે ઈંદ્રિયોના મૂળમાં વાસના ઊડી  
ઉતરેછે અને બાધ્ય ઈંદ્રિયો નિશ્ચેષ અને નિર્જિય હોવાછતાં તેમની  
તેમની પ્રકૃતિના સ્વભાવ પ્રમાણે તેમનો અનુભવ ત્યાં ત્યાં તે લેછે.

('જવનપગથી', આ.ડ, પૃ. ૧૭૭)

\* \* \*

જે સ્થિતિમાં મુકાયા હોઈએ તે સ્થિતિમાં ને તેમાંથી જ આપણે  
આપણો વિકાસ સાધવાનો છે. ('જવનપગથી', આ.ડ, પૃ. ૧૭૭)

\* \* \*

સંસારનું કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે જ્યાં રહીને ભગવાનને  
ભજ ન શકાય. ('જવનપગથી', આ.ડ, પૃ. ૧૭૭)

\* \* \*

સાધનાના માર્ગમાં 'ત્યાગ' કે 'બલિદાન' કરવાપણું કશું  
નથી. એ તો થયે જતું અનુભવાય તો જ યોગ્ય. આપણે તો  
આપણું બધું સમર્પણ કર્યું કરવાનું છે.

('જવનપગથી', આ.ડ, પૃ. ૧૭૭)

\* \* \*

વિકસતી જતી અને વિકસેલી લાગણીઓ અને ભાવનાઓનાં

જ્યારે પૂર આવે ત્યારે તેમને વ્યક્ત ન કરી દેતાં નામસ્મરણ સાથે તેને ઉડી ને ઉડી દિલમાં ભાવનાપૂર્વક ઉતારવાનો પ્રયત્ન કરવો.

(‘જીવનપગથી’, આ.ડ, પૃ. ૧૭૮)

\*

\*

પતિ-પત્નીનો સંબંધ વાસનાઓનું ઊર્ધ્વકરણ કરવા માટે છે. એટલે કે તેને શુદ્ધ અને ઉંચા પ્રકારની કરવા માટે છે.

(‘જીવનપગથી’, આ.ડ, પૃ. ૧૮૦)

\*

\*

પ્રત્યેક સંબંધ આપણી આંતરિક ચેતનાને જીવતીજગતી રાખવાને કાજે છે;—પછી તે વ્યાવહારિક હોય, સાત્ત્વિક હોય કે આધ્યાત્મિક હોય;—એવો જ્ઞાનપૂર્વકનો પૂરેપૂરો ખ્યાલ દરેક સાધકે અંતરમાં રાખવો ઘટે છે. સંબંધ ને સંપર્ક જીવને જીવદશામાં પ્રેરે છે કે આત્મદશામાં પ્રેરે છે, એ એણે પ્રત્યેક પ્રસંગમાં વિચારવું જોઈશે. જ્યાં સુધી જગત ને વ્યવહારમાં છે, ત્યાં સુધી સંબંધ હોવાનો ને રહેવાનો.

(‘જીવનપગથી’, આ.ડ, પૃ. ૧૮૦)

\*

\*

ભાવનાત્મક ઉત્તેજના જાગે છે, ત્યારે તેમાં દૂબી જવાય તો તે પણ યોગ્ય નથી. (‘જીવનપગથી’, આ.ડ, પૃ. ૧૮૦-૧૮૧)

\*

\*

આપણે જ્યારે બીજાને વિષે અન્યથાપણે કંઈ વિચારીએ છીએ, ત્યારે આપણે પોતાનામાં એ વૃત્તિનાં બીજ વાવીએ છીએ.

(‘જીવનપગથી’, આ.ડ, પૃ. ૧૮૧)

\*

\*

વિચારો ન જન્મે તે ઉત્તમ છે; પરંતુ તામસ કે જડતાભરી પ્રકૃતિવાળાને વિચાર નહિ થાય, તો તે બરાબર નથી. જેનામાં

રજસ પ્રકૃતિ છે, તેનામાં તો વિચાર થવાના જ. સત્તવગુણપ્રધાન પ્રકૃતિવાળાને વિચારમાં સમતા પ્રગટેલી હશે.

(‘જીવનપગથી’, આ.ડ, પૃ. ૧૮૭)

\*

\*

આપણા વિચારો આપણને ઘડે છે એટલે અંતર્મુખી અને એક જ ભાવનાના એકલીનતાયુક્ત વિચારો રહે તે જરૂરનું છે. વિચારોની સાંકળ કદી ન જોડ્યા કરવી.

(‘જીવનપગથી’, આ.ડ, પૃ. ૧૮૭)

\*

\*

જેમ શબ્દનાં-અવાજનાં મોજાં વાતાવરણમાં ફેલાઈ જાય છે એ સિદ્ધ હકીકત છે, એમ વિચારનાં પણ મોજાં થાય છે ને તે વાતાવરણમાં ફેલાય છે. (‘જીવનપગથી’, આ.ડ, પૃ. ૧૮૮)

\*

\*

આપણો કોઈ જીવતો જાગતો ચોકીદાર હોય તો તે આપણી ઉર્ધ્વગામી થવાની જાગેલી તમન્ના છે.

(‘જીવનપગથી’, આ.ડ, પૃ. ૧૮૮)

\*

\*

મનના જીવદશાના વલણને જેમ જેમ વધુ વળગીશું, તેમ તેમ આપણું જીવપણું વધુ ઉત્કટ બનતું જવાનું.

\*

\*

હૃદયની આંખો એટલે તાટસ્થ અથવા વિવેકદિષ્ટિ.

(‘જીવનપગથી’, આ.ડ, પૃ. ૨૦૫)

\*

\*

કોઈ પણ પ્રકારના ઉર્ધ્વગામી પથિકને એના ઉત્સાહમાં, એના વલણમાં, એના જોમમાં, સાહસમાં, હિંમતમાં ને

હોમાવાની તમન્નામાં કોઈ પણ જાતનો દ્વિઘાભાવ થાય, એના દિલમાં ગડમથલ કે તેવું હલનચલન થાય એવું કશું આપણાથી ન થવું ઘટે. કોઈનોય દાખિબેદ કે મતિબ્રમ કરાવવામાં આપણાથી ન પડાય.      ('જીવનપગથી', આ.ર, પૃ. ૨૧૪)

\*

જે જે પરિસ્થિતિમાં આપોઆપ આપણે મુકાતા જઈએ તે તે પરિસ્થિતિનો ધર્મ બજાવતાં બજાવતાં અને તેવી રીતે તેને આપમેળે છોડતાં છોડતાં આપણે આપણો માર્ગ કાપવાનો છે.

('જીવનપગથી', આ.ર, પૃ. ૨૧૬)

\*

આધ્યાત્મિક માર્ગમાં—કે કોઈ પણ માર્ગમાં—કોઈની પાછળ તણાતા જવામાં આપણને જાળું બળ કે પ્રેરણા મળતાં નથી. જો આપણે સ્વતંત્રપણે એમાં ઝંપલાવું હોય છે તો એમાં આપણું પોતાનું બળ કાર્ય કરે છે.

('જીવનપગથી', આ.ર, પૃ. ૨૧૮)

\*

યુદ્ધ આખ્યાં કરવાથી આપણામાં જાગૃતિ રહ્યાં કરેછે. જ્યાં યુદ્ધ નથી હોતું, ત્યાં તૈયારી પણ કશી રહેતી નથી, ને જાગૃતિ પણ કશી હોતી નથી.

\*

હૃદયનો જન્મેલો આદરભાવ તો જીવનને પલટાવવાને ને જીવનની નવી ગતિ કરાવવાને ઘણો ઘણો જરૂરનો થઈ પડે છે.

('જીવનમંડાણ', આ.પ, પૃ. ૧૩)

\*

જે તે બધું થતું હોય તે કંઈ આપણાથી થતું હોતું નથી, પણ આપણામાં જે ચેતન રહેલું છે, તેને લીધે તે તે બધું થતું હોય છે.

('જીવનમંડાણ', આ.પ, પૃ. ૧૩)

\*

સાધના એટલે જીવસ્વભાવને પલટાવવાની કે ઉલટાવવાની શાનપૂર્વકની પ્રક્રિયા.

(‘જીવનમંડાણ’, આ.પ, પૃ. ૧૪)

\*

\*

જે વિવેક ન પ્રગટે તો તે સાધના નથી. વિવેકની ભૂમિકા તો તટસ્થતા, સમતા આદિ ભાવોની સાથે રહેલી છે.

(‘જીવનમંડાણ’, આ.પ, પૃ. ૧૭)

\*

\*

જે જીવ જગ્રત રહે છે, તે પડતો છતાં ઊભો થવાનો જ છે.

(‘જીવનમંડાણ’, આ.પ, પૃ. ૧૮)

\*

\*

ભગવાનનું નામ ભુલાતાં આપણને અસહ્ય વેદના પ્રગટવી ઘટે.

(‘જીવનમંડાણ’, આ.પ, પૃ. ૧૯)

\*

\*

શ્રીભગવાનનાં ચરણકમળમાં જ્ઞાનભક્તિપૂર્વકની સંપૂર્ણ શરણાગતિ આપણા એકએક કરણની થઈ ગયા બાદ પ્રકૃતિનું દિવ્ય રૂપાંતર થયાં કરતું હોય છે; તે વિના નહિ.

(‘જીવનમંડાણ’, આ.પ, પૃ. ૧૯)

\*

\*

માનવના હૃદયમાં જ્ઞાગલો સદ્ગ્રાવ જ બીજાનાંમાંનું જે ઉત્તમ તત્ત્વ છે, તેને પારખી લેતો હોય છે. મૂલ્ય કે મહત્ત્વ સદ્ગ્રાવનું જ રહેલું છે. (‘જીવનમંડાણ’, આ.પ, પૃ. ૨૨)

\*

\*

બધાંની સાથે જ્ઞાનભક્તિપૂર્વકનો હૃદયનો સુભેણ સાધતા રહેવામાં જીવનની યથાર્થતા છે.

(‘જીવનમંડાણ’, આ.પ, પૃ. ૨૨-૨૩)

\*

\*

જીવનને સર્વતોમુખી બનાવવાનું છે, નહિ કે ઝૂવામાંના  
દેડકા જેવું.    (‘જીવનમંડાણ’, આ.પ, પૃ. ૨૪)

\*

\*

સંસાર એ જીવનના પમરાટને બહેલાવવા કાજે મળેલી  
તપશ્ચર્યાની ભૂમિકા છે.    (‘જીવનમંડાણ’, આ.પ, પૃ. ૨૫)

\*

\*

જીવનનો રસ સંસારમાં નથી, પણ અંતરમાં છે. વ્યક્તિનું જ  
વિસ્તાર-સ્વરૂપ સંસાર છે.    (‘જીવનમંડાણ’, આ.પ, પૃ. ૨૫)

\*

\*

સંસારમાં બીજાંને તથા બીજાંનું કશું ન જોતાં જે જીવ માત્ર  
પોતાનું પ્રતિબિંબ તેમાં જોયાં કરીને, ત્યાં જે રીતે પોતાને મઠારવાનું  
ચૂઝે તેમ તે જો પોતાને રચનાત્મકપણે મઠારવાનું કર્યા કરે તો  
સંસાર જેવી પાઠશાળા કે ગુરુ બીજે ક્યાંય પણ નહિ મળી શકે.

(‘જીવનમંડાણ’, આ.પ, પૃ. ૨૪)

\*

\*

સંસારમાં સંસારની રીતે જીવવાથી તો જીવન ઉકરડો બનશે.

(‘જીવનમંડાણ’, આ.પ, પૃ. ૨૬)

\*

\*

દરેક વૃત્તિથી અલગ રહેવાનો ને હોવાનો જ્ઞાનપૂર્વકનો  
પ્રયત્ન રાખવો ધટે.

\*

\*

જીવનની ભાવનાને આકાર પમાડવા કાજે ભૂમિકાની પ્રથમ  
જરૂર રહે છે.    (‘જીવનમંડાણ’, આ.પ, પૃ. ૨૬)

\*

\*

જે કોઈ જીવ પોતાની લાચારીની વાત કરે છે, તેવો જીવ  
જીવનવિકાસના માર્ગ કદી આગળ ધ્યે શકવાનો નથી. જ્યાં

શક્તિ નથી, ત્યાં જ લાચારી ને પામરતા છે.

(‘જીવનમંડાણ’, આ.પ, પૃ. ૨૮)

\*

\*

લાચારી પામવાપણામાં તો નરી નામર્દી છે.

(‘જીવનમંડાણ’, આ.પ, પૃ. ૨૮)

\*

\*

શ્રદ્ધા જેમ ભાવ-જ્ઞાનમૂલક છે, તેમ પાછી શક્તિપ્રેરક  
પણ છે. (‘જીવનમંડાણ’, આ.પ, પૃ. ૩૦)

\*

\*

સાત્ત્વિક નભ્રતાની જીવનવિકાસના માર્ગે જેટલી જરૂર છે,  
તેટલી જરૂર જીવનને ટટાર રાખવાપણામાં પણ રહેલી છે.

(‘જીવનમંડાણ’, આ.પ, પૃ. ૩૧)

\*

\*

સાચી ભક્તિ પ્રગટાતાં બુદ્ધિની સૂક્ષ્મતા પ્રગટે છે. ભક્તિમાં  
ઘેલણા નથી. ભાવયુક્ત ધૂન છે ખરી.

(‘જીવનમંડાણ’, આ.પ, પૃ. ૩૩)

\*

\*

ભક્ત કશાથી હારી જતો નથી, કશાથી ભાગતો નથી. જે  
જે આવી મળે તેને પ્રભુકૃપાપ્રસાદી સમજ તેનો તે પ્રેમભક્તિભાવે  
જ્ઞાનપૂર્વક સ્વીકાર કરે છે. (‘જીવનમંડાણ’, આ.પ, પૃ. ૩૪)

\*

\*

અજ્ઞાનમૂલક દશામાં થતો ત્યાગ તે ત્યાગ નથી, તે તો  
ખાલી ઘસડાવાપણું છે, તણાવાપણું છે. તેમાં નાધૂટકાપણાની  
લાગણી હોય છે ને લાચારીની દશા હોય છે. તેમાંથી કલેશ,  
સંતાપ, ઉદ્ઘેગ આદિ વધે છે ને જીવનનું કચડાવાપણું બને છે.

(‘જીવનમંડાણ’, આ.પ, પૃ. ૩૬)

\*

\*

આપણે આપણા કરતાં બીજાને વધારે મહત્વ સમજપૂર્વક આપવું. આપણને કોઈ સાચી રીતે સમજે કે નહિ તેની લેશ પણ પરવા કર્યા વિના બીજાને આપણે સાચી રીતે સમજવાનો જગ્રત પ્રયત્ન કરવાનો છે.                            ('જીવનમંડાણ', આ.પ, પૃ. ૪૨)

\*

\*

જેનામાંથી આપણે પ્રેરણા મેળવવી છે, તેનું જીવતું જાગતું ભાવપૂર્વક ભાન આપણા વર્તનવ્યવહારમાં જો રાખ્યાં કરીએ, તો તેનું ચેતના-સ્મરણ પણ આપણામાં જાગતું રહે છે; ને આપણને બળ મળતું હોવાનો અનુભવ થાય છે.

('જીવનમંડાણ', આ.પ, પૃ. ૪૩)

\*

\*

સકળ કંઈ કર્મ કરતાં કરતાં આપણા મનના આપણે સાક્ષી થતા રહેવું.                            ('જીવનમંડાણ', આ.પ, પૃ. ૪૬)

\*

\*

જે જીવ જીવનવિકાસની ભાવનાને દૃઢાવી દૃઢાવીને, મનનાં બધાં વલણોને સમજ સમજુને ભાવનાનો વિકાસ કર્યે જાય છે, અને જ્યાં જ્યાં નકારાત્મક વલણ પ્રગટે ત્યાં ત્યાં થંભી જઈને તેના વહેણમાં ન તણાતાં તટસ્થતાથી એવા વલણને પ્રભુકૃપાથી નકારે છે, ઈન્કાર કરે છે, તેવો જીવ આજ નહિ તો કાલે જાગવાનો જ છે.                            ('જીવનમંડાણ', આ.પ, પૃ. ૫૩)

\*

\*

જીવનવિકાસ સાધવાને કાજે મનોમંથન એ ઘણું ઘણું જરૂરનું અંગ છે.                            ('જીવનમંડાણ', આ.પ, પૃ. ૫૮)

\*

\*

ઝાજા વિચારો કર્યા કરવાથી આધ્યાત્મિક માર્ગ પળવાનું

બની શકે નહિ.

(‘જીવનમંડાણ’, આ.પ, પૃ. ૬૫)

\*

\*

ધ્યેય પરત્વેની અત્યંત ઉત્કટ અધીરાઈ અને તે સાથે સાથે અખૂટ ધીરજનો મેળ ખવરાવવો પડશે.

(‘જીવનમંડાણ’, આ.પ, પૃ. ૬૬)

\*

\*

તપશ્ચયોમાં નરી શુષ્ણતા છે કે માત્ર કઠણાશ છે, એ જ્યાલ ખોટો છે. આનંદપૂર્વક અને જ્ઞાનના હેતુથી, હૃદયના ઉમળકાથી જે તપ થાય છે, તેમાંથી તો ફૂલની જેમ જીવનમાં પમરાટ પ્રગટે છે અને જીવન ભર્યું ભર્યું લાગે છે. તપમાંથી તો ગુણ, શક્તિ ને જ્ઞાન પ્રગટે છે.

(‘જીવનમંડાણ’, આ.પ, પૃ. ૬૮)

\*

\*

સર્વ કંઈ ચોક્કસ લક્ષણોથી માપો. લક્ષણો વડે સમજવાની ટેવ પાડવાથી કદી પણ ભ્રમણામાં પડી જવાનું બનતું નથી.

(‘જીવનમંડાણ’, આ.પ, પૃ. ૭૦)

\*

\*

આધ્યાત્મિક માર્ગની કેરીનો અંત નથી. જ્ઞાનનો વિકાસ તો થયા જ કરે છે.

(‘જીવનમંડાણ’, આ.પ, પૃ. ૭૨)

\*

\*

હૃદયથી થયેલો કે પ્રગટેલો સાચો પસ્તાવો જીવનને એવી ને એવી દશામાં પડી રહેવા ન દઈ શકે. સાચા થયેલા પસ્તાવાથી જીવનની ગતિ ઊર્ધ્વ બને છે. (‘જીવનમંડાણ’, આ.પ, પૃ. ૭૫)

\*

\*

આપણા જીવનમાં ને મનમાં જે બીજાં ઉગે છે, તેનું કારણ તે બીજાં નથી પણ આપણો પોતે જ છીએ.

(‘જીવનમંડાણ’, આ.પ, પૃ. ૮૦)

\*

\*

પોચી પોચી રૂ જેવી લાગણીથી જીવન કદી ઘડી શકાવાનું  
નથી. (‘જીવનમંડાણ’, આ.પ., પૃ. ૮૦)

\*

આપણા બધા જ આગ્રહો, મમતા, ઈચ્છા વગેરે બધું જો  
આપણે ટાળવાનું હોય, તો વડીલોનું કહું કરવામાં આપણી બધી  
મમતા, ઈચ્છા, આગ્રહ, અહમું આદિ ટાળવાનું તે એક મોટામાં  
મોટું સાધન બની શકે છે. (‘જીવનમંડાણ’, આ.પ., પૃ. ૮૫)

\*

સંયુક્ત કુટુંબની ભાવનાને જો આપણે સાચી રીતે સમજતા  
હોઈએ, તો તેમાં ઘણા ગુણો કેળવવાની તકો મળ્યાં કરે છે.

(‘જીવનમંડાણ’, આ.પ., પૃ. ૮૫)

\*

પ્રેમની ભાવનામાં એક જ પક્ષ છે.

(‘જીવનમંડાણ’, આ.પ., પૃ. ૮૭)

\*

સાધના જેટલી આંતરિક પ્રકારની ને પ્રમાણની પણ છે,  
તેટલી જ ઉપરની રીતે બહારથી વ્યવહારું પ્રમાણની પણ છે.

(‘જીવનમંડાણ’, આ.પ., પૃ. ૮૮)

\*

જીવનમાં જ્યારે જ્યારે કોઈના તરફથી કંઈ સૂચન મળે, ત્યારે  
તેના બે ભાગ પાડી દેવા; ઉપયોગનું કે બિનઉપયોગનું. જે જે કંઈ  
કહેવાકથવામાં આવે કે સૂચવવામાં આવે ને જે કરવામાં કંઈ કશો  
ગેરલાભ ન હોય, એટલે કે ભાવનામાં ક્ષતિ ન ઉપજતી હોય,  
જે કરવામાં કશો વાંધો ન હોય, તેવું તો એકદમ સ્વીકારીને  
તુરતોતુરત કરી જ દેવું. (‘જીવનમંડાણ’, આ.પ., પૃ. ૮૮)

\*

સાધારણ રીતે નાની નાની બાબતોમાં કરવા કે ન કરવાપણામાં મનના આગ્રહ, ભમતા, આસક્તિ વગેરેનું દર્શન કે વ્યક્તપણું થયાં કરતું હોય છે.

(‘જીવનમંડાણા’, આ.૫, પૃ. ૮૮)

\*

\*

વૃત્તિ એ શક્તિસ્વરૂપ છે, જો જ્ઞાનભક્તિપૂર્વક એનો ઉપયોગ થતો હોય તો. (‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૧૫૬)

\*

\*

વૃત્તિથી જ વૃત્તિ ઘડાતી હોય છે. વૃત્તિ જાગ્યા વિના કશું બનતું નથી કે થતું નથી. (‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૧૫૬)

\*

\*

સાધનામાર્ગ પરત્વેની ભાવનાનું અનુશીલન અને પરિશીલન જીવનમાં સતત એકધારું થયા વિના કશો જાઓ ચંચુપ્રવેશ આમાં થઈ શકતો નથી.

(‘જીવનમંડાણા’, આ.૫, પૃ. ૮૭)

\*

\*

બીજાંનો દોષ હૈયે વસે તો ત્યાં આપણે ચેતવું રહ્યું.

(‘જીવનમંડાણા’, આ.૫, પૃ. ૮૮)

\*

\*

મન જો પ્રેમભક્તિથી, ભાવનાના વેગથી પ્રભુસ્મરણમાં મસ્તપણે ગુલતાન રહ્યાં કરે તો બીજા જીવોનું કશું અન્યથાપણે ટકોરેલું કે દુઃખદાયક કે કહેવું-કથવું આપણાને તે રીતે લાગવાનું નથી. (‘જીવનમંડાણા’, આ.૫, પૃ. ૮૯)

\*

\*

આપણામાંનો પુરુષ જો જાગૃત બની જાય તો પછી પ્રકૃતિ, પ્રકૃતિ હોવા છતાં ને પ્રકૃતિની રીતે પોતે વહેતી હોવા છતાં, ને

પ્રકૃતિ પ્રકૃતિની રીતે ભાગ ભજવતી હોવા છતાં, તેમાં પ્રકૃતિપણું  
રહેતું હોતું નથી. (‘જીવનમંડાણ’, આ.પ, પૃ. ૧૦૦)

\* \* \*

નિરાશામાંથી જો આપણાં મન, બુદ્ધિ, પ્રાણ અને અહંકાર  
આપણને સચેતન ન બનાવતાં હોય તો આપણી એવી થયેલી  
નિરાશા તે પ્રાણના પ્રાકૃતિક સ્વભાવની છે એમ સમજવું.

(‘જીવનમંડાણ’, આ.પ, પૃ. ૧૧૨)

\* \* \*

ભાવના જો જીવનના ઘડતરને યોગ્ય આકાર ન આપી શકે  
તો એવી ભાવનાની ઉર્મિ એ તો મોસમ વગરના માવઠાના  
જેવી સમજવી. (‘જીવનમંડાણ’, આ.પ, પૃ. ૧૧૬)

\* \* \*

કંઈ કશાનોયે ભાર કે બોજ લાગે તો જાણવું કે કયાંક  
ચણચણાટીની લાગણી છે. (‘જીવનમંડાણ’, આ.પ, પૃ. ૧૧૭)

\* \* \*

વિચારથી પ્રગટેલી સમજણ જુદી છે, ભાવનાથી પ્રગટેલી  
સમજણ જુદી છે ને વર્તનમાં મુકાપેલી સમજણ જુદી છે. વિચાર,  
ભાવના અને વર્તન એ ત્રણેનો સુમેળ આપણે સાધવાનો છે.

(‘જીવનમંડાણ’, આ.પ, પૃ. ૧૧૮)

\* \* \*

દણ્ણિ, વૃત્તિ અને વલાણ ગગનગવિહારી હોવા છતાં એનાં  
પગલાં તો વાસ્તવિકતાની ભૂમિકા ઉપર હોવાં જોઈશે.

(‘જીવનમંડાણ’, આ.પ, પૃ. ૧૧૮)

\* \* \*

આપણે તો જીવનમાં પ્રેમજ્ઞાનભક્તિની નક્કરતા  
પ્રગટાવવી છે, ને એ નક્કરતાથી જીવવું છે.

(‘જીવનમંડાણ’, આ.પ, પૃ. ૧૧૮)

\*

સંસાર એ મરુભૂમિ નથી; પરંતુ સાધનામય જીવન જીવવાને  
કાળે તપોમય ભૂમિકા છે. સંસારમાં આપણે વૃંદાવનનો અનુભવ  
કરવાનો છે. (‘જીવનમંડાણ’, આ.પ, પૃ. ૧૨૨-૨૩)

\*

એકની એક બાબતના જેના જેના વિચારો વારંવાર આવ્યાં  
કરે તો તેમાં તેમાં જીવ લપટાયેલો છે તેમ પ્રમાણવું.

(‘જીવનમંડાણ’, આ.પ, પૃ. ૧૪૧)

\*

કોઈ સંતાત્મામાં જીવનવિકાસ કાળે કરીને તેના જ્ઞાન-ભાન  
સાથે જો ખૂબ લાગણી જન્મતી હોય તો તેને આસક્તિ ન ગણાય.

(‘જીવનમંડાણ’, આ.પ, પૃ. ૧૪૨)

\*

જેવા પ્રકારના વિષયમાં મન ચોટે છે તેવા પ્રકારનું મન  
બને છે. (‘જીવનમંડાણ’, આ.પ, પૃ. ૧૪૨)

\*

કોઈનીયે જોડે અથડામણ થાય એનો અર્થ તો એ થયો કે  
આપણું મન હજુ અથડામણને સ્પર્શ કરી શકે છે.

(‘જીવનમંડાણ’, આ.પ, પૃ. ૧૫૪)

\*

જીવનની ભાવના મિથ્યા ભાવના નથી. એના જેવી નક્કર  
વાસ્તવિકતા બીજા કોઈ પ્રકારના જીવનમાં નથી.

(‘જીવનમંડાણ’, આ.પ, પૃ. ૧૫૬)

\*

જે જે આપણને જીવમય દશામાં રખાવ્યાં કરે છે, તે તે બધાંને ગુરુની ચેતના વડે આપણે સંપૂર્ણ શુદ્ધ કરી કરીને, તેના પ્રાકૃતિક ધર્મને બદલાવી બદલાવીને આધારના એકેઓક કરણમાં શરણભાવ પ્રગટાવવાનો છે. એવો શરણભાવ પ્રગટે, ત્યાર પછી જ ખરા આધ્યાત્મિક માર્ગની ચેતનાનો પ્રવાહ આપણા આધારમાં શરૂ થતો હોય છે.

(‘જીવનમંડાળા’, આ.પ, પૃ. ૧૫૮-૧૫)

\* \* \*

આપણામાં દુર્ગુણ હોય તે નિઃસંકોચપણે કબૂલ કરવાની જાહેર તાકાત પ્રગટવી જોઈશે. કબૂલ કરવાથી કંઈક અંશે આપણે તે દુર્ગુણથી જુદા છીએ અને તેની પરત્વે આપણને તેના સ્વીકારની ભૂમિકા નથી; વિશેષ કંઈ નહિ તો એની પરત્વે અભિરુચિ તો નથી જ, એટલા પૂરતું તો આપણું મન તેવી જાતનું તે બાબતમાં કેળવાય છે. (‘જીવનમંડાળા’, આ.પ, પૃ. ૧૬૪-૧૬)

\* \* \*

સારું જગત આપણી નાલેશી કરે કે હુરિયો બોલાવે તેમ છતાં આપણે શ્રીમગવાનના ચરણકમળની આસક્તિમાં સદાય મસ્તાન રહ્યાં કરીએ. જગત અને જગતજનનું અસ્તિત્વ આપણા મનમાં તદ્દન ગૌણ બની જાય એવું આપણે થવાનું છે.

(‘જીવનમંડાળા’, આ.પ, પૃ. ૧૭૫)

\* \* \*

(પ્રભુની) લગની લાગી જાય તે એક બાબત છે ને લગની લગાડવી તે બીજી બાબત છે.

(‘જીવનમંડાળા’, આ.પ, પૃ. ૧૮૦)

\* \* \*

સાધનાનું પરિણામ પ્રકૃતિ ને સ્વભાવનું રૂપાતર.

(‘જીવનમંડાળા’, આ.પ, પૃ. ૧૮૩-૧૮૪)

\* \* \*

જેમ લૂણ વિનાનું ભોજન, તેમ સદ્ગ્રાવ વિનાની સાધના.  
(‘જીવનમંડાણ’, આ.પ, પૃ. ૧૮૯)

\* \* \*

જેમ આરસીમાં મોં જોઈએ અને આપણું રૂપ દેખાય તેમ પ્રસંગ આપણને આપણું રૂપ બતાવી આપે છે.

(‘જીવનમંડાણ’, આ.પ, પૃ. ૨૧૦)

\* \* \*

કોઈ અપમાન કરે ને તે જ્ઞાનપૂર્વક જો ગળી જઈ શકાય અને મનથી ઊંચાનીયા ન થવાય તો તે આપણને સબળ બનાવે છે. લાચારીથી ભોગવેલું અપમાન વધુ નિર્બળ બનાવે છે.

(‘જીવનમંડાણ’, આ.પ, પૃ. ૨૨૧-૨૨)

\* \* \*

જ્યાં જ્યાં અનિષ્ટ હોય તેની સામે થવાની વૃત્તિથી નહિ, પરંતુ આપણો તે પરિસ્થિતિમાં જે કરવાનું હોય તે તેના યોગ્ય ધર્મના પાલન કાજે શું કરવું ઘટે, એમ વિચારીને તે કરવું જોઈએ.

(‘જીવનમંડાણ’, આ.પ, પૃ. ૨૨૨)

\* \* \*

મળેલું અમૃત પણ મહા સદ્ગ્રાયના અભાવે માનવી ઝેર સમું કરીને વણસાડી શકે છે, ને સમજુ, વિવેકી ને શાશપણવાળો જીવ મળેલા ઝેરને પણ એની માત્રા બનાવીને, ખાઈ પચાવીને એમાંથી શક્તિ મેળવે છે. (‘જીવનમંડાણ’, આ.પ, પૃ. ૨૨૩)

\* \* \*

જેને સર્વમાંથી, આડા-ઉભા સર્વ પ્રસંગોમાંથી, રૂંજ જ જોવા અનુભવવાની કળા જીવનમાં સાંપડે છે એવા જીવો ધન્ય છે.

(‘જીવનમંડાણ’, આ.પ, પૃ. ૨૨૩)

\* \* \*

अन्यथा विचारो आवे तेनी सामे आपणामां जो साची समजण जागी गयेली होय तो ते प्रभाषेना सामेना विचारो निश्चयपूर्वक मूळ्या करवा घटे. तो ज पेला अन्यथा विचारोनुं जोर तूटी पडे, ने असर ओढी थाय.

(‘ज्ञवनमंडाणा’, आ.प, पृ. २२५)

\* \* \*

नकारात्मक स्थितिनी समजण पडवा छतां तेमां तषायां करवुं ए तो नरी पामरता छे.

(‘ज्ञवनमंडाणा’, आ.प, पृ. २२७)

\* \* \*

समर्पण कर्यु होय तेना विषेना कशा पण आगणपाछणा विचारो समर्पण कर्या केडे आपणने न थवा घटे; तो ते योग्य प्रकारनुं उतम समर्पण गणाय.

(‘ज्ञवनमंडाणा’, आ.प, पृ. २२७-२२८)

\* \* \*

कणणमां कणेलो जीव महेनत करवाथी तो उलटो वधारे कणणमां उतरतो जवानो. एटले तेवी वेणाए महेनतनी त्यां सार्थकता नथी, परंतु बीजांनी मदृद माटे, जेटलुं जोर होय तेटलाथी, मदृद मांगवाने माटे बूमो मारवामां तेवी वेणाए सार रहेलो छे.

(‘ज्ञवनमंडाणा’, आ.प, पृ. २३१)

\* \* \*

दुर्गुण के दोषोनुं साचुं भान थवुं अेनुं लक्षण तो ए के ते ते आपणने घणा घणा खूचता, कठता ने सालता होय ने तेमांथी मुक्त थवावा माटे सक्किय रचनात्मक तालावेली प्रगटती होय.

(‘ज्ञवनमंडाणा’, आ.प, पृ. २३४)

\* \* \*

હુર્ગુણો કે દોષો એની મેળે અટકતા કે ખરી પડતા નથી. તેમ કરવા માટે તો તે વિષયની તે પ્રકારની ઉત્કટ સંવેદનશીલ જાગૃતિ દિલમાં દિલથી પ્રગટેલી હોવી જોઈશે.

(‘જીવનમંડાણ’, આ.પ, પૃ. ૨૩૬)

\*

\*

વિજ્ઞતીય સ્પર્શનો સંકોચ હોવો તે પણ યોગ્ય નથી, તેમ તે પરત્વેનો વિસ્તાર થવો તે પણ યોગ્ય નથી. સર્વ પ્રકારની ભડક અને ફડકમાંથી મુક્ત થવાનું છે. શરીરની ભડક આપણે ભાંગવાની છે, શરીર તો સાધનને માટે છે.

(‘જીવનમંડાણ’, આ.પ, પૃ. ૨૩૮)

\*

\*

સર્વનું મૂળ બીજ પોતાની પ્રકૃતિ છે. બીજા કોઈને દોષ દેવો કે બીજાનો દોષ જોવો તે આપણી પામરતા અને નિર્બળતા છે. આપણે પોતે જ વિશેષ જાગૃત રહેવાનો પ્રયત્ન કરીએ ને આપણે પોતાને જ દોષ દેવાનો છે.

(‘જીવનમંડાણ’, આ.પ, પૃ. ૨૩૯)

\*

\*

આપણા જ ધાર્યા પ્રમાણે ને આપણી સમજણ પ્રમાણે બધું બન્યાં કરવું જોઈએ અને તે જ બધું સાચું છે, એવા પ્રકારનું માનસ હોય તો તે એક પ્રકારનું સ્વચ્છંદીપણું ને સંકુચિતપણું પણ છે.

(‘જીવનમંડાણ’, આ.પ, પૃ. ૨૪૦)

\*

\*

વ્યક્તમાં જેમ છે તેમનું તેમ તે અવ્યક્તમાં પણ છે. પણ જે અવ્યક્તમાં છે તેની તે જ રીતે વ્યક્તમાં છે એવું નથી હોતું.

(‘જીવનમંડાણ’, આ.પ, પૃ. ૨૪૧)

\*

\*

સ્થૂળમાંથી આપણે કદી ચેતન વિષેનું પૂરેપૂરું સાચું ભાન  
એકદમ ઉપજાવી શકવાના નથી.

(‘જીવનમંડાણા’, આ.પ, પૃ. ૨૪૧)

\*

\*

જે રાગ આપણાને સ્થૂળમાં ચોંટાડી ન રાખે, પરંતુ તે  
રાગમાંથી વિવેકયુક્ત સમજણ પ્રગટાવીને તાટસ્થ અને સમતા  
જન્માવીને ઉપર ખેંચી આણે તે રાગ ઉત્તમ છે.

(‘જીવનમંડાણા’, આ.પ, પૃ. ૨૪૨)

\*

\*

સંત પુરુષમાં રાગ થવો એટલે આપણાં નિભ પ્રકૃતિનાં  
મન, બુદ્ધિ, ચિત્ત, પ્રાણ ને અહંકારનો તેની ચેતનાના હૃદયભાવ  
સાથે મેળ ખવડાવવો. (‘જીવનમંડાણા’, આ.પ, પૃ. ૨૪૨)

\*

\*

સાચી શ્રદ્ધા સામાન્યતઃ એકદમ પ્રગટતી નથી. શ્રદ્ધા પણ  
કેળવાતાં કેળવાતાં કેળવી શકાય છે, તેમ છતાં શ્રદ્ધાનો મૂળ  
ગુણધર્મ તો સહજ છે. (‘જીવનમંડાણા’, આ.પ, પૃ. ૨૪૨)

\*

\*

ભગવાન પરની શ્રદ્ધા એ તો નગદ નાણું છે. જેમ નગદ  
નાણા વડે ખપની ચીજ ખરીદી શકાય છે, તેમ ભગવાન પરની  
શ્રદ્ધા પ્રસંગ પડ્યે આપણાને જો ટટાર ન બનાવી શકે, તો એ  
શ્રદ્ધા તે શ્રદ્ધા નથી, પણ કોઈ પ્રકારની ખાલી આળપંપાળ છે.

(‘જીવનસોપાન’, આ.પ, પૃ. ૨)

\*

\*

મળેલા જીવનની પરિસ્થિતિમાંથી નવચેતન અને  
નવજીવનની આશાના અંકુર ઉગાડવા અને એ પ્રકારનો પુરુષાર્થ

જગાડવો ને પુરુષાર્થ કરવો એમાં સાચી માણસાઈ રહેલી છે.

(‘જીવનસોપાન’, આ.પ, પૃ. ૩)

\*

ભાગતાં તો સૌ કોઈને આવડે, પરંતુ પરિસ્થિતિની સામે ઊભા રહી, પરિસ્થિતિમાં હળીમળી, તેમાંથી ઊંચે આવવું એ વિરલ વીર આત્માનું કામ છે.

(‘જીવનસોપાન’, આ.પ, પૃ. ૩)

\*

કોઈની લાગણીને પંપાળવી એથી તો તેના જીવનને વધારે દુઃખી બનાવવાપણું પણ થઈ જાય.

(‘જીવનસોપાન’, આ.પ, પૃ. ૩)

\*

કોઈના મનને વધારે આણું બનાવવામાં કદાપિ પણ મદદગાર ન થવું. પરિસ્થિતિ આવી પડતાં તેમાંથી જીવનમાં મર્દની પ્રગટે, એવું કંઈક થઈ શકે તો તે ઉત્તમ સેવા છે.

(‘જીવનસોપાન’, આ.પ, પૃ. ૪)

\*

ચેતનને કોઈ આકાર કે રૂપ કે ગુણ કશું નથી. છતાં તે છે; ને તે વ્યક્ત હોતું નથી છતાં તે વ્યક્ત થાય છે.

(‘જીવનસોપાન’, આ.પ, પૃ. ૫)

\*

નકામી લૂલી લૂલી લાગણીઓ દર્શાવવામાં જીવતરને ફેંકી દેવાનું નથી. જીવનને તો નક્કર પાયા ઉપર ચણવાનું છે. કોઈને પણ એવી રીતે આશ્વાસન દેવાનો કશો અર્થ નથી.

(‘જીવનસોપાન’, આ.પ, પૃ. ૫)

\*

જીવદશાની ગતિમાં ચઢાયિતર તો વારંવાર થયાં જ કરવાની.

(‘જીવનસોપાન’, આ.પ, પૃ. ૬)

\*

\*

જીવદશાના બીજા કોઈ પ્રકારના પુરુષાર્થમાં સ્થૂળ પ્રકારના લાભ ને ગેરલાભ બન્ને સાથે સાથે સમાયેલા છે; જ્યારે આધ્યાત્મિક માર્ગના પ્રયત્નમાં માત્ર લાભ જ છે. ગેરલાભ મુદ્દલે નથી. (‘જીવનસોપાન’, આ.પ, પૃ. ૬)

\*

\*

મળેલી પરિસ્થિતિથી અકળાઈને ભાગવું અથવા સદાય તેનાથી અસંતોષ સેવ્યા કરવો અને તેનું દોષારોપણ હંમેશાં બીજાં ઉપર જ ઢોળ્યાં કરવું અને તેથી સદાય નિરાશા સેવ્યાં કરવી, એ તો ગાંડપણને નોતરવા જોવું છે.

\*

\*

આપણી આ ભવની પ્રકૃતિની ગતિ ને દિશા જેવા પ્રકારની હોય, તેવા પ્રકારનો આપણો પુનર્જીત છે.

(‘જીવનસોપાન’, આ.પ, પૃ. ૬)

\*

\*

જેટલા પ્રમાણમાં ઉત્કટ પ્રકારની ભાવના વધુ સાત્ત્વિક, તેટલા પ્રમાણમાં તેનો જન્મ વહેલો થાય તેવું કંઈક ખરું; અને આધ્યાત્મિક માર્ગની જેને લગની લાગેલી છે એવા જીવનો જન્મ બીજા પ્રકારના જીવો કરતાં ઘણો વહેલો થાય છે એવો અનુભવ છે. (‘જીવનસોપાન’, આ.પ, પૃ. ૭)

\*

\*

જીવની હરકોઈ દશામાં આપણે પતનની પળમાં છીએ, ખીણમાં છીએ, કે ચઢાયિતરની દશામાં છીએ એનું ઉત્કટ સંવેદનશીલ ભાન તે તે વેળા જો જીવને થયાં કરે, તો પતનની

વેળામાંથી તે સવેળા જાગ્રત થઈ જઈ શકે.

(‘જીવનસોપાન’, આ.પ, પૃ. ૭)

\*

બીજી કોઈ પણ પ્રવૃત્તિ આપણે કરતાં હોઈએ, છતાં આપણું  
મન તો આપણા અસલના કામમાં જ લાગુ રહેલું હોય, તેવી  
રીતે જીવવાની કળા સાધકે શીખવાની રહે છે.

(‘જીવનસોપાન’, આ.પ, પૃ. ૭)

\*

જ્યાં સુધી આપણા થતા જતા પુરુષાર્થમાં આપણું હદ્ય  
રેડાયું નથી, ત્યાં સુધી આપણો તેવો પુરુષાર્થ પૂરેપૂરો ફળી શકતો  
પણ નથી.

(‘જીવનસોપાન’, આ.પ, પૃ. ૮)

\*

જેટલો સમય ઉત્તમ પ્રકારની ભાવનાના વર્તનમાં ગળાયો  
તેટલો સમય આપણે સાચી રીતે જીવાં ગણાઈએ.

(‘જીવનસોપાન’, આ.પ, પૃ. ૧૦)

\*

આમેય દુઃખ સહન તો કરવું પડે છે જ. એને બદલે જે  
જ્ઞાનપૂર્વક દુઃખને સ્વીકારીને, દુઃખ એ જીવનને ઘડાવા કાજે  
સોનેરી તક છે, એમ સમજીને, જે કોઈ જીવ તેને નિવેદે છે—  
એવા માટે દુઃખ એ તપશ્ચર્યા છે; ને જે તપશ્ચર્યામાં હદ્ય છે,  
તેવા પ્રકારની તપશ્ચર્યામાં તો આનંદ, ઉત્સવ રહેલો છે.

(‘જીવનસોપાન’, આ.પ, પૃ. ૧૨)

\*

સંસારી કક્ષાના જીવોની દ્યા કે પ્રેમ તે દ્યા કે પ્રેમ નથી,  
એ તો જીવપ્રકારની ખાલી ખાલી લોલુપતા છે.

(‘જીવનસોપાન’, આ.પ, પૃ. ૧૩)

\*

બુદ્ધિમાં લાગણીનું તત્ત્વ ઉમેરાતાં સાચી રીતે વિચારવાની ટેવ ને તેનો ખરો ગુણ અંતરમાં જાગૃત ટકી શકતો નથી.

(‘જીવનસોપાન’, આ.પ, પૃ. ૧૪-૧૫)

\*

\*

દોષનું મનન-ચિંત્વન દોષનું બળ વધારે છે.

(‘જીવનસોપાન’, આ.પ, પૃ. ૧૫)

\*

\*

“સારા” પરત્વે સદ્ગ્રાવ જાગે એમાં તેની કશી કિંમત નથી. પણ “નઠારા” પરત્વે પણ સદ્ગ્રાવ જગાડીને જીવતો કરવાનો છે. જેટલું ‘સારુ’ પ્રેરણા આપી શકે તેટલું ‘નઠારું’ પણ જરૂર પ્રેરણા આપી શકે. (‘જીવનસોપાન’, આ.પ, પૃ. ૨૩)

\*

\*

પ્રયત્નની સાથે સાથે આપણે ભગવાનની કૃપા-મદદ જ્યારે ને ત્યારે ચાચતાં રહેવાની છે. (‘જીવનસોપાન’, આ.પ, પૃ. ૨૧)

\*

\*

બુદ્ધિ એ જ્ઞાનનું કરણ છે અને લાગણી-સહાનુભૂતિ વગેરે ભાવનું કરણ છે. જીવનવિકાસના માર્ગમાં બુદ્ધિ અને ભાવ બન્નેની જરૂર છે. (‘જીવનસોપાન’, આ.પ, પૃ. ૨૨)

\*

\*

જો આપણામાં બુદ્ધિ સતેજ ને સૂક્ષ્મ ન બનતી જતી હોય તો તેમાં આપણું હૃદય નથી એમ નિશ્ચે પ્રમાણવું.

(‘જીવનસોપાન’, આ.પ, પૃ. ૨૨)

\*

\*

સંસ્કાર કરતાં જીવનમાં પ્રેમનું મહત્વ વિશેષ છે. પ્રેમ કરતાં ભાવનું મૂલ્યાંકન જીવનમાં શ્રેષ્ઠ છે. પ્રેમ જાગ્યા વિના ભાવ જાગી શકે નહિ. એવો ભાવ પ્રગટતાં આપણાં કરણો તેના

રાગમાં રહે છે; પરંતુ એવો ભાવ સહજમેળે જાગી જતો નથી.  
(‘જીવનસોપાન’, આ.પ., પૃ. ૨૩)

\*

જે તે કંઈ અભ્યાસથી આવડે છે. અભ્યાસ વિના સાધનામાં પ્રાણ ન પ્રગટે. અભ્યાસ દઢ થતાં તેમાં હૃદય પણ રેડાય ને સામેલ થાય. અભ્યાસથી એક જાતની લઘણ જાગે છે. એવી લઘણમાં એક પ્રકારની ઘરેડ થઈ જવાનો સંભવ પણ ખરો; તેથી અભ્યાસમાં વારંવાર બુદ્ધિ વડે, હૃદયની લાગણીઓ વડે ભાવનાનું ઉદ્દીપન વારંવાર કર્યા કરવું.

(‘જીવનસોપાન’, આ.પ., પૃ. ૨૬)

\*

હૃદયની ભાવનાથી ભગવાનની કૃપા-મદદ માટે દિવસમાં વારંવાર પ્રાર્થના કર્યા કરવી. નામસ્મરણની જલકમાં ભાવનાનો પ્રવેશ થવા દેવો. આપણો જીવીએ છીએ તે શાને કાજે તેનો પણ વિચાર કરવો.

(‘જીવનસોપાન’, આ.પ., પૃ. ૨૭)

\*

આપણો મહાલવાનું છે હૃદયની ભાવનામાં. એ જ આપણો ખરો રંગ અને રસ છે.

(‘જીવનસોપાન’, આ.પ., પૃ. ૨૮)

\*

આપણું વિચારબળ એક જ પ્રકારની દિશામાં ને ગતિમાં સતત મનન-ચિંત્વનવાળું રહ્યાં કરે ને તે ભાવનું ઉદ્દીપન રહ્યાં કરે તથા એના તેવાં જ વર્તન અમલ થયાં કરે, તો નિભા પ્રકારની બુદ્ધિ જરૂર હઠવા માંડે અને આપણા પુરુષાર્થમાં આપણાને રસ જામવા માંડે.

(‘જીવનસોપાન’, આ.પ., પૃ. ૩૦)

\*

પ્રકૃતિમાં રહેલું ચેતન અનેક પ્રકારનું રૂપ-નવાં નવાં રૂપો

પણ-ધારણ કરે છે. એક હોવા છતાં અનેકરૂપ બને છે. આપણે પણ એક હોવા છતાં અનેક પ્રકારના વારંવાર થયાં કરીએ છીએ અને બદલાયાં કરીએ છીએ. આકાર એક ભલે દેખાય પણ આકારમાં પ્રકાર જુદા જુદા થયાં કરે છે.

(‘જીવનસોપાન’, આ.પ., પૃ. ૩૦)

\*

\*

આપણી પ્રાર્થનાનો સ્વર દિલમાં મધુર લાગે ત્યારે ભાવ સવિશેષપણે છે એમ સમજવું. અત્યંત કઠોર લાગે ત્યારે મનનું ઠેકાણું નથી અથવા તો કંઈક અકળાયેલું છે એમ જાણવું.

(‘જીવનસોપાન’, આ.પ., પૃ. ૩૧)

\*

\*

જીવનવિકાસ કાજે સાધના એ એક જ અને અંતિમ માર્ગ છે, એવી જે જીવને આત્મપ્રતીતિ છે, તે કશાથી પછી આવરાઈ જતો નથી. (‘જીવનસોપાન’, આ.પ., પૃ. ૩૬)

\*

\*

સાધકને માટે તો સાત્ત્વિક ભૂમિકા પરનો રજોગુણ હોય તો તે ઉત્તમ. (‘જીવનસોપાન’, આ.પ., પૃ. ૪૪)

\*

\*

જગતમાં કશાનો નાશ નથી. માત્ર ફેરબદલો થઈ શકે છે.

(‘જીવનસોપાન’, આ.પ., પૃ. ૪૮)

\*

\*

જીવનમાંના રચનાત્મક ગુણો આપણામાં સુદટપણો થાય એ તો જરૂરનું છે જ, પરંતુ તેટલાથી પતતું નથી. માત્ર સદાચાર અને નીતિના ધોરણ પરનું જીવન અને તેની ભૂમિકાથી માનવીને એવાં કોઈ આત્મવિશ્વાસ અને નિષ્ઠા નથી જન્મી જતાં કે જે એને

એની જીવનની કટોકટીની પળે ટણાર ઊભો રખાવી શકે.

(‘જીવનસોપાન’, આ.પ, પૃ. ૪૮)

\*

\*

જ્ઞાનપૂર્વકનું નમન અને તેની સાથે પ્રેમભક્તિનો સંચાર  
એ આપણી ભાવનાને ઉન્નત બનાવે છે.

(‘જીવનસોપાન’, આ.પ, પૃ. ૫૨)

\*

\*

આપણાથી જે કંઈ બને, સારું કે નરસું, તે જ્ઞાનપૂર્વક અને  
પ્રેમભક્તિથી સમર્પણ કર્યા કરવાનો યજ્ઞ અને તેની ભાવનાનો  
અભ્યાસ આપણે પાડ્યાં કરવાનો છે.

(‘જીવનસોપાન’, આ.પ, પૃ. ૫૨)

\*

\*

જે રીતે કોઈ જણાય તે તેવી જ રીતનો છે તેમ કદાપિ પણ  
આપણે ન માનવું. (‘જીવનસોપાન’, આ.પ, પૃ. ૫૩)

\*

\*

ઉચ્ચાત્માનો-ગુરુનો આશ્રય જીવનના ઊધ્વકરણ સારુ છે.  
ને તે પણ સાધનરૂપ છે. સર્વશ્રેષ્ઠ અને સર્વોત્તમ તો એકલા  
ભગવાન જ છે.

આપણે જ્યાં સુધી જીવદશામાં છીએ, ત્યાં સુધી આપણામાં  
જે કંઈ ઉત્તમમાં ઉત્તમ હોય, તે પણ ચેતનની અપેક્ષાએ પૂરતું  
અને યોગ્ય નથી.

જીવદશામાં જે જે કંઈ વૃત્તિ, લાગણી હોય અને તે ઉત્તમ  
પ્રકારની હોય તેમ છિતાં તે બંધનકારક છે. દા.ત. પુણ્ય હોય તો  
તે પણ બંધનકર્તા છે.

(‘જીવનસોપાન’, આ.પ, પૃ. ૫૩, ૫૪, ૫૫)

\*

\*

અનુભવનું જ્ઞાન કોરું નથી હોતું. એ તો ચલણી નાણું છે.

થએલા અનુભવમાંથી સમજણ તારવીને, તેનું નિરીક્ષણ કરીને તેનાથી આગળ પણ બુદ્ધિ જર્દ શકે છે; પરંતુ બુદ્ધિને પણ અનુભવના આધારની જરૂર રહે છે.

મનનચિંત્વન જો થયાં કરે તો બુદ્ધિ, અનુભવની નક્કર ભૂમિકા ઉપર ઠેકો મારીને આગળ જવાને આપણને પ્રેરાવે છે.

(‘જીવનસોપાન’, આ.પ., પૃ. ૫૭)

\*

\*

સમજણ સમજણના પણ પ્રકાર હોય છે. જે સમજણ આપણને ઊંચી દિશા પ્રતિ લઈ જાય છે, તે સમજણ માત્ર એકલી બુદ્ધિની નથી હોતી.

બુદ્ધિ ઊંચી દિશાનું વિચારી શકે છે, પણ ત્યાં ઠરી શકતી નથી. એનું ઉડ્યન ખાલી ખાલી હોય છે. બુદ્ધિ મદદ કરે છે ખરી, પણ તે અનુભવના જોર ઉપર.

(‘જીવનસોપાન’, આ.પ., પૃ. ૫૭-૫૮)

\*

\*

જીવન એ અંધારો કૂવો નથી અથવા તો વાવાડોડાના પવનની પેઠે ગમે તેમ ઊડી આવતો જંગાવાત નથી. જીવનની આકરામાં આકરી કસોટીમાં ને તેવા પ્રસંગોમાં જીવનનો એકધારો વણાટ સંગ્રહણે વણાયાં જતો હોય છે. એમ સંગ્રહ પટ વણાવાને કાજે જેવા પ્રસંગોમાં જીવને મુકાવું ઘટે તેવા તેવા પ્રસંગોમાં તે મુકાતો જતો હોય છે.

પ્રત્યેક પ્રસંગમાં જીવનના ઘડતરનો હેતુ છે.

(‘જીવનસોપાન’, આ.પ., પૃ. ૬૨)

\*

\*

સાધનાનો અર્થ ગળે ટૂંપો દઈને જીવનને ગુંગળાવી દેવાનો

નથી, પરંતુ સહજ સ્વાભાવિકપણે તેનો વિકાસ થાય અને એ જ રીતે વૃત્તિઓનો સુમેળ ઉપજે ને તેમાંથી શાંતિ, સમતા, તાટસ્થ્ય, ધીરજ, સહિષ્ણુતા, પ્રસન્નચિત્તતા આદિ ગુણોનો વિકાસ થતો અનુભવાય, તે તે ગુણોની શક્તિનો જીવનમાં સાંપડતા પ્રસંગોમાં જ્ઞાનપૂર્વકનો ઉપયોગ થયાં કરે, ને તેના વડે જીવન ભર્યું ભર્યું લાગે અને ધન્ય થતું અનુભવાય, એનું નામ છે સાધના.

(‘જીવનસોપાન’, આ.પ, પૃ. ૬૬)

\* \* \*

ભાવના વાસ્તવિકપણાના પ્રદેશમાં રમ્યાં કરે, તે કાજે સાધના છે. (‘જીવનસોપાન’, આ.પ, પૃ. ૭૦)

\* \* \*

મૌનએકાંત લેવાનો હેતુ લગની લગાડવાનો છે; ને સાધનામાં વિશેષ એકાગ્રતા, કેન્દ્રિતતા પ્રાપ્ત થાય તે કાજેનો છે.

(‘જીવનસોપાન’, આ.પ, પૃ. ૭૧)

\* \* \*

આપણી અહંતાને જેમ બને તેમ સમજ સમજને જ્ઞાનપૂર્વક આધાત આપ્યા કરવાનાછે. આપણું ધાર્યું કહ્યું નથાય, ત્યારે મનમાં વિશેષ રાજી થવાનું છે, કારણ એ રીતે અહમ્ભૂને ફટકો પડે છે.

(‘જીવનસોપાન’, આ.પ, પૃ. ૭૧-૭૨)

\* \* \*

વગર લેવેદેવે કોઈને કંઈ કશું સૂચન ન કરવું. સૂચન એ અહમ્ભૂની પેદાશ છે. (‘જીવનસોપાન’, આ.પ, પૃ. ૭૨)

\* \* \*

જીવનમાં માનવતાના જે ગુણો વર્ણવેલા છે તેટલામાં ને

એની મર્યાદામાં જ્ઞાન અને ભક્તિની પરિસમાપ્તિ નથી.

(‘જીવનસોપાન’, આ.પ, પૃ. ૭૨-૭૩)

\* \* \*

સદ્ગુરૂભાવની જગૃતિ થતાં ને તે ટકતાં સ્થૂળમાં સૂક્ષ્મનું દર્શન થાય છે.

જીવનની કમાણી સદ્ગુરૂભાવનાના પાયામાં રહેલી છે.

(‘જીવનસોપાન’, આ.પ, પૃ. ૭૬-૭૭)

\* \* \*

પ્રેમથી થતો નાશ એ ઉત્તમ પ્રકારનું જીવનનું રચનાત્મક પાસું છે.

(‘જીવનસોપાન’, આ.પ, પૃ. ૮૪)

\* \* \*

પ્રેમ એ જીવનઘડતરને કાજે છે, ને સાધન છે; તેમ છતાં તે પાછું સાધ્ય પણ છે; એટલે ભક્તિ કરતાં પણ પ્રેમનું સ્થાન ઊંચું છે.

(‘જીવનસોપાન’, આ.પ, પૃ. ૮૫)

\* \* \*

શરીરની સંભાળ રાખવી જરૂરી છે; એની ચિંતા કરવી એ ગાંડપણ છે; તેમ એને પંપાળવું એ ઘેલણા છે; પણ તેની યોગ્ય સારવાર કરવી એ આપણો ધર્મ છે.

(‘જીવનસોપાન’, આ.પ, પૃ. ૮૫)

\* \* \*

ઉર્ભિની ગતિમાંથી કર્મમાંચેતન પ્રકટેતો તે ઉર્ભિ ઉપયોગની.

(‘જીવનસોપાન’, આ.પ, પૃ. ૮૧)

\* \* \*

ચેતનનો અનુભવ કરવા સારુ વિસંવાદમાં સંવાદની દણિને હૃદયમાં જીવતી રાખીને આપણે વર્તવાનું રહે છે.

(‘જીવનસોપાન’, આ.પ, પૃ. ૮૬)

\* \* \*

અસત્ય પણ સત્યને પામવા માટેની ભૂમિકાનું સાધન છે.

(‘જીવનસોપાન’, આ.પ., પૃ. ૮૭)

\*

\*

આપણને જે જે વિચારો, વૃત્તિઓ, વલણ વગેરે ઉઠ્યાં કરે,  
તે ઉપરથી આપણને આપણી કક્ષાની સમજ પડી જવી જોઈએ.

(‘જીવનસોપાન’, આ.પ., પૃ. ૧૨૧)

\*

\*

માનવીના દિલમાં એકબીજા પ્રતિનો અવિશ્વાસ જણાય,  
છતાં મૂળમાં તો, અંતર્ગતપણે વિશ્વાસ-શ્રદ્ધા રહેલાં છે; જેમ  
નદીના પટમાં ભલેને પાણી સુકાઈ ગયેલું જણાયા કર્યું હોય,  
પરંતુ અંદર, અંતર્ગતપણે તો પાણી હોય છે જ તેમ.

(‘જીવનસોપાન’, આ.પ., પૃ. ૧૨૭)

\*

\*

વૃણા, દયા, લજ્જા, ભય, શોક, નિંદા, કુળ-અભિમાન  
તથા શીલ, સ્વભાવ ને જાતિનું અભિમાન એ બધાં પણ અમુક  
પ્રકારના સંકોચ છે. તેમાંથી મુક્ત થવું જ જોઈશે.

(‘જીવનસોપાન’, આ.પ., પૃ. ૧૨૮)

\*

\*

જીવથી બને તેટલો સકળ પુરુષાર્થ કરી કરીને છેવટના  
અંત સુધી તેમાં મથ્યાં કરે, ને તેમ સકળ ઉપાયો લીધેલા હોવા  
છતાં કંઈ કારી ન ફાવે, ત્યારે તે પ્રભુને મદદ માટે પોકારે. અંતે  
તો પુરુષાર્થ કરી કરીને એનામાં જ ગળી ને મળી જવાનું છે, એમ  
બનીને તેના સાચા અર્થમાં ‘નિર્બળ’ બનવાનું છે. ત્યાર બાદ  
પ્રાર્થના કરવાની કળા—‘નિર્બળ કે બળ રામ’ એમાંથી આપણને  
મળી રહે છે.

(‘જીવનસોપાન’, આ.પ., પૃ. ૧૮૨)

\*

\*

જીવદશાવાળા તો બેદને વધારવાનું જ સમજે છે. બેદને અભેદમાં લઈ જવાનું તો કોઈ વિરલ વીર જીવ જ કરી શકતો હોય છે. (‘જીવનસોપાન’, આ.પ, પૃ. ૧૮૩)

\*

\*

શરૂશરૂમાં ને ઠીક ઠીક લાંબા કાળ સુધી પણ સાધકનો સ્વ-પ્રયત્ન અનિવાર્ય છે. મૂર્ખ ને અજ્ઞાની લોક ‘બધું જ ગુરુ કરી દેશે’ એમ માની કશું પણ કર્યા વિના તમસના પ્રેર્યા એમ ને એમ પડ્યાં રહે છે. સ્વપ્રયત્નમાં અહંકાર ન રહે તેની પૂરી તકેદારી રાખવી.

(‘જીવનસોપાન’, આ.પ, પૃ. ૧૮૧)

\*

\*

જીવનમાં જે તે બધાં કર્મો પોતાના અહંકારને પોષવા અથવા તો મમતા, મોહ, લોભ, કામ, કોધ, રાગ, મદ, દ્વેષ, ઈર્ઝ્યા, લાલસા, કામના, આશા-ઈચ્છા, તૃષ્ણા આદિ વૃત્તિઓથી પ્રેરાઈને જ કર્યો કરતો હોય છે. (‘જીવનસોપાન’, આ.પ, પૃ. ૧૮૫)

\*

\*

ઝટ ઝટ કંઈ કશા ઉપર મત, અભિપ્રાય કે સમજણ ન બાંધી લેવાની જાગૃત તકેદારી રાખવી જ જોઈશે.

(‘જીવનસોપાન’, આ.પ, પૃ. ૧૮૮)

\*

\*

જેમાં ને તેમાં માથું મારવાનું દિલ થાય તો જાણવું કે તે અહંતા છે. (‘જીવનસોપાન’, આ.પ, પૃ. ૨૦૧)

\*

\*

અહંતાથી મુક્ત માનવી કેવો હોય એનું નરી નજરે આવે એવું વ્યક્ત લક્ષણ એક તો એ છે કે તે સાધારણતઃ સાવ સંપૂર્ણ સજ્ઞાન નિરાગ્રહી રહ્યાં કરતો હોય છે.

(‘જીવનસોપાન’, આ.પ, પૃ. ૨૦૦)

\*

\*

(શરીરની આરોગ્યતા અને સુખાકારી પૂરેપૂરાં જળવાઈ રહે તેટલા પ્રમાણનો) અલ્ય આહાર, અલ્ય વિહાર, અલ્ય નિદ્રા, અલ્ય બોલવું, અલ્ય સંબંધ, અલ્ય સંપર્ક, અલ્ય વ્યવહાર, અલ્ય જવું-આવવું ને અલ્ય મેળાપો એ બધું મનનો સંયમ કેળવવામાં ઘણાં ઘણાં મદદરૂપ છે. આવા બધા ‘અલ્યતા’ના પ્રકારની પાછળનો હેતુ તો એ છે કે જીવે વધારે ને વધારે અંતર્મુખતા કેળવ્યાં કરવાની છે. ('જીવનસોપાન', આ.ડ, પૃ. ૧૯૯-૨૦૦)

\*

\*

નમૃતા એટલે પોતે કશું જ નથી—એકમાત્ર ભગવાન જ સર્વ કંઈ છે એવી નિષાપૂર્વકની જ્ઞાનયુક્ત ભાવના.

('જીવનસોપાન', આ.ડ, પૃ. ૨૦૦)

\*

\*

જીવ અટવાઈ જાય, મૂંજાઈ જાય, લેવાઈ જાય, અકળાઈ જાય, અશાંત થઈ જાય, દુઃખી દુઃખી થઈ જાય, તો હજ એનામાં અહંતા ભરી પડેલી છે તેમ જાણવું, કારણ કે તેની અહંતાને તેવા તેવા પ્રકારના આધાત લાગે છે, તેથી કરીને તેને તેવી તેવી લાગણીઓ થાય છે. ('જીવનસોપાન', આ.ડ, પૃ. ૨૦૧)

\*

\*

મેલાં કપડાંને રંગ બરાબર ચઢી શકતો નથી. કપડાંને બરાબર રંગવા માટે પ્રથમ તો એમાંનો મેલ કાઢી નાખવો પડે છે. તેવું જ અંત:કરણાને, આધારનાં બધાં કરણોને શુદ્ધિને વિષે છે.

('જીવનસોપાન', આ.ડ, પૃ. ૨૦૩)

\*

\*

સંતને સમજવા ને ઓળખવા માટે આપણાં આંખ, મન, હૃદય તેવાં પ્રકારનાં થઈ ગયાં હોય, તો જ તેવાને ઓળખી શકાય, જાણી શકાય, બાકી તો નહિ.

કોઈ પણ માનવ-આત્મા સમગ્રપણે ઓળખવો લગભગ  
દુર્ઘટ હકીકત છે.                            ('જીવનસોપાન', આ.ર, પૃ. ૨૦૫)

\*

જીવનની સમસ્યાઓનો ઉકેલ બુદ્ધિના નિર્ણય કરતાં  
હૃદયમાંથી મળ્યાં કરે, તે માટે સાધકે અંતર્મુખતા વધુ ને વધુ  
કેળવ્યાં કરવાની રહે છે.

અંતર્મુખતા પૂરેપૂરી કેળવાયા વિના બુદ્ધિમાં સમતા પ્રકટી  
શકતી નથી.                            ('જીવનસોપાન', આ.ર, પૃ. ૨૦૯-૧૦)

\*

સદ્ગુરુની ભાવનાને લાયક થવું ને એની પસંદગીમાં આવવું  
એટલે જીવનવિકાસની સમગ્રતામાં પણ પ્રગટતા રહેવું.

('જીવનસોપાન', આ.ર, પૃ. ૨૨૩)

\*

જીવનનું ઘડતર કંઈ એમનું એમ બનતું નથી. એ કાજે તો  
હથોડાના ધા પણ સહન કરવા પડે છે, ચારે બાજુથી તથા ઉપર  
અને નીચે ટિપાવું પડે છે.                    ('જીવનસોપાન', આ.ર, પૃ. ૨૨૭)

\*

જીવન જો જીવવું જ હોય તો જીવનવિકાસના યજ્ઞ કાજે,  
મરીજીટી સર્વ રીતે ફના થઈ જવા કાજે જીવન એ તો આપણું  
સદ્ગુરુની સર્વ રીતે ફનાગીરીમાંથી જ જીવનની ફોરમ  
પ્રગટે છે.                            ('જીવનસોપાન', આ.ર, પૃ. ૨૩૧)

\*

આપણને જે હણવા આવે છે, તે જ અંતે તો તારીને જાય છે.

('જીવનસોપાન', આ.ર, પૃ. ૨૩૨)

\*

જે કંઈ જીવદશાના વલાણનું ઉદ્ભબે, ને તે બધું આપણા

પોતાના અસલ સ્વરૂપનું નથી, એવું જીવતુંજાગતું પ્રત્યક્ષ જ્ઞાનભાન રચનાત્મકપણે તે તે વેળા આપણામાં જાગી જાય તો સમજવું કે સમતાની ગ્રાફિ થવા માંડી છે.

(‘જીવનસોપાન’, આ.૩, પૃ. ૨૩૫)

\*

\*

જીવસ્વભાવનુંકોઈપણ પ્રકારનુંનકારાત્મક વલશ—એનુંનામ પણ અશુદ્ધિ કહી શકાય. શુદ્ધિ એટલે માત્ર નીતિમત્તાની ગણતરીનું ધોરણ એટલું જ તે નથી.

નીતિમત્તાના ધોરણના એકમાત્ર તેવા વિચારથી અને અમલથી કરણોની શુદ્ધિ થાય છે, એમ માનવામાં ક્યાંક અતિશયોક્તિ ને તર્કદોષ લાગે છે.

(‘જીવનસોપાન’, આ.૩, પૃ. ૨૩૬)

\*

\*

પુરુષાર્થ પણ એકલો નથી ને કૃપા પણ એકલી નથી.

(‘જીવનસોપાન’, આ.૩, પૃ. ૨૩૮)

\*

\*

નામસ્મરણ જ્યારે જ્ઞાનભક્તિપૂર્વકની જગૃતિથી થયાં કરે છે, ત્યારે જ તેમાંથી હૃદયમાં સાચી જગૃતિ પ્રગટી શકે છે, એકાગ્રતા ને એકરતતાની ભાવના જામી શકે છે.

(‘જીવનસોપાન’, આ.૩, પૃ. ૨૭૪)

\*

\*

સદ્ગુરુ તો જે જીવો પોતે મરી મરીને ફરી પુનર્જીવન ગ્રાપ્ત કરતા રહે છે, એવા જીવો પર તે વારી જતો હોય છે.

જે જીવ શહાદત ભરેલી જીવનની કુરબાનીથી પોતાના સદ્ગુરુની ભક્તિ કરે છે, જીવનને ન્યોછાવર કરી કરી શ્રીગુરુને ચરણકમળે આહુતિઓ પ્રેમથી આપ્યાં કરે છે, એવો જીવ

સદ્ગુરુની કૃપા મેળવવાને પાત્ર થતો હોય છે.

(‘જીવનસોપાન’, આ.૩, પૃ. ૨૭૮)

\*

\*

સદ્ગુરુને આપણા હૃદયમાં જીવતો કરવાનો છે. સદ્ગુરુ એટલે એની દેખીતી શરીરની આકૃતિ નહિ, પરંતુ એના હૃદયમાં પ્રગટી રહેલી ચેતનભાવના કે જેની મદદ લઈને ઉંચે આવી શકાય છે. (‘જીવનસોપાન’, આ.૫, પૃ. ૩૦૬)

\*

\*

સાધકે બને તેટલી શાંતિ, સમતા, તટસ્થતા, પ્રસન્નતા આદિ ગુણોને, એ બધાંને ખૂબ ખૂબ સાચવવાનાં છે. જીવનવિકાસની ભૂમિકા રચાવવાને કાજે તે ઘણાંઘણાં મહત્વનાં છે; પરંતુ તેને જ જો મહત્વ આયાં કરીને માત્ર ગુણોને મેળવવાને મથ્યાં કરીએ, તો તેનો અંત નહિ આવે. એના કરતાં તો હૃદયમાં એકનિષ્ઠાથી ચેતન-સ્મરણની ભાવના જો આપણે કેળવી શકીએ તો તેવા ગુણો આપણામાં પ્રગટા જતા આપણે અનુભવીશું.

(‘જીવનસોપાન’, આ.૩, પૃ. ૨૮૪)

\*

\*

હારતાં હારતાં પણ અડગ રહીને જે પ્રભુને પ્રેમભક્તિભાવે સ્મરે છે, તે જીવનને પામતો જતો હોય છે.

(‘જીવનસોપાન’, આ.૩, પૃ. ૩૦૪)

\*

\*

જેને પ્રભુ વિના જીવન અકારું ને નીરસ લાગે છે, તેના જીવનમાં પ્રભુ પોતે હૃદયરસ અને શક્તિ પ્રેર્ણા કરે છે.

(‘જીવનસોપાન’, આ.૩, પૃ. ૩૦૪)

\*

\*

મુક્ત-આત્મામાં એક પ્રકારનો સાત્ત્વિક ‘હુંકાર’ હોઈ શકે

છે; પરંતુ તે ‘હુંકાર’ નો પ્રકાર અને જીવદશાવાળાના ‘હુંકાર’ નો પ્રકાર એ બન્નેના પ્રકારમાં પાયાનો ફરક છે.

(‘જીવનસોપાન’, આ.પ, પૃ. ૩૩૨)

\*

શ્રી (ધન), સત્તા ને કામવાસના——એ ગ્રણે જીવને જીવપણમાં રાખનારા પ્રખર અવરોધો છે.

(‘જીવનસોપાન’, આ.પ, પૃ. ૩૩૨)

\*

જીવનવિકાસની સાધનામાં એવા પ્રકારનો તબક્કો પ્રગટે છે, કે જેમાં સાધનાને કાજે જ્ઞાનભક્તિપૂર્વકની ધારણ કરેલી નમ્રતા પોતે જ તેજસ્વિતપણમાં પ્રગટે છે, એક શક્તિ સ્વરૂપે પલટાય છે. (‘જીવનસોપાન’, આ.પ, પૃ. ૩૩૪)

\*

સાચા હદ્યની નમ્રતા તે ઘેટાના જેવી નથી હોતી; એનામાં તો અભિનું પ્રચંડ તેજ અને શક્તિ પણ રહેલાં છે.

(‘જીવનસોપાન’, આ.પ, પૃ. ૩૩૪)

\*

આદર્શના પડછાયાના અનુભવમાં કેટલાક જીવ પોતાના મૂળ આદર્શનો જ તે અનુભવ છે, એમ માની લઈ તેમાં સંતોષાઈ જતા હોય છે.

આદર્શની સંપૂર્ણતાની ટોચે પહોંચતાં પહોંચતાં તો આદર્શનું સ્વરૂપ પણ વિસ્તાર ને વિશાળતા પામતું જતું હોય છે ને આદર્શની રૂપરેખા પણ બદલાતી જતી હોય છે.

(‘જીવનસોપાન’, આ.પ, પૃ. ૩૪૦-૪૧)

\*

આદર્શને પમાતાં પમાતાં આદર્શ પોતે જ એક પદ્ધી એક તેની ઉત્કૃષ્ટતામાં પ્રગટતો જતો હોય છે.

(‘જીવનસોપાન’, આ.૫, પૃ. ૩૪૧)

\*

\*

જેના જીવનમાં કોઈ ઉચ્ચ આદર્શની આગ જલતી જ ન હોય, તેવા જીવે બીજાંને કહેવાપણું કે સુધારવા જવાપણું હોઈ શકતું નથી. (‘જીવનસોપાન’, આ.૫, પૃ. ૩૪૨)

\*

\*

જગતમાં તો બધું છે ને એમનું એમ જ ચાલ્યાં કરવાનું છે. કંઈક કંઈક સુધારકો થઈ ગયા, કંઈક કંઈક મહાત્માઓ થઈ ગયા, કંઈક કંઈક સંતો ને સદ્ગુરુઓ થઈ ગયા ને સાક્ષાત્ ભગવાનના અવતાર પણ થઈ ગયા, છતાં આપણે બધાં જેમ હતાં તેમના તેમ છીએ; માટે બધાંનો ને જગતનો વિચાર કરવાનો માંડી વાળીને આપણે જ જો ઠામઠેકાણે સાચી રીતે હદ્યની સચ્ચાઈથી થવાને મંડીશું, તો તો કંઈક દહાડો વળવાનો છે; બાકી જગતમાં તો બધું જ દેખાશે.

(‘જીવનપ્રવેશ’, આ.૩, પૃ. ૪)

\*

\*

સાધકે પોતાની ટેવો, મંતવ્યો, સમજણો, આગ્રહો, મતમતાંતરો, દોષો, કુટેવો, આશા, ઈચ્છા, કામના, તૃષ્ણા, કામ, કોષ, મદ, મોહ, લોભ, મત્સર ઈત્યાદિનો સ્વીકાર કરવાનો છે, પણ તે સ્વીકાર એમનાથી પર થવા કાજે છે.

(‘જીવનપ્રવેશ’, આ.૩, પૃ. ૬)

\*

\*

માનવી જે જુએ છે, સાંભળે છે ને જાણે છે, તે તેની તેની રીતે ને તે પણ સમગ્રપણામાં તો નહિ જ; તેથી તેના તેવા

કાર્યમાં યथાર્થપણું પૂરેપૂરું કદી પ્રગાઠી શકે નહિ. એવી અધૂરી જાણકારી ને અધૂરા જોવાપણા ને સાંભળવાપણામાંથી ન્યાય-અન્યાયનાં કાટલાં લઈને તોલવા ને માપવા બેસી જવું તે લગીરે ડહાપણભર્યું ન ગણાય.                            ('જીવનપ્રવેશ', આ.૩, પૃ. ૮)

\*

\*

મનમાં જે મનોમંથન થાય એમાંથી જીવનને યોગ્ય પરિવર્તન પ્રગટે, એવી નક્કર ભાવના પ્રગટતી રહે, તો તેવું મનોમંથન યોગ્ય પ્રકારનું સમજવું; બાકી તો મન નકામા નકામા તરંગે ચઢીને જીવનને ઉથલાવી પણ નાખે.

(‘જીવનપ્રવેશ’, આ.૩, પૃ. ૯)

\*

\*

ભાવ વિનાનું કર્મ, ને તે પણ જીવનવિકાસ પરતેના લક્ષ્યવાળું જો ન હોય તો તે કર્મ ભલેને ઉત્તમ હોય, છતાં તે કર્મ અંધન જ થાય.

કર્મ કરતાં કરતાં જે ભાવ મહત્વપણે, જ્ઞાનભક્તિપૂર્વક હૃદયમાં જીવતો રહેલો હોય છે, તે પ્રમાણે જ કર્મના સંસ્કાર ને પરિણામ ઉપજવાનાં.

જેમાં ન તેમાં ભાવ એ જ મુખ્ય વસ્તુ છે.

(‘જીવનપ્રવેશ’, આ.૩, પૃ. ૯-૧૦)

\*

\*

ચિંતા તો કદી ન કરવી; પણ ચિંતવન કરવું.

(‘જીવનપ્રવેશ’, આ.૩, પૃ. ૧૦)

\*

\*

અભ્યાસ પણ ઉપયોગ ખાતર જ કર્યાં કરવાનો હોય.

(‘જીવનપ્રવેશ’, આ.૩, પૃ. ૧૨)

\*

\*

સાધના એટલે જીવનવિકાસ કાળેની પળેપળની જ્ઞાનભક્તિપૂર્વકની અંતરમાં અંતરની ચેતનયુક્ત જગૃતિ.

(‘જીવનપ્રવેશ’, આ.૩, પૃ. ૧૫)

\*

\*

જેનું મુખ જે બાજુ વળેલું હોય છે, તે બાજુની પ્રમાણેનું જે તે બધું એને દેખાયાં કરે છે. (‘જીવનપ્રવેશ’, આ.૩, પૃ. ૧૬)

\*

\*

સંસારમાં રસ રહેતો હશે તો સંસારી બનાશે; પ્રભુમાં રસ રહેતો હશે તો પ્રભુમય બનાશે.

(‘જીવનપ્રવેશ’, આ.૩, પૃ. ૧૬)

\*

\*

અઢળક કામ હોય, ગમે તેવો વિષમ પ્રસંગ હોય, ગમે તેવું કારમું દઈ હોય, ગમે તેવું ભલે ને આહુંતેહું હોય, તે તે વેળા જો આપણો હૃદયમાં હૃદયથી પ્રભુને પ્રેમભક્તિપૂર્વક સાદ પાડીશું ને પ્રાર્થના કરીશું તો તેવી વેળા તે હૃદયમાં પ્રગટે છે, એવો અનુભવ થાય છે. (‘જીવનપ્રવેશ’, આ.૩, પૃ. ૧૭)

\*

\*

સદ્ગુરુની સ્થૂળ નિકટતા પામવાનું મન થાય, પરંતુ એના કરતાં આપણા હૃદયમાં એને જીવતો કરવાની કણા સાધકે શીખવાની ને કેળવવાની રહે છે. માત્ર સ્થૂળ રીતની નિકટતા તે સાચી નિકટતા નથી. (‘જીવનપ્રવેશ’, આ.૩, પૃ. ૧૭)

\*

\*

ભાવનાને નિશ્ચિત સ્વરૂપની ભાવનામાં વધુ ને વધુ ઉત્કર કરીને તેની મદદથી હૃદયમાં પોતાના સદ્ગુરુને મળવામાં જે આનંદ છે, તે સાચો આનંદ છે. (‘જીવનપ્રવેશ’, આ.૩, પૃ. ૧૮)

\*

\*

કોઈ કશું નડતરરૂપ નથી; જો હોઈએ તો પોતે જ પોતાને  
નડતરરૂપ છીએ.                         ('જવનપ્રવેશ', આ.૩, પૃ. ૨૦)

\*    \*

ચોર, ડાકુ આપણા ઉપર ચાકુ ચલાવે છે ચોરવાને ને  
લૂટવાને; સર્જન (શસ્વરૈઘ્ય) આપણા ઉપર ચાકુ ચલાવે છે સાજા  
કરવાને ને જિવાડવાને; બન્ને કાર્યોમાં કિયા એક જ પ્રકારની છે,  
પણ હેતુ અને ભાવમાં ધરમૂળનો ફરક છે; આથી કિયા અને  
કર્મનું મહત્વ નથી., પરંતુ તેની પાછળના અંતરમાંના ભાવનું  
જ મહત્વ છે. ડાકુનું ચાકુ જીવની જીવ પ્રકારની ઈન્દ્રિયોનું સાધન  
છે; સર્જનનું ચાકુ જાગેલા આત્માનું છે.

('જવનપ્રવેશ', આ.૩, પૃ. ૨૧-૨૨)

\*    \*

અકળાવાથી ઊલટું જીવની સામે જે કાજે તે અકળાવાનું  
કરે છે, તે જ વધારે વખત આવીને ઊભું રહેતું હોય છે, ને તેથી  
તેવો અકળામણનો ગાળો ઊલટો વધારે સમય લંબાતો રહે છે.

('જવનપ્રવેશ', આ.૩, પૃ. ૨૩)

\*    \*

જવનમાં ઉચ્ચ ગતિમાં પ્રવર્તવું છે, એવી ભાવના પ્રગટવી  
એ દુર્લભ ઘટના છે; ને તેમાંયે સત્પુરુષનો આશ્રય અંતરની  
પ્રેમભક્તિ ને જ્ઞાનભાવે જાગૃતિ સાથે પોતાના આંતરિક વિકાસની  
સમજણના ધોરણથી હૃદયમાં પ્રગટતો રહે તે તો વળી એનાથીયે  
દુર્લભ છે; ને તેથી યે વધુ દુર્ઘટ તો સત્પુરુષના હૃદયને સમજવું  
અને અનુભવવું તે છે.                         ('જવનપ્રવેશ', આ.૩, પૃ. ૩૦)

\*    \*

પ્રાર્થનાની પણ આપણાને ગરજ લાગી જવી જોઈશે. તે

વિના પ્રાર્થનાના ભાવમાં સાચો ઉઠાવ પ્રગટી શકતો નથી.

(‘જીવનપ્રવેશ’, આ.૩, પૃ. ૩૩)

\*

\*

જીવનમાં પ્રસંગો બને છે તો તૂટક તૂટક, પણ તે સર્વ પ્રસંગોને સાંકળી લેનારી એક જાતની સંખ્યા ને સમગ્રતા તે તે પ્રસંગના અંતરમાં રહેલી છે અને તે ભાવિ તરફ દોરી જતી હોય છે. જીવન છિન્નભિન્ન નથી; અવિચિન્નપણો એક છે.

(‘જીવનપ્રવેશ’, આ.૩, પૃ. ૩૩-૩૪)

\*

\*

હાલના આપણા દેખાતા જીવનની પાછળ ને આગળ પણ એક પરંપરા છે. એ પરંપરા અનાદિ છે, તેમ છતાં તેનામાં ચેતન હોવાથી ચેતનનું જ્ઞાનભાન પ્રગટી જાય તો તે અંતવાળી પણ બની શકે.

(‘જીવનપ્રવેશ’, આ.૩, પૃ. ૩૪)

\*

\*

કેટલાકનું કથન કે લખાણ તેમના બહુશુતપણમાંથી પ્રગટે છે, વાચનમાંથી પ્રગટે છે, સાંભળેલી વાતોમાંથી પણ પ્રગટે છે; પરતું કોક જ વિરલ આત્માનું અનુભવમાંથી પ્રગટતું હોય છે. અનુભવના કથનની પાછળ આત્મવિશ્વાસનું થનગનતું ચેતન રહેલું છે.

(‘જીવનપ્રવેશ’, આ.૩, પૃ. ૩૪)

\*

\*

શ્રદ્ધાયુક્ત જીવ કદીકને જો દૂબે તોપણ આત્મવિશ્વાસ કદી ગુમાવતો હોતો નથી.

(‘જીવનપ્રવેશ’, આ.૩, પૃ. ૩૫)

\*

\*

જે હેતુથી વ્રત લીધું હોય તે હેતુ ને તેનો ભાવ જો ફળાવતાં રહીએ તો સ્થૂળ રીતે કદીક વ્રતનો ભંગ કરવો પડ્યો હોવા છતાં ખરી રીતે તે વ્રતનો ભંગ થતો નથી.

કર્મની પાછળ કર્મને મહત્ત્વ ન આપતાં કર્મના હેતુને જો  
મહત્ત્વ આપ્યાં કરીએ અને તે તે કરતી પળે તે પરત્વેની તે  
પ્રકારની ભાવના હૃદયમાં જો પ્રવર્ત્યુ કરે તો તે વધુ (ઉત્તમ ગણાય).

(‘જીવનપ્રવેશ’, આ.૩, પૃ. ૩૬)

\*

\*

ઇંછેડાઈ પડવાથી અને અકળામણ કરવાથી તો ઉલટું  
ગાંઠનું ગોપીચંદન ગુમાવીએ છીએ.

(‘જીવનપ્રવેશ’, આ.૩, પૃ. ૩૭)

\*

\*

જ્યાં જ્યાં ભેદ લાગે ત્યાં ત્યાં જીવનનું મૃત્યુ છે.

(‘જીવનપ્રવેશ’, આ.૩, પૃ. ૩૮)

\*

\*

સદ્ગુરુ તો સર્વત્ર જેમાં ને તેમાં વિસ્તાર પામેલો છે.  
આપણા મનહૃદયનું લક્ષ જો તેનામાં પળેપળ પ્રેમ-  
ભક્તિજ્ઞાનભાવે એકાગ્ર, કેન્દ્રિત ને તાદાત્યભાવે રહ્યાં કરતું  
હોય તો આપણને જે જે કંઈ સ્પર્શ તેમાં તેમાંથી તે બોધ  
મેળવી આપે છે. (‘જીવનપ્રવેશ’, આ.૩, પૃ. ૩૯)

\*

\*

કદીકને ગબડી જવાય કે ખેંચાઈ જવાય તેને મહત્ત્વ  
આપવાનું નથી; પરંતુ તેવા પ્રસંગે મનની જગૃતિ કેવા પ્રકારની  
રહે છે, તે ઘણી ઘણી મહત્વની હકીકત છે.

(‘જીવનપ્રવેશ’, આ.૩, પૃ. ૪૦)

\*

\*

સદ્ગુરુ પણ સાધન છે, સાધ્ય નથી. નઢી પાર કરવાને  
કાજે હોડીરૂપ કે માળ પર ચઢવાને નિસરણીરૂપ તે છે.

(‘જીવનપ્રવેશ’, આ.૩, પૃ. ૪૧)

\*

\*

‘અર્ધ સત્યમાં હંમેશ સત્યનું ખૂન છે’ એમ માનવામાં

આપણી સમજણ અધકચરી છે. સકળ કંઈ કર્મમાં તેની પાછળ અંતર્ગતપણે રમી રહેલ ભાવ ને હેતુ મુખ્યત્વે મહત્વનાં છે.

કંઈ કશાનું ચોકહું બનાવી ન દેવું. સમજણનું પણ જો ચોકહું બની ગયું તો તે બાધક નીવડશે.

(‘જીવનપ્રવેશ’, આ.૩, પૃ. ૪૪, ૪૬)

\* \* \*

આપણા હદ્યમાં જ્ઞાનભક્તિપૂર્વકનો જીવતો જાગતો સદ્ગ્રાવ તે આપણો પરમ રક્ષક છે.

(‘જીવનપ્રવેશ’, આ.૩, પૃ. ૪૭)

\* \* \*

ચેતનાનો અનુભવ તો માર્ગી લે છે ભારે જ્ઞાનભક્તિપૂર્વકની તપશ્ચર્યા અને કઠણ સાધના. (‘જીવનપ્રવેશ’, આ.૩, પૃ. ૪૮)

\* \* \*

આંતરિક શુદ્ધિ થયાં કરે કે રહ્યાં કરે તે સારુ સાધક જો જાગૃતિ રાખ્યાં ન કરે તો તે બની ન શકે.

(‘જીવનપ્રવેશ’, આ.૩, પૃ. ૪૮)

\* \* \*

જ્યે એ જેટલો બહારનો પ્રકાર છે, તે સાથે સાથે તે આંતરિક પ્રકારનો પણ છે. જ્યે-યજ્ઞની ભાવનાથી અને તેમાં ચાલુ એકધારાપણું પ્રગટતાં આંતરિક બળ પ્રગટતું અનુભવાય છે. જ્યે-યજ્ઞ ચાલુ રહ્યા કરેલો હશે તો નકારાત્મક વૃત્તિઓનો ઈન્કાર કરવાનું, તેનો સમજણપૂર્વક સામનો કરવાનું વગેરે બધું સૂજયાં કરવાનું.

(‘જીવનપ્રવેશ’, આ.૩, પૃ. ૫૪)

\* \* \*

જે જીવાત્માનું અહ્મુ ઓગળી ગયું છે, તેને ક્યાંયે વિરોધ નથી થતો બલકે વિરોધ હોતો જ નથી

(‘જીવનપ્રવેશ’, આ.૩, પૃ. ૫૪-૫૫)

\* \* \*

ગમે તે જીવ ગમે તે પ્રકારનો હોય અને તેનું વર્તન દેખીતી રીતે અધમમાં અધમ હોય તો પણ આપણે તો તેનામાં સદ્ગ્રાવથી વિચારવાનું રાખીશું એ આપણા કાજે ઉત્તમ પ્રકારની કેળવણી છે.

કોઈ આપણા વિષે ગમે તેવું ધારે, વિચારે કે વર્તે તેમ છતાં આપણે તેના વિષે ઉત્તમમાં ઉત્તમ રીતે વિચારીએ, વર્તીએ, તે આપણા પોતાના જીવનવિકાસ કાજે એક ભારે મહત્ત્વની તાલીમ છે.                         ('જીવનપ્રવેશ', આ.૩, પૃ. ૫૬)

\*

\*

ભાવનું તેના ઉત્કટપણામાં સઘન બનવું એ કર્મથી પ્રગટે છે. કર્મનું મહત્ત્વ ભાવને લીધે છે.

જ્ઞાન કિયામાં પ્રત્યક્ષ થયા વિના મોક્ષ નથી.

(‘જીવનપ્રવેશ’, આ.૩, પૃ. ૬૨)

\*

\*

આત્મનિવેદન એટલે આપણને ચેતનના ભાવથી સંકળાવનાર કોઈ દિવ્ય સાંકળ.

(‘જીવનપ્રવેશ’, આ.૩, પૃ. ૬૨)

\*

\*

સાધક એટલે જીવનવિકાસપથે પળવાને સતત ભાવભક્તિયુક્ત જાગૃતિ સેવીને મથનાર જીવાત્મા.

(‘જીવનપ્રવેશ’, આ.૩, પૃ. ૬૩)

\*

\*

જો જીવે પોતાની નિભન્ન પ્રકૃતિને દાદ આપી તો તેનું જોર ચઢી વાગશે. વિજય તો સામનો કરવામાં ને યુદ્ધ આપવામાં રહેલો છે—પરિણામ ગમે તે હોય.

(‘જીવનપ્રવેશ’, આ.૩, પૃ. ૬૫)

\*

\*

જેમાં ને તેમાંથી જીવનની નેમને વધારે પ્રોત્સાહન મળે એવી કોઈ અગમ્ય પ્રકારની અંતર્દિષ્ટ આપણામાં જાગી જવી જોઈશે.

(‘જીવનપ્રવેશ’, આ.૩, પૃ. ૬૬)

\*

\*

જીવ હારતો ભલે લાગે, પણ જો તે પોતાની આંતર્દિષ્ટ ખુલ્લી રાખ્યાં કરે, તેમાંથી જીત મેળવવાપણાનું શીખવાની હૃદયમાં પાકી નેમ રાખ્યાં કરે તો તેવો જીવ હારતો હારતો પણ જીવતો રહી શકે છે. ટટાર ઉભો રહી શકે છે.

(‘જીવનપ્રવેશ’, આ.૩, પૃ. ૬૭)

\*

\*

સાધક સાચી રીતે સાધનામાં જીવ પરોવતો બની ગયો હશે તો તો પોતાની જ પ્રકૃતિના અનેક સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ હુમલાઓ એના પર થયા કરવાના. સામા જીવની પ્રકૃતિ દ્વારા એની પોતાની જ પ્રકૃતિ જાણો કે હુમલો કરવાને મથી રહી ન હોય એવા પણ સૂક્ષ્મ અનુભવો જો સાધક જાગ્રત રહેલો હશે તો થવાના છે.

(‘જીવનપ્રવેશ’, આ.૩, પૃ. ૬૭)

\*

\*

પોતે કોઈ રીતે જો આમતેમ આડાંઅવળાં થયાં ને પોતાની અંતરની નેમ ચૂક્યાં તો તો આપણે પ્રકૃતિની રમતમાં જરૂર ફસાઈ જવાનાં.

(‘જીવનપ્રવેશ’, આ.૩, પૃ. ૬૮)

\*

\*

વિકાસનો મૂળભૂત સિદ્ધાંત ઘર્ષણમાં રહેલો છે. ઘર્ષણ વિના તો માનવી જેમનો તેમ પડ્યો રહે. અંતર્મુખ વળેલા માટે ઘર્ષણ એ તો તેજસ્વિતાને જીવંત રાખવાને ખરું સાધન છે.

(‘જીવનપ્રવેશ’, આ.૩, પૃ. ૭૦)

\*

\*

આપણને ચેતવવાને અનેક પ્રસંગો ભગવાન આપણને

જીવનમાં સંપડાવે છે. અનેક વેળા અથડામણમાં મૂકી દે છે. ખરી રીતે તો તેને મૂકવાપણું કશું નથી. આપણી પ્રકૃતિ આપણને તેવી દશામાં મુકાવી દેતી હોય છે; પરંતુ એવા પ્રસંગોમાંથી પોતાની પ્રકૃતિનું જે સાચું દર્શન થાય, અનુભવ થાય, તેમાંથી જે જીવ બોધ તારવી લે છે તેને તો —

‘પ્રભો ! તારી શાળા જગતભરમાં વ્યાપ્ત રહી છે.’

એવું આંતરિક જ્ઞાન પ્રગટ થાય.

(‘જીવનપ્રવેશ’, આ.૩, પૃ. ૭૧)

\*

\*

કોઈએ અન્યાય કર્યો હોય તો તેનું સ્મરણ પણ ન રહે, એટલું જ નહિ, પરંતુ તેના પર ઉપકાર કરવાની ભાવના પ્રત્યક્ષ જાગતી રહી શકે એવું સાધકે પોતા વિષે કરી દેવું રહેશે.

(‘જીવનપ્રવેશ’, આ.૩, પૃ. ૭૩)

\*

\*

જે ભગવાનને જંખે છે ને એવી જંખનામાં જેનું હૃદય ભળેલું છે, તેના જીવનના સર્વ પ્રસંગોમાં તેનો ભગવાન નવનિર્મિષા પ્રગટાવે છે.

જેણે જીવનવિકાસ કરવો છે તેણે તેવો પાયાનો આધાર પોતાના જીવનમાંથી પ્રગટાવવાનો રહે છે.

(‘જીવનપ્રવેશ’, આ.૩, પૃ. ૭૪)

\*

\*

વર્તમાનમાં રહ્યે રહ્યે ભૂતકાળમાં વારંવાર ડોકિયાં ન કરે તે સાધકે કાજે ઘણું જરૂરનું છે. વર્તમાનને જ સંભાળી ને સાચવી લઈને તેમાં ઉજ્જવળ ભવિષ્યને ખંડું કરી દેવું ઘટે.

(‘જીવનપ્રવેશ’, આ.૩, પૃ. ૭૬)

\*

\*

પ્રત્યેક જીવપ્રકૃતિમાં કુતૂહલવૃત્તિ રહેલી છે; તે આપણામાંથી

સમુળગી જવી જોઈશે.

(‘જીવનપ્રવેશ’, આ.૩, પૃ. ૭૮)

\*

\*

સાધકે પ્રકૃતિ જીતવાની છે, એટલું જ નહિ પરંતુ પ્રકૃતિથી પર પણ થવાનું રહે છે.

(‘જીવનપ્રવેશ’, આ.૩, પૃ. ૭૯)

\*

\*

ભૂલેચૂકે પણ કોઈનેથ આપણે ભોંઠો ન પાડવો. એવી ભોંઠપ પોતે જ્ઞાનપૂર્વક વહોરી લેવી.

(‘જીવનપ્રવેશ’, આ.૩, પૃ. ૮૧)

\*

\*

કોઈ જાણી જોઈને આપણા પર દોષારોપણ કરે કે બીજી રીતે અન્યથાપણે કરે તો ઝટાટ તેનો ખુલાસો આપવા મન તૈયાર થઈ જાય તો તે યોગ્ય નથી. સાધક જીવે એમ તો પોતાનો બચાવ કરવાની વૃત્તિ પણ મૂકી દેવી પડશે.

(‘જીવનપ્રવેશ’, આ.૩, પૃ. ૮૧)

\*

\*

જો કોઈ પણ એક જીવની સાથે હંદ્યનો સાચો સુભેળ સાધી શકાયો તો બીજા જીવો સાથે પણ જરૂર સુભેળ સાધી શકાવાનો છે.

(‘જીવનપ્રવેશ’, આ.૩, પૃ. ૮૨)

\*

\*

શીખવાને કાજે તો ઘણા ઘણા જ્ઞાનપૂર્વક નમ્ર થવાની જરૂર રહે છે. એવી નમ્રતા જીવનમાં પ્રગટતાં બીજા ગુણોની જગૃતિ ને શક્તિ પણ છતી થતી હોય છે; તેથી સાધનામાં તો શૂન્યથીયે શૂન્ય થયા વિના આપણામાં સાચું તત્ત્વજ્ઞાન ઊળી શકવાનું નથી.

(‘જીવનપ્રવેશ’, આ.૩, પૃ. ૮૩)

\*

\*

જીવન તો એક અને સમગ્ર છે. જીવનમાં કંઈ કંઈ ઘટનાઓ બને છે; પછી એ ભૂતકાળની હો કે વર્તમાનની હો, પણ તે જીવન સાથે સંયંગપણે સંકળાયેલી છે. જીવન એ કંઈ બંધિયાર પાણી નથી. એ તો છે વહેતું ગતિમાન જરણું. મૂળ અને મુખ બન્ને વચ્ચે સ્થળ અને કાળનું ઘણું અંતર હોવા છતાં જીવનના પ્રવાહની ગતિથી તે બન્ને એકમેકની સાથે જોડાયેલાં રહે છે. મૂળ અને મુખ બન્ને જુદાં દેખાતાં હોવા છતાં, બન્નેની દિશા જુદી જુદી હોવા છતાં અને બન્નેનું તે તે સ્થિતિમાનનું કદ જુદું હોવા છતાં જીવન તો તેનું તે જ છે, માત્ર તેમાં ઘણા ઘણા વળાંકો અને સ્થિતિફેર થયાં કરે છે; પરંતુ તેથી કોઈ તેની સંયંગતા કે સમગ્રતા તૂટી હોતી નથી.

(‘જીવનપ્રવેશ’, આ.૩, પૃ. ૮૮-૮૯)

\* \* \*

આકર્ષણનો ઉપયોગ જીવનવિકાસ કાજે છે.

\* \* \*

સંસારવહેવારમાં જે તે બધા જ જીવો એકબીજાને એકદમ સલાહ આપવા, સૂચનાઓ આપવા અને શિખામણ દેવા તૈયાર થઈ જતા હોય છે. તેવા પ્રસંગોમાં આપણે મુકાઈ જવાનું થતાં આપણે શાંતિ ધારણ કરી તેમના કહેવાનો ભર્મ સમજવો ને સૂલટો અર્થ ઘટાવવો; પરંતુ આપણે પોતે તો કોઈને સલાહ, સૂચન કે શિખામણ દેવા કદી પણ કૂદી ન પડવું. શક્ય હોય ત્યાં માગે તોયે ના પાડવી.

(‘જીવનપ્રવેશ’, આ.૩, પૃ. ૮૯)

\* \* \*

કોઈના પણ તેમની તેમની રીતે વહાલા થવા જવું એ તો મૂખ્યમીછે. એથી કરીને તો ખાડામાં પડવાનાં. જ્ઞાનપૂર્વક બીજાને સાનુકૂળપણે વર્તવું એ વળી જુદી વાત છે.

(‘જીવનપ્રવેશ’, આ.૩, પૃ. ૧૦૦)

\* \* \*

દોષથી જે જીવ જાગે અને જાગીને જાગ્યા પ્રમાણેનું વર્તન  
કરે તેને દોષ નહતો નથી. ('જીવનપ્રવેશ', આ.ડ, પૃ. ૧૦૦)

\* \* \*

કોઈનાય જીવનનું મૂલ્યાંકન તે જીવથી થયેલા દોષોથી કંઈ  
થોડું મપાય છે? માનવી જીવદશામાં હોય ત્યાં સુધી દોષ તો  
થાય; પરંતુ જે જીવનનો ટેક આપણામાં જાગ્યો હોય તો ચેતી  
જવાતાં વાર નથી લાગતી. દોષમાંથી માનવી કેટલું શીખે છે ને  
તે દોષને જીવનવિકાસક તત્ત્વમાં કેટલો પલ્ટાવી શકે છે એ જ  
ઘણું ઘણું મહત્ત્વનું છે. ('જીવનપ્રવેશ', આ.ડ, પૃ. ૧૦૧)

\* \* \*

જે જીવ દુઃખમાં સુખ જુએ છે અને સુખમાં દુઃખ સંકળાયેલું  
જુએ છે, તેવો જીવ તે બન્નેમાંથી નોખો તરી આવવાનો.

('જીવનપ્રવેશ', આ.ડ, પૃ. ૧૦૨)

\* \* \*

સંસાર એ લાગે છે તો ઘટમાળ જેવો; પરંતુ તે ઘટમાળ માત્ર  
નથી, અનંત વિસ્તારની વિવિધતાપૂર્વકની તે દિવ્ય લીલા છે.

('જીવનપ્રવેશ', આ.ડ, પૃ. ૧૦૨)

\* \* \*

જે તે કંઈ બને છે તે તો ચેતનના પરિબળથી. પરંતુ તે તે  
થયાં કરતી પળે તે ચેતનથી બને છે એવું પ્રકટ સ્મરણ ને અનુભવ  
જીવને થતો નથી; એથી તો જીવ તેમાં ને તેમાં બંધાયા કરે છે.

('જીવનપ્રવેશ', આ.ડ, પૃ. ૧૦૨-૦૩)

\* \* \*

સારું અને નરસું એ પણ જીવપ્રકારનાં બે પાસાં છે; એ  
બન્ને પાસાંમાંથી ચેતીને તરીને જુદા પડવું રહ્યું. એવો અત્યાસ  
એ પણ સાધનાનું એક અંગ છે.

ખોટી રીતે અન્યાયના ભોગ ભલે આપણે બન્યાં હોઈએ,  
તેમ છતાં અન્યાયને જરા પણ સ્વર્ણવા ન દઈએ તો મન ત્રાસ,  
કંટાળો, સંતાપ કદાપિ પણ નહિ પામે.

(‘જીવનપ્રવેશ’, આ.૩, પૃ. ૧૦૩-૦૪-૦૬)

\*

વાણીનો જાગ્રતપણે વિવેક જળવવાનો રહે છે. શું, કેટલું,  
કેવું, ક્યાં, કોને, ક્યારે, કેવી રીતે કહેવું એ કળા આપણામાં  
આવવી જ જોઈશે. (‘જીવનપ્રવેશ’, આ.૩, પૃ. ૧૦૫)

\*

જે સત્ય હોય તે તેવું ને તેવું જ્યાં ને ત્યાં હુંમેશ કહી  
નાંખવામાં ડહાપણ નથી. તે તેમ ન કહેવાનું કરતાં કે ન કહેવા  
જતાં અસત્ય થાય છે એમ આપણને લાગે, પણ અચૂક હરેક  
પ્રસંગમાં તેમ માનવું યોગ્ય પ્રકારનું નથી.

(‘જીવનપ્રવેશ’, આ.૩, પૃ. ૧૦૬)

\*

સામાનો દોષ જાણવા છતાં પણ આપણે શાનયુક્ત  
અણજાણમાં છીએ તેવી રીતે વર્તવું એ જેવા તેવા જીવનું ગજું  
નથી. (‘જીવનપ્રવેશ’, આ.૩, પૃ. ૧૦૬)

\*

અન્યાયને સહી લેવાના વલાણને સ્થાને જીવનવિકાસના  
ગુણોને પ્રેમપૂર્વક કેળવવા કાજે તેનો સ્વીકાર કરવાની કળા આપણે  
શીખવાની છી. અન્યાયનો સ્વીકાર એવી રીતે કરીએ કે જેથી  
આપણે પણ ચઢીએ ને અન્યાય કરનારના જીવનમાં તે અંગેનું  
સાચું જ્ઞાન પ્રગટે ને તે સાચી સમજાણની કક્ષામાં પ્રવેશે. અન્યાય  
સ્વીકારવાની કળામાંથી ત્યાગ, બલિદાન ને સમર્પણની કળા  
આપોઆપ જીવનમાં વ્યક્ત થાય છે.

(‘જીવનપ્રવેશ’, આ.૩, પૃ. ૧૦૭)

\*

જે દુઃખ સમજણાની આંખ પ્રગટાવે, એ દુઃખ તો જ્ઞાનનું  
મૂળ કહેવાય. ('જીવનપ્રવેશ', આ.૩, પૃ. ૧૦૮)

\*

\*

કોઈ આપણો દોષ બતાવે તેને સાચો ગુરુ ગણવો. કોઈ  
ગુણપ બતાવે તો તેના પર વધારે રાજી થવું. તેવી વેળા હૈયાનો  
ઉમળકો પ્રગટે તો આપણે સાચા સાધક છીએ એમ માનવું, દોષ  
ચીંધનારના ઘણા ઘણા ગુણ ગાવા.

('જીવનપ્રવેશ', આ.૨, પૃ. ૧૩૭)

\*

\*

મનની દ્વિધાવાળી સ્થિતિ વેળાએ મૌનસેવન જરૂરી ભલે  
હોય, પરંતુ તે એકલું પૂરતું નથી. તેવી સ્થિતિ ટાળવાના ઉપાયો  
લેવામાં સતત જાગૃતિ સેવીએ તથા તે સ્થિતિનો ગાળો જેટલો  
ટૂંકાવી લઈ શકાય તેમ કરીએ તો ઘણું કમાઈએ.

('જીવનપ્રવેશ', આ.૨, પૃ. ૧૩૮-૧૩૯)

\*

\*

જીવનવિકાસ કાજેનો યોગ્ય સંબંધ પ્રગટાતાં ને વધતાં જીવ  
કદરપણાની જેમ બને તેમ ઓછામાં ઓછી આશા રાખે તે તેના  
કાજે વધુ યોગ્ય છે. જે જીવને પોતાનો વિકાસ કરવો છે, તે  
જીવના મનને વખાણ સાંભળવાની સ્થિતિમાં ન આવવું પડે  
એટલું વધારે ઉત્તમ. ('જીવનપ્રવેશ', આ.૨, પૃ. ૧૩૯)

\*

\*

અભ્યાસના મૂળમાં જો સાચેસાચો વૈરાગ્ય પ્રગટી ગયેલો  
હોય તો તેવો અભ્યાસ જલદી ફળે; નહિતર અભ્યાસ એકલો  
એકલો થયા કરે ને તે દીર્ઘકાળ પર્યત ને નિરંતર, તો તેમાંથી  
પણ વૈરાગ્ય પ્રકટી શકે છે. માટે આપણે તો ધીરજ ને હિંમત

રાખીને જે કર્યું કરવાનું છે, તે કર્યું કરવું.

(‘જીવનપ્રવેશ’, આ.ર, પૃ. ૧૪૧)

\*

\*

દોડીની વેલ ભર ઉનાળામાં ખીલે છે, એવી રીતે ખરેખરો સાધક તો જીવનસંગ્રહમનો રસિયો બને છે. મુશ્કેલી, ઉપાધિ, દુઃખ, નિરાશા આદિ જીવનમાં પ્રગટતાં તેનામાં કોઈ ઓર પ્રકારનું શહૂર ને જનૂન પ્રકટે છે.

(‘જીવનપ્રવેશ’, આ.ર, પૃ. ૧૪૨)

\*

\*

સમાજની ઘરેડથી ભિન્ન રીતે ચાલનારા જીવો સમાજનો અને કેટલીક વાર તો કુટુંબનો પણ પ્રેમ અને સહાનુભૂતિ ગુમાવી બેસે છે. તેઓ એકલા અને અટૂલા પડી જાય છે. એવાઓ પ્રત્યે આપણો ધર્મ તો હદ્યની પ્રેમપૂર્વકની ભાવનાથી પૂરેપૂરી માનસિક ઉદારતા દાખવીને તેમની સાથે સમભાવ દર્શાવવાનો હોય. ને શક્ય હોય ત્યાં સક્રિયપણે પણ.

સમાજની સજ્જડ નિષ્પ્રાણ બની ગયેલી ઘરેડને તોડવાને કાજે એવા પ્રસંગો તો આપણી આંખ ખોલનારા નીવડે છે. સમાજ આવા જીવોનો તુચ્છકાર કે અવગણના કરીને તે પોતાના સત્ત્વને જ હણતો હોય છે. (‘જીવનપ્રવેશ’, આ.ર, પૃ. ૧૪૬-૪૮)

\*

\*

સ્વર્યંદ અને ભૂલથી કરીને અથડાઈ પડેલા જીવની ઊલટી વધારે કાળજી અને સંભાળ લેવાની હોય.

(‘જીવનપ્રવેશ’, આ.ર, પૃ. ૧૪૮)

\*

\*

ધર્મની સાચી ભાવનાના પ્રાકટ્યથી તો હદ્યની ઉદારતા

અને વિશાળતા વધુ ને વધુ કેળવાય.

(‘જીવનપ્રવેશ’, આ.૨, પૃ. ૧૪૭)

\*

\*

સહન કરી લેવું અને ગમ ખાઈ જવી તે સારું છે; પરંતુ મનમાં તે અંગે ચણચણાટી કરીને મન જો ગણગણતું રહે, તો તે ઘણું ખરાબ.

(‘જીવનપ્રવેશ’, આ.૨, પૃ. ૧૪૮)

\*

\*

જીવનમાં ‘બીજાં’ ને માનવાથી જ બધી પીડા ઉભી થાય છે. જીવનમાં એક આપણો ને બીજો કોઈ હોય તો તે આપણો રંગીલો નટવર, આધાત લગાડનાર પણ એ છે ને એમાંથી જીવનમાં પ્રેરાવનાર પણ એ જ છે.

(‘જીવનપ્રવેશ’, આ.૨, પૃ. ૧૬૬-૬૭)

\*

\*

માનવીનું સાચું ખમીર તો એ જ્યારે વિરોધી કે અથડામણના, સંઘર્ષના, પ્રસંગોમાં મુકાતો હોય છે, ત્યારે પરખાઈ આવે છે.

(‘જીવનપ્રવેશ’, આ.૧, પૃ. ૧૩૦)

\*

\*

દરિયામાં દોટ મારવાનું સાહસ, હિંમત કરીશું તો રાખણવાઓ તો રામ છે. એ તારે તોયે ભલે ને બુડાડે તોય ભલે. એના તારવામાંય ને બુડાડવામાંય આપણું કલ્યાણ હોય છે.

(‘જીવનપ્રવેશ’, આ.૧, પૃ. ૧૩૧)

\*

\*

જીવનનો સાચો આનંદ તો સર્વ કોઈ સ્થિતિમાં જીવતો રહે; ને જીવતો રહે એનું જ નામ આનંદ.

આશા-નિરાશા એ તો માત્ર પ્રભુભાવના અતુલ અને અપાર સમુદ્ર પરની લહરીઓ છે. સમુદ્રની ગંભીરતા કે મહત્ત્મા

તेथी ધવાતી નથી.

(‘જીવનપ્રવેશ’, આ.૨, પૃ. ૧૭૪-૮૧)

\*

\*

બીજા બધા પ્રકારની વૃત્તિ કરતાં ભગવાનના ભાવની જ  
વૃત્તિ ઉઠ્યા કરે તે જ જીવનનું સાચું કલ્યાણ છે.

(‘જીવનપ્રવેશ’, આ.૨, પૃ. ૧૮૨)

\*

\*

જગતમાં કોઈનું સ્થૂળ આપેલું કે લીધેલું લાંબું ટકતું  
નથી; પરંતુ એ કર્મ દ્વારા હદ્યમાં જે પ્રેમ પ્રગટે છે, તે તો  
સદાય જીવે છે.

(‘જીવનપ્રવેશ’, આ.૨, પૃ. ૧૮૨)

\*

\*

જીવનના ધર્મના પાલનમાં હક્ક આપોઆપ સમાઈ જાય છે.

(‘જીવનપ્રવેશ’, આ.૧, પૃ. ૧૪૩)

\*

\*

શ્રીભગવાનની ભાવનાનું અનુશીલન અને પરિશીલન  
શરૂશરૂમાં તો નામનું નામનું જ બન્યાં કરે છે; પણ તેમાંથીયે  
કામનું તે થઈ શકે છે. તે ભાવનાને જે સર્વ કર્મમાં જાગૃતિપૂર્વક  
વણી લેવાનો સહજમેળે અભ્યાસ કેળવતો રહે છે, એનું નામ  
સાચી સાધના.

(‘જીવનપ્રવેશ’, આ.૨, પૃ. ૧૮૬)

\*

\*

યમુનાની (મનની) ગતિ આપણે ઉલટાવવાની છે.

(‘જીવનપ્રવેશ’, આ.૩, પૃ. ૧૫૦)

\*

\*

ચેતનભાવનું સાત્ય અખંડ રહે તે જ્ય. મનને ચેતન  
પરત્વેના સદ્ભાવથી જે રીતે પ્રેરાયેલું રાખી શકાય તે જ્યયજ્ઞ.

(‘જીવનપ્રવેશ’, આ.૩, પૃ. ૧૫૦)

\*

\*

મનનો સહજ સ્વભાવ તો સંકલ્પવિકલ્પનો છે. એ એનું સહજ લક્ષણ છે. એને તપથી સ્થિર કરવાનું છે.

(‘જીવનપ્રવેશ’, આ.૩, પૃ. ૧૫૦)

\*

\*

માનવજીવ અથડાતાં કુટાતાં પ્રકૃતિમાં પ્રકૃતિનો વિકાસ સાધે છે ખરો, પરંતુ એ વિકાસ અજ્ઞાનમૂલક રહે છે.

(‘જીવનપ્રવેશ’, આ.૩, પૃ. ૧૫૧)

\*

\*

જીવનની આંતરિક ચેતનાશક્તિને માર્ગ દેવા જીવનમાં સર્વ સંજ્ઞોગો મળે છે. એ સંજ્ઞોગો ભલે કર્મના નિમિત્તે હોય, પણ તેનો આંતરિક હેતુ તો જીવનને ફળદાયી બનાવવાનો હોય છે.

(‘જીવનપ્રવેશ’, આ.૩, પૃ. ૧૫૪)

\*

\*

મૌન-એકાંતની સાધનામાં અનુષ્ઠાનોથી જીવ એકદમ કંઈ શિવ થઈ શકતો નથી, પણ એમાંથી શિવ થવાની શક્યતા સાંપડતી જતી હોય છે. (‘જીવનપ્રવેશ’, આ.૩, પૃ. ૧૫૫)

\*

\*

આધ્યાત્મિક જીવનનાં કેટલાંક લક્ષણોમાં સૂક્ષ્મ, સાત્ત્વિક વિનોદ પણ—જે આપણા લોકોમાં નજ્વા પ્રમાણમાં છે તે— એક લક્ષણ લેખાવું જોઈએ. (‘જીવનપ્રવેશ’, આ.૩, પૃ. ૧૫૬)

\*

\*

ભગવાનના ભાવને સમગ્રપણે, સર્વભાવે પામવો, અનુભવવો ને એનાં સર્વ પાસાંનો ઉકેલ અનુભવથી થઈ જતાં એની સંપૂર્ણતાને કેટલું પામી શકતું હશે, તે તો એક પ્રભુ જાણો !

સત્તસંગનું સેવન જીવનવિકાસની ધગધગતી ભૂખને લીધે જે થયાં જાય, ને અંતરના તેવા સુષુપ્ત રહેલા માત્ર સંસ્કારના

બળે જે થતું જાય, એ બન્નેના પ્રકારમાં ધણો ફેર છે.

(‘જીવનપ્રવેશ’, આ.ડ, પૃ. ૧૫૮)

\*

જે કંઈ વૃત્તિ સામાન્યપણે ઉઠે છે, તે ગતિ તો કરે જ. તે અંધિયાર થઈને પડી રહેતી નથી. પરંતુ ઉર્ધ્વગામી જીવનની સદ્ગૃત્તિમાં માનવીજીવે પ્રાણચેતના રેઝ્યા વિના તે ગતિમાં આવી શકતી નથી. આથી જ પ્રભુકૃપાથી પ્રેરાઈને જીવે પ્રાર્થનાભાવે પુરુષાર્થ કરવાની જરૂર રહે છે.

ધ્યેય ગમે, રુચે તે એક વાત છે ને તેમાં દઢાત્મકપણે પગરણ મંડાયા કરવાનું થયાં જાય તે વાત વળી જુદી છે.

(‘જીવનપ્રવેશ’, આ.ડ, પૃ. ૧૬૪)

\*

કોઈ પણ સંત કે ગુરુ ચમત્કાર કે જાદુથી કોઈ પણ જીવમાં ભગવાનનો ભાવ એકદમ તત્કાણ પ્રકટાવી શકતો નથી; એવી શક્યતા પણ નથી. (‘જીવનપ્રવેશ’, આ.ડ, પૃ. ૧૬૮)

\*

આપણે ભાગે આવેલું કર્મ અહંતા-મમતાથી દૂર રહીને ભગવાન-પ્રીત્યર્થે કરતાં થઈ જઈએ ને પાછું એને જ ચરણકમળે સમર્પણ કર્યા કરવાનો જીવંત અભ્યાસ કેળવીએ, તો જ ભગવાનની કૃપા કે એની લીલા—એ બધું હકીકત છે કે માત્ર ગણ્યાં છે, તે આપણને હૃદયમાં હૃદયથી સમજાય. (સાધના) કર્યા કરવામાં જ જેને આત્મપ્રસન્નતા ને આત્મસંતોષ છે, એવાને તે ક્યારે ફળશે, આજ કે કાલ એવા પ્રશ્ન ઊઠતા નથી; ને ધારો કે ઊઠ્યા કે ઊઠતા હોય તો તે મૂંજવતા તો નથી જ.

(‘જીવનપ્રવેશ’, આ.ડ, પૃ. ૧૬૮-૧૭૨)

\*

પ્રત્યેક કર્મ જો કંઈ ને કંઈ શીખવાના જાગૃત હેતુના જ્ઞાનથી થયાં કરે, તો પછી કર્મ એ માનસિક ભૂમિકાને કેળવવાની એક પ્રયોગશાળા જ ગણાય. ત્યાં કર્મનું મહત્વ નથી રહેતું, પરંતુ માનસિક તુલાને જ્ઞાનનો અનુભવ કેળવવા માટેનું કર્મ તો માત્ર સાધન છે. એટલે વધારે મહત્વ ત્યાં માનસિક તુલાને કેળવવાને આપવાનું બન્યાં કરતું હોવું જોઈએ.

(‘જીવનપ્રવેશ’, આ.૩, પૃ. ૧૭૪)

\* \* \*

આ સંસાર કે જગત મિથ્યા લાગતાં નથી. એ બધું સહેતુકપણે વાસ્તવિક છે. (‘જીવનપ્રવેશ’, આ.૩, પૃ. ૧૭૭)

\* \* \*

અમુક જ સંપૂર્ણ સનાતન સત્ય છે, તે વિનાનું બીજું કશું સત્ય નથી, એવી મડાગાંઠ કદી ન વાળી શકાય. જે જે કાળે સમાજને જેવી જેવી ને જેટલી જેટલી જરૂરિયાત પ્રકટે છે, તેવી તેવી રીતે તેવા તેવા મહાન આત્માઓ કાળપુરુષ તરીકે જ્ઞાનભાવે પ્રવર્તવાનું કર્યા કરતા હોય છે. એટલે તે કામ તે કાળ પૂરતું ને તે કાળના સમાજના પૂરતું તે કાળે પૂરું સત્ય હોય. કાળે કાળે સત્યનું સ્વરૂપ પણ બદલાતું રહેતું હોય છે.

શાસ્ત્રનો શબ્દ, મહાપુરુષનો શબ્દ અને અનુભવનો શબ્દ એની એવી એકવાક્યતા પ્રકટે એ તો અતિ ઉત્તમ છે, ચેતનમાં પ્રકટેલા આત્માનું કહેવું-કથવું એ જ્ઞાનભાવે હોવા છતાં કાળે કાળે તેમાં પણ શ્રેયાર્થને તે તે કાળની વિકાસની ભાવનામાં તે તે બધું તે તે રૂપે પ્રગટતું જણાતું હોય છે. એક કાળે જે અર્થ તેમાંથી પ્રગટતો હોય, તો બીજા કાળે તેમાંથી વધારે વિસ્તારવાળો બીજા પ્રકારનો અર્થ પણ પ્રકટી શકે છે.

(‘જીવનપ્રવેશ’, આ.૨, પૃ. ૨૨૫-૨૬)

\* \* \*

પ્રભુદત કહો કે કર્મપ્રારથ્ય કહો, જે ગરીબાઈ મળેલી, જ્યારથી તે જ્ઞાનતો થયો ને જ્યારે તે કઠતી લાગેલી, ત્યારે વિચારવામાં એ આવેલું કે જે ગુણ કેળવવા કેટલાય લોકોને કેટલોય પુરુષાર્થ કરવો પડતો અને તેમાંથી તેના સાચા અર્થમાં તે (ગરીબાઈ) જ્ઞાનભાવે સાંપડતી. તો પ્રભુકૃપાથી આ જીવને તો જે સહજ મળી છે, એ તો જીવનની મોંધી મૂડી કે લક્ષ્મી મળેલી છે; ને એ રીતે તો આ જીવ લક્ષ્મીવંતોમાં પણ વધુ લક્ષ્મીવંત છે. જીવનના તે તે કાળનાં મૂલ્યાંકનોને તેવી રીતે ઉલટાવવામાં આવા પ્રકારની વિચારસરણી પણ આપોઆપ સૂજ્યાં કરેલી, તે પણ પ્રભુની જ કૃપાનું પરિણામ છે.

(‘જીવનપ્રવેશ’, આ.ર, પૃ. ૨૨૮)

\* \* \*

આપણે માનતાં હોઈએ કે ધારતાં હોઈએ તે રીતે જ તેમ થાય તો જ એની કૃપા વરસે છે કે તો જ એ કૃપા કરે છે એમ પણ માનવાનું કશું કારણ નથી. કોઈ કહેશે કે એ તો માત્ર કલ્યના જ કહેવાય ને ? તો બીજુ રીતે ચિંતા કરવામાં પણ કલ્યના સિવાય બીજું શું છે ? માનવીમાત્ર જ્યાં ત્યાંથી કલ્યના કરીને જીવતો હોય છે. તો જે કલ્યના આપણને ઊંચે આણે ને સામાને પણ પ્રાબલ્ય આપવાને, સાંત્વન પ્રેરાવવાને અંતરથી પ્રેરણાત્મક બની શકે, તેવી કલ્યના શા માટે ન રાખવી ?

(‘જીવનપ્રવેશ’, આ.ર, પૃ. ૨૩૦-૩૧)

\* \* \*

કર્મનો પ્રતાપ, પ્રભાવ ને તેની અસર કંઈ માત્ર વ્યક્તિગત નથી હોતી; સમાજિગત પણ હોય છે. જગતમાં આપણે એકલાં હોવા છતાં અનંત સાથે સંકળાયેલા જ છીએ. વિચાર, વૃત્તિ, ઊર્મિ, લહરી, ભાવના ને ભાવ વડે બધાંય સાથે મળતાં કે

મળતાં હોઈએ છીએ ને એકબીજાની અસરમાં જાણ્યેઅજાણ્યે આવ્યાં જ કરતાં હોઈએ છીએ.

(‘જીવનપ્રવેશ’, આ.૩, પૃ. ૧૮૫-૮૬)

\*

\*

જીવનવિકાસના ભાવસહ પ્રભુપ્રીત્યર્થે સતત કર્મમાં રોકાયેલા રહેવું અને મનને તેવી રીતે રોકાયેલું રાખવું, એના જેવી જીવનની બીજી કોઈ ઉત્તમ કેળવણી નથી.

(‘જીવનપ્રવેશ’, આ.૩, પૃ. ૧૮૭)

\*

\*

‘સમજવું’ એ જીવનના અનુભવમાંથી ઉગો છે અને સમજાવવું એ તો એક જુદી જ કણા છે.

(‘જીવનપ્રવેશ’, આ.૨, પૃ. ૨૩૮)

\*

\*

જેમ તરવાની ભૂમિકા રચવાને ને તે કણા હસ્તગત કરવા માટે પાણીની જરૂરિયાત છે, તેમ આપણાને આ જગતની ને સૌની જરૂર છે; ને એ જ્ઞાન એમના એમના સંપર્કથી મેળવી શકાય એટલા પૂરતું એ જ બધું ‘સત્ય’ છે, ને પછી નથી—આપણા પૂરતું જ. પણ તે પછી પણ એનું અસ્તિત્વ નાશ પામતું નથી, માત્ર એનો ઉપયોગ બીજી રીતે છે.

(‘જીવનપ્રવેશ’, આ.૨, પૃ. ૨૪૫)

\*

\*

સ્વજનો કે સંબંધીઓને પત્ર લખતી વેળા કે તેમનો પત્ર વાંચતી વેળા આપણે એટલું હૃદયનું સાન્નિધ્ય ને સંપર્કનો અનુભવ જો એકબીજા ન અનુભવીએ તો આપણા હૃદયના પ્રેમમાં કંઈક ઊંઘપ છે એમ એનો અર્થ નીકળે.

(‘જીવનપ્રવેશ’, આ.૩, પૃ. ૨૦૨)

\*

\*

એકાન્તિક જીવનમાં મૌનને પ્રધાન સ્થાન છે. તેમાંય સમગ્ર આધારને પ્રભુને સમર્પણ કરવાની ભાવનાને ઉદ્દીપ્ત કરવાને માટે તો મૌનની ખાસ જરૂર છે.

બધી ઈન્ડ્રિયોને પોત પોતાના વિષયમાં રસ લેતી રોકી શકાય, ત્યારે જ સાચું મૌન થયું ગણાય અથવા બીજી રીતે કહીએ તો મૌન એટલે ઈન્ડ્રિયોને પોતપોતાની પ્રાકૃતિક કિયાઓમાંથી ઉપરામ પમાડવાની કિયા.

(‘જીવનપ્રવેશ’, આ.ર, પૃ. ૨૫૭-૫૮)

\*

\*

સંયમ એટલે જીવનમાં આચારાઈ રહેલા ભાવોની સીમા. સંયમ એટલે પોતાના જીવનનું રક્ષણ કરવા યોજાયેલી જીવંત ભાવાત્મક આચારની દીવાલ.

જે સંયમી જીવન જગત પ્રત્યે કઠોર કરી મૂકે છે, તેવો સંયમ યથાર્થ નથી. જે સંયમને વારંવાર વ્યક્ત થવાપણું હોય છે તે સંયમ જ નથી. (‘જીવનપ્રવેશ’, આ.ર, પૃ. ૨૬૪)

\*

\*

લાગણીઓને યથેચ્છપણે વ્યક્ત થવા દેવાથી તેની શક્તિ કીણ થાય છે, ને જીવનવિકાસના કાર્યમાં તે નિરથી નીવડે છે.

જીવનની કોઈ પણ શક્તિને હેતુપૂર્વક સીમાબદ્ધ કર્યા સિવાય, તેને અમુક વિશેષ વસ્તુનો અભ્યાસ કરાવી ન શકાય. અસંયમી લાગણી ને વૃત્તિના પ્રાગટ્યમાં નિર્બળતા પોષાય છે.

(‘જીવનપ્રવેશ’, આ.ર, પૃ. ૨૬૬-૬૭)

\*

\*

કપડાં અને શરીર પાણીથી ધોવાથી જેમ તેમનો મેલ જતો રહે છે, તેમ ઈશ્વરને હૃદયથી પ્રાર્થના કરવાથી મનનો ને

અંતઃકરણનો મેલ સાફ થાય છે.

(‘જીવનપ્રવેશ’, આ.૨, પૃ. ૨૭૧)

\*

\*

સાહિત્યની ભાવના જે જીવનના ઉચ્ચ આશયને ગતિમાન કરવાને શક્તિમાન ન થાય, જનતાને પોતાની જીવનનિષ્ઠામાં દૃઢ ન કરાવી શકતી હોય, તો એને ઊંચું સાહિત્ય કેમ કરીને કહી શકાય ?

(‘જીવનપ્રવેશ’, આ.૨, પૃ. ૨૭૮)

\*

\*

માથે ઘણનો માર પડે એટલે ગમે તેવી વિકટ કે પ્રતિકૂળ સ્થિતિમાં મુકાઈએ, તોપણ જે ભાવના ઉગેલી હોય તે તેના યથાર્થપણામાં ઉલટી વધુ સતેજ અને શક્તિશાળી બને ને એવું પ્રત્યક્ષ અનુભવાય તો જ તે ભાવના સાચી, એમ પ્રમાણવું.

(‘જીવનપ્રવેશ’, આ.૨, પૃ. ૨૮૨)

\*

\*

હૃદયથી જે એકને વળગીને એકને પામે છે, તે અનંતને પણ પામી શકે છે.

(‘જીવનપ્રવેશ’, આ.૨, પૃ. ૨૮૭)

\*

\*

દાન કરતી વેળા જેને દાન કરતા હોઈએ તેના પરત્યે હૃદયથી ભક્તિ પ્રગટે અને આપણાં કરણો ઉદારતા, વિશાળતા વગેરે ભાવો જ્ઞાનપૂર્વક અનુભવે તથા આપણી સંકુચિતતાની વાડો તૂટે, તો તેવું કરેલું દાન જીવનવિકાસને ફળાવે ખરું. દાન કરવામાં પ્રાયશ્ચિત્તનો ભાવ જીવતો તે તે કર્મ રહી શકે તો દાનનો અર્થ છે. દાન કરવાનો તો આપણો ધર્મ છે. એમાં કલ્યાણ થવાની ભાવના રહે તો તે પણ યથાર્થ નથી.

(‘જીવનપ્રવેશ’, આ.૧, પૃ. ૨૨૩-૨૪)

\*

\*

ખાલી ગુરુમંત્ર લીધાથી કશું વળતું હોતું નથી. એ પણ એક પ્રકારની અજ્ઞાનમૂલક બ્રમજા છે. જ્યાં સુધી જીવનનું મૂળ વહેણ બદલાઈ ન જાય, ત્યાં સુધી એવા હજારો ગુરુમંત્ર લીધેલા વર્થ છે. ('જીવનપ્રવેશ', આ.૨, પૃ. ૨૮૦-૮૧)

આશા, તૃષ્ણા, કામ, કોધ, મદ, મોહ, લોભ, મત્સર, કામના, વાસના, રાગદ્રેષ, અહંકાર વગેરે બધાંને કાઢવાનું કે મોળાં કરવાનું જ્યાં સુધી, જંખનાપૂર્વકનું ઊર્ગી શકતું નથી, એવી તૈયારી જે જીવની ચાહીને થઈ શકતી નથી, એવા જીવને સાક્ષાત્ ભગવાન પણ ઊંચે ચઢાવી શકવા સમર્થ નથી.

(‘જીવનપ્રવેશ’, આ.૧, પૃ. ૨૨૫)

\* \* \*

ભૂત વળગે તે તો કોઈ કાઢી શકે, પરંતુ જે કોઈ એવા ચેતનમાં પ્રગટેલા છે, એવા આત્માઓ કોઈને ગળે વળગેલા છે, તે તો છૂટી શકે તેવું નથી. ('જીવનપ્રવેશ', આ.૨, પૃ. ૨૮૫)

\* \* \*

વૃત્તિ એ તો શક્તિનું સ્વરૂપ છે. સંસારી જીવની વૃત્તિનું મૂળ તો અજ્ઞાનમાં છે; જ્યારે કોઈ દિવ્ય, ઉચ્ચ આત્માની વૃત્તિનું મૂળ તો જ્ઞાનમાં રહેલું છે. આથી બન્નેની વૃત્તિના મૂળમાં ભૂમિકામાં ફરક હોવાથી, તે બન્નેને એક જ રીતે જોવાની, સમજવાની, માપવાની, અનુભવવાની મનીષા રખે આપણે રાખીએ !

અજ્ઞાની, સંસારી જીવની વૃત્તિ વધારે બંધનકર્ત્ત્વ ને રાગદ્રેષને વધારનારી છે; જ્યારે જ્ઞાની જીવાત્માની ભાવના મુક્તિપ્રદેશે પ્રવર્તાવનારી હોય છે. ('જીવનપ્રવેશ', આ.૨, પૃ. ૨૮૭)

\* \* \*

ઉપયોગ એ જ જ્ઞાન છે. જેમાં ને તેમાં ઉપયોગના હેતુના જ્ઞાનને હૃદયસ્થ દઢાવીને વર્તીએ. ઉપયોગ એટલે માત્ર કંઈ સ્વાર્થ

જ નહિ.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૧)

\*

\*

સાધન ઉત્તમમાં ઉત્તમ હોય, પરંતુ જો તે ઘરેડ પ્રમાણે અન્યાં કરે તો તેમાંથી કશું ચેતન મેળવી શકાતું નથી.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૧)

\*

\*

ગુરુ જે જે કંઈક આપણને સૂચન કરતા હોય તો તે કંઈ અમથું અમથું હોતું નથી. તેમાં કંઈક રહસ્ય અને હેતુ હોય છે. તે સૂચન પાછળ તેના હદ્યનો ભાવ પણ હોય છે. તે સૂચનનો અમલ પ્રેમભક્તિજ્ઞાનભાવે થયાં કરતો હોવાથી એની સ્મરણભાવના પણ દિલમાં પ્રગટ્યાં કરે.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૪)

\*

\*

બીજાનાં સૂચનોનું પણ દિલથી પાલન કરવાની ઉત્કંઠા જો અન્યાં કરે—અલબત્ત, વિવેક વાપરીને—તો તેમનો હદ્યનો સદ્ગ્રાહી આપણને મળ્યાં કરે છે.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૪)

\*

\*

જે કંઈ કરીએ તે તેવી રીતે માત્ર કરવાપણા માટે નથી કરવાનું, પરંતુ તેમાંથી ભાવ-શક્તિ પ્રગટાવવા કાજે તે તે કરવાપણું છે. જીવભાવે દ્યા એટલે અહંકાર.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૭)

\*

\*

ભાવનાને ટકાવી રાખવાને માટે, તેને વધુ તેજસ્વિત અને શક્તિશાળી બનાવવાને માટે, વધારે એકાગ્ર, કેન્દ્રિત કરવાને

માટે નામસ્મરણ એ જબરદસ્ત સાધન છે.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૮)

\*

\*

મળેલાં કર્મને સંપૂર્ણ રીતે, ઉત્તમપણાથી આપણા પોતાના વિકાસની ભાવનાથી પ્રેરાઈને, જીવનને વિકસાવવા, પ્રભુપ્રીતથ્યે કરવાનાં છે. (‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૮-૧૦)

\*

\*

બીજા કશાનો અંતરાય નથી; જે કંઈ અંતરાય છે, તે સાચા પ્રકારનો દઢ, મક્કમ નિશ્ચય પ્રગટેલો હોતો નથી તે છે.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૧૦)

\*

\*

આપણે કંઈ કશાનો સામનો કરવાનો નથી; સામનો જે કરવાનો છે તે તો અંતરમાં આંતરિક વૃત્તિઓનો.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૧૦)

\*

\*

સદ્ગુરુ માટેનો હૃદયનો ભક્તિભાવ કંઈ કશાથી ઓસરી જવો ન ઘટે; તો જ તેવો ભાવ ઉપયોગનો છે.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૧૩)

\*

\*

ભાવ ભાવને ખેંચે છે ને ભાવને પ્રગટાવે છે. હૃદયના ભાવનું બળ જેવું તેવું નથી. (‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૧૫)

\*

\*

ગુરુનું ભાવભર્યું પુણ્યસ્મરણ તે પ્રત્યક્ષ સંજીવની છે.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૧૭)

\*

\*

બીજાંઓનું જે જે નકારાત્મક હોય તે આપણા કાને, આંખે, મને કે એમ જે ચઢે તેને વાણીથી કે બીજી કોઈ પણ રીતે બીજાં

કોઈ આગળ વ્યક્ત કરવાનું હોય નહિ. નકારાત્મક મોજાંનાં વર્તુલો આ સંસાર-સરોવરમાં જેટલાં ઘટાડી શકાય તેટલાં ઘટાડવાં રહ્યાં. આમ થવાવા માટે વાણી ઉપર ભારે સંયમની જરૂર રહેશે. એવાં નકારાત્મક મોજાંનો વિસ્તાર થવા દેવો તે એક પ્રકારની નિંદા છે. નિંદાનો પણ રસ જીવને હોય છે. જગતમાંનાં ઘણાં વેરજેરો આ નિંદારસથી પોષાઈ રહેલાં છે ને વૃદ્ધિ પણ પામતાં રહે છે. એમાંથી જીવનવિકાસ ચાહનારે ઊગરી જવું જ રહ્યું.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૧૮)

\*

\*

કોઈ પણ જીવ વિષે બીજા કોઈ પણ જીવ આગળ નકારાત્મક ઉચ્ચારાયું તો સમજવું કે હજુ બધાં પરત્વે જ્ઞાનપૂર્વક આચરવાની સદ્ગ્ભાવની કેળવણી વિષેનું આપણને મહત્વ મનહૃદયમાં ઉત્ત્યું નથી. એવો જ્ઞાનાત્મક સદ્ગ્ભાવ રાખવાથી આપણને મનમાં શાંતિ, સમતા, પ્રસન્નતા, સરળતા આદિની ભૂમિકા જીવતી રહ્યાં કરે છે. (‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૧૯)

\*

\*

જે જે રીતે, જેવું જેવું આપણે સાંભળ્યું, વિચાર્યું, વર્ત્યું, બોલ્યાં, ને જેવી જેવી વૃત્તિ તે તે પણે આપણી રહી, તે તે રીતનું તેવું તેવું, તેવી તેવી વૃત્તિનું જીવન આપણા માટે આપણે નિર્માણ કરી ચૂક્યાં એમ નિશ્ચે જાણવું, સમજવું ને માનવું.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૨૦-૨૧)

\*

\*

જીવકક્ષાનું નકારાત્મક જે હોય, તેવું જીવનમાં નિર્માણ નથી જ થવા દેવું એવો મક્કમ નિર્ધાર જે જીવે કરેલો છે, તેવો જીવ કંઈ પણ કશો નકારાત્મપણાનો અંતરમાં કે બહારથી

અનુભવ થતાં અંતરથી પૂરો સાબદો બની જગ્રત બને છે.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૨૧)

\*

\*

ગમે તે થાય તેમ છતાં જીવનનાં નકારાત્મક પાસાંને તો આંખ, કાન, મોં ન ધરવાં તે ન જ ધરવાં.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૨૧)

\*

\*

સાધકે જ્ઞાનભક્તિપૂર્વક જીવનવિકાસનાં દશ્ટિ, વૃત્તિ ને વલણ પ્રગટાવી પ્રગટાવી વર્તવું, વિચારવું, કલ્યવું, સમજવું, માનવું, બોલવું વગેરે કરવું. જીવનની એ સાચી કમાણી છે.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૨૨)

\*

\*

સાધનાનો યજ્ઞ કંઈ જેવો તેવો નથી. એવા જીવનવિકાસાર્થે આદરાયેલા યજ્ઞમાં સતત આહૃતિ આપ્યાં કરવી પડશે. જે તે બધું હોમવા જેવું હોય, તે પ્રેમથી હોમવું પડશે ને હોમાઈ જવું પડશે.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૨૨)

\*

\*

મૌનનું આંતરિક વ્યાપક સૂક્ષ્મ સ્વરૂપ પ્રગટ્યાં વિના મન નિઃસ્તબ્ધ-નીરવ દશાને કદી પણ પામી શકતું નથી. મન નિસ્તરંગ દશાને જ્યાં સુધી ન પામે ત્યાં સુધી મનની મૂળ શક્તિ વ્યક્ત થતી અનુભવાઈ શકતી નથી. (‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૨૪)

\*

\*

જીવકક્ષાનું પુણ્ય પણ બંધનકારક.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૨૬)

\*

\*

મનાદિ કરણો ભાવનાથી જ્યારે તરબોળ રહ્યાં કરે છે, ત્યારે બીજી કોઈ જતના વિચારો પ્રવેશી શકતા નથી ને ઉઠી પણ શકતા નથી. તેવી દશામાં નામસ્મરણ આદિ સાધન ભાવની એકતાનતાથી, એકાગ્રતાથી સારી રીતે થયાં કરે છે. ભાવની એકાગ્રતા જમતાં જમતાં તેમાંથી કેન્દ્રિતતા જન્મે છે. ભાવની કેન્દ્રિતતા થતાં, ને તેની સંપૂર્ણતાની ટોચે પ્રગટતાં ને તે દશામાં લાંબા ગાળા સુધી સ્થિરપણે ટકતાં—જીવતી રહ્યાં કરતાં—તે પછી તેનો વિસ્તાર પણ થવા માંડે છે. સદ્ગુરુનું ચેતનવંતુ પવિત્ર સ્મરણ હૃદયમાં હૃદયથી પ્રગટાવી પ્રગટાવી તેના હૃદય સાથે આપણા હૃદયનું ભાવભક્તિથી એકતાનતાભર્યું અનુસંધાન કર્યા કરીને, તેવું જ્ઞાનયુક્ત તાદાત્મ્ય સાધી સાધીને, હૃદય હૃદયની એકતા જ્યારે ઉદ્ભવે છે, તેવી વેળા જે જીવંત ચેતનયુક્ત કેન્દ્રિતતા પ્રગટે છે, તે સ્થિતિ જ્ઞાનદશાના અનુભવની ભૂમિકારૂપે હોય છે.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૨૭)

\*

\*

શ્રીસદ્ગુરુના હૃદયના ભાવને જ્યારે સાધક પ્રેમભક્તિ વડે કરીને હૃદયમાં હૃદયથી પકડતો બની શકે છે, તે વેળાથી સાધકના જીવનનો વિકાસ ઘણો ઝડપી બની જતો હોય છે.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૨૮)

\*

\*

જીવદશામાં પ્રત્યેક ઊંચી કે નીચી કક્ષામાં ઉપભોગ એ તો મૃત્યુ છે ને ઉપયોગ એ જ્ઞાન છે.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૨૮)

\*

\*

આંતરિક કરણોની શુદ્ધિનો અભ્યાસ જીવતો થયા વિના

સાધના સર્વણ થવી શક્ય નથી. ('જીવનપોકાર', આ.૪, પૃ. ૩૧)

\*

\*

સ્થૂળ પ્રાણ પોતાની અસર મનાદિ ઉપર પહોંચાડીને બુદ્ધિને  
ભમાવી દે છે, ચિત્તમાં દોષ ઉત્પન્ન કરે છે, મનને ચકડોળે ચઢાવે  
છે એટલે વિચારની પૂરેપૂરી શુદ્ધતા આપણામાં રહી શકતી નથી.

('જીવનપોકાર', આ.૪, પૃ. ૩૧)

\*

\*

ફૂલમાંની મધુરી સુવાસમાં ને તેના સૌંદર્યમાં રસગ્રહણશક્તિ  
દ્વારા ભગવાનના ભાવને જ સાધકે અનુભવવાનો છે. ત્યારે  
સ્થૂળ હંદ્રિયોને તૃપ્તિ પમાડવાનો જ્યાલ જાગ્રત ન થવો ઘટે.

('જીવનપોકાર', આ.૪, પૃ. ૩૩)

\*

\*

સમજણની પણ મડાગાંઠો હોય છે, ને તેમાંથી પણ મુક્તિ  
મેળવવાની છે. ('જીવનપોકાર', આ.૪, પૃ. ૪૧)

\*

\*

કોઈ પણ કશી બાબતમાં કંઈ કશાનો આગ્રહ ન રહે તે  
સાધના કાજે ઉત્તમ છે, અંતે તો સારા કે ઉત્તમના આગ્રહથી પણ  
પર જવાનું ને થવાનું છે. ('જીવનપોકાર', આ.૪, પૃ. ૪૧)

\*

\*

આપવામાં જે આનંદ છે તે લેવામાં નથી. આપવાનું  
જીવનઘડતરમાં મદદરૂપ બનતું હોય છે.

('જીવનપોકાર', આ.૪, પૃ. ૪૩)

\*

\*

જે જે કારણથી દિલની શ્રદ્ધા વધતી રહેતી હોય, તેને  
હદ્યમાં પ્રેમભાવે ફરી ફરીને વિચારવું ને ચિંતવતાં રહેવું.

('જીવનપોકાર', આ.૪, પૃ. ૪૪)

\*

\*

બેળે બેળે, ગ્રાસીને, કંટાળીને, નાધૂટકે કામો કરવાની ટેવને ફગાવી દેવી પડશે. વેઠ પેઠે, ઉતાવળમાં, અધીરાઈથી, યદ્વાતદ્વા, આડાંઅવળાં, અભ્યવસ્થિત, રઘવાટભર્યા, કચવાટભર્યા ને ભાવ વિનાનાં કર્મો કર્યે ઊલટો બોજો વધે છે.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૪૭)

\*

\*

ખચકાતાં ખચકાતાં કંઈક કશું કોઈનેય આપવાનું બન્યું તો તેવા આપવાપણાથી કશું એની યોગ્યતામાં ફળી શકતું નથી. આપવામાં જો કંઈ કશી ગણતરી, માન્યતા, અપેક્ષા કે આડીઆવળી સમજણ પ્રગટેલી રહી તો તેવું અપાયેલું મિથ્યા નીવડી શકે છે. જે કંઈ આપવાનું હોય તે એક યજ્ઞભાવના તરીકે પોતાના વિકાસાર્થે ને શુદ્ધ, નિર્મળ ભાવના પ્રગટાવવા કાજે તેમ કરવાનું હોય.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૪૮)

\*

\*

જગત એટલે જ ફેરફાર. તો એવા ફેરફારને જીવનમાં જ્ઞાનપૂર્વક આપણે આવકારીએ અને સ્વેચ્છાએ આપણા જીવનનો સમૂળગો ફેરફાર પ્રભુકૃપાથી પમાડતાં રહીએ.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૪૮)

\*

\*

પ્રત્યેક વૃત્તિ ગતિ કરીને આકાર ધારણ કરતી હોય છે તો જીવનવિકાસ કાજે પ્રગટેલી ભાવના આપણા વર્તનબ્યવહારમાં વ્યક્ત થયા વિના કેમ રહી શકે ?

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૫૧)

\*

\*

ઇંક્રિયોની લાલસાઓને જીતવાનો ઉપાય તે તે વેળા ગદ્દગદ ભાવે ને તેની વેદનાથી ઉંખતા અને સાલતા હદયે, આર્ત અને

આર્દ્ર ભાવે શ્રીહરિની પ્રાર્થનામાં રહેલો છે. સતત ભાવનાભર્યાનામસ્મરણનું એકધારું દિલમાં દિલથી રટણ તે વેળા થયાં જવું ઘટે. એના જેવો બીજો કોઈ સરળ ઉપાય નથી.

આપણે શ્રીહરિને ભજવાનો છે,— તે પણ તેના પ્રેમની જ ખાતર. (‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૫૨)

\*

\*

આપણે માની લીધેલાં સુખદૃષ્ટિની સમજણમાં જો પડ્યાં જ રહેવાનું કરવું હોય તો જીવનવિકાસની આશા છોડી દેવી.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૫૫)

\*

\*

સંસારવહેવારવર્તનની રોજની નિર્જવ ઘટમાળમાં જ જો પરોવાઈ રહેવાનું હોય, તો પછી થઈ રહ્યું; એ સંસારની એવી ઘટમાળ ભલે રહી, કિંતુ આપણે તેમાં યાંત્રિક ઘટમાળરૂપે થઈ જવાનું નથી. આપણે તો જાગતાં રહેવાનું છે.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૫૬)

\*

\*

જ્ઞાનભક્તિપૂર્વકનું આત્યંતિક પૂરેપૂરું આત્મસમર્પણ થયું ન હોય, ત્યાં સુધી આપણા પોતાના અંગત પુરુષાર્થની ઘણી જરૂર રહે છે. (‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૬૨-૬૩)

\*

\*

બીજાંને આગળ આણ્યાં કરવાનું પ્રેમભાવે જો આપણે કરીશું તો તેમાં આપણું કશું જ બગડી જવાનું નથી, ઊલટો લાભ જ છે. અહ્મુક ટાળવાની એ તાલીમ બની શકે છે.

કોઈનાયે પરતે નકારાત્મક વલણ ઉપજે એટલે કે જો તેનું નરસું આપણું મન વિચારવાનું કરે કે, તુરતાતુરત તે જીવના ઉત્તમ પાસાને યાદ કરવું. (‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૭૪-૭૫)

\*

\*

જગતમાં અને સંસારવ્યવહારમાં ન્યાય-અન્યાયનાં પાસાં રહેલાં હોવાથી આપણને ન્યાય પણ થાય ને અન્યાય પણ થાય; એવું બનતું તો રહ્યાં કરવાનું જ. વળી આપણને જે અન્યાય થતો દેખાય છે, તેવો સાચેસાચ અન્યાય કરવાનો હેતુ સામાનો ન પણ હોય. આપણે તો હરકોઈ સ્થિતિમાં સદ્ગ્રાવ જ સેવવાનો હોય.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૭૬)

\*

\*

કંઈ કશામાં જીવનને વેડફી દેવાનું થતાં આપણે કાળજે અરેરાટી-ચિરાડો પડવો જોઈશે. કશીક ક્રીમતી વસ્તુ કે પાંચ-પચાસ રૂપિયા ખોવાતાં જે લાગણી થતી હોય છે, તેથી અનેકગણી વધુ ને તેના તીવ્રતમપણામાં તે પણ, તે વેળા આપણને થવી જોઈશે.

માનવીને સ્થૂળ ધનનું નુકસાન થતાં જે અરેરાટી થાય છે તેના સોમા ભાગનીયે સારું જીવન—મહામૂલું જીવન—વેડફાઈ જતાં તે લાગણી નથી થતી. આવી છે માનવીની કમનસીબી !

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૭૭)

\*

\*

વ્યવસ્થા એક વસ્તુ છે ને ઘરેડ બીજી વસ્તુ છે. બન્નેમાં ઘણો ફરક છે. વ્યવસ્થા પ્રગટાવીને માનવી તેને પણ પાછો ઘરેડરૂપ બનાવી દેતો હોય છે. જે તે કંઈ વ્યવસ્થાના આકારમાં મૂકી તે તે પછી પાછું ઘરેડ પ્રમાણે જ તે કરતો હોય છે. આ બરાબર નથી. જે કંઈ થયાં કરે, તેમાં આપણા જીવનની ભાવના થનગનતી, નૃત્ય કરતી હોવી જોઈશે.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૮૧-૮૨)

\*

\*

બીજી વ્યક્તિ તરફથી કોઈનીયે નકારાત્મક વાત નીકળતાં, તેવી વેળાએ આપણે કળા વાપરીને ચાલતી વાતને એવો તો

પલટો અપાવીને કોઈ બીજા ઊંચા ભાવનાના પ્રસંગના વલશમાં તેને ફેરવી નખાવવાનું કરવું જોઈએ. સામા જીવની ભાવનાને પણ તેજસ્વિત બનાવવાનું થાય, એવી રીતે વાતનો પ્રકાર ઉપજાવવાની કળા આપણામાં પ્રગટેલી હોવી જોઈશે.

દુન્યવી, સાંસારિક, કૃત્યક વાતો નધૂટકે સાંભળવી જ પડે તેવી નાજુક પરિસ્થિતિની વેળાએ તે વાત સાંભળવા છતાં સાંભળવાનું ન બને એમ મનને ત્યારે નામસ્મરણ-ધારણામાં બુડાડી દેવાનું પ્રભુકૃપાથી ચેતીને, જાગીને, થયાં કરતું હોય તેવી ટેવ આપણે પાડવી જોઈશે.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૮૨-૮૩)

\* \* \*

જેમ કાંટાથી કાંટો નીકળી શકે છે, જેમ ઝેર ઝેરની માત્રાથી ટળી શકે છે, તેમ જીવનનું સંસારીપણું જીવનવિકાસની ભાવનાને સંસારમાં તેની યથાર્થતા વડે જીવવાથી ટળી શકે છે.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૮૪)

\* \* \*

કર્મનાં પ્રેરક બળો પ્રાણ, અહમ્ આદિની વૃત્તિ કે વલશ ન હોય, પણ જીવનવિકાસની ભાવના જ તેનું પ્રેરક બળ હોય, ને તે કર્મ દ્વારા જીવનવિકાસક પ્રેમભાવ પ્રગટ્યા કરતો હોય, તો તેવાં કર્મો યજ્ઞસ્વરૂપ છે. (‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૮૧)

\* \* \*

સાત્ત્વિક ગુણ પ્રગટાં સાધનાના ભાવનો વિકાસ સહજપણે થયા કરતો રહે છે. (‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૮૪)

\* \* \*

ઘણા લોકો ‘એ(પ્રભુ યા ગુરુ) બધું જ જાણો છે, એ અંતર્યામી છે, એને શું કહેવાની જરૂર છે?’ એવા જે ઘ્યાલો રાખે છે, તે

અજ્ઞાનમૂલક ને બ્રહ્મજ્ઞાત્મક છે. અંતર્યામિત્વની હકીકત યથાર્થ હોવા છતાં સાધકે તો આત્મનિવેદનરૂપે જે તે બધું કહેવું કે લખવું ઘટે છે. પ્રાર્થનાનો આશ્રય લઈને ચેતનાની કૃપાશક્તિને પોકાર્યા કરવાની રહે છે.                            ('જીવનપોકાર', આ.૪, પૃ. ૧૧૦)

\*                                    \*

પોતાથી થતી પ્રાર્થના હૃદયપૂર્વકની હોવા છતાં જ્યારે તે ફળતી ન અનુભવાય, ત્યારે જીવે પોતાની જાતને-મનને-પ્રાણને, ચિત્તને, બુદ્ધિને, અહ્મુને તેનાં અનેક પાસાંઓમાં વળી વળીને તપાસી લેવાં ઘટે. ક્યાંક જરૂર કવાણું હશે જ.

('જીવનપોકાર', આ.૪, પૃ. ૧૧૧)

\*                                    \*

સંસારવહેવારવર્તનમાં જ્યાં જ્યાં આપણાને અન્યાય થતો લાગે, ત્યાં ત્યાં અન્યાયને અન્યાય તરીકે તો કદી પણ ન સ્વીકારવો. પ્રભુનો એની પાછળ આપણાને ઘડવાનો હેતુ પ્રીછવો. અન્યાય થયો છે એવું લાગે છે તો આપણાં મન, બુદ્ધિ, પ્રાણ ને અહ્મુને. તેઓ હજુ પૂરી સમતામાં, તટસ્થતામાં શાંતિયુક્ત દશામાં ક્યાં પ્રગટેલાં હોય છે, કે તેમનો તેવો તોળેલો તે અંગેનો ન્યાય યોગ્યતાવાળો હોય ? મનાદિએ જે વિચાર્યુ હોય તે તદ્દન ખરું જ છે એમ કેમ કરીને ગણી શકાય ? દરેક પ્રસંગને અનેક બાજુઓ હોય છે. એટલે તેને તેની સમગ્રતાથી અવલોકન કરવાનું આપણાથી કેવી રીતે બની શકે? માટે માનેલા અન્યાયને અન્યાય તરીકે ગણવાનું થતાં તો આપણે જ કદાચ બીજા કોઈને અન્યાય કરી બેસીશું.

આપણે ભલે કદાચ અન્યાયના ભોગ બની જતા હોઈએ, પણ આપણાથી કોઈને અન્યાય ન થઈ જાય તેમ જ કોઈને અન્યાયી માની ન લેવાય તેની પૂરી કાળજી રાખવાની છે.

આપણું અહમ્ અમથું અમથું જરાક પણ ઘવાતાં એની કિયા શરૂ થઈ જતી હોય છે. અહમ્-પણે પ્રકૃતિનું કાર્ય થતું હોય છે ને એની પાછળ પ્રકૃતિની પ્રેરણા છે. આપણી એવી અહંતા ટળે એ સાધનામાર્ગ માટે ઘણું મોટું ને જીવ કાજે ભારેમાં ભારે મુશ્કેલ કાર્ય છે; પરંતુ તે કર્યા વિના છૂટકો નથી..

આશાઓ, ઈચ્છાઓ, કામનાઓ, તૃષ્ણાઓ આદિનું સ્હુરણ થતું ભલે દેખાય, પણ ગતિમાન થતું ન અનુભવાય ત્યારે જાણવું કે આપણું અહમ્ નરમ પડેલું છે.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૧૨૧ થી ૧૨૩)

\* \* \*

પ્રાર્થના કરવાથી જે બાબતમાં પ્રાર્થના કરતા હોઈએ તે ફળે કે ન ફળે તે મહત્વની બીના નથી. પરંતુ જેમ જેમ પ્રાર્થનાનો ભાવ આપણા હદ્યમાં પ્રત્યક્ષપણે જીવતો બન્યા કરતો હોય છે, તેમ તેમ શ્રીભગવાનના ભાવ સાથેનો આપણા અંતરનો સંબંધ બંધાતો જતો હોય છે, તે એક મહત્વની હકીકત છે. (‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૧૩૪)

\* \* \*

કર્મની યોગ્યતા જોવા કરતાં ઈદ્રિયો ને મનાદિ કરણોની પાત્રતા ને શ્રેષ્ઠતા યોગ્ય પ્રકારની થાય, તે પરત્વેનો આપણો જીવતોજાગતો ઝોક હેતુપૂર્વકનો વધે તે ઘણું જરૂરનું છે.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૧૪૦)

\* \* \*

આજકાલ વ્યક્તિસ્વાતંત્ર્યને બદલે વ્યક્તિસ્વર્ચંદ્રતા સમાજમાં પ્રવર્તતી જણાય છે.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૧૪૩)

\* \* \*

જીવને અનુભવ તો મળે છે, પણ તે પોતે પોતાની પરિમિતતાને પરિણામે એને તે પરિમિત બનાવી દે છે અથવા એને તે તે સ્વરૂપે જ પારખી શકાતું હોય છે.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૧૫૪)

\*

\*

હૃદયના પ્રેમભાવનો સ્પર્શ તો અણુએ અણુમાં પ્રગટતો હોય છે, આપણા મળવાના રણકારમાં, આપણી બોલીમાં, આંખમાં, ચાલમાં, વર્તાવમાં પ્રગટી જતો હોય છે. એનો સ્પર્શ થયા વિના રહી શકતો નથી. (‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૧૫૬)

\*

\*

સર્વ પ્રકારનાં થતાં રહેતાં કર્મનાં ફળની કામનાઓનો ને કર્તૃત્વબુદ્ધિનો જો સમજણપૂર્વક સહજમેળે સમૂળગો ત્યાગ થતો રહે, તો તો સમતા આપોઆપ આધારનાં કરણોમાં સ્થપાતી અનુભવી શકાય. આવી સમતા સ્થપાતાં જ પ્રભુની ચેતના આપણા આધારમાં ઠામઠેકાણે પ્રગટવાની, ને તે પોતે કાર્ય કરવાનો આરંભ કરી દેવાની. (‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૧૭૫)

\*

\*

સદ્ગુરુની ભક્તિ માત્ર તેમના શરીરની સેવામાં પર્યાપ્ત થઈ જતી નથી; પરંતુ ગુરુની ચેતનાત્મક ભાવનાની ધારણા આપણા હૃદયમાં પળેપળ જીવતી રહ્યાં કરે; તેવી ધારણાથી આપણે જેમાં ને તેમાં ઊંચે તર્યારી કરવાનું પ્રત્યક્ષ તે તે વેળા જ્ઞાન પ્રગટ્યાં કરી તે તે કર્મ યજ્ઞભાવે થયાં કરે, તે પાછાં પ્રભુચરણકમળે સમર્પણ થયાં કરે ને તે બધું પ્રભુપ્રીત્યર્થે બન્યાં કરે,—એવું એવું જ્ઞાન તે તે કર્મ કરતી વેળા આપણામાં જીવતું રહ્યાં કરે, તે જ સદ્ગુરુની સાચી પ્રેમભક્તિછે. જેના વડે આપણા જીવનનું યોગ્ય સાચું ઘડતર

થયાં કરે તે સદ્ગુરુની પ્રેમભક્તિ છે.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૧૮૪)

\*

\*

પરમપ્રાપ્તિના પુરુષાર્થની તોલે જગતમાં બીજો કશો પણ  
પુરુષાર્થ આવી શકે એમ નથી. એવા પુરુષાર્થના હાઈમાં  
પ્રભુકૃપાશક્તિ વસેલી છે જ.

\*

\*

સદ્ગુરુની સાચી પિછાન તો કદી બાધ્ય રીતે થતી હોતી જ  
નથી. એ તો આગળ જતાં જતાં અંતરમાં અંતરથી થયાં કરતી  
હોય છે. એવો પ્રગટેલો અનુભવ તે જ સાચો અનુભવ છે.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૧૮૪)

\*

\*

સકળ કંઈ મળી આવતાં કર્મ એ આપણા વહાલા પ્રભુની  
પ્રસાદી છે, એમ જ્ઞાનપૂર્વક સ્વીકારીને જ્યારે જ્યારે કંઈ  
આણગમતું, અજુગતું કરવાનું આવી પડે, તેવી વેળાએ પણ તેને  
પ્રભુકર્મ સમજીને તેવા કર્મમાં તે કર્મનાં પાસાંને ન નિહાળતાં  
તેનાથી પ્રભુનો પ્રેમભાવ પ્રગટાવવાનું બન્યાં કરે, તો તો એવા  
થએલા અનુભવથી પ્રેરણાત્મક સમજણ આપણાને પ્રગટ્યાં કરે ખરી.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૧૮૪)

\*

\*

કુટુંબના વડીલો પણ આપણા જેવાં જ માનવીઓ છે. જેમ  
આપણામાં અનેક પ્રકારની ઊંઘપો, કુટેવો, અવગુણો વગેરે ભર્યા  
પડ્યાં છે તેમ તેમનામાં પણ હોઈ શકે છે; પરંતુ તેથી કંઈ તેઓ  
પરત્વેનો આપણો સદ્ગુરુ, આદર, પ્રેમભાવ વગેરે ઘટી જવો  
ન જોઈએ. સદ્ગુરુથી સદ્ગુરુ સાંપડે છે, ને તેવી ભાવનામાં  
વધારો થાય છે. તેમના પ્રતિ જે ભાવ, આદર કેળવવાનો છે તે  
આપણા પોતાના વિકાસ માટે છે. આપણો કંઈ ગુણની પૂજા

કરવા નથી નીકળ્યા, પરંતુ તેઓ આપણાં વડીલ છે તે હકીકત  
જ માન-ભાવ-આદર દેવા માટે પૂરતી ગણાવી જોઈએ.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૧૯૬)

\*

\*

કસોટીની પળે જો જીવને જરા પણ કંટાળો ઉપજ્યો, ત્રાસ  
થયો, સંતાપ પ્રકટ્યો, કે બેળે બેળેની વૃત્તિ જન્મી, તો તેવી  
કસોટીનું પરિણામ તો જીવનના અજ્ઞાનમય મૃત્યુમાં આવવાનું.  
કસોટી તો જીવનને કસી જોવા કાજેની કસોટી છે.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૧૯૭)

\*

\*

‘મન લાગો મેરો યાર ફીરીમે’

ફીરી એટલે માત્ર ગરીબાઈ નહિ, માત્ર ત્યાગ નહિ.  
ફીરી એટલે માત્ર ફનાગીરી પણ નહિ. જેનામાં મન-દિલ લગાડી  
દેવાનાં છે, તેના વિના બીજા કશામાં તે ચોંટી જ ન શકે એવી  
મસ્ત દશા પ્રગટેલી હોય તે પણ ‘ફીરી’ ના અર્થ માટે પૂરતું  
નથી. એનાથીયે આગળ ફીરીનો ભાવ તો જીવનવિકાસની  
ઉત્તમમાં ઉત્તમ જ્ઞાનમૂલક કક્ષાઓમાં પ્રગટ્યો રહ્યા કરે છે.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૨૦૦)

\*

\*

કર્મનું કર્તાપણું, એનું ઉત્તમપણું, એનું કૌશલ્ય, એની  
શક્તિ, એની કળા—એ બધું જીવનું નથી જ નથી. તે તો બધું  
વાતાવરણના ચેતનના વિસ્તારપણામાંથી પ્રગટેલું છે.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૨૦૪)

\*

\*

ગરીબની કોઈ ‘દયા’ ખાશો નહિ. દયા ખાનાર આપણો  
કોણ ? એ કોઈ કને દયા નથી માગતો, માગે છે ન્યાય. એ આપી

શકાતો હોય તો આપજો. દયા ખાવાની ન હોય. સહાનુભૂતિ ધરાવી શકાય. દયાની લાગણીમાં સૂક્ષ્મ અહંકાર છુપાયેલો છે.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૨૦૮)

\*

\*

ગુરુના આંધળા અનુકરણથી કશો શુક્કરવાર વળી શકતો નથી. તે તો જીવનનું અજ્ઞાનતામાં મૃત્યુ છે. ગુરુ કરવા ખાતર ગુરુ કરવા એ તો મુદ્દલે ખપના નથી. પરંતુ જીવનવિકાસની ભાવનાને જીવનમાં ઉપયોગમાં પ્રવર્તિવવા કાજે સદ્ગુરુનું જ્ઞાનભક્તિપૂર્વકનું સેવન કરવાના ભાવે જીવનવિકાસની ભાવનાના આધારના સાધનરૂપે, સદ્ગુરુ કરેલા હોય તો તે ગુરુ ખપના છે. એવું જો સાચેસાચ એના યોગ્ય ભાવાર્થમાં આપણા જીવનમાં હૃદયથી પ્રગટેલું હોય, તો એનું માપલક્ષણ એ છે કે એની ગરજ આપણામાં જાગી ગયેલી જીવનમાં અનુભવાશે. જો એવી પૂરેપૂરી સાચી ગરજ જાગી ગયેલી હોય, તો મન ફરી ફરી, વળી વળી, એના તરફ જ વણ્ણાં કરે. એમ હોય તો એ વારંવાર હૃદયમાં યાદ આવ્યા કરે.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૨૧૦-૧૧)

\*

\*

ગુરુને પારખી પારખીને, કસીને, સ્વીકારો તેની ના નથી. સ્વીકારતાં પહેલાં જે કંઈ અંતરમાં જાણવું હોય તે બુદ્ધિની, ભાવના આદિની મદદથી જાણી લેવાનું કરી શકાય; પણ એક વાર તેને હૃદયથી સ્વીકારાયા બાદ તેની સાથે ખાલી ખાલી ગતકડાં કરવાં, શંકા-આશંકાઓમાં અટવાવું, તર્ક-વિતર્કો કરવા વગેરે આપણા કાજે જરાકે યોગ્ય નથી. તેને આપણા જ જેવો (પ્રકૃતિથી પ્રેરાતા માનવી જેવો) સમજવામાં, માનવામાં, જાણવામાં આપણો પ્રકૃતિદોષ રહેલો છે તે નક્કી પ્રમાણવું.

ગુરુના હદ્યભાવને સહજમેળે પ્રેમભક્તિથી જો આપણાથી જીવનમાં સ્વીકારાઈ શકાતો હોય તો, તે સર્વથી ઉત્તમ છે.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૨૧૪)

\*

\*

વસ્તુને નક્કર સ્વરૂપે કરી બતાવવાની છે, તે કંઈ એમનું એમ થોડું થવાવાનું છે? તે કાજે તો મેંદીની જેમ પથ્થર ઉપર પથ્થરથી ઘણા ઘણા ભારથી અવારનવાર આમથી તેમ વટાઈ વટાઈને નરમ લોંદા જેવું બની જવું પડશે. ત્યારે જ એમાંથી રંગ પ્રગટી શકવાનો છે. એવું થવાની જેની ઉમેદ ન હોય તેવાને કાજે આ માર્ગ નથી.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૨૩૨)

\*

\*

આપણે જે જે કંઈ કરીએ છીએ, તે આઘાતપ્રત્યાઘાતથી પ્રેરાઈને કરતાં હોઈએ છીએ અને આઘાતપ્રત્યાઘાતની ભૂમિકા એટલે તો કોઈ ને કોઈ પ્રકારની કુષ્યતાની દશા.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૨૪૩)

\*

\*

કર્મ, માત્ર કર્મને માટે નથી; જીવનને માટે કર્મ છે. કર્મ કંઈ કોઈ બીજાના ઉદ્ધાર કાજે નથી; કર્મ તો પોતાના જીવનના ઉદ્ધાર કાજે છે; આવી ભાવના પ્રધાનતઃ કર્મના આચરણમાં જ્ઞાનપૂર્વક આપણામાં જીવંત પ્રગટેલી હોવી જોઈએ.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૨૪૫)

\*

\*

જે જે કંઈ જેને ઉત્કટપણે કઠે, તેમાંથી તે પરાજ્યમુખ પણ થઈ શકતો હોય છે. દુઃખ આપણને જગાડે ને ગતિમાં પ્રેરાવે તો તે દુઃખ સાચું.

દુઃખ પોતાને જાણવા સમજવા કાજેનું યોગ્ય દર્શા છે.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૨૬૪)

\*

\*

અનુભવથયા કરેછે તે હકીકત જો સાચી હોય, તો અનુભવથી સમજણ પણ ઘડાવાવી ઘટે ને? અનુભવ તો કંઈ સ્થિતિસ્થાપક નથી. એનો લાક્ષણિક ધર્મ તો પ્રસાર થયા કરવાનો છે.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૨૮૦)

\*

\*

જીવ પોતે જે સમજતો હોય, તેના ધોરણે ને માપે સમજવાનું, માનવાનું, ગણવાનું, સ્વીકારવાનું, અનુભવવાનું તે તે બધું પ્રયત્ન કરી કરીને છોડ્યાં કરવાની જ્ઞાનપૂર્વકની આદત કેળવવાની રહે છે. કોઈ પણ પ્રકારની આમ કે તેમ જે સમજણ રાખ્યા કરવાની બને છે, તેમાં અહમ્ પણ મોટો ભાગ બજવતું હોય છે.

\*

\*

બીજાના કામમાં જો કંઈક જરા આમ કે તેમ પ્રવેશવાનું બન્યું તો તેમાં આપણાથી જાણ્યે અજાણ્યે કંઈક સૂચવવાનું બની જતું હોય છે; ઘણી વાર તો એમ ને એમ સુધારો કે સૂચન કરવાનું કરી દેતાં હોઈએ છીએ; ભલે ને પછી આપણી તેવી સૂચના તે કર્મના ઉત્તમપણા માટે યોગ્ય પ્રકારની હોય, પરંતુ આપણા કાજે તો તેમ ટપકી પડવું નુકસાનકારક છે. એવું સૂચવવાનું કરવું એ પણ એક પ્રકારનું આપણું અહમ્ જ છે. કેટલીક વાર આવું અહમ્ બહિરૂપણે બ્યક્ત થવામાંથી અટકી જતું હોય છે, પરંતુ મનમાં તો તે પ્રગટ થઈ જ જાય છે; જ્યારે આપણો પ્રયાસ તો મનમાં પણ તે પ્રગટતું અટકી જાય તેવો હોવો ઘટે છે.

સૂચના કરી દેવાનું એકદમ જે બને છે તેનો અર્થ તો એ કે, તે પરત્વેની આપણામાંની પ્રગટતી રહેલી સમજણની ઉત્તમતા વિષેનું ભાન હજુ આપણને રહેલું છે, ને તેવા પ્રકારની સમજણને

માયું ઊંચું કરવાનું હજુ ધણું દિલ રહ્યાં કરે છે.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૨૮૮)

\*

\*

જીવનમાં અનેક પ્રકારના ફાંકાઓ હોય છે. સમજણનો ફાંકો, બુદ્ધિનો ફાંકો, આવડતનો ફાંકો, પોતાની શક્તિનો ફાંકો, ડહાપણનો ફાંકો, રૂપનો ફાંકો, વ્યવહારકુશળતાનો ફાંકો, વૈભવવિલાસનો ફાંકો, ધનનો ફાંકો આમ વિવિધ પ્રકારના ફાંકા હોય છે. આ બધા ફાંકાઓ આપણા જીવનમાંથી નિર્મૂળ થવા જોઈશે. આવા બધા ફાંકાઓમાં અહ્મું ધણો મોટો ભાગ ભજવતું હોય છે. તેના વડે તો તે જીવતા રહેતા હોય છે. આથી અહ્મું પર ફટકા પડે, ત્યારે સાધકજીવને ધણો આનંદ થવો ઘટે છે.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૨૯૩)

\*

\*

પ્રતિકૂળ વાતાવરણમાંયે અખંડ શાંતિ, સમતા, પ્રસન્નતા આદિ ગુણો સતત જીવતા રહી શકે તો જ એની ખરી કિંમત છે ને?

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૨૯૪)

\*

\*

જીવે ભગવાનના માર્ગ વળવાનું કર્યું કે લોક તેની કનેથી વધારે ને વધારે ઉત્તમપણાની આશાની ધારણા સેવતા હોય છે. તેમને એમ ખબર નથી રહેતી કે કોઈ કંઈ એકદમ પ્રકૃતિ કે સ્વભાવ થોડો જ સુધારી શકતું હોય છે? સાધક થતાંની સાથે થોડું જ સિદ્ધ થઈ જવાય છે? પરંતુ આમાંથી આપણે તો એ પાઠ લેવાનો છે કે હવે આપણાથી યદ્વાતદ્વા વર્ત્યે નભી શકાવાનું નથી. તેમ છતાં પાછું આપણે કંઈ લોકને માટે જીવવાનું નથી.

લોક તો બેદક વિનાના ઢોળવા જેવા છે; આજે એક બોલે તો કાલે બીજું પણ બોલે. જેને વખાણે તેને નિંદે પણ ખરા. તેમ છતાં તેમની અગવણના તો કદી ભૂલેચૂકે પણ આપણાથી થઈ

ન જ શકે. લોકોમાં પણ આપણો વહાલો પ્રભુ રમી રહેલો છે. તે દ્વારા આપણને તે ચેતાવતો પણ હોય એ રીતે આપણે તો લોકના બોલવાપણામાંથી શીખવાનું પણ હોય. તેમ છતાં લોક અને તે (ભગવાન) બન્ને એક નથી. લોકોમાં ભગવાન છે, પણ લોકો ભગવાન નથી.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૨૮૫-૮૬)

\*

વૈરાગ્યને અને જીવનના પ્રાપ્ત થએલા ધર્મકર્તવ્યને ક્યાંયે વિરોધ નથી. (‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૨૮૮)

\*

આપમેળે આનંદથી, સમજણના હેતુથી જે કર્યા કરીએ, ને કરવું જ પડતું હોય ને કર્યા વિના ધૂટકો જ નથી એવી રીતે તેનું તે જ કર્મ કરતાં હોઈએ, તો તે બન્નેના પરિણામમાં પણ ભેદ હોયછે. આપણે તો જે તે આનંદથી, જીવનની કેળવણીના હેતુનો જીવતો ખ્યાલ રાખ્યાં કરીને સમર્પણભાવે કર્યા કરવાનું છે.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૨૮૯)

\*

આશ્વાસન આપ્યું આપી શકતું નથી. લેવાની કળા તે કાજે જીવે શીખવાની રહે છે. (‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૩૧૭)

\*

કર્મનો હેતુ, માત્ર કંઈ તે કર્મ કરવાપણામાં જ નથી રહેતો પણ તે કરતાં કરતાં હૃદયસ્થ કેવી, કેટલી ઊંડી ભાવના પ્રગટીને જીવતી રહ્યા કરે છે, તે જ ખરેખરો તો સાચો કર્મ કરવાપણાનો મુદ્દો છે. (‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૩૨૩)

\*

ભક્તિમય જીવન એટલે કલ્પનામય જીવન એમ નથી. ઉર્મિમય જીવન પણ તે નથી. ભક્તિ એટલે પોકળતા પણ નહિ.

ભક્તિનો પાયો તો જ્ઞાનની વાસ્તવિકતાભરી હકીકતના નક્કર  
પાયા પર રચાયેલો હોય છે. ભક્તિ એટલે તો મનાદિ કરણોને  
સતત એકધારા એના પ્રિય ચિંતનમાં ગુંદર કે સરેશની જેમ  
ચિટકાવીને રખાવે, ત્યારે તેને ભક્તિ કહી શકાય.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૩૨૩)

\*

\*

શ્રીભગવાનની કૃપા પણ રેઢી નથી પડી. તે તો એનાં  
થએલાં હોય તેવી વેળાએ પણ તેની અભિનપરીક્ષામાં કેટલાંયે  
તેનાં ભક્તજનો આકરાં તવાયાં છે. એટલે તેની કૃપા, તેનાં થઈ  
જવાતાં પછી પણ, તેની કસોટીમાંથી પાર ઉત્તરતાં મળતી હોય  
છે. કૃપાનું સ્વતંત્ર અસ્તિત્વ છે ને બધું છે; પણ પહેલાં તો આપણું  
જ અસ્તિત્વ કર્યાં છે તેનું ભાન કેને છે ?

અનેક વેળા આપણે વધસ્થંભે ચઢ્યાં જ કરવાનું રહે છે.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૩૨૮-૩૯-૩૨)

\*

\*

કસોટીમાંથી સહીસલામત પસાર થયા વિનાનો સદ્ગ્રભાવ પણ  
શા કામનો ? જગતવ્યવહારમાં લોક પણ નાણું પરખીને લેતાં હોય  
છે, ત્યારે શ્રીભગવાન કંઈ સામાન્ય લોક કરતાં ઉત્તરતો તો ન જ  
હોઈ શકે ને ?

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૩૩૩)

\*

\*

જે જીવ સાચી રીતે મથતો હોય છે, તે કદી પણ માથે હાથ  
દઈને બેસી રહેતો નથી અથવા તો કદી પણ પરિસ્થિતિનો વાંક  
કાઢતો નથી. પોતાની અશક્તિ હોય, નબળાઈ હોય કે ગમે તેવું  
હોય તોપણ તેને તે રૂપે જ સ્વીકારી લે છે. તેમાં તે કોઈ જાતનાં  
ગલ્લાંતલ્લાં કરતો નથી.

‘અમુક થયું તેથી તેમ થયું ને આમ હતું તેથી તેમ બન્યું.’

તેવું તે કદી કહેતો નથી. તે તો ખચકાયા વિનાનો સ્પષ્ટ, ખુલ્લો, હૃદયનો એકરાર કરી દે છે. જે જીવ પરિસ્થિતિથી લાચાર બન્યો એમ ગણાવે છે, તેવો જીવ પોતાની લાચારીને, પરિસ્થિતિને નિમિત્તે સંતારે છે. એટલે જે જીવ સાવ ખુલ્લો નથી, તે કશાક નિમિત્તને પાછળ ઊભું કરતો હોય છે. તેવો જીવ ક્યાંક ને ક્યાંક જરૂર અટવાઈ પડવાનો.      ('જીવનપોકાર', આ.૪, પૃ. ૩૮)

\*

\*

આ માર્ગ તો છે મરજીવાનો. પહેલાં સંસારમાં મરતાં શીખી લો, ને ત્યાં મરતાં મરતાં પ્રભુનું પ્રેમભક્તિપૂર્વકનું, મુખ અને સ્નિધ સ્મરણ હૈયામાં જીવતું પ્રગટાવ્યાં કરો. અને જ જ્યાં ત્યાં મહત્વ દીધાં કરો. સંસાર, સગાંસંબંધી પણ એ અને પુત્ર પરિવાર જે કહો તે પણ એ જ બધું.    ('જીવનપોકાર', આ.૪, પૃ. ૩૯)

\*

\*

સંસાર તો અંતરમાં જડાઈ ગયેલો હોય છે. બહારનો સંસાર ને તેની ઘટના—તે તો માત્ર અંતરનાનું વ્યક્ત સ્વરૂપ છે.

('જીવનપોકાર', આ.૪, પૃ. ૩૯૦)

\*

\*

જે જે આત્મનિષ થયા છે તેમનામાં કંઈક કંઈક અમુક પ્રકારની વિચિત્રતાઓ-ખાસિયતો-જોવામાં આવેલી છે. તો તેવું શાથી ? એમ લોક પૂછે છે. તેનો જવાબ એ છે કે સામાન્ય માનવીમાં અને આત્મનિષમાં-બન્નેમાં ખાસિયતો, વિચિત્રતાઓ હોઈ શકે; કિંતુ સામાન્ય માનવી પ્રકૃતિવશ હોઈ વિચિત્રતાઓનો દાસ હોય છે, જ્યારે આત્મનિષ સ્વામી હોઈ તે તેની સાધનો પણ છે, તે તેની લાક્ષણિકતા પણ છે.

('જીવનપોકાર', આ.૪, પૃ. ૩૯૧)

\*

\*

પ્રકૃતિ એના ખરા અસલ સ્વરૂપમાં તો અશુદ્ધિવાળી નથી. તે તો હુંદની રમતમાં પડેલી છે. હુંદ એ એનું લક્ષણ છે. એના ચણતરમાં જ હુંદ રહેલું છે. ('જીવનપોકાર', આ.૪, પૃ. ૩૪૮)

\*

\*

વ્યક્તિગત જીવનમાં શું કે સમગ્ર જીવનમાં શું કે સારાયે સમાજ કે સૂચિના જીવનમાં શું, મન-બુદ્ધિ વગેરેથી જીવનના બધા પ્રશ્નો ઉકેલાઈ જવાના છે એમ અનુભવ તો બતાવી આપતો નથી. મન-બુદ્ધિ કંઈ કશાનું સમગ્રપણું ને સણંગપણું તોલવાને, માપવાને, સમજવાને, અનુભવવાને કદી પણ શક્તિમાન નથી.

('જીવનપોકાર', આ.૪, પૃ. ૩૫૨)

\*

\*

વિષનો કડવો ઘૂંટડો પીવા વારો આવે તો તેને અમૃત તરીકે સ્વીકારીને જે જીવ જીવનસંગ્રામ ખેલેછે, તે જીવન જીવી જાણેછે.

('જીવનપોકાર', આ.૪, પૃ. ૩૫૫)

\*

\*

પ્રાપ્ત ધર્મો છોડાય નહિ; પરંતુ તે તે બધા ધર્મો સાંસારિક વૃત્તિથી આચરવાના ન હોય, ભગવદ્ભાવથી આચરવાના હોય. તે ધર્મોના પાલનમાં જીવનવિકાસની ભાવનાનો જ સુદૃઢપણો એકમાત્ર ઝ્યાલ જો રાખ્યાં કરાય તો તે ધર્મનો હેતુ સાચી રીતે ફળી શકે. માટે સંસાર એ તો વૃત્તિઓથી તરવા કાજેની મુજિત્તિનાવ છે.

('જીવનપોકાર', આ.૪, પૃ. ૩૬૫)

\*

\*

ગીતાનો સંન્યાસ તે વૃત્તિનો સંન્યાસ છે. ગીતાનો ધર્મ મળેલી પરિસ્થિત અને મળેલા ધર્મથી ભાગવાની સ્પષ્ટ ના પાડે છે. તેને તે કાયરતા ગણે છે. જે કંટાળીને, ગ્રાસીને ભાગે છે, તે

ધર્મના હદ્યને પામી શકતો નથી.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૩૬૭)

\*

એકનિષ્ઠા પ્રકટ્યા વિના જીવનની સાધનાના પુરુષાર્થમાં નવચેતન, પ્રાણ પ્રકટી શકવાનાં નથી.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૩૬૮)

\*

આપણી સંસ્કૃતિમાં જે અનેક પ્રકારના સાંપ્રદાયિક મતો પ્રસર્યા, તે ત્યાગ ને ભોગ એ બેની વચ્ચેના તે બધા ફાંટાઓ છે. ત્યાગ કે ભોગ બન્ને પ્રેમભક્તિજ્ઞાનયોગની ભૂમિકાવાળા જ હોવા ઘટે, તો જ તે શોભે. (‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૩૬૮)

\*

સંયમ અને દમન એ બેમાં ઘણો તફાવત છે.

દમનથી બુદ્ધિ, પ્રાણ આદિ કુંઠિત બની જાય છે. જેમ નપુંસક માનવીમાં વાસના નથી હોતી એવું નથી હોતું; એવી રીતે કરણોને કુંઠિત બનાવીને આગળ વધવાના માર્ગને આપણી સંસ્કૃતિના અનુભવીઓએ સામાન્યતઃ નકાર્યો છે.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૩૬૯)

\*

અજ્ઞાનમય જીવનમાં તો નર્યો ભોગ જ છે. જ્યારે જ્ઞાનની અવસ્થામાં જીવનનો યજ્ઞ સંપૂર્ણપણે પરિપૂર્ણ થયા બાદ, જે કંઈ બાકી રહે તેવા ભોગને યથાર્થ ગણેલો છે અને તે પ્રભુપ્રસાદ છે.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૩૭૦)

\*

ત્યાગ કરવો ને ત્યાગ ભોગવવો એ બન્નેના ભાવાર્થમાં આસમાન-જમીનનો ફરક છે. ત્યાગ ભોગવવામાં જે આનંદ છે, તે ત્યાગ કરવાના આનંદ કરતાં ક્યાંયે વિશેષ ચંદ્રિયાતો છે.

ત्याग કરવानો આનંદ એ જીવનવિકાસની પ્રમાણમાં નીચેલી શ્રેષ્ઠીનો માર્ગ છે. ત્યાગ ભોગવવાનો આનંદ એ જીવનવિકાસની સહજ સાધનાનો આનંદ છે અથવા વધારે યોગ્યપણે કહીએ તો તે સહજ અવસ્થાનો આનંદ છે.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૩૭૦)

\* \* \*

પ્રેમની કુમળાશને સહુ કોઈ સમજે, સ્વીકારે ને આવકારે પણ પ્રેમની કઠળાશને જ્યારે પ્રેમભક્તિઆનંદથી સ્વીકારાય અને આવકારાય ત્યારે જ સાચો પ્રેમ પરખાય.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૩૭૧)

\* \* \*

જીવનનો ધર્મ સાંપ્રદાયિકતાનો નથી; જીવનનો વાસ્તવિક ધર્મ વિસ્તારપણાનો છે. (‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૩૭૧)

\* \* \*

લાગણીઓને પંપાળનારા શબ્દોથી કે એવા પ્રકારના કાગળના લખાણથી આશ્વાસન આપવાની રીત એ જીવનવિકાસની ભાવનાને સાચી રીતે પ્રેરનારી નથી; એથી તો ઊલટું જીવન કે લાગણી વધારે લૂલી લૂલી બને છે. ભાષા એ તો જીવનને આકાર પમાડવાનું ઘણું લૂલું ને અધૂરું સાધન છે; સાચું સાધન તો પ્રેમભક્તિજ્ઞાનયોગપૂર્વકની જીવનની તપશ્ચર્યા છે; શબ્દમાં, શબ્દ-લાલિત્યમાં, વિચારમાં ને લાગણીમાં રાચનારો જીવ જીવનવિકાસને સાચી રીતે સાધી શકવાનો નથી.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૩૭૨)

\* \* \*

ઉત્તમ શિલ્પકાર હોય તેમ છતાં ઉત્તમ રીતે ગમે તે પથ્થરને તે ઘડી ન શકે. એવા સર્જન માટે તે તો માર્ગી લે છે અમુક પ્રકારની

શરતોવાળો ખાસ પથ્થર. તો જ તેમાંથી સર્જન, તેના અંતરની તે પરત્વેની પ્રકટેલી ભાવનાની સમજણ અનુસાર નીપળ શકે.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૩૭૪)

\*

\*

ભાવના વિનાનું થએલું સર્વ કંઈ, સાધનાના યોગ્ય વિકાસ માટે મિથ્યા છે. (‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૩૭૮)

\*

\*

કર્મ વિના જ્ઞાન નથી ને જ્ઞાનના અનુભવ વિના કર્મથી મુક્તિ પણ નથી. (‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૩૮૨)

\*

\*

ગરજ જગાડી આપવાનું કાર્ય કોઈ કરી આપી શકવાનું નથી, આપણે જાતે જ તે જગાડવી પડશે.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૩૮૨)

\*

\*

કંઈ કશા પર તિરસ્કાર કરવાથી તેમાંથી નીકળી શકતું નથી. પણ ઉલટું કળણમાં વધારે ખૂંપી જવાય છે.

જીવનવિકાસના માર્ગમાં તિરસ્કાર, ઘૃણા, વેર, નિંદા, અવમાનના, અવગણના વગેરે વૃત્તિને સ્થાન જ નથી. ઘણાંને એમ કહેતા જાણ્યા છે કે, ‘પાપને વિકારતાં શીખો, પાપીને નહિ’ પરંતુ પાપ ને પાપી તે બન્નેને એકબીજાથી અલગ પાડીને જુદાં જુદાં સમજ તેમ ગણી શકવાની ખપમાં લાગી શકે એવી સૂક્ષ્મ વિવેકશક્તિ સામાન્ય જીવમાં તો હોતી નથી. એટલે પાપને વિકારવાની સાથે સાથે આપણું મન પાપીને પણ તેમાં સમાવી દેતું હોય છે. આથી આપણે તો સર્વ પરત્વે, સારા કે નરસા પરત્વે, એકમાત્ર જીવતો સદ્ગ્રાવ જ રાખ્યા કરવાનો હોય. જો

આપણા જીવનમાં જીવનવિકાસક ભાવનાનું મહત્ત્વ પ્રગટેલું રહ્યાં કર્યું હશે, તો નરસા પરત્વે આપણે વળગી શકવાનાં નથી. અથવા વળગતાં વળગતાં જાગી જઈને બચી શકવાનાં છીએ, તે નક્કી જાણવું.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૩૮૩-૮૪)

\* \* \*

સદ્ગુરુનાં વચનનો વર્તાવ કરતાં કરતાં મૃત્યુ આવે, તો તેને પણ પ્રેમથી સ્વીકારવાની તૈયારી સાધકમાં પ્રગટેલી હોવી જોઈશે.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૩૮૪)

\* \* \*

મહત્ત્વાકંક્ષાનાં પણ પ્રત્યક્ષ લક્ષણો છે. સાચી મહત્ત્વાકંક્ષામાં તો ખુમારી કોઈ ઓર હોય છે. એક પ્રકારની ધ્યેયની દિશા પરત્વેની ધૂન ને એની મસ્તીનો નશો, એના પરત્વેનું પ્રગટેલું એકરાગપણું, એના પરત્વેની તમન્ના, તન્મયતા ને એકતાનતા તેમાં હોય છે. (‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૩૮૦)

\* \* \*

પ્રયત્નમાં જ્યારે હૃદયભાવના ભળે છે, ત્યારે પ્રયત્ન વધારે યોગ્ય પ્રકારનો થતો હોય છે.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૩૮૨)

\* \* \*

સજાગ ને મથતા માનવીને તો ડગલે ને પગલે વિચારવાનું હોય છે. એને તો પળેપળ યુદ્ધની સ્થિતિમાં જતી હોય છે; આંતરબાધ્ય બધે જ સંગ્રામ પ્રગટેલો રહ્યાં કરે છે.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૩૮૫)

\* \* \*

સાંસારિક જીવનની સાંકળથી મુક્ત થઈ જ ન શકાતું હોય, ને બીજી બાજુથી માનવીની મહેચ્છા આધ્યાત્મિક જીવન પરત્વેની

થોડી ઘણી પણ હોય, તો તેવા જીવે પ્રાર્થના કરી કરી ભગવાનની  
મદદ માગવી રહી. ('જીવનપોકાર', આ.૪, પૃ. ૩૮૭)

\*

સદ્ગુરુનો કોઈ આકારપ્રકાર નથી, એ કાંઈ એક પ્રકારની  
ચોકઠામાં જકડાઈ શકે તેવી સમજજ્ઞા નથી. એ મર્યાદા નથી તેમ  
બંધન પણ નથી. મુક્તિ પણ નથી. તે તો જે છે તે છે.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૪૦૪)

\*

જેને છે તેને છે, ને જેને નથી તેને નથી. જેના હૃદયમાં તે  
જાગે છે, ત્યાંથી તે ઓલવાઈ જતો નથી. એક વાર જગાડીને  
જીવતો જો એને કરી શક્યાં, તો એના નવા નવા અવતારનો  
અનુભવ અવનવા પ્રસગોમાં આપણાને થયા જ કરતો હોય છે.  
સદ્ગુરુને અમુક પ્રકારે જ સમજવો તે તો અજ્ઞાન છે.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૪૦૪)

\*

જીવપ્રકૃતિને ચેતનપણામાં જ્ઞાનપૂર્વક લય પમાડી દેવી એનું  
નામ મરીને જન્મવું. ('જીવનપોકાર', આ.૪, પૃ. ૪૦૫)

\*

મનને તો ભરપૂર સંસારથી ભર્યું રાખ્યાં કરવું હોય ને  
બજનો ગાય કે રામનામ લે તો તેથી કશો યોગ્ય પત્તો ખાવાનો  
નથી. પ્રભુને કાજે રોમેરોમ આગ પ્રગટ્યા વિના, એવી પ્રેમ-  
ભક્તિનું શૌર્ય હૈયામાં પ્રગટ્યા વિના પ્રભુને મેળવવો દોષ્યલો છે.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૪૦૬)

\*

‘પ્રેમશૌર્યઅંકિત’ હૃદયની ભક્તિ પ્રગટતાં આધાર પણ  
અદલાઈ જાય. કરણો દ્વારા કામ કરતી પ્રકૃતિ પણ બદલાઈ જતી

અનુભવાઈ છે. ભગવાન કાજેનો એવો નૈસર્જિક પ્રેમભાવ જ્યારે ઉત્કટપણે પ્રગટે છે, ત્યારે જે તે બધું વાળીજૂરીને તે સ્વર્ચ, શુદ્ધ કરી દે છે ને શ્રીભગવાનની પ્રાણપ્રતિષ્ઠા થવા કાજે આંતરિક ભૂમિકાને તેવી યોગ્યતાવાળી બનાવી દે છે.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૪૦૬)

\* \* \*

પ્રભુના પ્રેમ વિના બીજા કશા પણ હેતુનો સંપૂર્ણ અભાવ, દંબ, અહમુ આદિ નિભ વૃત્તિઓનો સંપૂર્ણ અભાવ, સોદાની-સાટાની વૃત્તિવાળી કશી ગણતરીભરેલી માગણીનો પણ અભાવ, પ્રભુની ખાતર જ પ્રભુ, અંતકરણની ભાવનાથી સજ્જ થયેલી એવી પવિત્રતા—આ બધું સાધકે પોતાના આધારમાં જીવતું કરવાનું છે. (‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૪૦૭)

\* \* \*

કેટલાય જીવો પોતાની અશક્તિનો, પ્રકૃતિનો, તામસનો અથવા ખાલી ખાલી પડી રહી એળે સમય ગુમાવવાપણાની નિર્જ્યતાનો ઉપર ઉપરથી તો દોષ કાઢતા ને સ્વીકારતા જાણેલા છે. પરંતુ અંતરમાં અંતરથી તેવી પોતાની દશા નિર્ભળ કરવાને મુદ્દલે તેઓ સાચી રીતે ઉત્કટ તમન્નાથી હૃદયમાં જંખતા હોતા નથી.

સાધકે પોતાના અંતર્યમી સાથેનો આંતરિક ભાવાત્મક સંબંધ કોઈ ને કોઈ સાધનથી કરી, સતત પળેપળ એકધારો જીવતો થઈ શકે ને તેવા ભાવમાં એની સાથે હૃદયમાં હૃદયથી એકરસ થઈ રહી શકે એવા જ્ઞાનભક્તિપૂર્વકના પ્રયત્નમાં રહેવું જોઈએ.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૪૦૮)

\* \* \*

જીવનવિકાસ પરત્વેનો જે આશાવાદ છે, તે તો જ્યાં ને ત્યાં અને જેમાં અને તેમાં બાથોડિયાં મારતો હોતો નથી. એનો માર્ગ તો નિશ્ચલ હોય છે ને એની મતિ-ગતિ પણ નિશ્ચલ હોય

છે. એનો નિર્ણય પણ નિશ્ચલ હોય છે.

(‘જવનપોકાર’, આ.૪, પૃ. ૪૧૧)

\*

\*

ગુરુનાં ચરણસ્પર્શ કરવાં, સાષાંગ દંડવત્ પ્રણામો કરવાં, ચરણમૃતો પીવાં, ફૂલો ચઢાવવાં. ધૂપદીવા કરવા, પૂજાર્થીન કરવાં, અગરબત્તાં સળગાવવાં, માળાઓ પહેરાવવી, ભેટસોગાદો ધરવી, એવું બધું ને એટલું જ માત્ર કરવું—એનાથી જવન-વિકાસની દિશામાં કશું જ ન વળી શકે. જે કામ કરવું છે, તેની જગૃતિ, ચીવટ, ખંત, કાળજ વગેરે હજી ક્યાં પ્રગટ્યાં છે? પોતાના કામનું જવતું રટણ રોજિંદા વ્યવહારવર્તનમાં ક્યાં રહે છે? ખાલી ‘ગુરુ’ ‘ગુરુ’ કર્યે શું વળી શકે? ખાલી ગુરુના નામના જ્યનાદો અને પોકારો કર્યે શું થઈ શકે? આ તો બધી છે બહિરૂ પૂજા. તેનુંયે સ્થાન છે, જો તેથી આંતરિક ભાવ તેના યથાર્થપણામાં પ્રગટી શકતો હોય તો, નહિતર નહિ. તેથી તો બહુ બહુ તો આ માર્ગની અભિરુચિ ઉપજે, તેથી વિશેષ કશું નહિ. માટે જે ખરું કરવાનું છે તે કરવા દિલ લાગી જવું જોઈએ. ગુરુની સાથે આપણા હૃદયના તારનું જ્ઞાનભક્તિપૂર્વકનું હૃદયમાં હૃદયથી અનુસંધાન પળેપળ સંપૂર્ણ ચેતનયુક્ત જગૃતિમાં થઈ જવું ધટે. એવું અનુસંધાન જ્યારે જવતી દશામાં હૃદયમાં પ્રગટેછે, ત્યારે જ સાધના સહજમેળે થયાં કરે એવી કક્ષામાં પ્રવેશવાનું બની શકે છે.

(‘જવનપોકાર’, આ.૪, પૃ. ૪૧૬-૧૭)

\*

\*

મીરાંએ કોઈને કે કંઈ કશાને પણ અવગાયું નથી. એણે જે કર્યું છે તે તે સુધારાના હેતુથી પણ કરેલું નથી. એની ને એના પ્રભુની વચ્ચે જે જે આંદું આવ્યું તે તે એણે શ્રીપ્રભુને ચરણકમળે પ્રેમભક્તિભાવે સમર્પણ કર્યું જ કર્યું. એના જવનમાં ક્યાંયે

સ્વચ્છંદતા, ઉચ્છૃંખલતા ન હતી. એની સર્વસ્વ સ્વાર્પણ કરવાની હૃદયની તૈયારી સર્વ રીતે ને સર્વ ભાવે જાગેલી હતી. એ તો શ્રીહરિને વરી ચૂકેલી જ હતી. શ્રીહરિ કાજેની હૃદયમાંની એની આતુરતા એટલી પ્રચંડ ભાવે રહ્યાં કરતી હતી કે એની આગળ સંસાર પોતે શૂન્યવત્ત બની ગઅલો હતો. આપણે એની આગળ વેંતિયાં જેવાં પણ નથી.      ('જીવનપોકાર', આ.૪, પૃ. ૪૧૮)

\*

\*

રાગદ્વેષમાંથી ઊગરવાને કાજે આપણે કંઈ ખાસ મથામણ કરવાની નથી, પણ ખરી મથામણ તો કરવાની છે પ્રભુમય જીવન જીવવા કાજે. તેવું જીવન જીવવાની કણા જો પ્રભુકૃપાથી પ્રાપ્ત થઈ શકી, તો રાગદ્વેષનો વંટોળિયો જીવનમાંથી આપમેળે અદંશ્ય થઈ જવાનો છો. રાગદ્વેષ ને દ્વંદ્વાદિથી મુક્તિ મેળવવાને જે જીવ જહેમત ઊઠાવવાનું કરે છે એવા પ્રયત્નમાં જીવનનું કલ્યાણ નથી એમ કહેવાનો તો આશય ન જ હોય; પરંતુ એ બધુંયે પ્રભુમય જીવન થઈ જતાં આપોઆપ ફલિત થવાનું જ છે. એટલે જે ઝોક દેવાનો છે તે ગુણોની પ્રાપ્તિની સાધના પર નહિ, પરંતુ આંતરિક જાગૃતિ ને પ્રભુભાવ ઉપર ખરો ઝોક દેવાનો છે.

('જીવનપોકાર', આ.૪, પૃ. ૪૨૦-૨૧)

\*

\*

જે જીવને ચેતનનો અનુભવ કરવાની મહત્વાકંક્ષા છે, એવા જીવની પ્રાર્થના તો પળેપળ એના જીવનના તાણાવાણામાં સતત એકધારી જીવંત વળાઈ ગઅલી હોવી જોઈશે. એવાની પ્રાર્થના તો એના દરેક રોજિંદા વ્યવહાર, વર્તન, સંપર્ક, સંબંધ, વિચાર, લાગણી, વૃત્તિ, વાતચીત, કર્મ તે બધાંયમાં ઓતપ્રોત થયેલી હોવી જોઈશે. એવા જીવની પ્રાર્થનામાં ભાષાના વ્યક્ત શબ્દો જ માત્ર નહિ હોય; એની પ્રાર્થના તો એનું હૃદય કર્યા

કરતું હોવું જોઈશે. જ્યારે આવી પ્રાર્થના ફલિત થાય છે, ત્યારે તે ચેતનપ્રેરક હોય છે, પ્રાણપૂરક હોય છે. એવી પ્રાર્થના પોતે જ શક્તિસ્વરૂપ બની જતી હોય છે.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૪૨૫)

\*

\*

દરેક હકીકત ને પ્રસંગને ઘણાં પાસાં હોય છે; તેથી તેના સમગ્રપણાનો જીવતો ખ્યાલ ન પ્રગટી શકે, ત્યાં સુધી કંઈ કશા વિષે બુદ્ધિએના નિર્ણયાત્મકપણામાં ન પ્રવેશે એ જ ઉત્તમ ગણાય. ‘સારું કે નરસું’ એ તો માત્ર માનવીના મનની સીમાનું લક્ષણ છે. એનાથી પર જવાતાં એ રીતે કશાનું મૂલ્યાંકન ટકી શકતું નથી.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૪૨૭)

\*

\*

સાધારણતા: સદ્ગ્રાવથી સદ્ગ્રાવ પ્રગટે છે. જોકે સદ્ગ્રાવ રાખીએ તેથી સામી બ્યક્ટિત અચૂક સદ્ગ્રાવ રાખે જ એવું ન યે બને. તેવી વેળા આપણને પોતાને આપણા સદ્ગ્રાવલાણ અંગેનો આત્મસંતોષ રહેવો ઘટે. (‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૪૨૮)

\*

\*

કોઈ પણ પરત્વે સદ્ગ્રાવ હોય એટલે સામા જીવના જીવપ્રકારના વલણને ટેકો દેવો જ જોઈએ એવું કશુંન હોય. સદ્ગ્રાવ રાખવા છતાં અયોગ્ય વલણનો સામનો થઈ શકે છે. પ્રહૃલાદ, ધ્રુવના દાખલા મોજૂદ છે. મીરાંબાઈ પણ મધ્યયુગમાં થઈ ગયાં અને બીજાં અનેક સંતભક્તોના તેવા દાખલા આપણી જાણમાં છે.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૪૨૮)

\*

\*

ભાવનાને કર્મમાં પ્રવેશ કરાવવી ઘટે. કર્મનું પરિણામ ને તેની કક્ષા—જો તે કર્મમાં ભાવના હોય ને તે પણ તે હેતુલક્ષી

જ્ઞાનપૂર્વકની હોય તો—બદલાતાં રહેછે. આમ કર્મ અતિ ઉત્તમ કક્ષાનું હોવા છતાં, જો ભાવના જ્ઞાનપૂર્વકની ઉત્તમ કક્ષાની તેમાં જીવતી રહ્યા કરેલી ન હોય, તો તેવા ઉત્તમ કર્મનું પણ પરિણામ ઉત્તમ પ્રકારનું ન પ્રગટી શકે.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૪૨૮)

\*

\*

આપણે જે કામ હાથમાં લીધું હોય તથા જે કામ આવી મળ્યું હોય તેમાં ફિલે ધારો કે ન મળે, તો પણ તે કામ પરત્વેનો ઉત્સાહ હૃદયમાં જીવતો રાખ્યા કરવો. આપણે કામ સાથે ને તેમાં રહેલા અંતર્ગત ભાવ સાથે નિસબત છે. કામના પરિણામ સાથે નિસબત નથી. કામ કર્યેથી ને કામ કરતા રહેવાથી પરિણામ તો નિશ્ચિત છે. સંકલ્પની શક્તિ ઘણી મોટી છે. આત્મવિશ્વાસ પ્રગટ્યા વિના સંકલ્પમાં શક્તિ જીવતી થઈ શકતી નથી. માટે જે કામ હાથમાં લઈએ તે સંપૂર્ણ આત્મવિશ્વાસ દઢાવીને લઈએ અને પૂરું કરીને જ જંપીએ. (‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૪૩૦)

\*

\*

કામ કરતાં કરતાં તે કામથી કયાંય પણ રાગદ્વેષ ન પ્રગટે તેની તો પૂરેપૂરી જીવતી ચોકી રાખ્યાં કરીએ. સાધકનું પ્રત્યેક કર્મ રાગદ્વેષ ઘટાડનારું હોલું ઘટે, એવી જાગૃતિ રાખીને આપણે સંસારમાં વર્તવાનું છે. (‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૪૩૦)

અવગુણ કે દોષનો સ્વીકાર જેમ તેનાથી પર થવા કાજે છે, તેવી રીતે કર્મનો સ્વીકાર તેનાથી રાગદ્વેખાદિની મુક્તિ કાજે છે.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૪૩૦)

\*

\*

જે જીવ બાળકના જીવનને કચરી નાખે, તે અમારે મન રાક્ષસી પ્રકૃતિનો છે.

\*

\*

સાધનામય જીવન એ જ સાચું જીવન છે. સાધનાથી જીવનમાં જીવનનાં સહસ્ર નયન ખૂલતાં હોય છે. જીવનમાં અનેક પાસાંનાં સાધકને દર્શન ખૂલતાં જતાં હોય છે. જીવનના સહસ્રમુખી નારાયણનાં તે દર્શન કરતો રહે છે ને જીવનનાં સર્વ પાસાંને તે સાદર ને સદ્ગ્રાવથી નીરખે છે. જીવનના અનેક ક્ષેત્ર પરત્વેની સદ્ગ્રાવનાની સાથે તે તો સુમેળ સાધતો રહે છે. જીવનની સર્વ પ્રકારની રચનાત્મક પ્રવૃત્તિમાં તે સમાધાન મેળવતો રહે છે. એને કશા સાથે વિરોધ નથી.

\* \* \*

જો ધ્યેય પરત્વેનું લક્ષ્યબિંદુ એકાગ્ર, કેન્દ્રિત, જીવતુંજાગતું, એકધારું રહ્યાં કરતું હોય તો જીવનમાં મળતી જતી પરિસ્થિતિ ને સંજોગો આપણને વેધક ને પ્રેરણાત્મક જીવનદાટિ પ્રેરાવતા રહે છે.

\* \* \*

જીવનમાં જીવનના ધ્યેયની ભાવના જીવાળામુખીના જેવી ધગધગતી જ્યારે જીવલંતપણે પ્રગાટી ઊઠતી હોય છે, ત્યારે જ ધ્યેય પરત્વેની ભાવના પ્રમાણેનું વર્તન પ્રત્યેક થતા જતા કર્મમાં પ્રકટી શકે છે, અને એવો માનવી સજાગ રહી શકે છે.

\* \* \*

સ્કુટપણે કશું સમજવાની ઈચ્છા ન રાખવી. જેટલું વધારે સૂક્ષ્મપણે કહેવાયેલું આપણાથી સમજાય તેટલું વધારે સારું, એથી આપણી બુદ્ધિ કસાય છે ને વધારે સૂક્ષ્મ થાય છે. વસ્તુનું યથાર્થપણું શું છે અને આપણી પરિસ્થિતિને અનુકૂળ શું છે, તે પણ એને લીધે આપણને સમજવા માંડે છે.

('જીવનમંથન', આ.૨, પૃ. ૨-૩)

\* \* \*

ભલે કોઈ આપણી સરળતાનો, નેકદિલીનો ગેરલાભ લઈ જય. ખરો ગેરલાભ તો એને જ છે, આપણને નથી. છેતરનાર જ સાચી રીતે તો છેતરાય છે. ('જીવનમંથન', આ.૨, પૃ. ૩)

\*

પૈસાની ગણતરી કરવાની નથી, એ જેટલું આ માર્ગમાં સારું છે, તેટલું જ સારું એનો અયોગ્યપણે વ્યવહાર ન થાય, તે જોવાનું કામ પણ છે. ('જીવનમંથન', આ.૨, પૃ. ૪)

\*

ઇચ્છાશક્તિનું બળ વૃત્તિ, વિચાર કે વાસના કરતાં કયાંય અનેકગણું વધુ છે. ('જીવનમંથન', આ.૨, પૃ. ૫)

\*

ગુરુને કયા શબ્દોમાં સંબોધન કરો છો, તે તરફ લક્ષ આપવા કરતાં કેવો ભાવ આપણામાં ત્યારે જામે છે, એ તરફ લક્ષ આપવું જરૂરી છે. ('જીવનમંથન', આ.૨, પૃ. ૮)

\*

જેટલા પ્રમાણમાં માનવી પોતાને ઓળખે છે અને પોતાની (આત્માની) સેવા કરે છે, તેટલા પ્રમાણમાં તે જગતને ઓળખે છે ને જગતની સેવા કરે છે.

'આ જગત દ્વસડાયાં કરે છે અને તમારી કે મારી મદદની તેને જરૂર છે' એવી માન્યતા સાચી નથી.

('જીવનમંથન', આ.૨, પૃ. ૧૧)

\*

આપણા ધર્મ તો નિર્બળ તરફ હમદર્દી રાખવાનો અને ખોટાં કામ કરનારને પણ ચહાવાનો છે.

('જીવનમંથન', આ.૨, પૃ. ૧૨)

\*

જગત એટલે એક ભવ્ય મહાન આધ્યાત્મિક કસરતશાળા કે વ્યાયામગૃહ છે, જેમાં આપણે દરેકે વ્યાયામ કરવાનો છે કે જેથી આપણે વધારે ને વધારે આત્મબળવાળાં બનીએ.

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૧૨)

\*

\*

જેટલા વધારે આપણે શાંત રહી શકીશું અને આપણા જ્ઞાનતંતુઓ જેટલા વધુ સ્વસ્થ હશે, તેટલું વધારે સારું આપણું જનસેવાનું પણ કામ થશે અને આપણો પ્રેમ પણ તેટલો વધશે. એટલે મુખ્ય તો આપણે કેવી રીતે સ્વસ્થ, શાંત અને તેમ છતાંય તેને લીધે શક્તિશાળી થઈ શકીએ અને આપણી નાડીઓ અને જ્ઞાનતંતુઓ કેમ કરીને અસ્વસ્થ, અશાંત, કંપાયમાન થતાં અટકે તે જોવાનું કામ છે. (‘જીવનમંથન’, આ.૨, પૃ. ૧૩)

\*

\*

જેમ દરિયામાં અનેક નાનીમોટી નદીઓનાં વહેણ વહેતાં હોય છે, તેમ સંતાત્મા પાસે પણ અનેક જાતના લોકો પોતપોતાની મુરાદો બર લાવવાને જતા હોય છે. તેવા ‘શંભુમેળા’ભર્યા વાતાવરણને અંગે આપણને ત્યારે અન્યથાપણું ન પ્રગટવું ઘટે.

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૧૫)

\*

\*

જગત છે, ત્યાં સુધી એમાં અનેક પ્રકારના પ્રવાહો અને સામા પ્રવાહો રહ્યા જ કરવાના. સત ને અસત, સુખ ને દુઃખ, પ્રકાશ ને અંધકાર,—એવાં હ્યાં દુનિયામાં તો રહ્યાં જ કરવાનાં. હા! એમ બને કે કોઈવાર સત વધારે પ્રમાણમાં પ્રધાનપણે રહ્યાં કરે, કે જેને આપણે ‘સત્યયુગ’ કહીએછીએ. આવી રીતે સત્યયુગ, નેતાયુગ, દ્વાપરયુગ ને કળિયુગ એમ ચાર કાળની કલ્યના ઉદ્ભવેલી હશે. દરેક યુગમાં થોડા પ્રમાણમાં બાકીના ત્રણ યુગો

હોય છે જ અને આપણામાં પણ ચારે યુગો છે. તેમાંથી બીજા યુગોને ઘટાડી ઘટાડીને ને પછી તે સત્યયુગની પણ ઉપર થઈને જીવવાનું આપણું તો ધ્યેય છે. સ્થળ અને કાળ તો આપણાં શરીર તથા તેની અંદરનાં તત્ત્વોની રમતને અંગે છે ને એમને લીધે છે.

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૧૫-૧૬)

\*

\*

ઉશ્કેરાટ વખતે તો નામસ્મરણ વધુ ઉગ્ર તેજસ્વી બનવું ઘટે છે. (‘જીવનમંથન’, આ.૨, પૃ. ૧૬)

\*

\*

પરિસ્થિતિનો ધર્મ બજાવતાં બજાવતાં તેને છોડીને આગળ ધ્યે જવાનું છે. આપણે એક જ પરિસ્થિતિને વળગી રહેવાનું નથી. કારણ કે એક જ સ્થિતિમાં રહેવાનું બનતાં ત્યાં આસક્તિનું વલણ થયા વિના નહિ રહે. એટલે એનું કાર્ય પતતાં એને (પરિસ્થિતિને) છોડવાની જ હોય, પછી એ આપણા માટે મૃતવત્ત બની જાય છે. (‘જીવનમંથન’, આ.૨, પૃ. ૧૬)

\*

\*

સત્યનાં અનેક પાસાં છે, ને તે દરેક જગતમાં પોતાનું વર્ચ્યસ્વ જમાવવા મથવાનું. તે વેળા આ બધા મતાગ્રહોની સામસામી બેંચતાણમાં તેમાંના એકાદ બે કે અમુક પાસાંઓના આગ્રહમાં આપણે તણાઈ તો નથી જતાં ને? તે જોવાનું રહેશે. આપણું જીવનમુખ તો સહસ્ર નેત્રવાળું, સહસ્ર જીભવાળું, સહસ્ર કાનવાળું, સહસ્ર હંડ્રિયોવાળું, ટૂંકમાં આપણે સહસ્ર શરીરી પ્રગટવું જોઈએ. (‘જીવનમંથન’, આ.૨, પૃ. ૧૭)

\*

\*

વૃત્તિઓને કે રીતની વહેવાની ટેવ પડેલી છે, તેમાં ન વહેવા દેવા માટે જાગૃતિ, સાવચેતી, દફ્તા આદિ પ્રત્યેક નાનામાં

नानी बाबत, टेव के लक्षणमां जो रह्यां करे ने ते सामे युद्ध अपायां जाय, तो काम वहेलुं आगण धपी शકे.

(‘ज्ञवनमंथन’, आ.२, पृ. १८)

\*

\*

विचारनी सांकળो दिवसोना बीजा वर्खतमां पश (ध्यान, त्राट्क, नामस्मरण आदि साधनोना समय स्तिवायना वर्खतमां पश) न रह्यां करे ते पश जोतां रहेवानुंछे. आपणे युद्ध क्यां नथी लडवानुं ऐनी साधकना ज्ञवनमां भर्याई न होई शके.

(‘ज्ञवनमंथन’, आ.२, पृ. २०)

\*

\*

जे कंઈ छे ते यथायोग्यपणे ज मणेलुं छे, एटले कशुंये नकारवानुं नथी, पश जे छे तेनो साधनानी दृष्टिए अने रीते उपयोग करवानो छे ने ते अंगेनी समज वधार्या करवानी छे.

आपणने मणेलुं जगत, शरीर, मातापिता, सगांवहालां, भाईभांडु, पति-पत्नी, मालमिलकत, संज्ञेगो, परिस्थिति अरे ! ए बधां उपरांत आ ज्ञवन पश मात्र साधनाना उपयोग माटे मणेलुं छे.

(‘ज्ञवनमंथन’, आ.२, पृ. २०)

\*

\*

जगतमां के ज्ञवनमां जो लांबी दृष्टि करीने जोईअे तो जणाशे के कोई पश क्यांये स्वतंत्र नथी. आपणी मानेली समजूण, आपणी मान्यताओ, ज्ञवननां सुखनां साधनोनी आपणी समजूती,- ए प्रमाणे ज ए बधुं निर्विघ्ने चाल्यां करे, एमां सरणपाणुं रह्यां करे, क्यांये जरा पश अथडमाण न थाय एवां संज्ञेगो ने एवी वृत्तिने आपणे स्वतंत्रता मानी लईअे छीअे. पश खरी रीते एमां स्वंत्रता नथी. ए तो ठिंडियोनी वृत्तिओना गुलाम थता जवानो रस्तो छे. जगतमां कोई पश स्वतंत्र नथी.

જોણે ભગવાનને અનુભવ્યો છે, તે જ એકમાત્ર સ્વતંત્ર થઈ શકે છે. બાકીનાં બધાં તો ઘટમાળની ગુલામીમાં જ પડી રહેલાં છે, ને ઘટમાળની ઘરેડમાં તો કોણ નથી ?

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૨૩)

\* \* \*

આપણે ભગવાન વિષેના બધા જ્યાલો છોડી દઈને કોરાં પાન કે કોરી સ્લેટ જેવા થઈને પછી જે કંઈ એમાં થવાપણું હોય તે માત્ર જોનાર તરીકે બનીને આપણે થવા દીધા કરીએ. આવી રીતે મનના જૂના તમામ સંસ્કારોને ભુસાઈ જવા દઈએ તો જ આપણે સમૂહણા નગન (પવિત્ર અને શુદ્ધ) એની આગળ થઈ શકીશું અને ત્યારે સાચો ભાગવતભાવ આપણામાં જન્મવા પામશે. ત્યારે એ ભાવ-ના સંચારની ઝડપ કંઈ ઓર હશે.

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૨૬)

\* \* \*

આપણે શરીરને દુઃખ દેવામાંથી વેગળા રહેવાનું છે. તેમ જ શરીરને ફટવી દેવાનું પણ નથી. મધ્યમ માર્ગ રાખવાનો છે. આપણી સાધનામાં ખોરાક એ મુખ્ય નથી, પણ ઉત્કટ જિજ્ઞાસા અને ખપી જવાની તમન્ના એ મોટામાં મોટી વાત છે. જો કે ખોરાક શરૂમાં થોડો ભાગ ભજવે છે, તોપણ એના ઉપર જરાયે ઝોક કે મહત્ત્વ દેવાની જરૂર નથી.

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૨૬)

\* \* \*

‘વાડ વિના વેલો ચઢે નહિ’ તેનો અર્થ એવો નહિ કે ગુરુ વિના જ્ઞાન આવે જ નહિ. તેનો અર્થ તો એ કે આપણામાં જે ભાવના જાગી છે તેનો વિકાસ કરવા અમુક યોગ્ય પગલાં લેવાં ઘટે.

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૨૭)

\* \* \*

આવી પડેલા કામમાંથી કદ્દી પણ છટકવાની વૃત્તિ સેવવી નહિ; અને આપોઆપ જે કુંઈ આવી પડે—આપણા પોતાના કોઈ પણ જાતના વિચાર વિના—તો તે સહર્ષ સ્વીકારી લેવું.

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૨૭)

\*

\*

જગત મિથ્યા નથી, અસત્ય નથી, પણ જગતને જોવાની આપણી દણ્ઠિ અસત્ય છે. જ્યારે આપણે ભાવનામય થઈ જઈએ છીએ, ત્યારે જગત ‘જગત’ તરીકે રહેતું નથી; ભગવાનના વ્યક્ત સ્વરૂપ તરીકે ત્યારે આપણને તે દેખાય છે.

વ્યવહારને આપણે નકારવાનો નથી, તેમજ વહેવારને તાબે પણ થઈ જવાનું નથી. આપણે ભગવાનના એક જીવંત સજ્ઞાન, સભાન ચેતના-વાહન તરીકે સંસાર-વહેવારમાં જીવવાનું છે.

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૨૮)

\*

\*

સતત અત્યાસ અને વૈરાગ્ય વિના આપણને સાચી દણ્ઠિ, સાચું જ્ઞાન મળે નહિ. અત્યાસ એટલે કે આપણે જે ધ્યેય ધાર્યું છે— ભગવાનને મેળવવાનું—તેનું જ સતત ચિંત્વન પ્રેમ-ભક્તિભાવે આપણામાં જાગ્રત રહ્યાં કરે તે. તે આપણી જિજ્ઞાસા અને તમન્નાને વેગવંતી, પ્રાણવાળી, બળવાળી અને ચેતનવંતી બનાવ્યા કરશે. આ સધણું થવા માટે આપણામાં વૈરાગ્યની ભાવના પણ ખૂબ જામેલી હોવી જોઈએ. વૈરાગ્ય એટલે ‘સંસાર, જગત મિથ્યા છે’, વગેરે વિચારો નહિ, પણ કોઈ પણ બાબતની આપણને આસક્તિ ન રહે, રાગ ન રહે એનું નામ વૈરાગ્ય. વૈરાગ્ય એટલે નિર્જામ, નિર્મોહ, નિરાગ્રહ, નિરહંકાર, નિલોભ વગેરે વગેરેની સમગ્રતા.

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૨૯-૩૦)

\*

\*

ભગવાનના શરણથી ગમે તેવો દુષ્ટ માનવી પણ સુધરી જય છે. કેટલીક વાર તો એની લાયકાત આ માર્ગ વધારે પણ હોઈ શકે. જેટલો વધારે પતિત અને વધારે પાપી તેટલો ઉદ્ય પણ કદાચ વધારે વેગવાળો થાય—જેમ જમીન પર પછડાયેલો દડો જેટલો જોશથી નીચે પડ્યો હશે, તેટલા જોશથી ઊંચે આવવાનો—અલબત્ત આ અંગે સાર્વત્રિક નિયમ બાંધી ન શકાય.

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૩૧)

\*

\*

પર્વતની મોટી મોટી શિલાઓની અંદર રહેલું પાણી તેનાં છિદ્રોમાંથી પણ વહેવાને જોર કરી રહેલું હોય છે. તેવી રીતે આપણી અંદર રહેલો ભગવાન પ્રગટ થવાને માટે હંમેશ તૈયાર હોય છે. માત્ર આપણી તૈયારી કે તમના જાગેલી હોતી નથી.

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૩૩)

\*

\*

એક ઘડાનું મોહું સજજડ બંધ કરીને પછી તેને દરિયામાં નાંખવાથી તેમાં પાણી ભરાશે નહિ. તેવું આપણું છે. માટે મોહું ખોલીને, હુદ્ય ખોલીને, તેમાં ભગવાનનું નામ-ભાવ જેટલું ભરાય એટલું ભર્યો કરવું. તો પછી એ પરમ કૃપાળું આપણને અધે દેખાવા લાગશે.

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૩૩)

\*

\*

સાધના કરતાં કરતાં અથવા ધ્યાન સમયે કે ગમે તે વખતે ચમત્કારો દેખાય; આપણામાં કોઈ નવી શક્તિ આવી છે એવું સમજાય; અમુક સિદ્ધિ મળે; પરંતુ આ બધા તરફ કશું લક્ષ પરોવવું નહિ. તે ફસાવનારી વસ્તુઓ છે. આપણને તો ભગવાન જ મેળવવાના છે.

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૩૩)

\*

\*

ગુરુ તરફથી કંઈ ગાંધેલું પણ સૂચવાયું હોય તે કરવામાં ઉમંગ રાખીને તેમ કરવાથી એક પ્રકારનો શરણભાવ કેળવાતો જતો હોય છે; ને આપણી જ રીતે કામ લેવાના કે કરવાના આગ્રહો ઘટતા જાય છે. શરણાગતિ કેળવવા માટે આવી તાલીમ ઉપયોગી છે.

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૩૬)

\*

\*

ધ્યેય પરત્વેની અસાવધાનતા એનું નામ મૃત્યુ.

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૩૬)

\*

\*

આપણે માટે કોઈ થોડું કશું કરે અથવા બીજાનું રાઈ જેટલું પણ જો સારું હોય, તે આપણને ભાવનાથી કરીને પહાડ જેવું લાગ્યાં કરે, એવી સાધકની દણ્ણ કેળવાવી ઘટે. આથી પરસ્પર હૃદય વધુ પાસે આવ્યાં કરશે. (‘જીવનમંથન’, આ.૨, પૃ. ૪૮)

\*

\*

પત્રલેખન જો ચેતના-સાંકળથી સંકળાયેલા રહીને લખતી વખતે લક્ષમાં ભાવમૂર્તિને હૃદય સમક્ષ રાખ્યાં કરીને લખવાનું રાખીએ તો દિલમાં ઘણો આનંદ રહ્યા કરતો અનુભવાશે.

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૫૧)

\*

\*

પ્રેમને તો આપણે આપણી ભૂમિકાના માપથી માપવા મથ્યાં કરીએ છીએ એટલે જ વાંધો આવે છેને? લોકો જેને ‘પ્રેમ’ ‘પ્રેમ’ પોકાર્યા કરે છે તે પ્રેમ નથી, પણ પોતાના સ્વાર્થની સમજણ પ્રમાણેની માત્ર તેવા પ્રકારની લાગણી છે.

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૫૪)

\*

\*

આપણે હૃદયને ઓળખતા થઈએ એટલે કે ભગવાનને

ઓળખતા થઈએ—નહિ કે માણસને.

આપણા આંતરિક જીવનનો પ્રવાહ સતત એકધારો હૃદયના આધાર પ્રમાણે વહેતો થયા કરે તે જ જીવનવિકાસ થાય.

જેના પાયા પર આપણે જીવનવિકાસ રચવો છે, તે પાયામાં શ્રદ્ધા, ભક્તિ અને હૃદય પરત્વેની પ્રામાણિકતા તથા વફાદારી ભારોભાર ભરેલાં હોવાં જોઈશે.

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૫૮)

\*

\*

એક વખત જો સાધનાના માર્ગમાં દઢ, નિશ્ચયાત્મક, મરણિયો નિર્ધાર પ્રગટી જાય તો પછી ગમે તેવાં પરિણામ આવે તેનાથી આપણે ડગવાનું ન હોય.

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૫૮)

\*

\*

આપણું કોઈ કર્મ યોગ્ય હતું કે નહિ તે સમજવાની ઉત્કંઠા ને આતુરતા હોય તે સમજ શકાય; પરંતુ એક વખત કર્મ કરી દીધા પછી એ વિષે જારી ફિકર ચિંતા સેવ્યાં ન કરવી. જે તે બધો વિચાર કર્મના આદિમાં કરવો. (‘જીવનમંથન’, આ.૨, પૃ. ૬૦)

\*

\*

સદ્ગુરુ અંગેનો કે આપણા સાધનામાર્ગ અંગેનો આપણી આજુબાજુઓમાં, સગાંસંબંધીઓમાં કે ભિત્રોમાં વાણીથી યા લેખનથી ઝટ દઈને અધીરાઈભર્યો પ્રચાર કરવા ન મંડી પડવું. આપણા જીવનનો વિકાસ ને આપણા સ્વભાવનું રૂપાંતર જેમ જેમ થતાં જશે, જેમ જેમ એની સુંદર છાપ, અસર તેઓ ઉપર પડતી જશે તેમ તેમ તેમને તેમને પણ આ માર્ગના મહત્વ વિષે આપમેળે લાગ્યા વિના રહેવાનું નથી અને એવું લાગવું બને તે વધારે તત્ત્વવાળું ને ઊંડી અસર કરનારું નીવડશે.

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૬૧)

\*

\*

જીવનવિકાસ કાળે રચનાત્મક બાજુનું વાચન આપણી સમજણા  
કેળવવાને માટે મદદરૂપ થઈ પડે ખરું. જે કંઈ કરીએ તે સાધનાના  
અંગ તરીકે ગણી લેવાનું છે. એવું વાચન તે પણ ભાવનાના  
વિકાસ કાળે છે, એ દણિએ જો વાંચવાનું કરીએ તો ફાયદો થાય.

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૬૨)

\*

\*

પ્રતિક્ષણ ધર્મ બદલાતા જાય છે; એક પરિસ્થિતિનો જે ધર્મ  
હોય તે બીજી પરિસ્થિતિ થતાં તેનો તે ન રહી શકે અને સૌ  
સૌના, વ્યક્તિત્વે વ્યક્તિત્વે ધર્મ પણ બિન્ન હોઈ શકે.

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૬૨)

\*

\*

સત્યનું પણ એમ જ. આપણું સત્ય તે બીજાનું ન પણ હોઈ  
શકે અને આપણું આ ક્ષણનું સત્ય તે બીજી ક્ષણે બદલાઈ જઈ શકે  
છે. સત્ય અનંત છે. તેને સીમા નથી. “આ જ અને આટલું જ”  
સત્ય એમ કદી ન કહી શકાય. ‘અમુક જ સત્ય’ એમ જો હોય  
તો તેની તો તે રીતે મર્યાદા બંધાઈ ગઈ—સીમિત બની ગયું—  
—એટલે અનંતતાનો ગુણ ઊરી ગયો ને તેમ થતાં તે પોતે જ  
આપોઆપ અનંત સત્ય મટી જતું હોય છે.

\*

\*

શ્રીદત્તાત્રેય ગુરુજીએ ૨૪ ગુરુ કરેલા. તેમાં માનવકોટિ  
કરતાંયે નીચલી શ્રેષ્ઠીના જીવો હતા. છતાંયે એમનામાંથી તેઓ  
જીવનતત્ત્વને પામ્યા. એમાં મહત્ત્વા અને ખૂબી તો તેમની પોતાની  
હતી. એટલે એ રીતે પણ જે ખૂબી કે મહત્ત્વા સદ્ગુરુમાં સાધકને  
જણાય તો તેમાં ખરું મહત્વ સાધકની કેળવાયેલી દણિ ને  
ભાવનાનું હશે.

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૬૩)

\*

\*

પોતાના દોષો પોતાની મેળે જડે અને તેમાં રાચવાનું મન  
ન થાય તે પૂરતું નથી. તેમાં પ્રવેશવાનું થતાં મનને અડવું અડવું  
લાગે ને ફરીથી ભવિષ્યમાં તેમાંથી ઊગરી જવાનો પાક્કો નિર્ધરિત  
પ્રગટી જાય તો તે ઉપયોગનું છે. બાકી તો દોષ જણાય પણ તેનું  
નિવારણ ન થાય, તો તો ઠેરના ઠેર.

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૬૩)

\* \* \*

દોષના વારંવાર વિચાર ન કરવા. એના કરતાં તો  
ભગવાનની ભક્તિમાં મન પલળેલું રહે એ વધારે ઉત્તમ છે.  
માત્ર દોષો ખોળવાને જ મથવાનું નથી. એનો અર્થ એમ નથી  
કે દોષો પ્રતિ દુર્લક્ષ કરવાનું છે. દોષોને ટાળવાનો જ માત્ર  
પુરુષાર્થ કરવાનું કર્મ તો કોરું કોરું કર્મ છે. એનાં કરતાં  
પ્રભુભાવથી ભીજેલું હૈયું રાખવાનો પુરુષાર્થ થતો રહે તો સર્વ  
કંઈ સુતરું સુતરું વહ્યાં કરે.

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૬૩-૬૪)

\* \* \*

જીવનમાં જ્યારે ઘણા Co-incidents-યોગાનુયોગ થાય,  
ત્યારે તેમાં કયાંક દિવ્ય સાંકળ છે એવા અનુમાન ઉપર કોઈ  
આવે ને એને એવા હકીકતપણામાં માને તો તે માત્ર કલ્પના છે  
એમ ન કહી શકાય. ને એવાને માટે પ્રત્યક્ષપણે શ્રદ્ધા-વિશ્વાસ  
જીવંત કરનારું પણ તે નીવડી શકે છે.

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૬૪)

\* \* \*

હૃદયમાં પ્રેમ ઉદ્ભબે છે, ત્યારે તે ચાહ્યા વિના રહી શકતો  
નથી. કારણ કે એ તો એનું લક્ષણ છે. એથી કરીને પ્રેમી જ્યારે  
ચાહે છે, ત્યારે તે વધારે કશું કરતો હોતો નથી. એણે તો

નિરપેક્ષપણે ચાહવું જ પડે છે. ('જીવનમંથન', આ.૨, પૃ. ૬૭)

\*

\*

પ્રેમની ભાવનાનો બુદ્ધિ કે સમજણથી ખ્યાલ સાચી રીતે  
આવી શકતો નથી. જ્યાં સુધી આપણાં હદ્ય એટલાં ઉદાત, ઉદાર  
ને મહાનુભાવી થયાં હોતાં નથી, ત્યાં સુધી સાચા પ્રેમની ભાવનાને  
કલ્યવી દુષ્કર છે અને તેની કદર પણ થઈ શકતી નથી.

('જીવનમંથન', આ.૨, પૃ. ૬૭)

\*

\*

અંતરની પ્રગટેલી સદ્ગ્યાવનાના હેતુનાં બીજ આપણે  
ધારીએ છીએ, એના કરતાં ઘણાં ઊંડા પડતાં હોય છે. કોક ને  
કોક દિવસે તે ઊગી નીકળતાં પણ હોય છે.

('જીવનમંથન', આ.૨, પૃ. ૬૮)

\*

\*

હદ્યના ઊંડાણમાં જ્યારે આપણે ગયા હોઈએ છીએ, તે  
સ્થિતિમાં એકાગ્રપણે ભાવનાથી જે કંઈ બોલાયાં કરે, સંભળાયાં  
કરે તે તે બધું ઊંદું ઉત્તરતું હોય છે.

('જીવનમંથન', આ.૨, પૃ. ૬૮)

\*

\*

એક રાતમાં જીવન પલટાઈ જઈ શકે નહિ. “એક ક્ષણમાં  
બધું પલટાઈ જાય છે” એમ જે કેટલીક વાર કહેવામાં આવે છે  
તેમાં અતિશયોક્તિ સાધારણતઃ હોય છે. સ્વભાવનું રૂપાંતર  
પૂર્ણપણે એકદમ થતું હોતું નથી. ભાગ્યે કોક જ વિરલ, અતિ  
વિરલ અપવાદ હોઈ શકે.      ('જીવનમંથન', આ.૨, પૃ. ૬૮)

\*

\*

જીવન એટલે અનંત જન્મોના સંસ્કાર લઈને આવેલા

જીવની ચેતનશક્તિની માનવીદેહ દ્વારા થતી વહનક્રિયા.

(‘જીવનસંદેશ’, આ.૪, પૃ. ૨૨૪)

\*

\*

જીવન નદીના પ્રવાહની જેમ પ્રતિક્ષણો પલટાતું જાય છે ને છતાં તે પલટા જૂનાના આધાર ઉપર જ થતા રહેતા હોય છે. જૂના સંસ્કારોએ નદીના પટની માફક એક પટ રચેલો હોય છે; તે પટમાં વહેવા તરફ જીવનપ્રવાહનું વલાશ અને નવા સંસ્કારોનું ઘડતર સાધારણતાઃ અને સ્વાભાવિકપણો હોય છે. તેથી હંડ્રિયોના સામ્રાજ્ય હેઠળ માનવીઓ કર્મના-સંસ્કારનાં પોટલાં બાંધીને જગતમાં આવ્યા હોય છે અને વધારે મોટાં પોટલાં બાંધીને જગતમાંથી ચાલતાં થાય છે.

(‘જીવનસંદેશ’, આ.૪, પૃ. ૨૨૪-૨૫)

\*

\*

હંડ્રિયો નિરાસકત થવા માંડે છે ને પછી તેમ થાય છે, ત્યારે જ આપણાને સાચી વિવેકશક્તિ મળે છે. એવી વિવેકશક્તિની આંખ ઊઘડ્યા પહેલાંના નિર્ણયો આપણી બુદ્ધિના નિર્ણયો હોય છે અને આપણી બુદ્ધિ અનેક જન્મોના સંસ્કારોથી વિધવિધ રંગે રંગાયેલી હોય છે; તેથી એવી બુદ્ધિએ સુજાદેલા નિર્ણયો પૂરેપૂરા સાચા છે એમ માની લેવું એ પ્રભુપંથે જવામાં અવરોધકર્તા છે.

(‘જીવનસંદેશ’, આ.૪, પૃ. ૨૨૫)

\*

\*

પ્રતિક્ષણ બદલાઈ રહેલા વિશ્વમાં જીવનના જેટલું જ મહત્વ ધરાવતી વસ્તુસ્થિતિ મૃત્યુમાં છે. જીવન અને મૃત્યુ, ઉભયનું વાસ્તવિક સ્વરૂપ એક જ છે. જ્યાં મૃત્યુ છે, ત્યાં જ નૂતન જીવન પણ છે ને જ્યાં જીવન છે ત્યાં મૃત્યુનું પરિણામ પણ નિશ્ચિત છે.

મૃત્યુ અને જીવન એક જ જીવનતત્ત્વનાં બે દર્શન છે.

(‘જીવનસંદેશ’, આ.૪, પૃ. ૨૩૫)

\*

મૃત્યુ પ્રતિ માનવીને હંમેશાં આણગમો અને બીક રહ્યાં કર્યાં છે. તેનું કારણ તેની અપરિવર્તનશીલ મનોદશા અને અગમ્ય વિષેની ભીતિ છે.

મૃત્યુની પાછળ શોક કરવાની અસાત્ત્વિક વૃત્તિમાં, લાગણીમાં, નરી આસક્તિ છે અને અજાણી ઊંડી સ્વાર્થવૃત્તિ પણ હોવા સંભવ છે. (‘જીવનસંદેશ’, આ.૪, પૃ. ૨૩૭)

\*

અગમ્ય અને અકલ્ય એવી આપણી હૃદયની ભૂમિકાને જીવનની સર્વ ભૂમિકાની અંદર અવતરણ કરાવનાર સાધન લાગણી અને ભાવના છે. (‘જીવનસંદેશ’, આ.૨, પૃ. ૨૪૪)

\*

ભગવાનનાં જેટલાં નામ છે, તે પ્રત્યેક નામની પાછળ જીવનમાં તેવી જાતનો ભક્તોનો અનુભવ રહેલો છે; બાકી તેનાથી અતિરિક્તપણે ભગવાનમાં તેવું કશું નથી.

(‘જીવનસંદેશ’, આ.૨, પૃ. ૨૬૦)

\*

સદાચાર એ આધ્યાત્મિક જીવનનો મૂળ પાયો છે. તેમ છતાં સાધક પોતાના અંતરાત્માની સાધનામાં ઊંડો ને ઊંડો જેમ જેમ અનુભવે દઢ થતો જાય છે, તેમ તેમ ઉપર જણાવેલા પ્રદેશમાં પણ તે બદ્ધ રહી શકતો નથી. એક કાળે સદાચાર એ એના જીવનનો મૂળ પાયો હતો ને હકીકતપણે સત્ય હતું, ને તે જ સર્વસ્વ કંઈ હતું; પરંતુ આગળ જતાં, તે પ્રદેશનું કાર્ય પૂરું થઈ જતાં, તે પ્રદેશ-ભૂમિકા પર પહેલાં જેટલો જીવતો ઝોક તે જીવનો રહેતો હતો, તે

જીવંત ઝોકનો પ્રદેશ હવે કોઈ ઉચ્ચતર દશામાં વળી રહેલો હોય છે એટલું જ. અને ત્યાંથે પોતાની જ્ઞાનભક્તિપૂર્વકની જીવંત તટસ્થતા તો તે રાખ્યાં જ કરતો હોય છે.

(‘જીવનસંદેશ’, આ.૪, પૃ. ૨૪૬)

\*

\*

જે ગરીબ બકરીથીએ વધુ ગરીબ છે ને સાથે સાથે જેના અંતરમાં સિંહના જેવી શક્તિ ભરેલી છે તે સાચા અર્થમાં નમ્ર છે.

શક્તિ પોતે જ નમ્રમાંથે નમ્ર અને ઉગ્રમાંથે ઉગ્ર છે. જો તે સ્વભાવત: નમ્રથીયે નમ્ર ન હોય તો તે જડ જેવા દેખાતા પદાર્થમાં તે ક્યાંથી ભળી ગઈ હોત?

શૂન્યતા એ નમ્રતાનું અંતિમ માપ છે. શૂન્યતા એટલે અહંતાનો સર્વાશે લય.

જેનામાં લેશ પણ અહંતા કે અભિમાન નથી રહ્યું તેને જ નમ્રતા વરે છે.

અહંતા કદી કદી તો નમ્રતાનો સ્વાંગ સજીને પોતાનો વેશપલટો છુપાવે છે.

(‘જીવનસંદેશ’, આ.૪, પૃ. ૨૪૭-૨૮-૨૮)

\*

\*

કોઈ આપણો વિરોધ કરે, ત્યારે આપણે ધીરજ ન ખોઈ બેસીએ અને જેમની સાથે આપણાને વિરોધ થાય તેના પ્રત્યે પણ આપણે નમ્રતાથી અને આધ્યાત્મિક સદ્ગુરૂત્થી વર્તીએ.

સાધારણતા: આપણો એ સ્વભાવ જ થઈ ગયો છે કે કોઈ આપણા મતને ન માનતો હોય એને આપણે આપણો વિરોધી માની લઈએ છીએ; આ અસહિષ્ણતાનું સ્વરૂપ છે.

(‘જીવનસંદેશ’, આ.૪, પૃ. ૨૫૧)

\*

\*

ઉંડાં વેર હંમેશ કોઈ ને કોઈ જતના ઉંડા ધાને લીધે જન્મે છે. પછી ભલે ધા કરનાર વ્યક્તિ કોઈ બીજી જ હોય. ધવાયેલો માનવી પછી જોઈ શકતો નથી કે, “ધા કરનાર કોઈક છે ને હવે હું જેને ધા કરું છું તે તો બીજું જ કોઈક છે.”

(‘જીવનસંદેશ’, આ.૪, પૃ. ૨૫૨)

\*

\*

આપણે જેમને સમજવાની તસ્ટી લીધી નથી, તેમના કરતાં આપણે ઉચ્ચ છીએ એવા મિથ્યાબિમાનથી કુલાઈ જવાની વૃત્તિ ઉપર આપણે અંકુશ મૂકવો ઘટે.

(‘જીવનસંદેશ’, આ.૪, પૃ. ૨૫૨)

\*

\*

જીવનની સર્જન પ્રવૃત્તિ અસંખ્ય રીતે પ્રગટ થાય છે, તે દરેકનું મૂલ્ય અપ્રતિમ હોય છે. કેટલીક વાર આ સર્જનપ્રવૃત્તિ મહાભયાનક સંહારપ્રવૃત્તિ દ્વારા પણ સધાતી હોય છે.

(‘જીવનસંદેશ’, આ.૪, પૃ. ૨૫૨)

\*

\*

ભયાનક ને અનિષ્ટ દેખાતી પ્રવૃત્તિમાં પણ, એટલે કે પ્રત્યેક પ્રકારની પ્રવૃત્તિમાં ને પ્રકૃતિમાં પણ, ઈષ અને અનિષ્ટ એમ બન્ને પ્રકારો હોવાના.

કોઈ પણ કામ કરવાની રીતમાં પણ આવી “સાચી અને ખોટી” રીતનું સંમિશ્રણ હોવાનું.

સામાન્યપણે અનિષ્ટ ગણાતી વસ્તુનો કે પરિસ્થિતિનો સામનો કરવાનો આવે ત્યારે એમાં પણ કશુંક તો ઈષ છે એમ સમજીને તેનો સામનો જ ન કરવો એ જેમ એક પ્રકારની ભ્રમણા કે અયોગ્યતા છે, તેમ તેનો સામનો કરવામાં તાટસ્થ્ય ગુમાવી

કડવાશ ધારણ કરવી એ બીજા પ્રકારની ભ્રમણા છે.

(‘જીવનસંદેશ’, આ.૪, પૃ. ૨૫૨-૫૩)

\*

\*

સંપૂર્ણ સમભાવ અને પ્રેમજન્ય સમજણથી આપણે જગતનાં અનિષ્ટોનો સ્વીકાર કરવો જોઈએ ને તેનો જરૂર લાગે ત્યાં જરૂર પડે તેટલી જ માત્રામાં સામનો કરવાનો આવે તો તે કરવો જોઈએ.

દિવ્ય ચૈતનાશક્તિ તો માનવીને જેવો હોય તેવો ને તેવો જ સ્વીકારે છે; ને તે નિર્બળ હોય કે સબળ, જગતની દસ્તિએ અનિષ્ટ હો કે ઈષ્ટ હો, તો યે તેના ઉપર પ્રેમ રાખે છે, કેમ કે જેઓમાં એ ચૈતન્યશક્તિએ વાસ કર્યો હોય છે, તેઓનો પ્રેમ તો સ્વયંભૂ ને નિરાલભ હોય છે. પ્રેમશક્તિથી જ દુષ્ટમાં દુષ્ટ લુંટારાને કે અધમાધમ પતિત માનવીને તેઓ સંત કોટિમાં પલટાવી શક્યા છે.

(‘જીવનસંદેશ’, આ.૪, પૃ. ૨૫૩)

\*

\*

જેમ કોઈક અઠીક વાતાવરણમાં જવાનું થતાં મન તેવું કળી શકે છે, તેમ શરીર પણ કેટલેક ઠેકાણેથી પાછું પડી શકે છે. વળી કેટલાકને તેવા વાતાવરણનો ખોરાક પણ ચાખ્યા વિના જ અયોગ્ય અને અકારો લાગી શકે છે તેમ જ કોઈક સ્થળે બેસતાં જ શરીરથી વાતાવરણના ધ્વનિની પકડઆવી જઈ શકે છે, જેમ કીરીની ગળપણ સુંઘવાની ઈદ્રિય પ્રાકૃતિકપણે ઘણી તીવ્ર હોય છે તેમ.

(‘જીવનસંદેશ’, આ.૨, પૃ. ૨૮૧)

\*

\*

સત્કર્મનો બદલો સત્કર્મ જ આપી ચૂકે છે તેમાં અપેક્ષાને સ્થાન નથી.

(‘જીવનસંદેશ’, આ.૭, પૃ. ૨૮૧)

\*

\*

વાસનાઓનો એમની એમની રીતે ઉપયોગ કરવા જતાં એમનો વેગ વધવાનો છે. એ રીતે તેમની શુદ્ધિ સાધી શકાય નહિ. પણ એમનાં વહેણા પટથી બિન્ન રીતે તેનો જ્ઞાન ભક્તિપૂર્વક ઉપયોગ કરવાનો છે. નથી એમને નકારવાની કે નથી એમને જડ બનાવી દેવાની. નકાર્ય કે જડ બનાવી દીધે કંઈ એમનું અસ્તિત્વ નાશ પામી શકવાનું નથી.

ગુણધર્મ કે સ્વભાવનો નાશ સંભવી શકે નહિ. એનું રૂપાંતર થતું જાય. (‘જીવનસંદેશ’, આ.૭, પૃ. ૨૮૫)

\* \* \*

પરમતત્ત્વ પરત્વેના ભાવની ઉત્કટ પ્રેમમયતાને લીધે પોતાની જાતને તેનામાં ભૂલવાનું ને ભળવાનું બનીને એ રીતે અહંકારશુદ્ધિના માર્ગ જઈ શકાય છે.

(‘જીવનસંદેશ’, આ.૭, પૃ. ૨૮૮)

\* \* \*

જીવન કંઈ કાળપ્રવાહમાં તણાયાં કરતું માત્ર લાકું નથી, પરંતુ જીવન તો કાળને પણ વશ રાખી શકે એવી ચૈતન્યશક્તિનો આવિભાવ છે. (‘જીવનપાથેય’, આ.૩, પૃ. ૮)

\* \* \*

લાકડામાંથી કોઈ આકાર ઘડી લેવાનો હોય તો તે કારીગર પાસેથી તેને આકાર દેવાનું જ્ઞાન, એ માટે વાપરવા જોઈતાં સાધનોની માહિતી અને તેમને યોગ્ય કુશળપણે વાપરવાની આવડત તથા તે લાકડામાંથી આકાર ઘડી લેવાને ખંત, ખેવના, આંતરદષ્ટિ—આ બધું તે માણી જ લે છે ને તેવું જ સાધનામાં પણ થવાપણું રહેલું છે. (‘જીવનપાથેય’, આ.૩, પૃ. ૮)

\* \* \*

ચરણ એટલે ગતિ પ્રેરાવનાર—ગતિપ્રેરક. તેમાં સ્થિતિ-સ્થાપકતા છે, ગતિ છે ને ઉર્ધ્વપણું પણ છે. આમ ત્રણે ગુણનો સમાવેશ તેમાં છે ને તેનાથીયે તે પર પણ છે.

ચરણ વડે જ આપણે ઉભા રહી શકીએ છીએ, જ્યાં જવું હોય ત્યાં જઈ શકીએ છીએ; તે શરીરના આધારરૂપ છે, છતાં તેની કશી ગણતરી ન હોય તેમ તે પ્રવત્ત્યા કરે છે. તે મહત્વનું અંગ હોવા છતાં જાણે કશું જ મહત્વ તેનું ન હોય એમ લાગે છે, તેથી ચરણની ભાવનામાં જ્ઞાનભક્તિપૂર્વકની નમ્રતા રહેલી છે; તેવું આપણાથી થવાય તે કાજે પ્રતીક તરીકે આધ્યાત્મિક માર્ગમાં એની પૂજાને સ્થાન હોય; કિંતુ તે જડ તરીકે નહિ. ચરણનો જ્ઞાનભાવ તો દાસાનુદાસ છે. નમ્રતા કેળવવાનું તે પ્રત્યક્ષ પ્રતીક છે. તે બરછટ ને જડ જેવાં હોવા છતાં એના સૂક્ષ્મ ભાવમાં ને ચૈતનપણામાં ફરક પડતો નથી.

(‘જીવનપાથેય’, આ.૩, પૃ. ૧૦-૧૧)

\* \* \*

જે ગતિમાંથી આપણામાં જીવંત શ્રદ્ધા જન્મે, જે ગતિમાંથી હૃદયમાં ભક્તિની પ્રેરણા જાગે, સચરાચરમાં વ્યાપી રહેલા ચૈતન્યને અંતરના ઉમળકાથી પ્રણામ કરવાની સહજ ઊર્ભિ જાગે ને એવું જ્યાં જ્યાં ને જ્યારે જ્યારે થાય ત્યાં ત્યાં પોતાના શ્રીગુરુચરણ છે એમ અનુભવવું.

(‘જીવનપાથેય’, આ.૩, પૃ. ૧૩)

\* \* \*

નમવું એટલે જેને નમન કરવામાં આવે છે, તેનામાંથી ગ્રહણ કરવા લાયક જે કંઈ ઉત્તમ હોય તે ગ્રહણ ને સ્વીકાર કરવાની હૃદયની ઉત્કટ ભાવનાથી નમીને તે લેવા જવાનો ભાવ રાખવો તે.

સ્થૂળ નમવામાં કશો લાભ નથી; બલ્કે દંભ વધવાનો સંભવ છે. સંતમહાત્માઓને માત્ર પગે લાગવાથી કશું વળે નહિ.

(‘જીવનપાથેય’, આ.૩, પૃ. ૧૩)

\* \* \*

જેને ચિંતા હોવાનાં પૂરતાં સબળ કારણો અને સંજોગો  
હોવા છતાં તેનો કશો ભાર જ્ઞાનપૂર્વક લાગતો નથી, એવી  
પ્રેમભક્તિપૂર્વકની સ્થિતિને પ્રસન્નતા કહી શકાય.

પ્રસન્નતા એ કંઈ ઉભરાની સ્થિતિ નથી કે કોઈ ઉર્ભિનું  
વેવલાપણું પણ નથી.                            ('જીવનપાથેય', આ.૩, પૃ. ૩૩)

\*

\*

જેમાં જેમાં પરોવાવાપણું બનેત્યાં ત્યાંથી સાધકે શીખ્યાં કરવાનું  
છે. જો તેમ ન બનતું હોય તો તે કર્મ સામાન્ય માનવી જેમ ઘરેડ પેઠે  
કરેછે ને આપણે પણ તેમ કરતા હોઈએ તો એમાં પછી ફરક ન રહ્યો.

('જીવનપાથેય', આ.૩, પૃ. ૬૧)

\*

\*

પરિસ્થિતિને સહન કરી લેવી ને એનો સ્વીકાર કરવો એ  
એમાં આસમાન-જમીનનો ફરક છે.

('જીવનપાથેય', આ.૩, પૃ. ૬૨)

\*

\*

અંધ-અજ્ઞાનભરી શ્રદ્ધા કરતાં તો શ્રદ્ધા ન હોય તેવી સ્થિતિ સારી.

('જીવનપાથેય', આ.૩, પૃ. ૭૪)

\*

\*

શુદ્ધિ અને સત્ત્વવૃદ્ધિની દાખિએ જેટલું આપણું પોતાનું જીવન  
રૂપાંતર થતું રહે તે જ આપણી સાચી કમાણી—સાચું ધન છે.

('જીવનપાથેય', આ.૩, પૃ. ૭૭)

\*

\*

માનસિક ને ઐહિક વિકાસ અર્થે જેમ અનેક પ્રકારનાં  
શિક્ષણો લઈએ છીએ, તેમ જીવનવિકાસ અર્થે કષ્ટ ભોગવવાની  
—સેવા કરવાની—ને શારીરિક શ્રમ ઉઠાવવાની તાલીમ ઘણી  
જ જરૂરની છે.                                    ('જીવનપાથેય', આ.૩, પૃ. ૮૪)

\*

\*

પ્રેમ નીચે જુએ છે ખરો, પરંતુ તે નીચેનાંની દણિને  
ગૈર્ધગામી કરવા માટે. તેના નીચેના અવતરણમાં નીચેનાંને  
ગંચે પ્રેરાવવાને માટે.                            ('જીવનમંથન', આ.૨, પૃ. ૮૭)

\*

\*

અત્યાર સુધી જેને આપણે ત્યાગ માનતાં હતાં, તે ત્યાગ  
ન હતો. સાચો ત્યાગ તો આનંદમાં પરિણામે. બેળે બેળે થયાં  
કરેલું હોય તેને ત્યાગ ન કહી શકાય.

સમર્પણયજ્ઞ આપણાં અંદરનાં કરણોને તેમના  
પ્રકૃતિધર્મમાંથી મુક્તિ અપાવે છે, જ્યારે જીવપ્રકારનું ઘસાવાપણું  
કે આપવાપણું આપણને વધારે જકડાવે છે.

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૮૮/૮૯)

\*

\*

જોબનિયું તો ચાર દિવસનું ચાંદરણું છે. તેનો ઉત્તમ ઉપયોગ  
આત્માની પિછાણ કરવામાં થવો ઘટે. સંસારીને મન તે અમર  
છે. સાધકને મન તેમ નથી. તેને ગમે તેમ ખર્ચી નાંખવું પાલવે  
નહિ. જે કરી લેવાનું છે, તે અત્યારે જ કરી લેવાનું છે. યુવાની  
એ જીવનનો સર્વશ્રેષ્ઠ કાળ છે. સાધના માટે પણ આ જ સમય  
ઉત્તમોત્તમ છે. સાહસ અને અજ્ઞાણમાં ભૂસકા મારવા એ તો  
માત્ર યુવાની જ કરી શકે. સાધકનો પ્રથમ ધર્મ આ ગાળાને  
પ્રેમથી ઉત્સાહમાં આદર્શની રણભૂમિમાં જોડી દેવાનો છે.

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૮૯-૯૦)

\*

\*

કોઈ પણ વૃત્તિ શાથી ઉઠે છે તેનાં ઉંડાં મૂળ શોધી કાઢવાની  
શક્તિ સાધકે મેળવી લેવી જોઈશે.

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૧૦૦)

\*

\*

પ્રભુની લોહચુંબકની શક્તિના આકર્ષણના વર્તુલમાં આપણે આવી શકીએ એટલી નિકટતાની મર્યાદામાં આવવાનું કર્મ આપણા હાથમાં રહેલું છે. એક વાર તે વર્તુલમાં, પ્રવેશવાનું કરી શક્યા તો પછી તો જેમ સોય આપોઆપ લોહચુંબક નજીક હોતાં ખેંચાય છે તેમ આપણું થયાં જરે. પછી ખેંચાવાનો પ્રયાસ આપણે નહિ કરવાનો રહે.      ('જીવનમંથન', આ.ર, પૃ. ૧૦૧)

\*

\*

પ્રેમ કોઈની દયા ખાતો નથી. પ્રેમમાં કરુણા છે. કરુણામાં સહાનુભૂતિની ભાવના છે.    ('જીવનમંથન', આ.ર, પૃ. ૧૦૩)

\*

\*

મન કે મનની સમજણ સર્વશ્રેષ્ઠ નથી. મનનું સત્ય એ પૂર્ણ સત્ય નથી. તેમ જ ખરું સત્ય પણ નથી.

('જીવનમંથન', આ.ર, પૃ. ૧૦૪)

\*

\*

કોઈનાથી આપણામાં જે કંઈ સારું યા નરસું નીપજે છે તેવું નીપજવામાં તેની ભૂમિકા આપણામાં છે.

('જીવનમંથન', આ.ર, પૃ. ૧૦૬)

\*

\*

સ્થૂળ (ધન, લક્ષ્મી આદિ) સમર્પણ કરી દેવાથી તેના પરત્વેનું આંતરિક મમત્વ સમૂળગુંયે નીકળી જાય છે એમ પણ માનવાનું નથી. હોવાછતાં, રહેવાછતાં, સમર્પણની ભાવનાનો યજ્ઞ ચાલ્યાં કરે ને સપૂર્યુંયે મમત્વ નીકળી જાય તેવી સ્થિતિ પ્રગટાવવાનો હેતુ રાખ્યાં કરવાનો છે. ધનના નિષ્કામ માલિક થાઓ, ગુલામ નહિ.

('જીવનમંથન', આ.ર, પૃ. ૧૦૮)

\*

\*

સંસારબ્યવહારમાં આવી મળેલો ધર્મ આપણે પ્રભુપ્રીત્યર્થ  
બજાવવાનો છે તે સાચું, પરંતુ તે સાથે તેમાં ભેરવાઈ પડવાનું  
પણ નથી. આપણું વર્તન યોગયોગ્ય કુશળ હોવું ઘટે.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૧૦૮)

\* \* \*

નબળાઈનો સ્વીકાર સબળ થવા માટે છે. નબળાઈમાં પડી  
રહેવા માટે નથી. (‘જીવનમંથન’, આ.ર, પૃ. ૧૧૦)

\* \* \*

માનવી માનવીને ચાહે છે તે માનવીને માટે નથી ચાહતો  
પરંતુ કોઈ ને કોઈ જાતના તેના તરફથી સંતોષાવાપણા માટે  
ચાહે છે કે વળગે છે એટલે કે પોતાને માટે જ ચાહે છે.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૧૧૨)

\* \* \*

કર્મની બાબતમાં અધીરાઈ પુષ્ટ રહે પરંતુ તે સાથે સાથે  
સંપૂર્ણ ધીરજ હોવી જોઈશે. કર્મનો અંત લાવવાની અધીરાઈની  
જે વૃત્તિ રહે છે ને તેનો ઝટ ઝટ અંત લાવવામાં આપણું મન રહે  
છે તે પણ યથાર્થ નથી. કર્મમાં સમતા, શાંતિ, ધીરજ, તટસ્થતા  
આદિએ મુખ્ય ભાગ બજાવવાનો છે.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૧૧૪)

\* \* \*

સમયના ઉપયોગ માટેની જંખના પ્રશંસનીય ખરી. તે સાથે  
સાથે સમયનો ઉપયોગ જીવનવિકાસને કાજે થવો જોઈએ, એનું  
પ્રગટ ભાન રાખવું ઘટે. (‘જીવનમંથન’, આ.ર, પૃ. ૧૧૪)

\* \* \*

સામાને કે બીજાને સમજવાનું ત્યજને જે પોતાને જ

સમજવાનું લક્ષમાં લેશો તેનો જીવનવિકાસ યોગ્ય રીતે થવાનો છે.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૧૧૭)

\*

\*

સર્વ પ્રકારે અભય થયા વિના મમતા, રાગ, કામ, કોધ, મદ, મોહ, લોભ વગેરે ટળી શકતાં નથી. સાધનામાં પહેલો અભયનો પાયો મજબૂત કરવો પડે છે.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૧૧૮)

\*

\*

પ્રકૃતિ અને સ્વભાવના હુમલા જેટલા સામાન્ય જીવને નથી પ્રગટતા એના કરતાં અનેકગણા પ્રમાણમાં સાચી અને ખરેખરી રીતે સાધના કરતા માનવીને પ્રગટે છે.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૧૧૯)

\*

\*

આપણે શરીર નથી, મનાદિકરણ નથી, પ્રકૃતિ કે પ્રકૃતિનો સ્વભાવ નથી. (‘જીવનમંથન’, આ.ર, પૃ. ૧૨૫)

\*

\*

જે કંઈ બોલવાનું હોય તે ઉપરછલ્લું ન હોય, પણ અંતરને પ્રગટ કરનારું હોય. સ્વભાવથી, લાગણીથી પ્રેરાઈને તેના હથિયાર તરીકે જે બોલવાનું થાય ને બોલી દેવાય તે જુદું અને લાગણીને આપણે વાપરીએ છીએ તેવા સભાન જ્ઞાનપૂર્વકના ઝ્યાલ સાથે એનો જે ઉપયોગ બોલવામાં થાય તે હકીકત જુદી છે. પહેલામાં બોલાયેલા બોલ આપણા માલિક બની બેસે છે, જ્યારે બીજામાં બોલાયેલા બોલના આપણે માલિક ઠરીએ છીએ.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૧૨૬)

\*

\*

પ્રેમ અનુકૂળ પણ વર્તે ને પ્રતિકૂળ પણ વર્તે, પ્રેમને અનુકૂળ-

પ્રતિકૂળ જેવું કશું નથી. સાનુકૂળ, પ્રતિકૂળ તો સામા જીવને લાગે છે. એને દિલ તો તે બન્નોમાં ભાવ જ છે.

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૧૩૦)

\*

\*

અમથું અમથું મનને અન્યથાપણામાં ફસાઈ પડવાની ટેવ હોય, તો તેવી ટેવથી મુક્તિ પાખ્યા વિના સામાના દિલને સાચી રીતે આપણાથી સમજાઈ શકાવાનું નથી.

ગુરુનું કાર્ય તો ડોક્ટરનું છે; રોગ, ગૂમડાં, ચાંદાં આદિ દૂર કરવાનું ને જરૂર પડ્યે નસ્તર-ઓપરેશન કરવાનું કાર્ય છે. તેવી વેળા તે કિયાને જે પ્રેમથી આવકારે છે, તેનો વિકાસ જરૂરી બને છે.

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૧૩૩)

(‘જીવનપગથી’, આ.૩, પૃ. ૨૨૧)

\*

\*

તાલાવેલીમાં લાગણી-ભાવનાનું પૂર હોય છે ખરું; ને તે તેમાં જ-એકમાં જ-એકાગ્ર ને કેંદ્રિત કરી મૂકે છે; પરંતુ સાથે સાથે તટસ્થતાનો ગુણ ત્યારે કેળવાયેલો હોય તો તાલાવેલીથી પણ તે આગળ લઈ જશે. તાલાવેલી થવી તે ઉત્તમ છે પણ તેમાં ગળાબૂડ કૂબી જવાય તે ઠીક નથી. તાલાવેલી કૂબી જવા માટે નથી, પરંતુ ઊર્ધ્વ થવા માટે છે. તેનો ઉપયોગ હોય, ઉપભોગ નહિ.

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૧૩૮)

\*

\*

ખુલ્લી આંખે જે જોયેલું હોય, કાનોકાન જે સાંભળેલું હોય તોપણ તેવા જોવામાં અને તેવા સાંભળવામાં આપણા મનની સમજણ જે પ્રકારની હોય તે પ્રકારના ઢાળમાં જ તે જોવાનો અને સાંભળવાનો ભર્મ આપણાને સમજાય છે. તે કિયાઓની પાછળ જોનાર અને સાંભળનાર ખરી રીતે મન છે, અને મનની સમજણ

સત્ય હોઈ શકતી નથી. નજરે જોએલું અને કાનોકાન સાંભળેલું  
પણ કેટલીક વખત આપણે સમજ્યાં હોઈએ છીએ તે કરતાં જુદું  
હોવાનો સંભવ છે, એટલે કે ખોટું હોવાનો સંભવ છે.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૧૩૮)

\*

\*

જ્યારે ભાવ જાગતો હોય છે, કે જાગેલો હોય છે, ત્યારે  
ઉંઘ મુદ્દલે પણ ન હોય એવું બને છે ખરું.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૧૪૧)

\*

\*

લાખો રૂપિયાની રકમ દાનમાં દેવાથી કે ત્યજવાથી કરીને  
તે પરત્વેનું મમત્વ કે રાગ જતો રહે છે કે જતો રહ્યો હોય છે તેવી  
સમજણમાં ક્યાંક દોષ છે. (‘જીવનમંથન’, આ.ર, પૃ. ૧૪૨)

\*

\*

બીજાંના કહેવાયા પ્રમાણે હેતુપૂર્વક ને જ્ઞાનપૂર્વક આચરણ  
કરવાથી આપણે નિરાગ્રહી બનતાં જઈએ છીએ, કારણ બીજાંનું  
કહું કરવામાં આપણી સમજણથી બીજી રીતે પણ વર્તવું પડેછે ને તે  
રીતે આપણા અહ્મને ઓગાળવાનું બનતું રહે છે. બીજાંનું કહું  
આનંદથી ને હેતુપૂર્વક કરવા જતાં આપણે ગુલામ નથી બની જતાં,  
ઉલટું આપણે સામાના કરતાંયે આપણી જાતને ઉંચે પ્રગટાવતા  
જઈએ છીએ; જેમ વજનદાર વસ્તુ હલકી બનતાં નેછેક જ હલકી  
બની જતાં તે હવામાં પણ અધ્યર તરી-રહી શકે છે તેમ.

સ્વયંસ્કૃતિ ને ઉત્સાહથી પોતાના વિકાસાર્થે સર્વસ્વપણે ને  
સર્વભાવે કોઈ યોગ્ય સમર્થને શરણો જવામાં જીવનનો અદ્ભુત  
વિકાસ સાધી શકાય છે. શરણ એટલે ગુલામી નથી. શરણાગતિનું  
રહસ્ય મહામૂલું છે. (‘જીવનમંથન’, આ.ર, પૃ. ૧૪૫)

\*

\*

જીવનમાં જીવનનાં મૂલ્યાંકનો પ્રત્યેક ભૂમિકાએ જુદાં જુદાં  
અને બદલાતાં રહે છે. જીવનનું પરિવર્તન થતાં તેમ થવું આવશ્યક  
ને સાહજિક પણ છે. (‘જીવનમંથન’, આ.ર, પૃ. ૧૪૭)

\*

\*

પ્રેમ કોઈને ગુલામ બનાવતો નથી, હાથે જંજરો પહેરાવતો  
નથી, ચારે કોર સ્વતંત્રપણે વિહરવાની પૂર્ણ સ્વતંત્રતા બક્ષે છે,  
જેમ ભગવાને આપણને બક્ષી છે તેમ.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૧૪૭)

\*

\*

માનવી સર્વ કંઈ કરવા સમર્થ છે. જો આ વિધાનને  
સ્વીકારીએ તો પછી પ્રારબ્ધવાદ કે નિયતિ જેવું કશું રહેતું નથી.  
પ્રારબ્ધ, પુરુષાર્થ એવા બધા વાદ જેને ખરી ધગધગતી તમના  
પ્રગટે છે તેને વળગી શકતાં નથી.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૧૪૮)

\*

\*

જ્યાં સુધી જગત છે, દ્વંદ્વ છે, ગુણ છે ત્યાં સુધી બધાં સત્યો  
Relative-સાપેક્ષ છે. (‘જીવનમંથન’, આ.ર, પૃ. ૧૪૮)

\*

\*

બધી લલિત કળાઓમાં જીવનની કળા સર્વશ્રેષ્ઠ છે.

\*

\*

જગતમાં, કુદરતમાં જ્યાં જુઓ ત્યાં સુસંવાદ, સુમેળ છે.  
વિસંવાદ લાગે છે પણ તે તો છે માત્ર સપાટી ઉપરનો. સમુદ્રમાં મોટાં  
મોટાં મોજાંઓ ઉછણે છે ખરાં, પણ એની ભીતરમાં તો ગંભીરતા ને  
સ્થિરતા છે. આટઆટલા વિખવાદ, આટઆટલાં કારમાં વિશ્વયુદ્ધો,  
અનેક પ્રકારના દ્વેષો, અથડામણો—આ બધું હોવા છતાં સમાજ  
ટકી રહ્યો છે એ સુસંવાદનાં બળ ઉપર. એ સુસંવાદ માનવસમાજના

હાઈમાં ગૃહપણે પડેલો છે. જેમ ચેતનને આપણે જોઈ શકતા નથી, પણ તે છે તે હકીકત છે, તેમ આ અંતર્ગત સુસંવાદનું પણ છે.

જીવનના ભેદના પહાડો મહીં સુભેળનું ઝરણું,  
વધ્યાં અંતર કરે, તેને નિહાળે, તે જીવન પામે.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૧૬૫-૬૬)

\* \* \*

માનવી કેટલો બધો ભીરુ હોય છે ! ક્યાંક યુદ્ધ આવ્યું, ક્યાંક મથામણ પ્રગટી, ક્યાંક અથડામણ થઈ કે જાણે ‘ઉભી પૂછુડીએ’ ભાગે છે. જીવનનો સાધક તો સંગ્રામમાં પ્રેમથી, શૌર્યથી જગ્યુંમણે. એને તો જીવનમાં અનેક પ્રકારનાં યુદ્ધો પ્રગટવાનાં. એ લડતાં લડતાં ખતમ થઈ જવાના ઉમળકાથી પૂરેપૂરી તૈયારી સેવતો હોય છે. એ તો કહે છે કદાચ હારીશું તોયે તે જીતવા માટે છે. તેવી તેની હારમાંથી પરાક્રમ અને મર્દનગી પ્રગટે છે. ભગવાનને તે સમયે વધુ ને વધુ હૃદયથી વળ્ગે છે. ભગવાન જ એનો સાચો સહારો છે એમ તેને લાગી જાય છે. ‘એક સહારો રામ’, એ તે અનુભવે છે. ભગવાનને આર્તિતા ને આર્ક્રિતાપૂર્વક હૃદયથી કરેલા પોકાર અને તે સમયે એનાથી થતી ગદ્ગાદ ભાવનાયુક્ત પ્રાર્થના એ જ એનો રામબાળ ઉપાય બની રહે છે.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૧૬૮)

\* \* \*

ભગવાનના ભાવને પુરુષ કે સ્ત્રી એવી જાતિની મર્યાદા નથી, લિંગનાં ભેદ નથી. એને નથી કાળ કે નથી સંજોગો. એને કોઈ પરિસ્થિતિ નથી. (‘જીવનમંથન’, આ.ર, પૃ. ૧૭૩)

\* \* \*

મૈત્રીની ભાવના જેમ જેમ વિસ્તારને પામે છે તેમ તેમ સ્પર્ધાની લાગણી ઓસરવા માંડે છે; કરુણા જેમ જેમ જ્ઞાનપૂર્વક કેળવાતી જાય છે, ને જેમ જેમ એનો વિસ્તાર વધે છે, તેમ તેમ

અહંકારનો લય થતો જતો અનુભવાય છે. મુદ્દિતાનો—સર્વ પ્રકારની પ્રસન્નતાનો ઉદ્ય થતાં અદેખાઈનો નાશ થતો જાય છે. નિઃસ્પૃહતાથી ક્ષોભ, કલેશ, મોહ, મમતા આદિનો લય થવા માંડે છે. આથી સાધકે જીવપ્રકારની પ્રકૃતિની લઢણોને—નકારાત્મક વસ્તુઓને કાઢવા માટે તેના ઉપર જોશ ન દેતાં મહત્વ ન દેતાં મૈત્રી, કરુણા, પ્રસન્નતા, નિઃસ્પૃહતા આદિ એવી સાત્ત્વિક ભાવનાઓને કેળવવામાં જાગૃતિ રાખીને જ્ઞાનપૂર્વક મથ્યાં કરવું જોઈએ.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૧૮૨-૧૮૩)

\*

\*

જીવની જીવપ્રકૃતિને ઊર્ધ્વ કરવાને સજ્ઞાન ભાવનાના પુટ આપવાના રહે છે. (‘જીવનમંથન’, આ.ર, પૃ. ૧૮૩)

\*

\*

નિંદા, અતિ નિદ્રા ને લોકવાર્તા સાધકના જીવનને બાધક છે.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૧૮૩)

\*

\*

ભોગવવા જેવા તમામ પદાર્થોને વિષે ઉપયોગ પૂરતું જ તે લેવાનું રાખીએ, જેમ એરંડિયું પીવાની ગરજ—આવશ્યકતા—જ્યારે જાગે છે, ત્યારે તે ઉપયોગથી થોડુંયે વધુ લેવાનું કરતા નથી, તેમ વસ્તુઓને માત્ર નિર્વાહ પૂરતા યોગ્ય પ્રમાણમાં ઉપયોગ અર્થે વાપરવાની હોય. (‘જીવનમંથન’, આ.ર, પૃ. ૧૮૪)

\*

\*

કોઈ પણ વસ્તુ, પ્રસંગ, પરિસ્થિતિ પ્રાપ્ત કરવા માટે સ્વયંભૂ ઈચ્છા તો કરવી જ નહિ. તો પછી મનની નીરવતા પ્રાપ્ત થવામાં કશી મુશ્કેલી નહે નહિ. (‘જીવનમંથન’, આ.ર, પૃ. ૧૮૫)

\*

\*

જે કંઈસારું-નરસું, ઓછું-વધતું મળ્યાં કરે એનાં વિશે સંતોષની

લાગણી ધરાવવી; એમ કરવાથી સમતા કેળવવામાં મદદ મળશે.  
(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૧૮૫)

\*

ભૂખ, દુઃખ, અપમાન અને વિરોધી પ્રત્યે પણ પ્રીતિ રાખતા થઈ શકીએ, તો બધે જ અનુકૂળતા પ્રાપ્ત થઈ જવાની છે. અપમાનને અમૃત કરી સેવનાર અને માનને ઝેર સમાન લેખનાર જીવને કદી પતન થવા પ્રસંગ આવતો નથી. માનથી દેહાભિમાન અને અહ્મુ વધે છે. (‘જીવનમંથન’, આ.ર, પૃ. ૧૮૭)

\*

સાધનાના કૈત્રમાં ચઢતાં ચઢતાં સાધક એક એવી કક્ષાએ પહોંચે છે કે જ્યારે તે એકમાં હળે છે, ભળે છે, મળે છે ને પછી એકનો અનેક થવાને સહજપણે પ્રેરાય છે. અજ્ઞાનની જીવદશામાં પણ જીવ અનેક થવાને પ્રાકૃતિક પ્રેરણાથી પ્રેરાયેલો રહે છે. એકનું અનેક થવું એ કુદરતનું સહજ ધોરણ છે.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૧૯૫)

\*

ગોઠે તો કામ ભોગવો, ગોઠે તો રામ ભોગવો.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૨૧૦)

\*

જીવનમાં સદ્ભાવનો સંપૂર્ણ પ્રભાવ પ્રગટ્યા વિના જે તે બધાં જીવો સાથે આપણે ઉત્તમતાથી વર્તી શકવાનાં નથી.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૨૨૬)

\*

જ્યારે આપણે બોલીએ છીએ, ત્યારે શબ્દની ગતિનાં મોજાં આપણા અને બીજાંના કાન પર પડે છે. તેવી રીતે તેજનાં કિરણોની ગતિને લીધે જોઈ શકીએ છીએ. શબ્દ અને તેજને ગ્રહી શકે એવું

યંત્ર જો આપણા શરીરમાં યોગ્ય રીતનું ન હોય તો આપણે સાંભળી કે જોઈ શકતાં નથી—જેમ કે બહેરો અને આંધળો. આ જ પ્રમાણે વિશ્વમાં જે સૂક્ષ્મ કિયાઓ થઈ રહેલી હોય છે, તે પ્રત્યે આપણે બહેરાં અને આંધળાં છીએ. સ્થૂળ ઈંડ્રિયો આ સૂક્ષ્મને ગ્રહી શકવા અસમર્થ છે, ને સૂક્ષ્મ ઈંડ્રિયો જેની વિકસી નથી, તેને એ બધું કોયડારૂપ ભાસે છે. જ્યારે જેઓ ભગવાનની દિવ્ય સૃષ્ટિ સાથે ને તેના દિવ્ય હેતુ સાથે સંકળાઈ ચૂક્યા છે, જેમને દિવ્ય દિષ્ટિ સાંપડી ચૂકી છે, તેઓ-એવા વિરલ આત્માઓ-માટીના દેહધારી હોવા છતાં પણ વિશ્વમાં વિલસી રહેલાં સૂક્ષ્મ તત્ત્વોનાં આંદોલનો જીલી શકે છે-ગ્રહી શકે છે-તે સાથે તાર મિલાવી શકે છે, જોઈ શકે છે, સાંભળી શકે છે.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૨૨૭)

\* \* \*

સારુંયે વિશ્વ ગતિનું બનેલું છે. સચેતન અને અચેતન બધીયે વસ્તુઓમાં જેવી જેની પ્રકૃતિ તેવાં તેનાં ગતિનાં મોજાં. આપણાં પણ તેવાં ગતિનાં મોજાં છે. કોધમાં હોઈએ, પ્રસન્નચિત્ત હોઈએ, વિકારી વૃત્તિમાં હોઈએ, એમ ગમે તે વૃત્તિમાં હોતાં તેવાં પ્રકારનાં મોજાં પ્રગટેલાં રહે છે. વૃત્તિની જેવી અને જેટલી ઉત્કટ્તા એવાં એનાં મોજાં. જેને દિવ્ય દિષ્ટિ સાંપડી ચૂકી છે, તે આવાં મોજાંઓને જોઈ શકે છે, પારખી શકે છે, આકલન કરી શકે છે.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૨૨૮)

\* \* \*

જે બધાંમાંથી છૂટો થઈ ગયેલો છે, તેવો જ બધાંનામાં એની રીતે જકડાયેલો પણ રહી શકે છે.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૨૩૧)

\* \* \*

જે ભાવનાના ગુણો સ્ત્રીહદ્યમાં રહેલા છે, એને સ્ત્રીત્વ કહી શકાય. ભાવનાપૂર્વકનું એવું સ્ત્રીત્વ કેટલાક સમર્થ પુરુષોએ કેળવેલું જાણેલું છે. શ્રી રામકૃષ્ણ પરમહંસના જીવનમાં એવો ભાવ પ્રગટ્યાનું સુવિદ્ધિત છે. એટલે એવી સ્ત્રીત્વની ભાવના પુરુષપણામાં પણ પ્રગટી શકે છે, એની સંપૂર્ણ શક્યતા છે.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૨૩૨)

\*

\*

અતિ સ્થૂલ નિકટપણું પ્રેમને સમજવાને, અનુભવવાને આવરણરૂપ છે. જો આપણે સ્થૂળ રીતે નિકટવર્તી હોઈશું તેમ છતાં હદ્યના પ્રેમને પારખવાની, સમજવાની ને અનુભવવાની કળા હદ્યથી જો નહિ સાંપડી હોય, તો એવું નિકટપણું આપણને અંતરાયરૂપ પણ થઈ પડવાનું અને સ્થૂલપણે નિકટ હોવા છતાં અંતરમાં અંતરથી હજારો ગાઉ દૂર હોવાના.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૨૩૫)

\*

\*

કોઈ પણ મત કે અભિપ્રાય આપણે બાંધ્યો કે આપણે જ બંધાયા અને એટલા પ્રમાણમાં સંકુચિત બની ચૂક્યા એમ સમજવું.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૨૩૬)

\*

\*

“યમેવैષ વૃણુતે તેન લભ્યઃ ।”

(એ જેને પસંદ કરે છે, તેને તે મળે છે) એમ ઘણાં જણાને કહેતાં સાંભળ્યા છે—ને પોતાનો મનપસંદ અર્થ તેનો ઘટાવીને પ્રમાદ ને એશારામમાં જીવન વિતાવવા છતાં પ્રભુમય થવાની આકાશકુસુમવત્ત કલ્યનાઓ સેવ્યાં કરતાં જાણ્યાં છે. જો ચેતન આપણને પસંદ કરે એવું ઈચ્છતા હોઈએ અથવા ભલેને ઈચ્છતા ન હોઈએ તોપણ એના જેવા ગુણધર્મ આપણામાં પ્રગટેલા હોય

તો જ તે આપણને પસંદ કરે કે વરે. સંસારવ્યવહારમાં પણ પરસ્પર સમાન ધર્મ હોય છે, ત્યાં જ આકર્ષણ પ્રગટે છે, મૈત્રી જામે છે ને પસંદગી થવાપણું રહે છે. સમાન ગુણધર્મની ત્યાં પણ જરૂરિયાત રહે છે. આમ ચેતનના ગુણધર્મો જો આપણામાં પ્રગટાવી શકીએ-ને તે કાજે સાધના આવશ્યક રહે છે જ તો જ શ્રીભગવાન આપણને પસંદ કરે છે, ને આપણે એનાં થઈ શકીએ છીએ.

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૨૩૬)

\* \* \*

‘બધું જ પ્રભુ કરાવે છે ને કરાવશે’ તેવું બોલવું એ તદ્દન મિથ્યા છે. જ્યાં સુધી જીવમાં અહમ્ છે, દ્વંદ્વાદિક વૃત્તિઓ છે, ત્યાં સુધી તેમ બોલવું અને માનવું નર્યો મિથ્યાચાર, દંભ ને મહેનત લેવામાંથી છટકબારી શોધવાની વૃત્તિ છે. જીવને એ ભાવનાને અનુરૂપ ને તેવા અનુભવને આવશ્યક સંપૂર્ણ શ્રદ્ધા, વિશ્વાસ ને પ્રેમભક્તિ તો પ્રભુ પર પ્રગટેલાં હોતાં નથી, એટલે જીવનું તેવું બોલવું વર્થ છે, ‘વદતોવ્યાઘાત’ છે.

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૨૪૩-૪૪)

\* \* \*

જ્યાં સુધી બીજા જીવ વિષે આપણને અન્યથાપણું પ્રગટે છે, ત્યાં સુધી એમ સમજવાનું રહે છે કે જ્ઞાનની દશામાં પ્રગટવાને આપણને હજી ઘણી વાર છે. એવું અન્યથાપણું ઉદ્ભવતાં અન્ય વિષેના વિચારો પ્રગટે છે અને તે સાધનામય જીવનવિકાસમાં બાધક છે.

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૨૪૮)

\* \* \*

સામાન્યપણે તો, કોઈ પણ જીવને આપણે જે મદદ કરીશું તેનો ઉપયોગ તે પોતાની પ્રકૃતિ ને સ્વભાવ અનુસાર જ કરવાનો છે તે નક્કી સમજ લેવું. તે મદદનો દુરુપયોગ થતાં પછી તે વિષે મનમાં કશા વિચાર થવા દેવા તે બરાબર નથી. ભવિષ્યમાં આપણે

તેની સાથે વિચારીને વર્તવું ઘટે તો તેમ કરીએ; અથવા આપણી પોતાની ઉદારતા અને વિશાળતા કેળવવાને અર્થે પણ તે જીવને ફરીથી મદદ થઈ શકે છે. આમાં માત્ર એક હકીકતનો ખ્યાલ રાખવાનો રહે છે કે આપણા તેવા વર્તાવથી સામાની પ્રકૃતિની પકડને વધારવામાં અને તેના અયોગ્યપણાના વર્તનમાં આપણે મદદ કરતા થઈ રહીએ છીએ કે કેમ? આવા સંજોગોમાં પ્રસંગ-પ્રસંગને, વ્યક્તિ-વ્યક્તિને અને આપણા આંતરિક વલણને સમજ સમજને પરિસ્થિતિને યોગ્ય નિર્ણય કરવાનો રહે છે.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૨૪૮)

\* \* \*

કંઈ પણ કશાથી કરી ઉંચાનીચા થવાપણું ન કરવું, તે તો યોગ્ય છે; પરંતુ તેવી દશા થતાં આપણે વિચારવું કે તેથી કરીને આપણી પ્રગતિ થવાની કે પીછેહઠ થવાની? આપણે જેમ જે કરવું છે, તે કરવાની નેમમાં આપણી વિશેષ ને વિશેષ એકાગ્રતા ને કેન્દ્રિતતા પ્રગતે ને તે માટેની જંખના ઉત્તરોત્તર વધતી જતી અને તેજસ્વિત થતી જો ન અનુભવી શકાય તો આપણે ઠેરના ઠેર રહેવાના છીએ યા કદાચ પીછેહઠ પણ થાય. જ્યારે આપણા ધ્યેય પરત્વેની હૃદયની ભાવના જ્ઞાનભક્તિપૂર્વક એકાગ્ર અને કેન્દ્રિત બની ચૂકી હશે, ત્યારે પછીથી કંઈ કશા પરત્વે ઉંચાનીચા થવાપણું બનવાનું નથી. (‘જીવનમંથન’, આ.ર, પૃ. ૨૫૩-૫૪)

\* \* \*

જીવનમાં-સાધનામાં-આપણું શરીર-આપણો દેહ-એક મોટામાં મોટો ભાગ ભજવે છે. તેના વિના મુક્તિ સાંપડવી શક્ય નથી. શરીર માબાપને લીધે મળે છે. તેમાંય જનનીએ, માએ તો આપણને નવ નવ માસ પેટમાં રાખીને તેના લોહીમાંથી લોહી આપ્યું છે, તેના માંસમાંથી માંસ આપ્યું છે, તેના દેહના આધારે

આપણો દેહ જન્મ્યો છે, પોખાયો છે, વૃદ્ધિ પામ્યો છે. એવી જનની પરતે ગંગાના પુનિત પ્રવાહની જેમ આપણા હૃદયની ભાવના અખંડપણે, નિરંતરપણે ને સમગ્રપણે ઉમળકાબેરની જો ન અનુભવાય તો તેટલું આપણું કાચું સમજવું. મા એ સ્થૂળ મા નથી, એ તો જીવનની પ્રેરક અને ઘોતક છે. મા પરતેનું આપણું વર્તન આપણા હૃદયસ્થ ભાવને વિશેષપણે પ્રગટાવવા માટે છે.

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૨૫૬)

\*

\*

હેતુની શુદ્ધતાથી, જ્ઞાનપૂર્વકના નમ્રતાયુક્ત વર્તનથી ને તેવા વર્તનમાં ભારોભાર પ્રગટતી જતી હૃદયની માર્દવતાથી આપણે વડીલોનાં મન-હૃદયને જતી લેવાનાં છે. જીવનપથમાં આપણે કોઈનાથી નોખા થવાનું નથી. સર્વ પ્રકારના બેદ ટાળવાનું આપણે તો ચહું છે. આપણે તો હૃદય હૃદયને સાંધવાને મથવાનું છે ને જ્ઞાનપૂર્વકના વર્તનમાં અભેદભાવ પ્રગટે એવું જીવન પ્રભુકૃપાથી પ્રગટાવવું છે. એટલા માટે આ બેદપણું જે છે તે સાધન તરીકે લીધેલું છે. બેદને અભેદમાં પ્રગટાવવાનો છે.

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૨૬૦)

\*

\*

શાંતિ, સમતા, પ્રસન્નતા, તટસ્થતા વગેરે જે રીતે વધારેમાં વધારે સમય રોંઝિંદા વ્યવહારવર્તનમાં પ્રગટેલાં રહ્યાં કરતાં હોય, તેવી રીતે વર્તાએ તો ભાવનાથી જીવનમાં પ્રવર્તાવું શક્ય બને છે. ભાવનામાં એકાગ્રતા અને કેન્દ્રિતતા પ્રગટ્યા વિના સાધનાનું હાર્દ પકડી શકાતું નથી. ભાવના એ જ્ઞાનપ્રેરક છે, ભાવ પ્રગટતાં જ્ઞાન પ્રગટે છે.

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૨૬૮)

\*

\*

કોઈ પણ જીવની મૂદુ લાગણીને ભૂલથી પણ અવજાની નજરે જોવાનું ન બની જવું ઘટે. પ્રત્યેક સ્ત્રીનો સ્નેહ કહો, ભાવ કહો, પ્રીતિ કહો, લાગણી કહો એ આપણા હૃદયમાં જીવન-વિકાસની ભાવનાના એક પ્રતીકરૂપે સ્પર્શવી ઘટે. તેમને માટે જીવનમાં સંપૂર્ણ સદ્ગ્રાવ, માન, આદર ને ભક્તિ આપણાં જીવનમાં પ્રગટેલાં હોવાં જોઈએ.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૨૭૪-૭૫)

\* \* \*

જીવનવિકાસની સાધનાથી જે સર્વભૂતહિતરતપણું પ્રગટે છે, તે ઉત્તમ પ્રકારનું દાન છે.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૨૭૬)

\* \* \*

માત્ર ધર્મશાસ્ત્રોના અત્યાસ વડે કે બુદ્ધિના સૂક્ષ્મ ઊંડા ચિંતન દ્વારા દિવ્ય શક્તિની દણ્ણ ને શક્તિ ન સાંપડી શકે; કારણ કે હંદ્ર પ્રકારની વૃત્તિ-વાસનાથી મુક્તિ પામ્યા વિના, રાગદ્વેષથી પર થયા વિના, અજ્ઞાનની દણ્ણ લુપ્ત થયા વિના, કામનાઓ ઉપર વિજય મેળવ્યા વિના અને અહંકારથી સંપૂર્ણ નિર્મૂળ થવાયા વિના બુદ્ધિમાં બુદ્ધિની સંપૂર્ણ શુદ્ધિ ને સાત્ત્વિકતા પ્રગટી શકતાં નથી. યોગની સાધના દ્વારા એવી શુદ્ધિ પ્રગટી શકે છે. સાધનાના મૂળ હાર્દમાં કામનાની ને અહંતાની મુક્તિ રહેલી છે.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૨૭૭)

\* \* \*

કોઈ મહાન, જ્ઞાની, અનુભવી આત્માની પ્રેરણાત્મક જીવંત સંસ્કૃતિથી તીર્થ પ્રગટે છે. તીર્થ એ જીવની ભાવનાનું ને સંસ્કૃતિનું પ્રતીક છે.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૨૭૭)

\* \* \*

માનવી જેની પાસેથી પોતાના જીવનનો પ્રકાશ પામે છે, તેની વાતો કરવાને હૃદયની ઊર્ભિ સ્વયંપણે જાગતી હોય છે. એવી હૃદયોર્ભિને સંયમ ને વિવેકની મર્યાદામાં રાખવાની છે. એવી પ્રગટેલી ઊર્ભિનો ઉપયોગ સાધનાના ભાવમાં કરવાનો હોય.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૨૮૦)

\*

\*

જીવનના જે બધા આનંદો જીવનના નીચલા થરોની ભૂમિકાના છે ને જ્યાં સુધી તે અતિ મહત્વના લાગ્યા કરે છે, એટલું જ નહિ પરંતુ તે જીવનમાં નિશ્ચિતતા રૂપે મનમાં દઢ બનેલા હોય છે, ત્યાં સુધી આપણે તે બધાને છોડી દઈ શકીએ તેમ નથી બનતું. નીચલા થરોના એવા સુખની વાસના માનવી ત્યારે જ છોડી દઈ શકે કે જ્યારે એ બધાનો ને એ બધામાંથી હૃદયના દઢ અનુભવે એનો પૂરેપૂરો ભ્રમ ભાંગી ગયો હોય. જ્યાં પાર્થિવ સુખનો પૂરો અંત પ્રગટે છે, ત્યાં ને ત્યાંથી તે ક્ષણથી જ પારમાર્થિક જીવન શરૂ થાય છે.

કેટલીક વાર માનવીની ગણતરી પ્રમાણેના ભરપૂર સુખના આનંદમાં પણ કદીક કદીક અતૃપ્તિ કે અસંતોષની જ્વાળા પ્રગટતી હોય છે. એવા એના જીવનની તૂટમાં થઈને પણ કેટલીક વાર હૃદયના કોઈ ઉન્નતગામી જીવનની હાકલ પડતી સંભળાય છે. પરંતુ તેવી વેળાએ યોગ્ય તત્પરતા પ્રગટેલી ન હોવાથી એવી જાગેલી પ્રેરણા ઘણી વાર શમી જતી હોય છે ને ફરી પાછો અંધકાર છવાઈ રહે છે.      (‘જીવનમંથન’, આ.ર, પૃ. ૨૮૦)

\*

\*

જીવનની અને જગતની બધી સમસ્યાઓ અને પ્રશ્નોનો ઉકેલ આપણે અત્યારે ને અત્યારે જ પૂરેપૂરો લાવી દઈશું એવું માનવામાં કેવળ અજ્ઞાન છે. આવા બધા સમાજસુધારણાના પ્રયત્નમાં સાચી પ્રામાણિકતા, વફાદારી, નેકદિલી અને પૂરી

સચ્ચાઈ હોવા છતાં ‘આ એક જ સાધન એવું છે કે જેની પરિપૂર્ણતા થતાં સમાજનો પૂરેપૂરો, સર્વાંગીણ ઉદ્ધાર થઈ જશે,’ એવા પ્રકારની ઉગ્રતા જ્યારે પ્રગટે છે, ત્યારે તેમાંથી સત્યની શક્તિ મોળી પડે જાય છે. જ્યારે ‘આ જ ખરું ને બીજું નહિ’ એવી સમજણ જે જે પ્રયત્નમાં રહેલી છે, ત્યાં ત્યાં ચેતનાનું સાચું પૂરું વ્યક્તાવ્ય નથી એમ પ્રમાણવું.

(તેમ છતાં) આપણે તો જેમાં સત્ત્વયત્ન છે, પ્રામાણિકતા છે, સચ્ચાઈ, વફાદારી તથા નિષ્ઠાપૂર્વકનું વર્તન છે, ત્યાં ત્યાં સવિશેષપણે સદ્ગ્રાવ જ રાખવો ઘટે. આપણી રીત સંપૂર્ણ છે ને બીજાની સંપૂર્ણ નથી એમ માનવામાં પણ દોષ છે. સત્યનાં અનેક પાસાં છે. તેથી અમુક જ રીત સાચી એમ આગ્રહ ન રાખવો ઘટે. (‘જીવનમંથન’, આ.ર, પૃ. ૨૮૨-૮૩)

\* \* \*

જેમ જેમ જીવનો આંતરવિકાસ પ્રગટો જાય છે, તેમ તેમ એની જીવનદસ્તિ પણ બદલાતી જાય છે. કોઈ સાધક સાધનામાં અમુક મર્યાદિત ઉદેશથી જેમ કે દેશના ઉદ્ધાર અર્થે શક્તિ પ્રાપ્ત કરવાની નેમથી જોડાય, પરંતુ તેમાં ઊંઠું ઉિતરતાં એણે ધારણા કરેલા હેતુની દસ્તિની પાછળ અજ્ઞાન હતું એમ એને ત્યારે સમજાયા વિના રહેતું નથી. ને એમ એ ઉત્તરોત્તર ઉચ્ચ પ્રકારના જીવનમાં પ્રવેશતો પણ જતો હોય છે.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૨૮૩-૮૪)

\* \* \*

સુખ બાધ્ય પ્રકારનાં સાધનમાં નથી; સુખ તો છે અંતરમાંથી પ્રગટતી સાચી સમજણમાં અને તેને અનુરૂપ વર્તનમાં.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૨૮૦)

\* \* \*

આપણને જે ગમે છે કે નથી ગમતું એને જ આપણે ઘણી

વાર બુદ્ધિને સ્થાને, તર્ક-દલીલને સ્થાને, આમ કે તેમ વિચારને સ્થાને, બેસાડી દઈએ છીએ. ('જીવનમંથન', આ.ર, પૃ. ૨૮૪)

\* \* \*

જીવનમાં પ્રગટતા આવેશ કે આવેગની હકીકત એકાંતિક વ્યક્તિગતપણાની છે. આપણને તેમાં જેવું લાગે, તેવું બધાંને ન પણ લાગે. જ્યારે આવેગ કે આવેશથી પૂરા આવરાયેલા હોઈએ છીએ, ત્યારે બીજું કંઈ તેમાં પ્રવેશી શકતું નથી. એવી વૃત્તિમાં એક પ્રકારની ગૂઢતા પણ હોય છે. આથી તે પોતાની મર્યાદાના ક્ષેત્રમાં ગમે તેવી ભલેને મહાન હોય, પરંતુ તેના ક્ષેત્રની બહાર એને છાપરે ચઢાવવાનો આગ્રહ જો ભૂલેચૂકે પણ સેવીએ, તો અવગાણના થવાનો સંભવ રહે છે ખરો.

('જીવનમંથન', આ.ર, પૃ. ૨૮૫)

\* \* \*

કોઈ આપણને પ્રેમ ન કરતું હોય, તોપણ આપણા પ્રેમમાં કશો અભાવ કે ઊણાપ ન પ્રગટવાં ઘટે. આપણો જે પ્રેમ કરીએ છીએ તે પ્રેમ-તત્ત્વના ગુણના સ્વભાવને લઈને.

('જીવનમંથન', આ.ર, પૃ. ૨૮૭)

\* \* \*

સારાય વિશ્વમાં જે દૈત છે એનું રહસ્ય પ્રેમમાં રહેલું છે. દૈત હોવાને કારણે જ આકર્ષણ રહ્યાં કરે છે. તેમાં એક બાજુ અવતરણ છે ને બીજી બાજુ આરોહણ છે. સ્ત્રી-પુરુષનું દૈત પણ ચેતનના અનુભવ કર્યે છે. સર્જનને માટે દૈત જરૂરનું છે, અનિવાર્ય છે.

('જીવનમંથન', આ.ર, પૃ. ૨૮૮)

\* \* \*

મનાદિ કરણમાં જે ઉચ્ચ પ્રકારની સંસ્કૃતિ ને સમૃદ્ધિ પ્રગટેલી હોય તેને પણ રૂપ ગણી શકાય. જીવન-સંસ્કારની ખીલી

ઉઠેલી ભાવનાને પણ રૂપ ગણાય.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૩૦૦)

\*

\*

પુરુષ-પ્રકૃતિના વિકાસને અનુકૂળ નારીશક્તિ એટલે  
જગજજનની, આધશક્તિ. (‘જીવનમંથન’, આ.ર, પૃ. ૩૦૧)

\*

\*

જેને અતિમનસ મેળવવાની સાધના કરવી હોય તેઓ તે  
પ્રેમથી કરે પરંતુ એને યોગ્ય ઠેરવવાને બીજી પ્રવૃત્તિનું યોગ્ય  
મૂલ્યાંકન આંકવાની ને એમની યોગ્ય કદર કરવાની સાત્ત્વિક  
માનસિક તૈયારી તેવા સાધકની હોવી ધટે.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૩૦૪)

\*

\*

ચર્ચા કરવી નહિ; ચર્ચા કરવાની જો આવે જ, તો તે માત્ર  
જાણવા-સમજવા માટે હદ્યની નભ્રતાભરી જિજ્ઞાસુ ભાવનાથી  
તેમ કરવાનું રાખવું. (‘જીવનમંથન’, આ.ર, પૃ. ૩૦૪)

\*

\*

બરાબર સાંભળવાની પણ એક અનોખી કળા છે. જ્યારે  
આપણે કશુંક સાંભળતા હોઈએ ત્યારે કહેનારને પ્રતિકહેણ માટેની  
તૈયારીઓ માનસિકપણે રચ્યા વિના તથા પ્રત્યાઘાતી માનસિક  
આંદોલનો ઉઠવા દીધા વિના કે તે વિષય અંગે આપણા મનમાં  
બીજા કોઈ પણ વિચાર જાગવા દીધા સિવાય પૂર્ણ સ્વસ્થ ને  
નીરવ મનથી તથા એકાગ્રચિતથી સાંભળવાની ટેવ કેળવવા  
જેવી છે. આમ કરી શકીએ તો જ કોઈ પણ ચર્ચાનો લાભ  
મળવાનો હોય તો મળી શકે તથા સામાના દાઢિબિંદુને યથાયોગ્ય  
સમજવામાં સરળતા પણ રહી શકે.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૩૦૪)

\*

\*

કોઈની કોઈ સાથે સરખામણી કરવી એ તદ્દન અયોગ્ય છે. સરખામણી કરવામાં સરખાપણું, બરાબરપણું, યોગ્યપણું કદી પણ સંભવી શકતું નથી. તેમાં ગમે તે પક્ષને અન્યાય થઈ જવા પૂરી વકી છે. (‘જીવનમંથન’, આ.ર, પૃ. ૩૦૫)

\*

\*

બીજુ વ્યક્તિને અમુક કામમાં રસ લેતી કરવી હોય તો જે જે કામમાં તે સંકળાયેલ હોય એવી બધી હકીકતથી એને વાકેફ રાખવી ઘટે. આથી તેનો તે કામમાં રસ જળવાઈ શકે છે ને આપણી મુરાદ બર આવી શકે છે.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૩૧૦)

\*

\*

જે જે માનતા હોઈએ, તેનાથી ઊંચા પ્રકારનું આગળ ને આગળ છે જ તે નક્કી જાણવું. માટે જે માનતા હોઈએ, તે નવાનો સ્વીકાર કરવાને માટે છોડતા જવાનું રહે છે.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૩૨૨)

\*

\*

જેઓ ઉચ્ચતમ પ્રકારના સંગીતશાસ્ત્રી, કવિ, શિલ્પી, ચિત્રકાર, સાહિત્યકાર, કળાકાર છે, તે તે બધાં એ ચૈતન્યશક્તિના અવતરણની સૂક્ષ્મ પૂર્વભૂમિકા સમાચે. તેમાંના કેટલાંક તો તે ચૈતન્યશક્તિનો (તેઓ જ્યારે તેમના તેમના ક્ષેત્રના ભાવની ઉચ્ચ કક્ષામાં પ્રગટેલાં હોય છે ત્યારે) સ્પર્શ પણ કરતાં હોય છે અને તેવા સ્પર્શને પરિણામે ઉત્તમ કોટિનું સર્જન કરી શકતાં હોય છે. એવા મહાન સાહિત્યકાર કે કળાકારનું ચારિત્ય સદાચાર કે નીતિની દણ્ણિએ ઉત્તમ પ્રકારનું કદાચિત્ ન જણાય તો તેથી આધાત સેવવાની જરૂર નથી. ભાવનાની એકાગ્રતા પ્રગટે છે અને તેનું ઉક્યન અમુક ઊંચાઈએ થાય છે, ત્યારે એક પ્રકારનો ચેતનાત્મક સ્પર્શ જીવનમાં અનુભવાય છે. મહાન કળાકાર કે

સાહિત્યકારનું તેવા કાળનું સર્જન કે લખાણ તેવા સ્પર્શને કારણો નીપજતું હોય છે. એવું સર્જન કે સાહિત્ય ભગવાનની શક્તિનું સર્જન ગાળી શકાય. તેની સાથે સર્જકના સ્થૂળ જીવનને સંકળાવી ન શકાય. આવા પ્રકારનો વિવેક યોગ્ય મૂલ્યાંકન માટે જરૂરી છે.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૩૨૪-૨૫)

\* \* \*

એવાં કેટલાંય સંત-ભક્તો હોય છે, જેને તેમની હૃદયની નભ્રતાને લીધે કોઈ ઝટ પામી શકતું નથી. એવાંની હૃદયની એવી નભ્રતા તેમની દિવ્ય ચેતનાનું ઢાંકણ બની જતી હોય છે ને તેમનું જ્યાં ત્યાં રક્ષણ કર્યા કરે છે. તેમ છતાં, એવાની પ્રતિભા ઢાંકી ઢંકાઈ રહી શકતી નથી—જો આપણે હૃદયથી એવા ગુણની કદરભક્તિવાળાં પ્રગટેલાં હોઈએ તો.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૩૨૫)

\* \* \*

ચેતન હુંમેશ ઈચ્છે છે કે અચેતન તેને જીતી ન જાય. ચેતનને અચેતનમાં પૂરેપૂરો પ્રવેશ પામીને ત્યાં સંપૂર્ણ અભિવ્યક્તિ કરવી છે. અચેતન એક તસુ પણ એમને એમ મૂકી દેતું નથી. અહીં ચેતનાનો અર્થ જેટલો વિસ્તારીએ તેટલો ઓછો.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૩૩૦)

\* \* \*

સાધનાની ઉત્તરોત્તર કક્ષામાં અનંત પ્રકારના સંગ્રામ પ્રગટે છે. એમાં સાધક હારતો, જીતતો, અંતરની શક્તિને તે દ્વારા વધારતો એક એવી નિર્ણયાત્મક અને નિશ્ચયાત્મક સ્થિતિ પર પ્રગટે છે કે જે વેળા પછી એની શક્તિને ક્યાંયે હારવાપણું રહેતું નથી.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૩૩૦-૩૧)

\* \* \*

શરીરનો ધર્મ તો વધવા-ઘટવાપણાનો છે. તેની યોગ્ય સંભાળ ભલે લેવાય, પરંતુ તેની આળપંપાળ તો ન જ થાય.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૩૩૧)

\*

\*

આપણે ઝટ ઝટ, ને હકીકત કરતાં વધારે પ્રમાણનું માની લેનારા ન થઈએ અને સાથે સાથે દિવ્ય શક્તિની શક્યતાઓને અશક્ય પણ ન ગણી કાઢીએ.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૩૩૫)

\*

\*

ખુલ્લા થવું એટલે જીવપ્રકારની સમજણ, રીત, માન્યતા, ટેવ, આગ્રહ તથા મનાદિ કરણના પ્રાકૃતિક ધર્મથી મુક્તિ. આવું ખુલ્લા થવું તે જ્ઞાનપ્રકારનું ખુલ્લા થવાપણું ગણાય. એવું ખુલ્લા થવાપણું એટલે જ્ઞાનાત્મક શરણાગતિ. એવું ખુલ્લા થવાપણું એટલે જીવનું જીવપણું ટાળવાની મંગળમય ગ્રાથમિક ભૂમિકા. ખુલ્લા થવું એટલે જીવપ્રકૃતિએ જીવપ્રકૃતિમાંથી મુક્તિ મેળવીને ચેતનના પ્રદેશમાં પગલાં માંડવાનાં મંગળાચરણ.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૩૩૭)

\*

\*

શ્રીસદ્ગુરુના વચનના તાત્પર્યને—હાર્દને તેની સંપૂર્ણ જ્ઞાનાત્મક દશાથી ગ્રહણ કરવું એ કંઈ જેવું તેવું કર્મ નથી. સૌ કોઈ પોતપોતાની અધૂરી રીતે તે સમજતું હોય છે.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૩૩૭)

\*

\*

કોઈ પણ સિદ્ધિ અને મુક્તિ પણ પ્રાપ્ત કરવી તે એક વસ્તુ છે અને તેને અમલી બનાવવી, કાર્યક્ષેત્રમાં સફળપણે ઉતારવી તે બીજી હકીકત છે. જેમ અમુક વૈજ્ઞાનિક શોધ અને તેનો

વ्यवहारमાં ઉપયોગ અને અમલ તે બે ભિન્ન વસ્તુઓ છે તેમ.  
(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૩૩૮)

\* \* \*

સત્યનો આપણો કેટલી અને કેવી ભાવનાથી અમલ  
કરીએ છીએ તેના પર આપણા જીવનમાં તે સત્યના  
ટકવાનો આધાર છે. (‘જીવનમંથન’, આ.ર, પૃ. ૩૩૮)

\* \* \*

પોતાની વૃત્તિઓનું રૂપાંતર થતું જતું જો સાધક હૃદયથી  
અનુભવી શકતો હોય તો જ સાધના એ સાધના છે, નહિતર એ  
તો બંધન છે, વળગાડ છે. એમ સમજને એણો એવી સાધનાને  
ફગાવી દેતાં અચકાવું ન જોઈએ.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૩૩૯)

\* \* \*

બીજાંના સત્કર્તવ્યની કદરથી આપણું હૃદય આપોઆપ  
પ્રેમભાવથી ભીજાઈ જવું જોઈએ; પરંતુ આપણે તેવું નહિ કરીએ  
તો બીજાંને ઠીક નહિ લાગે અથવા બીજાં અમુક પ્રકારનું ધારશે  
એવું મનમાં ન થવું ધટે. આપણો ખ્યાલ આપણા પૂરતો જ રહે  
તો તે ઉત્તમ. કદર જે કરવાની છે તે તો આપણો ગુણ ગ્રાહકતાનો  
ગુણ કેળવવા ને આપણા જીવનમાં પ્રગટાવવા માટે.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૩૪૦)

\* \* \*

કર્મનો જે રીતે ઉપયોગ થાય ને એવા ઉપયોગમાં જે પ્રકારનો  
રસ લેવાયા કરાય તે પ્રમાણે કર્મનું પરિણામ આવવાનું શક્ય  
બને છે. કર્મની સાથે ભાવનાનો સંબંધ રહે છે.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૩૪૧)

\* \* \*

પ્રત્યેક કર્મમાં જાગૃતિપૂર્વકનો તેના હેતુનો ખ્યાલ જન્મવો

જોઈશે. એમ કરતાં કરતાં તે પ્રકારની અખંડ જગૃતિ તેનામાં પ્રગટવી જોઈશે. તેવી સતત એકધારી પ્રગટેલી જગૃતિ પછી તો તેના અનાયાસપણામાં પ્રગટી જશે.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૩૪૨)

\*

\*

આપણને કોઈ મોટું ગણે, સારા ગણી સન્માન ને આદર આપે, ઉત્તમ કદર કરે, ઉત્તમ આસને બેસાડે વગેરે રીતે બહુમાન કરે તો આપણે એના અધિકારી નથી એમ સમજવું; પરંતુ સર્વના કૃપાપાત્ર છીએ એમ લેખવું, ને બધાંએ કૃપા કરીને એવો અધિકાર પ્રેમથી આપ્યો છે, એમ સમજ નઅતા, ભગવાનની ભક્તિને યોગ્યપણે પામવાને હજી આપણને ઘણી વાર છે એમ સમજને, જ્ઞાનપૂર્વક ભાવના સેવવી અને ઈશ્વરનો આભાર માની સર્વની કૃપા યાચ્યાં કરવી. (‘જીવનમંથન’, આ.ર, પૃ. ૩૪૪)

\*

\*

સામાના ઉપકારનો બદલો વાળી ન શકાય એવી પરિસ્થિતિમાં હૃદયની ઘણી ઘણી કદર ને આદરભક્તિ બુદ્ધિથી પ્રગટાવીને જીવતી રાખ્યાં કરવી. જો એમ નહિ કરીએ તો કૃતધ્નતાનો દોષ આપણને લાગશે.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૩૪૪)

\*

\*

પરમ તત્ત્વને મેળવવાના ઉપાયોના માત્ર જાણકાર કરતાં એની પ્રાપ્તિના માર્ગનાં વિઘ્નોને યથાર્થ રીતે જાણનાર ને હામ ભીડીને એને પ્રભુકૃપાથી હઠાવનાર,—એને ઉત્તમ ગણેલા છે.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૩૪૪)

\*

\*

આપણને સ્વાર્થની જ્યારે ખૂબ તાલાવેલી પ્રગટેલી હોય

છે, ત્યારે આપણે જેમ સર્વ કોઈનું સારું-ખોટું સહી લઈએ છીએ, તેમ પરમાર્થના વિષયમાં—પ્રભુ પ્રાપ્ત કરવાના વિષયમાં પણ પ્રતિકૂળતાઓ જે જે ગ્રગટે, તેને પ્રેમપૂર્વક સ્વીકારીને, તપશ્ચર્યાભાવે સહી લઈને, કોઈના પણ ગુણદોષ ન જોતાં સર્વને અનુકૂળતા કરી આપવી, તે પ્રભુપ્રાપ્તિ થવામાં સાધનરૂપ છે.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૩૪૪)

\* \* \*

સંબંધી, સ્વજનના વિચાર તથા વર્તનને ન જોતાં, તેમના કલ્યાણ તરફ જ આપણે તો ધ્યાન રાખવાનું છે. જ્યારે તેઓને સમજાશે કે આપણે તો તેમના કલ્યાણમાં જ તત્પર રહીએ છીએ, ત્યારે તેઓ આપણા પરત્વે પોતાનું પ્રતિકૂળ વર્તન છોડી દઈને આપણને અનુસરવાનાં હશે તો અનુસરશે.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૩૪૫)

\* \* \*

જેનું હૃદય સદાય અવિરત પ્રસન્ન છે, એવા ઉપર શુભ સંસ્કાર પડવાથી પ્રાપ્ત થનાર પ્રત્યેક પ્રસંગમાં આનંદને અનુભવવાની મનને સતત ટેવ પડે છે. પછી એને કોઈ વસ્તુ, પ્રસંગ, ઘટના અરુચિકર જણાતા નથી. જેમાં ને તેમાં આનંદ, રસજીતા ને માધુર્યને અનુભવવાનો જ્ઞાનભક્તિપૂર્વકનો અભ્યાસ પડવાથી મનને શાંતિ મળે છે, પ્રસન્નતા ગ્રગટે છે તથા એની તેજસ્વિતા ને શક્તિ ઓર વધે છે.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૩૪૫)

\* \* \*

કોઈ જીવ ભાવનાપોષક મનાયેલ ક્ષેત્રથી બીજા કોઈ ક્ષેત્રમાં કાર્ય કરતો હોય; દા.ત. કોઈ વેપારી વેપાર કર્યા કરે છતાં તે પૂર જોશથી અને ભાવનાથી સાધના પણ કર્યા કરે એવી શક્યતા

જરૂર છે. પરંતુ એવાં જિગાર જગતમાં ખૂબ જ જૂજ, વિરલ.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૩૪૬)

\*

\*

વહેવાર વેળા વહેવાર ને સાધના વેળા સાધના, એમ બે જુદાં જુદાં ખાનાં પાડી નાંખ્યે નહિ ચાલે. સાધનાનો ભાવ જો પ્રેમભક્તિપૂર્વકનો, સાફ દિલવાળો, પૂરેપૂરો હોય તો તેવી ભાવનાનો જ્ઞાનપૂર્વક ઉપયોગ સર્વ ક્ષેત્રમાં કર્યા કરવાનું રાખે, તો સાધકના સ્વભાવનું રૂપાંતર થયાં કરવાનું બને; બાકી નહિ.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૩૪૬)

\*

\*

જ્યારે આપણે સમતા-તટસ્થતાપૂર્વક પૃથક્કરણ કરતાં હોઈએ, તે વેળાએ હદયનું મહત્વ તો નામસ્મરણમાં પ્રગટ્યાં કરે અને પૃથક્કરણ કરવામાંથી આડે ફંટાયાનું મૂળ કારણ સમજ જવાય અર્ને તેનું નિરાકરણ થાય એવી રીતનું ધોરણ જીવનમાં પ્રગટવું ઘટે. (‘જીવનમંથન’, આ.ર, પૃ. ૩૫૨-૫૩)

\*

\*

જેમ વ્યવહારની બધી ચીજો ઈંગ્રિયથી પરખાય છે, એમનું આકલન પણ થાય છે, તેવી રીતે ભગવાનનો જે ભાવ છે, ને જે અનિર્વચનીય છે, તેને પામવા કે પારખવા માટે જે શક્તિ આપણને ખપ લાગે તેનું નામ શ્રદ્ધા. શ્રદ્ધા એટલે તો આંતરદિષ્ટ પણ. (‘જીવનમંથન’, આ.ર, પૃ. ૩૫૩)

\*

\*

સારોયે સમાજ ઉન્નતિના સર્વोત્કૃષ્ટ શિખરે પહોંચી જાય તેવું બનવું શક્ય લાગતું નથી, વ્યક્તિ ચઢી શકવાની છે અને ચઢશે. સમાજ પણ વ્યક્તિ તરફ મીટ માંડતો હોય છે, વ્યક્તિથી દોરવાતો હોય છે, ને વ્યક્તિથી પોતાની પ્રાણ-શક્તિ બઢતી તે અનુભવતો હોય છે. સમાજ વ્યક્તિનો બનેલો છે.

આમ વ્યક્તિ જેટલું ઉંચે ચઢવામાં મથશે અને વધુ ને વધુ વ્યક્તિઓ ઉચ્ચ જીવન પ્રગટાવવામાં રસ લઈને તે પરત્વે નિષા જેટલી પ્રગટાવશે તેટલા પ્રમાણમાં સમાજનો પણ ઉદ્વાર થવાનો છે તે નક્કી વાત છે. ('જીવનમંથન', આ.૨, પૃ. ૩૫૫)

\* \* \*

દરેક સમાજને પોતપોતાની આગવી વિશિષ્ટ પરંપરા ને સંસ્કૃતિ હોય છે, જેને આપણે વિશિષ્ટ ગુણશક્તિ પણ કહી શકીએ. તેની પ્રેરણા પામી પામીને તે ચાલે તો એનો વિકાસ થઈ શકે છે. દરેક સમાજને એવી સ્વતંત્ર સંસ્કૃતિ હોય છે જ.

('જીવનમંથન', આ.૨, પૃ. ૩૫૬)

\* \* \*

સદ્ગુરુ સાધકની નબળાઈઓ પરત્વે કડકમાં કડક થઈને એનું તેને પૂરેપૂરું, ભાન પ્રગટાવે છે; જ્યારે બીજાંઓની નબળાઈઓ પરત્વે પૂરેપૂરા જ્ઞાનપૂર્વક ક્ષમાશીલ રહ્યાં કરી, ક્ષમાશીલ રહ્યાં કરવાને સાધકને પણ તે સૂચવે છે.

('જીવનમંથન', આ.૨, પૃ. ૩૫૭)

\* \* \*

બીજાંઓની નબળાઈઓ પરત્વેનું જ્યારે જીવને ભાન પ્રગટે છે તે ને જો પૂરેપૂરી જ્ઞાનયુક્ત તટસ્થતા ન પ્રગટી હોય તો તે વેળા તે જીવ તે પરત્વે નરક પર માખી જેમ બણબણે છે, તેમ તે ગણગણવાનો.

('જીવનમંથન', આ.૨, પૃ. ૩૫૭)

\* \* \*

આપણો મત, અભિપ્રાય, સાચાપણું કોઈને પણ આગ્રહથી ઠસાવવાને મથવું તેમાં પૂરી હિંસા રહેલી છે.

('જીવનમંથન', આ.૨, પૃ. ૩૫૮)

\* \* \*

આપણા જીવનમાં ઉડી ઉડી જડ ઘાલી બેઠેલાં સર્વ સંસ્કાર,  
વિચાર, વૃત્તિ, સમજણ, માન્યતાઓ, મડાગાંડો વગેરેનો વારસો  
ગુરુનો હુકમ થતાંવંત જ એકદમ બદલાઈ જવાનો છે એમ માનવું  
તે નર્યુ અજ્ઞાન છે. સદ્ગુરુ તો દણ્ણ પ્રેરે. જુદી જુદી પરિસ્થિતિઓ  
પરતે યોગ્ય વિચાર કરવાને પ્રેરાવે. બાકી બીજું બધું તો આપણે  
જ કરવાનું રહે છે.                                    ('જીવનમંથન', આ.ર, પૃ. ૩૫૮)

\*

\*

શ્રીભગવાનને ચરણકમળે તાજાં જ ફૂલો ચઢાવવાનાં હોય;  
તેવી રીતે જુવાનીમાં પ્રભુમય જીવન કરવાનું જોણે સ્વીકાર્યું છે તે  
જ વધુ યોગ્ય છે. જોબન-યુવાની એ તાજું ફૂલ છે. ઘડપણમાં  
મોટા ભાગે કોઈ ગોવિંદના ગુણ ગાઈ શકવાનું નથી. જીવનની  
સાધના એટલી સહેલી નથી. સાધનામાં જોઈતાં સાહસ, હિંમત,  
અડગ પુરુષાર્થનું બળ, ઉત્સાહ, ખંત, ધીરજ વગેરે ગુણો જુવાનીમાં  
જ વધુ ખીલેલા રહે છે. તે વેળાએ જીવનની સાધનામાં જો ખૂંપી  
જઈ શકવાનું બન્યું તો એવા એના ગુણોનો ઉત્તરોત્તર વિકાસ  
થતો રહેવાનો. એવા ગુણો એની શ્રેષ્ઠ કક્ષાએ પહોંચીને  
પરિપક્વપણે થઈ દિવ્યતાના અંશરૂપે પરિવર્તનને પામી શકવાના  
છે. ત્યારે તે ગુણ, ગુણ નથી રહેતા પણ શક્તિરૂપે પ્રગટેલા હોય  
છે. ત્યારે એવા માનવીને ઘડપણ હોવા છતાં ઘડપણ નહિ હોય.

('જીવનમંથન', આ.ર, પૃ. ૩૫૯-૬૦)

\*

\*

જીવનની સાધના એ હાંસીખેલ નથી. એ તો મર્દાનગીના  
ખેલ છે. એના મહત્વનો, ગંભીરતાનો ખ્યાલ હજુ આપણને  
પૂરેપૂરો પ્રગટેલો નથી. સર્વ પ્રકારે, સર્વ ભાવે જીવનને ન્યોદ્ધાવર  
કરી કરીને વારી વારી જઈને ત્યાગ, બલિદાન ને સમર્પણ કરવાની  
ઉત્કટ ભાવના પળેપળ જીવતીજાગતી રાખ્યાં કરીને આપણે

હોમાયાં જવાનું છે.

\*

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૩૬૦)

\*

જેટલાં બહિર્મુખ આપણે રહ્યાં કે થયાં, તેટલું સાચું ધન  
આપણે ગુમાવ્યું.

\*

(‘જીવનસંશોધન’, આ.૨, પૃ. ૮)

\*

બીજાંનાંમાં પ્રેમભક્તિ રાખવા છતાં આપણે તો આપણામાં  
જ મસ્ત રહેવાનું છે. બની શકે તેટલા નિઃસંગ રહેવું-સ્થળપણે  
અને સૂક્ષ્મપણે બન્ને રીતે. આપણામાં ભરાઈ રહેલાં મંતવ્યો,  
ગાણતરીઓ, માપો, મૂલ્યાંકનો, મડાગાંઠો, ગમાઅણગમા,  
રાગદ્વૈષ, સમજણો, સંસ્કારો—બધાં આપણાં સંગીઓ છે.  
એમાંથી હવે આપણે નિઃસંગ થવાનું છે.

(‘જીવનસંશોધન’, આ.૨, પૃ. ૧૨)

\*

\*

આપણને પસંદ પડતા વિચારો ને કાર્યો જેને અનુકૂળ ન  
આવતાં હોય તેના પ્રતિ અવગાણનાની વૃત્તિ, અનાં સાત્ત્વિક  
કાર્ય પરત્વે બેકદર વૃત્તિ વગેરે આપણામાં ન આવી જવી ધટે.  
આવી અનુદારતા અને અસહિષ્ણુતા જવી જોઈશે.

(‘જીવનસંશોધન’, આ.૨, પૃ. ૧૨-૧૩)

\*

\*

જો આપણે માત્ર પ્રભુમાં પ્રેમને એકાગ્ર ને કેંદ્રિત કરી  
શક્યા તો દુનિયાનો પ્રેમ તો મળવાનો જ છે.

(‘જીવનસંશોધન’, આ.૨, પૃ. ૧૬)

\*

\*

જેટલા પ્રમાણમાં જીવંત આદરભાવ કોઈ વ્યક્તિમાં વિશેષ  
તેટલા પ્રમાણમાં શ્રદ્ધા-વિશ્વાસ તેના કથનમાં અને કરેલામાં  
વિશેષ રહેવાનાં.

(‘જીવનસંશોધન’, આ.૨, પૃ. ૧૮)

\*

\*

પ્રભુનું સંપૂર્ણ યંત્ર બની જનાર જીવ સકળ કંઈ કશાનું સંપૂર્ણ જ્ઞાન ધરાવી શકે છે, એવી હકીકત અને સમજણ યોગ્ય નથી. એના અનુભવના વિષયમાં એ પૂર્ણ જ્ઞાની હોય છે. બીજા વિષયોમાં તો અપવાદ તરીકે તેવું તેવું જ્ઞાન નિમિત્તના કારણે તેને પ્રભુકૃપાથી કદીક કદીક ઉગ્રી શકતું હોય છે.

(‘જીવનસંશોધન’, આ.૨, પૃ. ૨૧)

\*

\*

જેની કનેથી આપણે મેળવવું છે, તેના દિલમાં આપણું દિલ એક કરી દઈ શકીએ અને જો આપણે તેના જ પૂરેપૂરા થઈ જઈ શકીએ તો તેનું દિલ આપણાં પર પ્રગટે છે.

જેની પાસેથી મેળવવાનું છે, તેના પરત્વે કૃતજ્ઞતાની ભાવના જાગવી ઘટે છે. જેના વડે કરીને આપણા દિલમાં ભાવ પ્રગટે છે, તે ભાવના પરિણામથી કૃતજ્ઞતાની ભાવનાનું પ્રાગટ્ય સહજ બને છે. તે જેમ જેમ પછી ભાવનું સ્વરૂપ લે છે તેમ તેમ આપણે અનુભવીએ છીએ કે કૃતજ્ઞતાની ભાવના જ આ માર્ગના આગળના પ્રવાસનું કારણ છે ને એથી વધુ આગેકૂચનું પરિણામ પણ તેણે.

(‘જીવનસંશોધન’, આ.૨, પૃ. ૨૧-૨૨)

\*

\*

કોઈક જો આપણને છેતરી જાય તો એનું મૂળ કારણ આપણા પોતાનામાં રહેલું સમજવું. (‘જીવનસંશોધન’, આ.૨, પૃ. ૨૪)

\*

\*

જો જીવનધ્યેયનો હેતુ લક્ષમાં હોય તો મળેલો પ્રસંગ તો જીવનઘડતરની એરણ છે. (‘જીવનસંશોધન’, આ.૨, પૃ. ૨૭)

\*

\*

સહિસલામતીની વૃત્તિના સકંચામાં જે રહ્યાં કરે છે, તેનામાં

આત્મબળ પેદા થઈ શકવાનું નથી.

(‘જીવનસંશોધન’, આ.૨, પૃ. ૨૭)

\*

\*

સંઘર્ષણોનો સ્વીકાર જીવનવિકાસની કેળવણી અર્થે  
આવશ્યક છે. (‘જીવનસંશોધન’, આ.૨, પૃ. ૨૮)

\*

\*

અશિષ્ટ અને મુફ્ફલિસ પોષાકના અંચળામાં સાધના કરનાર  
સાધકને ગુપ્તપણે નિરાંતે સાધના કરવાની સરળતા મળી રહેતી  
હોય છે તથા એથી કરી બીજી કોઈ રીતે ભાગ્યે જ શિખાય તેવા  
નભ્રતાના પાઠો સમાજના હાથે શીખવાના મળે છે. માન-  
અપમાનની પર થવાના અભ્યાસની શક્યતા પણ તેમાંથી નીપળ  
શકે છે અને પરિણામે સર્વ પરતે સદ્ગ્રાવ રાખવાની આવશ્યક  
તાલીમ તેમાંથી સાંપડે છે—જો સતત હેતુનું લક્ષ ને જાગૃતિ  
સેવી શકાઈ તો. (‘જીવનસંશોધન’, આ.૨, પૃ. ૩૧)

\*

\*

ખાલી ખાલી મોઢેથી પ્રાર્થના બોલવાથી તેવી પ્રાર્થનાનો  
ઉઠાવ અને રણકાર કદી પણ ઉઠી શકતો નથી.

(‘જીવનસંશોધન’, આ.૨, પૃ. ૩૪)

\*

\*

‘વૃત્તિનો સંયમ કરો’, ‘સંયમ કરો’, ને અમુક ‘આ પાળો  
કે તે પાળો’ એવા પોકારથી કે એવો બોધ દેવાથી કંઈ કશું જાળું  
વળનાર નથી. માનવીને જ્યારે પોતાના જીવનધ્યેયની દિલમાં  
ખરેખરી તમન્નાયુક્ત વ્યાકુળતા પ્રગટે છે, ત્યારે જ જીવન-  
વિકાસના માર્ગનું ખરેખરી રીતનું કામ થતું અનુભવાય છે.

(‘જીવનસંશોધન’, આ.૨, પૃ. ૩૮)

\*

\*

કોઈ કીમતી વસ્તુ ખોવાઈ ગઈ હોય છે તો તે જે નહિએ  
ત્યાં સુધી તેમાં જ આપણું લક્ષ આપમેળે બીજી પ્રવૃત્તિઓ ત્યારે  
કરાતી હોવા છતાં સતત જારી રહે છે; તેમ આપણા જીવનલક્ષ્યનો  
જીવતો ખ્યાલ ને ભગવાનનું સ્મરણ આપણી ઈતર સકળ  
પ્રવૃત્તિમાં રહેવાં ઘટે છે.      ('જીવનસંશોધન', આ.૨, પૃ. ૪૧)

\*

\*

જો આપણે આપણા પોતાનામાં જ પૂરેપૂરા યોગ્ય રીતે સતત ગંગધારાવત્ત સ્થિર અને રત થયાં હોઈશું તો તેમાંથી એક એવી હૈયાસૂજ અથવા હૈયાઉકેલની શક્તિ પ્રગટી જાય છે કે પછી કોઈ કર્મ વિષે જાણા વિચાર કરવાના રહેતા નથી. તે સમયે તેનો ઉકેલ કેમ લાવવાનો તેનું માર્ગદર્શન આપોઆપ પ્રભુકૃપાથી મળ્યા કરે છે.

(‘જીવનસંશોધન’, આ.૨, પૃ. ૪૫)

\*

\*

બુદ્ધિમાં સમતા પ્રગટે તેનું નામ યોગ છે.

(‘જીવનસંશોધન’, આ.૨, પૃ. ૪૬)

\*

\*

જ જાગી શકે છે, તે જીવી શકે છે, બાકીનાં નહિએ.

(‘જીવનસંશોધન’, આ.૨, પૃ. ૪૮)

\*

\*

જીવનસાધના પણ એક નદી જેવી છે. જીવંત અત્યાસ  
વધતાં વધતાં તે ઊરી અને પહોળી થતી જાય છે.

(‘જીવનસંશોધન’, આ.૨, પૃ. ૪૮)

\*

\*

અવળા અનુભવ થાય ત્યારે અકળાવું નહિએ. તે પણ  
વાદળની જેમ વિખરાઈ જવાના જ છે.

(‘જીવનસંશોધન’, આ.૨, પૃ. ૪૮)

\*

\*

જીવનધ્યેય પરતેની ભાવના, કોઈ પણ પ્રકારે, રોજિંદા કર્મવ્યવહારમાં અખંડપણે વધ્યાં કરે અને આંતરિક કરણોના જીવપ્રકારના પ્રવાહમાં ન તણાઈએ તથા તેમાં તાટસ્થ્ય, સમતા, શાંતિ, પ્રસન્નતા આદિ પ્રગટ્યાં કરે અને તેમ કરવાને હૃદયથી જાગૃતિપૂર્વક પ્રભુકૃપાથી મથાયાં જવાય તેનું નામ સાચી સાધના.

(‘જીવનસંશોધન’, આ.૨, પૃ. ૪૯-૫૦)

\* \* \*

જે જે કંઈ જીવદશાનું હોય કે પ્રગટે તેનો જો જાગૃતિપૂર્વક ઈન્કાર થયા જાય અને જો તેની લાંબી પરંપરા ન ચાલે અને મનાદિ કરણો ભાવનામાં એકાગ્રતાથી રમ્યાં કરતાં અનુભવાય તો સાચો ઈન્કાર થયેલો એમ ગણી શકાય. એવી કળામાં અખંડતા પ્રગટે તે વેળાથી સાચી સાધનાની શરૂઆત થાય છે.

(‘જીવનસંશોધન’, આ.૨, પૃ. ૫૦)

\* \* \*

નિરંતરતાની ભાવાવસ્થામાંથી ચેતનનું વ્યક્ત થવાપણું આપમેળે પ્રગટે છે. (‘જીવનસંશોધન’, આ.૨, પૃ. ૫૧)

\* \* \*

દિલમાં ને દિલથી પ્રગટેલા ભાવમાં કોઈ કશી ગણતરી રહેતી નથી, કે તેના પ્રકાર ઊઠતા નથી. જ્યાં કશી ગણતરી છે, ત્યાં દિલ પૂરું પ્રગટેલું નથી એમ પ્રમાણવું.

(‘જીવનસંશોધન’, આ.૨, પૃ. ૫૨)

\* \* \*

ચૂંથણાં ચૂંથવાથી મન વધારે બગડવાનું. જે ચૂંથીશું તેના તે પ્રકારના સંસ્કાર પડવાના જ.

(‘જીવનસંશોધન’, આ.૪, પૃ. ૬૪)

\* \* \*

કોઈને પણ સાચી રીતે સમજવું હોય તો આપણે તેની સ્થિતિમાં મુકાઈ જવું જોઈએ.

(‘જીવનસંશોધન’, આ.૪, પૃ. ૬૫)

\*

\*

તટસ્થતા પ્રગટ્યા વિના પૃથક્કરણ થવું શક્ય નથી.

(‘જીવનસંશોધન’, આ.૪, પૃ. ૬૫-૬૬)

\*

\*

આધ્યાત્મિક માર્ગમાં અશ્રદ્ધા એ ભારેમાં ભારે, વધારેમાં વધારે અવરોધકારક છે. (‘જીવનસંશોધન’, આ.૪, પૃ. ૬૮)

\*

\*

પ્રાર્થના એ એક પ્રકારનું ભાવાત્મક ધ્યાન છે.

(‘જીવનસંશોધન’, આ.૪, પૃ. ૭૨)

\*

\*

માનવી શું કામ કરે છે, જગતના ધોરણે તેનું વર્તન કેવું છે, એના ઉપર એની જીવકક્ષા કે જીવનની ઉચ્ચ્યતાનો આધાર મુદ્દલે નથી. ખરો આધાર તો એનું અંદરનું સત્ત્વ કેવું છે ને કેવું ઘડાયાં જતું હોય છે તેના પર છે; એટલે તે જ્યાં સુધી આપણે જાણતા નથી, ત્યાં સુધી આપણને કોઈનુંયે મૂલ્યાંકન કરવાનો સાચો અધિકાર નથી. (‘જીવનસંશોધન’, આ.૪, પૃ. ૭૩)

\*

\*

હૃદય કે જે ચેતનાશક્તિનું સ્થાન છે તેનો બ્યક્તપણે વિકાસ થયા કરે તો તે વધારે શ્રેયસ્કર છે.

(‘જીવનસંશોધન’, આ.૪, પૃ. ૮૧)

\*

\*

આપણે કશામાં આગ્રહી વૃત્તિ રાખવાની નથી. વિચારમાં પણ નહિ ને મનમાંયે નહિ. કોઈ કહે કે આમ છે તો તો ભલે તેમ, કોઈ કહે કે આમ નથી તો ભલે તેમ. માત્ર, જે કામ આપણું સમજ્યા

છીએ તેમાં તો મક્કમતા ને મરણિયો નિર્ધાર પ્રગટાવવાનો છે.

(‘જીવનસંશોધન’, આ.૪, પૃ. ૧૧૧)

\*

\*

જીવનધ્યેય માટેનો આગ્રહ એટલે એકનિષ્ઠાપૂર્વકનું એકાગ્ર ને કેન્દ્રિત જીવનવહુન; એવો અર્થ અહીં ‘આગ્રહ’નો કરવાનો છે. (‘જીવનસંશોધન’, આ.૪, પૃ. ૧૧૨)

\*

\*

શક્તિ અને બુદ્ધિને તથા અંતરનાં કરણોને ‘બહુશાખા’ અને ‘અનંત’ થવા દેવાનાં તથા વેરવિભેર થઈ જવા દેવાનાં નથી.

(‘જીવનસંશોધન’, આ.૪, પૃ. ૧૧૨)

\*

\*

બીજું, બીજું બાબતોમાં—જેમ કે રાજકારણ, સમાજસેવા, તત્વજ્ઞાનવાદ એવા બધાંમાં આગ્રહ એટલે એક પ્રકારનું સૂક્ષ્મ અહીં—પછી ભલે ને તે વિસ્તૃત સમજણના પ્રકારનું હોય !

(‘જીવનસંશોધન’, આ.૨, પૃ. ૧૦૦)

\*

\*

ધર્મમાં પણ અહીંમાં આગ્રહ હોય છે. અમારો જ ધર્મ સાચો અને તે પ્રમાણે બીજાં જીવે તો જ તેમનું કલ્યાણ થાય, કે જલદી કે વધારે કલ્યાણ થાય, એવો મતાગ્રહ હોય છે. એવી જ રીતે આધ્યાત્મિક માર્ગમાં પણ જોવામાં આવે છે.

જગતમાં જે સંઘર્ષણો વાદોના, મતોના, પદ્ધતિઓના આદિ પ્રવર્ત્ત છે તેનું મૂળ આ અહીંમાં છે.

(‘જીવનસંશોધન’, આ.૨, પૃ. ૧૦૦)

\*

\*

(પ્રચલિત અર્થવાળી) ફિલસ્ફ્ઝી જ્યાં પૂરી થાય છે, ત્યાંથી

સાચી સાધનાની શરૂઆત થાય છે.

(‘જીવનસંશોધન’, આ.૪, પૃ. ૧૧૩-૧૪)

\*

જે કોઈ કામ હાથ પર લેવાનું બને તે શ્રદ્ધાપૂર્વક લેવું અને તેને પ્રેમથી સંપૂર્ણપણે પાર ઉતારી શકીશ એવો નક્કર આત્મવિશ્વાસ દ્દાવવો. (‘જીવનસંશોધન’, આ.૪, પૃ. ૧૧૪)

\*

બીજાંના દોષ તરફ નજર નાખવાને બદલે તેના ગુણ તરફ નજર દિલમાં જો રહ્યાં કરે, તો તેવા ગુણ આપણામાં પણ વિકસી શકે. સાધનામાં જ શું, જીવનના કોઈ પણ ક્ષેત્રમાં કદરભાવના અને ગુણગ્રાહકતાનો ગુણ અતિ ઉપયોગી ને જરૂરી છે. આપણું લક્ષ જેના પર રહેશે તે તત્ત્વ વહેલું મોડું આપણામાં બેંચાશે.

(‘જીવનસંશોધન’, આ.૨, પૃ. ૧૦૩)

\*

એકના એક કર્મને એકધારી ભાવનાથી સજ્ઞાનપણે વળગી રહેવું તે કંઈ નાનીસૂની વાત નથી અને તેમાં વર્ષોનાં વર્ષો ટકવું તે પણ એક પ્રકારનું જીવનનું પ્રગટ રહેતું બળ સૂચ્યવે છે.

(‘જીવનસંશોધન’, આ.૪, પૃ. ૧૨૩)

\*

સમર્થ પુરુષ કાળને બનાવે છે કે કાળ સમર્થ પુરુષને ઉપજાવે છે એ તાત્ત્વિક ચર્ચા જવા દઈએ. એટલું તો નિર્વિવાદ છે કે સમર્થ પુરુષ કે મુક્તાત્મા કાળના ઘડવૈયા જરૂર હોય છે. તેઓ કાળની અસર પ્રમાણે વર્તે છે તે હકીકત સાચી છે, પરંતુ તે તેનાથી તણાઈને નહિ, તેનાથી ઉપર તરતા રહીને.

અવતાર તો કાળની અસરથી પર હોય છે, પણ જગતની તેમના તેમના અવતાર સમયની બીજી કોઈ રીતે ન પુરાય એવી

ચેતનાના અવિર્ભાવની માગણી તેઓ પૂરૈ છે, ને તે તેમના દેહધારણનો હેતુ હોય છે.

જે કોઈ પરમ પુરુષે જે કંઈ જગતમાં કર્યું તે તેમના થુગકાળના ધર્મને અનુસાર કર્યું ને તે કાળના ધર્મના પ્રમાણમાં તે રીતે જગતમાં તેમનું વ્યક્તત્વ થયું. તેથી કંઈ તે એટલામાં જ સમાયા હતા, તેટલાં જ તેમનાં શક્તિસામર્થ્ય હતાં એમ માનવું એમાં વિચારદોષ દેખાય છે.

આપણે તો સર્વ ધર્મ પરત્વે, ધર્માના મૂળ આચાર્યો પરત્વે તથા સર્વ સત્પુરુષ કે મુક્તાત્મા પરત્વે હદ્યનો ભક્તિભર્યો ઊછળતો સદ્ગ્ભાવ કેળવી કેળવીને પૂરેપૂરો દાખવવાનો છે.

સર્વ પરત્વે જ્ઞાનયુક્ત સદ્ગ્ભાવ પૂરેપૂરો દાખવ્યા વિના સર્વ પરત્વેની સમત્વની ભાવના પ્રગટી શકવાની નથી.

(‘જીવનસંશોધન’, આ.૨, પૃ. ૧૧૧-૧૨)

\* \* \*

EXCLUSIVELY-એકલો, અલગપણે, ભક્તિયોગ તે ભક્તિયોગ નથી, જ્ઞાનયોગ તે જ્ઞાનયોગ નથી, કર્મયોગ તે કર્મયોગ નથી. જીવનસાધનામાં તે બધા એકબીજામાં પરસ્પર ઓતપ્રોત થઈ ગયેલા હોય છે.

જ્યાં સુધી આપણામાં તટસ્થતા, સમતા, સાક્ષીભાવ પૂરેપૂરાં પ્રગટ્યાં નથી, ત્યાં સુધી આપણે કોઈને પણ યોગ્ય રીતે તોળી શકવાના નથી. તેથી બીજાનું આહું જોવું તે કરતાં આપણે તેમાંથી પરાજમુખ થવું તે આપણા શ્રેય માટે ઉત્તમ છે.

(‘જીવનસંશોધન’, આ.૨, પૃ. ૧૧૨, ૧૧૪)

\* \* \*

આપણાં સાથીદારોને કેમ કરીને વધુમાં વધુ ઉપયોગી થઈ પડાય ને તેમને કેમ કરીને વધુ મહત્ત્વ દેવાયાં જાય ને આપણે

પોતે તો શૂન્યમાં શૂન્ય રહી શકીએ એમ વર્તવાથી શરણાગતિની ભાવના કેળવાતી આવે છે. જો કે આવા વર્તવથી ઘણીવાર પ્રત્યક્ષ ગેરલાભ પણ થતો હોય છે, કિંતુ તેવા ગેરલાભમાંથે સાચો લાભ સમાયેલો હોય છે, એ અંતે જણાયા વિના નહિ રહે.

(‘જીવનસંશોધન’, આ.૨, પૃ. ૧૧૬)

\* \* \*

જીવનપથમાં આવતાં વિધો, મુશ્કેલીઓ, ગૂંચો તો ઊલટાં આધ્યાત્મિક તંદુરસ્તી ને બળને પુષ્ટ કરનાર ઔષધિ જેવાં નીવડે છે— જો આપણી તે પરત્વેની જીવંત, વેધક, સારગ્રાહી દણ્ણિ પ્રગટેલી હોય તો.

(‘જીવનસંશોધન’, આ.૨, પૃ. ૧૧૬)

\* \* \*

આપણને જે વીજન્સ-સૂક્ષ્મ દશ્યો આવે છે એ એક રીતે સાધનાનું સારું લક્ષણ ગણી શકાય, પરંતુ આપણે આવાં દશ્યોને મહત્ત્વ દેવાનું નથી. તેમાંથી મન, ચિત્ત જેટલાં પાછાં વાળી શકાય તેટલું સારું. આપણું વલણ એવું થએલું હોવું જોઈશે કે આના કરતાં આપણા મનમાં નીરવતા પ્રગટે, કામનાનો લય વગેરે થાય તો ઉત્તમ.

ગુણાની સાથે તેની શક્તિ આપોઆપ તેમાં રહેલી હોય છે.

(‘જીવનસંશોધન’, આ.૨, પૃ. ૧૧૮-૧૯)

\* \* \*

સુમેળ, સુસંવાદ, સમાધાન અને સમન્વય એ સાધક જીવનનાં પ્રત્યક્ષ લક્ષણો ગણી શકાય.

(‘જીવનસંશોધન’, આ.૪, પૃ. ૧૩૨-૩૩-૩૪)

\* \* \*

બીજાના સદ્ગુણ પરત્વેનું સહજ આકર્ષણ ને તેની કદર સાધકના જીવનમાં જો વ્યક્ત થતી ન અનુભવાય, તો પોતાની

દિશા ખોટી છે એમ સમજવું.

(‘જીવનસંશોધન’, આ.૪, પૃ. ૧૩૩-૩૪)

\*

\*

બીજા કોઈ જીવનાં ગુણગાન કે વખાણ સાંભળતાં જો મનમાં દ્વેષ-ઈર્ષ્યા કે એવી કોઈ વૃત્તિ ઉદ્ભવે ને તેના પ્રતિકારરૂપે તે જીવની આપણી સમજણની આડીઅવળી વાત હૈયે ચઢે યા વ્યક્ત થઈ જાય તો સમજવું કે બીજાના સદ્ગુણ પરતેનું સહજ આકર્ષણ હજુ આપણામાં પ્રગટ્યું નથી ને એટલે અંશે સદ્ગુણની સાધના લૂલી યાને અધૂરી સમજવી.

(‘જીવનસંશોધન’, આ.૨, પૃ. ૧૧૯)

\*

\*

હદ્ય એ શબ્દ સ્થળવાચક નથી, પરંતુ કક્ષાવાચક ને ભૂમિકાવાચક પણ છે. (‘જીવનસંશોધન’, આ.૨, પૃ. ૧૨૦)

\*

\*

જીવન માત્ર કંઈ ગુણોનો સમૂહ નથી. ગુણોમાં જીવન રહેલું છે, એ વાત સાચી. સદ્ગુણથી જીવન શોભે છે એ પણ ખરું છે; પરંતુ જીવનની સાચી વાસ્તવિકતા ને તેની મર્યાદા એકલા ગુણના વર્તુળમાં પુરાઈ રહી શકતી નથી. એ એનાથી પાર પણ છે.

ગુણ એ આપણું લક્ષ્ય નથી. ગુણને પ્રેરાવનારી જે શક્તિ ને ગુણમાં રહેલી જે શક્તિ, તે શક્તિનું આપણા જીવનમાં જ પ્રાગટ્ય થાય અને તે આપણા સકળ કર્મમાં, વ્યવહારવર્તનમાં કાર્યસાધક થઈ રહેલી અનુભવીએ એ આપણું ધ્યેય હોવું ઘટે.

(‘જીવનસંશોધન’, આ.૨, પૃ. ૧૨૧)

\*

\*

આધ્યાત્મિક જીવનના વાંछુને એકાંત અને મૌન એ ઘણા ઘણાં જરૂરનાં છે. અહીં મૌન એટલે મનની નીરવતા પ્રાપ્ત થવામાં સહાયરૂપ થાય તે પ્રકારનું મૌન અને એ ઉત્તમ પ્રકારનું મૌન છે. (‘જીવનસંશોધન’, આ.૪, પૃ. ૧૩૭)

\*

\*

જ્યાં કંઈ કશોયે ભાર લાગે, કંટાળો લાગે, ત્રાસ લાગે, અકળામણ લાગે, સંતાપ લાગે કે એવું એવું થાય, ત્યારે જાણવું કે આપણામાંથી સરળતા અને સહજતા ઊરી ગયેલાં છે કે ઘટી ગયેલાં છે; આપણે આપણી સાચી સ્થિતિમાં નથી.

(‘જીવનસંશોધન’, આ.૪, પૃ. ૧૩૭)

\*

\*

સંપૂર્ણ સાત્ત્વિકતા અને ચેતન પરત્વેનું પૂરું, યોગ્ય, ઉત્કટ એકરતપણું જ્યાં સુધી જીવનમાં પ્રગટે નહિ, ત્યાં સુધી બ્રહ્મચર્યનું સ્થિર થવાપણું કદી પણ બની શકતું નથી.

(‘જીવનસંશોધન’, આ.૪, પૃ. ૧૩૮)

\*

\*

માનવીનો વિકાસ આમ તો પ્રકૃતિના પટમાં થયાં જ કરતો હોય છે પણ તે પ્રકૃતિમાં વિકાસ થયે જાય છે, ચેતનમાં નહિ. તે ચેતનતત્ત્વ પ્રત્યેકના જીવનનો જે પ્રકૃતિનો પટ પડેલો છે, તેના દ્વારા બ્યક્ત થાય છે. એટલે ચેતનને બ્યક્ત કરવા સારુ પ્રકૃતિના વલાણને ચેતનાભિમુખ કરવાનું રહે છે.

(‘જીવનસંશોધન’, આ.૨, પૃ. ૧૨૭)

\*

\*

જાગૃતિ એ તો સાધનાનો મૂળ પાયો છે, તેમ જ એ તેનું ઘડતર અને ચણતર છે. સાધના કરતાં કરતાં જો જ્ઞાનપુક્ત જાગૃતિ ન જાગતી હોય ને પ્રસંગે પ્રસંગે ચેતવાનું ન થતું હોય તો

આપણાથી કશી સાધના થતી નથી એમ જાણવું.

(‘જીવનસંશોધન’, આ.૪, પૃ. ૧૪૫)

\*

\*

જ્યાં સુધી ચિત્તમાં જીવદશાના પડેલા સંસ્કારો છે, ત્યાં સુધી વિચાર તો પ્રગટવાના. (‘જીવનસંશોધન’, આ.૪, પૃ. ૧૪૫-૪૬)

\*

\*

આધ્યાત્મિક લખાણમાં અને સાધના અંગેના લખાણોમાં એક જ વિષયની હકીકતનું ને સમજણનું લખવાનું હોવાથી કદી કદી એકનું એક લખવામાં આવે છે કે કહેવામાં આવે છે, ને તે કુદરતી છે. મોટા ભાગે તો કંઈક ને કંઈક નવું પણ, તે એકનું એક કહેવા સાથે આવે છે ખરું. તેમ છતાં ‘એકની એક હકીકત આ તો આવી’ એમ ગણીને સાધકે આધ્યાત્મિક વાચનથી કંટાળવું નહિ.

(‘જીવનસંશોધન’, આ.૪, પૃ. ૧૫૧)

\*

\*

માનવીને હરકોઈ રીતે કંઈક ને કંઈક વિવિધતા જોઈએ છે. મન દરરોજ નવા નવા રસાસ્વાદ લે તો સંતોષાય એવું બની ગયું છે. ઈન્દ્રિયોને નવું નવું ગમે છે. આ વલણમાં માનસનું છીછરાપણું બ્યક્ત થાય છે. (‘જીવનસંશોધન’, આ.૪, પૃ. ૧૫૧)

\*

\*

જે કળાથી દિલની સાત્ત્વિક પ્રસન્નતા પ્રગટે તે સાચી કળા છે. જે કળાથી માનવીના મનમાં વિકાર જન્મે કે વિકૃતિ થાય અને તેને કારણે જે તન્મનાટ્યુક્ત ઉશ્કેરાટ અને ‘મજા’ જન્મે તે સાચી લલિતકળા નથી. (‘જીવનસંશોધન’, આ.૪, પૃ. ૧૫૨)

\*

\*

માનવીને અંતરમાંથી સ્વયંસ્હુરિત પ્રસન્નતા અને આનંદના ફૂવારા ફૂટતા ન હોવાથી બહિરૂપણે, બહારથી, કંઈક ને કંઈક

લહેર ભોગવવાનું ઈચ્છીને કે ભોગવીને આ ખોટ પૂરવાને મથે છે. આ કારણે જીવને ઈન્દ્રિયોના વિષયભોગો ખૂબ ગમે છે. આમ તેનું સારું જીવન ક્ષુલ્લક પ્રકારની ક્ષુદ્ર પ્રવૃત્તિઓની હારમાળામાં વીતી જતું હોય છે.

(‘જીવનસંશોધન’, આ.૪, પૃ. ૧૫૨)

\* \* \*

મનને એક પછી એક, એક એકથી જુદા, રસો લેવાની જે ટેવ પડેલી છે તેને બદલે સનાતન, સૂક્ષ્મ, સાત્ત્વિક આનંદમાં રસ લેતું કરવાને એકના એક પ્રકારના કશાક સાધનાના અભ્યાસમાં પરોવવું પડશે. (‘જીવનસંશોધન’, આ.૪, પૃ. ૧૫૩)

\* \* \*

અભ્યાસ તો એનું નામ કે જેમાં વારંવાર વિકાસ થવાને જ્ઞાનયુક્ત પુનરાવર્તન થયાં જ કરે; એવા પુનરાવર્તન વિના એક ને એક વાત ફરી ફરીને આવ્યા વિના, કોઈ જાતનો વિચાર કે ભાવના સ્થિર થાય નહિએ.

(‘જીવનસંશોધન’, આ.૪, પૃ. ૧૫૩-૫૪)

\* \* \*

બહેનો અને માતાઓ સાથેનો નિર્ભળ ભાવસંબંધ એ પતન કરનારું સાધન નથી; પરંતુ બળ અને પ્રેરણા આપનારું સાધન છે. તે સંબંધના અંતરના હાઈમાં જીવનવિકાસના ધ્યેયનું જ્ઞાનભક્તિપૂર્વકનું ભાન પ્રગટેલું હોવું જોઈશે.

(‘જીવનસંશોધન’, આ.૨, પૃ. ૧૪૧)

\* \* \*

સંબંધ વધે તેમ તેમ નિઃસંગની ભાવના પણ સવિશેષ કેળવાયા જાય તે તરફ લક્ષ દેવું ઘટે છે. સત્સંગની ભાવના રાખવાથી, એટલે કે જે જે કંઈ મળે તેની સાથે જીવનવિકાસના

હેતુના જ્ઞાનની ભાવના ફળવવાની એકમાત્ર એકાગ્ર ને કેંદ્રિત દાખિલી, વૃત્તિ ને વલણ પ્રગટ્યાં હોય તો તેવા સત્સંગથી નિઃસંગ ભાવના એટલે કે આત્માની ભાવના કેળવવાતી જતી હોય છે.

સકળ પ્રકારના સંબંધ અને કર્મ પણ ભાવના કેળવવાને અર્થે છે અને જીવનવિકાસના ઘડતર ને ચાણતરને કાજે છે. તે વિના સંબંધ કે કર્મનો બિજો કોઈ અર્થ કે હેતુ નથી.

(‘જીવનસંશોધન’, આ.૨, પૃ. ૧૪૦, ૧૪૨)

\*

‘પલમેં માસા, પલમેં તોલા’ એવી સગડગભરી વૃત્તિને સાધકે ચેતી ચેતીને દૂર કરવાની રહે છે.

(‘જીવનસંશોધન’, આ.૨, પૃ. ૧૪૪)

\*

ભાવમાં જ્યારે એકાગ્રતા ને કેંદ્રિતતા પ્રગટે ને ટકે એટલે કે એમાં જ એટલી તો ગાઢ તન્મયતા જન્મે કે આગળપાછળનું ભાન પણ ન રહે, એવી સ્થિતિ વારંવાર જ્યારે થઈ જતી હોય ત્યારની સંપૂર્ણ એવી ભાવાવસ્થા થઈ જવાની તૈયારી હોય, ત્યારે જેવા થવાનું દિલ હોય તેની સદ્ગુણાવના સચેતનપણે જો આપણે હૃદયમાં રાખી શક્યા, તો આપણી પ્રગતિ ઘણી જરૂરી થાય.

(‘જીવનસંશોધન’, આ.૨, પૃ. ૧૪૬)

\*

જુદા જુદા મુક્તાત્માઓની વાણી જુદી જુદી હોવાનો પણ સંભવ રહે છે. એકમેકથી કોકવાર પરસ્પર ભિન્ન પણ હોવાનો સંભવ ખરો; છતાં તે પણ અનુભવની વાણી હોઈ શકે છે. અનંત પાસાંવાળા પરમાત્મતત્વનો તેઓએ પોતપોતાની જુદી જુદી રીતે અનુભવ કર્યો હોય એટલે વક્તવ્યમાં ભિન્નતા રહેવાની ખરી.

(‘જીવનસંશોધન’, આ.૪, પૃ. ૧૬૮)

\*

આપણી પ્રેમભાવના બીજા તરફથી મળતા પ્રેમ ઉપર આધાર  
રાખતી હોય તો તો તે એક જાતની શરતી લેવડટેવડ થઈ.

(‘જીવનસંશોધન’, આ.૪, પૃ. ૧૮૭)

\*

\*

જેના પરતે આપણને અણગમો હોય કે થાય તેને  
જ્ઞાનભાનપૂર્વક ખાસ સવિશેષ પ્રેમથી ચહાવું અને તે પણ આપણા  
કલ્યાણને માટે તેમ કરવાનું છે.

(‘જીવનસંશોધન’, આ.૨, પૃ. ૧૬૮)

\*

\*

નામ-સ્મરણની ધારણા માત્ર યાંત્રિક થયા ન કરે એ ખાસ  
જોતા રહેવાનું છે. (‘જીવનસંશોધન’, આ.૪, પૃ. ૧૮૮)

\*

\*

એકમાંથી અનેકમાં વિસ્તાર પામવું એ તો પ્રકૃતિનો  
અનાદિ ગુણાદ્ધે. માટેજે કોઈ એકને પૂરેપૂરું જાણેછે, તે અનેકને પણ  
જાણી શકશે. (‘જીવનસંશોધન’, આ.૪, પૃ. ૧૮૯)

\*

\*

અંતે તો પુરુષ અને પ્રકૃતિ એ બન્નેની શક્તિઓનો સમન્વય  
અને સુભેળ સધાય ત્યારે જ સાચું જીવન પ્રાપ્ત થવાનું છે અને  
તેમ થવું અનિવાર્ય પણ છે. (‘જીવનસંશોધન’, આ.૪, પૃ. ૧૯૦)

\*

\*

વ્યવહારની બહારની પ્રવૃત્તિઓમાંથી અલિખ રહેવાનું છે  
તે વાત સાચી, પરંતુ જે પ્રવૃત્તિ આવી મળેલી હોય, તે તરફ એક  
પ્રકારની અરુચિની વૃત્તિ, ગ્રાસ કે કંટાળાની વૃત્તિ ઊપજતી હોય  
ને તેને લીધે તેમાંથી ભાગી છૂટવાની વૃત્તિ પેદા થતી હોય તે  
યોગ્ય નથી. તે પણ એક પ્રકારનો તમોગુણ છે.

(‘જીવનસંશોધન’, આ.૨, પૃ. ૧૭૨-૭૩)

\*

\*

सत्संगनो मહिमा ઘણો ગવાયો છે, તે એટલા માટે કે મુક્તાત્માની સાથે પ્રેમભક્તિજ્ઞાનપૂર્વકના આંતરિક પરિચયથી જીવનમાં પ્રેરણાત્મક ભાવ પ્રગટે છે અને એવા ભાવનો સદ્ગુરૂની અંતર્મુખતા કેળવ્યા કરવામાં રહેલો છે.

(‘જીવનસંશોધન’, આ.૨, પૃ. ૧૭૫)

\* \* \*

સદ્ગુરૂ જે કંઈ કહે, તે “તેઓ કહે એટલા માટે કરીશું” એવું વલણ રાખવાથી કશો લાભ થાય નહિ, આપણે મન-બુદ્ધિને સમજાવીને, તેમનો સહકાર સાધીને, જો તેમ કરવાનું રાખીશું તો તે ઊગી નીકળવાનું છે. (‘જીવનસંશોધન’, આ.૪, પૃ. ૧૮૭)

\* \* \*

આપણને મળેલું કર્મ આપણા પોતાના વિકાસ માટે કરવાનું છે. પછી ભલે એની કોઈ કદર કરો કે ન કરો.

(‘જીવનસંશોધન’, આ.૪, પૃ. ૧૮૮)

\* \* \*

કશું પણ કેવળ અનિષ્ટ નથી. અનિષ્ટને પણ સદ્ગુરૂની રીતે ભાવનામાં પ્રેરી શકાય છે. જેર એ જેર જ માત્ર નથી પણ અમૃત પણ છે, જો એના સદ્ગુરૂની કળા આવડતી હોય તો. દવાઓમાં હળહળતાં જેરનો પણ તેનું રૂપાંતર કરીને તેની યોગ્ય માત્રામાં ને યોગ્ય મિશ્રણ સાથે ઉપયોગ થાય છે એ જાણીતી હકીકત છે. (‘જીવનસંશોધન’, આ.૪, પૃ. ૨૦૨)

\* \* \*

શોક થતાં તે પણ એક પ્રકારની લાગણી જન્માવે છે. ને તેનો પણ નામસ્મરણમાં ઉપયોગ થઈ શકે છે; તેમાંથી એકાગ્રતા જન્માવી શકાય છે. કોઈ પણ ઊર્મિને, લાગણીને રચનાત્મક

સાધનાના ઉપયોગમાં લઈ શકાય એમ છે.

(‘જીવનસંશોધન’, આ.૪, પૃ. ૨૦૭)

\* \* \*

જીવપ્રકારની કોઈ પણ વૃત્તિના બળથી મુક્ત, એવો જે મુદ્દલે બળ વગરનો જીવ તે સાચી અબળા.

જ્યારે સંપૂર્ણ નિરાસકિત, નિર્મભત્વ, નિરાગ્રહ, નિરહંકારીપણું વગેરે જીવનમાં કામ કરતાં થઈ જાય, ત્યારે જ સાચી રીતે ભગવાન ઉપર આધાર રાખી શકાતો હોય છે.

(‘જીવનસંશોધન’, આ.૨, પૃ. ૧૬૦)

\* \* \*

અધ્યાત્મપથે ‘નિર્ધન’ થઈ જવાનું છે એટલે કે જે જીવપ્રકારનો જીવપ્રકારની-વૃત્તિઓનો-ખજાનો છે તે ખપાવી દઈને, એ અર્થમાં, પૂરેપૂરા બિખારી બનવાનું છે.

(‘જીવનસંશોધન’, આ.૨, પૃ. ૧૬૭)

\* \* \*

આત્મભાવનાને પોષક જુદી જુદી ભાવનાઓમાં માંહોમાંહે સખ્યભાવ હોય છે, અથવા એક જ તત્ત્વનાં તે તો જુદાં જુદાં સ્વરૂપનાં દર્શન છે; તેવી રીતે અભિમાન, ભય, કોધ, કામ વગેરે વગેરે જીવપ્રકારની વૃત્તિઓમાં પણ માંહોમાંહે બેરુભાવ હોય છે, ને તે પણ એક જ આસુરી વૃત્તિનાં જુદાં જુદાં સ્વરૂપ છે.

(‘જીવનસંશોધન’, આ.૨, પૃ. ૨૦૨)

\* \* \*

ગુરુભાવ એટલે ગુરુ પોતે નહિ કે તેનું શરીર પણ નહિ; પરંતુ જીવનનો વિકાસ થવાને આપણાને જે ઉત્કટ તમના પ્રગટેલી હોય છે, તેને એકાગ્ર ને કેન્દ્રિત એકમાં કરીને તેનામાંથી પ્રેરક બળ અને ચેતનવંતા પ્રાણ પ્રાપ્ત કરવાને જે

લક્ષ્ય, જે સાધન છે તે. ('જીવનસંશોધન', આ.ર, પૃ. ૨૦૩)

\*

\*

પ્રેમના ભાવનું ધારણ આધાત-પ્રત્યાધાતના અવલંબનથી થતું હોતું નથી. તે તો સ્વયંસ્કૃતિ છે.

('જીવનસંશોધન', આ.ર, પૃ. ૨૦૮)

\*

\*

જે પોતાને ભાગે આવેલો ધર્મ સંપૂર્ણ અદાથી કરીને પાળે છે, તેને કોઈ કશાને વિષે ફરિયાદ કરવાનું કારણ રહેતું નથી.

('જીવનસંશોધન', આ.ર, પૃ. ૨૦૯)

\*

\*

હદ્યની સજ્ઞાન પ્રેમભક્તિથી ઋષિમુનિઓની સેવા કરવામાં ઈતિકર્તવ્યતા માનનારા પણ તરીને પાર ગયાના શબ્દરી જેવા દાખલા પણ છે. એટલે જીવનવિકાસની સાધનામાં એકાગ્ર ને કુદ્રિત થવાતું જવાય તો વિવિધ ગુણશક્તિઓ સાથે સાથે વિકસે છે, ને એમ કરતાં કરતાં પૂર્ણત્વની કક્ષામાં પણ પહોંચી શકાય છે.

('જીવનસંશોધન', આ.ર, પૃ. ૨૧૩)

\*

\*

સાધનામાં કાળબદ્ધ યોજનાની જેમ એવા કોઈ કાળનું અમુક સમયને અંતે અમુક સ્થિતિ કે ભાવના થાય એવી નિશ્ચિતતાનું નિર્ણિત સ્થાન ન હોઈ શકે. જે કોઈ પોતાની 'આજ' યોગ્યપણે સંભાળે છે, તેની 'કાલ' યોગ્ય રીતે પ્રગટવાની જ છે.

('જીવનસંશોધન', આ.ર, પૃ. ૨૧૪)

\*

\*

આપણા મનને અથવા ભાવને સ્થિર કરવાને માટે સાકાર આલંબનની જરૂર રહે છે; આથી એક યા બીજા પ્રકારે માનવસમાજમાં સાકાર પૂજાનો સંસ્કાર જીવંત રહેવાનો છે.

સદ્ગુરુની પ્રથા પાછળનો અંતર્ગત હેતુ તો એક આલંબનનો જ  
મુજ્યત્વે હોઈ શકે છે. ('જીવનસંશોધન', આ.ર, પૃ. ૨૨૪-૨૫)

\* \* \*

સેવાના પ્રેમથી તો ભેદ ઘટે અથવા ઘટવા માટે, પરંતુ  
ભેદની માત્રા સેવાક્ષેત્રે જો વધેલી અનુભવાતી હોય તો એના  
સાચા અર્થમાં તે 'સેવા' ગણાય કે કેમ તે વિચારવું રહ્યું.

('જીવનસંશોધન', આ.ર, પૃ. ૨૩૫)

\* \* \*

પ્રભુને પામવાના અનંત માર્ગ છે; સાધનાના અનંત પ્રકાર  
છે ને ભગવાનનાં દર્શન પણ અનંત રૂપોમાં થાય છે.

('જીવનસંશોધન', આ.ર, પૃ. ૨૩૭)

\* \* \*

વિચારને કદી વાગોળશો નહિ. વાગોળવું જુદું છે અને  
મનનચિંતન એ જુદી હકીકત છે.

('જીવનસંશોધન', આ.ર, પૃ. ૨૪૦)

\* \* \*

પ્રથમ તો સત્ત્પુરુષ (મુક્તાત્મા) મળવા જ દુર્લભ છે. કદાચ  
મળી જાય તો તેમને ઓળખવા દુર્ઘટ છે અને કદીકને ઓળખાય  
તો તેમને સમજવા એ તો ઓર દુષ્પાય છે; અને સદ્ભાંયે  
કદાચ સમજાય તોપણ તેમનું જ્ઞાનભક્તિપૂર્વક પોતાના  
જીવનવિકાસને અંગે સર્વપિણભાવે અનુશીલન પરિશીલન કરવું  
એ તો મહા દુઃસાધ્ય કાર્ય છે.

('જીવનસંશોધન', આ.ર, પૃ. ૨૫૩)

\* \* \*

જીવદશામાં જે કંઈ ગતિ પ્રગટે છે, એ ગતિની પાછળ વેગ  
અને ધક્કો આપનારી જે શક્તિ છે તે તો અહમ્ની છે અને

જીવદશામાં પણ જે નમ્રતા કેળવાતી હોય છે અને કેળવવાની હોય છે તેની કેળવણી પાછળ પણ તે અહમ્મનો ધક્કો હોય છે. નમ્રતા એ સદ્ગુણ છે એ વાત સાચી, પરંતુ જીવદશામાં તો સદ્ગુણનું પણ સૂક્ષ્મ અભિમાન પ્રગટતું હોય છે, ને સત્ત્વગુણની અસરથી અલિપ્ત થવાનું તો ઘણું ઘણું મુશ્કેલ છે.

(‘જીવનસંશોધન’, આ.ર, પૃ. ૨૫૬)

\* \* \*

સાચો ને ઈચ્છવાયોગ્ય ચમત્કાર તો પ્રકૃતિનું રૂપાંતર થાય તે છે. ભાવનામાં અખંડતા પ્રગટતાં પ્રગટતાં મનમાં નીરવતા, બુદ્ધિમાં પ્રજ્ઞાવસ્થા, ચિત્તમાં ચેતનની ભાવના, પ્રાણમાં એકમાત્ર ભગવદ્ભાવનાની ઝંખના ને અહમ્મનાં પ્રભુપ્રેરિત શક્તિ, એવાં પરિણામમાં પ્રગટતાં પ્રગટતાં શરણાગતિને પ્રભુકૃપાથી પામીશું. આપણે તો આ પ્રકારની ભાવાત્મક પરિણામજનક ચમત્કારની વાંછના રાખવી.

(‘જીવનસંશોધન’, આ.ર, પૃ. ૨૬૮)

\* \* \*

અવ્યક્તમાં આસક્તિ થવી એ ઘણું દોધાલું છે. સાકારની ભક્તિ પ્રમાણમાં વધુ સુગમ છે. આથી સાધનાને માટે ભક્તિ વિશેષ સાનુકૂળ છે. ભક્તિમાંથી જ્ઞાન પ્રગટે છે અને જ્ઞાનમાંથી યોગ પ્રગટે છે. ને તે બધાંમાંથી કર્મકૌશલ્ય પણ પ્રગટે છે.

(‘જીવનસંશોધન’, આ.ર, પૃ. ૨૭૭)

\* \* \*

સાધનના અભ્યાસમાંનું સાકારપણું એટલે તેનો ભાવ અને તેમાંથી પ્રગટતી એકાગ્રતા, કેંદ્રિતતા ને સંખ્યાતા; ને તે પછી તેનો થતો વિસ્તાર.

(‘જીવનસંશોધન’, આ.ર, પૃ. ૨૭૮)

\* \* \*

જેમ શિક્ષણમાં આગળ વધવાને માટે સાકારનું શરણું એ

શિક્ષક, તેવી રીતે જીવનવિકાસ પંથે અવલંબન યોગ્ય સાકાર સાધન તે સદ્ગુરુ. (‘જીવનસંશોધન’, આ.ર, પૃ. ૨૭૮)

\* \* \*

સમજવું તે એક વાત છે ને સ્વીકારવું તે જુદી વાત છે. સમજ્યા હોઈએ પણ સ્વીકારાયું ન હોય એવું પણ ઘણીવાર બને છે.

(‘જીવનસંશોધન’, આ.ર, પૃ. ૨૭૮)

\* \* \*

સારાયે દિવસની સમગ્રતાઃ કુલ વપરાયેલ શક્તિનો ઘણોખરો મોટો ભાગ સાધનાની ભાવના મૂર્ત સ્વરૂપ લે એવી રીતે તે પરત્વે જ વળેલો હોવો જોઈશે.

(‘જીવનસંશોધન’, આ.ર, પૃ. ૨૭૮)

\* \* \*

કર્મ કરવા છતાં એ કર્મ પાછળની ઈચ્છા કોઈ લૌકિક પ્રકારની ન હોવી જોઈએ; કિંતુ સાધનાના ભાવને ગ્રેરક બળરૂપ પ્રકટ્યા કરે એવી રીતે ને એવા ભાવે પ્રભુપ્રીત્યર્થ મળેલાં કર્મો યજ્ઞભાવે આપણે કર્યાં કરવાનાં છે.

(‘જીવનસંશોધન’, આ.ર, પૃ. ૨૭૮)

\* \* \*

મૌન તો સારું જ પરંતુ પાછું એ મૌન ઘરેડ પ્રકારનું, શુષ્ણ, કોરું કોરું ન હોવું ઘટે. મૌનમાં આંતરિક પ્રવાહ ભાવનામય પ્રગટેલો રહે અને તેવું ન હોય તે વેળાએ મનનચિંતનની પ્રક્રિયા ચાલતી રહે; એટલે કે કોઈ ને કોઈ પ્રકારે મૌન પાળતી વેળાએ સાધનાના રચનાત્મક સાધનમાં વળગેલાં રહ્યાં કરતાં હોઈએ, તો તે પ્રકારનું મૌન વિકાસાત્મક છે.

(‘જીવનસંશોધન’, આ.ર, પૃ. ૨૮૦)

\* \* \*

આપણામાં ભાવના જગેલી હોય છે અને સદ્ગુરી પ્રગટેલો  
હોય છે તો બીજામાંથી તેવું મળ્યાં કરે છે.

(‘જીવનસંશોધન’, આ.ર, પૃ. ૨૮૦)

\*

\*

સંબંધ માત્ર, ગમે તેની સાથેનો, ભાવ પ્રગટે ને કેળવાય  
તે હેતુ અર્થે છે. શ્રેયાર્થને માટે તેવો સંબંધ ભાવ વિનાનો હોઈ  
શકતો નથી. (‘જીવનસંશોધન’, આ.ર, પૃ. ૨૮૦)

\*

\*

જીવદશાનાં વિચાર, વૃત્તિ કે લાગણી સંતોષવાનું કરવા જતાં  
જીવન પરતવેની તમન્નાનું જોશ ને બળ ઘટી જતાં હોય છે.

(‘જીવનસંશોધન’, આ.ર, પૃ. ૨૮૨)

\*

\*

અજપાજપ પ્રગટે છે, ત્યારે જ માનસિક જપની ધારણા  
સતત નિરંતર રહી શકે છે.

(‘જીવનસંશોધન’, આ.ર, પૃ. ૨૮૮)

\*

\*

સંસારી માનવી અને સાધક બન્ને જણા સાંસારિક,  
વ્યાવહારિક કર્મો કરતા હશે. એટલે બન્નેના કામનો પ્રકાર બાધ્ય  
રીતે તો એક જ હોવા છતાં કર્મની પાછળના ભાવમાં પાયાનો  
ફરક હોય છે. સંસારીનું લક્ષ તો સંસાર પરત્વે રહેવાનું ને એના  
ચિત્તમાં સંસાર જન્મવાનો; જ્યારે સાધક પોતાના ધ્યેયની  
ભાવનાને કેંદ્રસ્થ કરતો હશે ને પોતાની તે ભાવનાને વિશેષ  
મહત્ત્વ આપતો હશે. જો તેમ ન કરી શકતો હોય તો તે તેની  
નબળાઈ છે. તેવી નબળાઈ તેનો દોષ છે. તેમાંથી તેણે નીકળી  
જવું ઘટે. એટલે સાધક જ્યારે ખરેખરી રીતે સકળ પ્રકારનાં કર્મ  
કરતાં કરતાં અંતરમાં એકમાત્ર સાધનાના જ ભાવની એકાગ્રયુક્ત

જ્ઞાનાત્મક ધૂનમાં પ્રગટેલો રહ્યા કરતો હશે, ત્યારે તેવા તેવા કર્મના ક્ષેત્રપ્રકારના સંસ્કાર તેના ચિત્ત ઉપર પડી શકવાના નથી, પરંતુ તેના બળમાં તેથી તો ઉમેરો થવાનો છે.

(‘જીવનસંશોધન’, આ.ર, પૃ. ૨૮૦)

\*

\*

સદ્ગુરુ સાથે એકતા એટલે સદ્ગુરુના જેવા થવાનું છે એમ નહિ; પરંતુ એનો અર્થ તો એટલો કે હૃદય હૃદયની સાથે ભળી, ભળી, ગળી ગયું હોય અને દિલ-દિલનો જ્ઞાનભક્તિપૂર્વકનો તાદીત્યભાવ પૂરેપૂરો પ્રગટી જાય, અને એકના દિલમાંની બીજા પરત્વેની ભાવના બીજાના દિલને પણ ભળી શકે એવી દિલની તેવા પ્રકારની એકતા; અને તે થવાને આપણે મથવાનું છે. બાકી આપણે એકબીજાના જેવાં થવાનું નથી. આપણે તો પ્રભુના જેવા થવાનું છે. પ્રભુની જે સગુણ ભાવના છે, તેની ધારણા અનુસાર આપણા જીવનનો વિકાસ કરવાનો છે.

(‘જીવનસંશોધન’, આ.ર, પૃ. ૨૮૫)

\*

\*

કર્મ યોગ્ય પ્રકારે થયાં કરે અને તેમાં વ્યવસ્થિતી પ્રગટે તેના પર ઝોક ને મહત્વ ન દેતાં કર્મ કરતાં કરતાં મન-હૃદયમાંનો ભાવ આપણી સાધનાને અનુકૂળ અંતર્ગતપણે વહ્યાં કરે તેને મહત્વ દેવાનું છે. ભાવને મહત્વ આપતાં કર્મમાં યદ્વાતદ્વાપણું પ્રગટશે એ માન્યતા એ એક ભ્રમ છે. કર્મકોશલ્ય એકાગ્રતામાંથી પ્રગટે છે.

(‘જીવનસંશોધન’, આ.ર, પૃ. ૨૮૬)

\*

\*

ભાવ કેળવાઈને એકાગ્ર ને કેંદ્રિત થતો જાય છે. તેનું પ્રત્યક્ષ લક્ષણ એ કે વૃત્તિઓ શમતી અને ઠરતી હોય છે તે છે.

જેમ કોઈ નિપુણ વગાડનારને કે પ્રવીણ ગાનારને જરાક

પણ સૂર બેસૂરો થતાં સજાળી ખબર પડી જાય છે, તેમ આપણને ક્યાંક ભાવની ધૂનથી જરાક પણ ભિન્ન થવાતાં એકદમ આંચકો લાગી જવો જોઈશે. એ રીતનો અનુભવ જો થાય તો આપણે ભાવની ધૂનમાં રહ્યા હોવાનું પ્રમાણવું.

(‘જીવનસંશોધન’, આ.ર, પૃ. ૨૮૮)

\*

કોઈ પણ જાતની અન્યથાવૃત્તિ કોઈના વિષે આવવા દેવી નહિ અને કરવી પણ નહિ. કારણ કે એમાં તો પોતાનું અહિત છે. ધારો કે આપણને તેમ થવાનું સાચું યોગ્ય કારણ મળ્યું હોય તો પણ તેમ થવાથી તે અન્યથાવૃત્તિના તેવા સંસ્કાર આપણામાં જ પડવાના છે; એટલે આપણે પોતે થઈને આપણું જ અહિત કરી રહેલા છીએ, એવું સાધકને લાગી જવું જોઈશે. સાચી રીતે તો સાધનાપથે સર્વ પરત્વે કેમ કરીને કેવળ સદ્ભાવ કેળવાયા કરે તે તરફ લક્ષ રાખવું ઘટે છે. યથાર્થપણે થતી જતી સાધનાના ભાવમાંથી તો તેવો સદ્ભાવ પ્રગટતો રહે છે.

(‘જીવનસંશોધન’, આ.ર, પૃ. ૩૦૦)

\*

જે ભાવ દફાવવાનો આપણે નિશ્ચય કર્યો હોય તે નિર્જયને મદદ કરે એવું જે જે વિચારવાનું બને એ તો જાણો ઉત્તમ; પરંતુ જે આંદુંઅવળું પ્રગટે ત્યારે તેના પ્રવાહમાં તણાઈ ન જવું ઘટે, એટલી જાગૃતિ હોવી, રાખવી જોઈશે.

(‘જીવનસંશોધન’, આ.ર, પૃ. ૩૦૧)

\*

જેવું વાણીનું મૌન તેવું જ પ્રત્યેક ઈન્દ્રિયનું મૌન. આ પ્રકારના મૌનનો અભ્યાસ કર્યા કરવાનો રહે છે.

(‘જીવનસંશોધન’, આ.ર, પૃ. ૩૦૪)

\*

એકાગ્રતાનો પણ એક જાતનો આનંદ હોય છે. કંઈ પણ કશમાં પ્રગટેલી એકાગ્રતામાંથી ભાવ ને આનંદ જન્મે છે. જેમ જેમ એકાગ્રતા કેળવાતી અને વધતી જાય, તેમ તેમ ભાવ વધારે ને વધારે ખીલતો જાય છે. ('જીવનસંશોધન', આ.ર, પૃ. ૩૦૪)

\* \* \*

કરુણાથી બીજાંને માટે પ્રેરાઈ જવાનું બનતું હોય તો આપણી જાત માટે જ પ્રથમ કરુણા કેમ નહિ? આપણે આપણા પોતા માટે તો હૃદયની યોગ્ય પ્રાર્થના કરવાને પૂરા સમર્થ થયા નથી, ત્યાં બીજાંને માટે તેમ કરવાની વૃત્તિ કરવી એ આડફંટે જવા બરાબર છે. ('જીવનસંશોધન', આ.ર, પૃ. ૩૧૧)

\* \* \*

જીવદશાનાં પ્રાકૃતિક વલણોમાંથી મુક્તિ કંઈ બુદ્ધિની કોરી સમજણથી, વિચારના બળથી કે નીતિ ને સદાચારના ધોરણ પ્રમાણે વર્તવાથી મેળવી શકાતી નથી.

('જીવનસંશોધન', આ.ર, પૃ. ૩૨૨)

\* \* \*

જે કંઈ આવે તેને તેના બહિરૂ સ્વરૂપથી નહિ પણ તેના હાઈના ભાવથી સ્વીકાર કરીએ તો સરળતા પ્રગટે છે.

('જીવનસંશોધન', આ.૧, પૃ. ૩૨૪)

\* \* \*

સુજ્ઞ જનો માનવીની કિંમત તેના આંતરસત્ત્વ પરથી આંકે છે, નહિ કે બહારના પોષાક કે દેખાવ પરથી; તેમ ભાષાના પ્રાસંગિક અને પ્રાસાદિક અલંકારો કરતાં એના સમગ્ર રૂપરંગ પરથી અને સમગ્ર રૂપરંગ કરતાં પણ એમાંથી નીકળતા ભાવરહસ્ય પરથી કોઈ પણ સાહિત્યિક રચનાનું મૂલ્યાંકન અને કદર કરવાં વધુ ઈષ્ટ છે. ('જીવનસંશોધન', આ.ર, પૃ. ૩૨૫)

\* \* \*

ગીતાજીમાં જે “ભજતે” શબ્દપ્રયોગ આવે છે, તેનો ઉપર-  
છલ્લો વાણીમાં જ ભજન કરે છે એવો અર્થ કે ભાવ હોતો નથી,  
પણ આપણી આખી ચેતના પળેપળ ગ્રભુના ભક્તિભાવની સતત  
ને સંંગ ધારાથી ઊભરાયા કરે તે ‘ભજતે’નો અર્થ છે. વળી  
મનસા, વાચા, કર્મણા ભજવા ઉપરાંત અથવા તેના વધુ સ્પષ્ટ  
અર્થ તરીકે “સમ્યગ્ વ્યવસ્થિત હિ સઃ” કહ્યું છે. એટલે કે એના  
જીવનના પ્રત્યેક આચારવિચાર યોગયોગ્ય ચેતનાત્મક પ્રકારના  
પ્રગટેલા હોવા જોઈશે; તેનાં અંદરનાં બધાં મનાદિ કરણોમાં સુભેણ,  
સુસંવાદ હોવો જોઈશે, એટલે કે તેઓ સુવ્યવસ્થિત હોવાં જોઈશે.  
તેમ જ તેના જીવનમાં અને જીવનનાં સર્વ ક્ષેત્ર અને સર્વ પાસાંમાં  
તેનામાં ભાવપૂર્ણ યોગયોગ્ય વ્યવસ્થિત પ્રગટેલી હશે, ને તેથી  
તેનો જીવનવ્યવસાય પણ એ પ્રકારનો હશે; એવો ભક્ત ક્ષિપ્રમ्”  
જલદી ધર્માત્મા થાય છે, ચિર શાંતિને પામે છે, અખંડ ધારાવત્ત  
હૃદયનો આહૂલાદ પામે છે. એવા ભક્તને માટે ભગવાન વચન  
આપે છે કે તેની ભક્તિ મિથ્યા થતી નથી, તે નાશ પામતો નથી.

(‘જીવનસંશોધન’, આ.૧, પૃ. ૩૨૬)

\*

\*

‘નિર્બળ કે બળ રામ’નો અર્થ તો એ છે કે જ્યારે  
જીવદશામાંથી સંપૂર્ણ અહમસ્નો લય થઈ જાય અને છેક છેવટની  
ઘડી સુધીનો સકળ પુરુષાર્થ કરી કરીને ‘હારે કો હરિનામ’  
એવી સ્થિતિ પ્રાપ્ત થાય, ત્યારે ‘નિર્બળ કે બળ રામ’ એમ  
આપણે સાચા ભાવથી પોકારી શકીએ.

(‘જીવનસંશોધન’, આ.૧, પૃ. ૩૨૩)

\*

\*

ઘણાખરા ભાષ્યકારો અમુક સાંગ્રદાયિક મતને પોષણ  
આપનારા કે પોતાની રુચિ ને કક્ષા અનુસાર કે પોતે માનેલા

કાળધર્મ અનુસાર પોતાના Mission—પ્રભુપ્રેરિત તે સ્થળકાળ માટેના તેમના કર્તવ્ય અનુસાર મૂળ શ્લોકનો અર્થ કરતા હોય છે ને તે તેમને માટે યોગ્ય પણ છે. પણ આપણે તો મૂળ શ્લોકનો જ આપણા પોતાના જીવનયોગને અનુકૂળ જે રીતે અર્થ સૂઝે તેમ તેમાંથી તેનું હાઈ પકડવું. ('જીવનસંશોધન', આ.ર, પૃ. ૩૨૮)

\*

'શાન'નો ખરો અર્થ સમજણ નહિ, પણ તેવું જીવન.

(‘જીવનસંશોધન’, આ.ર, પૃ. ૩૩૧)

\*

માનવીના સંજોગોથી, બુદ્ધિના પ્રભાવથી, મનના ફંકાથી, વિદ્વતાના ઘમંડથી, જીવનવ્યવહારમાં મેળવેલા કે મળેલા લાભો તથા જ્ય ને જશથી, આગળપાછળના લોકોની બોલબાલાથી, વાતાવરણથી વગેરે એવાં એવાં અનેક કારણોથી જીવમાં એક પ્રકારની અહંપ્રેરિત Personalityનું—વિશિષ્ટતાયુક્ત વ્યક્તિત્વનું—થર જામતું હોય છે ને એ જીવનમાં વિકાસપંથે ભારે અંતરાયરૂપ બની રહેછે. અહંપ્રેરિત વિશિષ્ટ વ્યક્તિત્વના કે એવી બીજી વૃત્તિના કોઈમાં એટલે કે અભિમન્યુના ચકાવામાં આપણે પેઢા એટલે પછી તો ભુલભુલામણીમાં ભૂલા પડીને અટવાયા કરવાના. આવા ચકાવામાંથી બહાર ખેંચી કાઢનાર જો કોઈ હોય તો તે જીવનવિકાસની સાધના છે. એ સાધનાના જોરે આપણાથી સવેળા જાગ્રત થઈ જવાય છે ને આપણી થતી ચૂક દીવા જેવી સ્પષ્ટ દેખાઈને એવી ભુલભુલામણીમાંથી પ્રભુકૂપાથી બહાર નીકળી શકાય છે.

(‘જીવનસંશોધન’, આ.ર, પૃ. ૩૩૬-૩૮)

\*

ચર્ચાનું મૂળ ઉત્પાદક કારણ અહંકાર છે. ચર્ચામાં સામા પરત્વે એક પ્રકારની સૂક્ષ્મ અનુદારતા પ્રગટેલી રહે છે. સામાને

ઓળખી શકવાની શક્તિ હોયા વિના તેને વિશે જાણ્યે-અજાણ્યે આપણને એમ માનવાનું મન થાય છે કે આપણે તેનાથી બુદ્ધિમાં ને સમજજ્ઞમાં ને તેની યોગ્યતામાં ચઢિયાતા છીએ. વળી સૂક્ષ્મપણે એમાં દંભ પણ સેવાઈ જતો હોય છે, કારણ કે ચર્ચાના રસમાં તણાઈને સામી વ્યક્તિના કથનમાં જે કંઈ રહેલા સત્યને સ્વીકારવાનું અશક્ય બની જાય છે અને કોઈક વાર તે ઉડિ ઉડિ સમજાતું હોય તોપણ તેના પ્રતિ દુર્લક્ષ કરીને આપણો કક્કો ખરો કરવા મથીએ છીએ. ચર્ચામાં બુદ્ધિનો દુરુપયોગ પણ થયા કરે છે.

(‘જીવનસંશોધન’, આ.ર, પૃ. ૩૪૦)

\* \* \*

‘અમુક કાર્યની સિદ્ધિ તેનો કાળ પાકે ત્યારે થાય’ એમ જે કહેવામાં આવે છે તે ‘કાળ પાકવાના’ નિર્માણની હકીકત જેટલી સત્ય છે તેટલી જ પાછી કાળ પાકવાની મુદ્દતમાં ઓછાવતાપણું આપણી સાધનામય જીવનધ્યેયની તમન્નાની ઉત્કટતા, જીવનવિકાસની પ્રેમભક્તિ આદિમાંથી ફલિત થતા આંતરિક ઉત્કટ પ્રયાસથી થઈ શકે છે, એ હકીકત પણ એટલી જ સાચી છે.

(‘જીવનસંશોધન’, આ.ર, પૃ. ૩૪૫)

\* \* \*

સાધના એટલે જ કાળને જલદી નેઢતાં યોગ્યપણે પકાવનારી જડીબુદ્ધી. પ્રતિકૂળ સંજોગોને અનુકૂળ કરવાની કળા એટલે સાધના એમ પણ કહી શકાય. પ્રકૃતિ દ્વારા જીવની થતી ઉત્કાંતિમાં શક્તિ ને પ્રાણસંચાર પ્રગટાવી તેને વેગવાળી અને ભાવાત્મક બનાવનાર જે ચેતનાની પ્રક્રિયા તે સાધના એમ પણ કહી શકાય.

(‘જીવનસંશોધન’, આ.ર, પૃ. ૩૪૫-૪૬)

\* \* \*

જ્યાં જ્યાં કંઈક સાત્ત્વિક અસામાન્યપણું નિરખાય કે લાગે ત્યાં ત્યાંથી ભગવાનની ભાવનાના પ્રેમભક્તિપૂર્વકના સ્વીકારનો

અનુભવ કર્યા કરશો.      ('જીવનસંશોધન', આ.૨, પૃ. ૩૬૮)

\*

\*

સૂચિના જીવનવિકાસના ઈતિહાસમાં મૂળ તત્ત્વની અંતર્ગત રહેલી ચેતના—એ અંતરમાં રહીને કોઈ ને કોઈ રીતે વ્યક્ત થયા કરી નવાં નવાં રૂપાંતરો પામે છે.

(‘જીવનસંગ્રામ’, આ.૫, પૃ. ૧, ૨)

\*

\*

યુદ્ધ એટલે માત્ર સંહાર એ સમજણ ઘણી અધૂરી છે. યુદ્ધથી ખંડન અને મંડન બન્ને થાય છે; યુદ્ધ એટલે ખંડન અને મંડન બન્ને.

(‘જીવનસંગ્રામ’, આ.૫, પૃ. ૨, ૩)

\*

\*

સતત એકધારી રહ્યાં કરેલી પોતાની સુખાકારી ને સુખનું ભાન માનવીના મનમાં જાગતું નથી; જ્યારે સુખાકારીના પ્રમાણમાં ખૂબ જ અલ્ય સમયના રોગ ને દુઃખનું ભાન તીવ્રતરપણે તેને થાય છે.

(‘જીવનસંગ્રામ’, આ.૫, પૃ. ૬)

\*

\*

વ્યક્તિને, જાતિને કે સમાજને સંઘબદ્ધ થયા વિના ચાલતું હોતું નથી. જે કોઈની શક્તિ એના સર્વશ્રેષ્ઠ યોગ્યપણ્યમાં સંઘબદ્ધ રહ્યાં કરે છે, તે જ જીવવાને લાયક રહે છે.

(‘જીવનસંગ્રામ’, આ.૫, પૃ. ૮)

\*

\*

બુદ્ધિના ક્ષેત્રે, મનના ક્ષેત્રે, પ્રાણના ક્ષેત્રે, શારીરિક ક્ષેત્રે એમ માનવીના આધારના પ્રત્યેક કરણની પ્રવૃત્તિમાં યુદ્ધ ખેલાયાં જતું હોય છે.

(‘જીવનસંગ્રામ’, આ.૫, પૃ. ૧૨)

\*

\*

જ્યાં દ્વંદ્વ છે ત્યાં યુદ્ધ છે. અનેક પ્રકારનાં દ્વંદ્વોનાં યુદ્ધ દ્વારા

સૂચિમાં ભગવાનનો દિવ્ય સૂક્ષ્મ હેતુ સધાયા જતો હોય છે.

(‘જીવનસંગ્રામ’, આ.પ, પૃ. ૧૬)

\*

\*

જે નિર્જયની પાછળ વિષાદ રહે છે, દુઃખ રહે છે, સંતાપ જગે છે, કલેશ ઉપજે, તે નિર્જય યોગ્ય રીતે હૃદયથી સ્વીકાર પામેલો નથી એમ જાણવું. (‘જીવનસંગ્રામ’, આ.પ, પૃ. ૨૭)

\*

\*

માનવી જ્યાં સુધી બધી બાબતમાં પોતાને જ સર્વશ્રેષ્ઠ સમજતો હોય છે, ત્યાં સુધી ભગવાનનો ભાવ કદી પણ તેના આધારમાં જાગી શકવાનો જ નથી.

(‘જીવનસંગ્રામ’, આ.પ, પૃ. ૪૬)

\*

\*

કર્મનું ક્ષેત્ર ઊંચું હોય કે નીચું, તેના પર કર્મના પરિણામનો આધાર નથી; પરંતુ કર્મની પાછળ માનવી જીવતો-જાગતો કેવો હેતુ ને ભાવ રાખે છે તેના પર કર્મના ઉત્તમપણાનો કે કનિષ્ઠપણાનો આધાર છે. (‘જીવનસંગ્રામ’, આ.પ, પૃ. ૫૬)

\*

\*

જ્યાં વિસંવાદ છે ત્યાં અશાંતિ; જ્યાં અશાંતિ ત્યાં વિકાસની રૂંધામણ.

(‘જીવનસંગ્રામ’, આ.પ, પૃ. ૫૭)

\*

\*

કર્મના ક્ષેત્રમાં બ્રહ્માનું સર્જન પણ હોય, વિષ્ણુનું રક્ષણ અને પોષણ પણ હોય અને મહાદેવનું વિનાશક તાંડવ પણ હોય. (‘જીવનસંગ્રામ’, આ.પ, પૃ. ૫૮-૫૯)

\*

\*

સમર્પણશાળી જીવનથી નવી જ્યોત પેદા થાય છે.

જગતમાં બધું \* અભેદ રૂપે \* તત્ત્વરૂપ \* છે, એટલે જે કંઈ

આપણને બન્યાં કરે તે આપણે લીધે જ છે. એનું મૂળ કારણ  
આપણાંમાંનું છે. (‘જીવનસંદેશ’, આ.૪, પૃ. ૮)

\*

\*

કુઈ પણ કશું (આણગમતું યા દુઃખદાયક પણ) ઉદ્ભવતાં કે  
થતાં એનું મૂળ પોતાનામાં જ જોવા મથવું ને જોવાનું કરવું એનું  
નામ અભેદ ઉપાસના. એમ કરતાં કરતાં જગતનું મૂળ આપણે જ  
છીએ એમ અનુભવ થયા વિના રહી શકતો નથી.

(‘જીવનસંદેશ’, આ.૪, પૃ. ૧૧)

\*

\*

સાધના એટલે ભક્તિ, જ્ઞાન, ધ્યાન અને કર્મમાર્ગનો  
સમન્વય. ભક્તિ એ ભાવનાનો ધોધ, જ્ઞાન એ હેતુ, ધ્યાન એટલે  
એકાગ્રતા અને કેન્દ્રિતતા, કર્મ એટલે એ બધાંને સુયોગ્યપણે,  
સુભેળ રીતે વહેવા માટેનો પટ-channel.

(‘જીવનસંદેશ’, આ.૪, પૃ. ૧૦)

\*

\*

ભાવનું ઉદ્ભવસ્થાન હૃદય છે. જો આપણે કોઈ પણ  
નિરાલભ ભૂમિકાનો અનુભવ કરવો હોય તો કોઈ પણ  
કલ્યનાગમ્ય સાકારમાં પરોવાવાનું ન હોય, જેને તેમ થતું હોય  
તે એને માટે શ્રેયસ્કર હોય. એવાને મતિભ્રમ પણ આપણાથી ન  
જ કરાવાય. આપણે માટે એ બરાબર નથી.

(‘જીવનસંદેશ’, આ.૪, પૃ. ૧૩)

\*

\*

પ્રાર્થના પણ એક પ્રકારનું ધ્યાન જ છે. પ્રાર્થના સાકાર છે.  
ધ્યાન નિરાકાર છે. ધ્યાનમાં આપણે કશો આધાર લેતા નથી;  
ભાવની વૃદ્ધિ અર્થે પ્રાર્થનાનો સાધન તરીકે આધાર લઈએ છીએ  
પણ બન્નેનું પરિણામ એકસરખું છે. પ્રાર્થના વેળા આપણે

ધ્યાનસ્� રહ્યાં કરતાં હોવાં જોઈએ. ભાવનાનો ભાવમાં લય થઈ જય એ પ્રાર્થનાનું રહેસ્ય છે. ('જીવનસંદેશ', આ.૪, પૃ. ૧૩)

\*

ગુરુ એટલે સાધકને એના જીવનવિકાસનાં પગથિયાં ઉત્તરોત્તર ચઢાવતી જનારી એક નિસરણી; તેની સમજને ઉચ્ચતર અને ઉચ્ચતમ ભૂમિકાઓ સાથે જોડનારી સાંકળ.

('જીવનસંદેશ', આ.૪, પૃ. ૧૬)

\*

સૂક્ષ્મભાવમાં કહીએ તો ગુરુની સમીપતા કે દૂરપણું કશું છે જ નહિ; કારણ કે ગુરુ એ તો ભાવ રૂપે છે.

('જીવનસંદેશ', આ.૪, પૃ. ૧૭)

\*

પોતાની સાથે લગ્નભાવનાથી જોડાયેલા જીવની જે અવગાણના કરે છે, તે સમાજની પણ અવગાણના સાથે સાથે કરી રહેલો છે. એવા જીવનાં સમાજને ચરણે થતાં લાખો રૂપિયાનાં દાન એવા જીવનવિકાસ કાજે વૃથા છે. એવા દાનથી સમાજની ભાવના કદી પણ વિકસી શકવાની નથી, ભલે કદાચ સ્થૂળ દાસ્તિએ સમાજનું કંઈક ચાલતું રહેવાનું હોય તો રહે.

('જીવનસંદેશ', આ.૪, પૃ. ૫૨)

\*

Trifles-કૃલલકપણું પણ નકામું નથી. એમાં પણ શ્રીભગવાનની જ ચૈતનાશક્તિ રમી રહેલી છે. એ પણ એનું જ સ્વરૂપ છે પણ એમાં પણ આપણો ભાવ તો એ ચૈતન્યભાવનો જ રમ્યા કરે તો.

('જીવનસંદેશ', આ.૪, પૃ. ૫૮)

\*

જગતમાં કશું નકામું નથી. જેને માનવી તદ્દન ખરાબ ગણે

છે તે પણ નકામું નથી. એ ખરાબ દેખાય છે કે ગણાય છે એનું કારણ આપણે એને એ રીતે ગણતા, દેખતા, સમજતા, માનતા, વાપરતા આવ્યા કર્યા છીએ તે છે; બાકી ખરાબ કશું જ નથી. જે તે કંઈ બધું યથાસ્થાને યોગ્ય જ છે ને ભગવાનમય છે.

બેતરમાંનું ખાતર ગમે તેટલું દુર્ગંધ ફેલાવતું હોય તો પણ એને સૂચિમાં સ્થાન છે જ અને ત્યાં એનો ઉપયોગ પણ છે.

(‘જીવનસંદેશ’, આ.૪, પૃ. ૫૮, ૧૩૪)

\*

\*

આત્મવિશ્વાસ એ મિથ્યાભિમાનની લાગણી નથી, પરંતુ એ તો ધ્યેય પ્રતિ પહોંચાડનારી આવશ્યક ભાવના છે.

(‘જીવનસંદેશ’, આ.૪, પૃ. ૧૦૭)

\*

\*

પ્રેમસ્વરૂપ થવા માટે જો કશાની પણ અનિવાર્ય આવશ્યકતા હોય તો તે હાર્દિક માનસિક ઉદારતાની છે.

\*

\*

હાર્દિક ઉદારતા એટલે જીવમાત્ર પરત્વે મૈત્રીભાવ.

(‘જીવનસંદેશ’, આ.૪, પૃ. ૧૧૮)

\*

\*

કેવળ બુદ્ધિથી કે કેવળ લાગણીથી કે બન્નેમાંથી એકના વધુ પડતા ઝોકથી જે જીવન જિવાય છે તે વિવેકશૂન્યતાભર્યું જીવન હોઈ સાધક માટે બાધક છે.

(‘જીવનસંદેશ’, આ.૭, પૃ. ૧૩૧)

\*

\*

તટસ્થતા અને અનાસક્તિ લગભગ પર્યાયવાચક (સમાન અર્થવાહી) શબ્દો છે; છતાં તેમાં ભેદ છે. તટસ્થતાને એક રીતે અનાસક્તિનું પરિણામ પણ ગણી શકાય.

(‘જીવનસંદેશ’, આ.૭, પૃ. ૧૩૧)

\*

\*

બુદ્ધિ લાગણી કરતાંથે વધારે આગઢી અને દીર્ઘકાળ પર્યત  
પોતાનું જીવન ટકાવવાની શક્તિવાળી છે.

(‘જીવનસંદેશ’, આ.૭, પૃ. ૧૩૪)

\*

\*

વિવેક એટલે સમ્યગ્ દર્શન કરાવનારી દષ્ટિ, યોગ્ય ભાવ  
રખાવનાર હૃદય, યોગ્ય કર્મ સુઝાડનાર સદ્ગુદ્ધિ.

(‘જીવનસંદેશ’, આ.૭, પૃ. ૧૩૫)

\*

\*

જીવનવિકાસનો સાચો સાધક પ્રજાને-પોતાના દેશને  
પ્રત્યક્ષપણે ઉઠાવવાના (ઉંચે આણવાના) સીધા કાર્યમાં ભલે ન  
હોય, પણ તે પોતે હૃદયથી એવી ભાવનાશીલ રીતે ઉઠ્યા કરતો  
હશે કે એવા ઉઠ્યા કરવામાં જે સમસ્ત પ્રજા ઉઠતી હોય; અને  
એ કંઈ એક જ પ્રજાની માત્ર સેવા નથી, પણ સર્વ પ્રજાની અને  
અનાથીયે વિશેષ સમસ્ત સમાણિની તે સેવા છે.

(‘જીવનસંદેશ’, આ.૭, પૃ. ૧૪૪)

\*

\*

દુનિયામાં ખેલાતાં યુદ્ધોમાં પરોવાયેલાંની તો જગતને જ્ઞાન  
પણ થાય છે; એનાં યશોગાન ગવાતાં હોય છે પણ આ આધ્યાત્મિક  
યુદ્ધક્ષેત્રે યુદ્ધ ખેલનાર સાધકને તો કોઈ જોઈ કે જ્ઞાની નહિ શકે,  
કારણ કે જગતને જગતમાં તેવી દષ્ટિ કે વૃત્તિ તે પરત્વેની બહુ જૂજ  
હોય છે એટલે એની કદર કે એની વાહવાહ બોલનારા ખાસ કોઈ  
નહિ હોય. એણે પોતાનામાંથી જ સંતોષ મેળવી લેવાનો રહેશે.

(‘જીવનસંદેશ’, આ.૭, પૃ. ૧૪૫-૪૬)

\*

\*

પ્રેમ એટલે એકબીજાને જોડનારી સૂક્ષ્મ સાંકળ.

પ્રેમ એ જોડનાર એટલે બાંધનાર સાંકળ પણ છે અને મુક્તિ  
અપાવનાર સાધન પણ છે.

સંપૂર્ણ બંધન તથા સંપૂર્ણ મુક્તિ એટલે પ્રેમ. સાચો પ્રેમ એવી  
સાંકળ છે કે જે સાંકળ જ નથી, પણ મુક્તિનું સ્વરૂપ પણ છે.

(‘જીવનસંદેશ’, આ.૪, પૃ. ૧૫૯, ૧૬૨)

\*

\*

પરમ ચૈતન્યતત્ત્વ સાથે સંકળાયેલો દેહધારી એટલે  
જીવનમુક્ત. (‘જીવનસંદેશ’, આ.૪, પૃ. ૧૬૨)

\*

\*

પ્રેમ દ્વૈત વિના અશક્ય છે, પણ તે જ દ્વૈત તેના જીવનમુક્ત  
શુદ્ધતમ રૂપમાં અદ્વૈત છે.

પ્રેમ એટલે જ્ઞાન.

પ્રભુનું જ્ઞાન મેળવવા માટે પ્રભુ પ્રત્યે પ્રેમ અનિવાર્ય સાધન  
છે અને પૂર્ણ પ્રેમ અને પૂર્ણ જ્ઞાન એ તો પર્યાયવાચક શરૂઆદ થઈ  
રહે છે. (‘જીવનસંદેશ’, આ.૪, પૃ. ૧૬૯)

\*

\*

ધિક્કારવૃત્તિ એ પ્રેમની વિકૃત દશા છે, યાને ઊલટું પાસું છે.

(‘જીવનસંદેશ’, આ.૪, પૃ. ૧૭૨)

\*

\*

સાચા સ્વાનુભવમાં જેમ સર્વાનુભવ આવી જ જાય છે તેમ  
સ્વકલ્યાણની પ્રવૃત્તિમાં સર્વકલ્યાણની પ્રવૃત્તિ આપોઆપ થયાં  
કરે છે.

સમદાચિ એટલે નિર્વિન્દ સમન્વયાત્મક દાચિ.

(‘જીવનસંદેશ’, આ.૪, પૃ. ૧૬૮-૭૧)

\*

\*

પોતાના દેશ કે સમાજ માટે પ્રાણાર્પણ કરવા તૈયાર થનારામાં

ઉચ્ચ કોટિનો પ્રેમ નથી એમ તો કેમ જ કહેવાય ? છતાં એમાં  
પણ ઘણીવાર વિસ્તૃત અહંકાર અને પાર્થિવ માપથી જ અન્ય  
જનને સમજવાની વૃત્તિ અને દાણિ રહેલાં હોય છે અને તેથી ત્યાં  
રાગદ્વેષની માત્રા પણ ઘણી હોય છે; શુદ્ધ પ્રેમ તો આત્મસ્વરૂપ  
—પ્રભુસ્વરૂપ છે; એમાં ક્યાંય પક્ષાપક્ષી ન હોય.

(‘જીવનસંદેશ’, આ.૪, પૃ. ૧૬૮)

\* \* \*

પ્રેમ એ આપણા દિલની ભાવનાનું ગતિવાહક યંત્ર છે.

(‘જીવનસંદેશ’, આ.૪, પૃ. ૧૮૧)

\* \* \*

આપણા જીવનને કર્મ-પ્રારબ્ધનો પાશ રહે છે ખરો પણ  
જીવનમાં ભગવાનની શક્તિ પણ સાથે સાથે પડેલી છે; રહેલી  
છે, તેથી તે નવું રચવાને સ્વતંત્ર છે.

આજ જેમ ભૂતકાળનું પરિણામ છે તેમ ભાવિનું સર્જણ  
સર્જક પણ તે થઈ શકે છે      (‘જીવનસંદેશ’, આ.૪, પૃ. ૧૮૧)

\* \* \*

સ્વભાવના હુમલા ગમે તેટલા જોરદાર થાય તો પણ,  
ત્યારે પણ, કાળજી રાખીને, જાગૃતિથી તેનાથી દોરવાઈ જઈને  
બીજાં પ્રત્યે અયોગ્ય વર્તન ન થાય એવું જોવા ને વર્તવા મથનાર  
એનું નામ સાધક.      (‘જીવનસંદેશ’, આ.૪, પૃ. ૧૮૬)

\* \* \*

રામ-રાવણ યુદ્ધમાં રામ, લક્ષ્મણ આદિને કદાચ સૌથી વધુ  
ત્રાસ ઈદ્રજિતનો હતો; કેમ કે તે પોતાનું સાચું સ્વરૂપ માયાવી  
સ્વરૂપમાં ઢાંકી દઈને, વાદળાં પાછળ છુપાઈને, ન દેખાય એવાં  
સ્થળેથી પોતાનાં બાણ ફેંકતો હતો. તેવી જ રીતે પ્રકૃતિના હુમલા  
સાધકના જીવનમાં વધુ ને વધુ ગુપ્ત વેશના થતા જવાના. એવા

માયાવી સ્વરૂપથી રક્ષણ કરવાનું શાખ સાધક માટે તટસ્થતા અને સમતાયુક્ત આંતરનિરીક્ષણ છે.

(‘જીવનસંદેશ’, આ.૨, પૃ. ૨૧૩)

\* \* \*

સાધક એટલે બધી વાતે બાધો નહિ, કિંતુ સાધક એટલે બધી રીતે દક્ષ, ચકોર અને હોશિયાર.

(‘જીવનસંદેશ’, આ.૪, પૃ. ૨૦૨)

\* \* \*

સંતસમાગમથી તથા તેમની સમીપ વસવાટના વાતાવરણથી આપણાં કરણો ઉપર સારી અસર થાય છે તે ખરું છે;—પણ જો એ સંત પ્રત્યે આપણાને સદ્ગ્રાવ, માન, આદર, વિશ્વાસ, શ્રદ્ધા યા પ્રેમભક્તિ આપણા હૃદયમાં પ્રગટ્યાં હશે તો જ.

(‘જીવનસંદેશ’, આ.૪, પૃ. ૨૧૭)

\* \* \*

આસક્તિ બિલકુલ ન હોય તો અહમ્મનો સંપૂર્ણ લય થઈ ગયો હોય; કેમ કે અહમ્માંથી આસક્તિ, રાગ, મૌહ, લોભ, કોધ આદિ જન્મે છે. (‘જીવનસંદેશ’, આ.૪, પૃ. ૨૨૦)

\* \* \*

સાધકના જીવનમાં દુઃખ એ ઘડતર-ચણતર છે, તે જરૂરી તાલીમ દેનારું છે, ને આ દુઃખના પ્રકારમાં આર્થિક દુઃખનો પણ સમાવેશ થાય છે.

\* \* \*

શરીર તો રગશિયું ગાડું છે. એનામાં જે પરોવાઈ રહે છે તે શરીરને જ મેળવે છે, શરીર જેવો જડ રહે છે ને થાય છે; પણ શરીરને સાધન માની એને એ રીતે જે રક્ષે છે, તેની સંભાળ લે છે, એની કુટેવોને સુધારી લે છે ને એનું પણ દિવ્ય રૂપાંતર કરવાનું છે એવો સજ્જવ ખ્યાલ-ભાન રાખે છે, તેવા સાધકને તે

મદ્દરૂપ નીવડવાનું છે.

એક વેશ્યા, જુગારી, કસાઈ કે એક રાજકીય રમતનો ખેલાડી—આવા લોક પણ જો તેમની બુદ્ધિ ભગવાનને શરણે થઈ ગઈ હોય તો તેમના તેમના ક્ષેત્રમાંયે ભગવત્યચિંતન જરૂર હૃદયથી કરી શકે છે, તેનો લાભ મેળવી શકે છે, ને તરી જઈ શકે છે.

(‘જીવનપાથેય’, આ.ડ, પૃ. ૧૨૭)

\*

\*

જે જીવ સાધનામાં ઓતપ્રોત થતો જાય છે, તેનામાં તો જ્યાં જ્યાં જગતમાં સૌંદર્યની ભાવના કોઈ પણ કળા રૂપે વ્યક્ત થયેલી હોય, તેના પ્રતિ તેના હૃદયની કદરવૃત્તિ ખીલતી જતી હોય છે. રમ્ય સૂર્યાદ્ય કે સૂર્યસ્તને સમયે, આકાશમાં પૂનમની શીતળ ચાંદની ખીલી હોય ત્યારે, જંગલની વનસ્પતિનું કુદરતી સૌંદર્ય ભરપૂર ભર્યું હોય ત્યારે, સાગરના ઘૂઘવતાં મોજાંઓમાં, માનવીના હૃદયના સદ્ભાવમાં, નૃત્ય-સંગીત-ચિત્ર-શિલ્પકળા આદિ લલિત કળાના તેજસ્વિત દર્શનમાં, કલ્પનાના ઉદ્ઘયનશીલ પ્રભાવમાં યા કોઈ આકાશી ઊર્મિના સાહિત્યસર્જનમાં—આવા બધામાં ભગવાનની ચેતનાશક્તિનો દિવ્ય સ્પર્શ થયેલો છે એમ હૃદયની ધારણા ધરાવાઈ ને ત્યાં ત્યાં એવા સાધકનું પ્રાર્થનાભક્તિભાવે શિર નમે છે.

(‘જીવનપાથેય’, આ.ડ, પૃ. ૧૮૩)

\*

\*

જે મંથનમાંથી, વલોપાતમાંથી, રુદ્ધનમાંથી કશું શુભ જન્મતું નથી તે મંથન, વલોપાત ને રુદ્ધન વર્થ છે. માનવી રિસાય, અકળાય, રુંધાય, આઘાત લાગે ત્યારે રડવાનું બને; પરંતુ એના પ્રત્યાઘાતોએ કરીને એના પરિણામજનક અનુભવને હૃદયમાં સ્વીકારવાને તૈયારીવાણું જો માનવી બની શકે નહિ, તો એવું

દુઃખ, રુદ્ધન આદિ એ તો એની મૂઢતાને કારણે છે. મૂઢતા ન હેઠળ ત્યાં સુધી કશી યોગ્ય સમજણ પ્રવેશી ન શકે. મૂઢતા એ એક જ્ઞાનની આડેનો મોટો પડદો છે.

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૧૬૨)

\* \* \*

જીવનવિકાસના માર્ગ સાચી રીતે, સાચી ભાવનાથી, મર્દનિગીથી, હૃદયના ઉમળકાથી, પ્રેમભક્તિથી જે જીવ એક એક પછી એક ડગલું આગળ ને આગળ માંડતો રહે છે, તેનું તે કાર્ય સાચી ગુરુદક્ષિણા છે.

સાધનાના ક્ષેત્રમાં જે પડ્યા, તો તેમાં તો સંપૂર્ણપણે હોમાઈ જવાનું રહે છે. જુદી જુદી દિશામાં વહેંચાયેલા દિલને સંકેલીને, સંકોરીને ને જીવંત પ્રગટાવીને સતત યજ્ઞમાં હોમ્યાં કરવાનું રહે છે. એવો પળેપળનો જીવંત યજ્ઞ જીવનમાં પ્રગટ્યા વિના સાધનાનું કામ પાકવાનું નથી. જીવનમાં જીવનનો એવો સતત એકધારો ચાલતો યજ્ઞ એ જ સાચી ગુરુદક્ષિણા છે. એની કિંમત ગુરુચરણે લાખો રૂપિયાની ભેટ કરતાં ઘણી વધારે છે.

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૧૭૧, ૧૮૪)

\* \* \*

પ્રત્યેક જીવની જન્મોજન્મની સમગ્ર ને સળંગ સંસ્કારશક્તિ કેવા પ્રકારની છે અને મૃત્યુટાણે તે જીવની કેવી ગતિ રહે છે, તેના પર તુરત કે મોડો તે જીવનો જન્મ થવાનો આધાર રહે છે.

પુરુષશરીરી જીવ બીજા જન્મમાં સ્ત્રી પણ જન્મે અને સ્ત્રીશરીરી જીવ પુરુષ પણ જન્મે. પુરુષ હોય તે પુરુષ જ જન્મે ને સ્ત્રી હોય તે સ્ત્રી જ જન્મે એવો કશો અફર ને અટલ નિયમ નથી.

(‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૧૧૦-૧૧)

\* \* \*

મૌન એટલે માત્ર વાચાનું મૌન નહિ; એ તો એક એના

સ્થૂળ પાસાનો અર્થ. સાચું મૌન તો પાંચે હંડ્રિયોનું હોવું જોઈએ.  
બધી હંડ્રિયોને પોતપોતાના વિષયમાં રસ લેતી રોકી શકાય ત્યારે  
જ સાચું મૌન ગણાય. એવી દશા પ્રગટતાં સારાયે જીવનની  
દાખિલાં ને સૃષ્ટિમાં પલટો થાય છે.

(‘જીવનપ્રવેશ’, આ.ર, પૃ. ૨૫૮)

\*

\*

પ્રસંગ, બનાવ, સંજોગ, પરિસ્થિતિ વગેરે બધું ભલે જુદું  
જુદું લાગે, તેમ છતાં આ બધાંની આગળ, મધ્યમાં ને પાછળ  
એક સણંગતા ને સમગ્રતા, સતત રહ્યાં કરેલી જ હોય છે. એ  
સણંગતા ને સમગ્રતાનાં અનુભવ-દર્શન જેને થાય છે, તેવો આત્મા  
કદી પણ તે તે પ્રસંગ બનાવ, સંજોગ વગેરેને તેની તેની તેવી  
એકલી જ રીતે જોઈ શકતો નથી. તેથી પ્રસંગ, બનાવ વગેરેને  
જોવાની, સમજવાની તેની દાખિલાં કાંઈક પારલૌકિક, અલૌકિક  
પ્રકારની હોય છે. તેથી તે જોતો તો હોય છે, પણ તે આપણી પેઠે  
તો નહીં. એના હૃદયની સંવેધકતાની પારદર્શિતાને તો તે જ  
જાણી ને સમજી શકે. આ જ કારણથી પ્રસંગ, બનાવ, સંજોગ  
વગેરે પરત્વેની તેની સમજણને યોગ્ય સ્વીકારાત્મક ભાવથી જીવ  
પ્રેમભાવે ગ્રહણ કરી શકે છે, તેવો જીવ વધારે નિરાંતવાળો પણ  
બની શકે છે.

### રત્નકણ્ણિકા

(અનુષ્ટુપ)

કર્મથી કર્મનું થાય કર્મમાં સૌ સમર્પણ,  
સર્વ પ્રકારનું શ્રેષ્ઠ, એ કર્મ પ્રભુ-તર્પણ.

\*

\*

આદિ મધ્ય અને અંતે કર્મની પ્રભુને હંદે,  
રાખીને જે કરે કર્મ, તે સત્કર્તવ્ય-યોગ છે.

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૧૮૭)

\*

\*

મળે છે કામથી રામ, નામના કામથી મળે,  
કામથી રામ જાગે છે, કામથી રામ શો મળે !  
છે જેના કામમાં રામ, પાંસરું કામ તે થશે,  
કામ તો કામધેનું છે, કામ તો કલ્પવૃક્ષ છે.

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૧૮૩)

બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ કર્મનાં તે સ્વરૂપ છે,  
અનાદિ કર્મની માયા, કર્મમાં ઈશ વ્યક્ત છે.

\*

\*

સેવાની ભાવના સાથે ચેતના પરમેશ્વરી,  
ધારણા જો ન હો હેયે, દિવ્ય વિકાસ-લૂહાણ શી ?

\*

\*

સૂર્યની સાબિતી કાજે કોઈ બીજાં પ્રમાણ ના,  
મેળે અનુભવાયે તે, તેવું ચૈતન્યભાવમાં.

\*

\*

વિદ્યુતત્ત્વ સ્વયં પોતે અપ્રકાશ રહે છતાં,  
સંબંધે તત્ત્વના બીજાં દેદીઘ્રમાન થાય તે.

\*

\*

માનવું એક છે વાત, મનાયેલી દશા બીજી,  
અંતર કેંક ગાઉનું બન્ને વચ્ચે રહ્યું સહી.

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૩૩, ૩૭, ૫૬, ૧૩૬, ૧૫૮)

\*

\*

કર્મથી વિશ્વ જન્મે છે, કર્મે પોખાય વિશ્વ આ,  
કર્મથી મૃત્યુ પામે તે, કર્મમાં એ ત્રણે કિયા.  
\* \* \*

સેવાના જ્યાં તમે ઉભા ત્યાં ત્યાં પ્રસંગ સાંપડે,  
સેવા પોતાની એ રીતે જે કરે, તરશે જગે.

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૧૬૧-૧૬૪)  
\* \* \*

મોંઘામૂલો મહામંત્ર જીવનસિદ્ધિનો કશો,  
વિશ્વે અસ્તિત્વમાં હોય, દુઃખ તો એક જાણશો.

(‘જીવનપગલે’, આ.૧, પૃ. ૪૩)  
\* \* \*

દુઃખ એ તો મહાશક્તિ સંજીવની જીવો તણી,  
દુઃખે એ કુરબાની છે પ્રભુના પ્રેમ-ભાવની.

(‘જીવનપગલે’, આ.૧, પૃ. ૪૬)  
\* \* \*

ઉર-દૌર્બલ્યથી જન્મ્યો સંતોષ ખપનો જ શો !  
એ તો મૃત્યુ પમાડે છે, અજિનને બૂજવે પૂરો.

(‘જીવનપગલે’, આ.૧, પૃ. ૫૦)  
\* \* \*

વિશ્વનો કાયદો એવો ભરીને જીવવા તણો,  
દુઃખથી જે મરે જ્ઞાને, ચેતનાથી જીવ્યો ગણો.

(‘જીવનપગલે’, આ.૩, પૃ. ૫૨)  
\* \* \*

મર્યાદા જેની ના કો છે આપણામાંનું તત્ત્વ તે,  
ઓળંગાવી શકાવે તે મર્યાદાઓ બધી ખરે.

(‘જીવનપગલે’, આ.૩, પૃ. ૮૭)  
\* \* \*

નિર્ણિત હો થયેલી સૌ યાંત્રિક રીતની દશા,  
એવી પરંપરાથી યે તત્ત્વ જીવનનું મહા.

(‘જીવનપગલે’, આ.૩, પૃ. ૬૮)

\*

માયાને જાણવાથી તો માયાને મેળવે જનો,  
માયાના પડદા ચીરી જે જુઅે, મેળવે ખરું.

(‘જીવનપગલે’, આ.૩, પૃ. ૧૦૦)

\*

આખરી સત્ય ના કર્મ, સત્ય છે પર કર્મથી,  
પ્રીછવા સત્યને કર્મ, કર્મ સર્વોપરી નથી.

(‘જીવનપગલે’, આ.૩, પૃ. ૬૮)

\*

પ્રકૃતિ ચેતના વચ્ચે સદા માનવી તો જૂલે,  
‘સ્વતંત્ર-જકડાયેલો’ એવી બે વૃત્તિમાં રમે.

(‘જીવનપગલે’, આ.૩, પૃ. ૧૦૧)

\*

કર્મ તો વ્યવહારે ને પારમાર્થિક ક્ષેત્રમાં,  
સંસ્કાર પાડતું રે’ છે; મરે ને મારતું ત્યણાં.

(‘જીવનપગલે’, આ.૩, પૃ. ૧૦૧)

\*

કર્મનો કાયદો ભારે, ખીલતાં આત્મશક્તિ જ્યાં,  
એને આધીન રે’વાનો; જાણજો નિશ્ચયે સદા.

(‘જીવનપગલે’, આ.૩, પૃ. ૧૦૦)

\*

પ્રભુના ભાવથી જુદું સ્વતંત્ર કર્મ કર્યાંય ના,  
શુદ્ધ સાત્ત્વિક સૌ કર્મ સ્વભાવ વ્યક્ત બ્રહ્મનો.

(‘જીવનપગલે’, આ.૧, પૃ. ૧૧૦)

\*

સદેલી વસ્તુ ફેંકી દે સહેલથી માનવી જગે,  
સદેલા કિંતુ વિચારો માનવી સહેલથી ગ્રહે.

(‘પુનિત પ્રેમગાથા’, આ.૨, પૃ. ૭૮)

\* \* \*

મરેલું હો પૂરેપૂરું માંહેથી તૂમંડું યદિ,  
પોતાને તારવા શક્તિ પામે છે તે હૃદે નકી.  
પારો જ્યારે મરેલો હો, શક્તિ રોગ સુધારવા,  
આપમેળે મળે એને, એવું આપણું જાણવું.

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૩૪૬)

\* \* \*

મૃત્યુને ભેટવામાંયે જેને પ્રેમ રહ્યા કરે,  
મૃત્યુ ને જીવનું—બેથી એવો નિત્ય વસે પરે.

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૩૪૭)

\* \* \*

મળેલો ધર્મ જે હોયે એને ઉવેખીને બીજે,  
ધર્મ મેળવવા જાય, એને ધર્મ નહિ મળે.

\* \* \*

જ્યાં જ્યાં જીવન-સંબંધ ત્યાં ત્યાં ધર્મ રહ્યો ગણો,  
જુદો જીવનથી કયાંયે ધર્મનો ભાવ ના કશો.

\* \* \*

એક એક કરી જેઓ અનંત ડગલાં પથે,  
ધીરે ધીરે ભરે, તેઓ પામી અનંતતા શકે.

\* \* \*

અત્યાસ કેળવ્યા વિના હૈયાના પ્રેમભાવથી  
ઘોંચવા શક્ય જે ધારે, એ તો મૂર્ખશિરોમણિ.

\* \* \*

પ્રભુને મૂકીને ટોલ્યે સ્વભાવે વશ કર્મને,  
જે કર્યા કરવું રાખે, એને કેમ કૃપા મળો ?  
\* \* \*

વિશ્વથી તે જુદો ભાવ પ્રભુનો ક્યાંય છે નહીં;  
જુએ જે પ્રભુ પોતામાં, એને તે વિશ્વમાં જડે.  
\* \* \*

જીવન-સાધના પ્રેમે જે કરે, શ્રેય પામશે;  
જે તે એનું બધું શ્રેય, એનું જીવન શ્રેય છે.

(‘જીવનસંદેશ’, આ.૨, પૃ. ૧૮૪-૮૫-૮૬)

\* \* \*

સ્વતંત્ર રૂપ એકુયે પ્રેમનું કોઈયે નથી,  
પોતાના જેવું માને સૌ પ્રેમનું રૂપ ચિત્તથી.  
પ્રેમને માનવું એવું મિથ્યા માનવીનું ખરે,  
આપણાં સર્વ રૂપોથી પ્રેમ કેવો પરાતપરે !

(‘જીવનપાથેય’, આ.૩, પૃ. ૫૪)

\* \* \*

જીવને ઉદ્ભવેલો જે આપણો ધર્મ હોય તે,  
આચર્યા કરવામાં જ સંતોષ માનવો હુદે.

(‘જીવનપાથેય’, આ.૩, પૃ. ૬૮)

\* \* \*

(માલિની)

મહીં

હુદ ભીતરી ઊર્ધ્વતી વૃત્તિઓ જે બધી તે,  
શરમ નહિ જ રાખે સર્વ કેં બોલી દેશે.

(‘જીવનપાથેય’, આ.૩, પૃ. ૮૫)

\* \* \*

(વसंततिलકા)

ખીલ્યાં દીસે સ-રસ જે તક-પુષ્પ આજે,  
કાલે કદા વિખરશે કરમાઈ તાપે;  
લેવો જ હોય કંઈ લાભ, સવેળ લેશો,  
ચાલ્યો જશે સમય, કાલ નવું જ જોશો.

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૧૮૦)

\*

\*

(અનુષ્ટુપ)

પોતાનો કોઈ જો હોય સાચો એવો પરીક્ષક,  
પોતે છે એક, જો જીવે સાચું જાગૃતિપૂર્વક.

(‘જીવનપાથેય’, આ.૩, પૃ. ૧૨૫)

\*

\*

કિંતુ સંસાર એ તો છે પ્રાકટ્ય પ્રભુની લીલા,  
એમાં પ્રભુ ન જો પેખો, મળો તો પ્રભુ ક્યાંય ના.

(‘જીવનપગલે’, આ.૧, પૃ. ૩૨)

\*

\*

સંસાર તો પ્રભુની છે શાળા પ્રયોગ શીખવા,  
શીખવા માટે સંજોગો પ્રભુએ સૌ ઉભા કર્યા.

(‘જીવનપગલે’, આ.૧, પૃ. ૩૨)

\*

\*

એકસરખીયે કોની પ્રકૃતિ ના કદી જગે,  
છતાં તેમાં રમે કેવો એકભાવે પ્રભુ બધે !  
આદર્શ દાખલો એવો પ્રભુનો આપણે લઈ,  
વર્તવાનું જગે રાખો; કામ તો નિપટે સહી.

\*

\*

કેવળ અંતરે જે હો ન તે એકાગ્રતા પૂરી,  
રાખો સૌ બાધ્ય કર્મામાં તેવી એકાગ્રતા નરી.  
પાછું એકાગ્ર રે'વામાં ત્યાં તટસ્થ રહ્યાં જવું,  
નહિ તો કર્મામાં પૂરા ભેણાઈ જ જશો પૂરું.

(‘જીવનપગલે’, આ.૧, પૃ. ૩૨, ૩૪)

\*

\*

(ગઝલ)

સમર્પણ-યજ્ઞની વેદી પરે બલિદાન આપીને,  
ચઢે જે પ્રિયને મળવા, બને છે એક પ્રિયમાં તે.  
જીવનસર્વસ્વ કુરબાની કર્તાં પ્રિયને કાજે,  
દીવા કોઠે થતા આઠે, જીવનની લૂહાણ પામે તે.

(‘જીવનસંદેશ’, આ.૨, પૃ. ૧૪૨)

\*

\*

તમારે ને અમારે શા પડે વાંધા, અરે ! શાને ?  
કશું શું લેંચવાનું છે ? અહ્મુ એનું જ કારણ છે.

(‘પ્રણામ-પ્રલાપ’, આ.૨, પૃ. ૮)

\*

\*

કલેવર, કાવ્ય કે રાગ ન સંગીતને પૂરું થાય,  
અધૂરાં કેમ તે જાણો; જીવન-સંગીત શું વ્યાપ્ત !

(‘પ્રણામ-પ્રલાપ’, આ.૨, પૃ. ૨૬)

\*

\*

સકળ જડ ચેતને વ્યાપ્ત રહ્યું શું એકનું એક,  
છતાં તે વ્યક્તતામાં તો જુદું જુદું બધું છેક.  
વિવિધતા સૂક્ષ્મ જીવનની નિરાળી શી નિરાળી છે !  
વિવિધતામાં છતાં પાછું રહેલું એક કેવું તે !

(‘પ્રણામ-પ્રલાપ’, આ.૨, પૃ. ૫૧)

\*

\*

હદ્યના પ્રેમશૌર્યથી જીવન-શહાદત તણા પંથે,  
ઉંડી તૈયારી ખપવાની પૂરા ઠંડા કલેજાએ.  
પ્રભુને પદ્ધકમળ જેની, જીવન-શક્તિ હદ્ય કેરી,  
રહે છે કેળવાયેલી, કરી શકશે પ્રભુભક્તિ.

(‘પ્રાણામ-પ્રલાપ’, આ.ર, પૃ. ૧૨૬)

\*

\*

(અનુષ્ટુપ)

દૈવી ચૈતન્યનો ભાવ પૃથ્વીની પ્રકૃતિમહી-  
ઠરે ના તે કદી, એવું જાણવું સાધકે સહી.  
દૂધ સિંહણ કેરું તો સોનાપાત્ર વિષે ઠરે,  
ભૂમિકા એવી હૈયાની તે યોગ્ય કરવી ઘટે.

\*

\*

‘ધર્મ-પાલન’ ‘સ્વીકાર’ બન્ને મહત્વનાં ખરાં,  
બન્નેની યોગ્યતામાં તો સાધકે વર્તવું સદા.  
એકને છોડીને બીજું લેવા સાધક જો જશે,  
ભ્રમણામાં પડી પોતે તત્વને તે ગુમાવશે.

\*

\*

કર્મના ફળની આશા રાખવાની નથી ભલે,  
છતાં પ્રાપ્તિ નથી તેની માનવાનું ન એવું તે.

\*

\*

પોતાનું કામ જે માન્યું બુદ્ધિ તેમાં ઉંડી ખૂંપે,  
ખૂંપતી જાય જો બુદ્ધિ, વરેલા કામને ગણો.

\*

\*

કર્મને કરતી વેળા ભાવના, જ્ઞાન ધારવાં,  
ત્રણેનો યોગ સંધાતાં યોગની પરિપૂર્ણતા.

\*

\*

જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય કર્મની એ પરિસ્થિતિ,  
કર્તા ભોક્તાપણું તેમાં એકલા જ્ઞાનને નથી.  
જ્ઞાન ને જ્ઞેય સંબંધે પ્રેરાઈ જે થતું રહે,  
થયાં તે કરવાનું છે જ્ઞાન ને જ્ઞેય કારણે.

\* \* \*

કરો કે ના કરો પોતે, પ્રકૃતિ કેમ છોડશે ?  
પ્રકૃતિથી રહી જુદા વર્તાતાં મુક્ત તે થશે.

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૩૮, ૩૯, ૪૦, ૪૫, ૫૬)

\* \* \*

(અનુષ્ટુપ)

જીવને સર્વ સંબંધો આપણા કર્મથી મળે,  
કર્મ તેમાં વધાર્યું, તો કર્મ પોતે વધ્યાં કરે.

\* \* \*

જે જે વૃત્તિ દ્વિધા કેરી જીવને ઉદ્ભવ્યાં કરે,  
એનું તે નામ માયા, જે ભમાવ્યાં જીવને કરે.

\* \* \*

બધો જીવનનો થાક જેના શીતળ છાંયડે,  
ખંખેરી માનવી નાખે, એવું તો સંત-વૃક્ષ તે.

\* \* \*

નિત્યની જગૃતિ વિના વ્યવસ્થિતિ ન સાંપડે,  
વ્યવસ્થિતિ વિના શક્ય નથી વિકાસ જીવને.

\* \* \*

અદૃશ્ય શી જગ્ઞાતી કો ભાવના શક્તિ પાસ તે,  
વિજ્ઞાન વીજળી કેરું જોમ હિસાબમાં ન છે.

\* \* \*

વિચારહીન યાંત્રિક માનવીની ગતિ જગે,  
મૃત્યુમાં તે પડેલા છે, જીવતા ન છતાં જીવે.

\* \* \*

જેનામાં સર્વ તાકાત સહેવા અવહેલના,  
છતાં કોમળતાવાળી જેનામાં શક્તિ, સાધુ તે.

\* \* \*

ત્યાગ જ્યારે મહારુદ્ર સમો મેળે બની જતો,  
પોતાને વાપરી નાખી મહત્તા નિજ સ્થાપતો.

\* \* \*

સંગ્રહી લેવી થોડામાં થોડી જે પળ સાંપડે,  
સાચું જીવન તે છે, જે નકામી પળ ના ખુઅે.

\* \* \*

મળેલી તકનો પૂરો હેતુની યોગ્યતાભર્યો,  
ઉપયોગ કરી જે લે, એને જીવન આણજો.

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૬૦, ૬૨, ૬૩, ૬૪, ૬૫)

\* \* \*

(ઉપજીતિ)

અન્યાય કાજે ફરી ફરીને, જેણે હજારો કહી શબ્દ નાખ્યા,  
એનાથી તો શબ્દ વિના જ એકે, પ્રેમે સહે, શ્રેષ્ઠ ગણાય છે તે.

(મંદાકાંતા)

ચીલે ચાલે જગત પરના, તે ન ચીલે કદી છે,  
લીધા વિના નિજ જીવનનો તાગ, શું મેળવે તે ?

(અનુષ્ટુપ)

વીજળી કેરી શક્તિથી યંત્ર સૌ કામ આપતું,  
શક્તિ ઉદ્ભાવવી એવી જીવને રહી લક્ષ્ય શું !

\* \* \*

શક્ય ના માનવીને શું દૃઢત્માવાન જો થશો,  
ઉગ્ર નિશ્ચયવાળાને બને શક્ય અશક્ય સૌ.

\* \* \*

માત્ર વિચાર ને વાતો કર્યે આકાર ના બને,  
કર્મ વિના ઘડાતું ના કોઈ જીવન ક્યાંય તે.

\* \* \*

સહાનુભૂતિ છો રાખો બીજાંઓ સાથ સૌ રીતે,  
છતાં વિચાર બીજાના આવવા ધો ન તે વિષે.

\* \* \*

ભક્તિ, ધ્યાન અને યોગ, જ્ઞાન જે સૌ થયાં કરે,  
કર્મ તાદૃશ્ય પ્રેરીને પ્રભુને કાજ જે જીવે,  
ચેતના હેતુની એને પ્રભુ કાજે રહ્યાં કરે,  
એવા પ્રભુ તણું યંત્ર કૃપાથી એની થઈ શકે.

(‘કર્મગાથા’, આ. ૧, પૃ. ૬૫, ૬૬, ૬૭, ૭૧, ૭૨, ૭૬)

\* \* \*

આપણું સર્વ છોડીને કૃપા મેળવવા હુદે,  
ધ્યાને એકાગ્રતા ધારી પ્રાર્થના કરવી ખરે;  
ચિત્તની શાંતિને માટે ધ્યાનનો ઉપયોગ ના,  
કૃપાને યોગ્ય થાવાને ધ્યાનનો ઉપયોગ ત્યાં.

\* \* \*

ભીની માટી થતાં ચિહ્ન પડે છે પગલાં તણાં,  
ઉદ્રેક ભાવનો એવો થતાં યોગ્ય ગ્રહાય ત્યાં.

\* \* \*

પ્રસંગો સર્વ સામાન્ય જે જે નિત્ય બન્યા કરે,  
તેનાથી જિંદગી સૂક્ષ્મ વણાયાં કરતી રહે.

\* \* \*

વस्तुना તત્ત્વની સાથે હૈયે સંબંધ એકલો;  
મર્યાદા તત્ત્વને ના છે, જ્યાં ત્યાંથી તે લીધાં કરો.

\* \* \*

વરસાદ બધે વર્ષે બધાંને ઉપયોગનો,  
મર્યાદા આપણી એને મર્યાદિત કર્યો કરે.

\* \* \*

કિયા ચિત્તંત્રની સર્વ રહ્યા એકાશયે વિના,  
દ્વિધા થયેલું ચિત્તંત્ર થાય તે બળવાન ના.

\* \* \*

થતાં ઘૃણા, બીજી બાજુ પ્રેમની ભાવના હદે,  
એના પ્રત્યે જગાડીને સૌખ્ય ભાવે પ્રવર્તજે.

\* \* \*

જેટલો ભાવમાં પ્રાણ જાગેલો હોય અંતર,  
પ્રકૃતિનું થશે તેવું તેટલું ત્યાં રૂપાંતર.

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૭૬, ૮૧, ૮૪, ૮૭, ૮૮, ૮૧, ૧૦૨)

\* \* \*

પોતે શાંત થયા વિના, પોતે મુક્ત થયા વિના,  
શાંત, મુક્ત બીજાંઓને શેં કરાવી શકો ભલા ?

\* \* \*

હેતુ વિનાનું તે મૌન સારશે કાંઈ અર્થ ના,  
હેતુથી સંકળાવેલું જન્માવે મૌન ચેતના.

\* \* \*

મૌનની તો દશાઓ છે એક એકથી શી જુદી !  
આત્માના મૌનની જેવી સર્વોત્કૃષ્ટ દશા ન કેં.

\* \* \*

ભિખારી હોય તે કે'શે કે, ‘હું રાજાધિરાજ છું’,  
એને એવું કહેવા ઘો, કાઢી લો કામ આપણું.

\* \* \*

સર્વ કામ મહીં વૃત્તિ પોતાની જો રહે ન તે,  
‘હું’ બધું નીકળી જશે, ત્યારે શક્તિ છતી થશે.

\* \* \*

પૂરું શુદ્ધ થતાં ઘેલાં ગળાવું ભડીમાં પડે,  
ગળાવાની કિયામાં સૌ ધૈર્ય, પ્રેમ થવાં ઘટે.

\* \* \*

ચિત્તશુદ્ધિ થવા કાજે પ્રભુભાવ દેઢાવવા,  
કર્મ એરણ રૂપે સૌ ઘડાવા કરવાં રહ્યાં.

\* \* \*

વિના હેતુ ‘નકામું’યે નકામું ના મળે કદા,  
હેતુ જ્ઞાન સ્ફુરે જેને, ‘નકામાં’માં કરે રખ્યાં.

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૧૧૭, ૧૨૮, ૧૨૯, ૧૩૦, ૧૩૩-  
૧૩૪, ૧૩૭, ૧૪૮)

\* \* \*

પ્રેય ને શ્રેયની વચ્ચે ફેર શો જાણવાની તે,  
મળે ના શક્તિ એવામાં એવાં પીસાય જીવને.

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૧૭૭)

\* \* \*

અહંકાર થકી સર્વ કામે પ્રેરાયેલાં રહે;  
કામ જે શુદ્ધિ અર્થે લે, અહં તેનું ગળ્યાં જશે.

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૧૮૧)

\* \* \*

‘કામ જેણો કર્યું તેણો કર્યું કામણા’, ઉક્તિ છે,  
સાચું તથાંશ એમાં છે, વળી સાચું હકીકતે.

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૧૮૭)

\*

\*

જવવું, મરવું એને બન્નેમાં ભાવ એક શો !  
પ્રભુ માટે બધા એના જે તે સર્વ પ્રકાર તો.

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૨૦૮)

\*

\*

(ગઝલ)

પ્રભુના કોપમાં ભારે અનુંધા, દ્યા, પ્રેમ,  
જગજ્જન ના શકે સમજી, પ્રભુની શી હશે નેમ !  
પ્રભુના વિશ્વની રચના તણો કંઈ ખેલ ન્યારો છે !  
ઘડીમાં તે રડાવે છે, ઘડીમાં તે ખીલાવે છે.

(‘જવનપગલે’, આ.૧, પૃ. ૪૭)

\*

\*

(શિખરિણી-મંદાકાતા)

ભરાયેલું પાણી કઠણ ગિરિમાં માર્ગ તે ત્યાંથી કાઢે,  
ભલેને રૂંધાયે અધવચ પથે, તે છતાં તે ન કંપે;  
ભરે તે પોતામાં ગતિબળ વધુ, ચેતનાને વધારે,  
અજાણી કો વેળા અદ્યાણ બધી ક્યાંય શી ફેંકી દેતે !

(‘જવનપગલે’, આ.૧, પૃ. ૭૨)

\*

\*

(અનુષ્ટુપ)

ગમે તેવું હશે ભૂત પુરુષાર્થે મથી મથી,  
ભવિષ્ય વર્તમાને જે આણશે, ધન્ય તે થશે.

(‘જવનપગલે’, આ.૧, પૃ. ૮૧)

\*

\*

પ્રેમને કાજ તો પ્રેમ આપવો પડશે સદા;  
પ્રેમ મેળવવા જત પડે છે હોમવી તદા.

(‘જીવનપગલે’, આ.૧, પૃ. ૮૯)

\*

\*

સર્વથી આત્મની શક્તિ સર્વસામર્થ્યવાળી શી !  
શ્રદ્ધા-વિશ્વાસ હૈયે તે ધારી મેળવવો જ્ય.

\*

\*

પ્રેમના અભિનમાં જેણે નાખ્યું છે પડતું ખરે,  
પ્રેમની જ્યોતની જવાળા એને કેમ ન લાગશે ?  
પ્રજાળી સર્વ અંગોને ભસ્મીભૂત બનાવશે;  
યજ્ઞમાં સર્વ હોમાવા પૂરો યોગ્ય કરાવશે.

(‘પુનિત પ્રેમગાથા’, આ.૨, પૃ. ૧૪)

\*

\*

વહેવા દો વહેવા દો ગંગા પ્રેમની ઊલટી,  
દિવ્ય તે પ્રેમ-ગંગાથી ગાત્ર દો સર્વ ભીજવી.

(શિખરિષ્ણી-મંદાકાન્તા)

કૂપાથી દીધેલું પ્રાણ્ય ઝરણું, તે પ્રભુની પ્રસાદી,  
ન તે પોતા કાજે રસબસ થવા વ્હેચવા સર્વમાંહી.

(મંદાકાન્તા)

વ્હેચ્યે વ્હેચ્યે વધુ વધુ વધે, એવું એ દિવ્ય પાત્ર,  
વ્હેતાં વ્હેતાં વધુ વધુ વહે, શો અહા ! પ્રેમસ્તોત !

(‘પુનિત પ્રેમગાથા’, આ.૨, પૃ. ૨૩)

\*

\*

(અનુષ્ટુપ)

જગો ઈશ તણું પ્રેમ એ તો બ્યક્ત સ્વરૂપ છે;  
કહ્યું છે એટલા કાજે ‘પ્રેમ એ પરમેશ્વર’.

કેળવાતાં હદે પ્રેમ, પ્રેમ પૂરો બની જતાં,  
આપણે ઈશ-મંદિરે પ્રવેશી શકશું તદા.

(‘પુનિત પ્રેમગાથા’, આ.૨, પૃ. ૪૭)

\*

પ્રેમની આર્દ્રતાવાળા સ્પર્શ માનવઉર તે,  
ધરી કોમળતા કેવું ભીજાયેલું થતું દીસે !

\*

સુખાકારી શરીરે શી બીમારીથી વધુ રહે !  
છતાં ના ભાન એનું રે’, બીમારી સાલતી રહે.  
સદાકાળ રહેલું જે જીવંત આપણા વિષે,  
એનું અસ્તિત્વ સહેજેયે જીવને દાખિમાં ન રે’,  
એવું તે પ્રેમનું સૌમાં જીવતું તત્ત્વ વિશ્વમાં,  
ભરપૂર રહેલું જે, ત્યાં પડે દાખિ ના છતાં.

(‘પુનિત પ્રેમગાથા’, આ.૨, પૃ. ૪૮)

\*

હૈયાના પ્રેમની કોઈ માલિકી ના કરી શકે,  
માલિકી કરવા જતાં તેવો પ્રેમ ન રૈ’ શકે.

(‘પુનિત પ્રેમગાથા’, આ.૨, પૃ. ૪૯)

\*

બે પાળો મધ્ય વ્હે રેલો નદીનો જેમ આપથી,  
વહેવા તેમ દો શક્તિ આવિર્ભાવ કરી કરી.

(‘પુનિત પ્રેમગાથા’, આ.૨, પૃ. ૫૦)

\*

પ્રેમને ભોગવી જે લે પ્રેમ ના મેળવી શકે,  
પ્રેમ જે ઉપયોગે લે પ્રેમ તે મેળવી શકે.

(‘પુનિત પ્રેમગાથા’, આ.૨, પૃ. ૧૮૩)

\*

આપથી આપ જન્મે છે આપણું આપથી જવે !  
આપનું વિશ્વ છે આપ; તેમ છે ભાવનું ખરે.

(‘જીવનસોપાન’, આ.૧, પૃ. ૧૪૧)

\*

\*

‘કર્તાહર્તા પ્રભુ પોતે આપણાં સર્વ કર્મમાં’-  
એમ તો એકલો પૂર્ણ જ્ઞાની માત્ર કહી શકે.

\*

\*

સાચવી-સાચવી તે શું સાચવી શકીશું બધું ?  
આપણે શું થઈ બેઠાં કર્તાહર્તાય સર્વનાં ?  
ક્ષણ એક પછી કેવું જવી તે શકશું ભલા !  
એની તો જાણ ના કેંછે, - શું કરો પછી વેતર્યો ?

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૨૦૨)

\*

\*

(ગઝલ)

પરસ્પરનું ખરું સગપણ હૃદયની ભાવનામાં છે;  
જીવનભક્તિ જગવવામાં ખરા ઉપયોગનું તે છે.

\*

\*

હૃદયનો ભાવ જ્યાં જાગે, બધું ત્યાં જીવતું લાગે;  
હૃદયનો રસ જહીં જામે, બધું તાદ્શ તહીં લાગે.  
નથી જુદાઈ તલભરની, બધો રસ ત્યાં હૃદય કેરો  
-હૃદયમાં શો સમાઈને હૃદયથી તે વહે પાછો !

(‘જીવનસોપાન’, આ.૧, પૃ. ૧૦૦)

\*

\*

અનુભવ ક્યારે થાય; તેનો લાભ કેમ ઉઠાવવો ?

(પરમ) અનુભવ થવા માટે સતત ચિંતવન અને ધ્યાન  
જરૂરનાં છે. તેનાથી ભૂમિકા રચાય છે. અમુક ભૂમિકા રચાય તે

પછી અનુભવ થવા માંડે છે. જીવનનો નિચોડ અનુભવમાં છે, પણ તે ત્યારે જ થાય કે જ્યારે આપણે ભગવાનમાં સતત યુક્ત રહેવાનો જગ્રત પ્રયત્ન કર્યા કરતાં હોઈશું; એવો યજ્ઞ અવિરત દીર્ઘકાળ પર્યત ચાલુ રહે, તો આપણામાં એવો આંતરિક ભાવ ખીલી ઊઠશે કે તેના પ્રતાપે સર્વ કંઈ થવું શક્ય છે.

(‘જીવનપગથી’, આ.ડ, પૃ. ૭૪-૭૫)

\* \* \*

અનુભવ એવો હોવો જોઈએ કે તે અનુભવમાંથી મળેલું જ્ઞાન હૃદયમાંથી કદ્દી ખસી ન જાય.

ભગવાન ભલેને કદાચ ભારેમાં ભારે મોટા અનુભવ કરી બતાવે, પરંતુ તેથી કરીને આપણામાં જ્યાં સુધી અનુભવનો યોગ્યપણે લાભ લેવાની શક્તિ, દાસ્તિ ને અભિલાષા પ્રગટ થયેલ હોતી નથી, ત્યાં સુધી તેવા અનુભવો ઉપર-ઉપરથી ચાલ્યા જાય છે.

(‘જીવનપગથી’, આ.ડ, પૃ. ૧૫૮-૧૫૯)

\* \* \*

આપણને જે જે કંઈ અનુભવ થાય તેને ઊંડા ને ઊંડા ઉતારતા જઈએ, તો તે અનુભવ અને તેની અસર જાઓ વખત ટકશે, પછીથી જીવંત સ્વરૂપ બનશે અને તેનો ખરો લાભ ઉઠાવી શકીશું.

આપણા જીવનનો જો સૂક્ષ્મની ભાવનામાં વિકાસ કરવો હશે તો આપણે સ્થૂળ અનુભવોમાં સૂક્ષ્મ ભાવ સમજવાનો પ્રયત્ન કરવો પડશે. એ જાતની સમજ પહેલાં-પહેલાં તો બુદ્ધિથી આપણે આપણામાં ઉતારવી જોઈશે. બુદ્ધિથી તે સમજણમાં ઉતરી શકશે ખરી, પરંતુ તેને લાગણી અને ભાવનાના પ્રદેશમાં લઈ જઈને પોતાના વિકાસ માટેનાં અર્થવાળાં સૂચન મળ્યાં કરે અને અનુભવો તેવી રીતે આપણા હૃદયમાં અંકાય એમ કરતાં કરતાં આપણને સ્થૂળમાંથી સૂક્ષ્મ ભાવ સમજાતો જશે અને તેનું રહસ્ય હૃદયમાં

ઉિતરવા માંડશે. ('જીવનપગથી', આ.૩, પૃ. ૧૬૪, ૧૭૬-૭૭)  
\* \* \*

ત્યાં જે અનુભવ થાય તેની નોંધ રાખશો. કોઈને પૂછશો ગાછશો નહિ, સહુ કોઈ પોતપોતાની સમજણ પ્રમાણે એને ઘટાવવા મથે ને એમ તો એનું મહત્ત્વ ઘટી જવાનું.

('જીવનમંથન', આ.૨, પૃ. ૩૨૧)  
\* \* \*

અનુભવ કશાના આધાર વિનાનો હોવો જોઈશે, એટલે કે સ્વયંભૂ પ્રગટ્યા કરેલો હોવો જોઈશે. એવા અનુભવની આગળ-પાછળ કશી સમજણ, માની લીધેલી કલ્યનાનું જોશ, સંસ્કાર વગેરે એવું કશું ન હોવું જોઈએ. જે અનુભવ થયો હોય એને તેની યોગ્યતા ને તેના મહત્ત્વની દાઢિ સાથે જે સાધક હૃદયથી સ્વીકાર કર્યા કરીને પ્રેમભાવથી, હૃદયથી એની નિષ્ઠા રાખ્યા કરે છે, ને એની શક્તિ પર પોતાના જીવનનું સર્વ કંઈ ન્યોછાવર કર્યા કરે છે, તો તેને જીવનમાં પ્રગટેલો તેવો અનુભવ આગળનો માર્ગ ખુલ્લો કરીને બતાવ્યા કરે છે ને તેમાં પ્રવેશ કરાવ્યા કરે છે. આમાં બ્રમજામાં પડી જવાનો કદી સંભવ રહેતો નથી.

('જીવનમંથન', આ.૨, પૃ. ૩૪૨)  
\* \* \*

### અભિપ્રાય ઝટ ન બાંધી લેવો.

(અનુષ્ટુપ)

કર્મનું એક પાસું તે જોઈને કર્મનો મત-  
બાંધી લેવો ઘટે ના; તે રાખશો લક્ષમાં દઢ.

કર્મનો હેતુ કોઈનો જાણ્યો ના હોય જ્યાં સુધી,  
ત્યાં સુધી તોળવા કર્મ બેસી ના ત્યાં જવું કદી.

પાસાં તો કર્મનાં કેંક, પાસું પ્રત્યેક છે જુદું,  
જુદો પ્રત્યેક પાસાંનો, લક્ષ્યાર્થ હોય છે ઊડો.

સર્વ બાજુથી જોવાની કર્મમાં દણ્ણિ, વૃત્તિ તે-  
થયેલી પાકી જ્યાં ન હો, ધારવું ટીક ના થશે.

ખીલેલાં સમતાદિ હો, તાટસ્થ્ય ને નિરાગ્રહ,  
ત્યારે જોઈ શકો પૂરાં કર્મ સૌ તુલનાત્મક.

ખ્યાલ સૌ બાંધવાના તે સાધકે છોડવા ઘટે,  
નવાં મૂલ્યાંકનો જોવા રાખવું લક્ષ સાધકે.

ધારતા હોઈએ પોતે એકલું માત્ર તે ખરું,  
મદાગાંઠ કશી એવી બાંધી રાખી ન બેસવું.

પ્રભુ-પંથે વળે છે જે, પ્રભુ તેને કરી કૂપા,  
છોડાવવા મદાગાંઠો અનેરા દે પ્રસંગ શા !

માનવીમાં પ્રભુ-ભાવ જુદી જુદી રીતે કરી,  
બ્યક્ત પોતે થતો રે' છે એની પ્રકૃતિ-રીતથી.

આપણી પ્રકૃતિ જેવી બીજાંની પ્રકૃતિ ગણી,  
સમદણ્ણિ પૂરી રાખી એનામાં વૃત્તિ રાખવી.

સમતા, શાંતિ રાખવી.

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૧૫૩, ૧૫૫)

\*

\*

### ગઝલ

અમારા તો અમે કાજી, અમે કાજી બીજાંનાયે,  
‘વળી કાજ્યના કાજી’ થતાં ખાનાખરાબી છે.

(‘જવપગલે’, આ.૧, પૃ. ૭૮)

## હદ્ય-અશ્વ

(ગજલ)

હદ્યનાં આંસુનું મૂલ્ય હદ્ય તે એકલું જાણે,  
ન મૂલ્યાંકન કશાથીયે કદ્દી એનું થઈ શકશે.  
પુલાં આંસુઓ એ તો હજુ મુજથી ન ભૂલાયે,  
હદ્યમાં ભાવ-મૂર્તિને અહા ! તે કેવી જન્માવે !

હદ્યનાં આંસુનો ભાવ હદ્યથી જે રડી જાણે,  
સમજશે એકલાં તેવાં અનેરો ભાવ એનો જે.

પડે નવ આંસુઓ અમથાં, કથા આંસુ તણી ન્યારી;  
વહે છે આંસુની અંદર હદ્યનો મર્મ કો ભારી.,

હદ્યની ભાવના કેરો વહે ઈતિહાસ આંસુમાં,  
અને આંસુથી જ ભાવ બઢાવે, શક્તિ તો તેમાં

ન લૂલી ભાવના આંસુ તણી, શક્તિ મહા એ તો,  
જગવવાને, બઢવવાને, હદ્યનો ભાવ—આંસુઓ.

વહાવો અશ્વ ના અમથાં, વહાવો જ્ઞાનપૂર્વક તે  
-હદ્યના મર્મને વીધવા, હદ્યમાં ભાવ ઠરવાને.

ગમે આંસુ મને વૃહાલાં પ્રભુ-પ્રગટાવનારાં જે,  
હદ્ય ખુલ્લું કરાવીને હદ્ય-ચરણે ઠરાવે તે.

વહે જ્યાં આંસુઓ અંતર ભીનું ત્યાં થાય કેવું તે !  
અને એકાગ્રતા-ભાવ હદ્ય શો જામતો લાગે !

હદ્યની ઉર્ભિમાં કોઈ રીતે સંચાર જ્યાં લાગે,  
બની આંસુરૂપી ઉર્ભિ હદ્યનો ભાવ પ્રગટાવે.

જીવન-આંતર-દશા આંસુ થકી કેવી જણાયે, જે  
—લહે અંતર વિષે, આંસુ મહા સાધનરૂપે એને.

મહા આનંદથી આંસુ વહે અંતર થકી જેને,  
રૂડાં એવાં અહા ! આંસુ પડે, તે ભાગ્યશાળી છે.

નકામાં દુઃખને કાજે વહાવે આંસુ નયને જે,  
જીવન નિર્બળ કરી નાખી નમાલા શાં બને પોતે !

જીવન જન્માવવા આંસુ તણી જે સાધના કરશે,  
જીવનને પામીને તેવાં મહા બડભાગી શાં બનશે !

વહાવો આંસુ અંતરનાં હૃદયનાં આર્ત ને આર્દ્ર  
—સ્હુરતાં ભાવથી; ઠરવા બધો આધાર પ્રભુ-પાદ.

હૃદયનાં આંસુથી હૈયું વલોવાયે ઉંચું જેનું,  
હૃદયના ભાવનો પડઘો પડાવે તે ખરો ઊડો.

હૃદય પૂરું શમવવાને પ્રભુ-સાધન રૂપે આંસુ,  
મહા મૌક્કિક અણમોલ પ્રસાદીથી મળ્યાં તે સૌ.

(‘જીવનસંદેશ’, આ.૨, પૃ. ૧૫૨ થી ૧૫૪)

\* \* \*

### હાઈક ઐક્ય

(ગઝલ)

હૃદયમાં જે હૃદય જીવે હૃદયને એ જ ખારું છે,  
પછી બોલાવવાનું ત્યાં રહે અમથું કઈ રીતે ?

હૃદયથી બૂમ તે કોને પદ્ધીથી પાડવાની છે ?  
બધુંયે આપનું એનું સમાયે આપમાં પોતે.

હદ્યના પ્રેમ-સાગરના હિલોળે તે ચઢી ઝૂલે,  
દીવાની પ્રેમ-મસ્તીની મહી જે તે સમાયું છે.

(‘પ્રાણામ-પ્રલાપ’, આ.ર, પૃ. ૧૪૩)

### અહં

(અનુષ્ઠાપ)

અહં-આગ્રહ વહેણો તે ના કર્મ રાખવાં હદે,  
કર્મના ભાવ-ઉત્સાહે ઓગાળી નાખવાં જ તે.

અહં-આગ્રહ શક્તિ છે, ધપવા કેરી કર્મમાં;  
તે શકે રાખી એકાગ્ર જોડાયેલા જ દિલમાં.

પ્રવેશાઈ ઉંદું ઉંદું કર્મ-અંતર-ગર્ભમાં  
—કર્મની તે ગતિ સાથે અહં જોડાઈ જાય ત્યાં.

અહં જો હોય ના, તો તો કર્મ કેં ના થઈ શકે,  
કર્મ પ્રવેશવા કાજે અહં તત્ત્વ જરૂરી છે.

અહંથી વિશ્વ જન્મે છે, અહંથી વિશ્વ સૌ નભે,  
અહંથી ફેરવાયે તે, અહં છે જોર ભાવનું.

જ્ઞાનપૂર્વક એનો જે ઉપયોગ કર્યા કરે,  
અહં એનું થશે યોગ્ય ને વિકાસ કર્યા કરે.

ઉપયોગ અહંનો સૌ તેથી કર્મ વિષે ઉંડો  
—કરવો તે પ્રવેશવા જ્ઞાનભાવે કરી ખરો.

‘અહં’ને સાત્ત્વિકી જોમે પૂરું કેળવવું રહ્યું,  
તે વિના સાધનામાં તો પ્રાણ જાગે ન રીત કો.

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૬૧)

\*

\*

(ગઝલ)

કરી તે શું શકે કોઈ કશુંયે કર્મને પોતે ?  
અહમ્માં ચેતના પ્રભુની; કરાવ્યું એનું થાયે છે.  
ગુણો વ્યક્તત્વ શક્તિનું ભલા ! ‘પોતાપણું’ શાને  
—પછી આરોપતાં રહીને ખુઓછો આપશક્તિને?

(‘પ્રણામ-પ્રલાપ’, આ.૨, પૃ. ૭૦-૭૧)

\* \* \*

### આધાત અને પ્રત્યાધાત

આધાત શબ્દનો રૂઢ અર્થ તો “દુઃખ” કે “ફટકો-માર” એ ભાવાર્થમાં સમાજમાં તે પ્રચલિત થઈ ગયો છે. પણ આધાત એટલે કશાનું કશા સાથે અથડાવું, સંપર્કમાં આવવું કે સંબંધમાં આવવું.

“જેવો આધાત તેવો પ્રત્યાધાત” એ જરૂર વસ્તુઓમાં પ્રચલિત નિયમ છે. ભીત ઉપર હાથ જેટલા જોરથી પછાડીએ, તેટલા જોરથી ભીત સામો પ્રત્યાધાત આપશે—એટલે કે તેટલા જોરથી આપણને વાગશે. ઈચ્છાપૂર્વક પ્રત્યાધાત કરવો એ જરૂર વસ્તુનો સ્વભાવ કે ગુણ નથી.

પશુઓમાં જે વેરવૃત્તિ સાધારણ રીતે જોવામાં આવે છે, તે પણ આધાત-પ્રત્યાધાતના ભૌતિક સિદ્ધાન્તનું સૂક્ષ્મ સ્વરૂપ છે. માનવીમાં પણ વેરવૃત્તિ છે ને તેટલા અંશે તે પશુ છે. જેમ કક્ષા નીચી તેમ આધાત તેવો જ પ્રત્યાધાત અને શક્તિ હોય અને કઠો હોય તો વધારે દુઃખ પ્રત્યાધાત, એવો નિયમ પ્રવર્તે છે. ભલું કરનારનું પણ ભૂંકું કરનારના કિસ્સા માનવીમાં અલ્ય નથી, અસંખ્ય છે; કેમ કે માનવ જાતિમાં બધી જાતના થરો આવી રહેલા છે; વળી એવું ભૂંકું કરનારા ઉપર સંસ્કાર, પ્રારબ્ધ, ઈતર જનોનાં

કર્મ વગેરેના એવા આધાતો પડેલા હોય છે કે તેના પ્રત્યાઘાત તરીકે તે વ્યક્તિ-વ્યક્તિમાં ફેર જોઈ શકતો નથી અને સદાય સ્વભાવવશ વર્તાને ઉપકારનો બદલો અપકારથી વાળે છે. પરંતુ એકંદરે માનવી પશુ કરતાં આધાત-પ્રત્યાઘાતના નિયમને ઓછો વશ હોય છે. જેમ ચેતનની જાગૃતિ વધુ, તેટલા પ્રમાણમાં આ નિયમ હળવો બનતો જતો જગ્યાય છે. પોતાની વેરવૃત્તિ શાંત કરવા અને આધાતથી થતા દુઃખને ખમાવવા માનવીએ બીજાં અનેક જાતનાં બળો ઉત્પન્ન કર્યાછે. રૂઢિ, પોતાનો જાગ્રત પ્રયત્ન, સંસ્કાર આદિથી માનવી આ નિયમથી થોડો પણ મુક્ત રહી શક્યો છે.

આવાં કારણોસર માનવીનું ઉર્ધ્વગમન થયાં જતું હોય છે તેમ તેમ તેનો આધાતનો પ્રત્યાઘાત હળવો બનતો જાય છે. દુઃખ આધાતની સામે તરત જ વેરનો પ્રત્યાઘાત એ તેની પ્રકૃતિની પ્રેરણા છે; પણ સાથે સાથે એ જ પ્રકૃતિમાં સ્વવિકાસનો ગુણ રહેલો હોવાથી, તેનામાં બીજી એવી સામી પ્રેરણા પણ રહેલી હોય છે અને તેના બળ વડે માનવી પેલા નિયમને પોતાને વશ રાખવામાં ઉત્તરોત્તર શક્તિમાન થતો જાય છે.

ધારી વાર મનમાં પ્રકૃતિજન્ય અસહ્યતાથી અત્યંત તિરસ્કાર અને દ્વેષ હોય પણ બહારથી મીઠાશથી વર્તતા માનવીઓ આપણે જોઈએ છીએ. આવા વર્તનની પાછળ બુદ્ધિએ સમજણનું એક નવું બળ તેઓને આપેલું હોય છે, ને તેથી તેઓ જાણતા હોય છે કે મીઠાશભર્યુ વર્તન ન રાખવાથી તેમના પોતાના વિકાસમાં અવરોધ આવશે. તેઓ મનમાંની દ્વેષની વૃત્તિને સંયમમાં રાખીને દાબી દઈને તેને આચરણમાં વ્યક્ત થવાની તક દેતા નથી. આ થયો તેમનો એટલા પ્રમાણમાં પ્રકૃતિ ઉપરનો વિજય; પરંતુ આ બને છે કેવળ વિચારને-બુદ્ધિને લીધે. આગળ જતાં માનવી બુદ્ધિની સાથે હદ્યને ભેળવી શકે છે અને જ્યારે તેમ બને છે

ત્યારે આધાત અને પ્રત્યાધાત વચ્ચેનો તફાવત વધારે ને વધારે થતો જાય છે અને અંતે આધાત અને પ્રત્યાધાત એ બે કિયાઓ જુદી જ પડી જાય છે. શરૂઆતમાં આધાતની સામે વેરવૃત્તિ ઉપજે, પણ વર્તનમાં તે અંકુશમાં આવે; તે પછી વાણીમાં અંકુશમાં આવે, તે પછી મનમાં પણ એટલા પ્રમાણમાં અંકુશમાં આવે કે વેરવૃત્તિ ઉપજે જ નહિ, યા તો ઉપજે તો નહિ જેવી. પરંતુ એવા આધાતોથી દુઃખ ઘણું થાય. આમ દુઃખી થવું એ પણ આ નિયમને હળવા પ્રકારે વશ થવાપણું ગણાય. આવી રીતે માનસિક કાબૂ વડે ઉત્તરોત્તર રચાયેલો સંયમ એટલો તો મજબૂત બનતો જાય છે કે છેવટે કોઈ પણ આધાત થાય—ભારેમાં ભારે દુઃખ પ્રકારનો—તોપણ તેને બદલો કેમ વાળવો, તેના પરિણામે મનમાં કેવી વૃત્તિ ઉઠવા દેવી, કેવો ભાવ થવા દેવો એ બધું પોતાના કાબૂની વાત બની જાય છે. આવો અનુભવ મથતા સાધકને થયા વિના રહેતો નથી. અલબજ્ટ, આની પાછળ ઘણો પુરુષાર્થ, એકાગ્ર ચિંત્વન, પ્રભુભાવની સંધનતા, કુશળ વર્તન, પ્રભુકૃપા આદિ અનેક સાધનોની આવશ્યકતા રહે છે; તેમ ઇતાં માનવીને માટે તે શક્ય છે, સાધ્ય છે.

શરૂઆતમાં જે આધાતોથી ઘણું દુઃખ લાગે તેવા જ પ્રકારના આધાતોથી ઓછું ને ઓછું દુઃખ લાગતું જાય અને છેવટે તો બિલકુલ દુઃખ ન લાગે તેવી મનોદશા કેળવી શકાય છે. પરંતુ આ સ્થિતિમાં અને જડ-નઠોર-માનવીની મનોદશામાં આસમાન-જમીનનો ફેર છે. જડ માનવી તેની જડતાથી, તેના બુઢાપણાથી, આવા આધાત પ્રતિ અદુઃખ સ્થિતિમાં પ્રવર્તે છે; જ્યારે પેલો મથતો જીવ તો પ્રાકૃતિક પ્રેરણાઓને કમશા: કાબૂમાં આણતો-આણતો આ નિયમમાં ઉર્ધ્વગમન કરતો આવે છે. જડ માનવીનું જે બુઢા થવાપણું બન્યું હોય છે, તે તો ગમે તે રીતે આનંદ

મેળવવાની અથવા દુઃખને હળવું કરવાની કુદરતી પ્રેરણા હોવાથી કેવળ એના ૪૩ સ્વભાવની પ્રેરણાને લઈને બને છે; તથા ઘણી વખત અમુક જાતની કઠોર વાણી સાંભળી-સાંભળીને યા તેવું વર્તન સહી-સહીને તેવાઓને એવી ટેવ પડી જાય છે કે પછી તેઓને તે બાબતનું દુઃખ નથી લાગતું. આ કંઈ આધ્યાત્મિક ઉચ્ચ માનસનું લક્ષણ નથી; મથતા સાધકમાં તો જ્ઞાનપૂર્વકની સહનશીલતા કેળવાઈ હોય છે. આથી તેનો ઉદ્દેગ ક્યાંયે ઊરી જઈને તે પ્રસન્નતા રાખી શકે છે, તથા પોતાનું શ્રેય—પોતાનો જીવનવિકાસ—કેવી જાતના વર્તનથી થશે તેની સૂજ તેને પડતી જાય છે; આથી કોઈ પણ આધાતનો જવાબ, પ્રત્યુત્તર, પેલા નીચલા થરના માનવી કરતાં જુદી જ રીતે, ઉચ્ચ પ્રકારે વાળે છે. અને અંતે તો જ્ઞાનપૂર્વક યોગ્ય રીતે આધાતનો પ્રત્યાઘાત કરવાનો એનો એટલો તો સહજ જ્ઞાનયુક્ત સ્વભાવ થઈ જાય છે કે આધાત આપનાર વ્યક્તિ પ્રત્યે પ્રેમ રાખીને પેલાનું કલ્યાણ થાય તેમ તેવી રીતે તે વર્તી શકે છે. આમ, આધાત-પ્રત્યાઘાત વચ્ચે શુભ હેતુનો અને આંતર્શુદ્ધિનો પટ આવી જાય છે.

આવી રીતે આધાત-પ્રત્યાઘાતનો નિયમ સાર્વત્રિક હોવા છતાં તેની પર જવું ને થવું શક્ય છે. અનેક સંત-મહાત્માઓ પર થઈ શક્યા છે. સાધનામાંથી નિષ્પન્ન થતા સદ્ગ્ભાવની સહાયે અને ભગવાનના ભાવ વડે કરીને આ સહેલાઈથી થઈ શકે છે.

(‘જીવનસંદેશ’, આ.૨, પૃ. ૮૭ થી ૮૨)

\*

\*

આપણે જો આપણને થતા આધાતો અને પ્રત્યાઘાતોના પરિણામ પ્રમાણે ચાલવાનું અટકાવી દેવું હોય, તો સમતા ને તટસ્થતાની વૃત્તિ આપણે કેળવ્યે જ છૂટકો છે. આધાત-પ્રત્યાઘાતના પરિણામે થતી વૃત્તિઓ આપણને વિચારોની

પરંપરામાં ડહોળાવી નાખે છે, ને એનાથી જુદા થઈને કંઈ કશું જોવા દેવાની દસ્તિ આપણને ઉગવા દેતી નથી. આપણે એક યા બીજા વલાણના જે હોઈએ છીએ, તેને બદલે કોઈ પણ પ્રકારના વલાણ વિનાના—પક્ષ કે ઝોક વિનાના રહેવાનો પ્રયાસ કરવાનો છે.

(‘જીવનપરાગથી’, આ.૩, પૃ. ૨૦૨)

\*

\*

ગમે તેવા પ્રસંગો કે વાણી વગેરેના કશાયના આધાત પ્રત્યાધાત આપણામાં ન ઉઠે એ તો ઉત્તમ થયું કહેવાય. પણ એ ઉઠે ત્યારે પણ આપણાથી એવા કશામાં તદ્વાપ થઈ જઈ તે પ્રમાણે ન વર્તાય અને એમનાં સ્વરૂપોનાં મૂળ સમજાય, એવી ને એટલી તટસ્થતા, સમતા, સ્થિરતા આપણે સતત કેળવ્યાં કરવાની છે. વળી વૃત્તિ કે વિચાર કે મનના વલાણથી દોરવાઈ ગયા વિના એને કેવી રીતે રચનાત્મક વળાંકમાં વાળી શકાય તે આપણને સૂજવું જોઈશે.

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૫)

### સાધનામાં આધાતોની આવશ્યકતા

મોટા મોટા ભક્તોના જીવનમાંથી આપણને જણાય છે કે તેમને એવા કોઈ ભારે આધાતો લાગ્યા હોય છે, ત્યારે ભારે ઊથલપાથલ તેમના મનમાં પ્રગટી જાય છે; એમાંથી એમનું મન ચેતી જાય છે, જગ્યત થઈ જાય છે; ખરી વસ્તુસ્થિતિની તેમને જાણ થઈ જાય છે ને પછી તે કામે લાગ્યી જાય છે; એમ આપણને પણ એવા આધાત લાગવાની જરૂર છે, કારણ કે આપણને આપણા જીવનઆદર્શ માટે મરણને સ્વસ્થપણે ભેટવાની તૈયારી હશે કે કેમ તે શંકાસ્પદ છે. વળી આપણા મનને આપણા જીવનઆદર્શની સર્વોપરીતાની ખાતરી હજી થઈ નથી. આપણે આપણા આ કામમાં વધુ ને વધુ રસ

લઈને તથા વધારીને મનને એમાં વાણ્યાં કરવાનું છે.

(‘જીવનપગથી’, આ.૩, પૃ. ૩૦)

\*

\*

આપણામાં રહેલા અહ્મુ તત્ત્વના ઊર્ધ્વકરણ માટે, તેને સાચ્ચિક બનાવવા માટે, આપણે એને જબરદસ્ત આધાતો આપવા પડશે. તે માટે આપણને જે ન ગમતાં હોય તેવાંને પ્રેમથી મળવું, એમનું ક્રમ કરી આપવું ને એમનો પ્રેમ સંપાદન કરવાની કોશિશ કરવી.

(‘જીવનપગથી’, આ.૩, પૃ. ૭૦)

\*

\*

આપણને જીવનમાં જગાડવા માટે ઘણી તકો સાંપડતી હોય છે. આપણી વસ્તુસ્થિતિ સમજાય તે માટે ભગવાન આપણને ઘણાય આધાત આપે છે. એવા આધાત જ્યારે થાય છે, ત્યારે કોઈક ધન્ય પળે આપણને આપણી વસ્તુસ્થિતિ સમજાય છે. જો ત્યારે તે સમજણ ઊંડી ગઈ હોય છે, તો આપણે પલટો કરવાનું પણ દિલ રહ્યાં કરે છે. (‘જીવનપગથી’, આ.૩, પૃ. ૧૩૮)

\*

\*

આધાત-પ્રત્યાધાતને કારણે આપણી ભૂમિકામાં તેની અસર ઊંડી ઊતરતી હોય છે. તેથી મંથન પ્રગટે છે. તેને લીધે વિચારવાનું બને છે. આથી તે ને તે સ્થિતિમાં પડી રહેતા સાધકને ત્યાંથી ધક્કેલવા માટે આધાત-પ્રત્યાધાત મળ્યા કરે છે તે ઘણું જરૂરનું છે. ગુરુમાં તેનાં સ્વજનોને-આત્મકલ્યાણાર્થ થયેલાં સ્વજનોને સમજ-સમજને જ્ઞાનભક્તિપૂર્વક એવા આધાત-પ્રત્યાધાત આપવાની કળા ઊગેલી હોય છે ને તેનો ઉપયોગ પણ થતો હોય છે.

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૨૪૬)

\*

\*

## આત્મનિવેદન

જે કોઈ પોતાની નબળાઈઓ છુપાવતો નથી ને નિવેદન કરતો રહે છે, તે તો સારી વાત છે; પરંતુ જો તેવાં નિવેદનો માંથી પ્રાણ ન પ્રગટતા હોય ને તેવાં ને તેવાં જ જીવપ્રકારનાં વલશોમાં ફરીફરીને તેનું પરોવાવાનું બન્યાં કરતું હોય તો તેવા જીવે ચેતવું જોઈએ, વિચારવું જોઈએ; કારણ કે હૈયાના નિર્ભળતા ભાવભર્યાં, સચ્ચાઈભર્યાં પ્રામાણિક નિવેદનથી તો ટણારી આવવી ઘટે. કેટલાક જીવોને વિષે એવો પણ અનુભવ છે કે તેઓ પોતે આત્મનિવેદન તો કરે છે, તેમ છતાં પોતાની નિર્ભળતાઓને છાવરતા હોય છે.

('જીવનપ્રવેશ', આ.૨, પૃ. ૩૦)

\*

\*

આત્મનિવેદનમાં હૃદયનો ભાવ મહત્વપણે હોતાં તેમાં અભિમાન નથી હોઈ શકતું. આત્મનિવેદનથી આપણા હૃદયનો સંબંધ વધુ ને વધુ ચેતનભાવે નિકટવર્તી બનતો જાય છે ને વધુ ને વધુ ખુલ્લા થતા જતા હોઈએ છીએ. આપણામાં સરળતા, પ્રસન્નતા, સંતોષ પ્રગટતો હોય છે. જેમ મળની શુદ્ધિ માટે ખાસ વિધિ ને કિયા છે, તેમ મનાદિના મેલ માટે શ્રીપ્રભુના ચરણકમળે થએલું નિવેદન છે. આત્મનિવેદનમાંથી પ્રત્યક્ષ નમ્રતા પ્રગટવી ઘટે. કરણોની શુદ્ધિ થતી અનુભવાવી જોઈએ.

('જીવનપ્રવેશ', આ.૨, પૃ. ૭૭)

\*

\*

હૃદયનાં આત્મનિવેદનો કંઈ રોદણાં નથી. રોદણાં રડવાથી તો શું વળે ? સાચું ખરેખરું હૃદયથી હૃદયનું થતું આત્મનિવેદન તો એક પ્રકારની શક્તિ પ્રગટાવે છે. તે આપણને વિશેષ જાગ્રત કરે છે. આપણી નિર્ભળતાને ચીધે છે. તેમાંથી સબળ બનવાની

પ્રેરણા આપે છે. જે બાબતનું આત્મનિવેદન આપણે કરતા હોઈએ, તે અંગેની સતત જાગૃતિ જે આપણામાં પ્રગટતી અનુભવાય તો તે આત્મનિવેદન સાચું પ્રમાણવું. જે બાબતનું નિવેદન થઈ શક્યું હોય તેવા એકરારમાંથી તો ફરીથી તેવું કર્મ ન બની શકે એવી જ્ઞાનયુક્ત જાગૃતિ પ્રગટવી ધટે; તો જ તે સાચો હદ્યનો એકરાર ગણાય.

(‘જીવનમંથન’, આ.ર., પૃ. ૧૫૦)

### આત્મનિવેદન

(શિખરિણી-મંદાકાન્તા)

વિના સંકોચે જે મન-હદ્યને ભાવથી ઠાલવે છે,  
ભલેને લાગે કે હદ્ય તમને ના પ્રભુ સાંભળે તે;  
હદ્ય કિંતુ જ્યારે ઝળહળ થતી ભાવના જગી ઊંડી  
—પરોવી કર્મ જ્યાં પ્રભુપદ ઢળે, સાંભળે તુર્ત શ્રીજ.  
કહેવામાં એને મન હદ્યથી સર્વ ખુલ્લાં થવાનું,  
કહેવામાં એને લળી લળી હદ્ય ભાવનું વ્યક્ત હોવું;  
કહેવાનું રાખો ચરણકમળે જે કર્યા સૌ કરો તે,  
વધારો એ રીતે પ્રિય પ્રભુ તણો પ્રેમ-સંબંધ હૈયે.

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૮૪)

તમારું જે જે કેં બનતું પ્રભુને આત્મભાવે નિવેદો,  
બધું આરોગાવી પછીથી ગ્રહજો તે પ્રસાદી જ રૂપે;  
અજીહું એને તો કશું ન ધરશો, ના ગમે એવું એને,  
ચખાડ્યા વિના તો હદ્ય પ્રભુને ના કશો સ્વાદ લેશો.

(‘જીવનપગલે’, આ.૧, પૃ. ૭૫)

\*

\*

### આહાર

ખોરાક-અન્ન એ સ્વાદને અર્થે નથી; ચેતનને અર્થે છે, ને

ચેતન તેમાંથી પ્રગટે છે તે અર્થે લેવાનું છે. તેમાં જેટલી વધુ શુદ્ધિ હોય તેટલું સારું જ છે. વળી ભોજન કે રસોઈ બને તે વેળા ઉત્તમ પ્રકારની શુદ્ધિથી, ભક્તિથી, પ્રાર્થનાભાવે તે બધું બને તો તે કલ્યાણકારી થાય છે. તે લેતાં પહેલાં અને લેતી વખતે પણ સતત ચેતનભાવે અને ચેતન કાજે તેને અનુરૂપ પ્રાર્થના સાથે ને પ્રાર્થનાભાવે તે લેવાનું હોય. ('જીવનપ્રેરણા', આ.૧, પૃ. ૮૨)

\* \* \*

જેમ અન્નની મદદ વડે પ્રાણ ટકે છે, તેવું પાછું અન્નને લીધે પ્રાણમાં અયોગ્યતા પણ પ્રગટે છે. ખોરાક કેટલો, કેવો અને કેમ લેવો એ પણ એક કળા છે. ખોરાક જીવનને ટકાવી રાખવા માટે, શક્તિ જાળવી રાખવા ને પ્રગટાવવા સારુ લેવાનો હોય, ને નહિ કે સ્વાદને ખાતર. ('જીવનમંથન', આ.૨, પૃ. ૨૬૩)

વિના કારણે ભોજનમાં જાગ્યા કશા ફેરફાર કરવાનું ન રાખવું. અત્યંત ખારું, ખાદું, તીખું-તમતમતું ને ઘણા બધા મસાલાવાળું ખાવાનું ન હોય તો ઉત્તમ. ખોરાક સહેલાઈથી પચી શકે તેવો સાઢો સારો. સામાન્ય રીતે બધા લોકો જેવું ખાતા હોય તેવું, એટલે આપણા દરરોજના ખોરાકમાં ઉપર મુજબનો જરાતરા ફેરફાર કરી લેવાને વાંધો ન હોય. મધ્યમ માર્ગ આપણા માટે સારો છે. ('જીવનપગરણ', આ.૨, પૃ. ૧૨૯)

\* \* \*

સૌથી ઉત્તમ તો જેવું મળે તેવું ખાઈ લેવાની ટેવ સાધક માટે ઉત્તમ ગણાય. ('જીવનપગથી', આ.૩, પૃ. ૪૬)

\* \* \*

સાધનામાં ખોરાક એ મુખ્ય નથી પણ જિજ્ઞાસા અને ખપી જવાની તમન્ના એ મોટામાં મોટી વાત છે; જોકે ખોરાક

શરૂઆતમાં થોડો ભાગ ભજવે છે ખરો, તોપણ એના ઉપર  
જરાયે જોર રાખવાની જરૂર નથી.

(‘જવનમંથન’, આ.૨, પૃ. ૨૬)

### એક

(અનુષ્ટુપ)

આખરે એક તો સર્વ, એકમાં સૌ સમાયેલું;  
એકથી સૌ પરિવ્યાપ્ત, છતાં કાં અન્ય લાગતું ?

આપણે એક તો પૂરા થયેલા ના બધાં વિષે,  
તેથી તો સર્વમાં એક દીસે આપણને ન તે.

એકમાં એક સંપૂર્ણ, એકથી એક એકમાં-  
એકાકાર થયા વિના જાણાયે કેમ એક ત્યાં ?

એકની આગળે શૂન્ય, શૂન્ય પહેલાં થવું પડે,  
થવાતું જાય છે જેમ શૂન્ય, એક ઝર્યાં કરે.  
નકારાત્મક જે માત્ર ભાવ, ‘શૂન્યે’ ન જાણશો,  
શૂન્યતામાં રહેલો છે એકનો ગર્ભ ગૂઢ શો !

(‘જવનપાથેય’, આ.૩, પૃ. ૧૪૩)

\*

\*

### શૂન્ય

(અનુષ્ટુપ)

‘કશુંયે જે ન કે’ એને લોક તો શૂન્ય કહે જગે,  
ભાવમાં ‘શૂન્યતા’નો તો એવો અર્થ ન સંભવે.

અભાવાત્મક ના જાણો શૂન્યતાને ભૂલેચૂકે,  
શૂન્યતા પ્રગટાવે છે ભાવ કો ઓર ગૂઢ તે !

પ્રેરક ભાવ તો શૂન્ય; શૂન્યની શક્તિ ઓર શું !  
 ‘ખાલી’માં શક્તિ શી ભવ્ય ! વિજ્ઞાને સિદ્ધ તે કર્યું.

ખાલી ના કૈ થવાયે છે એમનું એમ કોઈથી,  
 પૂરેપૂરો પુરુષાર્થ તે માટે કરવો પડે.

(‘જીવનપરાયન’, આ.ગી.બી.સી., પૃ. ૧૪૩-૧૪૪)

\* \* \*

### એકાશ્રય, સાધનામાં

જેને જેને સંત કહેવામાં કે ગણવામાં આવતા હોય, ત્યાં ત્યાં સાધકે બધે દોડવાનું હોય નહિ. જેમની સાથે કંઈક હૃદયનો સ્નિગ્ધ પરિચય હોય, ત્યાં એવું નિમિત્ત મળતાં જરૂર જવાય. તેમાં પછી સંકોચ ન રાખવો. તેવું મળવા જવાનું ઉમળકાથી પ્રેમભક્તિથી થવું ઘટે. તે ઉપરાંત હૃદયનો સહજ એવો જ્યાં ઉમળકો જાગે, તો ત્યાં પણ જવાય ને તેમાં પણ એક ચેતનાનું જ જીવતુંજાગતું લક્ષાબિંદુ હોય. હૃદયની સહજ ભક્તિ પ્રગટ્યા વિના સંત કે ઉચ્ચાત્માનું નિકટપણું જીવને આનંદભાવમાં પ્રવેશાવી શકતું નથી, ઊલટું એથી ગુંચવાડો પણ ઊભો થવા સંભવ રહે તો રહે. જુદા જુદા સંતોનાં નામ માત્ર સાંભળીને દોડવાનો અર્થ ના હોય.

ઉત્તમ પ્રકારના સાત્ત્વિક સાધુઓના જીવનની અમુક અમુક કક્ષામાં પણ Hierarchy-ઉત્તરોત્તર ચઢતી શ્રેણી હોઈ શકે છે. તેવાની કોઈક કક્ષાની અમુક ભૂમિકાઓમાં સ્પર્ધા પણ રહે છે અને તે પછીની ચઢિયાતી કક્ષામાંથી તો તેવી વૃત્તિ ઉત્કાંતિને પામી જતી હોય છે. (‘જીવનપ્રેરણા’, આ.ગી.બી.સી., પૃ. ૧૫૭-૧૫૮)

\* \* \*

પવિત્ર આત્માઓના સંપર્ક, સંબંધ અને પ્રેમમાં સાધક જેટલો રહે એટલું સારું છે; પણ તે વલણ જેટલું કેંદ્રિત થાએલી દણ્ણિવાળું

હોય તેટલું વધારે લાભદાયી છે. નહિ તો એટલા બધાની સાથેના સંપર્ક અને સંબંધમાં એની વૃત્તિ અને શક્તિ વેરવિખેર પણ થઈ જાય, વહેંચાએલી થઈ જાય, ‘બહુશાખા’ થઈ વિખરાઈ જાય અને એથી કરીને એનામાં ગોટાળો થવાનો સંભવ રહે.

(‘જીવનસંદેશ’, આ.૨, પૃ. ૪૫)

\*

\*

શ્રી...વર્જજ પાસે જવાનો વિચાર માંડી વાળવાનો કર્યો છે તો તે પણ ભલે. મનહદ્યથી એકને વળગતાં સાચી રીતે આવડયું હોય યા આવડી જાય તો ઉત્તમ છે. પણ અમારાથી એમ ન કહેવાય કે અમને એકલાને વળગી રહો. એથી ઊલટું જો કોઈ સાધકને એવી મડાગાંઠ હોય કે ગમે તેવો ઉચ્ચાત્મા હોય તો પણ જવું જ નહિ તો તેવી મડાગાંઠ તોડાવવાને કોઈકને મોકલવાનું પણ થાય; એમ પણ બને. (‘જીવનમંડાણ’, આ.૩, પૃ. ૧૭૬)

\*

\*

અમારા સિવાય એટલે કે અમારા હદ્ય સિવાય બીજા કશા વિષે પણ અમારું જે સ્વજન હોય તે કશો કંઈ પણ ગ્રેમ કે ભાવના ન ધરાવે તો તેવી સ્થિતિ તેના વિકાસને કાજે અમને ઘણી ગમે ખરી. અમે કદી અદેખા તો નથી જ.

\*

\*

‘સર્વ કંઈ ઈશ્વર કરાવે છે’; ‘ધાર્યું ધાર્યીનું થાય છે.’

સર્વ કંઈ ઈશ્વર કરાવે છે એ વાત તત્ત્વજ્ઞાનની દાખિએ સોએ સો ટકા સાચી છે; પરંતુ તે આપણે ત્યારે જ કહી શકીએ કે જ્યારે આપણે પળેપળ ભગવાનના જ ભાવમાં રહ્યાં કરતાં હોઈએ, દ્વંદ્વોની પાર ગયાં હોઈએ, અહ્મું પૂરો ઓગળી ગયો હોય, ત્રિગુણાતીત થયાં હોઈએ ને આપણે એના પૂર્ણપણે સચેતન યંત્ર બની ચૂક્યાં હોઈએ.

આપણાં મનમાં પસાર થતા અનેક વિચારો, આપણામાં ઉદ્ભવતી વૃત્તિઓ, આપજા ચિત્તના સંસ્કારો, આપજા આગ્રહો વગેરે જ્યાં સુધી મનમાં ડેક્ઝિયાં કરતાં હોય ત્યાં સુધી આપણાથી એમ ન કહેવાય કે એ બધું ભગવાન કરાવે છે, ‘જેમ એ કરાવશે એમ કરીશ,’ ‘બધું જ પ્રભુ કરાવે છે ને કરાવશે’—આવું બધું બોલવાનો કશો અર્થ નથી.

આપજા મનને, પ્રાણને, ચિત્તને, બુદ્ધિને, અહંના અનેક પ્રકારના વળાંકો વગેરેને આપણો જો પૂરેપૂરું સમજી ન શક્યાં હોઈએ તો પૂરું સમજી લેવું ઘટે. આપણો તો પ્રકૃતિના પ્રેર્યાં વર્તીએ છીએ ને આપણો અહમું આપણને ધકેલ્યાં કરતો હોય છે.

\* \* \*

શ્રીભગવાનને પંથે જેને જવું છે, એના બધા ભ્રમો ભાંગી જવા જોઈશે. ‘ધાર્યું તો ધણીનું થાય છે,’ આ સૂત્ર ને તેની ભાવના ઉત્તમ છે; પણ જીવમાત્રમાં જે ચૈતન રહેલું છે એ કંઈ નમાલું નથી, સર્વ કંઈ કરવાને શક્તિમાન છે. મરણિયો નિર્ધિર જો પ્રગટે છે તો પ્રભુકૃપાથી બધું થઈ શકે છે. લોક જેમાં ને તેમાં ઉપરનું કથન ને એવાં બીજાં કથનો ટાંકતાં હોય છે. આમ જે બોલે છે તેનામાં અહંકાર નથી હોતો એમ નહિ. જેનામાં સંપૂર્ણ જ્ઞાનભક્તિપૂર્વકની નમ્રતા પ્રગટેલી છે ને જેનું અહમું પૂરેપૂરું ઓગળી ગયેલું છે તેવો જીવાત્મા તેવું બોલે તો તે યોગ્ય ગણાય અથવા તો બહુ બહુ તો જે સાધક સંપૂર્ણ જ્ઞાનપૂર્વકની નમ્રતા કેળવવાનો જીવતોજાગતો સચ્ચાઈ ભરેલો અભ્યાસ કેળવે છે, તેવો જીવ નમ્રતા કેળવવાના હેતુથી એવું ઉચ્ચારે તો કંઈક યોગ્ય ગણાય. પરંતુ જેનામાં નર્યું અહમું ભર્યું છે ને જેને સાધનાની કશી ગતાગમ નથી, તે જો તેવું બોલે તો તે વદ્ધતોવ્યાધાત છે.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૧૫૮-૬૦)

\* \* \*

‘કર્તાહર્તા તો ભાઈ ! ભગવાન છે; એની મરજી પ્રમાણે  
બધું ચાલ્યાં કરે છે,’ એવું એવું બોલનારાં જગતમાં ઘણાં લોક  
નજરે પડે છે. તેવું બોલવું માત્ર ઉપરછલ્લું ને ખાલી ખાલી છે.  
જ્યાં સુધી ભાગવતજીવન જીવવાનો મરણિયો નિર્ધાર પ્રગટ્યો  
નથી, જ્યાં સુધી તેમાં યાહોમ કરીને સંપૂર્ણપણે ઝંપલાવવાની  
શક્યતા પ્રગટી નથી, જ્યાં સુધી આધારનાં નિભ કરણોના  
વળાંકોને પકડી પકડીને ટાળવાનું કર્યું નથી, ત્યાં સુધી ઉપર  
પ્રમાણે બોલવું ને તે પ્રમાણેની માન્યતામાં રહીને પ્રકૃતિવશ  
હુંમેશ વર્ત્યે જવું એને એક પ્રકારનો દંબ લેખી શકાય. કેટલાક  
એનો એમ પણ બચાવ કરતાં જોયા છે કે તે સમયે તેનો તેવો  
Mood-માનસિક વૃત્તિ-તરંગ હોય એટલે તેના પ્રવાહમાં તણાઈને  
બોલાતું હોય છે. તે ગમે તે હો. એમ બોલીને માનવી પોતાને  
કંઈ કરવું ન પડે એવા પ્રકારની છટકબારી શોધતો હોય છે.  
જીવને એવા પ્રકારનાં સંપૂર્ણ શ્રદ્ધા, વિશ્વાસ, ભક્તિ આદિ તો  
પ્રભુ પર પ્રગટેલાં હોતાં નથી ને બોલવા પ્રમાણેની નિષા તો છે  
નહિ એટલે એ નર્દો મિથ્યાચાર જ ગણાય.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૨૫૦)

\*

\*

### ઈશ્વર જ બધું સંભાળે છે ?

કેટલાંક જીવોને જરા પરમાત્મા તરફ વળવાની વૃત્તિ થાય  
છે ત્યારે—અને તે વૃત્તિ તમન્નાનું થોડું જોશ પકડે છે ત્યારે પણ—  
—એક વિચિત્ર મંતવ્યની પકડને લીધે તેમનો વિકાસ રૂધ્યાય છે,  
અથવા બહુ ધીમો થાય છે. પોતે હવે તો ભગવાનને શરણે ગયો  
છે, એટલે બાકીનું બધું સચરાચર પરમ ચૈતન્યશક્તિ સંભાળી  
લેશે અથવા લે છે અને હવે એણો તો ભગવાનમાં દઢ શ્રદ્ધા રાખ્યા  
સિવાય બીજું કશું કરવાનું નથી એમ તે કલ્યી લે છે.

આ માન્યતાની રાહે આગળ ચાલતાં ચાલતાં પોતે જે કંઈ કરે છે તે, અને પોતાથી જે કોઈ સંજોગોમાં આવવાનું થાય છે તે બધું ભગવાન જ કરાવે છે, અને પોતે તો એનું એક નિભિત્તમાત્ર છે એમ જીવ કલ્પવા માંડે છે. આવી માન્યતાથી જ સાધકમાં જે નમ્રતા હોવી જોઈએ તે પોતામાં આવે છે એમ તે માનવા માંડે છે. ‘ભગવાનની ઈશ્વરા વિના એક પાંદડું પણ હાલતું નથી,’ એવાં એવાં શ્રુતિવાક્યોનો, તથા અનેક સંતોષે એવો શરણભાવ રાખ્યો ત્યારે તેમની કસોટી તો થઈ, પણ તેમાંથે તેમણે શ્રદ્ધા કાયમ રાખી તો તેમનાં દુઃખો પરમાત્માએ ટાયાં; એવા પ્રસંગોનો પણ તે આધાર લે છે. એટલે તેઓની માફક પોતે પણ ભગવાનને શરણે ગયો છે એટલે ‘જે કંઈ સુખદુઃખ આવી પડે તે બધું સહી લેવું અને તે ભગવાને જ મોકલ્યું છે’ એવી માન્યતાને આધારે પોતાનું જીવન ઘડવાનો દેખીતો પ્રયાસ કરે છે.

પણ એવા સંતોની શરણાગતિમાં ને આવી પ્રાથમિક, પ્રારંભિક કક્ષાની કલ્પી લીધેલી શરણાગતિમાં ઘણો ફેર છે એટલે જ આવા સાધકને સોસવું પડે છે, ને તેની પ્રગતિ ધીમી થાય છે. આપણામાં કર્મના નિયમની ઉપરછલ્લી સમજણને લીધે જે એક જતની નિઃસત્ત્વ દૈવાધીનતા કદી કદી આવી જાય છે તેનો જ એક સ્વાંગ પ્રાથમિક કક્ષાના સાધકની ઉપરની કલ્પના કે માન્યતા છે.

આવી માન્યતાથી સાધક પોતે સાધક છે, ને સિદ્ધ નથી એ હીકિત ભૂલી જાય છે; અથવા તો તેનો ઈન્કાર કરે છે. “ઈશ્વર સર્વ કંઈનો કર્તાહર્તાં છે,” એ અંતિમ સત્ય તરીકે ભલે સાચું હોય અને છે, પણ સાધક જો પોતાનાં બધાં વર્તનમાં અને પોતાનાં બધાં સંજોગોમાં ઈશ્વર ઉપર જ જવાબદારી નાંખી દેશે તો તેથી એને જ નુકસાન થશે. માનવજીવનમાં તો એનાં અનેક પૂર્વકર્માને

પરિણામે પડેલા સંસ્કારો, તેની માન્યતાઓ, તેની લાગણીઓ, તેની બુદ્ધિનાં વલણો, તેના પ્રાણની વાસનાઓ, તેનો અહંકાર વગેરે કંઈ કંઈ અશુદ્ધ-નીચલા થરની પ્રકૃતિનાં તત્ત્વો અસર પાડ્યાં કરતાં હોય છે. કેટલીક અસરો તો એવી સૂક્ષ્મ અને છૂપી હોય છે કે તે પારખવા માટે પણ ભારે જાગૃતિની અને સાધનાની જરૂર રહે છે અને તે ભૂસી નાખવા તો વળી વધારે પરિશ્રમ ને ખંત જોઈએ છે. જેમ પથ્થરમાં પણ ઈશ્વરનો-ચેતનાશક્તિનો-આવિર્ભાવ છે ને માનવીમાં પણ છે, પણ બન્નેમાં ઘણો વાસ્તવિક ફરક છે; તેમ પ્રકૃતિનાં બધાં બળોમાં જો કે ચેતનાશક્તિ રહેલી જ છે તોપણ તેમાં ઘણો ફેર હોય છે. એટલે સાધકના દરેક કામમાં કે દરેક સંજોગમાં પરમાત્માનો પૂરો આવિર્ભાવ નથી હોતો પણ સાધકની પોતાની જ નિભ થરની પ્રકૃતિનો પણ આવિર્ભાવ સાથે સાથે હોય છે. આથી પ્રકૃતિના સ્વભાવથી કયું કામ તે કરે છે, તે શોધી કાઢવાનું સાધકને માટે ઘણું જરૂરી છે.

જે અંતિમ સત્ય છે તે સત્યનો અનુભવ કરી શકવાની કક્ષાએ પહોંચ્યાં પહેલાં તેવા અનુભવીનું અનુકરણ કરવું, કે તેવું કલ્પવું કે માનવું એ સાધકને માટે જોખમકારક છે. નવા નવા સંજોગો, વ્યક્તિઓ, સંબંધો, વિચારો-એ બધાંમાંથી જે નવજીત અનેક મથામણો ને ઠોકરો ખાઈને તેણે તારવવું જ પડશે, તે નવજીતની તારવણીમાં અને એવી માન્યતાથી વળી કેટલીક વધારે ઠોકરો ખાવી પડશે. પોતાની ભૂલ જ્યાં સુધી સૂજે નહિ, ત્યાં સુધી તેને નિવારવા કોઈ પણ તૈયાર થઈ શકતું નથી. દરેક સંજોગ એને શિખવવા માટે પ્રભુએ કૃપા કરીને આપ્યો છે અને એમાંથી એણે પોતાની પ્રકૃતિનું કઈ બાબતમાં રૂપાંતર કરવાનું છે, તે જોવા સદાય જગ્રત રહેવું પડશે, તેથી તેવી દાસ્તિએ તેણે તે સંજોગોને જોવા જોઈએ; તો જ પોતાનાં વર્તન, વાણી કે

વિચારમાં ક્યાં અકુશળતા છે, તેની તેને ખબર પડશે. શરણભાવ, સાચી રીતનો શરણભાવ, પણ એમ ને એમ મળતો નથી. તે પણ ભાવનાપૂર્વક, જ્ઞાનપૂર્વક પુરુષાર્થથી કેળવવો પડે છે. જેમ જેમ એનો સ્વભાવ, એની પ્રકૃતિ, પ્રભુભાવના સંચાર માટે લાયક થતી જાય છે તેમ તેમ જ એનો શરણભાવ વહે છે. તે પહેલાંનો શરણભાવ તો એક માન્યતા જ છે, જીવનની નક્કર હકીકત નહિ. એના પુરુષાર્થનું ફળ અપાવનાર ચૈતન્યશક્તિ જ છે એમ પાછું દ્વારાને, પુરુષાર્થના કારણે આવી જતા અહંભાવને એણે ટાળવાનો છે, એ વળી બીજો પ્રશ્ન છે.

પ્રભુ જરૂર એને સહાય કરવા ઉત્સુક હોય છે, પણ તે કલ્પે છે તે રીતે સહાય મળી શકે નહિ. પ્રભુનો ઉપદેશ જીવનમાં મળતા પ્રસંગો દ્વારા અપાય છે, અને અનેક જાતના અનુભવ કરાવીને તે ઉપદેશ પાકો કરાવવાનો તેનો હેતુ હોય છે, એટલે જ પોતાની ભૂલ ક્યાં થઈ તે જોવા આંખ તત્પર હોય તે જ અનુભવ ઉપરથી શીખી શકે.

સર્વ ભાવે ને સર્વ રીતે શરણાગતિની ભાવના જ્ઞાનપૂર્વક સાધકમાં પ્રગટે, એટલે કે જો તેના આધારનાં સર્વ કરણો સર્વ પ્રકારની શુદ્ધિને પામ્યાં હોય તો બાળક જેમ પ્રકૃતિવશાત્ર નિશ્ચિંતતાથી ને નિરાંતથી આનંદ માણતું માના ખોળામાં રહે તેવી, પણ પ્રજ્ઞાપૂર્વકની ભૂમિકા સાધકની બને તે વેળાએ—તેનું ‘ઈશ્વર બધું સંભાળો છે’—તે હકીકતે સાચું ઠરે છે. તેવી દશા થયા પહેલાં સાધકે તેવું માનવાની અમણામાં કદી પણ પડવું નહિ; પરંતુ તેમાં સર્વ પ્રકારનો ઝોક પ્રભુની કૃપાનો એકમાત્ર સહારો લઈને તેનાં સર્વ કરણોની શુદ્ધિ થાય તેમાં જ એકાગ્ર ને કુંદ્રિત હોવો ઘટે. (‘જીવનસંદેશ’, આ.ર, પૃ. ૧૮૦ થી ૧૮૩)

\*

\*

## ઉદાર માનસ

જેમ માનવીને ને પ્રભુને જોડનાર સૂક્ષ્મ દોરી પ્રભુકૃપા છે તેમ માનવી-માનવીને જોડનાર, સાંકળનાર, ઉદાર માનસ છે. પ્રેમ દુન્યવી જીવનમાં ઉદાર માનસના સ્વરૂપમાં અવતરે છે. કોઈની પણ વિશિષ્ટતાઓ, વિચિત્રતાઓ અને ઘૂણાજનક વિકૃતિઓ પણ પ્રેમથી સહન કરી લેવાની તાકાત ઉદાર માનસ વિના શક્ય ન બને, તે જ પ્રમાણે ઉદાર માનસ પણ પ્રેમ ન હોય તો અશક્ય બની જાય. આમ પ્રેમ અને ઉદાર માનસ પરસ્પરાવલંબી છે.

માનસિક ઉદારતા કે સહિષ્ણુતાનો અભ્યાસ આપણી સંકુચિત મનોદશાનો, સ્વાર્થવૃત્તિનો, મમત્વનો નાશ કરીને જીવન સાર્થક ને આનંદમય બનાવે છે. તે લાગણીઓના આવેશનનું નિયમન કરે છે. શ્રેયસ્કર, આનંદપ્રદ અસરો આપણામાં ઉપજાવે છે તેમ જ સંબંધમાં આવતાં જીવોમાં પણ નિપજાવે છે. સહિષ્ણુતા યાને માનસિક ઉદારતા જેટલા અંશે કેળવીશું તેટલા પ્રમાણમાં ભગવાનના યંત્ર બનવાની કિયામાં આપણે આપણી જાતને સહાયરૂપ બનીશું. આ ગુણથી બીજુ ઉચ્ચ ભાવનાઓ જીલી શકવાની ને તેમને આપણામાં ભેળવી દેવાની શક્તિ સાંપડે છે.

અન્યના સ્વભાવને, વાણીને, જીવનદર્શિને, લાગણીને, માનસને, જીવનવ્યવહારને ટૂંકમાં અન્યના સમગ્ર વ્યક્તિત્વને સન્માન આપવું એનું નામ હૃદય-સૌજન્ય અથવા માનસિક ઉદારતા. જેટલા પ્રમાણમાં સાધકનો આત્મવિકાસ સધાર્યો હશે, તેટલા પ્રમાણમાં આ ગુણ તેનામાં મોખરે આવ્યો હશે. જીવનવિકાસની એ એક પારાશીશી પણ બની રહે છે.

માનસિક ઉદારતા હોવી એટલે બીજાના દોષોને અપનાવી લેવા એ અર્થ નથી. અનિષ્ટ પ્રત્યે ઉદાર મન એટલે તેની ઉપેક્ષા. પણ જો બીજાંઓ આપણા જીવનવિકાસની આડે આવી ઊભાં રહે તો તેમને નમી પડવું, ને તાબે થઈ જવું એ આ ગુણનું લક્ષણ નથી; ત્યારે તો શાંત, સબળ ને સફળ મક્કમ વિરોધ કરવો એ ઉદારભાવનું લક્ષણ છે. તે સાથે સાથે અનિષ્ટ ઈચ્છા કે કરવા પ્રયત્ન કરનાર પ્રતિ ત્યારે જો તિરસ્કારની કે એવી કોઈ વૃત્તિ રહી તો ઉદાર ભાવનો લોપ થયો સમજવો. આ ભાવ જેના પ્રતિ રખાયો હોય તેનું પણ કલ્યાણ સાધે છે.

કેટલાક એમ માને છે કે ન્યાયપ્રિય માનવીને આવો ઉદારભાવ રાખવો પાલવી શકે નહિ. આ ભૂલ છે; કેમ કે માનવસમુદ્દાયમાં દસ્તિએ પડતાં સત્ય, સૌંદર્ય અને સૌજન્યના અનેક આકારો અને પ્રકારોમાં રહેલો ગુપ્ત સુમેળ જોવો ને સાધવો એ સાચી ન્યાયપ્રિયતાનું લક્ષણ છે. માનવીજીવનની પ્રત્યેક દિશામાં અમુક મર્યાદા તો રહેવાની જ. તેની અવગાણના કરવી તે હિતકર નથી; પણ તેને સમજીને સહજભાવે નિભાવી લેવી એ સાચી ન્યાયપ્રિયતા છે. માનવીની અનેક પરિમિતતાઓને, વિચિત્રતાઓને ભગવાન સહી લે છે. ભગવાનની સૃષ્ટિનો મધ્યાક્ષનો સૂર્ય તે પ્રખર તેજસ્વી પ્રેમ છે તો ઉદાર ભાવ એ એનો ઉષા:કાળ છે. એને સૌ કોઈ, ઈચ્છે તો, નિહાળી શકે અને એમાં રાચી શકે.

હાઇક ઉદારતા બધાનું શાંતિથી સાંભળે છે, સમજવા માગે છે; તદ્દન વિરોધી દસ્તિબિંદુની પણ કદર કરવા મથે છે.

(‘જીવનસંદેશ’, આ.ર, પૃ. ૧૩૨ થી ૧૪૦)

\*

\*

## ઉર્મિનો સદ્ગુપ્યોગ

(અનુષ્ટુપ)

હૈથાની વેદના ઉંડી ભલે જાણો ન કોઈ છો,  
વેદનાથી ઉંડો ભાવ શક્તિ જો પ્રગટાવશો-  
વેદના તેવી તો કેવું અલત્ય કામ આપશે !  
કલ્યાણમૂળ એ એવી, જેને તે વેદના થશે.

ઉંડો આધાત જ્યાં લાગે ભાવના તેથી જન્મશે,  
ભાવના જોમને ત્યારે જોતરો સાધના વિષે.

કશાથીયે હદે ઉર્મિ જાગતાં કર્મ-સાધને,  
વાપરી દેવી તે યોગ્ય, ઉપભોગ કરો ન તે.

ઉર્મિ તે શક્તિનું રૂપ આડફંટે લગાડતાં,  
જાગૃતિ ચેતના ઓછી આપણી જાણજો તદા.

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૬૮)

ઉર્મિ કે લાગણી, પ્રેમ, ભાવના, ભાવ સૌબધું,  
શક્તિ તે, કામ લેવાને આપણે જાણવું રહ્યું.

તેના સર્જક તો પોતે એવું ભાન રહ્યાં જતે,  
સ્વતંત્ર ચેતના-શક્તિ આનંદ માણશે હદે.

કશું ના ભોગવી લેવું પોતાના ઉપભોગમાં,  
આનંદ જે મળે તેને વાપરો શક્તિ સર્જવા.

(‘જીવનપગલે’, આ.૧, પૃ. ૨૦)

\*

\*

ઉર્મિ તો શક્તિનું રૂપ નકામી ના કદી ગણો,  
વાખ્યાં જે કરશે ધ્યેય લ્હાણ તે પામશે ખરો.

ଓરିଂ ଜେ ଶକ୍ତିନୀ ନାନୀ କେଵି ତେ ତୋ ଲହେର ଛେ.

ପିଛାନୀ ଶକ୍ତିରୁପେ ତ୍ୟାଂ ଏବି ଵାପରବୀ ଧଟେ.

(‘କର୍ମଗାଥା’, ଆ.୧, ପୃ. ୭୩)

\*

\*

### ଉଂଘ-ନିଦ୍ରା

ସାଧକନୀ ନିଦ୍ରା ନରୀ ଜଡ଼ତାଵାଣୀ ନ ହୋବି ଜୋଈଅେ.  
ତେମାନୀ ସ୍ଥୁଣ୍ଟା ଘଟତୀ ଜଵି ଧଟେ. ନିଦ୍ରାମାଂ ପଣ ଜାଗ୍ରତ ଦଶା  
ପ୍ରଗାଢ଼ୀ ଶକେ ଛେ. ଉଂଘତାଂ ହୋବା ଛତାଂ ଅନ୍ତରମାଂ ଜାଗୃତି ହୋଈ ଶକେ  
ଛେ. ଆ ପଣ ପୂର୍ବତୁଂ ନଥି. ଉଂଘ ପରନୋ ସଂପୂର୍ଣ୍ଣ ଜ୍ଵତୋ କାବୁ  
ଏନେ ଆବି ଜବୋ ଜୋଈଅେ ଛେ; ଏନୋ ଏ ଅର୍ଥ ନଥି କେ ଏ ଧାରେ  
ତ୍ୟାରେ ଉଂଘୀ ଶକେ ନେ ଧାରେ ତ୍ୟାରେ ଉଠି ଶକେ—ଜେ କେ ଏ ପଣ  
ନିଦ୍ରା ପରନା କାବୁନୋ ଏକ ଗୌଣ ପ୍ରକାର ଛେ. ସାଧନାନା ଗାଣାମାଂ  
ଏବୋ କାଣ ପଣ ପ୍ରଗଟେ ଛେ କେ ଜ୍ୟାରେ ଉଂଘ ସମୂହଗୀ ପଣ ଜତି  
ରହେ ଛେ; ଅଲବତ୍ ତେ କୋଈ ରୋଗନେ କାରଣେ ନାହିଁ.

(‘ଜ୍ଵନପୋକାର’, ଆ.୪, ପୃ. ୧୦୩)

\*

\*

ଉଂଘନୋ ପ୍ରକାର ସାଧନାନୀ ପାରାଶିଶୀନୁ ଏକ ଲକ୍ଷାଣ ବନୀ ଶକେ  
ଛେ. ଜେ ପ୍ରକାରନୁ କର୍ମ କରତା ହୋଈଅେ ତେନା ପର ଉଂଘନୋ ଆଧାର ଛେ.  
ଜ୍ଞାନତଂତ୍ରାନେ ଯେଣ୍ୟ ଜ୍ୟାଂ ବଧୁ ରହେ ତେବୀ ଦିଵସନୀ ଜେନୀ ପ୍ରଵୃତ୍ତି ହୋଯ  
ତେନେ ୭ ଥି ୮ କଲାକ ପଣ ଉଂଘ ଜରୁରୀ ବନୀ ରହେ. ଜ୍ୟାରେ ଜେ ପ୍ରକାରନା  
କର୍ମମାଂ ଶାଂତି, ପ୍ରସନ୍ନତା ହୋଯ, ସମତା ହୋଯ, ବ୍ୟଵସ୍ଥିତି ଅନେ  
ସୁବ୍ୟଵସ୍ଥିତପଣ୍ଡୁ ବଧୁ ହୋଯ, ରାଗଦେଖ ନ ହୋଯ, କାମ, କୋଧ ଆଦି  
ପ୍ରାଣନୀ ପ୍ରଵୃତ୍ତି ନ ହୋଯ, ଅହଙ୍କାରଥୀ ଭରେଲାଂ କର୍ମ ନ ହୋଯ; ତେବାଂ  
ପ୍ରକାରନାଂ କର୍ମ ଜେ ଜୀବଥୀ ଥତାଂ ହୋଯ ତେବାନେ ଉଂଘ ୪ ଥି ୫ କଲାକ ପଣ  
ବସ ଥାଏ ରହେ. ଜେ ଜୀବନୁ ରୋଜିଂଦୁ ଏକଧାରୁ ସତତ ମନନଚିନ୍ତନ  
ସାତ୍ତ୍ଵିକ ପ୍ରକାରନୁ ଛେ, ତେନୀ ଉଂଘ ତେ ତେନାଥୀ ପଣ ଓଛା କଲାକନୀ

સંભવી શકે છે. કેટલીક વાર અત્યંત ઉશ્કેરાટથી પણ મુદ્દલે યા ઓછી ઉંઘ થઈ જાય છે. જે જીવને ઓછામાં ઓછી ઉંઘથી પોતાના જ્ઞાનતંતુનું સમારકામ—ગ્રંગાટી ગયેલા સાત્ત્વિક ગુણોને લીધે—થએલું અનુભવાય છે, તેવા જીવને ઉત્તમ પ્રકારનો જાણવો. ઉંઘ એ જ્ઞાનતંતુના સમારકામ માટે છે.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૨૩૭-૩૮)

\*

\*

ઉંઘના માત્ર કલાક, બળપૂર્વક ઘટાડવાથી ફાયદો નહિ થાય, એટલું જ નહિ પણ બગાડો થશે. તેના કરતાં તો દિનભર શાંતિ, પ્રસન્નતા, અંતર્મુખતા આદિ દૈવી ગુણોની વૃદ્ધિ તથા મનનચિંતન પ્રતિ ખાસ ધ્યાન દેવાવું જોઈએ. તમસ અને રજસ પ્રકારનું ગુણનું ધોરણ ઘટીને સાત્ત્વિક પ્રકારનું પ્રગટે તેમ કરવું જોઈએ. આવું બધું કરવાથી ઉંઘમાં જે ફેરફાર થશે તે ઉત્તમ હશે. જેના આધારની સમગ્ર ભૂમિકા પ્રભુમય દશામાં પ્રગટવા માંડી છે, પ્રભુ પર જેનાં શ્રદ્ધા, વિશ્વાસ અટલ છે ને જેના જીવનમાં તે પરત્વેની એકાગ્રતા પ્રગટેલી છે, તેવાને પણ ઉંઘ સાત્ત્વિક પ્રકારે ઓછી હોઈ શકે છે. જીવનમાં સંપૂર્ણપણે આત્મનિષ્ઠાનો ભાવ પ્રગટી જાય છે, ત્યારે ઉંઘનો સ્થૂળ પ્રકાર સંપૂર્ણ બદલાઈ જાય છે. એ ઉંઘતો હોવા છતાં ઉંઘતો નથી.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૨૩૯-૪૦)

\*

\*

કેટલાકની શરીરપ્રકૃતિ જ એવી હોય કે આહારની જેમ ઉંઘ ઓછી યા વધતી હોય. આ કારણથી સાધકે ઉંઘની બાબતમાં સ્થૂળપણે વિચારવાનું કર્યા કરતાં પોતે પોતાના રોજિંદા જીવનમાં ભગવાનના ભાવને કેટલો વધારે સમય ધારણ કરી શક્યો છે, તે

એની આગળ એક ભારે મહત્વનો વિષય હોવો ઘટે.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૨૪૦)

\*

\*

ઉંઘ પર જેનો ચેતનપૂર્વકનો સંયમ પ્રગટે છે, તે ઉધ્વરિતસ્થ થઈ શકે છે, એટલે કે એવા પ્રકારની સંભવિતતા એનામાં જન્મે છે. ઉંઘની જરૂર શરીરને છે. જ્યારે સતત ગંગાના પ્રવાહના જેવા ભાવપ્રવાહમાં જ્ઞાનપૂર્વક આપણી જીવનધારા પ્રગટતી હોય છે, ત્યારે શરીરનું સ્થૂળપણું તેમાં વચ્ચે આવી શકતું નથી. જ્યારે ભાવ જાગતો કે જાગેલો હોય છે, ત્યારે અમુક કાળ પૂરતી ઉંઘ મુદ્દલે પણ ન હોય એવું બને ખરું. ઘણી આગળની કક્ષામાં ઉંઘ વેળા નસકોરાં પણ બોલતાં હોય, શરીર પણ નિશ્ચેષપણે પડેલું હોય, પણ માંદીથી જાગૃતિ રહ્યાં કરતી હોય એમ પણ શક્ય બને છે. તે પછીથી તો ઉંઘ ઘણી જાણે ગાઢી હોય ને મડદાના જેવી ઉંઘ પણ હોય, તેમ છતાં માંહેલી ચેતનયુક્ત જાગૃતિ તો જીવતીજાગતી જ હોય તેમ પણ બનતું હોય છે.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૧૪૧)

\*

\*

સાધના કરતી વેળા ઉંઘ આવી જાય છે, તેનું કારણ તો એટલું જ કે હજુ આપણને આપણી ઈચ્છાશક્તિનો યોગ્ય ઉપયોગ કરતાં આવજ્યું નથી. જેમ ચચ્ચુની કે તલવારની ધાર ઘણી વાર વાપર્યે જળવાઈ રહે છે તેમ આપણે આપણી ઈચ્છાશક્તિનો, સંકલ્પબળનો સાધનામાં ઉપયોગ કરીશું અને આપણી ભાવનાનો વિકાસ થાય એ હેતુના ખ્યાલ સાથે તેનો નિત્યના વ્યવહારમાં પણ ઉપયોગ કરતાં રહીશું તો સાધના કરતાં કરતાં જે ઉંઘ આવે છે તેને આપણે અટકાવી શકીશું.

(‘જીવનપગથી’, આ.ર, પૃ. ૧૪૧)

તને હમણાંની ઉંઘ ઘણી વધારે આવે છે, તેનું કારણ આળસ અને તમસ ગણાય. તારી ઘટનામાં ઉંઘનું કારણ શરીર જણાય છે. અત્યંત તામસિક જડતાને કારણો પણ ઉંઘનો એવો હુમલો હોય અથવા તો જ્ઞાનતંતુઓની નબળાઈ થઈ જવાથી પણ કેટલાકને તેમ બને ખરું. કેટલાકની બાબતમાં તેમની અમુક સહજ ફુદરતી વૃત્તિઓને દબાવવાનું બનતું હોય અથવા તેનું જે પ્રકારનું સહજ બ્યક્ત થવાપણું હોય, તેવી રીતે તે ના થતું હોય અને તેથી કરીને એક પ્રકારની વિકૃતિ પણ થાય છે, તેને પરિણામે પણ ઉંઘ વિશેષ આવતી હોય છે. ('જીવનસોપાન', આ. ૧, પૃ. ૬૬-૬૭)

\* \* \*

### કર્મસાધનાના મુદ્દાઓ

(૧) સતત પ્રભુસ્મરણ સાથે ભાવનાને કર્મમાં ઉતાર્યા કરવી ઘટે, કે જેથી ભાવના વધુ ને વધુ જીવલંત, પ્રાણવાન, ચેતનપ્રદ ને ધ્યેયની જંખનાવાળી સાકાર બનતી જાય.

(૨) તે તે કર્મની પાછળ આપણી સાથે 'કોઈક' ઊભું છે, એવી અનુભવથી નિષા સાધકની કેળવાતી જતી હોવી જોઈએ.

(૩) તે તે કર્મના, ઓછામાં ઓછું, આદિ, મધ્ય ને અંતમાં સમર્પણની ભાવના જીવતી રહેવી ઘટે.

(૪) તે તે કર્મના ફળ કે પરિણામની તો આશા સાધક કદી સેવે જ નહિ,—એનો અર્થ એમ નથી કે પરિણામ નથી. કર્મના કર્તૃત્વપણાનો ઘ્યાલ પણ જવો જોઈશે.

(૫) કર્મ માત્ર સ્વ-જીવનના વિકાસાર્થે મળેલું છે. ઘડાવાની ને ભાવનાને સાકાર કરવાની તક રૂપે તે છે. બીજા કોઈના ઘ્યાલ તેમાં ન હોય; બીજું તો ત્યાં નિમિત્તમાત્ર છે.

(૬) તે તે કર્મ કરતાં પહેલાં કે પછી એના વિચારો ન ઉદ્ભવવા જોઈએ; આવે તો મનને સમજાવીને એનાં કારણો

તપાસવાં ઘટે ને પછી તેમાંથી મુક્ત થઈ જવું જોઈએ. કર્મ કરતાં જે આપણી ઉણપો, દોષો વર્તય તેમાંથી, વેળાસર મોકણા થઈ જવાનો દઢ નિર્ણય પ્રગટી જાય.

(૭) તે તે કર્મ વેળા તે આત્મકલ્યાણાર્થે જ થયાં કરે છે ને પ્રભુનું કામ હોઈ આપણું રૂપાંતર થવા માટે છે, એ ભાવ સતત રહેવો જોઈએ. કર્મ કરતાં કરતાં જો આપણું રૂપાંતર ન સધાયાં જતું હોય તો તે કર્મનો આપણા માટે કંઈ અર્થ સરતો નથી.

(૮) કર્મમાં તાદાત્યતા હોવી એ એક વાત છે ને તેમાં દૂબી જવાપણું હોવું, તે જુદી વાત છે. દૂબી જવાપણામાં સ્વભાવવશ વર્તન છે. જ્યારે તાદાત્યતામાં જ્ઞાનપૂર્વકની જાગૃત ચેતના રહેતી હોઈ આપણે તે પ્રગટાવવાની છે.

(૯) કર્મમાં ધાંધલિયાપણું, રઘવાટ, ઝટ અંત આણવાની અધીરાઈ, યદ્વાતદ્વાપણું, અશાંતિ, અવ્યવસ્થિતિ, બોજો લાગવાપણું, ઉડ્જૂડિયાપણું, શુષ્કતાપણું, બેળે-બેળેપણું, બેપરવાપણું, બેદરકારીપણું, બીજાં કામોનો માથે ભાર ત્યારે હોવાપણું આદિ મુદ્દલે ન હોવાં જોઈએ.

(૧૦) જે જે કર્મ કરવાનું હોય એના હાઈનો ને સર્વાંગીપણાનો તાદેશ ઘ્યાલ સાધકને જાગી જવો જોઈશે. તે તે કર્મ સાથેનું જે જે સંંગપણે થવાનું કે જાળવવાનું હોય તે બધું તે કર્મ સાથે થવાવું કે જાળવવું જોઈએ, નહિતર તે કર્મ બધાં અધૂરાં થયાં જ કરવાનાં.

(૧૧) જે તે કર્મમાં સાધકે વિવેકશક્તિ, બુદ્ધિ, સમતોલપણું, તાટસ્થ્ય, આયોજન, નિયોજન, આકલનશક્તિ આદિ બધાંનો ઉપયોગ કર્યો કરવો જોઈશે.

(‘જીવનપાથેય’, આ.૩, પૃ. ૬૨ થી ૬૮)

\*

\*

## કર્મ-મહિમા

(અનુષ્ટુપ)

કામ તો આદ્ય શક્તિ છે, ચેતના-શક્તિ કામ છે,  
કામ તો પ્રાણદાતા છે કામથી કામ સૌ રળે.

કામ દાક્ષિણ્ય પ્રેરે છે જીવને શું રસાત્મક !  
કામ ઔચિત્યનું ભાન જગાડે ભાવપ્રેરક.

સૂક્ષ્મતા બુદ્ધિમાં આવે કામ યોગ્ય કર્યા કર્યે,  
કર્મ-કૌશલ્ય જન્મે છે કામ સદ્ગ્રાવથી કર્યે.

કામ તે કામ ના ખાલી જીવન પ્રેરનારું તે,  
કામ ના હોત તો ક્યાંથી હોત આ ઘટમાળયે !

કામ તો કામધેનું છે કર્મ કલ્પતરુ ખરે;  
કર્મમાં હેતુનું જ્ઞાન જે રાખે શ્રેય મેળવે.

રૂડા પ્રસંગ શા દે છે કર્મ જીવનમાં સદા !  
કર્મથી જે મળે બોધ બીજાંથી તે મળે જ ના.

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૧૮૪-૮૫-૮૭)  
(વસંતતિલકા)

ના હોત કામ, જગ થાત પ્રવેશ કેમ ?

ના હોત કામ મળતે કહીંથી જ વેગ ?

ના હોત કામ સ્ફુરતે ઉર - પ્રાણ ક્યાંથી ?

ના હોત કામ જગ હોત ન પંડ પોતે.

એ કામ એક કણથી કંઈ લાખ આપે,

એ કામ પથ્થર થકી પ્રભુ-મૂર્તિ થાપે.

છે કામ ઉર્મિ, રસ, રંગ જમાવનારું,

છે કામ શક્તિપ્રદ ચેતન પ્રેરનારું.

જો કામ છે, બધુંય છે, નવ કર્મ, કેં ના,  
આધાર કામ હૃદમાં સહુ રીત પ્રોવા;  
છે કામ સાધન જ પ્રકૃતિ જાણવાને  
છે કામ ભાવ પ્રભુનો જગ રેલવાને.

જ કામ ચિત્ત, મન બુદ્ધિ શમાવવાને,  
તે કામ અંગ સહુ ચેતન ધારવાને.

છે કામ દિવ્ય પ્રભુ ! આહુતિ યજની જે,  
તે કામ જ્ઞાન પ્રભુભક્તિ કરાવવાને.

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૪૮ થી ૫૧)  
(અનુષ્ટુપ)

કામ પ્રત્યક્ષ શાળા શી પોતાને ઘડવા તણી !  
કામમાં દાણ ને વૃત્તિ એવી સંપૂર્ણ રાખવી.

જીવતોજાગતો કોઈ ગુરુ જો હોય ક્યાંય તો,  
કામ પોતે જ એવો છે સર્વોત્કૃષ્ટ ગુરુ ખરો.

કામથી વિશ્વ જન્મે છે કામ વિશ્વ સમાય છે,  
પોષાતું કામથી વિશ્વ કેવું, અદ્ભુત કામ તે !

ચેતનાશક્તિ પ્રેરાવે ઊંડી જીવનમાં સદા,  
સંધાવે ચેતના-તાર કામ શા એકમેકમાં !

પ્રદેશ એકથી એક જુદા કામ બતાવતું,  
'મનોદશા શી પોતાની' કામથી સૂર્જી આવતું.

કામને સાધનારૂપે ગાડી જે કામને કરે,  
અવતાર નવો એનો જન્માવે કર્મ નિશ્ચયે.

કામ આકાર દેવાને, ચેતના-શક્તિ કાજ છે,  
શું પરાત્પર છે કર્મ ! કામ તો વ્યક્ત ઈશ છે.

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૧૮૭-૮૮-૮૯-૨૧૪)

## કર્મ-સાધના

સાધકે કર્મને માત્ર કર્મ તરીકે જોવાનું, ગણવાનું નથી. તે કર્મ કરતાં કરતાં આપણી ભાવના કેવા પ્રકારની જીવતી રહે છે, તે મુખ્ય બાબત છે. આથી કર્મને કરતી વેળા હૃદયમાં ભાવનાનો ઓઘ ઉિછળતો રહે, આનંદ પ્રગટ્યા કરે, કર્મના સંપર્કને ને સંબંધને લઈને જે જે સ્વજનોના અને વ્યક્તિઓના સમાગમમાં આવીએ તેમની પરતે હૃદયનો સમભાવ કેળવીએ. સદ્ગ્રાવમાં સર્વ સાથે વર્તી શકીએ તો કર્મ કરવામાંથી આપણો જીવનવિકાસ સધાયે જવાનો છે. કર્મને શુષ્ણપણે કરવાથી તો જીવન ઉિલટું કચડાવાનું છે.

('જીવનસોપાન', આ.૧, પૃ. ૧૬૮)

\*

\*

આ જીવનમાં જે જે મળેલાં છે, તે આપણાં પોતાનાં જ કર્મવલણને અંગે મળેલાં છે. તે જીવો સાથે આ જન્મે પણ તેવા સ્વભાવે જ જો વર્તવાનું બન્યું તો તે પાછું ઉભું રહેવાનું. એની અનંતતાનો કદી પાર ન આવે. તે બધાં મળેલાં છે કર્મગ્રારબ્ધ પૂરું કરાવવા એમ સમજીને તેમની સાથે જીવસ્વભાવે ન વર્તતાં ભગવાનધારણાએ તેમની સેવા એ ભગવાનની સેવાભક્તિ છે; એવા પ્રકારની જ્ઞાનભક્તિપૂર્વકની જીવતી ધારણા રાખીને વર્તાયાં કરાય તો આપણા જીવનની ગતિ ઉંચી થયાં કરે. સંસાર તપશ્ચયાની યોગ્ય ભૂમિકારૂપે આપણને મળ્યો છે. સંસાર સાંસારિક રીતિએ જીવવાનો ન હોય, પરંતુ જીવનવિકાસની ભૂમિકારૂપે એનો જ્ઞાનપૂર્વક ઉપયોગ કર્યા કરવાનું બને તો જીવનું કલ્યાણ જ છે. કલ્યાણ ક્યાંયે બહાર નથી.

\*

\*

કર્મમાત્ર છે જીવનને પ્રેરકપણે ઉઠાડવા કાજે, ચેતાવવા કાજે; પછી તે કર્મ નાનું હોય કે મોટું હો. તેના પ્રકાર સાથે નિસ્બત ન હોય. કર્મને એવી રીતે કરવાનાં હોય કે જેથી દુંદ્રાત્મક વૃત્તિઓ મોળી પડે. કર્મમાં પોતાનામાં શક્તિ નથી, પરંતુ કર્મ કરતી પણ એ કર્મના હેતુનું પ્રાગટ્ય તેમાં પ્રગટાવીને તેમાં જે ભાવના રેડાય છે, તે ભાવનામાં શક્તિ રહેલી છે.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૬૦-૬૧)

\*

\*

સદ્ગુરુ તરફથી આપણા ભાગે આવેલું કાર્ય હૃદયના ઉમળકાથી, ઉમંગથી, આનંદથી જો ન કરી શકાયું તો તો પછી એમનું લાખો ગણું કામ કર્યા છતાં તે આપણા વિકાસાર્થે કશા જ ઉપયોગનું નીવડવાનું નથી. પોતાના સ્વભાવ ને પ્રકૃતિની રીતે કર્મ કર્યા કરવાથી ઊંચે પ્રગટી શકાવાનું નથી; પરંતુ તે કર્મ સદ્ગુરુનું કર્મ સમજીને તેવા કર્મમાં જ્ઞાનપૂર્વક ઉત્તમ કળા પ્રગટાવીને, સાંગોપાંગ પાર ઉતારીને તે બધું પાછું પ્રેમભાવે એને જ સમર્પણ કર્યા કરવાનું જીવતું ભાન પ્રગટાવીએ, તો તેવાં સૌંપાયેલાં કર્મ પણ યજ્ઞસ્વરૂપે પ્રગટ્યાં કરે; ને એવી રીતે ને એવી ભાવનાએ કરાયેલાં યજ્ઞકર્મ જીવનની પ્રકૃતિને પલટાવવાને શક્તિસ્વરૂપે બની જતાં હોય છે.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૧૬૦-૬૧)

\*

\*

### કર્મ-સાધના (અનુષ્ટુપ)

નિરાણું આપણું કામ બધાંયે કામથી ઊંદું,  
થતાં સૌ કર્મમાં એને આપણે પામવું રહ્યું;

થતું હોય નહીં જો તે, કર્મ તો કર્મ-બંધન,  
દેખીતું શ્રેષ્ઠ છો હોય, આપણા કામનું નથી.

(‘જીવનપગલે’, આ.૧, પૃ. ૨૧)

‘જે જે કામો કરો તે તે પ્રભુની શક્તિથી કરો,’  
હુદે સૌ ધારણા એવી જીવતી ત્યાં જગાડજો.  
જે જે કામો કરંતા હો પ્રભુને કાજ સૌ થતાં,  
દિવ્ય ઊંડો હુદે ભાવ ધર્યા જવો જ કર્મમાં.  
ખાલી ખાલી હુદે એવું ધારવાનું ન તે કરો,  
કિંતુ તે ધારણામાંહી ચેતના-પ્રાણ આણશો.  
એકલું કોરું તે કર્મ કર્યા જો કરશો તમે,  
પ્રકૃતિનું તમોમાંની તો રૂપાંતર ના થશો.

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૧૦૧-૦૨)

જે જે સૌ મળે છે તે કર્મનું પરિણામ છે,  
કર્મને તરછોડચાથી કર્મ ના છૂટી જાય છે;  
કિંતુ જે કર્મને એનાં હોય જે વલણો વડે  
—ભોગવે કર્મને, પાછું વધાર્યા ઉલટું કરે.  
કર્મનાં વલણોને જે જીવને રચનાત્મકે  
—વાળવાનું કરે, તેવો મેળવે કર્મ-તત્ત્વને.  
તાટસ્થ્ય, સ્થિરતા, હૈયે શાંતિ, ઊંડી પ્રસન્નતા,  
સર્વ કર્મ કરાતાં ત્યાં રે'વાં ઘટે પૂરેપૂરાં.  
ઘણાં કામ ભલેને હો લાગવા ભાર ધો ન ત્યાં,  
એક એક કરીને સૌ પાડવાં પાર તે પૂરાં.

નિશ્ચળ, નિશ્ચયી ખંત ધાર્યા ઊંડી કરો હુદે,  
જીત્યા વિના કશુંયે તે મૂકી દેવું ન આપણે.

શક્તિ ને પ્રેમનો ભાવ સાધનાથી જો ન વધે,  
ઘરેડની પ્રમાણે તો થયાં કરેલું જાણજો.

(‘જીવનપગલે’, આ.૧, પૃ. ૩૮, ૮૫, ૮૬, ૮૭)

જાણવાં સર્વ કર્માને ભૂમિકાને દ્રબ્દાવવા,  
તે રીતે જીવને કર્મ રે'વું આચરતાં બધાં.

(‘જીવનપગલે’, આ.૧, પૃ. ૧૧૦)

(વસંતતિલકા)

ના કામ મુખ્ય, પણ કામની ભાવના છે,  
એ સૂરને સતત જાળવી રાખ હૈયે;  
છે ભાવની બઢતી કાજ જ કામ સર્વ,  
એ લક્ષ ચિત્ત ધરી કામ કરો બધાંય.

સૌ કામ છો પણ કરો, નવ રાગ રાખો,  
તે તે થતાં હુદયમાંહિ તટસ્થ વત્તો;  
થાતાં, થયા પછી, અને પહેલાંય વત્તો  
-જાણે ન હોય મન કાંઈ જ લેવુંદેવું.

‘સર્વસ્વ શક્તિ મુજ નિશ્ચય વાપરીશ,  
ધાર્યું ગમે ત્યમ કરી પણ મેળવીશ;’  
વિશ્વાસ એમ હુદયે દ્રદ કેળવીને,  
આગે બઢ્યા નિત કરો નિજ કામ સાથે  
ધ્યેય-લક્ષ્યે.

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૧૬૩)

(અનુષ્ઠાપ)

કર્મ પ્રયોગની શાળા જ્ઞાન ઉદ્ભાવવા હુદે,  
કર્મ પ્રયોગશાળા છે

કર્મને આચરે જે કો એ રીતે, જ્ઞાન મેળવે.

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૧૬૩)

### કર્મમાં સારાનરસાપણું

શરીર રહે છે ત્યાં સુધી એને સારું તેમ જ નરસું કર્મ, બન્ને  
પ્રકારનાં કર્મ, મય્યાં કરવાનાં. બન્નેમાં સાધકે ધારણા તો પોતાની  
ભાવના-સમજણાની જ કર્યા કરવાની છે. ન તો સારાને જોવાનું  
છે કે ન તો નરતાને. તે બન્ને માત્ર ગુણની લીલા છે. તેવાં કર્મ  
જીવનને વિકસાવવાને મળેલાં છે, એટલે કે મનને શાંતિ, સમતા,  
તટસ્થતા, સાક્ષીપણું, ધીરજ, સહિષ્ણુતા, ઉદારતા, વિશાળતા,  
પ્રેમભાવના આદિ દૈવી સંપત્તિના ગુણો કેળવવા કાજે તે તે મય્યાં  
કરે છે, એવો હેતુ જો જીવ પ્રત્યેક કર્મમાં જીવતો રાખી શકે તો  
સારાં કે નરસાં કોઈ પણ કર્મ તેને બંધનકર્તા નથી નીવડતાં. તે તે  
કર્મમાંથી તે જીવ પોતાના જીવનનો હેતુ જ ફળાવતો જતો હોય  
છે, ને એમ દરેક કર્મ એના જીવનને ફળાવનારું બની જાય છે.  
જેમ વેપારીને ત્યાં અનેક પ્રકારના સારાનરસા સ્વભાવના ઘરાકો  
આવે છે; પરંતુ તેઓ સાથે એને નિસ્બત છે માત્ર કમાવાની જ;  
તે તેઓના સ્વભાવને મહત્વ મુદ્દલે દેતો નથી; પરંતુ કમાવાનો  
હેતુ લક્ષ્યમાં રાખીને સારા કે નરસા પાસેથી તે પોતાનો હેતુ સાધી  
લે છે. તેવી રીતે જે સાધક પોતાને મળતાં રહેતાં સારાં કે નરસાં  
કર્મમાંથી એકમાત્ર પોતાના જીવનનો હેતુ જ ફળાવી શકવાના  
એકતાનમાં રહે છે, તેવા જીવને કર્મનું સારાપણું કે નરસાપણું નડતું  
નથી. એ તો માત્ર સમજે છે તેમાં તેમાંથી પોતાના જીવનહેતુને  
ફળાવવાનું; અને તેવો હેતુ ફળાવવાનું શરીર વિના શક્ય નથી.

(‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૮૭-૮૮)

## નઠારું, સારુંનરસું

(અનુષ્ટુપ)

સારા કે નરસા કેરું આપણો કેં ન ચિંત્વવું,  
પરંતુ સર્વમાંથીયે ભાવને નિત્ય પ્રીછવું.

સારા ને નરસા કેરું રહેતું દ્વંદ્વ સદા જગે,  
જીવને પાર તેનાથી પ્રભુભાવે થવાનું છે.  
નઠારું તે નઠારું ના જો પ્રભુભાવ ત્યાં હશે,  
'દ્વંદ્વની પાર એ રીતે જિંદગીમાં થવાનું છે.

દ્વંદ્વમાં તે પ્રભુભાવ જો રાખી ન શકાય તો,  
દ્વંદ્વથી શી રીતે પાર થવાના પદ્ધી જીવને ?  
'દ્વંદ્વની વૃત્તિ તે દ્વંદ્વે રાખવાની ન જીવને,'  
એકધારું ઊંઠું એવું ભાન તે રાખજો હુદે.

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૧૫૮, ૧૯૪૪-૬૫)

(ગઝલ)

નઠારું જે ગણે લોક રહે ત્યાં ઈશની શક્તિ,  
નઠારાનોય આધાર લઈ શકશે પ્રભુ-શક્તિ.

નઠારાને નઠારું તે ન માનો કોઈ સૌ રીતે,  
નઠારાને નઠારી તે રીતે ના ભોગવો ક્યાંયે.  
નઠારાને લઈ તાબે પૂરેપૂરું જીવનતત્ત્વે,  
રૂપાન્તર તો થવા એને અનેરી શક્યતા ત્યાં છે.

નઠારું ના નઠારું છે નઠારું એકલું કદીયે,  
અને નીરખાતું ‘સારું’ જે, ન સારું એકલું કદી છે.  
થવાનું આપણું જેવું સતત તે ભાવ હૈયાનો  
-‘નઠારું’ ‘સારું’ બન્નેમાં પરોવીને પ્રભુ ભજવો.

(‘પ્રાણામ-પ્રલાપ’, આ.૨, પૃ. ૨૦, ૧૩૧)

\*

\*

## ગમે તે હો ભલે ક્ષેત્ર

(અનુષ્ટુપ)

કોઈ ક્ષેત્ર પ્રભુ-ભાવ વિનાનું વિદ્યમાન ના,  
જેમાં-તેમાં પ્રભુ હૈયે લક્ષ પ્રવેશવું સદા.

ગમે તે હો ભલે ક્ષેત્ર બાંધનારું ન તે ગણો;  
સારું ખોટું હદે એને જાણવાનું ન રાખશો.

ખોટું હોવા છતાં એની સાથે શી હોય નિસ્બત ?  
એમાં ના પરોવાનું આપણો રાખવું દિલ.

દેખા ખોટુંય જે દે છે, એમનું એમ તે કદી  
—જીવને આવતું ના કેં, આવે તે કેંક હેતુથી.

હેતુનું જ્ઞાન તે વેળા તેવામાં જેમને સ્ફુરે,  
ખોટાની માંહીથી સત્ય બોધ એને થયાં કરે.

ખોટું ના એકલું ખોટું સારું તેમાંય હોય છે,  
સર્વના કર્મને તેથી તે રીતે જોવું ત્યાં હદે.

બૂધું જે તે ભરેલું છે પ્રભુના ભાવથી નર્ધુ,  
તેથી પ્રેરાઈ ત્યાં હૈયે પ્રભુ-ભાવેથી વર્તવું.

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૧૬૩-૬૪)

\*

\*

કાર્ય સાત્ત્વિક છો હોય, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોય છો,  
ચેતના-શક્તિનું ભાન જાગેલું જો ન હોય તો-

જ્ઞાનયુક્ત હદે ભાવ કર્મ સૌ કરતી પળે-  
જેને રહે ન, તેવા સૌ અવિદ્યામાં રમ્યા કરે.

સંસારી લોકની કક્ષા થકી તે લોક ઉચ્ચ છે,  
કિંતુ ત્યાં ધમના ધમ એવા તો વિરમી રહે.

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૧૬૮)

\*

\*

નિદ્યમાં નિદ્ય હો કર્મ તેમાંથે શુભ તારવી  
-કલ્યાણ-ભાવના પોષ્યાં જે કરે, શ્રેય તે વરે.

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૨૦૧)

ભાવ-વિહોષું જે કર્મ, કર્મ તે કર્મ-બંધન;  
ભાવયુક્ત થતાં કર્મ, કર્મ તે મુક્તિ-પ્રેરક.

(‘જીવનસોપાન’, આ.૧, પૃ. ૧૪૦)

પોતાની પ્રિય વસ્તુના વિના હૈયું ન કેં ચહે,  
ભક્તિ અહેતુકી તે, જે એકલી પ્રભુને ચહે.

(‘પુનિત પ્રેમગાથા’, આ.૨, પૃ. ૧૫૦)

\*

\*

### કસોટીનો ભહિમા

કસોટીકાળે પુરુષાતન દાખવીને સાહસ, હિંમત, ધીરજ આદિ ગુણોથી પ્રેરાઈને જે ટકી રહેવાનું કે વિકાસ પામતા જવાનું કરે છે, તેવો જીવ કદી તેમાં ગુંચવાતો નથી, ગભરાતો નથી, મુંજાતો નથી. કસોટી પ્રકટે છે, આપણા જીવનની સાચા ખમીરની પરીક્ષા કરાવવા. કસોટીમાં જે જાગતો ને જીવતો રહ્યો તે જીવી ગયો જાણવું. આ કાળ ચેતવવા માટે છે, સતત જાગ્રત રહેવા માટે છે. કસોટીમાં જે જીવ આનંદની ઉત્કટ માત્રા જાળવી રાખે છે, તેવો જીવ દુઃખની અનંત હારમાળાથી પણ પછી કશા આંચકા અનુભવી શકનાર નથી. કસોટી તો જીવનને કસી જોવાની કસોટી છે.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૨૦૦-૨૦૧)

\*

\*

કસોટીની પળોએ જે ભગવાનને પોકારે છે, ભગવાનની ભક્તિ કરે છે, ને એવી આકરી કસોટીના પ્રસંગોમાં પોતાના જીવનઘડતરનો જ્ઞાનપૂર્વકનો ભગવાનના હેતુનો જેને જ્યાલ રહે છે તેવો જીવ ભગવાનને પામી શકે છે. જીવનમાં એકધારા સરળતાના પ્રસંગો હુંમેશાં મળ્યાં કરે એવું કદ્દી બનનાર નથી. કસોટીમાં જે મરજીવો બને છે, તે ઈશ્વરનો સાચો બંદો છે. આપણે તો એના બંદા બનવું છે ને ?

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૨૦૧)

### કસોટી

(અનુષ્ઠાપ)

વેદના  
કસોટી પ્રભુની એ તો અમોલી ભેટ-દાન છે.

એને જે કો નકારે તે પ્રભુતા પામી ના શકે.  
કસોટી પાર થાનારો એને જો સમજ્યા કરે,  
એવો જીવનનું પામે રહસ્ય કોક દિ' ખરે.

સંદેશ દુઃખ હા !  
માનવી-જાગૃતિ માટે દૈવી કસોટી શી અહા

દુઃખ નાખે

દ્યા લાવી પ્રભુ આપે તે તો સૌને જગાડવા.

## કાવ્ય, આત્માનું કથન

(જૂલાણા)

હદ્યની ભાવના આપમેળે સ્હુરી, જીવન-આવિભાવે ઠરે જે,  
જીવન જે કાવ્ય છે, કાવ્યમાં કલ્યના, ખાલી કોરી રહે ત્યાં ન સુહેજે.  
હદ્યની ભાવનાથી થતાં કર્મ જે, કર્મ તે કાવ્ય સાકાર રૂપે;  
પ્રેમ-ભક્તિ થકી જ્ઞાનહેતુ થકી સૌ સમર્પે બને, કાવ્ય તે છે.  
કાવ્યની કલ્યના નોખી જે જીવનથી હોય ના કાવ્ય તે કાવ્ય જાણો;  
'કાવ્ય તો આત્મનું કથન છે' જાણવું તે વિના જ બધું, અર્ધકચરું.

(‘જીવનપાથેય’, આ.૩, પૃ. ૮૨)

## નામસ્મરણ

(જૂલાણા)

જો જરા ઉતરી કેં ઉંડું ત્યાં જુઓ, નામરૂપે બધુંયે જણાશે;  
'નામ' વિશ કેં કશું વિશ્વમાં શું દીહું? નામ સર્વસ્વ જ્યાં ત્યાં બધેયે.  
માનવીમૂર્ખતા ક્ષુદ્ર કેવી દીસે! ત્યાગ મિથ્યાત્વનો કેમ આવે?  
સૂર્યની આગળે આગિયો ક્ષુદ્ર છે, તેથીયે તે વધુ નામ આગે.  
જનમાં ઓળખે કોઈ પણ નાછતાં, ફોઈ વરની થઈ ખૂબ મુહાલે;  
ભારનો પોટલો માનવી શિર લઈ, વરની મા ના, છતાં મ્હોડ ઘાલે.  
નામની નથમહીં હદ્ય નથથઈ જતાં દોરશે નામ ત્યાં આપમેળે,  
કંઈ કશો ભાર ના કેં જ ચિંતા ન ત્યાં દિવ્ય નિશ્ચિતતા નામખોળે.

(‘જીવનપાથેય’, આ.૩, પૃ. ૧૧૦-૧૧)

શ્રીગંગાચરણો (ચેતનને ઉદેશીને દ્વિઅર્થી શ્લોકો)  
 (શિખરિષી-મંદાકાન્તા)

ગતિ તારી કોઈ પરખી ન શક્યું, માપી કોઈ શક્યું ના,  
 તને હૈયે જોવા નિજ બનવવા વીરલા કોક ફાયા;  
 મહા મોંઘામૂલું તુજ રસ તણું કેન્દ્ર-બિંદુ પમાવું;  
 મહામાયા માડી ! શરણ મુજને રાખજો, પાપી હું છું.

સદા ઢંકાયેલું તુજ મૂળ રહે; ક્યાંથી તું નીકળે છે  
 —પૂરેપૂરું કોઈ મથન કરતાં, શોધતાં, હાર પામે;  
 છતાં તારામાં મા ! સકલ જનની દસ્તિ ખેંચાતી રે' છે,  
 તને જોતાં કેવું મન પીગળતું પ્રેમના મુગ્ધભાવે !

અહા ! શી લાગે જ્યાં શીત, ભય, નર્યોંપલાવાનું થાતાં !  
 જતી જાણે લાગે હૃદયથી અરે ! ખૂટતી હામ શી ત્યાં !  
 છતાં તે વેળાએ, મન-હૃદયથી હામ બે હાથમાં લૈ  
 —મૂક્યું જો માનામાં પડતું, પછી તો ઓર આનંદ વાપે.

ભલે લાગે જુદાં જનની ! તુજ તે મૂળ ને મુખ બન્ને,  
 છતાં જોડાયેલાં ઉભય તુજ તે ચેતનાના પ્રવાહે,  
 વસે બન્નેમાં તું, ઉભય સ્વરૂપે એકની એક મા ! તું,  
 છતાં તારું થાયે સકળ સ્થળમાં દશ્ય મા ! જુદું જુદું !

બનીને તારાં જે શરણ રહીને પંથ કાચ્યાં કરે છે,  
 ભલે ભૂલે તેવાં પણ કરી કૃપા પંથ લે પાછી એને;  
 નહિ ખોવાવા તું કદીય પણ દે મા ! કરુણાળુ એવી,  
 ભૂલેલાંની લે મા નીરખી-નીરખી પ્રેમ-સંભાળ ઝારી.

જતાં તારે પંથે જન નીરખિયાં, પાગળાં ને અશક્ત,  
 ‘ચઢાવે લૂલાંને ગિરિ તુજ કૃપા’ ઉક્તિ તે ભાળી સત્ય;

જનો કોઈ એને કવિ-મન તણી કલ્પના ખાલી માને,  
પરંતુ જેઓને અનુભવ થયો હોય તે સાચી જાણે.

થતાં પૂરો પંથ જહીં નીરખતાં ત્યાં જતાં તે અધૂરો  
—વધારે ઊંચો ને કઠળ અઘરો આવી ઊભો રહે શો !  
થયું જાણે પૂરું ચઢવું તહીં તો દૂરનું દૂર ધામ  
—જતું જાયે કેવું ! મન તણી કરે મા કસોટી અપાર.

મહા પંથે તારે શિખર શિખરો એકથી એક ઊંચાં,  
ચઢાઈ ભારે શી ! શ્રમિત બની જ્યાં માનવી શાસ લેતાં;  
ચઢાઈમાં કોઈ ભય જીવનને જોખમાવા તણો ના,  
પરંતુ નીચાણે પતન બનવા સર્વ સંજોગ ત્યાં મા !

ઘણી આંટીઘૂંટી પથ મહીં છતાં એકધારો બને તે,  
વળાંકો આવે છે કંઈ અવનવા, તે છતાં એક રે'છે;  
વળી માર્ગ ભક્તો મન જનનીને સેવતા હર્થી જે,  
વધારી આનંદ, શ્રમિત મનને ઓર ઉલ્લાસ પ્રેરે.

જગે ચાલી આવી શરણજનની એકધારી કતાર,  
શરૂ આદિ કેરો નવ તૂટ્યો યજા એવો અખંડ;  
યુગો યુગો વીત્યા પણ નવ ખૂટે આહૃતિ દેવી માને,  
અને ચાલી આવી જીવતી જગમાં ભાવના એવી રીતે.

બધા કું કું બેળાં નિજનું સઘળું આપી તુંમાં શમાતાં,  
છતાં તું તો કેવી નિજ સ્વરૂપથી જેવી ને તેવી રે' મા !  
કશાથીયે રંગ તુજ અસલનો ના કદી ફેરવાયે,  
સદા એવી માડી ! અસલ મુજને રાખજે મૂળ રંગે.

(‘શ્રીગંગાચરણો’, આ.૧, પૃ. ૬, ૧૨, ૧૫, ૧૬, ૨૩, ૨૮)

\*

\*

જગે ક્યાંથી દુઃખો જીવન-કલહો, દર્દ-દારિદ્ર્ય આવાં ?  
 હશે રોગો જેવા ત્યમ દરદીને ઉપચારો કરાતા;  
 અનેરી રીતો છે પ્રભુની ઘડવા, જેવી સામગ્રી હોયે,  
 છતાં અજ્ઞાનીઓ નવ સમજતાં દોષ દેતાં પ્રભુને.

(‘જીવનપગલે’, આ.૧, પૃ. ૪૮)

### ગુણો, તમસ-રજસ-સત્ત્વની સમજૂતી

તમસ ગતિ કરતું જાળાય પણ હોય ઠેરનું ઠેર. પરિમિતપણું,  
 સ્થિતિસ્થાપકપણું અને નિર્જિયપણું એ એનાં લક્ષણ છે. એટલે  
 આપણે જો વિશેષ અર્થમાં ગતિ કરવી હોય તો રજસગુણને  
 ધક્કેલવો પડશે. પ્રત્યેક વસ્તુમાં આ ગુણ પણ રહેલો છે. આમ  
 પ્રકૃતિમાં ફેરફાર થવાનાં કારણોમાં પદાર્થનો ગતિશીલતાનો—  
 રજસનો ગુણ છે; પરંતુ જો આ બે ગુણો જ માત્ર પ્રત્યેકમાં હોત  
 તો વસ્તુમાત્રમાં જે પ્રકારભેદ છે તે ન હોત. જડ અને ચેતન  
 અથવા પણ અને માનવી એવા ભેદો ન પડત. સ્થિતિસ્થાપકતા  
 (તમસ) અને ગતિશીલતા (રજસ)ના ગુણધર્મોના પરિણામને  
 લીધે જે ગોઠવણી થયાં કરે છે, તે પણ પદાર્થનો ગુણ જ છે અને  
 તેને પદાર્થનો સત્ત્વગુણ ગણાય. પ્રત્યેક ચીજ પોતપોતાની  
 સ્થિતિમાંથી સહજમેળે નીકળવાનો સતત પ્રયત્ન કર્યો જ કરતી  
 હોય છે.

આમ જો આપણે આપણા જીવનધ્યેયને આકાર અપાવવાને  
 કાજે જીવતો ખ્યાલ સેવીને રજસના ગતિશીલતાભર્યા કિયાધર્મને  
 આપણા પ્રત્યેક કર્મ, વ્યવહાર, વર્તન, સંબંધ, વૃત્તિ આદિમાં  
 અને ધ્યેયાકાર વૃત્તિમાં સ્થિર કરવાને જાગૃતિવાળા રહ્યા કરતા  
 હોઈએ તો ઘણો ફેર પડ્યા કરે. પરિમિતતામાંથી (તમસમાંથી)  
 જીવનધ્યેયાકારની વૃત્તિ ગતિશીલકિયાધર્મમાં (રજસમાં)

જીવંતપણે બન્યાં કરે, ત્યારે આપણને આધ્યાત્મિક અનુભવો થવાના અને તેમાં યોગ્ય વ્યવસ્થિતિ (સત્ત્વ) પ્રગટે. જ્ઞાનપૂર્વકની ચેતનાની દશાની વ્યવસ્થિતિ તે સત્ત્વનું લક્ષણ છે. તેમાં સમતા છે, એકની એક સ્થિતિ છે, પરંતુ ચેતન છે, જડતા નથી.

પ્રત્યેક કર્મ આ ત્રણ ગુણ અંગે થાય છે, આ ત્રણેય ગુણનાં જુદી જુદી રીતનાં સંભિશ્રાણથી જુદી જુદી ભૂમિકાવાળી જુદી જુદી દશાઓ જન્મે છે અને તે દશામાંનાં કર્મોનો પ્રકાર પણ ભિન્નભિન્ન બન્યા કરે છે. જ્યારે સજ્ઞાનમય ચેતનાબરી જાગૃતિ સતત પ્રગટે છે, ત્યારે જે સમતાયુક્ત પ્રસન્ન મસ્ત ડેલન પ્રગટે છે, તે સાત્ત્વિક ભાવનાનો પ્રકાર છે અને અંતે તો જીવની શિવપણામાં ગતિ થતાં તમસ ‘સત્ત્વ’માં, રજસ ‘ચિત્ત’માં અને સત્ત્વ ‘આનંદ’માં સંચ્યદાનંદમાં પરિવર્તન પામે છે.

(‘જીવનપ્રેરણા’, આ.૩, પૃ. ૧ થી ૫)

સાધકે પોતાના જીવનમાં ક્યારે કયો ગુણ કામ કરી રહેલો છે, તે સમજવું જોઈએ ને તે સમજ-સમજને તે તે ગુણોની અસરથી ભાવનાબળ પ્રગટાવીને મથવું જોઈશે. એક જ દિનના ગાળામાં ઘડીકમાં તમસ, ઘડીકમાં રજસ ને બહુ જ ઓછો કાળ સત્ત્વગુણ પણ પ્રવર્તલો હોય છે.

(‘જીવનસંશોધન’, આ.૧, પૃ. ૨૫૭)

તમોગુણમાં આળસ, જડતા, પ્રમાદ, નિર્બળતા, અશ્રદ્ધા, શિથિલતા, અશક્તિ, અકૌશલ્ય, બસ પડ્યાં જ રહેવું, ઉમંગનો અભાવ, બેળે બેળે થવું, શંકા-કુશંકા, નિરાશા, વિષાદ, રોદણાં, મંદતા, અગ્રહણાત્મક સ્થિતિ, સાનમાં સમજ જવાની અશક્તિ, ખાંખત ને ખંતનો અભાવ, અચોક્કસતા, બેપરવાઈ, બેદરકારી, અનિયમિતતા, સાતત્યનો અભાવ, યદ્વાતદ્વાપણું, થાક, મોહ, અજ્ઞાન, આળસ, ઠંડા ને વાસી પદાર્થખાદ્યવૃત્તિ, અજ્ઞાનતા, મંદ

સૌંદર્યગ્રાહકશક્તિ, મંદ રસવૃત્તિ, લાગણીઓના મર્યાદિત પ્રત્યુત્તર આદિ હોય છે.

રજસમાં વેગ, ગતિ, શક્તિ, કુશળતા, ચપળતા, પરિસ્થિતિને કાબૂમાં લેવાની ઈચ્છા, સક્રિયતા, સબળપણું, હોંશ, પુરુષાર્થ કરવાની જેવના, આશાવાદ, એક ને એક સ્થિતિમાં રહેવાની અનિચ્છા, ઝૂભમવાની વૃત્તિ, આગ્રહો, નેતા થવાની વૃત્તિ, અહમનું જોશ, કીર્તિની જંખના, ચોકસાઈ, નિયમિતતા, સાતત્યતા, ખંત, શીખવાની આતુરતા, સર્જનશક્તિ, ઉમંગ, ગ્રાહકતા, આવેગ, આવેશ, કામના, આશા, ઈચ્છા, અપેક્ષા, ચંચળતા, સ્ફૂર્તિ, તરવરાટ, રાગ, આસક્તિ, ધાંધલ, પ્રવૃત્તિપ્રિયતા, હરીફાઈ, લોભ, હિંસાખોરી, અભિમાન, તીખુંખાટું ખાદ્યવૃત્તિ, હારજીત, અનુદારતા, બુદ્ધિની હઠીલાઈ આદિ હોય છે.

સત્ત્વમાં સમતા, શાંતિ, આનંદ, પ્રેમ, પ્રસન્નતા, સ્થિરતા, મુલાયમતા, નિરાગ્રહ, સરળતા, સત્યપ્રિયતા, ક્ષમા, કરુણા, નભ્રતા, નિર્દોષતા, અભય, અહિસા, ઈન્દ્રિયદમન, દાન, શાખાભ્યાસ, ત્યાગ, નિર્લોભતા, અદ્રોહ, અવિચળતા, કોમળતા, ન્યાય, બ્રહ્મચર્ય, પવિત્રતા, ભક્તિ, આરોગ્યશક્તિપ્રદ ખાદ્યવૃત્તિ, સહિષ્ણુતા, અમાનિત્વ, સર્વભૂતહિતરતપણું, બુદ્ધિશાળી અને સપ્રમાણ મન, બુદ્ધિ અને સૌંદર્યરસવૃત્તિથી પ્રેરાતી સંકલ્પશક્તિ, આત્મસંયમ, સંસ્કારિતા, સપ્રમાણતા, મધ્યમમાર્ગ-પ્રવર્તના આદિ હોય છે.

\*

\*

સત્ત્વગુણ આપણા આધારમાં જીવતો મહત્ત્વપણે પ્રગટ્યા કરેલો હોય છે, તે વેળા આપણાં શરીર, મતિ, મન અને પ્રાણ

એ ચારમાં તે મુખ્ય ભાગ ભજવ્યા કરે છે, ને સાત્ત્વિક ગુણો ઉભરાયા કરે છે. સત્ત્વગુણનું બળ જામતાં જામતાં એક એવી દશા પ્રગટતી હોય છે કે તેમાંથી જ્ઞાનદશાનો અભ્યુદય થતો અનુભવી શકાતો હોય છે. સત્ત્વગુણ જ્ઞાનપ્રધાન મહત્વે કરીને હોય છે ખરો, પરંતુ તેનો અર્થ એવો નથી કે એમાં ભાવના-ભક્તિ ન જ હોય કે કર્મયોગ પરત્વેનાં લક્ષણો પડ્યા ન હોય. સાત્ત્વિક ગુણ પ્રગટતાં સાધનાના ભાવનો વિકાસ સહજપણે થયાં કરતો રહે છે. (‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૮૪)

સત્ત્વમાં સાત્ત્વિક ગુણોનું પ્રાગટ્ય સહજ હોવાથી તેનો લાભ પૂરેપૂરો સમય એકાગ્રતાથી સાધનાના કર્મમાં જ વપરાય એમ જો જાગૃતિયુક્ત તકેદારી ને સાવચેતી રાખી શકાય તો સાધનાકર્મના ફાલની પ્રક્રિયામાં વધુ ને વધુ ઉત્સાહ પ્રકટ્યા કરે. સત્ત્વગુણમાં ઉચ્ચ ક્ષેત્રનો પુરુષાર્થ કરવામાં ઉત્સાહ ને ઉમ્ભંગ પ્રવર્તે છે; જાઝા કશા વિચારોની ગડમથલો હોતી નથી. સગડગ, સંશય, શંકા, ઘમસાશ, દ્વિધાભાવ આદિની ગેરહાજરી હોય છે. એટલે આવી ભૂમિકાનો લાભ જેટલો ઉઠાવાય તેટલું ઉત્તમ છે.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૨૫૭-૫૮)

સાધનામાં આગળ જવાતાં એક એવી સ્થિતિ પ્રવર્તે છે કે કોઈ કરણમાં સત્ત્વગુણ તો કેટલાંક કરણોમાં રજોગુણ પડા કાર્ય કરતો હોય છે.

રજોગુણમાં અહંપ્રાધાન્ય ઘણું રહેછે. તેમાં જે પ્રકારનો અહમ્મ છે તે અત્યંત વેગવાળો હોય છે; તેથી એવા સાધકે વધુમાં વધુ ચેતનાયુક્ત જાગૃતિ રાખીને નમ્ર રહેવાને સજાગ રહ્યા કરવું.

દરેક જીવમાં અને પદાર્થમાં ત્રણો ગુણ રહેલા છે. એક કે બે જ ગુણોવાળું અસ્તિત્વ અશક્ય છે. ત્રણો ગુણોમાં અવારનવાર ચઢાયિતર, ઓછાવધતાપણું થયે જ જતું હોય છે. સત્ત્વ ઉત્તમ,

રજસ મધ્યમ અને તમોગુણ કનિષ કહેવાયો છે. તમસને ને રજસને સત્ત્વમાં તથા રજસને સત્ત્વમાં પરિણમાવી શકાય છે. આખરે તો ત્રાણ ગુણોની પાર થઈ સાધકે ત્રિગુણાતીત થવાનું છે.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૮૫-૮૬)

### ગુણ-વિકાસની સરળ રીત

મન-બુદ્ધિથી પ્રાણ કે અહમ્ પર કાબૂ કાયમનો ને ભરોસાપાત્ર લાવી શકતો નથી. તે કાબૂ જીવતો નથી હોતો. જીવંત, ચેતનમય અને જ્ઞાનાત્મક સંયમ કાજે તો એનાથી પર જે શક્તિ છે, તે દ્વારા તે યોગ્ય રીતે સાધી શકાય. પ્રભુની કૃપાશક્તિમાં જે સાધકને શ્રદ્ધા, ભક્તિ પ્રગટેલાં છે, એવો જીવ જ્યારે પોતાનાં કરણોની શુદ્ધિ કાજે શ્રીહરિને હૃદયમાં હૃદયથી હૃદયનો આર્ત ને આર્ડ પોકાર પાડે છે, ત્યારે તેવા પોકારથી જે કામ બને છે, તેવા પ્રકારનું કામ (કે શક્તિ), નીતિ કે સદાચારના નિયમો માત્ર પાળવાથી બની શકતું નથી. નીતિ કે સદાચારના નિયમો પાળવાની જરૂર છે, તે હકીકત તદ્દન યથાર્થ છે; કિંતુ તે એકલું ને એટલું જ પૂરતું નથી. જ્ઞાનભક્તિકર્મયોગથી અંતઃકરણની પૂર્ણ વિશુદ્ધિ પ્રમાણમાં જેટલી સરળતાથી, જડપથી અને આસાનીથી થઈ શકે છે તેટલું ને તેવું -મન-બુદ્ધિજનક સંયમથી, કે ગુણોની ખાતર ગુણોના વિકાસની સાધનાથી, થવું શક્ય નથી લાગતું.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૩૫૨)

\*

\*

અનેક પ્રકારનાં પ્રાણ અને અહમ્થી ઊઠતાં આંદોલનો પ્રભુકૃપાથી પ્રેમભક્તિભાવે પ્રભુસ્મરણ સાથે સમજવાને મથ્યા કરતો. આવા જ્ઞાનપૂર્વકના અભ્યાસનું પરિણામ તો એ થવા માંઝયું કે સમતા, તટસ્થતા, શાંતિ, વિવેક, પ્રસન્નતા, સહિષ્ણુતા આદિ સાત્ત્વિક ગુણો એની મેળે પ્રગટતા અનુભવાયા હતા.

આમ, જ્ઞાનભક્તિપૂર્વકની જગૃતિથી ને તેના હેતુ અર્થે પળાતા જતા સાધનાના અભ્યાસથી ગુણો તો આપોઆપ કેળવાતા જતા હોય છે, તે નિશ્ચિત અનુભવની હકીકત છે. એકલા ગુણો કેળવવાનો મહાવરો આ જીવનો કદી ન હતો.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૧૨૪)

### ગુણોની રમત

(અનુષ્ટુપ)

ગુણોથી ગુણની રીતે કામ લીધાં કર્યે બધું.

ગુણની ચેતના-શક્તિ ફળાવે છે ન ત્યાં કશું.

ગુણોથી આવવું ઊંચું એમનું એમ ના બને,  
જાણવા જોઈશે ‘ગુણો’, ‘સ્વામિત્વ ગુણનું શું’? તે.

ગુણનું કામ ગુણો તે એમ ને એમ ના કરે,  
સ્વભાવે ગુણ વર્તાવ્યાં સામાન્ય જનને કરે.

ગુણોની ઉપરે કાબૂ પૂરો મેળવવા હુદે,  
કર્મમાં જ્ઞાનના ભાવે વર્તવું તેથી સાધકે.

ગુણોને સેવવાથી તો મળે ના કાબૂ એમનો,  
જ્ઞાનભાવેથી વર્તાતાં કાબૂ ત્યાં મેળવી શકો.

પુરુષ-પ્રકૃતિ-જ્ઞાને વિવેકશક્તિ સત્ત્વ દે.  
અનાસક્તિ પરાવૃત્તિ સંપૂર્ણ રાજસે રહે,  
જીવનાસ્તિત્વમાં પૂરી સમતા તામસે રહે.

દૈવી તે ચેતનાનું દે કામ ગુણો ત્રણે ખરું,  
ભાવે તટસ્થ જો પોતે બેઠો જોતો રહે બધું.

\*

\*

(શાર્દૂલવિકીડિત)

ક્યાંયે ના બળ છે સ્વતંત્ર ગુણનું એની પૂઠે ચેતના,  
આખું વિશ્વ રમે ગુણોની રમતે કેવું રસીલું અહ્ય !  
જેવી હો ભૂમિકા ગુણોની જીવને તેવી દરે ચેતના,  
જેવું બાળ રમે ધરી રમકું ને ફોડી નાખે કદા.

સર્વે કામ કરાવતી જગતમાં પૂઠે રહી ચેતના,  
ને દેખાવ ગુણો ધરી જ અમથો વર્યે રહ્યા છે ઊભા;  
ને તેનું ઉપરીપણું કરી શકો જો દૂર પૂરેપૂરું  
તો શક્તિ પ્રભુ-ચેતનાની હૃદયે નિહાળશો સર્વ શું !

(‘પુનિત પ્રેમગાથા’, આ.ર, પૃ. ૧૭૪-૭૫)

### ગુરુની આવશ્યકતા

કોઈ પણ વિષય કે કાર્યક્ષેત્રમાં કોઈ સારો ને સહદયી હોશિયાર શીખવનાર પ્રત્યક્ષપણે મળી જાય તો તે વિષયમાં કે કાર્યક્ષેત્રે કુશળતા મેળવવી શીખનારને ઘણી સહેલી થઈ પડે છે. સંસારમાં જ્યાં જ્યાં નજર નાંખીશું, ત્યાં માલૂમ પડશે કે દરેક વ્યક્તિ કોઈ ને કોઈ શીખવનાર પાસેથી પોતાને જોઈતું શીખી લે છે. અજ્ઞાણ્યા પર્વત ઉપર ચઢવું હોય તો આપણે ભૂલા ન પડીએ કે સંકટોમાંથી ઊગરી જઈએ તે કારણે ભોમિયાને સાથે લઈએ છીએ તેવું જ અધ્યાત્મમાર્ગ છે.

જેણે પ્રભુના માર્ગ વળવું છે, અંતર્મુખી થવું છે, ભગવાનને શરણે રહેવું છે અથવા ઊર્ધ્વગામી જીવન પોતાનામાં ઉદ્ભવવાવું છે, તેણે એવા કોઈક સાથે સંપર્ક રાખવો જરૂરી છે કે જેથી પેલાના સંપર્ક અને સંબંધના પરિણામે પોતાનામાં ઊર્ધ્વગામી પ્રવાહો અથડાય અને જન્મે. એવી વ્યક્તિ-વિભૂતિ નિરાસકત, અહંરહિત, દુંહાતીત, ત્રિગુણાતીત અને ભગવાનની ભાવનામાં સદ્ય રત હોવાથી સાધારણ માનવીમાં જે રાગાત્મક પ્રવાહો પડેલા છે તેનાથી ઉચ્ચ કોટિના પ્રવાહો તે જીવમાં અથડાશે. જે કે સાધકને શરૂમાં આની જાળ થઈ શકતી નથી, પરંતુ આગળની

કલ્ખાઓમાં જાણ થઈ શકે છે અને સાધકમાં એક જાતનું સંવર્ષણ થઈ મંથન જાગશે. આમ સામસામા રાગાત્મક અને અરાગાત્મક પ્રવાહો જાગ્યા કરતા હોવાથી જીવની ચેતનાશક્તિમાં જરૂર ફેરફાર થવા માંડશે. આપણા બીજા સંબંધો પાર્થિવ હોવાથી એવા સંબંધો આપણને પાર્થિવપણાથી ઉપર લઈ જઈ શકતા નથી. ગુરુની પ્રથા આ કારણે હશે.

જેમ સંપર્ક કે સંબંધ એકલાથી આપણને સામી વ્યક્તિનું ચિંતવન થતું નથી પણ એમાં જ્યારે રાગ કે આસક્તિ પ્રગટે છે, ત્યારે તેનું ચિંતવન થયાં કરે છે ને રાગ જેટલો વધુ તેટલું ચિંતવન વધુ, તેમ જ એવા ગુરુ પ્રત્યે પણ જો ખૂબ પ્રેમ જામ્યા કરશે તો એનું ચિંતવન પણ જરૂર સવિશેષ રહેશે. ગુરુ પ્રત્યેના પ્રેમનો હેતુ આપણી ચેતનાને જગાડવાનો, જગાડીને કિયાત્મક બનાવવાનો અને તેમ થતાં થતાં આપણું સર્વાશે દિવ્ય રૂપાંતર થવાનો છે. આ સંબંધના હેતુમાં પૂરેપૂરી રીતે જ્ઞાન અને ભાન હોવા ઉપરાંત ગુરુ પ્રત્યેનો આપણો ભાવ Receptive and Responsive-ગ્રહણાત્મક અને કિયાત્મક સહકારવાળો હોવો જોઈશે. ખરી આતુરતાભર્યા વલણ, વૃત્તિ અને દિલ્લિ આપણામાં કેંદ્રિત, એકાગ્ર ને હંદ્યસ્થ રહેવાં જોઈશે.

(‘જીવનસંદેશ’, આ.૨, પૃ. ૪૪-૪૫, ૧૦૪)

### ગુરુ સૂક્ષ્મ-ભાવરૂપે

(અનુષ્ટુપ)

ગુરુ ના દેહધારી તે ગુરુ તો સૂક્ષ્મ-ભાવ તે,  
ગુરુ આધાર ભૂમિકા પામવા ગૂઢ તત્ત્વને.

ગુરુ પ્રત્યક્ષ છો ના હો, ગુરુની ભાવના હંદે-  
દઢાવતાં રહીશું જો મેળે પ્રત્યક્ષ તે થશે.

(‘જીવનપાથેય’, આ.૩, પૃ. ૫)

(દોહરા)

‘ગુરુ’ ‘ગુરુ’ તે શું કરો, ખાલી ના તે શર્ષદ,  
ગુરુ તો શક્તિભાવનો વ્યક્તપણો છે દેહ.

ગુરુ ના માટી-પિંડ છે, માત્ર ન તે છે દેહ,  
ગુરુ અંતર જેને રમે પામે પદારથ તેહ.

ગુરુ તો ચેતન-ભાવ ને શક્તિ કેરો પિંડ,  
કર્મ વિષે મન ધારણા એ હો નિત્ય અખંડ.

(‘પ્રશામ-પ્રલાપ’, આ.૨, પૃ. ૧૪૬)

### ગુરુ-માહાત્મ્ય

(અનુષ્ટુપ)

સ્થૂળ દેહ ગુરુ ના છે સૂક્ષ્મથી સૂક્ષ્મ ભાવ શો !  
ગુરુના જીવને જ્યારે ભળશો તો પિછાનશો.

ગુરુની ચેતના-શક્તિ જીવને તે પ્રવેશવા,  
અને કરી શકે કાર્ય આપણાં, તે પ્રમાણવા.

ગુરુમાં લક્ષ રે'વાનું તે મહત્વનું કેટલું,  
જીવન-સાધના જેઓ કરે તે જાણશે ખરું.

ગુરુના સ્થાનનું કેવું મહત્વ જીવને ઉંઠું !  
જે કોઈ જાણશે એને નવા રૂપે દીસે ગુરુ.

મહત્ત્વ ગુરુની એવી જ્ઞાનભાવે ગ્રહ્યાં કરી,  
ઠસાવો જીવને ઉંડી જેથી તે તો ફળે નકી.

(‘જીવનપાથેય’, આ.૩, પૃ. ૫)

\*

\*

## સદ્ગુરુની પરખ

પ્રસંગે પ્રસંગે જે સદ્ગુરુની સમજણ પ્રવર્તતી હોય છે તે સમજણ, વ્યવહાર-વર્તન-પ્રસંગમાં તે બીજાને દોરવણી આપે છે તે હકીકત તથા તેમનું કર્મકૌશલ્ય, એનો સૂક્ષ્મ વિવેક, એની જેમાં તેમાંથી સહજમેળે તારતમ્ય શોધી કાઢવાની કળા, જરાક જેટલા પરિચયમાં પણ આવતાં કોઈની પ્રકૃતિની યોગ્ય સમજણ પ્રગટી જવી, પ્રસંગને તેની યથાર્થતામાં સમજવાની તેની સૂર્જ, સર્વ મળતા જીવોને સમજવાની ને તેમના તેમના યથાર્થપણામાં સ્વીકારવાની શક્તિ, જુદી જુદી પ્રકૃતિ અને સ્વભાવના જીવો સાથે એનો વર્તનપ્રકારનો સુમેળભાવ ને તેવા તેવા જીવો સાથેની તેની સુમેળભાવની વર્તનકળા; વૃત્તિ, વિચાર, ભાવના આદિનું સૂક્ષ્મમાં સૂક્ષ્મ સમતાપૂર્વકનું નિરીક્ષણ, અવલોકન; પૃથક્કરણ કરી કરી, તેનું યથાસ્થાને શું શું યથાયોગ્યપણું હોઈ શકે તેનું સ્પષ્ટ હકીકતપણામાં વર્ણન કરી બતાવવું; પ્રત્યેક મનાદિકરણના પ્રાકૃતિક ધર્મ તથા ગુણોની રમત અમુક અમુક કક્ષામાં કઈ કઈ ને કેવી કેવી હોઈ શકે, જીવનની અમુક અમુક સ્થિતિ પ્રગટાના તેનાં શાં માપલક્ષણો હોઈ શકે તેનું યોગ્ય આકલન કરીને તે આપણાને સમજાવવાનું બની શકવું; તેવાની જીવનની બીજી લાક્ષણિક ફ્લો, એવાથી અનેક પ્રકારના જુદા જુદા થતા રહેતા અનુભવો, એવાના સંબંધ-સંપર્કના પરિચયથી ઓછાવધતા પ્રમાણમાં કોઈ કોઈ બદલાતી રહેતી પ્રકૃતિઓના દાખલાઓ; એનું નિરહંકારીપણું, નિર્મત્વપણું, એની અપાર નિઃસ્પૃહતા ને સાથે સાથે અપરંપાર સ્પૃહા, એનો રાગ અને રાગનું અભાવપણું; આપમેળે જે તે કંઈ બન્યા કરે તે જ કર્મ એવી એની સમજણ ને વર્તન; કર્મને કે સંબંધને કદી પણ ખોળવા જવાની જરા સરખી પણ વૃત્તિનો તદ્દન અભાવ; જેના વડે કરીને આપણા જીવનમાં

ધીરજ, હિંમત, સહનશીલતા, મતસહિષ્ણુતા, પ્રેમ, સર્વ પરત્વે સદ્ગ્રાવ ને સમભાવ આદિ આદિ પ્રગટેલાં અનુભવી શકાય છે; જેના વડે કરીને આણાઈઠ, ઓચિંતી કંઈક કશા વિષે પ્રેરણા મળ્યાં કરતી હોય છે,—જેના વડે કરીને આપણું સારું જીવન ઊર્ધ્વગામી થયાં જતું જણાયું છે; જેના વડે કરીને આપણાં શારીરિક દર્દો સાથેની તેની તાદાત્યતા તેના શરીર પર અનેક વાર પ્રત્યક્ષ અનુભવે વર્તાઈને જેણે આપણાં દુઃખોમાં સહભાગી બનીને આપણને સરળતા ને હળવાશ કરી દીધાં છે;—વગેરે વગેરે બધાંથી કરી સદ્ગુરુની યથાયોગ્યતા સમજ શકાય તેવું હોય છે. આવું જો બધું તેનું આપણને તદ્દન વાસ્તવિક લાગતું હોય, તેવા લાગવાપણામાં સંપૂર્ણ યથાર્થતા હોય, ને ક્યાંયે અતિશયોક્તિ ન લાગતી હોય તો પછી એવાને આપણે સ્વીકારવો તે યથાયોગ્યપણે છે એમ માનવું ને જાણવું.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૨૧૩ થી ૨૧૬)

### ગુરુનો સાધક સાથેનો વર્તાવ

(અનુષ્ટુપ)

મહાકાન્તિ કર્યા વિના હૈયાનો પ્રેમ ના મૂકે,  
પ્રેમ તો દુઃખ સહેવાનું જાણો છે પ્રેમ સાથ તે.

પ્રેમ-ભાવ મહીં શક્તિ સર્જવા કેરી ગૂઢ શું !  
માટીમાંથી કરે પેદા માનવી, જોમ પ્રેમનું.

મરેલાંને નવી દે તે જીવન-ચેતના હુદે,  
સ્વરૂપ ફેરવાવી દે અદ્ભુત શક્તિ પ્રેમ તે.

જેટલો પ્રેમ જેનો હો વધારે તેટલું ખરે,  
એને સહેવાનું આવે છે, પ્રેમનો એ પ્રતાપ છે.

લીધેલું કામ તો પ્રેમ કો કાળે તે મૂકી ન હે,  
જેને તે વળગેલો હો એને કાજે મરી જીવે.

કોટિ જન્મ ભલે જાય કિંતુ જ્યાં પ્રેમ હો ઠર્યો,  
કરાવ્યાં વિષા કલ્યાણ તેઓનું તે ન જંપતો.

મંથનો કંઈ તે ગૂઢ જગાડ્યાં કરશે હદે,  
અનોખી રીતથી પોતે બોધ ઉંડો અપાવશે.

પ્રેમ પોતાનું અસ્તિત્વ જણાવા હે ન કોઈ દી,  
એની મેળે મૂકી ના હે, કેડો પ્રેમ મૂકે નહીં.

જે જે સાથે કરે પ્રેમ હૈયાના મેળભાવથી,  
સાંધે તાદાત્મ્ય સૌ સાથે સહેવાનું આવતાં સહી.

કેળવી જો શકાયે તો એવો જીવન-પ્રેમ તો,  
જન્મશે સર્વભાવે તે આપમેળે કલ્યા વિના.

તાદાત્મ્યભાવ જન્માવે ન્યારી તે પ્રેમની કળા,  
છતાં પોતાનુંયે ભાન પ્રેમ રાખ્યાં કરે સદા.

પ્રેમ ના ભોગવી લે છે પ્રેમને કોઈ રીતથી,  
પ્રેમથી પ્રેમનું કામ પ્રેમ લીધાં કરે ચહી.

આપવું પ્રેમ જાણો છે, આપવામાં કૃતાર્થતા  
—પ્રેમ પોતાની શી માને ! પ્રેમ-ભાવ અખંડ હો !

પ્રેમના ભાવમાં કેવી ગતિ અદ્ભુત હોય છે !  
જાણો ત્યાં ના ગતિ હોય એવી તે સ્થિરતા ધરે.

વિરોધભાસી શો ભાવ પ્રેમનો લાગતો કદી,  
સ્વરૂપ ના પૂરેપૂરું પ્રેમનું કો શકે કળી.

પ્રેમને ના કશું મિથ્યા, દેખે તાત્પર્ય સર્વમાં,  
નકામું ના કશું એને, સર્વનો અર્થ પ્રેમમાં.

બધાંના હાઈમાં પ્રેમ નીરખી શકતો ઉંચુ,  
પ્રેમને પ્રેમથી પોતે તારવ્યાં કરતો બધું.

નિરખત પ્રેમને કોઈ, વિના પ્રેમ બીજી નથી,  
ઓળખે અન્યથા કોઈ, પ્રેમને ત્યાં તમા નથી.

પોતામાં તે રહે મસ્ત, પોતાથી પ્રેમ તે કરે,  
અપેક્ષા પ્રેમ ના રાખે, પ્રેમ સ્વાર્થ નહીં ધરે.

મર્યાદા પ્રેમમાં ના કો સંકોચ પ્રેમમાં ન કો,  
ઉડી પાર જવા સૌની પ્રેમ શી પાંખ આપતો !

સંતોષાતો નથી પ્રેમ અસંતોષ ધર્યા કરે,  
પ્રેમથી પ્રેમની મૂડી વધાર્યા કરવું ચહે.

પ્રેમથી કુમળો કોઈ ભાવ આ વિશ્વમાં નથી,  
પ્રેમના જેવી કો બીજી ક્યાંયે કઠોરતા નથી.

શિલ્પીના ટાંકણાં જેવો પ્રેમ ઘાટ ઘડ્યાં કરે,  
પ્રેમને પ્રેમ શો પોતે અનોખી રીતથી ધે !

રૂપ ભાવ નથી જેમાં જન્માવે પ્રેમ તે થકી,  
બોલતી મૂર્તિ જાણો હો ચેતના ભાવવાળી શી !

મૃત્યુ કરાવવું યોગ્ય ત્યાં તે મૃત્યુ કરાવતો,  
લાગે જન્માવવું યોગ્ય ત્યાં તે જન્મ અપાવતો.

પોષવું યોગ્ય જે લાગે એને પ્રેમ ઉછેરતો,  
પ્રેમને યોગ્ય શું તે તો પ્રેમ પોતે પિછાનતો.

(‘જીવનપગલે’, આ.ડ, પૃ. ૮૦ થી ૮૫)

\*

\*

મર્યાદા આખરી સુધી એવો તો વળગ્યાં જશે,  
ત્યાં સુધી રાહ શી જોઈ પોકાર્ય પ્રિયને જશે.

એને નિસ્બત કો સાથે પ્રેમ વિના કશી ન તે,  
પ્રેમથી ઉદ્ભબે પ્રેમ જો ના, નિસ્બત તો ઘટે.

પ્રેમનો હક્ક જે કોઈ પૂર્યાં આનંદથી કરે,  
તેવાને હક્ક સર્વસ્વ આપ્યાં પ્રેમ સદા કરે.

જેના પર રીજે પ્રેમ એને તો નિજનો કરે,  
પોતા જેવો બનાવીને પોતાનામાં રમાડશે.

પ્રેમની ભૂખ જે ભાંગે ભાંગશે ભૂખ એહની,  
પ્રસન્ન જે કરે પ્રેમ, વરાયે તે જ પ્રેમથી.

પ્રેમ નિર્બળતાથી કેં સાંખી બીજાંનું લે ન તે,  
પ્રેમ જો સાંખતો દેખો તો તે પ્રવેશવા હણે.

ના પ્રત્યાઘાત આઘાતો પ્રેમને વળગ્યાં કરે,  
કરે જો પ્રેમ એવું તો પ્રેમી કાજ કર્યાં કરે.

મેલ જીવનનો લેવા એને જરવવા તણી,  
પ્રભુકૃપાથી તાકાત એણે તો આપી છે ઘણી.

મેલ શાને ભરી રાખો અંતરે એકઠો કરી ?  
જે જે સ્ફુરે, તરે ઊંધું એને ના સ્થાન દો જરી.

પીધેલું શંકરે જેર હળાહળ શી હકીકત !  
અનુભવાવવા એ તો મળ્યાં શાં સ્વજનો અહા !

(‘પ્રણામ-પ્રલાપ’, આ.૨, પૃ. ૪૧)

દેવાતો હોય તો દેજો આપવો હોય આપજો,  
પ્રેમની વાંછના ભૂખ લાગી જો હોય આપજો.

બાકી હું પ્રેમનો ભૂખ્યો, માનવી આપી આપીને-  
એને તે શું શકે આપી ? છાલો મારો સમર્થ છે.

ધૈર્ય છે ઉર એને કે ‘ભાવ કામ કરાવશે  
—હશે જો ભૂમિકા ભાવ જાગેલો આપણા હૃદે.’

તેથી મહત્વ આપું છું હૈયાના ભાવને ઊંધું  
કેળવ્યાં કરશું પ્રેમ વળે તો કો દી આપણું.

‘ઉરના મર્મને વીધે એવો પ્રેમ થયાં જતાં,  
‘પાકવાનું બધું કામ,’ એવો નિર્ધાર દિલમાં.

(‘પુનિત પ્રેમગાથા’, આ.૨, પૃ. ૮૮, ૮૯, ૨૧૫)

કેળવી જો શકાયે તે એવો જીવન પ્રેમ તો,  
જન્મશે સર્વ ભાવો તે એની મેળે કહ્યા વિના.

કરાવે પ્રેમ પ્રત્યક્ષ ગૂઢમાં ગૂઢ તત્ત્વ જે,  
કિંતુ પાવકમાંથી ત્યાં શું પસાર થવું પડે !

(‘જીવનપગલે’, આ.૧, પૃ. ૬૦)

\*

\*

## ગુરુથી થતું સાધકનું જીવન-ઘડતર

વ્યાયામશિક્ષકનું કાર્યક્ષેત્ર શરીરવિકાસ છે. શિક્ષકનું કાર્યક્ષેત્ર મનોવિકાસ કે બુદ્ધિવિકાસ છે, તેમ ગુરુનું કાર્યક્ષેત્ર માનવસ્વભાવનું હિંબ રૂપાંતર કરવાનું છે, શીલવિકાસનું કાર્ય ભાગ્યે જ શિક્ષકના કાર્યક્ષેત્રમાં આવી જાય છે. માનસિક વિકાસ થોડો ધાર્ણો શિક્ષક કરાવી શકે છે. આધ્યાત્મિક વિકાસ થતો હોય તો બહુ જ નજીવો અને આડકતરી રીતે. આમ જ્યાં શિક્ષકનું કાર્ય સમાપ્ત થાય છે ત્યાંથી સદ્ગુરુનું કાર્ય શરૂ થાય છે.

લાગણીઓ, પ્રેરણાઓ, પ્રાણ, મન, બુદ્ધિ, ચિત્ત, સંસ્કાર, સુખ માનસ વગેરેમાં જે જે કુટેવો ગળે ઘંટીના પડ જેવી લટકતી રહ્યાં કરીને સાધકનો આત્મિક વિકાસ અટકાવતી હોય છે, તે બધી દૂર કરી અથવા શુદ્ધ કરી, આત્મસ્થિતિમાં પ્રગટવામાં સાધકના પ્રયાસને સદ્ગુરુ સહાય કરે છે. ગુરુનું કાર્ય માત્ર બોધ દેવાનું નથી, પરંતુ સાધકની સુખુપ્ત શક્તિઓને છતી કરી જાગ્રત કરવામાં મદદરૂપ થવાનું છે.

આવા અતિ સૂક્ષ્મ કાર્ય માટે કુદરતી રીતે જ સાધન પણ સૂક્ષ્મ યોજાતું હોય છે. આ સાધન એટલું તો સૂક્ષ્મ હોય છે કે સાધકને શરૂમાં તો ખબર પણ પડતી નથી કે પોતે ગુરુની અસર નીચે પ્રવર્તતો હોય છે. અલબજ્ઞ આ વિદ્યામાં વાણી છેક વજ્ય નથી, પરંતુ સૂક્ષ્મ સંબંધ કરતાં ઉપદેશાત્મક વાણી ઓછી અસરકારક હોય છે ને તેથી તેનો ઉપયોગ પણ ઓછો કરવામાં આવે છે. આવા જ કોઈ કારણસર સદ્ગુરુઓ અને સંતો ધારી વાર નિર્જિય અથવા તદ્દન સ્થગિત જેવા દેખાય છે, અને તે કેવળ જગતમાંનાં આંદોલનો પરત્વે જ નહિ પણ જેઓએ એમને માર્ગદર્શન માટે સ્વીકાર્ય હોય તેવાઓ પ્રતિ પણ ખરી રીતે તો જગત કે પેલા સાધકો ભલે ન જાણો, તેમ છતાં તેઓ તો સૂક્ષ્મ

અને અદૃશ્ય રીતે ખૂબ જ પ્રવૃત્તિશીલ પેલાઓના હિતના કારણો જ રહ્યા કરતા હોય છે. તેઓ વાણી દ્વારા ઉપદેશ આપે કે ન આપે, સાધકોને સમીપમાં રાખે કે દૂર રાખે, તોપણ આધ્યાત્મિક શક્તિનાં આંદોલનો તેઓ સતત વહેવડાવ્યાં કરતા જ હોય છે. આવાં આંદોલનો સાધકોના વ્યક્તિત્વમાં ઊંડાં પ્રવેશીને તેમનું પરિવર્તન કરવા માંડે છે. સાધકની નિદ્રાવસ્થા વેળા જ્યારે તેના આંતરસત્ત્વને પહોંચવું કેંક વધુ સુગમ હોય છે, ત્યારે પણ સદ્ગુરુ આવાં આંદોલનોના ઉપયોગ કેટલીક વાર કરતા હોય છે.

સાધકનાં આંતરૂ-મંથનો તથા તેની સમીપ ખડા થતા કોયડાનું જ્ઞાન ગુરુને હોવાથી, એ એવા કોયડાનો ઉકેલ કદીક કદીક વાત વાતમાં ગ્રીજ વ્યક્તિની સાથે વાત કરતાં જ આપી દેતા હોય છે. સાધકને આ કારણે ખૂબ જગ્રત રહેવાની જરૂર પડતી હોય છે ને તેની ચકોરતાને તાલીમ પણ મળતી રહે છે. કેટલીક વાર કડવા અનુભવે જ શીખવા દેવાની ગુરુની દેખીતી રીતે નિર્દ્ય પદ્ધતિમાં સાચી કરુણા, ડહાપણ અને પ્રેમ સમાયેલાં છે, એમ સાધકને ભાન થાય છે; ને પોતાના એકમાત્ર સાચા અને પ્રેમપૂર્ણ હિતકારીને તે ભ્રમણામાં તણાઈને મનમાં દોષ દેતો હતો એવું જબકતાં તે વળી વધારે ગુરુ પ્રતિ આકર્ષય છે. હવે એને સૂજે છે કે કપરા સંજોગોમાં જાણી જોઈને એને મૂકવામાં આવ્યો, તો જ એની અંદર દટાઈ રહેલી શક્તિ જોર કરી ફૂટી નીકળી ને લાભ થયો. ઊંડા પાણીમાં હડસેલનાર પણ ગુરુ અને તરફડિયાં મારી કિનારે પહોંચવાના તેના પ્રયાસમાં ગુપ્ત સહાય આપનાર પણ ગુરુ છે; કેટલીક વખત હુન્યવી કાર્યોનો લગભગ અસાધ્ય બોજો નાખીને ગુરુ તેની પ્રગતિ દુંધતો અથવા પીછેછઠ પણ કરાવતો લાગે; પરંતુ એમાં પણ અંતે કલ્યાણકારી પરિણામ સાધક અનુભવે છે. શ્રદ્ધાની આકરી કસોટી થાય એવાં કાર્યો

પણ ચીંધવામાં આવે છે. આવી બધી પ્રવૃત્તિઓ દ્વારા સદ્ગુરુનો હેતુ પોતાની સાથે સાધકની ચેતનાની સાંકળ દઢ અને અતૂટ થવા માંડે તે પણ હોય છે. કેટલીક વાર ગર્ભિત, સૂક્ષ્મ દ્વિઅર્થી કે અનેક અર્થી વાણીનું પણ અવલંબન સાધકની સૂક્ષ્મતા, ચકોરતા અને વિવેકશક્તિના વિકાસ માટે લેવામાં આવતું હોય છે.

શરૂઆતના સાધકને કેટલીક વાર અનુભવ થાય છે કે ગુરુ તેની યોગ્ય કે અયોગ્ય એવી બધી ઘણી ઈચ્છાઓ પૂરી કરે છે; અને ગુરુને આથી કેટલીક વાર ઘણું સહન કરવાપણું પણ આવે છે તો તેને તે પોતાનું પ્રારબ્ધ ભોગવાઈ જાય છે, એમ જાણીને તેવું બધું થવા દે છે. જ્યારે સાધકને આની જાણ થાય છે, ત્યારે એનો ગુરુ પ્રત્યેના પ્રેમનો હુવારો જોરથી ફૂટી નીકળે છે. શરૂઆતમાં સાધકને જાણ નથી થતી કે પોતે કોઈ સૂક્ષ્મ અસરને પરિણામે ઘડાતો જતો હોય છે. તે વખતે દુઃખદ લાગતા અનુભવો પણ એને થવાનાં; પરંતુ જો એવા વિષમ સંજોગોને પણ તે આનંદપૂર્વક સ્વીકારી લે છે તો પ્રગતિ જટ થાય છે. કોક વાર ગુરુ પોતાની દિવ્ય ચેતનાશક્તિનો સહજ પરચો પણ સાધકને બતાવે છે—જેને સાધક ચમત્કાર તરીકે લેખતો હોય છે—અને એ સાધન દ્વારા પણ સાધકને પોતાના પરત્વેના આકર્ષણમાં પ્રેરાવતો હોય છે. કેટલીક વાર આધાત આપીને પણ પેલાનાં મન, પ્રાણ, બુદ્ધિને સંકોરીને સતેજ કરી પોતા તરફ વાળતો હોય છે. જેમ મા પોતાના બાળકને કોક વાર હસાવે છે, કોક વાર પટાવે છે, કોક વાર લાડ લડાવે છે તો કોક વાર રડાવે છે ને કોક વાર તેની સાથે ગુસ્સે પણ થાય છે તેમ ગુરુ પણ સાધક સાથે વર્તતો હોય છે;—પરંતુ અલબજ્ઞ માની જેમ પ્રકૃતિવશપણે નહિ કિંતુ સભાન-સજ્ઞાનપણો-પ્રકૃતિ પરના સ્વામિત્વ સાથે હેતુપૂર્વક. સાધકની પ્રગતિ જેમ જેમ સધાતી જાય છે તેમ તેમ તેને પ્રતીતિ થતી જાય

છે કે ગુરુનું માર્ગદર્શન અને વર્તન કશા પણ અગાઉથી કરાવેલા વિચારથી પ્રેરાયેલ નહિ પણ સહજ અને સ્વતઃસ્હૂર્ત હોય છે અને એના એકેએક કાર્યમાં, વાણીમાં અને હાવભાવમાં ગૂઢ હેતુ પણ સમાયેલો હોય છે. એવો કોઈ જાતનો મત કે સિદ્ધાંત નથી હોતો કે જે ગુરુનો પોતાનો આગવો અંગત ગણાય. એ તો પળ પળ બદલાતી પરિસ્થિતિ અને વ્યક્તિને-સાધકને યોગ્ય જે જાતનું ત્યારે વલાણ અને વર્તન ઘટિત હોય તે તટસ્થતાપૂર્વક રાખે છે. તેનું આજનું વર્તન કાલ કરતાં તદ્દન બિન્ન પ્રકારનું પણ હોઈ શકે છે.

(‘જીવનસંદેશ’, આ.૨, પૃ. ૧૬૪ થી ૧૭૩)

જ્ઞાનની કક્ષામાં આવ્યા પહેલાં તે સ્થિતિ પ્રાપ્ત કરવાને માટે પોતાની જાત પ્રત્યે જેવો સખ્ત અને નિષ્ઠર સદ્ગુરુ બન્યાં કરેલો હોય છે, તેવો જ નિર્દ્ય તે સાધક પ્રત્યે પણ વખત આવ્યે જરૂર થતો હોય છે. દરેક સાધક સાથે પાછો તે તે પ્રમાણે જ વર્તશે એવું પણ નથી. કયા સાધકની પ્રકૃતિ કેવી છે અને તેના પોતાની સાથેના કર્મ-પ્રારબ્ધના સંજોગો કેવા છે, તેની તેને જાણ હોવાથી સાધક - સાધક સાથે યોગ્ય સમયે તે તે સાધકના કલ્યાણ અર્થે જ તેનો તેવો વર્તાવ રહેતો હોય છે. શરૂઆતમાં ને ઘણી વાર તો લાંબા કાળ સુધી પણ સાધક આવું વર્તન સમજ શકતો હોતો નથી, ને તેથી ગુરુ પ્રત્યે તે કોષે પણ ભરાય કે મનમાં અન્યથાપણે પણ વિચારે; પરંતુ તેથી તો સાધકને પોતાને જ નુકસાન થાય છે. સાધકને ગમે તેવું દુઃખ કે કષ થાય તોપણ જરૂર ઉભી થતાં જે કંઈ યોગ્ય કરવાનું હશે તે કરતાં ગુરુ અચકાશે નહિ. જ્યાં સુધી એવી ઘડતરની ને ચણતરની છિયાને સાધક દુઃખ અને કષ ગણ્યાં કરશે, ત્યાં સુધી એને સંતાપ અને કલેશ રહ્યા કરવાનો.

(‘જીવનસંદેશ’, આ.૪, પૃ. ૮૧)

\*

\*

એક જ ગુરુને સાધકો જુદી જુદી રીતે અનુભવતા હોય છે. એક સાધકને તે વ્યવસ્થિત, કાળજીવાળો, ચોકસાઈવાળો, સમૃતિવાળો, એવા એવા પ્રકારનો દેખાય. વળી બીજો સાધક એને બીજી રીતના અનુભવવાળો નિશ્ચયપૂર્વક તેમ જાણતો હોય છે. વળી ત્રીજા પ્રકારના જીવ સાથે તે ત્રીજી જ રીતે માલૂમ પડતો જણાય છે. એમ તે અનેકની સાથે જુદો જુદો દેખાતો હોય છે, ને તેવો તેમને અનુભવ થતો હોય છે; તેથી કોઈએ તેવી કોઈની જણાવેલી હકીકતમાં ભેટ માનવાપણું નથી. પોતપોતાને તેવાનો થએલો અનુભવ તેને તેને સ્થાને યથાર્થ હોવાનો પૂરતો સંભવ રહે છે.

\*

\*

બધાંની સાથે મારું એક જ જીતનું વર્તન હોતું નથી. કોઈની સાથે વ્યાવહારિક રીતનું હોય છે તો કોઈ સાથે એનાથી તદ્દન ઊંધું. એમ કોઈ મને સરખાવે તો મારું વર્તન સમજાય નહિ એવું હોય છે. જેને ‘વદ્તોવ્યાધાત’ કહે એના જેવું પરસ્પર મેળ ન ખાનારું પણ હોય છે. એને કેટલાક દંભ પણ કહી શકે; પણ મને એની કશી પડી નથી, કારણ કે વ્યાવહારિક વર્તન ક્યાં રાખવું ને ક્યાં ન રાખવું એનો પ્રભુકૂપાથી મને વિવેક છે. એટલે તમારી—સાધકની બાબતમાં મારાથી વ્યાવહારિક વર્તન થઈ શકશે નહિ. (‘જીવનપગથી’, આ.૩, પૃ. ૬૫)

\*

\*

જીવ તો હંમેશાં પાર્થિવતાની પકડમાં જ રહીને, એના ચોકઠામાં જકડાઈને જે તે બધું વિચારતો હોય છે. ગુરુની સલાહથી એને દેખીતો ગેરલાભ પણ થતો દેખાય—તેમ પણ બને—તેમ છતાં ગુરુનો હેતુ તો પેલાના જીવનના કલ્યાણ કાજેનો હોય છે. એટલે એવાનું કહેવું જો માત્ર પોતાના આંતરિક જીવનવિકાસની

ભૂમિકા પરથી અને માત્ર અંતર્મુખપણાના માપથી, તટસ્થ  
 સાત્ત્વિકતાથી જો ગ્રહણ કરવાનું બની શકે તો તેથી ઉપજતી સર્વ  
 કોઈ સ્થિતિમાં માનવીનાં દાણિ, વૃત્તિ અને વલશ જીવનવિકાસ  
 પરતે રહેવાયાં કરવામાં પ્રેરણારૂપે ઝળહણ્યાં કરે. જે સંતના  
 સમાગમમાં આપણે આવ્યા હોઈએ અને જેની અતિમાનવતાનાં  
 દર્શન અને અનુભવ આપણને હૃદયથી થયાં હોય ને પછી કોઈ  
 એવા કશાકના કંઈક વિષે આપણામાં ગડમથલ જાગે, તો એનાં  
 પેલાં અતિમાનવતાનાં દર્શન ને આપણને એના થયેલા  
 અનુભવોના દઠ જ્યાલથી, તેવા તેના ‘કંઈક’નો આપણા જીવન  
 વિષેનો શો હેતુ હોઈ શકે, એવું તટસ્થતાપૂર્વકનું પૃથક્કરણ  
 જ્ઞાનપૂર્વક જો કરવામાં આવે, તો તેવાનો કોઈક દિવ્ય હેતુ  
 સમજાયા વિના રહે નહિ. અતિમાનવતાનાં દર્શન ને અનુભવ  
 જેના વિષે આપણને ખરેખરાં થયાં હોય, તેના વિષે કશી સગડગ  
 પણ ન હોય, અને જેના વિષે બુદ્ધિ પણ તે કબૂલ કરતી હોય,  
 તો તેવી વ્યક્તિ કદી પાર્થિવપણાના જીવનવાળી હોઈ શકતી  
 નથી. જેમ વિજ્ઞાનશાસ્ત્રમાં ગમે તેમ અલેલટપે કશું જ સ્વીકારી  
 લેવાતું નથી, તેના કરતાં પણ વિશેષપણે આમાં એનાં યોગ્ય  
 પ્રમાણો ને લક્ષણો હોય છે. કાં તો એમ સંભવે કે એવાનાં  
 અતિમાનવતાનાં દર્શન કે અનુભવ કરવામાં આપણી માત્ર સાવ  
 અંધશ્રદ્ધા હોય, તો પછી જુદી વાત. પરંતુ જેનો અનુભવ નરી  
 પ્રમાણભૂત હકીકતોને આધારે, નરી આંખે, બુદ્ધિ ને મનથી  
 પ્રત્યક્ષ થયો હોય, અને એ નક્કર હકીકત હોય, તો પછી એના  
 વિષે કશું વિચારવા કરતાં પોતા વિષે જ સાધકે ઊંડામાં ઊંડું  
 વિચારવામાં લક્ષ આપવું યોગ્ય લાગે છે.

(‘જીવનપ્રવેશ’, આ.ર, પૃ. ૧૫૭-૫૮)

\*

\*

મારામાં (ગુરુમાં) તો કશું નથી. જે કંઈ તમોને લાભ મળ્યાં કરશે તે તમારા થતા જતા વિકાસને અંગે તથા તમારા મળતા જતા સંકિય સાથને કારણે આ જીવથી જે તે બધું બન્યાં કરવાનું છે; કારણ કે સ્વતંત્રપણે તો મારે કંઈ કશું કરવાપણું પ્રભુકૃપાથી રહેલું હોતું નથી. સ્વતંત્રપણે કંઈ કશામાં આ જીવને પરોવાવાપણું રહેલું નથી. જે તે બધું Relatively-સાપેક્ષપણે-રહ્યાં કરે છે.

\* \* \*

કરોળિયાને ચઢવાને માટે આધારભૂમિકા રૂપે સૂક્ષ્મમાં સૂક્ષ્મ તાંત્રણો પણ જેમ જરૂરનો રહે છે તેમ મારું પણ તેવું છે.

### શિલ્પી-ટાંકણા શો પ્રેમ

(અનુષ્ઠાપ)

શિલ્પીના ટાંકણા જેવો પ્રેમ હોવો ઘટે હદે,  
આકાર ભાવને યોગ્ય તેવો પ્રેમ દઈ શકે.

કાળની જેમ તે કૂર મૂર્તિને ઘડવા સમે,  
સૂક્ષ્મ જ્યાં ઘાટ દેવો હો, હાથ એનો મૂછુ બને.

જેવું કામ, હદે તેવો ભાવ તે પ્રકટાવશે,  
ભાવ કેંદ્રિત તે રાખી કામમાં જવ પ્રેરશે.

પંપાળ્યે કામ ના આવે વૃત્તિને એમ તો કદી,  
ટાંકણા-પ્રેમથી વૃત્તિ નિત્ય યોગ્ય ઘડ્યાં જવી.

(‘પુનિત પ્રેમગાથા’, આ.૨, પૃ. ૮૨-૮૩)

પાછળ શો પડે પ્રેમ કેમ કેડો ન છોડી છે,  
પ્રેમ તે પરવા કોની ક્યાંયે રાખે ન સહેજ્યે.

મર્યાદા બાંધવા યોગ્ય ત્યાં તે બાંધે ખુશી ચહી,  
પોતાની મેળ તે વર્તે સ્વયંભૂ પ્રેરણા થકી.

### સંવાદી ગૂઢ તત્ત્વ

(અનુષ્ટુપ)

બજારુ-પ્રેમ સૌ કોઈ ખરીદી શકશે જગો;  
વરવા જો તમના હો પ્રેમ કોક વરી શકે.

પ્રેમ મેળવવા કાજે પ્રેમ સૌ આપવો પડે,  
પહેલાં પ્રેમ આપીને જાણો, પ્રેમ પછી ચહો.

પ્રેમ-જીવન એ પ્રશ્ન અંતરે વૃત્તિ-મેળનો,  
અંતરે વૃત્તિનો મેળ સાથે તે પ્રેમ મેળવે.

સંવાદી જે રહેલું છે વિશ્વમાં ગૂઢ તત્ત્વ તે,  
પ્રેમ દ્વારા જનો એને શોધવા મથતા હુદે.  
બીજ રૂપે રહેલું જે સંવાદી તત્ત્વ સર્વમાં,  
શોધી જે શકશે ઊંઠું, ફળાવે હેતુ ઘ્યેયમાં.

(‘પુનિત પ્રેમગાથા’, આ.૨, પૃ. ૮૩)

### ગુરુ અને સાધક

સાધક એક વખત પોતાના જીવનમાં ગુરુની આવશ્યકતા સ્વીકારી લે છે, તે પછી એને એની મહત્તમા સમજાયા વિના રહેતી નથી. એને સમજાતું જાય છે કે ગુરુ એટલે વિશ્વની પ્રત્યેક વસ્તુનું કોઈ પરમ ચેતનાશક્તિ સાથે શા માટે અને કેવી રીતે સંકળાવાનું બને છે, તે સમજાવનાર જ્ઞાન-શક્તિ. માનવી-જીવનનું શું રહસ્ય છે, શા માટે આપણાને જન્મ મળેલો છે, જીવનનો શો હેતુ છે, તેની સાથે જગતનો શો સંબંધ છે એ બધાંની કમશઃ સમજણ

જેની ચેતનાશક્તિ વડે પોતાનામાં પ્રગટ થતી જાય છે તે ચેતનાશક્તિ.

આમ જે સાધકને ગુરુની મહત્ત્વા સમજાય છે, તે જીવનમાં નવું નવું શીખતો જાય છે ને ધીમે ધીમે પછી ગુરુની નજીક આવતો જાય છે. શરૂઆતમાં સાધકને ગુરુની સ્થૂળ સમીપતાની જરૂર વધુ લાગે છે, તો પણ યોગ્ય ગુરુ તો તે સાધકને જરૂર પૂરતો જ પાસે રહેવા દેશે. જરૂર કરતાં વધુ રહેવું, એ સાધકમાં ગુરુ પ્રત્યેની જે યોગ્ય સમજણ કે આદરવૃત્તિ જન્મેલાં કે જન્મતાં હશે તે માટે લાભકારક ન પણ હોય. ગુરુ તો સાધકના આધારમાં બીજ રોપીને, અદશ્યપણે પોતાનો ભાવ જરૂર જેટલા પ્રમાણમાં રાખીને તટસ્થતાથી જોયા કરે છે. સાધક જ્યારે ગુરુની સમીપ હોય છે, ત્યારે ગુરુ એવા કંઈ ને કંઈ પ્રસંગો ઉપજાવે છે કે જેથી સાધકનું મન ગુરુમાં આકષ્યિલું રહ્યાં કરે.

જે સાધક પોતાનાં જૂનાં મંતવ્યો, સમજણો, ગણતરીઓ, મડાગાંડો, આગ્રહો આદિ રાખ્યાં કરતો હશે, તેને તે બધાંમાંથી છોડાવવા ગુરુ કોઈ ને કોઈ સૂક્ષ્મ પ્રયત્ન કર્યા કરતા હોય છે—કોઈક વાર આધાત આપીને પણ. આથી સાધકને અંતરમાં વિરોધ પણ જાગતો હોય છે. પરસ્પર બે વિરોધી બળોની અથડામણને લીધે આવું થવાનું જ. ગુરુનો ભાવ સાધકના પ્રત્યેક તબક્કામાં તેની સાથે રહ્યા કરતો હોય છે.

જે સાધકને પોતાના જીવનના હેતુની ગેડ હજી બરાબર બેઠી નથી કે તેનું પૂરેપૂરું મહત્વ હજી અંતરમાં વસી ગયું નથી તેવો સાધક ગુરુને યથાર્થ રીતે સમજ શકતો નથી; એટલું જ નહિ પણ પોતાની અધૂરી સમજણ અનુસાર ગુરુ વિષે મત બાંધીને તેમને અન્યાય પણ કરતો હોય છે. આવા વલણથી ગુરુની

નિકટતા કર્દી પણ લાભ અપાવી શકતી નથી. જો સાધક અતિમાય  
ન બાંધી લેતા ખુલ્લો રહેવા મથે ને રહે તો લાભ મેળવી શકે છે.

કદાચ કર્મ-પ્રારબ્ધના સંજોગે કોઈ અતિ નીચલા થરના  
સાધક સાથે ગુરુનો સંબંધ થયો હશે તો અનેક જાતની મથામણો  
તે સાધકના જીવનમાં ઉદ્ભવવાવીને તેને ઊંચે લાવ્યા વિના ગુરુ  
રહેનાર નથી. આ કાર્યની પરિપૂર્ણતા માટે એને મન કાળનો  
પ્રશ્ન હોતો નથી. એને તો અપાર ધીરજ હોય છે. સાધકને પોતાનું  
સ્પષ્ટ ભાન જાગે એવું કરાવવામાં તે કશુંયે બાકી રાખતો નથી.  
અલબત્ત સાધકના હાથે જ તે બધું તે થવા દે છે. એની પાછળના  
સંજોગોમાં પોતે ઊભો છે એવો જ્યાલ પણ તે સાધકને જાગવા  
દેતો નથી. પરંતુ સાધક જ્યારે ગુરુનો સૂક્ષ્મ હાથ ઓળખી કાઢે  
છે, ત્યારે તેને પોતાના જીવનની ફૂટાર્થીતા થતી લાગે છે.

(‘જીવનસંદેશ’, આ.૪, પૃ. ૧૬ થી ૨૧)

\*

\*

ગુરુની સમીપતા વેળાએ જુદી જુદી પ્રકૃતિનાં અનેક  
માનવીઓ સાથેના ગુરુના વર્તિવમાં શરૂઆતના સાધકને  
જીવનદસ્તિના અભાવે દંભ, ડોળ, આડંબર, અહંકાર, કોધ એમ  
પ્રકૃતિની જુદી જુદી અનેક વૃત્તિઓ જાણાયાં કરે છે. ગુરુ પોતાનો  
પ્રભાવ, ઓજસ, મહતા, શક્તિ વગેરે સાધકના દિલમાં  
જોરજુલમથી જાણે ઠસાવવા માંગે છે એવું પણ સાધક કલ્પયા વિના  
નથી રહી શકતો. આવાં બધાં સાધકનાં વલણોને ગુરુ સ્પષ્ટપણે  
જાણી જતો હોય છે; તોપણ પોતાના વર્તનનો યોગ્ય ખુલાસો ગુરુ  
ભાગ્યે જ કરે છે. પોતાને ઊંધી રીતે આસાનીથી સમજાવા દે છે.  
તેને ધીરજ હોય છે કે સાધક જો સાધનાને જ મહત્વ આપ્યાં કરશે  
તો આજે નહિ તો કાલે, ગુરુનું વિચિત્ર કે દેખીતી રીતનું અયોગ્ય  
લાગતું વર્તન તેના યોગ્યપણામાં સાધકને સમજાયા વિના રહેવાનું નથી.

(‘જીવનસંદેશ’, આ.૨, પૃ. ૨૨)

કોઈને પણ એનાં લખાણો કે એના પત્રોના અભ્યાસથી કે તેના તત્ત્વજ્ઞાનની સમજણથી પણ આપણે પૂરેપૂરા સમજ શકીશું નહિ. એ કાજે એવાનો નિકટ સહવાસ જરૂરી ભલે હોય છતાં તે પણ પૂરતું નથી. સતત એકધારો જીવનવિકાસક અભ્યાસ અને હૃદયની ભાવનાથી સેવેલો સહવાસ; તે ઉપરાંત તેનું હૃદય સમજવાનો ને એના જીવનની સમગ્ર, સંંગ અને સર્વતોમુખી વિચારસરણી, ભાવસરણી અને જીવનસરણીની ઈમારત કર્યા પાયા ઉપર ચણાયેલી છે તે જાણવા, સમજવા અને અનુભવવાનો આપણો નમ્રભાવે, જિજ્ઞાસુભાવે, હૃદયનો સત્તુપ્રયત્ન હશે તો જ તેનું જીવન-મૂળ આપણને કદાચ હાથ લાગશે. અને જો હાથ લાગે તોપણ તે પૂરેપૂરી રીતે તો નહિ જ. આથી સાધક પોતાનામાં થતાં પરિવર્તનોને સત્ય હકીકત રૂપે અનુભવશે, ત્યારે તેના દિલમાં ગુરુની પરમ મહત્ત્વાનો ને ઉપયોગીપણાનો વધારે ને વધારે સૂક્ષ્મ સ્ફોટ હૃદયથી થતો જશે.

(‘જીવનસંદેશ’, આ.૨, પૃ. ૫૨-૫૩)

ગુરુની સમીપતા યોગ્યતાવાળી અને ફળદાયી તેટલા જ પ્રમાણમાં ગણી શકાય કે જેટલા પ્રમાણમાં સાધકનું સમગ્ર જીવન તેની ચેતનાશક્તિ સાથે સંકળાતું જાય અને તેનો દૈવી લાભ લેવાતો જાય. સાધકે પોતે જ આ બાબતમાં સજાગ રહીને પોતાની નિભ પ્રકૃતિઓનાં વિકૃત વલાણોનો ઈન્કાર સતત કર્યા કરીને મથ્યાં કરવાનું રહે છે. (‘જીવનસંદેશ’, આ.૪, પૃ. ૨૭)

\*

\*

જે સમજણ કે પ્રેરણાઓ સાધકને મળે તે સાધકને રચનાત્મક મદદ અને વેગ આપનારી હોય, તેની અસરને આડફિટે લઈ જનારી ન હોય તે વિષે સાધકે સૂક્ષ્મ જગ્યાત વિવેક રાખ્યાં કરવો રહેશે. કારણ કે જે ચેતનાશક્તિ સાથે આપણો સંબંધ થયેલો છે,

તે ચેતનાશક્તિ વ્યક્તપણે નિર્મણ સરળતાથી આપણી સાથે કામ લઈ રહેલી હોતી નથી. આપણને તે કદીક બીજું પણ બતાવે; અને તે વેળાએ આપણી પૂરી કસોટી થઈ જવાનો સંભવ રહે છે. આ કારણથી સાધકે કદી પણ વિવેક-શક્તિ નહિ વાપરવી કે બુદ્ધિનો ઉપયોગ નહિ જ કરવો એમ માની લેવું તે બરાબર નથી. આપણામાં પૂરેપૂરી સમજ, તુલનાત્મક બુદ્ધિ ને શક્તિ, પ્રત્યેક પરિસ્થિતિમાં પોતાનો શો ધર્મ છે, તે સમજ લેવાની સહજશક્તિ, ગુંચોનો ઉકેલ તરત કરવાની હૈયાસ્યુઝ—એવું બધું આપણામાં ઉગાડવા માટે ગુરુની ચેતનાશક્તિ છે. એ શક્તિ આપણને પરાધીન રાખવા માગતી નથી; પણ પોતાના જેવા જ ચેતનાશક્તિવાળા બનાવવા ઈચ્છે છે.

(‘જીવનસંદેશ’, આ.૪, પૃ. ૩૨-૩૩)

\*

\*

વળી, ઘણી વાર ગુરુ જેમ થતું હોય તેમ નિરાંતે થવા દે છે. તે કશું બેણે બેણે લાદી શકતો નથી. એ પણ તેની તેની તેવી તેવી ભૂમિકા માગી લેતો હોય છે. સમાચિની અને વ્યક્તિની રચનામાં અને ચલણામાં આ જગતમાં રહેલા મહાન આત્માઓ સાક્ષીવત્ત જ રહેતા હોય છે. વળી સાધક ગુરુને પૂરેપૂરા હૃદયથી સ્વીકારી પણ શક્યો હોતો નથી. કદાચ ધારો કે ગુરુ એને હંકારવાનું ઈચ્છે તોપણ પેલો જીવ એને સમજ ન શકે, એના ભાવની રીતે તે ચાલી પણ ન શકે. ગુરુના આધાત-પ્રત્યાધાત સ્વીકારવા એ સહેલું નથી. અરે ! સ્વીકારવાનું તો બાજુએ મૂકો, પણ સહેવા પણ અટપટા છે. સાધકની કક્ષા જ્યાં સુધી જીવભાવમાં હોય છે, ત્યાં સુધી તેવો જીવ ગુરુની ભાવનાને ને ચેતનાને અને તેના યોગ્ય પ્રકારના હકીકતપણાને સમગ્ર ને સર્બાંગપણે સમજ શકવાને સમર્થ બની શકતો નથી. ગુરુની જાગી ગયેલી ચેતનાશક્તિની

પ્રતીતિ અને અનુભવો જીવને અનેક વાર થયા હોવા છતાં સાધક જીવદશામાં છે, ત્યાં સુધી તેવા આત્માની યોગ્યતામાં તેને સગડગ જગ્યા વિના રહી શકતી નથી. જીવસ્વભાવમાં જકડી રાખવા આપણામાંની પ્રકૃતિ આપણને અનેક સ્થૂળ, સૂક્ષ્મ અને કારણરૂપે કુંઈ અને કુંઈક કશુંક બતલાવી કે અમુક આપણી તેવી દશામાં ‘હકીકતપણે’ દેખાય તેવું બતાવીબતાવી મનને પેલાનામાં એકરાગ થતું અટકાવવા બધાં જ તનતોડ પ્રયત્ન તે કરતી રહેવાની જ.

(‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૧૨૩ થી ૧૨૫)

\*

\*

જ્યાં સુધી સાધકનો સંપૂર્ણભાવ એકરાગપણે ગુરુમાં સર્વ ભાવે ને સર્વ રીતે શરણપણાની જીવતી ભાવનામાં પૂરેપૂરો ન બની શક્યો હોય, ત્યાં સુધી ગુરુ પણ બિચારો સાવ લાચાર હોય છે. એની લાચારીનો તો પાર નથી હોતો. એવા એના દર્દને કોણ પિછાની શકે કે કોણ અનુભવી શકે? ગુરુ તો મડદા જેવો છે. એને જીવાડો તો જીવે અને મડદા જેવો રાખી મૂકો તો તે તેમ પણ નિરાંતે પડી રહે. તે જીવતો આપણા આધારે જ બની શકે. ગુરુની ભાવના આપણામાં સર્વપર્ણભાવે, સર્વપણે, સમર્પણભાવે, ને કેંદ્રિતપણે જીવતીજાગતી આપણા આધારના એકે એક કરણમાં ન બની જાય ત્યાં સુધી ગુરુ પણ લૂલોપાંગળો હોય છે. ગુરુનામાં આપણો પૂરેપૂરો હૃદયથી હૃદયમાં એકરાગ થઈ જવો——તેમનામાંનું સ્વીકારવાની ભૂમિકા યોગ્યપણે થવા કાજે—ઘણો જરૂરી છે. તેવું થઈ શકે તો જ યોગ્ય ગુરુ યોગ્ય સાધકને તેની યોગ્ય રીતે હંકારી શકે. આવું આનું વિજ્ઞાનશાસ્ત્ર છે.

(‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૧૨૫-૨૬-૨૭)

\*

\*

જેને આપણે ગુરુ માનીએ છીએ, એની ચેતનાશક્તિને  
કેટલો વખત આપણા આધારમાં, વ્યવહારમાં, સંબંધમાં,  
વિચારમાં, ભાવનામાં, કર્મમાં મૂર્તિમંત કરતા હોઈશું? હદ્યની  
શુદ્ધ નિર્મળ ભાવનાથી એનો પૂરો પ્રયોગ તો કરો! એને તમારા  
આધારમાં કામ કરવા દેવાની અનુકૂળતા તો કરી આપો! તમારું  
ભરેલું ખાલી કરીને એને જ જ્યાં ત્યાં બધે જગા તો આપો! ને  
પછી જુઓ! મદદ ઉભી છે કે નહિ?

\* \* \*

### ગુરુ પરત્વે સાધકનો ને શ્રેયાર્થીનો ધર્મ

એમની પ્રત્યેક સૂચના નભ્રપણે, પૂરેપૂરા ભક્તિભાવથી,  
કંઈ પણ કશી આશા અપેક્ષા રાખ્યા વિના, આપણા પોતાના જ  
કલ્યાણાર્થે તે તે બધું છે એમ સમજીને અને તે વેળાએ તે સૂચનાથી  
બીજો સામો વિચાર ઉગવા દીધા વિના તે સૂચનાનો હદ્યપૂર્વક  
અમલ કરવાનું રાખવું.

ગુરુ અંગેની કોઈ ઘટના કે ગમે તેવી જાતની આકરી તેમના  
તરફની પ્રસંગ-કસોટીમાં, મન-બુદ્ધિથી ન સમજાય તેવી વેળાએ  
પણ મનમાં અકળામણ, ઉદ્દેગ કે બીજી વૃત્તિ ન જાગી શકે એવી  
દશા મનની રહ્યાં કરે અને મનમાં કંઈ કશાં બીજા ખ્યાલ ન  
જાગી શકે તો આપણા મનને જીવનના રચનાત્મકપણામાં જવતું  
થવાને, તે એક ભારે ઉત્તમ પ્રકારની તાલીમ થઈ પડે. સદ્ગુરૂભાવ,  
ભક્તિકે આદરભાવ જે આપણે રાખવાનાં છે, તે આપણા પોતાના  
જ જીવનવિકાસ કાજે કરવાનું છે.

વ્યાવહારિક ક્ષેત્રની જેમ આધ્યાત્મિક ક્ષેત્રે પણ જ્યાં સુધી  
આપણને તે ક્ષેત્રનું જ્ઞાન, સમજ કે અનુભવ નથી ત્યાં લગી એને  
(ગુરુને) આપણે યોગ્ય રીતે સમજ શકવાના નથી. આથી એના  
અંગે કંઈ પણ વિષે જેટલા ખુલ્લા મનવાળા આપણે રહી શકીએ

તે આપણા કાજે ઉત્તમ છે.

\*

\*

ગુરુ પણ સાધનરૂપ છે. એનું મહત્વ હોય તો તે સાધન પૂરતું જ છે. એને—એ સાધનને—ઘટતું ને જરૂર જેટલું ને યોગ્ય મહત્વ હોય તેટલું આપણે આપવાનું. તેનાથી ઓછું પણ નહિ ને વધારે પણ નહિ. વધારે આપવા જતાં સાધનમાં જ આપણે ભરાઈ પડવાનો સંભવ રહ્યાં કરે છે, ને ઓછું અપાતાં સાધનનો પૂરેપૂરો લાભ ઉઠાવી શકતો નથી.

(‘જીવનપગથી’, આ.૩, પૃ. ૧૯૨-૯૩)

\*

\*

આપણો પ્રેમ તેઓ (ગુરુ) માગે છે તે આપણા માટે માગે છે. જેટલો વધુ અપાય તેટલું આપણું જ શ્રેય છે. આપણા પ્રેમ વડે કરીને તેના કામમાં તે આપણને ભાગીદાર બનાવે છે. તેને આપણામાં કામ કરી શકવાને આપણામાં ભૂમિકા રચાવાના હેતુ અર્થે તે માગે છે.

\*

\*

સાધકે કોઈ પણ પ્રકારનો સંકોચ કે અંતર ગુરુની અને પોતાની વચ્ચે ન રાખવું ધટે. ‘જીવનસંદેશ’, આ.૪, પૃ. ૨૬)

\*

\*

પોતાના રાહબર પ્રત્યે અશ્રદ્ધા કે અસદ્ભાવનું મનનું કે એવા કશાયનું એક પણ મોજું-લહરી ન ઉઠે એ જોવાનું ને ઉઠે તો તેનો તત્કાણ ઈન્કાર કરવાનું કાર્ય સાધકનું હોવું ધટે..

ગુરુ અને સાધક

(અનુષ્ટુપ)

વિકાસ માટ આધાર માત્ર સાધન તો ગુરુ,  
ફેરફાર થવા કાજે એને યોગ્ય ગ્રહ્યાં જવું.

સર્વશ્રેષ્ઠ પ્રભુભાવ તોલે આવે ન એની કે,  
ગુરુ પગથિયાં રૂપે મથો જો ચઢવા ઉંચે.

વારો ભોગવવા આવે ગુરુને એથી તો ઘણો,  
પ્રેમ જો હો ગુરુ પ્રત્યે તેવું નિમિત્ત આપણે  
—એના ભોગવવા કેરું થવું ના ઘટતું કશે.

આલંબન લીધેલું છે, છતાં લીધા સમું ન તે,  
એનું ભાન નથી રે'તું જેને, તે શું કરી શકે ?

ઉદ્ભાવવા હદેમાંથી ચેતના-શક્તિની કળા,  
લીધો આશ્રય જેનો તો તે કાજે વાપરો ન કાં !

‘બધું કોક કરી દેશે’ મિથ્યા એ ભ્રમણા ખરે !  
પ્રત્યક્ષ સહાય, જો પોતે સાચી રીતે મથ્યાં કરે.

આપણે એક બાજુનું જોઈ ના શકીએ પૂરું,  
તેમાં બીજાનું તે માપ કાઢી શેં શકીએ કશું ?

આપણું માપ પોતાથી કાઢી તો શકતા નથી,  
દોઢાત્યાં થઈ શાને પેલાને માપીએ પછી ?

માપવા તો જતાં એને મપાઈ આપણે જશું,  
શકો માપી હદે ક્યાંયે એવાને કોઈ રીત શું ?

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૮૧, ૮૨, ૮૩, ૧૧૩)

દિલને ચીરતા એવા કદી વિચાર આવતાં,  
રોકી ત્યાં શકવા ચિત્ત, ભાવ લો ઉપયોગમાં.

વંટોળેથી વિચારોના કદીએ ઉડી ના જવું,  
સ્થિર રે'વું હદે ત્યારે ઉલટું વેગથી ઘણું.

શ્રદ્ધા, વિશ્વાસ ને પ્રેમ ઉંડી આદર-ભાવના,  
નઅતાની તમન્ના સૌ રાખશે શરણે તદા.

(‘પુનિત પ્રેમગાથા’, આ.૨, પૃ. ૧૬)

ભક્તિ ને પ્રેમ દેવાનાં પોતાને કાજ તો નથી,  
આપણા સૌ વિકાસાર્થે દેવાં જો યોગ્ય દો ચહી.

\* \* \*

જેના આધારથી પોતે ધાર્યું છે ચઢવા ઉંચું.  
તેનો આધાર લેવાનું ચિંતવ્યાં કર્યું ના કશું.

એની સ્મૃતિ બધાં કર્મ જાગ્યાં ઉંડી કરી ન તે,  
ઉભો પૂઠે સદા એ તો એવી ના ધારણા હદે.

સ્મૃતિ કો વેળ ઉઠેલી તેમાંયે પ્રાણ ના કશા,  
કેવી રીતે પછી આવે કેં ભલીવાર કામમાં ?

‘ઈશારે આપણે નાચે, ઈશારા આપણા વડે,  
પ્રેમ સર્વ કરે’ એવું માનવી શાં ચહ્યાં કરે !

પોતે ચલાવવા એને પોતાની માન્યતા રીતે,  
સદા તે માનવી ધારે કેવાં પામર મૂઢ તે !

(‘પુનિત પ્રેમગાથા’, આ.૨, પૃ. ૧૧૧-૧૨, ૨૦૩)

(શિખરિષ્ણી-મંદાકાંતા)

તમારે ઈશારે પ્રભુ ! નચવવાનું બધું મૂકી દેજો,  
ઈશારે એને સૌ જીવન રચવા ભાવ-તેયારી પ્રેરો;

ગુંડાયે છે માટી કણ કણ વિષે પાત્ર-આકાર યોગ્ય  
 બને છે ત્યારે તે, પણ ત્યમ થવા દેવું કોને ગમે છે?  
 કહેલુંયે જે કેં પણ કરી શકો ના તમે જ્યાં ઉમંગે,  
 વધારેની આશા કહીં થકી ધરું કેવી રીતે પછી તે ?  
 કશે પૂરેપૂરું સ્વરૂપ નિજનું ઓળખી ના શકો ને,  
 છતાં દાવો મોટો કયમ કરી ધરો, ના ગળે ઉતરે તે.  
 થવા મોટું ઈચ્છે જન બધાં, કિંતુ તેવું ઘડાવા,  
 —પડેકેવાકેવા વિષમટપલા ! તે ખમાયે બધા ના;  
 ખમાવાનું ક્યાંયે દૂર દૂર રહ્યું, ભાગતા દૂર ક્યાંયે !  
 પછી કેવી રીતે પ્રભુ ઘડી શકે ઉર વિચારજો તે.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. 303)

(અનુષ્ઠાપ)

પ્રેમમાં જો ભળાયું ના ભળી ક્યાંથી બીજે જશો ?  
 ‘પ્રેમ’ એ ભાવના સૂક્ષ્મ ભલેને વ્યક્તિમાં જ હો.  
 વિલીન થૈ જવા કેરી જેનામાં ઝંખના ઊંડી,  
 થવું વિલીન જેમાં છે એને તો રાખવું જડી.  
 સાધનામાં ખપે ના સૌ પરંપરાગતે કશું,  
 માર્ગી મૌલિકતા તે લે પ્રાણચેતનાભરી.  
 પ્રેમને જાણવા કાજે પોતે પ્રેમ થવું પડે,  
 થઈ પ્રેમ જતાં પોતે કામ કેવાં બધાં સરે !  
 પ્રેમ ઉદ્ભાવશે શક્તિ હૈયે હૈયાં નિભાવશે,  
 માધુર્યભાવ જન્માવી આત્માને ઓળખાવશે.

પ્રેમમાં કોઈ વૃત્તિની છાયા ના આવવી ઘટે,  
પ્રેમ તે પ્રેમને કાજે હજો ત્યાં શુદ્ધ ભાવથી.

(‘પુનિત પ્રેમગાથા’, આ.૨, પૃ. ૭૭, ૮૭, ૧૦૪, ૧૭૮)  
(શાર્દૂલવિકીડિત)

જે પ્રેમે ભરી સ્નિગ્ધતા હૃદયની ને આર્ડતા, આર્તતા,  
તે પ્રેમે ભળી એકતાર બનતાં જન્મે શું માધુર્ય ત્યાં !  
સૌ રાગાત્મક વૃત્તિઓ સરકતાં તે પ્રેમ જન્મ્યાં કરે,  
તેવાં જીવન, દણ્ણિ, વૃત્તિ—વલણે એવું થવા હો હુદે.

### ચમત્કાર

ચમત્કાર તો, જોવા જઈએ તો પળેપળ જે તેવાછે. ચમત્કાર  
અંગેની સમજણ સમાજમાં જે પ્રવર્તે છે, તે જ્ઞાનને ઘોતક નથી.  
આપણા પોતાના જ જીવનમાં જીવદશાની કક્ષામાં પણ કેટકેટલા  
ફેરફાર થતા હોય છે; તે શું ચમત્કાર નથી ? જીવનની વૃત્તિમાં  
કેટલીક વાર એકદમ પલટો પ્રગટે છે; શું એ ચમત્કાર નથી ? જરૂર  
પ્રકારના માનવીમાં ચેતના પ્રગટે છે અને તે નવો અવતાર ધારણ  
કરેછે; આવા અનેક પ્રકારના વિધવિધ ચમત્કારો જીવનમાં જોઈએ  
તેટલા જે તેમ છે. સાચી રીતે તો આપણાં કરણોની પૂર્ણ શુદ્ધિ  
થઈને આપણે પૂર્ણ નિરહંકારી, કામનારાહિત, દ્રંદ્ધાતીત, ગુણાતીત  
આદિ બધું પ્રભુકૃપાથી થઈ શકીશું એ જ આપણા માટે ખરો  
ચમત્કાર છે. આપણે તો આ ચમત્કારની વાંદ્ધના રાખવી.

(‘જીવનસંશોધન’, આ.૧, પૃ. ૨૬૮-૬૯)

\* \* \*

સાધકના દિલને અથવા તેના હૃદયને એકદમ આધાત  
આપવા માટે, એટલે કે એના જીવનવલણને પલટાવવા માટે,  
પ્રેરણાત્મક ભાવનાયુક્ત યોગ્ય ચમત્કારનું સ્થાન રહે છે ખરું.  
સાધનામાર્ગમાં યોગ્ય ચમત્કારને સ્થાન છે; પરંતુ એવા ચમત્કાર

ઉપર જો આપણી શ્રદ્ધા અને વિશ્વાસ ઠરેલાં ન હોય અને શંકા-  
કુશંકા તેના પર થયાં કરી તો તે પોતાનો ભાવ યોગ્ય રીતે ભજવી  
શકશે નહિ, ને જોઈતું પરિણામ નિપણવવામાં નિષ્ફળ જશે.  
ચમત્કાર એ કંઈ જાણુના બેલ નથી. હાડકું ઉતરી ગઅલું હોય,  
ત્યારે તેને એક સખત આંચકો મારીને બેસાડવવામાં આવે છે, તેવી  
રીતે સાધકને તેવો અનુભવ શ્રીભગવાન કોક વાર કરાવે છે ખરો.

(‘જીવનપગથી’, આ.૩, પૃ. ૧૫૮)

### ચમત્કાર

(અનુષ્ટુપ)

ચમત્કાર નથી એ તો વ્યક્તત્વ શક્તિ કેરું ત્યાં,  
થયાં કરેલું પોતાનું નિમિત્તરૂપ વ્યક્તિમાં.

આત્મની શક્તિનો ભાવ ઉદ્ભવ એ રીતે થતાં,  
વ્યક્ત એમ થતો રે'શે કોઈ ગૂઢ રીતે તહાં.

ભલે નિમિત્ત ત્યાં બીજું શક્તિનો પ્રાણ સ્પર્શવા,  
આત્મ-શક્તિ તાણું જ્ઞાન એ રીતે પ્રભુ દે તહાં.

વિસ્તાર જ્ઞાનનો થાવા નિમિત્ત ભૂમિકા હૃદે,  
જોઈતી, આપતો રે'છે કૃપાળુ પ્રભુ એહને.

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૧૨૨)

### ચૈતન્ય, કર્માના મૂળમાં

(અનુષ્ટુપ)

જે પ્રભુત્વ રહેલું છે ગૂઢમાં ગૂઢ જીવને,  
થવા પ્રાગાટ્ય તે માટે નિમિત્ત કર્મ-સાધન.

ચૈતના-શક્તિના ભાવે મૂલ્યાંકનો સનાતન,  
મૂલવવાં સદા સૌનાં, યોગ્ય તે માપ-નિયમ.  
ઘટે છે જાણવા

ચૈતન્યે જે અવસ્થા રે' મથે પ્રાગટ્ય તે થવા,  
સૌ

તે પરે સર્વ આધાર રહેલો કર્મમાં સદા.

સ્વરૂપ મૂર્ત ચૈતન્ય આપવા કર્મ સૌ મળે,  
કર્મમાં હેતુ ને જ્ઞાન રાખવાં તેથી જીવને.

આબેદૂબ પ્રતિકૃતિ ચેતના તાણી જે નથી,  
એવાં કર્મ તણું મૂલ્ય લગારે જીવને નથી.

ચૈતન્ય-અંતરેથી સૌ કર્મ તે જન્મવાં ઘટે,  
કર્મનું મૂળ ચૈતન્યે રે'વું તે આપણું ઘટે.

દુંદ્રાદિ અસરોથી કેં જે જે કર્મ થયાં કરે,  
ચેતના-શક્તિ પ્રાબલ્ય ઓછું ઓછું કર્યા કરે.

રાગમોહાદિથી મુક્ત ભાવને અર્થ કામ સૌ—  
જેમ જેમ થતાં રૂહેશે ચૈતન્ય તેમ જાગશે.

આલંબન લીધેલું છે જેનું ભાવ જગાડવા,  
હૈયામાં શાસ તે એનો કરો રાખ્યાં કૃપાથી ત્યાં.

પ્રાણવાળી સ્મૃતિ એની હૈયે જો ચેતતી રહે,  
ઉપજાવ્યા વિના ભાવ તેવી સ્મૃતિ ન તે રહે.

માનવીનાં બધાં કર્મ તે ચૈતન્ય દબાવી હે,  
કેટલી વાર શો ભાવ મારી નાખે બધોય તે.

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૮૭-૮૮)

જ્યે, નામસ્મરણ ઘરેડરપે લેવાતાં પણ, કેંક તો ફળે ખરું

નામનું સતત સ્મરણ થવું તે કંઈ સહેલી વાત નથી. તમે આટલા બધા વખતથી મનને ટકોરીને સ્મરણ કરવાનું રાખો છો તોપણ તે ભૂલી જવાય છે. કોઈ જીવ ભગવાનનું નામ એમ ને એમ લઈ શકતો નથી. સતત ભગવાનનું નામ લેવું એ હાંસી-ખેલ નથી. આટલી બધી કાળજી, જગૃતિ રાખ્યા છતાં નામસ્મરણ સતત રહેતું નથી તો ઘરેડ પ્રમાણે કેમ રહી શકે? અને ધારો કે ઘરેડ પ્રમાણે રહે તોપણ તેનું પરિણામ નકામું જતું નથી. જેમ કોઈ ખેડૂત બી વાવતાં પહેલાં ખેતરમાં ખાતર નાંખીને તેને ખેડીને પોચું બનાવે છે અને પછી બી નાંખે તો, અને ભગવત્ કૂપારૂપી વરસાદ વરસે તો તેમાંથી મબલક શુભ પરિણામ નીપજ્યા વગર રહેતું નથી. પરંતુ કોઈ આપસુ ખેડૂત બરાબર ખેડખાતર ન કરે અને બી વાવી દે તોયે થોડું ધાણું ઊગ્યા વિના રહેતું નથી. કંઈ નહિ તો ઢોરને ખાવાને રાડાં પણ પાકે; એમ ભગવાનનું નામસ્મરણ જો ખાતરખેડ કર્યાની માફક, એટલે કે આપણાં મન, બુદ્ધિ, ચિત્ત, ગ્રાણ ને અહંકાર એ બધાંને નામસ્મરણ ઊગી નીકળવાની ભૂમિકાને યોગ્ય કેળવ્યાં કરવાનું રાખીને નામ લીધાં કરીએ તો તેવો માનવી પ્રત્યક્ષ પરિણામ પોતાના જીવનમાં અનુભવ્યા વિના રહેતો નથી. આને માટે અત્યંત, અપાર ધીરજ ને ભારે પુરુષાર્થની જરૂર હોય છે.

(‘જીવનપાથેય’, આ.ડ, પૃ. ૧૮૧-૮૨)

\*

\*

જાપનું ઉદ્ભવસ્થાન હદ્ય છે. જાપ આખરે તો એક ભાવ જ છે. જો જાપ હદ્યના ધબકારા સાથે આપણે બરાબર કર્યા કરીએ તો ધ્યાન પણ આપોઆપ ત્યાં રહેશે. એ અભ્યાસ સ્થિર થતાં જાપ હદ્યમાંથી સ્વતઃપણે થયાં જશે ને જો તેમાં ભાવ

ઉમેરી શકાયો તો ધારણા પણ રહ્યાં કરશે. એમ ત્રણે જાપ, ધ્યાન ને ધારણા બરાબર થશે.

કોઈનાય સ્મરણે ઊર્ભિ જાગતાં કે કોઈ પણ લાગણીનો ઉદ્રેક થતાં તેનો સદ્ગુપ્તયોગ જાપ-ભાવથી કરી લેવામાં થઈ શકે છે.

જાપ ભાવુક અને સાત્ત્વિક તો અંદરથી ચાલ્યાં કરતો હોય તે જ સારો. પણ જેમ આદર્શને એકદમ પહોંચી શકતું નથી તેમ જે રસ્તે તેને પહોંચવાની શક્યતા જણાતી હોય તે માર્ગ હાલ લેવો સારો, એટલે મોટેથી જાપ કરશો તો વાંધો નથી; પછી કમશઃ જીબ માત્ર હલાવીને મનમાં જાપ થઈ શકે અને અંતે તો અંદરથી હૃદયમાંથી આપોઆપ તે થયે જાય. જાપના ધ્યેયને જો ભૂલીશું નહિ તો યાંત્રિક, જડટેવ પડવાની નથી. આપણા અર્થમાં ‘ધારણા’ એ તો કમમાંથી પરિણામ પામનારી અસર છે. મુખ્ય તો હૃદયના ધબકારા સાથે ખૂબ ભાવાવેશ સાથે જાપ થાય એ જરૂરી છે.

(‘જીવનપરાગ’, આ.ર, પૃ. ૩૮, ૪૦, ૪૧, ૧૨૯-૩૦)

\* \* \*

પ્રતિદિન જાપ બોલવામાં આપણને ઉમળકો વધ્યે જવો ઘટે. જાપનો હેતુ શ્રીભગવાનની ભાવનાનું સાત્ત્વ જીવતું એકધારું રહ્યાં કરે તે કાજેનો છે. જાપ એ માત્ર સાધન છે. સાધન એ તો સાધ્યનો, ધ્યેયનો મેળાપ કરાવનાર હોવાથી તે દણ્ણિએ સાધનની તેટલી મહત્ત્વાંથી છે. માત્ર સાધનને જડપણે ખાલી ખાલી પકડી રાખનાર કદ્દી ધ્યેયને હાંસલ કરી શકતો નથી. તેથી આપણે ધ્યેયને ભૂલવાનું નથી. પણ જે જીવ કોઈ પણ પ્રકારનું સાધન જ લેવાનું કરતો નથી અથવા જે જીવને સાધનાની ભાવનાની ધારણા કોઈ ને કોઈ પ્રકારે જીવતી રહી શકતી નથી, એ જીવને ધ્યેયને પામવાની અવધિ લાગશે નહિ. એકધારી રીતે જાપ ભલે ન થઈ શકે, પણ જે હેતુથી તે લેવાનો હોય તેને દિવસના સળંગ વહેવારમાં અંતર્ગતપણે

જાળવી શકાય તો એનું નામ પણ જપ છે. જપ તો સ્થૂળ છે; પરંતુ એનાથી ઉત્પન્ન થતી ભાવના જ મહત્વની છે.

(‘જીવનપ્રવેશ’, આ.૨, પૃ. ૧૬૦-૬૧)

\* \* \*

બીજાં કાર્યોમાં આપણે પરોવાયેલાં હોઈએ, ત્યારે શરીરનો કોઈ પણ સહેજ ધૂટો પડેલો ભાગ, જેમ કે પગનો અંગૂઠો, હાથનો અંગૂઠો કે આંગળી, હલાબ્યા કરવાનો, ને તેની સાથે સાથે જપયજ્ઞ ચાલુ રાખવાનો અભ્યાસ તેની તેવી સજ્જવ જાગૃતિ સાથે પાડ્યા કરશો તો બીજું કામ કરતાં કરતાં પણ અંતરમાં સ્મરણભાવની ધારણા જરૂર ચાલુ રહેશે. આવો ભાવનાથી જ્ઞાનપૂર્વક થતો રહેતો પ્રયોગ—ચાલતાં, ઊઠતાં ફરતાં, બેસતાં, રોજની હરેક ક્રિયાઓ કરતાં કરતાં—સ્મરણભાવની ધારણા જીવંત રાખવામાં સરળતા પ્રગટાવે છે. જો કે આવું પણ એકદમ કંઈ નહિ થઈ જાય.

(‘જીવનસંશોધન’, આ.૧, પૃ. ૩૦-૩૧)

શરૂશરુમાં માનસિક જપ થવો શક્ય નથી. મન તો સંકલ્પવિકલ્પ કરી શકે; તે વિના બીજી શક્યતા નથી. જપની સ્મરણભાવની ધારણાનો એકધારો અભ્યાસ બોલીબોલીને પાડવાનો રહે છે. જ્યારે અજપાજપ પ્રગટે છે, ત્યારે જ માનસિક જપની ધારણા રહી શકે છે. બાકી તો આપણે માનીશું કે મનમાં જપ થઈ રહેલા છે અને જાપનું થવું તો ક્યાંયે ગેબ થઈ ગયું હશે તેની ખબર પણ નહિ પડે !

(‘જીવનસંશોધન’, આ.૨, પૃ. ૨૮૮)

\* \* \*

જપને યજ્ઞમાં ગણેલો છે. એ એક મોટું, સહજ ને સરળ સાધન છે. સામાન્યપણે જપ ટૂંકામાં ટૂંકો હોય તો ઉત્તમ. એ જપવામાં ક્રિલાષ ન હોવો જોઈએ, સરળ હોવો જોઈએ. છુસ્વ ને

મૂછ તથા કઠળ નહિ એવો (ધોષ વ્યંજન) હોય તો વધુ સારું. શબ્દનાં ત્રણ સ્થળ છે; નાભિ, કંઠ ને બ્રહ્માંદ્ર. જપ એવો હોવો ઘટે કે ત્રણોયને સ્પર્શી શકે. એકેએક સ્થળ ઉપરથી જપના પ્રત્યેક અક્ષરનું ભાવપૂર્વકનું હેતુની સંખ્યા ધારણા સાથે ઉચ્ચારણ થાય, તો તે સાધના અતિ ઉત્તમ છે. જપમંત્ર શાસોચ્છ્વાસ સાથે અથવા નાડીના ધબકારા સાથે લેવાય તો ઉત્તમ. જપને યજ્ઞ કહેવાનું કારણ એ છે કે યજ્ઞમાં જે તે બધું હોમવાનું હોય છે; એટલે આપણે પણ મનાદિ કરણનું જે જે બધું ઉભાળે તે બધું તેમાં પ્રાર્થના સાથે જ્ઞાનભક્તિપૂર્વક હોમ્યાં કરવાનું છે.

(‘જીવનસંશોધન’, આ.૧, પૃ. ૩૨૦-૩૧)

\* \* \*

મંત્ર એકધારો, નિરંતર હૃદયથી જો લેવાયા કરાતો હોય તો તેવા મંત્રના ઉચ્ચારણમાંથી પ્રગટતી ધારણાથી જ્ઞાનતંત્રાઓ Tone up-પ્રાણવાન થાય છે. એથી સમતા અને શાંતિ પ્રગટે છે. એવી સમતા અને શાંતિ જ્યારે જ્ઞાનતંત્રાઓમાં પ્રગટીને તેની ટોચ પર પહોંચે છે, ત્યારે શરીરના રોગને પણ તે નિવારવા શક્તિમાન બને છે. જપમાં આ કારણે ગંગાના પ્રવાહના જેવી સતત, એકધારી, સંખ્યા નિરંતરતા પ્રગટવી એ ધણી જરૂરની છે. તે વિના જપ પૂરા અસરકારક નીવડી શકતા નથી. જ્યારે જપમાં એવી ભાવાત્મક નિરંતરતા પ્રગટે છે, ત્યારે કરણોનાં પ્રાકૃતિક વલણોને યોગ્યપણે પ્રગટવામાં તે પ્રેરણાત્મક બને છે.

(‘જીવનસંશોધન’, આ.૨, પૃ. ૩૮૪)

\* \* \*

જપ એટલે ચેતનભાવનું સાતત્ય અખંડ રહેવું તે. મનને ચેતન પરતેના સદ્ગ્ભાવથી જે રીતે પ્રેરાયેલું રાખી શકાય તે જપયજ્ઞ. મનનો સ્વભાવ જ્યાં લગી ચેતન પરતેનાં રસાર્દતા ને

આર્તિતાવાળી ભૂમિકાયુક્ત ન બની જાય, ત્યાં લગી તે યદ્વાતદ્વા જ રહ્યાં કરવાનું. એટલે હદ્યથી એવા સદ્ધભાવમાં રહેવાનો જેટલો જ્ઞાનયુક્ત અભ્યાસ વધે તેટલું ઉત્તમ.

(‘જીવનપ્રવેશ’, આ.૨, પૃ. ૧૮૭)

\*

\*

નામસ્મરણનો પ્રભાવ અપરંપાર છે. દિવસના સમયનો વધુમાં વધુ સમય જો એમાં આપી શકીએ, આપણી બધી શક્તિના સરવાળાનો મોટો ભાગ એમાં ખર્ચીએ, તો ભાવનાની સંબંધતા પણ પ્રગટી શકે. નામસ્મરણની ભાવના જેને દિલમાં ઊળીને, તે પ્રમાણે જગ્રત બનીને, ઊર્મિ સહ તેમાં પરોવાઈને જો તે તરફ વળવાનું દિલથી બને તો તેને તે માર્ગ પરત્વે વળી શકવાની પૂરી શક્યતા છે.

\*

\*

સ્થૂળ રીતે, દેખીતી રીતે નામસ્મરણ વિના સ્થૂળ જીવન નભી શકે છે; પણ પ્રભુમય જીવન માટે નામસ્મરણ પ્રાણસમાન છે. એ ન હોય તો કશું નથી. એટલે ધ્યાન આદિ બીજાં સાધનો કરતાં પણ એનું સવિશેષ ધ્યાન રાખવાનું છે. નામી કરતાંથે નામ ચઢી જાય છે. દિવસોભર જમ્યા વિના જીવી શકાય, પણ જેને ભગવાનને શરણે જવું છે તેવાને નામસ્મરણ વિના એક ક્ષણ પણ ન ચાલવું જોઈએ. નામસ્મરણ એ આપણું એક રીતનું જીવન છે.

(‘જીવનસંદેશ’, આ.૪, પૃ. ૨૩૮-૪૦)

\*

\*

કંઈ પણ કામ કરતાં કરતાં પણ જો આપણું ભાવપૂર્વક નામસ્મરણ રહ્યાં કરતું હોય તો એ કામ આપણે સાધનાના એક સાધન તરીકે જ કરીએ છીએ, એવી ભાવના આપણામાં ઊંડી ઊતરતી જ જાય; કેમ કે આપણને ઊંદું ભાન તો એ સ્મરણને

લીધે રહે કે આપણો એ કામ કરતાં કરતાં ભગવાનની શક્તિનું  
આવાહન જાણ્યેઅજાણ્યે કરીએ છીએ, એટલે એ શક્તિ થોડીવત્તી  
પણ આપણામાં ઉત્તરે ૪.      ('જીવનસંદેશ', આ.૪, પૃ. ૨૪૦)

\*

\*

### જન્મ-મૃત્યુના રાસ (શાર્દૂલવિકીર્ણિત)

કેવો રાસ રચાય છે પળપળે મૃત્યુ અને જન્મનો !  
એની એ ઘટમાળામાં સરકતું તે વિશ્વનો ખેલ શો !  
તેમાં જીવ રખ્યાં કરે પણ ખરું ના ભાન એને થતું,  
કેવો આપ વખ્યાં કરે પ્રકૃતિથી કોઈ ન ત્યાં જાગતું.

જેનામાં પ્રભુ-ભાવના તરવરે, ઉન્મુખતા અંતરે,  
જેનામાં નિજ કર્મમાં નીતરતો રે' ભાવ તેવો ખરે,  
જેને છૂટી જતા દીસે મન તણા સંકલ્પ વિકલ્પ સૌ,  
એવા જીવ રહી શકે પળપળે ત્યાં જાગતા આપ તો.

('પુનિત પ્રેમગાથા', આ.૨, પૃ. ૨૨૩-૨૨૪)

\*

\*

શા શા રાસ રચાય છે નવનવા વૃત્તિ-કુંડાળાં રચી !  
ને શા છાસ થઈ જતા અવનવા સહેજે ઘડી વારમાં !  
જન્માવે પલકારમાંછી, પલકે શું મૃત્યુ ઉદ્ભાવતો !  
એ તારી ઘટમાળમાં અમર થૈ રે'વા કૃપા દે પ્રભો !

કેવું પ્રેમ-સ્વરૂપ દિવ્ય રસીલું શું મુગધ રૂપે રસ્યું !  
તે આકર્ષણ જાદુ કે અવનવું દુર્ગાં અને કાલીશું !  
લીલા પ્રેમ-કળા ખરી જીવનમાં સજ્યાં કરે સૃષ્ટિ શી !  
મૃત્યુ જન્મ થયાં કરે પળપળે તોયે રહી એક શી !

('પુનિત પ્રેમગાથા', આ.૨, પૃ. ૧૪-૧૫)

\*

\*

## પ્રકૃતિમાં પ્રથન પ્રભુ

(અનુષ્ટુપ)

પ્રકૃતિમાં પ્રભુભાવ છૂપો સૌ કોઈમાં રહ્યો,  
પ્રકૃતિ છો જુદી લાગે છતાંથે એક ત્યાં રહ્યો.

માનવીચિતને જુદી લાગતી પ્રકૃતિ ભલે,  
જામતાં શૂન્યતા ચિતે સત્ત્વ પ્રકૃતિનું મળે.

પ્રકૃતિ પ્રકૃતિ પોતે એકલી તે કદી નથી,  
પ્રકૃતિમાં રહી કોઈ એને ચલાવતું નકી.

(‘જીવનપાથેય’, આ.ડ, પૃ. ૧૪૪)

\* \* \*

## જીવનના એ ફિરસ્તા છે.

(ગુજરાતી)

વરદ પદ એ ચરણરજમાં જીવનસાફલ્ય પામીને,  
લગન લાગી ગઈ જેને સદા મસ્તાન એવા છે.

ચળાવી ના શકે કોઈ ભમાવી ના શકે કોઈ,  
ફગાવી ના શકે એને જગતની શક્તિ જે કોઈ.

જગત-જીવન તણી રક્ષા જગત-જીવન તણું સિંચન,  
જગત-જીવન તણું પોષણ મળ્યાં એથી જતું નિશાદિન.

જીવનના તે સિતારા છે, જીવનના તે મિનારા છે,  
જીવનના શા પીનારા તે ! જીવન પાનાર પણ તે છે.

અનાદિ આદિથી એવાં હરિનાં જન થયેલાં જે,  
જગત-ચરણે જ ચગદાયાં જગત-ઈતિહાસ એવો છે.

થયાં એવું પહેલાંયે પડે ચગદાવું એવાને,  
ખરે ! ચગદાઈ જીવવાનું થયાં કેદેય પદ એને.

હદ્દય બન્નેયની રીતમાં જુદો જુદો જીવન-ફેર,  
જીવન જે એકથી પ્રગટે બીજું નિપણવતું જીવન.

(‘પ્રણામ-પ્રલાપ’, આ.૨, પૃ. ૧૦૫)

પ્રભુનો પાડ માનો કે પ્રભુએ મોકલેલા છે,  
જીવનનાં પ્રેરણા-બળ છે, જીવનના એ ફિરસ્તા છે.

(‘પ્રણામ-પ્રલાપ’, આ.૨, પૃ. ૪૮)

(અનુષ્ઠાપ)

ચઢાવી જે શકે ઉંચા કોઈનેય જરા કશું,  
ચહેલું જાણવું એને પ્રાણ ચૈતન્યથી ભર્યું.

(‘જીવનપગલે’, આ.૧, પૃ. ૨૬)

\*

ઇતાં જીવન નથી ત્યાંયે

(ગઝલ)

જીવન શું છે ? જીવન ક્યાં છે ? જીવન શેમાં ? જણાવો કો ;  
જીવનને ક્યાં જઈ શોધું ? જીવન-પથને બતાવો કો.

રહેવા રાજમંદિર ને હવા ખાવા બગીચા હો,  
વિમાને વ્યોમમાં વિહરો ઇતાં જીવન નથી ત્યાંયે.

મળે સુખ સ્વર્ગનાં છોને અને દેવો પવન નાંખે,  
મળે સાખ્રાજ્ય છો જગનું ઇતાં જીવન નથી ત્યાંયે.

ભલેને પુત્ર-પરિવારે ભરેલા હો સ્વજનથી ને,  
ઉપાડે બોલ તમ સહુ કો ઇતાં જીવન નથી ત્યાંયે.

તમારી ક્રીતિની ગાથા ગવાયે વિશ્વ સારામાં,  
બધે તમ હાક છો વાગે છતાં જીવન નથી ત્યાંયે.

સકળ શાસ્ત્રો તણાં પોથાં અને વેદો પુરાણોને  
અહંભાવે કર્યા કંઠે, છતાં જીવન નથી ત્યાંયે.

જીવનના તત્ત્વજ્ઞાનીઓ ! જીવનને માણનારાઓ !  
જીવનને જીણવા કેરી ભલા ચાવી બતાવો કો ?

મળેલા કર્મ-સંજોગે બધા સંબંધથી રહીને,  
હંદ્યથી જે જીવે ભાવે, જીવનમાં તે પ્રવેશે છે.

બીજા જીવના જીવનરૂપે ખપાવે જીવ પોતાનો,  
મહા કો ઉચ્ચ આદર્શે જીવનને તે અનુભવશે.

હંદ્યની ભાવનાઓને કરી પ્રત્યક્ષ કર્મ જે,  
રહે નિર્લિપ્ત જે ત્યાંયે શકે તે પામી જીવનને.

મળેલાં સાધનો, શક્તિ પ્રભુને કાજ જે ખર્યે,  
પ્રભુ કાજે મરે જીવે જીવન તે એકલાં પામે.

(‘જીવનપગલે’, આ.ડ, પૃ. ૫૫-૫૬)

### જીવન-સોદો

(ગઝલ)

જીવનની પ્રાપ્તિ કરવાને જીવનને આપવું પડશે,  
જીવનને આપશો જેવું વધુ તેનાથીયે મળશે;

જીવન-વેપાર કરવાની પ્રભુએ પેઢી ખોલી છે,  
કશું આચ્ચા વિના સોદો કશોયે ના થવાનો છે.

જીવનને જે ફના કરશે જીવનનો ઘ્યાલ રાખીને,  
જીવન એને જરૂર મળશે જીવનથી તે જીવન રળશે.

‘થતું રૂહે જે રીતે ઘડતર’ બધાં સાધન પ્રભુ લેશે,  
બધી સામગ્રી તે તે સૌ ઉમળકે આપવી પડશે.

તુલાના એક પલ્લામાં પ્રભુએ તો જીવન-તોલ  
—મૂક્યું છે નિજનું પોતે, તમે આપો જીવન-મૂલ્ય.

જીવનને તો ખરીદાશે જીવનના માપથી નિત્યે,  
જીવનથી તો જીવન મળશે જીવનની એ ખૂબી નિશ્ચે.

જીવનને સાચવી રાખે સદા નિજ સ્વાર્થ કાજે જે,  
જીવન તે મેળવી શકશે નહીં ઉપાય કોટિએ.

જીવન વાતોથી ના મળશે, જીવન ના લક્ષ્મીથી મળશે,  
જીવન ના બુદ્ધિથી મળશે; જીવન તો ભાવથી મળશે.

જીવનની સર્વ ઘટનામાં હદ્દયનો ભાવ કેવો રૂહે,  
મહત્ત્વ ભાવનું જેવું જીવન ત્યાં તેમ સમજાશે.

જીવન બલિદાન કરવામાં હદ્દય જેને સ્ફુરે ઊર્મિ,  
બલિ દે જ્ઞાનભાવે તે મુદ્રા માણે જ જીવનની.

(‘જીવનપગલે’, આ.ઃ, પૃ. ૪૩, ૫૭)

### જીવન-વ્યાપ્તિ પ્રભુમાં છે.

(ગજલ)

હદ્દય સંભારશે પ્રભુ જે પ્રભુ સંભારશે એને,  
હદ્દય સંભાળશે પ્રભુ જે પ્રભુ સંભાળશે એને.

પ્રભુનો પાળશે હુકમ હુકમ એનો પ્રભુ પાળે,  
બને તેનો પ્રભુ દાસ પ્રભુનો દાસ જે રૈ’ છે.

પૂજારી પ્રેમનો પ્રભુ છે પ્રભુ તો પ્રેમ માંગે છે,  
દઈ દેતાં બધો પ્રેમ ન એથી તે ધરાયે છે.

અજીઠો પ્રેમ એને તો કશો ખપમાં ન આવે છે,  
ગ્રહો તેથી તમે જે જે ગ્રહો પ્રભુને ધરાવી તે.

પ્રભુના યક્ષમાં જેઓ સમર્પણ આહુતિ દે છે,  
ચઢે છે નૂર તે દેતાં પ્રભુને તે જ પામે છે.

પ્રભુ વ્હાલો હૃદય જેને સહુથી શ્રેષ્ઠ લાગે છે,  
મહત્ત્વ સર્વમાં એને પ્રથમ પંક્તિનું તે દે છે.

પ્રભુ વિના બીજું કાંઈ ન એને ક્યાંય સૂજે છે,  
જીવન-સૂષ્ટિ પ્રભુ કેરી રચાવી બસ રમે છે તે.

‘બધી કિયા જીવનમાંની હૃદય એકાત્મભાવેથી,  
પ્રભુ-હેતુ ફલિતાર્થ થતી રે વ્યક્ત,’ તે ભક્તિ.

પ્રભુનો ભક્ત એવો તે હૃદય પ્રભુને બિરાજે છે,  
જીવન-માધુર્ય રસથી શો ભરેલો નિત્ય જીવે તે !

જીવનનું મધ્યબિંદુ ને જીવન-ત્રિજ્યા પ્રભુમાં છે,  
જીવનનો વ્યાસ પણ તેછે જીવનવ્યાપ્તિ પ્રભુમાં છે.

(‘પ્રણામ-પ્રલાપ’, આ.૨, પૃ. ૧૦-૧૧)

\*

\*

પ્રકાશેથી જીવે એને ન અંધારા તણો ભય રહે,  
જગતનાં માનવીને શો અહા ! તે બોધ દે બન્ને.

(‘પ્રણામ-પ્રલાપ’, આ.૨, પૃ. ૫૦)

\*

\*

જોબનિયે જીવન-સિદ્ધિ  
 જોબનિયું ખાંડાની ધારે ખેલો,  
 જોબનિયું આજ આવ્યું ને કાલ જાશે;  
 જોબનિયું પ્રેમ-મહ્સ્તીમાં મૃહાલો,  
 જોબનિયું આજ આવ્યું ને કાલ જાશે;  
 જોબનિયું આત્માની અંધાણે પેખો,  
 જોબનિયું આજ આવ્યું ને કાલ જાશે;  
 જોબનિયું રસ-રંગ હીચે હિલોળો,  
 જોબનિયું આજ આવ્યું ને કાલ જાશે;  
 જોબનિયું ફાટુંફાટું ઉર રાખો,  
 જોબનિયું આજ આવ્યું ને કાલ જાશે;  
 જોબનિયે કરવાનું સૌ કરી નાંખો,  
 જોબનિયું આજ આવ્યું ને કાલ જાશે;  
 જોબનિયે જીવન-સિદ્ધિ પામો,  
 જોબનિયું આજ આવ્યું ને કાલ જાશે;

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૨૮)

\*

\*

(અનુષ્ઠાન)

ગુણ દોષ મળે બન્ને માનવી-જીવને સદા,  
થવા નિર્મળ, જુવાની ઋતુ તે માટ યોગ્ય ત્યાં.

અંતે જુવાનીની કાં તો મૂર્ખ કે સમજુ બને,  
માનવી જે જુવાનીમાં વળે, તે ગમ તે ઢળે.

જોશ યૌવન ઊભું છે, ત્યાં સુધી માત્ર જીવન,  
જિંદગીના વિકાસાર્થી યોગ્ય શો કાળ યૌવન !

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૬૨)

## જ્ઞાનેન્દ્રિયો અને આસક્તિ

આસક્તિ કોઈ ને કોઈ, સૂક્ષ્મ કે સૂક્ષ્મતર રીતે, રહ્યાં કરતી હોવાથી માનવીજીવ તો બધી ઈન્ડ્રિયભોગ્ય વસ્તુઓ વિષે તે વધારતો જવાનો ને પરિણામે દુઃખ પ્રાપ્ત કરવાનો. આસક્તિમાં સૂક્ષ્મ ઈચ્છાઓને પોષવાની વૃત્તિ હોય છે; આથી જીવ હંમેશાં એક યા બીજી ઈચ્છાને પોષવામાં જ જીવન ગાળતો હોય છે; પરંતુ તેને તેનું ભાન હોતું નથી. આપણી આંખ, જીબ, નાક, કાન, ત્વચા બધું જ, અરે, એટલું જ નહિ, સમગ્રપણે જેને આપણે ‘હું’ કહીએ છીએ તે પણ અકળ આસક્તિમાં ખૂબ મીઠાશ માણતાં હોય છે. આ મીઠાશ ઈન્દ્રિયજન્ય છે ને ઈન્દ્રિયોના સંતોષ અર્થે છે. જ્યાં સુધી જીવ તેને પ્રયત્નપૂર્વક પૂર્ણ અનાસક્ત ન બનાવી શકે, એની ટેવોના પ્રવાહને ન પલટાવી શકે, ત્યાં સુધી તે બધી વસ્તુઓના પોતપોતાના વિષયમાં સ્વચ્છંદ રાયવાની. અત્યાર સુધી નિર્દોષ માનેલી પ્રવૃત્તિનું મૂળ પણ કોઈ પ્રકારની સૂક્ષ્મ આસક્તિમાં, ઈન્દ્રિયની ઉપભોગની વૃત્તિમાં હતું એમ સાધકને લાગ્યા વિના રહી શકતું નથી; તેથી જ એણે યમુનાની ગતિ ઉલટાવવાની છે. ઈન્દ્રિયોનો સ્વચ્છંદ જીવનો વિનાશ નોતરે છે. ઈન્દ્રિયોના પ્રબળ રસના પરિણામે દુઃખ જ છે, એમ કદી કદી જીવને ભાન જાગતું હોય છે તોપણ જીવ તેમાં પરવશપણે ઘસડાયે જતો હોય છે. આ નિવારવા સંસ્કારશુદ્ધિના સમર્થ પ્રયાસની ખૂબ આવશ્યકતા રહે છે. તે જગ્રત ચેતનાની શક્તિ સિવાય આ બનવું અશક્ય છે, ને આ શક્તિને પ્રાપ્ત કરવા પ્રયંક, સમર્થ, જ્ઞાનપ્રેમભક્તિયુક્ત, જગ્રત ને એકધારી સાધના અનિવાર્ય છે.

(‘જીવનસંદેશ’, આ.ર, પૃ. ૨૩૭)

જ્ઞાની ને અજ્ઞાનીના જીવન-સ્વીકાર ને કર્મ વર્ણયેનો ફેર

સંસારવ્યવહારવર્તનમાં જેમ સામાન્ય જીવ જીવનને—  
સંસારને સ્વીકારીને વર્તે છે, તેવી રીતે જ્ઞાની પણ તેનાથી નોખો  
નથી હોતો; તેમાં પણ જીવનનો સ્વીકાર છે. અજ્ઞાનીના  
આધાર—કરણોમાં પ્રતિષ્ઠા જીવપણાના અહંપ્રધાન, પ્રાણપ્રધાન,  
મનપ્રધાન, બુદ્ધિપ્રધાન આદિ પ્રકૃતિપણાની છે; જ્યારે ચેતનના  
અનુભવીના આધારનાં કરણોમાં તેમ નથી હોતું, પરંતુ તે કરણોનું  
દિવ્ય રૂપાંતર થઈ ગયેલું હોય છે; તેટલો જ માત્ર ફરક હોય છે.  
બાકી કરણો તો એનાં એ જ બન્નેને હોય છે. બન્નેમાં પ્રકૃતિ પણ  
છે. અજ્ઞાની પ્રકૃતિનો દાસ છે, જ્ઞાની તેનો સ્વામી છે. કર્મ પણ  
એક જ પ્રકારનું બન્ને કરતા દેખાતા હોય છે પણ તેના પાછળના  
મૂળ અધિષ્ઠાનની ભૂમિકામાં પાયાનો ફેર હોય છે. એક કર્મ  
અજ્ઞાની સંસારીનું હોય ને તેવું જ કર્મ જ્ઞાનીનું હોય; તે બન્ને  
કર્માનો બાધ્ય આકાર ભલે એકસરખો હોય, તેમ છતાં બન્નેના  
મૂલ્યાંકનમાં, પરિણામમાં ને બન્નેની તેની પાછળ કાર્ય કરતી  
ચેતના ને તેના ભાવમાં ધરમૂળનો તફાવત રહેલો છે. અજ્ઞાનીની  
પ્રકૃતિનાં કર્મમાં પણ પસારો તો થયા કરતો હોય છે ને ચેતના-  
ધિષ્ઠાનભૂમિકાની પ્રકૃતિથી થતાં કર્મમાં પણ પસારો તો હોય છે;  
બન્નેનું કારણ તો પ્રકૃતિ હોય છે. પરંતુ અજ્ઞાનીમાં પ્રકૃતિ કર્તાહર્તા  
હોય છે, જ્યારે જ્ઞાનીમાં પ્રકૃતિ એકમાત્ર સ્વાધીન કરણરૂપે બની  
રહી હોય છે, ને જ્ઞાની પોતે જ પ્રકૃતિનો સાક્ષી, અનુમન્તા,  
ભર્તા, ભોક્તા ને ઈશ્વર પણ છે. આવાં જ્ઞાનીનાં કર્મમાં  
જીવપ્રકારની પ્રકૃતિનું જોશ નથી હોતું. પ્રકૃતિનું સ્વાધિષ્ઠાન  
ચેતનમાં પરિણમી જતાં પ્રકૃતિ પછી પોતાની રીતે વર્તી શકતી  
નથી. એ એની મેળે વધ્યાં કરે છે ખરી પરંતુ એના મૂળ  
અધિષ્ઠાનના —ચેતનના ગુણધર્મના ભાન સાથે.

\*

\*

## જ્ઞાની ને અજ્ઞાની વર્ચ્યેનો ફેર

(અનુષ્ટુપ)

કામ સૌ જ્ઞાની, અજ્ઞાની કર્યા ગુણાશ્રયે કરે,  
બન્નેના હેતુમાં જ્ઞાન જુદું જુદું રહ્યાં કરે.  
તિન્ન પરસ્પરે રહે.

નદીના પટની જેમ કર્મનો પટ તો ગુણો,  
ગુણોમાં જેવું હો જ્ઞાન તેવો રે' પટ કર્મનો.

સોનાની ભસ્મ તો થાતાં ગુણ એનો જુદો બને,  
તત્ત્વ તો એકનું એક છતાં ભેદ તહીં પડે.

યદ્વાતદ્વાપણો પેલો અજ્ઞાની વર્ત્યા જશે,  
જ્ઞાનીનાં કર્મની આગે ધારણા-પગથી હશે.

‘જ્ઞાની-અજ્ઞાનીમાં ફેર પાયાનો શો હશે ખરે !’  
અનાસકત હશે ઘેલો બીજો આસકત માનવો.

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૧૩૬, ૧૫, ૧૬)

\*

\*

## બેહદનો આનંદ

(ગઝલ)

અરે ! સંભાળતાં રો'છો તમે હદને બધી રીતે,  
રહો છો ત્યાં જ અટવાઈ રમતાં હદ વિષે જે તે.

મળે આનંદ બેહદનો કદીયે હદ વિષે ના તે,  
ન આવે કલ્યાણ-ખ્યાલે પૂરો આનંદ એવો જે.

છતાં હદમાં રહી, બેહદ તણા આનંદ-આદર્શો  
જુકાવ્યાં જે હદય રાખે, જશે તે કોક દી પાર.

હદ્ય હદ્ના રિવાજોને જવા બેહદ તણા ભાવે,  
વટાવે પ્રેમને જ્ઞાને પ્રવેશે બેહદે તે તે.

રહી હદ્માં હદ્ય બેહદ તણું જે ધ્યાન સેવે છે,  
ભળે હદ્ની અને બેહદ તણી સરહદ વિષે તે તે.

(‘જીવનસંદેશ’, આ.૪, પૃ. ૧૦૫-૦૬)

### જ્ઞાન, ભક્તિ ધ્યાનયોગનો સમન્વય

(અનુષ્ટુપ)

આડાંતેડાં મળે કર્મ તેમાં જોવું નહિ કશું,  
સ્વભાવ પલટાવા કર્મ સાધન પ્રીછવું;

તેથી ભલે ગમે તેવાં કર્મ હો, કિંતુ ધારણા-  
ઈષની ત્યાં હદે રહેતાં પામશો ફળ ઈષ ત્યાં.

કર્મની સાધના એવી હૈથે ધ્યાન ધરી કરે,  
કર્મને પ્રેરનારી તે ચેતના મેળવી શકે.

શ્રદ્ધા-વિશ્વાસ જીવંતાં કેળવાયાં જતાં હદે,  
કર્મનું બાધ્ય જે રૂપ મેળે ઉકેલ પામશો.

જ્ઞાન જન્માવવા કર્મ, કર્મ પ્રેરક ભાવ છે,  
રાખવા ત્રણમાં મેળ થવું કેંદ્રિત ત્યાં પડે.

ત્રણોમાં એકનું ઊંઠું જેને ધ્યાન રહે હદે,  
ગ્રંથિઓ તૂટશે મેળે એકતા પામતાં ત્રણો.

ત્રણોને એકભાવેથી જોડવાની કળા હદે,  
સાંપડી હોય તેવાને કોયડો ક્યાંય ના કશો.

અનાદિ આદિ કેરા જે ગુંચવાડા ભર્યા બધા,  
પ્રશ્નો સૌ વિશ્વજૂના તે ઉકેલાઈ જશે તદા.

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૧૫૦-૫૧)

ભક્તિ ને ધ્યાન ને યોગ, જ્ઞાન, સૌનો સમન્વય  
આપણામાં થશે ત્યારે સુમેળ જન્મશે ઉર.

એકલી ભક્તિનો ભાવ કરી દે મુખ શું બધું !  
જ્ઞાન તેથી જરૂરી છે સ્ફોટ રે'વા પૂરું ઉંઠું;  
ઉંઠું ત્યાં ખૂંપવા, યોગ અલિપત્તપણું ધ્યાન છે,  
માટે ચારે તણો હૈયે થવાવો મેળ જોઈશે.

(‘જીવનપગલે’, આ.ડ, પૃ. ૮૭-૮૮)

\* \* \*

### ઝંખના-અજિન

(અનુષ્ઠાપ)

‘થવું છે, થવું છે’ માત્ર પોકારો પાડવા થકી,  
થવાશે ના થવું જેવું, ઈચ્છા એવી ભલે રહી;  
ઝંખના તે થવા કેરી એકલી કામ શું કરે ?  
બિચારી વાંઝણી એ તો ઠેરની ઠેર ત્યાં રહે.

ઝંખના જો પુરુષાર્થે ધક્કેલા મારતી રહે,  
એકની એક જગ્યામાં બેસી રે'વા ન દે પળે;  
તોય કેડો ન મૂકી દે આપણો ફરી ને ફરી,  
ટકોર્યા તે કરે ઉંઠું ઘેય-પ્રાપ્તિ થવા મહીં,

જીવલંત ઝંખના એવી જેના હૈયે જલી રહી,  
કું ન હુર્લબ એવાને, એવો પ્રાપ્તિ કરે બધી.

મન, બુદ્ધિ અને ચિત્ત, પ્રાણ, વૃત્તિ, અહં બધાં,  
તેજસ્વી ઝંખના થાતાં ફેરવાયાં કરે સદા.

અજિનથી ભસ્મ સૌ થાયે કૂં સો ગણું હો ભલે,  
કૂડાનું ચાલશે ના ત્યાં ઝંખના-અજિન જો જલે.

કું સૌ જે, કૂડારૂપે પછી રે'શે ન તે કદી,  
દિવ્ય રૂપાંતરે એવું ફેરવાઈ જશે નકી.

ઝંખના એવી તે હૈયે ઉગ્રમાં ઉગ્ર ભાવથી -  
વર્ધતાં, યજ્ઞની જ્વાળા રીતે; અર્થ જતો સરી.

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૩૧)

\*

\*

(વસંતતિલકા)

જે ઝંખના હૃદય શક્તિ ન પ્રેરતી રે',  
જે ઝંખના હૃદય ચેતનતા ન પ્રેરે;  
જે ઝંખના સ્મરણભાવ ન દિવ્ય પ્રેરે,  
સાચી ન તે હૃદયની મૂળ ઝંખના છે.

(‘પુનિત પ્રેમગાથા’, આ.૨, પૃ. ૨૦૬)

\*

\*

તમના અને સંજોગશૃંખલા

(શિખરિણી-મંદાકાન્તા)

હૂબેલા હો છો ને કરદમ ભરી ભૂમિમાં પૂરી રીતે,  
તમના જાગેલી અફળ ન જશે કોઈ રીતે કદીયે;  
ભલેને સંસારે જગત પરના હો ફસાયેલ પૂરા,  
પ્રસંગો ત્યાં કિંતુ અનુકૂળ બધા સંપડાવે તમના.

મુકાયેલા જ્યાં હો તહીં પણ કંઈ ગૂઢ હેતુ રહેલો,  
બળાત્કારે કોઈ અફળ કરશો તે ન આવેશથી કો;  
તમના જાગેલી મન હૃદય જે સાચી પૂરી હશે તે,  
ગમે ત્યાં છોને હો તહીંથી તમને માર્ગ પ્રેર્યા જશે તે.

તમન્નાવાળો જે નિજ જીવનના કર્મ-પ્રારબ્ધ જોગે,  
મળેલા સંબંધો થકી પીઠ કરી ભાગશે તે ન ક્યાંયે;  
મળે છે દણાતો વિરલ વીરલા શૃંખલા તોડી ભાગ્યા,  
પરંતુ તેઓની મન, ઉર દશા શી હશે તેવી વેળા !

નહોતું તેઓને મન જગતનું ભાન જાગું કશુંયે,  
વિકારી વૃત્તિનું પણ નવ હતું નામ નિશાન ક્યાંયે,  
સદા તે વેળાએ દિલ મહીં હશે એમનો ભાવ કેવો !  
તમોને જો લાગે દિલ ત્યમ થયું, મોકષા તો તમે છો.

પરંતુ ઊઠેલો નિજ જીવનનો ઘ્યાલ જે ઊર્ધ્વગામી,  
ફૂલેફાલે એવું જીવન જીવવા હામ રાખો ઊંઠેથી;  
કરી દેશે વ્હાલો સહુ સરળતા જ્યાં સમો યોગ્ય આવે,  
ત્યહીં સુધી રાખી ધીરજ પૂરતી ભાવ એનો વધારો.

(‘જીવનપગલે’, આ.૧, પૃ. ૭૨ થી ૭૪)

\*

\*

### તાટસ્થય

(અનુષ્ટુપ)

કામનાઓ બધી જે તે તેમાં સાક્ષી રહ્યાં કરી,  
અનુમતિ ન ધો એને જવા ધો વહી આપથી.

કામનાઓ ઊઠે ત્યારે તેમાં ભેળાઈ ના જવું,  
આપણું રૂપ ના તે છે એમ માની છૂટા થવું.

તાટસ્થય રાખતાં રે'વું પ્રત્યક્ષ કામના થતાં,  
જાગૃતિ ચેતના એવી રે' તો કામ સધાય ત્યાં.

સાક્ષીભાવ અને પૂરું અલિપ્તત્વ બધાં થકી,  
જળવવાં ઘટે; છોને ભળેલા હો અનેકથી.

વાણી, વર્તન ને કર્મ થયાં નિરાગ્રહી જવું,  
સ્વભાવ તે વિના એ તો ઘસેડાવ્યાં કરે પૂરું.

વિચારો ઉઠતા હોય કિંતુ તે સાથ સાંકળ  
—જોડવી આપણે ત્યાં ના જીવી ચેતન—જીવન.

કોઈ પ્રકારથી ચિત્ત વિક્ષિપ્ત ના થવું ઘટે,  
ભૂમિકા એવી જ્યારે તે થતાં, પ્રત્યક્ષ સૌથશે.

યોગ્ય કર્તવ્ય ને ધર્મ, અહંતા નીકળી જતાં,  
તાટસ્થ્ય જળવાતાં ત્યાં, સમજાઈ જશે પૂરાં.

જાગ્રા વિચાર તે વેળા ધર્મ-કર્તવ્યના ઊંડા,  
કરવાના રહેશે ના, આપમણે જશે સુર્યા.

(‘જીવનપગલે’, આ.૧, પૃ. ૧૭-૧૮)

સર્વ કર્મ વિષે હેતુ ભાવની વૃદ્ધિ કાજ છે,  
ભલે તાદાત્મ્ય રે’ તોયે હજો તાટસ્થ્ય વર્તને.

વિના તે એવું વર્તાયાં સર્વ કેંમાં અલિપ્તતા,  
આવવાની ન કો રીતે આપણામાં કદીય ત્યાં.

(‘પુનિત પ્રેમગાથા’, આ.૨, પૃ. ૧૦૭-૦૮)

\* \* \*

કાન્તિને પ્રેરનારું છે દુઃખ એ તો સનાતન,  
દુઃખ જીવનનું પર્વ, દુઃખ જીવન-ઉત્સવ.

(‘જીવનપગલે’, આ.૧, પૃ. ૬૧)

\* \* \*

કોઈનો દોષ જોવાનો આપણાથી કરાય ના,  
પોતાનો ખોળી ખોળીને, મથો યોગ્ય પૂરું થવા.

(‘જીવનપગલે’, આ. ૧, પૃ. ૨૪)

\*

\*

## તીર્થનો, યાત્રાનો, દર્શનનો લાભ તથા આધ્યાત્મિક આશ્રમોની યાત્રા

દર્શનને દિવસે બધાંને મળવા કરવાનું મૂકી દેવું. દર્શન સમય પહેલાં, ભાવનાથી કોઈ એક પ્રાર્થનાના ભાવ સાથે એકાગ્રતા કેળવવી. દર્શનસમયે પણ તેવી એકાગ્રતા સાથે તેવી પ્રાર્થના ભાવનાપૂર્વક કરવી. પોતાને જ્યાં ઉભા રહેવાનું આવે ત્યાં દૂરથી ત્રાટકના એકાગ્રભાવે, હૃદયસ્થ ભાવને પ્રેરીને (દર્શનના વિષય સાથે) જ્ઞાનભક્તિપૂર્વકનું તાદ્યાત્મ્ય હૃદય હૃદયથી સંધાયા જાય એમ પ્રવર્તનું. આવું કંઈ એકદમ, છેલ્લી ક્ષણે, નહિ બને. આપણે દર્શનસમયે તેમ વર્તવું છે, એમ જ્ઞાન-ભાવ રાખીને, દર્શન પહેલેથી જ (બને તેટલા વધુ દિન યા વખત પહેલેથી) ભાવનાને એકાગ્ર ને કેંદ્રિત રાખી રાખીને, દઢાવીને વર્તવાનું છે. તે વાતાવરણનો સૂક્ષ્મ ભાવ શાહીચૂસની જેમ ચૂસી લેવાને માટે હૃદયથી સ્વીકારાત્મક અને ગ્રહણાત્મક બનવાનું રહે છે. પ્રત્યક્ષ દર્શનસમય આવે તે પહેલાં આપણા મનની સ્થિતિ ધ્યાન મધ્યસ્થ વેળાએ જેવી રહે તેવી કરવાની છે. પહેલેથી કશા વિચાર ન કરવા કે ન ઉદ્ભવવા દેવા. તે સમયે આમ કરીશ કે તેમ કરીશ—  
—એવું દ્વિધાપણું કશા અંગે ન થવા દેવું.

દર્શન પછીનો તરતનો સમય કોઈ એકાંત સ્થળે જઈને ધ્યાનમાં ગાળવાનો હોય. દર્શન બાદ કોઈની સાથે હળવા-

ભળવામાં ન ગાળવો. દર્શનથી પ્રગટતી અસરનો આવો  
રચનાત્મક જ્ઞાનપૂર્વકનો ઉપયોગ આવશ્યક છે.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૨૬૬-૬૭)

\*

તીર્થયાત્રામાં કશાથી ધરાઈ જવું નહિ. વધારે ને વધારે  
સમજવાને ચિંતવવું. હૃદયમાં ઉત્તરી શકે એવો પ્રાર્થનાભાવ  
દૃઢાવવો. ઘણાં લોકો તીર્થમાંનું તીર્થમાં જ પાછું મૂકતાં આવે છે,  
તેવું આપણું ન થવું ઘટે. તીર્થયાત્રાને પરિણામે ભક્તિભાવ,  
શરણભાવ, સમર્પણભાવ ને ભગવાનમાં શ્રદ્ધા-વિશ્વાસ એ બધું  
જીવંત બનવું ઘટે.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૩૧૩)

\*

(આધ્યાત્મિક આશ્રમોની યાત્રા વેળા) ત્યાં આપણે આપણા  
આગ્રહો, મતમતાંતરો, આપણી રીતરસમો, સમજણો કે  
દાખિલિંદુઓના સકળ મદારને છોડીને માત્ર જિજ્ઞાસાભાવે સંપૂર્ણ  
જ્ઞાનપૂર્વકની નભ્રતા ધારણા કરીને જેટલું સ્વીકારાત્મક ભાવે  
સમજવાને મથીશું, તેટલું સમજવાનું, જાગ્રવાનું ને અનુભવવાનું  
વિશેષ મળવાનું. ત્યાં સત્સંગની ભાવનાથી જીવનમાં સાધનાની  
ભાવનાને દર્શાવવાને અને કેળવવાને માટે ગયા છો, તે રીતે  
લાભ લેજો. એકાંતનું વધુ સેવન કરજો ને ધ્યાન કરતા રહેજો.  
આપણું મન, હૃદય ત્યાંનો યોગ્ય લાભ લેવાને માટે ખુલ્લાં બને  
તેટલાં રાખજો. ક્યાંય કશી સરખામણી કરવામાં ન પડી જશો.  
દરેક આશ્રમની સૌ સૌની આગવી અને અનોખી વિશિષ્ટતા  
હોય તેવું જ ચેતનમાં પ્રગટેલા આત્માઓ વિષે પણ સમજશો.  
આવી તીર્થયાત્રાના દિવસોમાં જેટલું પારમાર્થિક ચિંતવન રહ્યાં  
કરે તેટલું ઉત્તમ. આવું બધું થયાં કરે તો જ તીર્થ ગયાનું સાર્થક;  
બાકી તો નાહકનો સમય, નાણાં અને શ્રમનો દુર્વ્યય થયો ગણાય.

તીર્થ એ જીવનનું સાચું મહત્ત્વ પ્રગટાવવા માટે છે. ઘણાં લોક જે દર્શન માટે આવેલા હોય છે, તેમને દિલમાં તેની પૂરી ગંભીરતા જાગેલી હોતી નથી; તો મહત્ત્વ અને રહસ્યની તો વાત જ શી ! પરંતુ આપણે તો આપણી રીતે તેનો પૂરો લાભ લેવાનું કરવાનું હોય. બીજાં બધાંથી અનોખી રીતે વર્તવાનું હોય.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૩૨૮-૩૮)

\* \* \*

આ જમાનામાં ઘરેડ રીતે થતી જાત્રાથી જીવનની સમજ કદી ઊગી શકી જાણી નથી; કારણ કે જીવનમાં હૃદયની એવી જાત્રાની ભાવના-ધારણા ઊગ્યા વિના જીવનના તેવા કર્મમાં તેવી ધારણા જન્મી શકતી નથી. જીવનને સહેલગાહે ભોગવવા લઈ જતા હોઈએ એવો જ ખ્યાલ લોક જાત્રામાં રાખે છે; માત્ર ફરવા જતા હોય એવું, મને તો લાગે છે; બાકી જો સાચી જાત્રાની ભાવના હોય તો સમજણમાં અને વર્તનમાં ફરક પડ્યા વિના ન રહી શકે. પહેલાનાં જમાનાની જાત્રાઓમાં મુશ્કેલીઓ, વિઘ્નો અને ઘણું ઘણું સહેવાનું પણ આવતું; સાહસ, બહાદુરી, ધીરજ, હિંમત, અભય આદિ ગુણો કેળવવાના ઘણા પ્રસંગો મળતા; આથી યાત્રીઓના જીવનનું ઘડતર થવાની શક્યતા રહેતી. એ પણ આજે તો નથી રહ્યું.

(‘જીવનપ્રેરણા’, આ.ર, પૃ. ૫૩-૫૪)

\* \* \*

તીર્થ એ જીવની ભાવનાનું ને સંસ્કૃતિનું પ્રતીક છે. તેથી તો તીર્થનો મહિમા છે. વળી જાગતા નરના (આત્માના) સીધા સંપર્કમાં પ્રેમભાવે આવવું, એના જેવું તો બીજું કોઈ ઉત્તમ તીર્થ નથી.

“સંતો ! જગતા નર સેવીએ.”

એવું એક ગોરખનું જૂનું ભજન છે. જગતા નરની હદ્યપૂર્વકની જીવનવિકાસના હેતુ અર્થે જ્ઞાનપૂર્વકની આરાધના થઈ શકે, તો તે તીર્થનું ઉત્તમ રૂપ ગણાય. અસલથી જે તીર્થ મનાયેલાં છે, તે તીર્થોનું માહાત્મ્ય પણ એવા એવા જગોતા પુરુષોની જીવંત સંસ્કૃતિથી કરીને પ્રગટેલું છે. એટલે સ્થળ તીર્થોમાં માત્ર જવા કરતાં એવા પ્રત્યક્ષ જગતા નર એ સૂક્ષ્મ તીર્થ છે અને ત્યાં પણ, જીવનવિકાસના હેતુનું જ્ઞાન પ્રગટાવીને જો જવાનું થાય, તો તે ઉત્તમ છે અને તે સાચી યાત્રા છે.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૨૭૭-૭૮)

....તીર્થમાં ગયા છો, તો હદ્યમાં તેવા પ્રકારની ભાવનાને સતત સંકોરતા રહેજો. તીર્થગંગામાં મનાદિ કરણનો બધો મેલ ધોવાનો ઘ્યાલ રાખજો. મનમાં કશું ભરી ન રાખશો. ખુલ્લા થયાં ને રહ્યાં કરજો અને જીવનની ભાવનાને સ્વીકારવાની અને તે પ્રમાણે વર્તવાની તત્પરતા દાખવજો.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૨૭૭)

### ત્યાગ અને ભોગ

આપણી સંસ્કૃતિમાં જે અનેક પ્રકારના સાંપ્રદાયિક મતો પ્રસર્યા, તે ત્યાગ ને ભોગ તે બેની વચ્ચેના તે બધા ફાંટાઓ છે. ત્યાગ કે ભોગ, બન્ને પ્રેમભક્તિજ્ઞાનયોગની ભૂમિકાવાળા હોવા ઘટે; તો જ તે શોભે. જ્ઞાનભક્તિ વિનાનો ત્યાગ એ ત્યાગ નથી, પણ જીવનને બેળે બેળે કચરી દેનારું અને જીવનની કુમળાશને હણી નાખનારું તે નકારાત્મક તત્ત્વ છે. આપણી સંસ્કૃતિમાં દમન ઉપર વધુ ઝોક દેવાયેલો છે; પરિણામે જીવનના પ્રાણ ઉલટા કચરાઈ ગયા છે. સંયમને સ્થાન હોય,

દમનને નહિ. બન્ને વચ્ચે મોટો તરફાવત છે. દમનથી બુદ્ધિ, પ્રાણાદિ કુંઠિત બને છે. તેની સામી બાજુએ બીજા કેટલાક સાંગ્રામિક પંથોએ જીવનનો સ્વીકાર કર્યો છે ને ભોગપ્રધાન છે. એ ભોગ મૂળે તો હોવો ઘટે પ્રેમભક્તિજ્ઞાનના યોગપૂર્વકની ભૂમિકાવાળો; પરંતુ તેની તેવી સ્થિતિ ન રહેતાં તેવી સંસ્કૃતિનું પણ પતન થયું. જીવનમાં ભોગને સ્થાન છે. જ્યારે જ્ઞાનની અવસ્થામાં જીવનનો યજ્ઞ સંપૂર્ણપણે પરિપૂર્ણ થયા બાદ જે કંઈ બાકી રહે તેવા ભોગને યથાર્થ ગણેલો છે. જીવનમાં ત્યાગ અને ભોગ બન્ને છે. જીવદશાની કક્ષાના ભોગમાં અને જ્ઞાનઅનુભવદશાના ભોગમાં ઘણો તરફાવત છે.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૩૬૮-૬૯)

\* \* \*

ત્યાગ કરવો ને ત્યાગ ભોગવવો—એ બન્નેના ભાવાર્થમાં પાયાનો ફેર છે. ત્યાગ ભોગવવાનો આનંદ જે છે, તે ત્યાગ કરવાના આનંદ કરતાં ક્યાંયે વિશેષ ચઢિયાતો છે. ત્યાગ કરવાનો આનંદ એ જીવનવિકાસની, પ્રમાણમાં, નીચલી શ્રેષ્ઠીનો માર્ગ છે. ત્યાગ ભોગવવાનો આનંદ જીવનવિકાસની સહજ અવસ્થાનો આનંદ છે. ત્યાગ ભોગવવામાં સહજપણું છે, જે ત્યાગ કરવાના આનંદમાં નથી. પહેલી સ્થિતિ છે નૈસર્જિક, જ્યારે બીજી છે સહજપણાને પ્રાપ્ત કરવાનું સાધન.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૩૭૦)

\* \* \*

### ત્રાટક

ત્રાટકનો હેતુ આપણી આંતરિક કિયાઓ ઉપર કાબૂ વધારવાનો છે. આપણા વિચારો, લાગણીઓ, ભાવનાઓને ગમે

તેમ અસ્તવ્યસ્ત રીતે વિહરવા ન દેવા માટે આ સાધન છે. આનાથી એ બધાનો યોગ્ય પટ આપણે રચી શકીશું, ને તેવી આત્મશ્રદ્ધા આપણને ગ્રાટકમાંથી જન્મી જવી જોઈશે.

ગ્રાટકમાં હંદય ઉપર આંતરૂદૃષ્ટિ રાખવાથી લીનતા આવે છે એ સાચું છે; પણ બાધ્ય દાષ્ટિ તો ગ્રાટકબિંદુમાં જ રાખશો. આજુબાજુનું કશું દેખાવું ન જોઈએ. માત્ર બિંદુ જ દેખાય. પાંપણ પણ ત્યારે મુદલે ફરકવી ન જોઈએ. ગ્રાણ કલાક સુધી તે આપણે લઈ જવાનું છે; પરંતુ વૃત્તિ ઉપર કોઈ જાતનો બળાત્કાર નથી કરવાનો. જેમ જેમ પ્રેમ, રસ તેમાં જામતાં જાય તેમ તેમ સમય વધારતા જવું. આંખ મીંચાઈ જાય કે પાંપણ ફરકી જાય તો બંધ કરી દેવું રહ્યું. તે વખત પૂરતું ને પૂરું થયું ગણી લેવું. પૂરું થયા બાદ ઠંડા પાણીથી આંખોને છાલકો મારવી યા ઠંડા પાણીમાં પાંચેક મિનિટ બોળી રાખવી ને તે બાદ આંખો મીંચીને, થોડો સમય બેસી રહેવું યા સૂઈ રહેવું ને નામસ્મરણ કર્યા કરવું. આંખે લૂગડાનો સ્વર્ણ જડો પાટો રાખવાથી પણ વધુ ઠીક રહેશે. આંખને આરામ વધુ મળશે.

(‘જીવનપરાગ’, આ.૨, પૃ. ૫૩, ૭૨)

\*

\*

શરૂઆતમાં જરા પણ ભાર આંખનાં પોપચાં ઉપર ન દેશો. ધીમે ધીમે સહજ રીતે હળવે હળવે થોડી આંખો ઉઘાડવાનું રાખવું ને ત્યારે જો ખૂબ પ્રેમભાવ ઉભરાતો રાખી શકીએ તો ઉત્તમ.

બિંદુનું ગ્રાટક એ આપણી બહિર્મુખ સર્વ સ્થૂળ અને સૂક્ષ્મ પ્રવૃત્તિઓમાંથી એકમાં કેમ કરીને એકાગ્ર રહી શકાય એને માટે છે; જ્યોતનું ગ્રાટક શક્તિના આવાહન માટેનું છે. (જ્યોત તદ્દન સ્થિર, લગીર પણ હાત્યા વિનાની રહેવી ઘટે.) બંનેથે જરૂરી છે.

(‘જીવનપરાગ’, આ.૨, પૃ. ૭૨-૭૩)

\*

\*

ત્રાટકમાં બેસતાં પહેલાં મનથી ખૂબ નિશ્ચય કરીને બેસવું કે પાંપણો ફરકવાની નથી જ. આપણો આપણી સંકલ્પશક્તિને જન્માવવાની ને સર્વોપરી કરવાની છે. આંખની પાંપણો ફરકે તો તે ત્રાટક ન કહેવાય. જ્યોત ત્રાટક દિવસમાં બે વાર થઈ શકે. બિંદુત્રાટક ગ્રાણચાર કલાકને અંતરે બેથી ગ્રાણ વાર થઈ શકે. ત્રાટકબિંદુ કે જ્યોતની ઊંચાઈ આંખની સીધાણમાં સામે જ આવે તેમ રાખવાનું. અંદરની કીકી હાલતી નહિ લાગતી હોય પણ એની Pitch—એકાગ્ર દાસ્તિપાતની જગા કંઈક બદલાતી હશે. પણ નજર જો મધ્યબિંદુ પરથી ખસતી ન હોય તો હરકત નથી. દેખાવ જાંખો થઈ જાય છે એ તો એકીટશે જોઈ રહેવાને લીધે.

(‘જીવનપગરણ’, આ.ર, પૃ. ૮૫, ૧૧૬)

\* \* \*

સૂર્યનું ત્રાટક છ સાત મિનિટ જ રાખશો અને તે પણ તદ્દન ઊગતા સૂર્યનું. કિરણો તદ્દન કુમળાં હોવાં જોઈએ.

(‘જીવનપગરણ’, આ.ર, પૃ. ૧૦૮)

(‘જીવનસંશોધન’, આ.૧, પૃ. ૩૬૬)

ત્રાટક વેળા સૂક્ષ્મ આંખ અને મન-હદ્દ્યમાં કેન્દ્રિત હોવાં જોઈએ.

ચંદ્રમા સામે પણ ત્રાટક કરી શકાય, પણ ત્યારે શો ભાવ ધારણ કરીએ છીએ તે મહત્વનું હશે.

(‘જીવનપગરણ’, આ.ર, પૃ. ૧૧૬)

ત્રાટક વેળા જ્ય તો આપણે ચાલુ રાખ્યા જ કરવાના છે. ત્રાટકથી આંખો બગડે નહિ એટલું જ નહિ, પણ આંખોનું તેજ વધે છે તથા દાસ્તિ લાંબે સુધીની થાય છે.

(‘જીવનપગરણ’, આ.ર, પૃ. ૧૩૧)

\* \* \*

ત્રાટક સમયે જે જે વિચારો આવે તે ગમે તેવા લલચાવનારા હોય તો ય તેમાં રસ ન લેવો. એને આનુષ્ઠાંગિક વિચારની સાંકળ ન જોડવી. ત્યારે નારીના ધબકારા ગણાજો. ત્રાટક વેળા હદ્યમાં જેટલા ઊંડા ઉત્તરી શકાય એટલું ઉત્તમ. ત્યાં જ વધારે મહત્ત્વ આપશો. ધૂન, જાપ, ભજન સિવાય પણ તેમાં ભાવ જામી શકે તો ઉત્તમ. અંતર્મુખતા પણ પ્રગટવી જોઈએ.

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૨૦૨)

ભાવમાં જ્યારે ઘણી ઘણી એકાગ્રતા પ્રગટે છે, ત્યારે આંખ એની મેળે સ્થિર રહે છે. આંખને તે વેળા સ્થિર કરવી નથી પડતી. એવી જ રીતે જ્યારે આપણને જીવનસાધનામાં ખરેખરો રસ જામે છે ને તેથી તેમાં એકાગ્રતા જામે છે, ત્યારે સાધના કરવી નથી પડતી; ત્યારે તે તો સહજમેળે થયે જાય છે. એકીટશે જોઈ રહેવાથી એકાગ્રતા સર્જય છે.

(‘જીવનસંશોધન’, આ.૧, પૃ. ૪૮)

\*

\*

પ્રકૃતિમાંની સગડગની વૃત્તિને નિશ્ચયાત્મકપણામાં પ્રગટાવવાને ત્રાટક સારું સાધન છે. હદ્યમાં પ્રગટેલો ભાવ વ્યવહારમાં પણ શાનપૂર્વક ઉપયોગમાં પ્રગટાવવાનો છે.

(‘જીવનસંશોધન’, આ.૨, પૃ. ૧૫૩)

\*

\*

સદ્ગુરુના હદ્ય પર ત્રાટક કરવાથી તેના ભાવની અસર જીવનમાં ઉદ્ભબવે છે ખરી, પરંતુ તેમ થવાનો સાચો આધાર આપણા પોતાના હદ્યમાં તેના પરત્વે કેટલો ઉત્કટ ભાવ પ્રગટેલો છે તેના પર છે અથવા કોઈ પવિત્ર જીવંત જાગેલા પુરુષની મૂર્તિ કે છબીની ઉપર અથવા તો મંદિરની મૂર્તિ ઉપર પણ એવી રીતે હદ્યની ભાવના પ્રગટાવીને ત્રાટક થઈ શકે

છે. ગ્રાટકની પાછળનો હેતુ, ઉદેશ ભુલાવો ન જોઈએ. બાકી ખાલી ખાલી આંખો ફાડીને જોયા કરવું એનું નામ ગ્રાટક નથી. ગ્રાટકમાં ભાવ પ્રગટતાં એકાગ્રતા વધે જ. એવી ભાવાત્મક એકાગ્રતા પ્રગટતાં આંખમાંથી અશ્વ નીકળે છે કે નહિ, તેની પણ સમજાણ પડતી હોતી નથી. દેહ-ચેતનાનું ભાન પણ રહેતું હોતું નથી અને અંતરમાં અંતરની ભાવનામાં, એકાગ્રપણે ત્યારે મશગૂલ થઈ ગયા હોઈએ છીએ.

(‘જીવનસંશોધન’, આ.૧, પૃ. ૩૪૯-૫૦)

### દંભ

આધ્યાત્મિક માર્ગમાં દંભ એ એક એવો મહા દુર્ગુણ છે કે જે જીવને આ માર્ગે કદી જવા દેશે નહિ. દંભનો પડદો ચીરાવો જ જોઈશે. સાધનાની સચ્ચાઈમાં આ દંભ આડે આવતો હોય છે. એ એવી સૂક્ષ્મ રીતે દૂધ અને દહીં, બન્નેમાં પગ આપણને રખાવે છે કે જેથી ભલભલાને ગતાગમ ન પડે. પ્રકૃતિની એ એક જબરદસ્ત પકડરૂપે છે. અવનવાં રૂપો ધારણ કરીને સાધકને એ પછાડે છે. આપણા જીવસ્વભાવનું પૂરેપૂરું સ્વરૂપ ખુલ્લું થયા વિના કે કર્યા વિના કે તેનાથી પર થયા વિના પ્રભુ-ચરણો આસક્તિ થઈ શકવાની નથી. પ્રભુભક્તિને માર્ગે દંભ એ આપણો એક મોટામાં મોટો શરૂ છે.

(‘જીવનમંડાણ’, આ.૩, પૃ. ૨૦૩)

\*

\*

કોઈ જીવને કોઈ બીજા જીવ પર તેના વર્તનથી ઘણી ખીજ ચઢી હોય, કોધ ચઢ્યો હોય, ત્યારે તે રીતે બોલી ન દેતાં ખીજ કે કોધને જીવનવિકાસાર્થે અંદર શમાવીને તેના પ્રતિ પોતે શાંત વૃત્તિ ધારણ કરે, મનમાં દબાવી રાખે ને તે રીતે વ્યક્ત ન થાય

તો તેના જીવનમાં દંભ છે એમ ન ગણાય; પરંતુ એવી રીતે શમન કરવું ઊલદું સારું ગણાય. આથી કદાચ પોતે મનમાં અકળાય પણ ખરો ને કેટલાકમાં તે અંગેની વિચારપરંપરા પણ કદાચ ચાલે; તેમ છતાં ખીજ ને ગુર્સે થવાનાં કારણો મળવા છતાં તેમ થવા દેતો ન હોય તો તેમાં દંભ નથી. જીવન-સાધકે એવી વૃત્તિને ઓળખીને, કાબૂમાં આણીને કમશઃ નિર્મળ કરવાની રહે છે. ને એમ થતાં ધીમે ધીમે પછી તો તેના મનમાં કોધની વૃત્તિ મુદ્દલે ના ઉપજે તેવી સ્થિતિ તેના શમનના પ્રારંભમાંથી જ રખાઈ જતી થઈ જશે. આવા શમન પાછળનો હેતુ મીઠું બોલીને, મનમાં ડંખ રાખીને, લાગ આવ્યે વેર વાળવાનો નથી; પરંતુ પોતાની વૃત્તિ અઠીક લાગતાં તે વૃત્તિને વ્યક્ત કરીને તેને વેગ ન આપતાં શમાવીને, તેને કાબૂમાં આણીને અંતે નિર્મળ કરવાનોછે.

(‘જીવનમંડાણ’, આ.૩, પૃ. ૨૦૭)

### દાન

કોઈને પણ દાન કે એવું કશુંક આપવાનું બને ત્યારે ભગવાને આપ્યું છે અને એને જ આપું છું—અપાય છે—એમ જીવતી ભાવના રાખશો. ત્યારે વખાણ સાંપડતાં તે પરતે બેપરવા રહીને તેવું બધું શ્રીભગવાનચરણે સમર્પણભાવે ધરવું.

સાચી દાનવૃત્તિ કરુણાવૃત્તિમાંથી નીપજે છે. આ વૃત્તિનો પણ આપણો આપણા માટે ને આપણામાં ઉપયોગ કરવાનો છે. દાનમાંથી જન્મતો ભાવ એ આપણું પરમ બળ છે.

દાન કરવામાંથી સૂક્ષ્મ અભિમાન પણ પ્રગટતું હોય છે. એ આપણને સૂક્ષ્મ રીતે પાડતું હોય છે.

(‘જીવનપગરણ’, આ.૨, પૃ. ૪૬, ૫૭)

\*

\*

દાનનો મૂળ હેતુ ‘સર્વભૂતહિતરતઃ’ થઈ જવાનો છે. તે સ્થૂળ દાનથી બનવું મુશ્કેલ છે. જીવંત સાધનામાંથી પરિપક્વ થતાં થતાં ને એના પરિણામરૂપે ઉદ્ભવેલા ભાવનું સર્જન થતાં ને એથી કરી જીવનમાં કળાનું જે નવું સ્વરૂપ પ્રકટે છે, તે પ્રગટાં સર્વભૂતહિતરત થવાપણું પ્રગટે છે. બાકી જગતની રીતે કરેલા દાનનું ફળ તો કેટલીક વખતે અહંતાને પોષવામાં ને વધારવામાં પણ પરિણામે છે. કેટલીક વાર એવા દાનમાં માનવીની વૃત્તિ અધિત્પણે સંતોષાર્થ જાય છે, ને એવા ઉપરછલ્લા સંતોષમાં પોતાની જાતની છેતરામણ થાય છે. જીવનવિકાસમાં સ્થૂળ દાનનો કશો જ અર્થ નથી, એમ નથી; પરંતુ દાન કયને પરિણામે આત્મસંતોષ માની, તેની જાણ્યે અજાણ્યે આત્મવંચના જે પોષાય છે તે અહિતકર છે અને આજે તો દાનની પ્રથા ઘણી વેળા એક પ્રકારનો વહેવાર પણ થઈ ગઈ છે. જીવનવિકાસની સાધનાથી જે સર્વભૂતહિતરતપણું પ્રગટે છે તે ઉત્તમ પ્રકારનું દાન છે.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૨૭૬)

\* \* \*

### દિલદારનું દર્શન

(ગઝલ)

જીવન દિલ-તાર જોડીને જીવનના દર્દથી ભારે,  
જીવન-વીણા બજાવી છે તહાં મહેફિલ જામી છે.

જહાં મહેફિલની રંગત બરાબર જામી જીવનની,  
મળ્યો પાનાર પીનારો થયા શા સંગી મહોબતથી!

હૃદય-દિલદારનું દર્શન જગતના ગૂઢ વ્યવહારે,  
અમારે તો કરી-કરીને રહ્યું શું રાચવાનું તે !

રસાયેલા જીવન-દિલનો હરેકે તાર જુદો છે,  
અને એ તારના સૂરને ગજબ કો સૂણનારો છે.

મળ્યા ચોગાનમાં આલમ તણા પાનાર-પીનારો,  
પછી માઝા રહે શી ત્યાં ! જહાં પાનાર છે ન્યારો.

જીવનની રાખથી એને અમે જીવતો સદા રાખી,  
થઈ બંદા અમે એના જીવનમાં ગાજશું રાચી.

હદ્ય-દિલદાર દિલબર એ જગતમાંયે સમાયો છે,  
જગત ના બેવફા તેથી કદીયે નીવડે અમને.

જગત રંજાડીને અમને જગત રંજાડશે નિજને,  
જગત બતલાવશે કેવો રચેલો સ્વાંગ એનો છે !

નથી રંજાડનારું તે અમોને કોઈએ ક્યાંયે,  
બધે જેમાં અને તેમાં અમારે ભેટ ભાંગે છે.

સિતમગર જાદુગર વ્હાલો જીવનસર્વસ્વાએ, અમછે,  
જીવન જે સાથ જોડે ત્યાં અમારું રાચવું રે' છે.

(‘પ્રાણમ-પ્રલાપ’, આ.ર, પૃ. ૧૩૬-૩૭)

\* \* \*

### દુઃખ, જીવનદાતા

(અનુષ્ટુપ)

ઉલ્કાન્તિ સર્વ જીવોની થતી દુઃખથી જાણજો,  
જીવન-કાન્તિમાં ફાળો દુઃખનો ઓર ભવ્ય શો !

દુઃખ વેઠચા વિના જન્મ કશાનોય થતો નથી,  
દુઃખ આઘાત આપીને પ્રેરાવે બોધ આપથી.

જન્માવવા પુરુષાર્�, ચેતના પ્રગટાવવા,  
મળેલું દુઃખ સદ્ગ્રાહ્યે ઉઘા, જીવન પ્રેરવા.

હતાશ દુઃખથી જેઓ બને નિર્માલ્ય જીવને,  
દુઃખ એનું ચઢી વાગે દુઃખમાં તે રૂષ્યા કરે.

બેળે બેળે સહેવાથી દુઃખનો લાભ ના મળે,  
કારમી ઉપજાવે તે નિરાશા કેવી જીવને !

દુઃખ એ કલ્પના માત્ર માનવીના મને વસે,  
દુઃખ એને ગણે જે ના દુઃખ એને નહિ કશે.

પ્રેમની તે પરાકાણા પૂર્ણોચ્ચવા શો વિયોગ છે !  
તેવું જ દુઃખનું જાણો વિકાસાર્થે મળ્યું જ તે.

દુઃખ એ શક્તિ છે પોતે કાલિકા શી પ્રચંડ તે !  
વાળશો જેવી રીતે તે આપશે ફળ એ રીતે.

દુઃખ જેને જનો માને, કેંક બીજા કશા તણો-  
છાયા આભાસ છે એ તો, તાપથી જેમ જાડનો.

જન્મનું સાથી તો દુઃખ, મૂત્ય સાથ વળી રહ્યું,  
ભલભલા ભલે ભૂપ એણોયે દુઃખ તો સહ્યું.

દુઃખથી તો જણાયે છે સાચું વિશ્વ-સ્વરૂપ શું !  
દુઃખથી તો પમાયે છે તત્ત્વ જીવનનું ખરું.

(‘જીવનપગલે’, આ.૧, પૃ. ૪૩, ૪૪, ૪૬, ૫૫, ૫૬)

દોષોનું ભાન, સ્વીકાર ને વેદના

દોષોનું, દુર્ગુણોનું સ્પષ્ટ દર્શન પ્રથમ તો થવું જોઈશે; પરંતુ  
તેય પૂરતું નથી. તેને હઠાવવા આપણામાં દઢ નિર્ધાર જાગી જવો

જોઈશે. નકારાત્મક બળને રચનાત્મક શક્તિથી હણવાનું છે. જો તેમ નહિ થાય તો દોષોનું ભાન નિરાશાના વમળમાં દુબાડી દેશે ને આપણે હતાશ થઈ જઈશું.

\* \* \*

દોષોની ચિંતા કર્યી કરવાથી તે દૂર થતા નથી; બલકે વધે છે. દોષ અને સ્ખલન તો થઈ જવાનાં. તેનાથી જે ચેતે ને ચેતીને વર્તે, તેનો થયેલો દોષ પણ તેનો સદ્ગુરુ બની શકે છે. દોષ આપમેળે સૂજવા માંડ્યાં છે તો આપણે સમજવું કે હવે આપણો સુધરવા વારો આવ્યો છે.

('જીવનપ્રવેશ', આ.ર, પૃ. ૧૨૬)

\* \* \*

દોષોનો સ્વીકાર તેમાંથી મુક્તિ પામવા માટે છે, ને નહિ કે તે માત્ર સ્વીકારીને બેસી રહેવા માટે. દોષો આપણને ખૂબ ખૂબ કઠવા ઘટે, ઉંખવા ઘટે. આપણને આપણી વક્તાનાં દર્શનમાંથી જો સીધા થવાનું ન સૂઝે ને તેમ ન બને તો તેવું દર્શન કુંઈ જ ખાસ મદદરૂપ નથી. પોતાનો જરાક જેટલો દોષ ને દુર્ગુણ જ્યારે સાધકને હિમાલય પર્વત જેવડો લાગે અને તે ઘણો ઘણો સાલે તથા તેમાંથી ઊગરવાને જ્યારે સહદ્યતાથી પ્રમાણિકતાથી તે મથ્યા કરે છે, ત્યારે તેનાથી હદ્યના પોકારથી થયેલી ભગવાનની પ્રાર્થના તેને મદદરૂપ નીવડી શકે છે. મારા તે કાળના તબક્કાની એવી પ્રાર્થનાઓ ‘હદ્યપોકાર’માં છે. આપણા દોષો, વિકૃતિઓ, દુર્વૃત્તિઓ જો ઉત્કટ પ્રમાણમાં ઉંખતી હશે તો તેવી પ્રાર્થના કરતાં કરતાં ચોધાર આંસુ પણ આંખમાંથી સરે. તેવી પ્રાર્થનામાં આપણને થતા દુઃખનો એવો રણકાર ઊઠશે કે તેના પ્રત્યાઘાતથી પેલું બધું ક્યાંયે અદૃશ્ય થતું જાય.

\* \* \*

અનેક ભક્તોએ “મો સમ કૌન કુટિલ ખલ કામી” અને ગાયું છે. તેઓ શું ખરેખર તેમ હતા? હરગિજ નહિ. પરંતુ તેમના જીવનની જીવપ્રકારની તલ જેટલી ક્ષતિ પણ તેમને અત્યંત વેદનાથી બાકુણ કરી મૂકે છે, ને તેનો પોકાર ઉપરના જેવી કડીમાં વ્યક્ત થાય છે. આપણાને પણ જો આપણા દોષોનું ભયંકરપણું લાગી જાય તો, ઊંઠું ઊંઠું સાલે તો, નિવાર્યા વિના ચેન ન પડે. વીંધીને કે સાપને અડકીશું? ગળે લટકાવી રાખીશું? જ્યારે દોષોને, દુર્ગુણોને આપણે હજ આપણામાં લટકવા-ટકવા દઈએ છીએ, કારણ તેની ભયંકરતાનું ભાન જાગ્યું નથી. તેનું વિષ વ્યાપ્યું નથી.

‘જીવનસંશોધન’, આ.૨, પૃ. ૨૫૮)

\* \* \*

### સ્વ-દોષ નિરીક્ષણ

(અનુષ્ટુપ)

‘પોતાની પ્રકૃતિ સામે, સામાના રૂપમાં ભળી,  
 ‘કેવી હરાવવા ચાહે’ લક્ષ તે રાખવું મથી.  
 કોઈ ના આપણી સામે બીજું પ્રત્યક્ષ ત્યાં વસે,  
 સ્વભાવ ચાલબાજ શી નવી નવી ધર્યા કરે.

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૮૮)

બીજાંનો દોષ જોવાતાં આપણે ચેતવું હશે,  
 બીજાંનો ગુણ થોડોયે પ્હાડ જેવો ગણો હશે.

(‘પુનિત પ્રેમગાથા’, આ.૨, પૃ. ૧૬)

અહંતાથી જનો વિશે પ્રેરાયે કામમાં સદા,  
 કલેશ, સંતાપ ને દુઃખ જીવને તેથી પામતાં;

છતાં એ સર્વનું મૂળ બીજાંને માનવી ગણે,  
‘બીજાંથી આ થયું’ એવું કહેતાં સાંભળ્યાં જગે.

સર્વનું મૂળ પોતામાં રહ્યું, ના તે જનો જુએ,  
કરે ખદબધાં કેવાં **માનવી નિજ જીવને  
છાણ માંહી કીડા સમે!**

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૨૦૧)

(ગઝલ)

બીજાંના દોષ દુર્ગુણને અમોથી ના વિચારાજો,  
અમારા દોષ જોવાજો અને અમથી ન તે બનજો.

(‘પ્રણામ-પ્રલાપ’, આ.૨, પૃ. ૧)

(અનુષ્ટુપ)

નિમિત્ત બીજું તો ખાલી આપણા જીવને ખરે,  
બીજાનું નામ ત્યાં લેવું તે કઢંગું બધી રીતે.

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૧૭૮)

કરેલાં કર્મની છાયા દુઃખને જાણવું ઘટે,  
બીજાંને દોષ દેવાનો છોડી દેવો સદા ખરે.

(‘જીવનપગલે’, આ.૧, પૃ. ૬૨)

જ્યાં સુધી આપણે પોતે પૂરેપૂરા થયા નથી,  
અન્યથા કેરું તો મૂળ શોધવું આપણી મહીં.

ઓછો અન્યાય બીજાંને થવા સંભવ એ રીતે,  
શોધતાં મૂળ પોતામાં ખોઈએ આપણે ન કેં.

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૧૨૪)

## ધ્યાન

ધ્યાન આપણા અંતરની શોધ માટે થાય, સમર્પણની ભાવના માટે થાય, ખાલીપણું-નિર્વિચારપણું કેળવવા માટે, લય થવા માટે, પ્રાર્થનાના Mood-ભાવતરંગ માટે થાય; આમ ધ્યાનના અનેક પ્રકારો છે. તેથી એક વખત આમ થયું ને બીજી વખત આમ કેમ થયું? એવી સ્થિતિયુસ્તતા એમાં નથી. જે થાય તે જોયાં કરવું. ધ્યાનમાં એકાગ્રતાનો ભાવ એ મુખ્ય વસ્તુ છે. તે સ્થિરતા-જડતાવાળી એકાગ્રતા નહિ પણ ચેતન-સ્ફુરતી હોવી જોઈએ.

ધ્યાન સમયે તંક્રા એ એક મોટો સામાન્ય અવરોધ આવતો હોય છે. તે આવતાં આપોઆપ સામાન્યતઃ તો ખબર પડી જતી હોય છે. ધ્યાનમાંથી કોઈ ખાસ પ્રકારની લાગણીઓ ઊપજે એવી કશી અપેક્ષા ન રાખવી. માત્ર એમાંથી આપણે સતત જગૃતિ મેળવીએ ને સાધનામાં વેગ મળે તો હાલ તો તે ઘણું છે. તે વેળા આપણા આગ્રહો, મંતવ્યો, મડાગાંઠો, વિચારો આદિ બધું જ સાચા અર્થમાં લય પામી શકે તો તેટલી વેળા આપણી અંદરની ચેતનાનો—જેને ભગવાનનો ભાવ પણ કહી શકાય તેનો—સ્પર્શ થાય, જાણ થાય, અનુભવ થાય.

ધ્યાનમાં સમયની ગાણતરી એ મુખ્ય માપ નથી. આટલા અમુક કલાક ધ્યાન થયું તે ગૌણ છે. ઊંડાણનો ઝ્યાલ રાખશો. તે ઝ્યાલને પણ મહત્વ દેવાનું નથી. ધ્યાન વેળા જે કંઈ અનુભવો થાય તે તટસ્થપણે જોયા કરવા.

(‘જીવનપરગરણ’, આ.૨, પૃ. ૩૭, ૪૪, ૪૭)

\* \* \*

ધ્યાનમાં આપોઆપ સ્વાભાવિકપણે શ્યાસોચ્છ્વાસ ધીમા પડતા જશે ને અંતે તો તદ્દન શાંતપણે ચાલશે. તેમાં પ્રાણાયામના

નિયમો સ્વતઃ પળાયા જરો—જો ધ્યાન યોગ્યપણે કરાતું હશે  
તો. ને તદ્દન છેવટે તો શાસોચ્છ્વાસ તદ્દન લય પામ્યા જેવી  
સ્થિતિ થશે.

ધ્યાન વખતે ધ્યાન જ. પ્રાર્થના વખતે પ્રાર્થના. જે કરતા  
હોઈએ એના ભાવને જ પ્રધાનપણે વળગી રહેવું. ધ્યાનને  
છોડવાની ઈચ્છા ન થાય તો ચાલુ રાખવું. સમય પૂરો થયો માટે  
છોડી દેવું, તેમ ન કરવું.

ધ્યાનમાં જવાતાં જ્યે ઉપર ભાર રાખવાનો નથી, ચિત્તનું  
લક્ષ તો જ્યારે પૂરી લીનતા અનુભવાય ત્યારે અંદરની જે ચેતના  
છે એ અનુભવવામાં રાખવાનું છે. ધ્યાન પૂરું થયા પછી જે  
ઘૂમરી ને એકાગ્રતા જેવું રહે છે એનાથી જ્યે, ધારણાનો ભાવ  
ઉંડો હૃદયસ્થ ઉતારવો.

(‘જીવનપગરણ’, આ.૨, પૃ. ૫૨-૫૩-૫૪)

\* \* \*

ધ્યાન શરૂ કરતી વેળા જ્યેનો આશ્રય લઈ શકાય, પણ  
તેના પર જોક દીધા વિના; પછી તેનો પણ આગ્રહ ન હોય.  
ખરેખરી સર્જનાત્મક શક્તિનો અનુભવ પ્રત્યક્ષ કાર્યક્ષેત્રમાં ઊતરી  
સર્વાંગે અંતે ન અનુભવાય ત્યાં સુધી આપણે ધ્યાનની સાધના  
ચાલુ રાખવાની છે. ધ્યાન માત્ર શાંત બેસી રહેવા માટે નથી.  
મનને નીરવતામાં પ્રગટાવવા ધ્યાન મદદરૂપ છે,—એ તો જો કે  
તેનો તાત્કાલિક લાભ છે. તેમ થવાતાં મનથી પરનો અનુભવ  
શક્ય બને છે. ધ્યાન એટલે જ અંતરની ખોજ.

(‘જીવનપગરણ’, આ.૨, પૃ. ૬૪)

\* \* \*

હળવા ધ્યાનમાં મનની ચાલબાળાઓ જગાઈ શકે છે.  
ધ્યાનમાંથી શક્તિ, આનંદ, નૂતનતા સાંપડે છે તથા આપણાં

દાણિબંધુઓમાં તે ફેરફાર કરાવી આપે છે, આત્મવિશ્વાસ અને શ્રદ્ધાની વૃદ્ધિ કરે છે—આવા બધા આડકતરા લાભ પણ મળે છે. મૂળ હેતુ તો આત્માની ખોજ છે.

ધ્યાન સમયે આસનની ફેરબદ્ધલી ન કરવી. શરીર ઠીક ન હોય ત્યારે સૂતાં સૂતાં પણ થઈ શકે. સૂતાં સૂતાં પલાંઠી વાળીને પણ થાય. આ વેળા તંદ્રા કે નિદ્રામાં ન પડી જવાય તેની તકેદારી રાખવી જોઈશે. ધ્યાનનો સમય પણ બનતાં લગી અમુક મુકરરપણે રાખવો ને સ્થળ પણ. આસનની જરૂર ધ્યાનમાં શરૂમાં જ રહે છે. તેમાં તરબોળ થવાતાં અમુક ચોક્કસ આસનની જરૂર નથી રહેતી.

ધ્યાન વેળા બહારના અવાજો સંભળાય છે, તેનો અર્થ કે હજુ એકાગ્રતા જામી નથી. તેનો અર્થ એમ પણ નથી કે ધ્યાનમાં મૂઢ થવાનું કે રહેવાનું છે. સજ્ઞાન મૂઢપણું તો ઈદ્રિયોનું કેળવવાનું છે. મનની શૂન્યતા તો કમશઃ વધવી જ જોઈએ, ને મનનાં અંગ-ઉપાંગો પણ સાથે સાથે રસ લેતાં થવાં ઘટે.

ધ્યાન વેળા ભાવો જાગે તે ઠીક નહિ. ગમે તે તબક્કે અવ્યક્ત ને નિરાકાર ભાવ જાગે તે ઠીક. જે જે વિચારો આવે તેમાં રસ ન લેતાં, સાંકળ ન જોડી દેતાં, તેમને વહી જવા દેવા.

(‘જીવનપગરણ’, આ.૨, પૃ. ૬૪, ૬૮, ૭૦)

\*

\*

નક્કી કરેલો સમય પૂરો થયા પછી જ બનતાં લગી ધ્યાન છોડવું. વધુ મન થાય તો ભલે વધુ બેસવું, પણ વચ્ચેથી ઊઠી તો ન જ જવું; અપવાદ માઝ. કશુંયે યદ્વાતદ્વા કરવાનું ન હોય. તેમ જડ નિયમ પ્રમાણે પણ નહિ. ધ્યાનમાં સારા વિચારો આવે તે પણ તે વેળા માટે યોગ્ય નથી.

એકાગ્ર ધ્યાન વેળા મન, બુદ્ધિ, ચિત્ત બધું લય પામી જાય છે, ને એમનો સુમેળ જાગે છે. ધ્યાન વખતે લક્ષ ને ચિત્ત હદદ્યે

રાખવાં ઠીક. હૃદયે લક્ષ રાખીને ભૂમધ્યે ચિત્ત (ધારણા) રાખો અથવા તો નાકના ટેરવે. બન્નેમાં લક્ષ તો હૃદયે જ હોય, એનાથી વિચારો ઘટી જશે.

‘ધ્યાનમાં અમુક અમુક થાય તો જ સારું’ એવી લાગણી ન રાખવી. જે કંઈ થાય ત્યારે તેમાં મન ભળી ન જાય તેની ખબરદારી રાખવી ઘટે. લીન ને એકાગ્ર થવાતાં ઊંધું ઊંધું ઉત્તરતા જવું, ને જ્યાં સુધી ઘ્યાલ રહ્યાં કરે ત્યાં સુધી ભગવાનના ભાવનો ઘ્યાલ રાખવો; એ પણ ઊંડા જતાં તેને ઊડી જવા દેવો, ને તટસ્થપણે જોયાં કરવું.

(‘જીવનપગરણ’, આ.ર, પૃ. ૭૨, ૮૩, ૮૪, ૧૭૨)  
\* \* \*

ધ્યાન વેળા કે પછી હાથપગ આદિ શારીરિક અવયવોના અસ્તિત્વનો ઘ્યાલ જતો રહે છે, એનું કારણ એ કે બધા એકની એક સ્થિતિમાં રહેવાથી એમ બને છે.

જે ભાવનાને વધાર્યા કરવી હોય તે ભાવના પણ ધ્યાનથી વધી શકે છે. રોજ નવી નવી ભાવના રાખવાથી તેનો કંઈ ખાસ ફાયદો ન થાય. તેમ જ ભાવનાને નડતરરૂપ જે કંઈ હોય તેનું દિવ્ય રૂપાંતર કરવાને માટે પણ ધ્યાનનો ઉપયોગ થઈ શકે છે.

ધ્યાનમાં લીનતા હોય તે વેળા લક્ષ ખસી જતાં લીનતા ઘટી ન જતી હોય તોપણ લક્ષ તો હૃદયે જ હવે રખાયાં કરાય તે તમારા માટે ઉત્તમ છે. લીનતા વેળા ચેતનાની સ્થિતિ બદલાતી જતી હોય છે. ત્યારે તેવી તેવી પ્રત્યેક કક્ષામાં ભળી ન જવું, નહિતર વિકાસ અટકી જશે.

(‘જીવનપગરણ’, આ.ર, પૃ. ૮૫, ૧૨૬-૨૭)  
\* \* \*

ધ્યાનની એકાગ્રતા થતાં, પદ્ધી કોઈ વિચારનો હુમલો ત્યારે નહિ આવે. વિચારો આવતાં, તેઓ સપાઠી પરથી વહી જશે; બન્ને નસકોરામાંથી પવન સરખો આવતો જતો હશે એટલે કે શાસોચ્છ્વાસ સમ હશે. છાતીમાં ખેંચાણ પણ થાય છે. કેટલાકને કંઠમાં શોષ પડેછે ને જીભ સુકાય છે તો કેટલાકને મુખમાં અમીરસ પણ જરે છે. કોક વખત ધ્યાનના અંતે માથું કાં તો હળવું હળવું કે સ્ફૂર્તિજનક ભારે ભારે લાગે છે.

\* \* \*

લક્ષ એટલે એક પ્રકારની એકાગ્ર, કેંદ્રિત ને ધ્યેયલક્ષી ઉત્કટ સઘન સત્ત્વાનતા ને ચિત્ત એટલે એના ઉપર જ્ઞાનભક્તિયુક્ત ચેતના. લક્ષ એટલે ભાવ અને ચિત્ત એટલે એનાં પ્રાણ અને શક્તિ એવો અર્થ અહીં કરું છું.

બહિરૂમાં એકદિનિ રહી શકે તે માટે ભક્તિની જરૂર ને અંતરમાં તેમ થવાવા માટે ધ્યાનની જરૂર.

(‘જીવનપગથી’, આ.૩, પૃ. ૪૮, ૫૫, ૮૪)

\* \* \*

ધ્યાનમાં એક પ્રકારની ઉન્માદકારી લહરીઓ આવવી જોઈએ. એક પ્રકારની અલગપણાની શક્તિ તેમાંથી મળી આવવી જોઈએ, ને તેને દિવસના બીજા બ્યવહારમાં સક્રિય બનાવવી ઘટે.

ધ્યાનમાં વૃત્તિઓ અને આસક્તિઓનું બળ આપણને માલૂમ પડી આવે છે. કેટલીક વાર ધ્યાન વેળા સૂક્ષ્મ તત્ત્વો અથડાય છે. દા.ત., સૂક્ષ્મ કર્ણોન્દ્રિયને અસર કરી શકે એવાં નાદનાં સૂક્ષ્મ તત્ત્વો એને અથડાય છે. દિવ્ય સંગીત સંભળાય છે. આવા બધા વખતે જાગૃતિ રાખીને પોતાનું ધ્યેય જુદું છે એમ દઢ ખ્યાલ રાખવાનો છે. ‘નાદબ્રહ્મ’ સ્થિતિ કંઈ સર્વોપરી નથી.

(‘જીવનપગરણ’, આ.૨, પૃ. ૧૪૪-૪૫, ૧૮૪)

\* \* \*

ધ્યાનમાં નાડીના ધબકારા ઘટે છે તે સારું છે. તે ચેતનવાળી સ્થિતિ છે. ધ્યાનની સંપૂર્ણતામાં નાડીના ધબકારા શૂન્યની દશાએ પહોંચે છે. ધ્યાન પૂરું થયા પછી જો ધબકારા પઠ થયા, તો ધ્યાનની ખરી વેળાએ તો એનાથીએ ઓછા હોય છે. ધ્યાનની એકાગ્રતામાં હૃદયના ધબકારા ઓછા થતા જાય છે.

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૧૧૬, ૧૪૫)

\*

\*

ધ્યાનની એકાગ્રતામાં આંતરિક ચેતનાની સ્હૂર્તિ સતેજ થતી હોય છે.

ધ્યાનમાં તદાકાર થવાને માટે મન-હૃદય સર્વ પ્રકારે સરળતાવાળાં, નિશ્ચિતભાવવાળાં, નિર્દ્વિદ્બ ભાવવાળાં બની જવાં જોઈએ. આ બધા માટે રોજના કર્તવ્યવ્યવહારમાં મનાદિનાં વલણોને જ્ઞાનપૂર્વક કેળવવાં ઘટે.

\*

\*

### નામ-સ્મરણ

(હરિગીત)

પ્રિય-નામ-સૂર્ય ઉ઱્યા થકી ઝીટે જીવન-અંધાર સૌ,  
અનું કૃપાથી જીવનમાં અમને કૂલવજો ફળવજો;  
ચાનક અમોને લાગજો તુજ દિવ્ય જે પ્રિય નામની,  
પ્રગટી રહો અમ જીવન તે છાયા રૂપે તુજ પ્રેમની.

સંસારના કર્તવ્યમાં, વ્યવહારીઓની સાથમાં,  
સહુ કામમાં, ખાતાં, પીતાં, ઉઠતાં અને વળી બોલતાં;  
જે જે કંઈ કરતાં, બધાંની સાથ વર્તતાં સદા,  
તુજ નામનું પ્રિય સ્મરણ તે સાથી રહો મન-હૃદયમાં.

(‘શ્રીગંગાચરણો’, આ.૧, પૃ. ૨૭, ૩૧)

(માલિની)

પ્રિય સુરાણ મહીં જો પ્રેમ આહુલાદ જન્મે,  
સુરાણ પ્રિય ગણો તે ભાવનાવાળું હૈયે;  
સુરાણ સુરાણ ખાલી, ચેતના જો ન ત્યાં છે;  
પણ સુરાણ અખંડ કોઈનું ક્યાં રહે છે ?

સુરાણ સુરાણ માંહે કેંક ને કેંક ફેર,  
પ્રિય મહીં જ્યમ વાધે પ્રેમ, તે યાદ શ્રેષ્ઠ.  
સુરાણ મહીં ભીનાશ જો ન હો, તેય વ્યર્થ,  
સુરાણ મહીં ઉઠે જો પ્રેમનો ભાવ, સાર્થ.

(‘પુનિત-પ્રેમગાથા’, આ.૨, પૃ. ૧૦૭, ૧૩૫)  
(તોટક)

નવ જાપ કર્યે કંઈ કામ થશે,  
યદિ જાપ વિષે નવ ભાવ હશે;  
પ્રભુ-પ્રેમની છાલક ના ઉછળે  
—હદયે, તવ જાપ નિરર્થક છે.

(‘પુનિત-પ્રેમગાથા’, આ.૨, પૃ. ૧૮)  
(અનુષ્ટુપ)

ખાલી નામ લીધાથી કેં આપણું વળવાનું ના,  
ભાવવૃદ્ધિ થતાં જાણો ફળતું નામ ઉરમાં.

(‘જીવનપગલે’, આ.૧, પૃ. ૧૨)  
(ભુજંગી)

હરિ-નામને ચિત્તમાં તું મહી લૈ-  
હુદે શ્રેય ને પ્રેય બે સાધી લે ને;  
હંમેશાં પ્રભુ-આશ્રયે લીન રૈ'ને,  
સ્મર્યા વિશ તું ના ઘડી એક ખોજે.

હુદે	નામના	જપની	પ્રેમમાળા-
વહાવો	પદે	તે સદા	ગંગધારા;
શમાવી	પૂરાં	બુદ્ધિ ને	ઉરભાવ-
તહીં	હોમજો	પ્રાણની	વૃત્તિ સર્વ.
સ્મરંતાં	સ્મરંતાં	થવું	એક ધ્યાન,
સ્મરંતાં	સ્મરંતાં	થવું	એક ધ્યાન;
સ્મરંતાં	સ્મરંતાં	થવું	હેળમેળ,
સ્મરંતાં	સ્મરંતાં	થવું	એકમેળ.

\* \* \*

### તુજને નમું હું (વસંતતિલકા)

સૂછિની આઘ, પ્રભુ ! મધ્ય જ, અંતમાં તું,  
સર્વે વિભૂતિ તણું તત્ત્વ છૂપું પ્રભુ ! તું;  
સૂર્યો અનેક તણું તેજ પવિત્ર છે તું;  
એવા પ્રભુ ! હદ્યથી તુજને નમું હું.  
ગોપાલ છે જગત-ધર્મ બધા તણો તું,  
સૌ વિશ્વમાંથી પ્રભુ ! અક્ષરધામ છે તું,  
તું આઘ દેવ જ પુરુષ પુરાણ છે તું,  
એવા પ્રભુ ! હદ્યથી તુજને નમું હું.

('તુજચરણે', આ. ૧૫, પૃ. ૨૫, ૨૮)

\* \* \*

### સ્મરણ-સાથી (હરિગીત)

મનના વિચારોમાં અને મનની બધીયે વૃત્તિમાં,  
મન-વાસનામાં, પાપમાં, ચિત્તના બધા સંસ્કારમાં;

મનની રમત ને ગમતમાં મનનાં રમણ ને વલણમાં,  
તુજ નામનું પ્રિય સ્મરણ તે સાથી રહો મન-હૃદયમાં.

ખટ રસ તણા સહુ સ્વાદમાં, મીઠી મીઠી બધી વાસમાં,  
ઉર ચેતનામાં, બુદ્ધિમાં, ચિત્ત-પ્રેરણ મહીં, પ્રાણમાં,  
અમ લાગણીમાં, ભાવનામાં, પ્રેમમાં, રસમાં બધા,  
તુજ નામનું પ્રિય સ્મરણ તે સાથી રહો મન-હૃદયમાં.

અમ શરીરથી બનતી કિયામાં, ઈન્દ્રિયોના વિષયમાં,  
અમ શરીર કેરા રોમરોમે, હૃદય કેરા લોહીમાં;  
રગ રગ મહીં, નખશિખ મહીં, ને શરીરના નવ દ્વારમાં,  
તુજ નામનું પ્રિય સ્મરણ તે સાથી રહો મન-હૃદયમાં.

જીવન તણા સહુ ભંગમાં, જીવન તણા સહુ રંગમાં,  
જીવન તણા એ અટપટા આડા ઊભા સહુ તારમાં,  
મારી ગમે તેવી ભલે હો સર્વ જીવન-ભાતમાં,  
રસીલું વણાયાં ત્યાં કરો પ્રિય નામ તારું ભાવમાં.

સારાય જીવન-પટ તણા તાણા અને વાણા વિષે,  
ભીજાયલા હોય રગરગે તુજ પ્રેમથી રંગાયલા,  
તુજ નામના પ્રિય સ્મરણના ઠોકે સદા ઠોકાયલા,  
એવું પ્રભુ-પદ હો સમર્પિત આ જીવન, હો તવ કૂપા.

(‘શ્રીગંગાચરણે’, આ.૧, પૃ. ૩૦, ૩૧, ૩૨)

\* \* \*

### નિરાશા, વિષાદ, સાધનાપથે

જે જીવને હૃદયમાં હૃદયથી સાચી ભાવના પ્રગટેછે, તેનામાં  
ક્યાંયે નિરાશાને સ્થાન નથી. જેને નિરાશા વ્યાપે છે, તેણે જરૂર

જાણવું કે એનામાં ક્યાંક તેના તેવા પ્રયત્નની પાછળ કંઈ કશી ભાગણી, વાંછના કે વાસના રહેલી હોવી જોઈએ. આપણો પ્રભુ ઉપર કશો હક્કદાવો નથી કરી શકતાં કે આટલું આટલું આમ કર્યું છતાં કેમ આમ ન બન્યું? આપણો ધર્મ કર્યા કરવાનો છે. એ આપણને ક્યારે ગ્રહણ કરીને સ્વીકારી લે તે કામ તેનું છે.

\*

\*

નિરાશા ભલે આવી; પરંતુ જે સાધક માથે હાથ દઈને ત્યારે બેસી રહે છે, તેને ક્યાંયે ઊગરવા વારો નથી. ખરો સાધક તો જેનો તેનો યોગ્ય ઉકેલ કાઢવાને મથ્યાં કરવાનો. જ્યારે નિરાશા, હાર, વિષાદ, આદિની પકડમાં પડી જવાનું બને ત્યારે હૃદયમાં વધુ ને વધુ શાંત બનીને દફ્તાથી સ્વસ્થતા ધારણ કરવી. આવી વેળાએ અકળાઈ જવાથી ઊલટું મન વધુ ખરાબ બને છે. એવી વેળા પ્રભુની મદદ માટે પ્રાર્થના કર્યા કરવી.

('જવનસોપાન', આ.ગ, પૃ. ૩૦૭-૦૮)

\*

\*

વैજ્ઞાનિક કોઈક તત્ત્વની શોધ કરવાને મથે છે તો તેને સેંકડો વાર નિરાશ થવું પડે છે; તેમ છતાં તે ધીરજ, હિંમત, સાહસ ગુમાવતો નથી; અને ફરી-ફરીને તેના તે જ વિષયનું મનન, ચિંતિન કરીને નવા નવા પ્રયોગ કરે છે અને મળેલી નિરાશામાંથી તે નવી સમજણ ને નવું જ્ઞાન મેળવ્યાં કરે છે. તો આપણો તો પરમ તત્ત્વને મેળવવા નીકળ્યાં છીએ. શ્રીભગવાનને અનુભવવાને સાધના આદરી છે તો સેંકડો વાર શું, હજારો ને લાખો વાર નિરાશા ને હાર ભલેને મળે? પરંતુ સાધક તેવી નિરાશાથી-હારથી નિરાશામાં ડૂબી જઈ શકતો નથી. તે તો ફરી-ફરીને અંતઃકરણમાં ડૂબકી મારે છે અને ત્યાં પૂરું સંશોધન કરે છે. નિરાશા એ તો આગળ ધપવા માટે ઉત્તમ તક છે. જેનું ધ્યેય

જીવનવિકાસ કાજેનું છે એવાને તો હજારો ને લાખો નિરાશાઓ  
વચ્ચે આશા જ પ્રવતર્યી કરવાની. સાધકની આશા તો અમર,  
જોરદાર, પ્રાણવંત ને ચેતનવંત હોવી ઘટે. એ તો જેમાં તેમાંથી  
આશાના તંતુ જ વણ્યા કરતો હશે. આશાના જોર પર તો એનું  
નાવ આગળ ધૂપી રહ્યું હોય છે.

(‘જીવનદર્શન’, આ.૨, પૃ. ૫૬)

\* \* \*

### નિરાશા-હાર

(અનુષ્ઠાપ)

માનવીને નિરાશા તો બનાવી દે હતાશ; ને  
ભગ્ન એવાં થતાં હૈયાં ત્યાંથી જ કાંતિ ઉદ્ભબવે.

(‘જીવનપગલે’, આ.૩, પૃ. ૫૩)

હારમાંયે હુદે હાથ નિહાળે પ્રેમનો જ જે,  
તેને હાર નથી કયાંયે જ્યાંત્યાં તે પ્રેમને જુએ.

સર્વ પરિસ્થિતિમાં જે પ્રેમને નિરખ્યાં કરે,  
શબ્દનાં ખાલી ખોખાં છે ‘હાર’ ને ‘જત’ એહને.

(માલિની)

અવિરત રહી મંડ્યા કામ પોતાનું જ લે,  
કદીય પણ નિરાશા એહને ના રહે છે;

થતું સહુ કંઈ તેથી પ્રાણ તે મેળવે છે,  
સ્મરણ કરી-કરીને પ્રાણ જે

સમજાણ નવી એને ઉરમાં જન્મતી રે’.

(‘પુનિત પ્રેમગાથા’, આ.૨, પૃ. ૧૦૭)

(શિખરિણી-મંદાકાન્તા)

બધી બાજુએ જ્યાં નિજ જીવનને ઘોર અંધાર ધેરે,  
વિનાશે ધેરાયું જીવન નીરખી વજ-આધાત થાયે;  
અને એનાથીયે પણ વિષમ કો જ્યાં નિરાશા ભલે હો,  
પરંતુ ત્યાંયે શી પરમ વિલસે ગૂઢ એની કૃપા તો.

મહા જંજાવાતો બહુ પવનના સૂસવાટા થતા હો,  
મહા અભિન કેરો પ્રલય જીવને ઉદ્ભવેલો જ કેં હો;  
કૃપા-શક્તિને તો તહીં અનુભવી જે શકે છે પ્રભુની,  
ધે છે એવા કો પરમ વિરલા જાતને શી અનેરી !

(‘જીવનપગલે’, આ.૩, પૃ. ૪૧)

(ગઝલ)

કર્યા કરતો રહે છે જે ન તેને પ્રશ્ન જાગે કે  
—બને તે આજ કે કાલ, કર્યા કરવે જ મશગૂલછે.

(‘પ્રણામ-પ્રલાપ’, આ.૨, પૃ. ૧૧૫)

(ભુજંગી)

ટીપેથી ટીપેથી તળાવે ભરાતું,  
ઉદાસીન તારે પછી શું થવાનું ?  
ભલેને કપાયો હશે પંથ થોડો,  
ઇતાં વેગ એમાંથી છે જન્મવાનો.

\*

\*

### પત્રવ્યવહાર, સાધનરૂપે

મારે હિસાબે તો પત્રલેખન હદ્યના જોડાણ માટેનું એક  
સાધન છે. પ્રેમની સાધનાનું એક અંગ છે; પ્રિયના સ્મરણના ઉઠાવ

માટેની એક ઉત્તમ તક છે. દિલ દરિયાવ ભાવ જગાડીને એમાં પરોવાવા માટે, એકાગ્ર થવા માટે ને દિલના દરિયામાં જો એની કુપા હોય તો કોઈ મહેરામજા જાગે, ને પ્રેમની યાદથી કંઈ એને હલાવવું હોય તો હલાવે એવું એવું પત્રલેખનમાં સમાયલું છે.

મને પત્ર લખતી વખતે આપણે જાણે પાસે હોઈએ, આપણી ચેતના જાગ્રતપણે ત્યારે આપણામાં જ સમાયેલી રહે, એવું થઈને લખવું. ત્યારે એકાગ્ર બનીને, ભાવવાળા બની જઈએ તો આપણે શરીરે પાસે હોતાં પણ જે ન કરી શકીએ, તે ત્યારે થઈ શકવાનો વધુ સંભવ છે. પાસે હોઈએ છીએ ત્યારે—‘અહીંયાં જ છે ને !’ એવી સંતોષાઈ જવાની લાગણીને લીધે ભાવનામાં વેગ ને જોશ નથી હોતાં, દૂરની ભાવનામાં સાધારણતઃ પ્રેમ ને ભાવનાનો ઊણો વધારે રહ્યાં કરે છે. (‘જવનપગથી’, આ.૩, પૃ. ૮૬)

\*

\*

કોઈને પણ કાગળ લખો તેને સાધનાનું અંગ ગણજો. આપણા હૃદયના પ્રેમભાવને વધારે વેગ આપવાને માટે આપણા પ્રેમીની સાકાર ચેતના અથવા વધારે સારું તો ભાવાત્મક ચેતના આપણી સામે સાધન તરીકે આપણે આણવાની છે. એનું ઉત્કટપણું વધતાં જતાં પ્રેમીને આપોઆપ પ્રત્યક્ષ કરાવશે. સ્થળ અને કાળ કયાંયે દૂર થઈ જશે, ને માત્ર ભાવ પ્રવર્તશે. પત્રવ્યવહાર એ પણ ભાવનાને પ્રગટાવવા ને તેજસ્વિત કરવા માટે છે.

(‘જવનપગથી’, આ.૩, પૃ. ૮૭)

\*

\*

પત્રલેખન જો ચેતના-સાંકળથી સંકળાયેલા રહીને લખતી વખતે લક્ષ્યમાં ભાવમૂર્તિને હૃદય સમક્ષ રાખ્યાં કરીને લખવાનું રાખીએ તો દિલમાં ભાવ રહ્યા કરશે ને તે અનુભવે સમજાશે.

પત્રવ્યવહાર જીવનવિકાસના માર્ગમાં પ્રેરક અને મદદકર્તા છે.  
(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૫૧)

\* \* \*

### પરિસ્થિતિ-પ્રસંગો

જે જે પરિસ્થિતિ મળતી રહે છે, તે તે માનવીના અભ્યુદય કાજે પૂરેપૂરી શક્યતાથી ભરપૂર હોય છે; કશાથી ભાગી છૂટવાની જરૂર નથી. પરિસ્થિતિ અને પ્રસંગો તો અનેક પ્રકારના આવશે અને જીશે, પરંતુ એમાં આપણે કેવાં રહીએ છીએ ને કેવી રીતે જીવીએ છીએ, એના પર આપણા જીવનવિકાસનો આધાર રહેલો છે.

\* \* \*

જે જે પરિસ્થિતિ આપણને મળે છે કે પ્રસંગો સાંપડે છે તે બધા જ કોઈ નવી સમજણ ઉગાડવા માટે મળે છે અથવા મળેલી સમજણને દઢ કરવા માટે મળે છે; એટલે તેવી વેળાનાં મૂલ્યાંકનો આપણને રચનાત્મક મદદ કરે એવા વળાંક પ્રમાણે કરીએ ને તેમનો તે પ્રકારે ઉપયોગ કરીએ, એમાં આપણી યોગકુશળતા રહેલી છે. (‘જીવનપગથી’, આ.૩, પૃ. ૧૮૭)

\* \* \*

હરેક જાતની પરિસ્થિતિ અને પ્રસંગ આપણને આત્માની તેજસ્વિતાનો અનુભવ થવા માટેની એક તક છે. તેવી પરિસ્થિતિ તો પ્રભુની ઝૂપાલીલાછે, એવા ભાવે જ્ઞાનભક્તિપૂર્વક પોતાના જ કલ્યાણાર્થે તેનો સ્વીકાર કરવાનો છે. કશું જ નકામું નથી.

પ્રસંગો સિવાય જીવનમાં બીજા શેનાથી આપણે ઘડાઈ શકાવાનાં છીએ ? તેથી પ્રસંગોમાં તો ગુરુ બિરાજેલા છે, એવી સજીવ ભાવના જે જીવ રાખે છે તે પ્રસંગોથી આવરાઈ જતો નથી,

લેવાઈ જતો પણ નથી, તો પછી સંતાપ તો પામી જ કેમ શકે ?  
પ્રસંગો તો પ્રત્યક્ષ ઘડનારા છે. પ્રસંગો સારાયે હોય ને નરસાયે  
હોય, પરંતુ આપણે તો તે બન્નેમાં પ્રભુભાવના જ દ્વારાવવાની  
હોય. (‘જીવનસોપાન’, આ.ડ, પૃ. ૨૩૧)

\*

\*

પરિસ્થિતિમાં ભળી જવું, ગળી જવું, ને પાછું તેને તાબે  
થઈને જીવવું—એવો લોકોના જીવનનો દેખીતો કમ છે. સાધકને  
એવું જીવન જીવે પાલવી ન શકે. તેણે તો સર્વ કોઈ પ્રસંગોમાંથી  
નોખા તરી રહીને તેમાંથી વિકાસક પ્રેરણા પામીને આગળ ને  
આગળ ધયે જવાનું રહે છે. તેનો જીવન પરત્વેનો આશાવાદ  
શક્તિપ્રેરક બની રહેવો જોઈશે.

\*

\*

### પૂજા-અર્ચન-આચાર

(અનુષ્ટુપ)

પૂજા, અર્ચન, સેવા સૌ, પ્રભુ મેળવવા હદે;  
યદિ તેવું થતું ના હો, ભૂલા ક્યાંક પડેલ તો.

પૂજા, આદર જે આપો, મહત્વ એનું કાંઈ ના,  
કિંતુ એનાથી શો પામો લાભ, એ જ મહત્વ ત્યાં.

વિધિ કે માન્યતાઓમાં રહેવું જકડાઈ ના,  
ભાવ-પ્રાગટ્ય અર્થે સૌ તે તે છે ખપનું ભલા !

મને મહત્વ ના આપો આખ્યાં તે સત્યને કરો,  
સર્વશ્રેષ્ઠ ગણી ભાવ એને યોગ્ય મહત્વ દો.

વ्यक्ति, પરंપરाथી સૌ સત્ય મહત्वનું ધણું,  
સત્યને જળવી રાખી તેવા ભાવેથી જીવવું.

વર્તને હેતુનું જ્ઞાન આપણું જેવું રે' હુદે,  
વિકાસ તેટલો થાય જીવને સર્વ નિશ્ચયે.

ધર્મ-આત્મા પુરાયેલો આચાર-પિંજરા વિષે,  
આચાર-કોટલા બહાર થૈને તત્ત્વ જગાડજો.

સૌ આચાર કરેલા તે શક્તિને પ્રગટાવવા,  
કિંતુ આચારમાંથી સૌ ધર્મ-પ્રાણ જતા રહ્યા.

આચાર મડદાં જેવા આજે તો પ્રચલિત છે,  
એને જે ગ્રહી રાખે છે મેળવી પ્રાણ ના શકે.

કિંતુ આચારને જેઓ ભાવ-જ્ઞાન હુદે થવા,  
સ્વીકારે છે પ્રભુ કાજે જન્મે તે થકી ચેતના.

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૩, ૮૩, ૮૪, ૮૬, ૯૫)

\*

\*

## પુરુષાર્થ અને કૃપા

પુરુષાર્થ ને કૃપાના જગડા કે ચર્ચા નકામાં છે. પુરુષાર્થ પણ છે ને કૃપા પણ છે. એકલી કૃપા પર ઓક રાખનારનાં લક્ષણો હોય છે. તેનામાં શરણાગતિ, પ્રેમભક્તિ, અપાર શ્રદ્ધા આદિ જીવંત સક્રિય બની ગયેલાં હોય. એવાનું જીવન તો નર્યા પરાક્રમથી ભરપૂર હોય. તેવો મથે છે ભલેને કૃપાના બળ ઉપર, પણ તેય જરૂમતો તો હોય છે જ. કૃપા પામવાને જે આવશ્યક શરતો પૂરી પાડવાની રહે છે, તે સ્થિતિ મેળવવા માટે પણ પુરુષાર્થ તો કરવો જ પડતો હોય છે. કૃપામાં માનનાર જીવની

અહેતા પ્રતિદિન નિર્મળ થતી જાય; પોતાના કર્યા કારવ્યામાં રાચે નહિ, જેમાં ને તેમાં પ્રભુને જ જુએ ને વિચારે. આમ એનાં પણ માપ-લક્ષણો હોય છે.

પુરુષાર્થ કરનાર જીવ જો હૃદયની સાચી નેક દાનતથી પ્રેમભક્તિભાવે સાધના કરતો હશે તો તેવાનું અભિમાન, અહેતા જરૂર ગળતાં જવાનાં છે. પુરુષાર્થ પણ શાને કાજે છે? મનાદિ કરણો શ્રીહરિની ભાવનામાં મળી જઈને તેમાં ગળી જાય ને એ એનું યંત્ર બની જાય તેવા હેતુથી તો તે સાધનમાં પ્રેરાયો છે. જે સાચો સાધક છે, તેને તેનું અભિમાન વધતું જતું હશે તો શું એની એને ખબર નહિ પડે? ને ખબર પડશે તો શું તે અભિમાન પોષ્યાં કરશે? સાધક જેમ જેમ સાધનામાં આગળ વધતો જાય છે તેમ તેમ તેના વિવેકની આકલન-શક્તિમાં પણ સૂક્ષ્મતા પ્રગટતી જતી હોય છે. સાધનામાં આગળ જતાં જો સૂક્ષ્મતા નિભન્ન પ્રકૃતિના હુમલાઓમાં પ્રગટે છે, તો સૂક્ષ્મતા તેના ઊર્ધ્વપણામાં—કરણોમાં પણ—પ્રગટતી જતી હોય છે; તેથી શરૂઆતનો સાધક જેમ પોતાના અભિમાનને કદી પોષશે નહિ તેમ આગળ જતાં તે જ સાધક એવા સૂક્ષ્મતમ હુમલાઓ થતાં પ્રગટેલ વિવેકશક્તિની સહાયે તેમને નિવારવાને તે પ્રભુકૃપાથી મથ્યા કરશે, તે પણ અનુભવની હકીકત છે.

કૃપાને અવલંબન તરીકે જે જીવ હૃદયમાં હૃદયથી માન્યા કરતો હોય તેવો જીવ ખાલી શું પડ્યો જ રહેતો હોય છે? ખાલી મોઢેથી બોલવું તે એક વાત છે ને માનવું તે બીજી વાત છે. વળી માનવું ને તે પ્રમાણે અમલમાં મૂકીને તે પ્રમાણે અનુભવમાં પ્રમાણવું તે તો વળી ઓર જુદી હકીકત છે.

(‘જીવનસોપાન’, આ.૩, પૃ. ૨૭૧-૨૭૩)

\*

\*

હદ્યથી કૃપામાં માનનાર જીવ કદી પણ જીવનમાં આળોટ્યાં નહિ કરે. તે તેનાં માનસિક વલણોમાં તણાયે નહિ જતો હોય. તે તો જેમાં ને તેમાં કૃપાને પોકારે છે. કૃપાનું જ્ઞાનભાન રાખે છે. કૃપાના અવલંબનમાં માનનાર જીવ જો એમ માનતો હોય કે તેણે કંઈ કશું કરવાનું નથી, કૃપાને યોગ્ય પણ રહેવાનું નથી, તો તેવાનું માનેલું અવલંબન સાચું નથી તે નક્કી જાણવું.

કૃપાના આધાર પર જે જીવ પુરુષાર્થ કરે છે, તેને અભિમાન જાગવાનો કશો ઊર નથી હોઈ શકતો. ‘પુરુષાર્થ’ ને ‘કૃપા’ એકબીજામાં સંકળાયેલાં જ છે. કૃપામાં પુરુષાર્થ છે, પુરુષાર્થમાં કૃપા છે. (‘જીવનસોપાન’, આ.ડ, પૃ. ૨૮૨-૨૮૪)

\* \* \*

શરૂઆતના સાધક કાજે પ્રથમ પ્રયંડ પુરુષાર્થની જરૂર રહે છે. પુરુષાર્થ થતો રહે ને તે કૃપાની પ્રાર્થના પણ કરતો રહે; કૃપાની મદદ હદ્યથી યાચ્યાં કરે તે પણ મહત્વાનું છે. પરંતુ એવો શરૂઆતનો સાધક—ને તે પણ ઠીક ઠીક લાંબા સમય સુધી— માત્ર કૃપાના અવલંબન પર જ રહી શકે એવું એનામાં પરિબળ જાગેલું હોતું નથી. તેથી એણે જાતે કૃપાના બળને પોતામાં નોતરી-નોતરી, પ્રગટાવી-પ્રગટાવીને, પોતાથી બનતો બધો પુરુષાર્થ કરવામાં ડાપણ અને વિવેક રહેલાં છે.

(‘જીવનમંથન’, આ.ડ, પૃ. ૨૮૫)

\* \* \*

પોતાનાં ખંત ને ધગશના પુરુષાર્થની સાથે સદ્ગુરુના આશીર્વાદ ને તેની કૃપા જરૂરનાં છે, તેની ના નથી; પરંતુ પોતે પણ કંઈ પણ કર્યા-કારવ્યા વિના એની કૃપા પર જ આધાર રાખવાનું કરશે તો તેવી કૃપા મળવી શક્ય નથી. સર્વ કરણોનું પ્રેમભક્તિજ્ઞાનપૂર્વકનું શરણ પામવાનું બન્યાં પછી જ સાધના

સહજસાધનાની પ્રક્રિયામાં ફેરવાઈ શકે છે.

સ્વતંત્રપણે કૃપાનાં પ્રત્યક્ષ અસ્તિત્વ અને વાસ્તવિકતા છે. કૃપાને કોઈ પ્રકારનાં ચોકદાં કે બંધન નથી હોતાં, કે કોઈ પ્રકારની શરતોથી તે બંધાયેલી નથી હોતી; પરંતુ આ હકીકતને શરૂશરૂના સાધકે જરા પણ મહત્વ આપવાનું નથી. પ્રભુકૃપાથી પોતાના સત્ત્વપ્રયત્નમાં જ અખંડ જીવતોજાગતો ઝોક તે આખ્યા કરે, તે તેને કાજે શ્રેયસ્કર છે.

\*

\*

ગુરુકૃપા જેવું કંઈક હશે તો સાધકનો પ્રામાણિક સત્ત્વપ્રયત્ન તેને તાણી લાવશે જ. વળી સાચી રીતે સાધક કે શિષ્ય સર્વ રીતે અને સર્વ ભાવે ગુરુકૃપા પર આધાર રાખી શકતો પણ હોતો નથી. તે તો તેની ખાલી ભ્રમણા પણ હોય.

ગુરુની કૃપા એ તો સાધકથી થતા જતા પુરુષાર્થની ભાવનામાંથી ફલિત થતો ભાવ છે. અથવા બહુ બહુ તો તે બન્ને ભાવના એકરૂપે પરસ્પર સંકળાયેલી છે.

જે અપેક્ષા રાખીએ કે હોય તેને યોગ્ય હકીકતપણે ભૂમિકા હોય તો જ તેવી અપેક્ષા પરિણામ પામી શકે.

ગુરુકૃપા તો હોય કે ન પણ હોય, પણ આપણો તો આપણું જે સ્પષ્ટ ધ્રુવ હોય એને જ સંપૂર્ણપણે હૃદયની ભાવનાથી મજબૂત પકડી રાખવાનું છે.

(‘જીવનસંદેશ’, આ.૪, પૃ. ૩૪-૩૫-૩૬)

\*

\*

પુરુષાર્થ

(અનુષ્ટુપ)

જણાતું હોય ક્યાંયે ના આશા-કિરણ એકયે,  
છતાંયે ત્યાં પુરુષાર્થ છોડી દેવો ન યોગ્ય તે.

૪૦૧ □ જીવનપરાગ

કર્મની પાકવા ક્યારે મર્યાદા આવી ઘોંચતી,  
જાણ એની પડે છે ના, ચીટકી રે'વું યોગ્ય ત્યાં.

કેવો બેડૂત તાપે ને વર્ષામાં તે તપી ભોঁજુ  
—તપશ્ચયાર્થ કરી અંતે મેળવે રૂડી ધાન્યશ્રી.

પાર જે પાડવા ધાર્યું તે કેં એમનું એમ તે,  
સહેલાઈ થકી પ્રાપ્ત થતું ના કદી કોઈને.

માર્ગમાં ઠોકરો જે જે મળો, એને સ્વીકારતાં,  
સત્કારે પ્રેમભાવે તો જન્મશે ભાવ કર્મમાં.

જેઓ જેઓ કશું પામ્યાં તેમને સર્વને જગે,  
કેં કેં નડ્યાં કરેલું છે, હઠતાં ના, મળ્યું ખરે.  
ખાલી ખાલી નથી આ સૌ વાતો બુદ્ધિ તણી ખરે,  
એમાં તો ખેલવાના છે મહા કેં જંગ જીવને.

બેસી રે'વાથી શી રીતે કાંઈ પાલવશે કશું ?  
'સૂતેલા સિંહને મોઢે ભક્ષ્ય પોતે નહીં પડે.'

વહેતી શી થઈ ગંગા જ્યારે ફોડ્યા પહાડ કેં,  
વિઘ્નો હઠાવવા પોતે ત્વરાથી શી તદા ધસે !

લીધેલું પાડવા પાર જેની ખંત અપાર રહે,  
એક દી જીતવાનો તે નિશ્ચયે જાણજો ખરે.

ભલેને આજ ના થાય કાલે તે બનવાનું છે,  
રહીને નિશ્ચયે એવા જીવને મંડવું ઘટે.

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૫, ૭૭, ૮૧, ૧૮૧)

## આરામે ના મળે રામ

(અનુષ્ટુપ)

‘પ્રેમ-પ્રવાસી’ના હૈયે આરામ-શાંતિ જે વસે,  
શક્તિમાન બધી રીતે સર્જવા તે નવું હદે.

(‘પુનિત પ્રેમગાથા’, આ.૨, પૃ. ૭૮)

આરામ આળસુ કેરો તામસે મૃત્યુથી ભર્યો,  
એવો આરામ સર્જ શું મોહનિદ્રાથી જે ભર્યો ?

(‘જીવનસોપાન’, આ.૧, પૃ. ૪૪)

એવા આરામને વાંછે લૂલો આદર્શને કરે,  
જેઓ

આરામે ના મળે રામ તેવા નિર્માલ્ય તો બને.  
ગયેલું હો સડી અન્ન

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૬૩)

પુરુષાર્થ તણા અંતે શાંતિ-આરામ જે મળે,  
ભૌગવી નાખશે તે જો, તેવા સર્જ ન કું શકે.

(‘પુનિત પ્રેમગાથા’, આ.૨, પૃ. ૭૮)

જિંદગી-ધ્યેયને કાજે જે અસંતોષ જાગ્રિયો  
જાગશે,

કુમેયે જંપવા તે તો માનવીને ન હે કશે.

આવો જે હો અસંતોષ જાણો ઉદ્ઘિનતા નહીં,  
આવો જે હો અસંતોષ જાણો આરામને નહીં.

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૬૩)

\*

\*

## પ્રકૃતિની ચાલબાળ, છૂપા વેશો

(અનુષ્ટુપ)

પ્રકૃતિ પ્રકૃતિ જાણો એમાં ના ભેળવો બીજું,  
એમાં ભેળાવ્યું જો કે તો ભેળવાયાં જશો ખરું.

કાગને કાગડો જાણો, શાનને શાન જાણવો;  
શંભુમેળો કરો ત્યાં ના, જુદા ભાગ ગણ્યાં કરો.

‘પ્રકૃતિ કેવી પોતાની’ જાણ્યાં શુદ્ધ રીતે કરો,  
ભેળાવીને પ્રભુને ત્યાં આપદા ના ઊભી કરો.

પ્રકૃતિથી થતાં કામો ને એનું જોશ કેટલું,  
જાણવું જોઈશે પૂરું; તે વિના ચાલશે નહીં.

‘પ્રકૃતિમાં ભણેલી છે ચૈતન્યશક્તિ ઈશની,  
સંકળાયેલ રે’વાનું જીવને ઈશ-ભાવથી.’

પ્રકૃતિના પ્રવાહો સૌ અંતરેથી ફગાવવા  
—આવડી છે કળા જેને, તે એવો ભેદ પામતા.

બુદ્ધિની કલ્યના રમ્ય દોડાવ્યે વળશે ન કેં,  
ઓળખી પ્રકૃતિ-રૂપ શક્તિ દાખવવી હદે.

અંતરેથી ફગાવાનું પ્રકૃતિના પ્રવાહને  
—કરી તે જ શકે, જેને શક્તિ પેદા થયેલ છે.

તરંગોની પ્રમાણે તો વર્તવું છોડવું પડે,  
હેતુના ભાન ને જ્ઞાન રીતે ત્યાં વર્તવું પડે.

અંતરે સૂક્ષ્મનું જોશ પ્રકૃતિની પરે ખરું.  
—લાગવા માંડતું ત્યારે તે અનુભવ ગ્રીછશું.

ગમે તેવી ભલેને હો આપણામાંની પ્રકૃતિ,  
પ્રકૃતિ પ્રકૃતિ રૂપે હૈયે પારખવી રહી.

સેળભેળ કરો ના તે ઈશના ભાવ સાથ કેં,  
બુદ્ધિથી સમજો કે તે પ્રકૃતિ ગ્રાણવાન છે.

રહેલું ચેતનાતત્ત્વ પ્રકૃતિ માંહીનું બધું,  
ભલે તે ચેતનાતત્ત્વ ઈશના મૂળનું સહુ;

પાણી ડો'ળાયલું જો હોવા પાણી છતાં કદી  
-પીવાનું કોઈ ના રાખે, પીવાને પથ્ય તે નથી.

પ્રકૃતિ પ્રકૃતિથી તે જિતાશે એમ માનીને,  
પોતાની જાતને એવું ધો ના ભોળાવવા કશે.

પ્રકૃતિમાં ભળેલું છે કેંક છો ઈશનું ભલે,  
બન્યું તે પ્રકૃતિરૂપ ચેતના-પ્રકૃતિ રૂપે.

કેંક પ્રકૃતિનું એવું, શુદ્ધ તત્ત્વ ન ઈશનું,  
રખે પડો ભુલાવામાં એને પ્રકૃતિમાં ગાણી.

દૂધમાંથી બને છાશ, છાશ તેથી ન દૂધ છે,  
પડી જતા રખે એથી ગોટાળામાં કદી હદે.

જાડમાં જાડરૂપે તે પાણીમાં પાણીરૂપ તે,  
પૃથ્વીમાં પૃથ્વીરૂપે તે તેમ તે પ્રકૃતિરૂપે.

પહેલાં તો પ્રકૃતિમાંથી છૂટકારો થવો ધટે,  
ભાન એનું પૂરેપૂરું હૈયાથી લાવવું ધટે.

અને સૌ કર્મમાં ભાવ પ્રભુના ભાવનો ધરી,  
થવા રૂપાંતરે પૂરું મંજ્યા તો કરવું ચહી.

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૭૮ થી ૮૦)

\*

\*

## પ્રકૃતિજ્ઞન્ય પ્રવાહો

(અનુષ્ઠાપ)

પ્રવાહો પ્રકૃતિજ્ઞન્ય નકારાત્મક હો ભલે,  
કિંતુ એમાંથી તો જ્ઞાન મળ્યાં આપણાને કરે.

બોધ લેવા મળ્યાં છે સૌ ભૂમિકારૂપ વિશ્વ તે,  
કર્મથી જે અતિરિક્ત ચેતના, પ્રીધજો હદે.

ગુણ-પ્રભાવથી કર્મ જે તે કોઈ પ્રવેશતું,  
પ્રકાર ગુણનો જાણી ગુણનું ભાન રાખવું;

ગુણનું ભાન ના ચાલે, ઈશની ધારણા હદે,  
આરપાર બધાં કર્મ જીવતી રાખવી ધટે.

આપણામાં રહેલી છે પ્રકૃતિ ત્રિગુણાત્મક,  
પોતાના તે સ્વભાવેથી વર્તાવ્યાં કરશે જગા.

ઈશની ચેતનાશક્તિ પ્રકૃતિમાં શી ગૂઢ રહે,  
યંત્ર પેઠે ચલાવે છે વિશ્વને મૂઢતાથી તે;

પોતાના ઉરમાં કિંતુ ચેતનાવંત જે રહે,  
વિવેક-શક્તિથી હૈયે જાગેલો તે રહ્યાં કરે.

સર્વ પ્રવૃત્તિમાં એ તો તાંત્રે ધારણા તણા,  
એકધારું પરોવાઈ રહેવાનું ચૂકે ન ત્યાં.

ઇષ્ટની ધારણા સૌમાં સારા કે નરતા વિષે,  
એવો અભ્યાસ ભાવેથી રાખવો પડશે બધે.

પ્રકૃતિજન્ય પોતામાં પ્રવાહો જે ઊંઠાં કરે,  
ધસડાઈ ગયા વિના સંયમે સમતા ધરે;  
પ્રવાહોની ગતિ ક્યાં તે પ્રેરાવે છે લઈ જવા,  
સર્જનો ને સમગ્રે તે, જોવાનું રાખવું સદા.

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૧૪૮)

\* \* \*

### માનવ-પ્રકૃતિ

(અનુષ્ટુપ)

પ્રકૃતિના સ્વભાવેથી દોરાયાં ના જવું ધટે,  
સ્વતંત્ર એથી કો શક્તિ છે, ધારી વર્તવું હદે.

પ્રકૃતિના પ્રવાહો સૌ મિથ્યા કિંતુ ન તે ગણો,  
તેમાં સૌ ભાવ મૂકીને કક્ષા એની ઉંચી કરો.

પ્રકૃતિના ત્રણે ગુણો જીવને કામના ખરે,  
ગમે તેવી ભલે કક્ષા, કોક આધાર જોઈશે.

આધાર જેટલો શુદ્ધ દિવ્ય તે જેટલો હશે,  
જાગેલી ચેતના-શક્તિ પ્રાણ તે વધુ પ્રેરશે.

\* \* \*

પ્રકૃતિ-કાયદા જાણે જ્ઞાની કો ના થઈ જતું,  
પ્રકૃતિથી થવા પાર મથે જે, પાર તે થતું.

\* \* \*

પ્રકૃતિ તો પ્રભુની છે, પ્રભુ વિના ન કોઈને  
—તાબે એ તો થવાની છે, જાણજો નિશ્ચયે હદે.

વિના પામ્યા પ્રભુને કો પ્રકૃતિ પાર ના થશે,  
પ્રભુને પામવાથી તે સમેટાઈ હદે જશે.

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૮૬, ૧૬૦)

ચૈતન્ય-શક્તિ હૈયાની પૂરેપૂરી જગ્ગાવવા,  
વિના તે સાધના તેવું આપણું થવું શક્ય ના.

પ્રભુની ઉપરે ભારે હોવી નિર્ભરતા ઘટે;  
કિંતુ સૌ ચેતનાથી તે આપણાથી થવું ઘટે.

તામસી પ્રકૃતિવાળા જડતામાં રહ્યાં કરી,  
શરાષ્યમાં રહે પોતે માન્યા એવું કરે ચહી.  
પોતે એવું કરે છે સૌ માન્યાં એવું કરે કદી.

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૧૦૧)

### પ્રસંગો

(શિખરિષ્ણી-મંદાકાન્તા)

બધા નાના મોટા નિજ જીવનમાં સાંપડે જે પ્રસંગો,  
નકામા તે ના’વે જરૂર પ્રભુનો ગૂઢ હેતુ રહેલો;  
નડે વિન્ધો જ્યાં જ્યાં પ્રકૃતિ નિજની માનજો ત્યાં રહેલી,  
જીતી લેવા એને હદ્ય દઢતા રાખજો ખંતવાળી.

પ્રભુ ડાખ્યો જ્ઞાની તમથી અદકો; શ્રેય જે છે તમારું,  
—તમોને પ્રેરાવે તહીં, પણ છતાં ધ્યાન બેસે ન પૂરું;

સ્વભાવે દોરાઈ જીવન ઘડવાના પ્રસંગો ગુમાવો,  
હશો દેતાં શાને પદ્ધીથી અમથો દોષ એને જ માથે ?

નકામું ના કાંઈ અમથું બનતું સર્વમાં હેતુ એનો,  
રહે સંતાપેલો સકળ જીવને સંકળાપેલ એ તો.

(‘જીવનપગલે’, આ.૧, પૃ. ૧૦, ૫૦, ૫૧)

### કસોટી

પ્રસંગો આપે છે પ્રભુ કરી કૃપા આપણું સત્ત્વ જોવા,  
'સ્વીકારો શી રીતે મન-હદ્દયથી' પારખું તેનું લેવા;  
ગમે તેવું આવે સહન કરતાં હાલી ત્યાં કેં ન જાતાં,  
પ્રભુને સંભારી બનતું સધણું સૌ કરો સોંપી એને.

તમન્નાવાળાને નડતર કરે કોઈ એવું ન ક્યાંયે,  
થવાવા દેવામાં નડતર ઊભું, શી પરીક્ષા કરે તે !  
ઘડાવાને પાકું જીવતર મળે આધિ, વ્યાધિ, ઉપાધિ,  
શકો રાખી કેવું તમ જીવન ત્યાં એટલી છે કસોટી.

(‘જીવનપગલે’, આ.૧, પૃ. ૫૪, ૭૪, ૭૫)

(અનુષ્ઠાપ)

મળે છે ના નકામું કેં સર્વમાં હેતુ તો રહ્યો,  
હેતુને જાણવા જ્ઞાન-દાઢિ જગૃત રાખજો.

(‘જીવનપગલે’, આ.૧, પૃ. ૧૦૧)

(શાર્દૂલવિકીર્ણિત)

જે જે સર્વ પરિસ્થિતિ જગ મળે તે તે વિકાસાર્થ છે,  
એ રીતે ઉપયોગ શક્તિ કરીને ત્યાં શોધજો તત્ત્વને.

(‘જીવનપગલે’, આ.૧, પૃ. ૫૪)

(અનુષ્ઠાપ)

ઓછાં તો આપણે છીએ કોઈ ને કોઈ વાતમાં;  
બીજાં ઓછાં બીજી વાતે, એક સૌ સરખાં ભલાં !

(‘જવનપગલે’, આ.૧, પૃ. ૨૪)

લેવાનું વ્હાલું લાગે છે, આપવાનું ન લાગતું;  
કરે આચ્ચા બધુંયે જે, લેવાનો હક્ક પામતું.

સાધનાથી જુદું એવું ક્યાંયે ના જીવવાપણું,  
જવન સાધનાથી ના જુદું છે એમ જાણવું.

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૩૦, ૮૩)  
**પ્રાર્થના**

પ્રાર્થના એ તો જવનનો પ્રત્યક્ષ સહારો છે. જવનને યોગ્ય  
બળ, પ્રેરણા, સહાનુભૂતિ, ધીરજ, હિંમત એવું એવું પ્રાર્થનામાંથી  
મળી રહે છે—જો પ્રાર્થનાની કણા સાધકને સાંપડી હોય તો.  
જેમ શરીર સાઝ રાખવા સારુ નિયમિત નાહવાનું છે, તેમ  
અંતઃકરણને સ્વચ્છ ને શુદ્ધ રાખવા માટે પ્રાર્થના છે. પરંતુ તે  
સ્વયં ઊર્મિથી ને ભાવનાથી થવી જોઈએ. પ્રાર્થના જવનને  
તેજસ્વી બનાવે છે. પ્રાર્થના એ કંઈ લૂલી-લૂલી લાગણીની  
વ્યક્તતા નથી, પરંતુ લાગણીને યોગ્ય પ્રકારનો આકાર આપવાનું  
એ તો એક ઉત્તમ સાધન છે. પ્રાર્થનાના એકધારા ભાવભીના  
અભ્યાસથી કર્મોમાં દોષો ઓછામાં ઓછા થતા હોય છે; તેથી  
જવનમાં સદ્ગુણારોની પ્રેરણા પણ સાંપડે છે.

(‘જવનસોપાન’, આ.૧, પૃ. ૧૩૭)

(‘જવનપ્રવેશ’, આ.૨, પૃ. ૨૭૧)

\*

\*

કોઈની સેવા કરવી, સદ્ગત્ત્વવ કરવો, સત્કર્મો કરવાં, સદાચારી ને પરોપકારી રહેવું ને થવું એ બધી પ્રાર્થનાની જ એક પ્રકારની રીત છે; પરંતુ આપણા માર્ગમાં સૌથી વધુ ઉંડી અસર કરે એવી પ્રાર્થના તો ઈશ્વરનું ધ્યાન, મનનચિંત્વન છે. પ્રાર્થનાના અભ્યાસથી મનાદિ કરણોમાં શુદ્ધિ પ્રાપ્ત થાય છે. જીવનવિકાસમાં પ્રાર્થનાનું મહત્ત્વ અમાપ છે. પ્રાર્થનાની પણ આપણને ગરજ લાગી જવી જોઈશે; તે વિના તેમાં સાચો ઉઠાવ પ્રગટી શકતો નથી. પુરુષાર્થથી બનવા કાજે ઘણો કાળ લાગે અને કોઈક વાર તો અશક્ય જેવું લાગે, તેમણ્ઠાં પ્રાર્થનાના બળથી તેવું તેવું થઈ જતું ઘણાંએ અનુભવેલું છે. ('જીવનપ્રવેશ', આ.ર, પૃ. ૨૭૨)

\* \* \*

પ્રાર્થના જેવું ચેતનવંતું ને બળવાણું બીજું કોઈ સાધન નથી. હદ્યમાં હદ્યના સાચા ભાવથી આર્તનાદે ને આર્દ્ધભાવે જે જીવ એનો આશરો લે છે, એને તેવી પ્રાર્થના કદી નિરાશ કરતી નથી; એવી છે પ્રાર્થનાની અંતરતમ શક્તિ. પરંતુ જીવની કેવી પરમ લાચારી છે કે એને પ્રાર્થનાનું શરણું લેવાનું કદી સૂઝતું જ નથી ! કોઈક જીવ કરે છે તો તે કેવી લૂલી-લૂલી, પ્રાણ વિનાની. જ્યારે કંઈક સાચી ગરજ જાગે, કંઈક ઉંડું દર્દ થાય, ઘણું ઘણું સાલવા માંડે, ત્યારે જે પ્રાર્થના થાય છે, તેમાં પણ દર્દથી જે પ્રાર્થના થાય છે એટલે કે જે પ્રાર્થનાના ભાવમાં અંતરનું દર્દ બ્યક્ત થાય છે, તેવી તે વેળાની પ્રાર્થનાનો ભાવ વળી કંઈ ઓર હોય છે. પ્રાર્થના તો સકળ કંઈ કામ કરતાં થઈ શકે. તે કેટલું સરળ, સહજ ને ઉત્તમ સાધન છે ! ('જીવનપોકાર', આ.૪, પૃ. ૭૧-૭૨)

\* \* \*

બાળકને જોતાં એના જેવી નિર્દોષતા જીવનમાં પ્રગટો; કોઈ પ્રેમી ખરા હૃદયના પ્રેમભાવવાળું જોઈએ તો એમના જેવો ખરેખરો પ્રેમ પ્રભુ પરત્વે આપણા જીવનમાં પ્રગટો; કોઈ કાર્યનિષ્ઠ, કાર્યરત જીવને જોઈએ તો એના જેવી લઢણ આપણા ધ્યેય પરત્વે આપણને પ્રગટો; કોઈ સાધુપુરુષને જોતાં એમના જેવી સાધના કરવાની તીવ્ર તત્પરતાવાળી ભાવના અને શક્તિ તથા એવું ઓજસ આપણામાં પ્રભુકૃપાથી પ્રગટો; કોઈ નિર્મળ ભાવવાળાં બહેન કે મા જોઈએ તો એમના જેવી નિર્મળતા આપણામાં પ્રગટો; કોઈક નૈસર્જિક સુંદર દશ્ય જોવાતાં એના જેવો પ્રભુનો આવિલ્લાવ આપણામાં ઉદ્ભવો; વેગવંતી નદીને જોતાં એ જેવા ઉત્સાહ અને ઉન્માદથી અવિરતપણે ધસારાબંધ જેમ પોતાના ધ્યેય પ્રતિ ધર્સણાં કરે છે તેવું આપણા જીવનમાં થાઓ; એવા એવા અનેક જીવનમાં મળતા પ્રસંગોમાં અને દશ્યોમાં એવો ભાવ જાગૃતિ રાખીને, પ્રગટાવીને, હૃદયમાં કેળવીને, ધ્યેયના હેતુને ફળાવવા અર્થે તે તે પ્રકારની હૃદયથી પ્રાર્થના કરવી, તે પણ એક મોટું સાધન છે.

(‘જીવનસંશોધન’, આ.૨, પૃ. ૨૮૭-૮૮)

### પ્રાર્થનાભાવે પ્રવૃત્તિઓ

(અનુષ્ટુપ)

અન્ન કે સ્થૂળ એવું જે આવે તે ઉપયોગ સૌ,  
ચેતના-શક્તિ પ્રેરાવા મળેલાં ધારીને ગ્રહો.

(‘જીવનપગલે’, આ.૩, પૃ. ૮)

અન્નથી તો ટકે પ્રાણ, અન્નમાં ચેતના ખરે,  
—શક્તિ જન્માવવા કેરી જીવને ધારવી ઘટે.

પાણી ઓગાળવાને છે આપણામાંની વકતા,  
પાણીને લેતી વેળાએ રાખજો એવી ધારણા.

દુર્વૃત્તિરૂપ સૌ ત્યાગ મળ વાટે જતો દીસે,  
થવાવા દૂર તેવું સૌ તે વેળા પ્રાર્થજો હદે.

સૂતી વેળા સૂઈ જતું આપણામાંનું સ્થૂળ તે,  
'જાગતાં સૂઈ તે રે'જો', પ્રાર્થજો એવું તે પળે.

પ્રાર્થનાભાવ હૈયામાં દ્ઘાવી કર્મ સૌ કરો,  
વિના ભાવ થતાં કામો નકામાં સર્વને ગણો.

પ્રાર્થના દિવ્ય શક્તિની શુદ્ધ આધાર સૌ થવા,  
જોઈએ કરવી નિત્યે, ભાવે યત્ને કરી રહ્યાં.

ખાઓ, પીઓ, સૂઓ, બેસો, ઊઠો, જે સૌ કર્યા કરો,  
ધારી ત્યાં ધારણા એની તે તે સર્વ કર્યા જજો.

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૧૦૬, ૧૧૮)

(ભોજન-પ્રાર્થના)

(શાર્દૂલવિકીર્ણિત)

સ્વીકારી પ્રભુ અલ્ય અર્થ કરજો શુદ્ધિ સહુ કોષની,  
ચેતાવો હદ શક્તિ મુજ જીવને શી ચેતનાથી ભરી !

(‘વિધિ-વિધાન’, આ.૪, પૃ. ૮૬)

\*

\*

### પ્રારબ્ધવાદ અને પુરુષાર્થ

પ્રારબ્ધવાદીઓ માને છે કે જગતમાં બધું જ ભગવાને નક્કી  
કરી રાખેલું છે, ને પ્રારબ્ધ કે વિધાતાએ વિશ્વને માટે મુકરર  
યોજના (કર્મને લીધે) ઘડી જ રાખી છે, ને તે પ્રમાણે થયાં કરે છે.

આવી માન્યતામાં ઘણી બ્રમજા રહેલી છે. ભગવાનનો ભાવ તો નિત્ય નિત્ય નૂતન રહ્યાં કરે છે. જીવનમાં કર્મનું પરિણામ, ફળ, છે ખરું, પણ પાછું, જીવમાં નવું રચવાની—નવું પ્રારંભ ઉભું કરવાની—પણ સ્વતંત્ર શક્તિ, પ્રભુએ આપેલી છે. ‘કંઈ નવું થઈ શકતું નથી’ એ પણ ખોટી બ્રમજા છે. જેમ ગુરુને આપણે ચલાવીશું નહિ ને હલાવીશું નહિ ત્યાં સુધી તે હાલવાનો નથી, ને ચાલવાનો પણ નથી; તેમ ભગવાનનો ભાવ પણ નિર્જિયતાથી ચેતનપણે આપણામાં પડેલો છે, એને જે કામમાં લે છે તેઓને જ એ મદદરૂપ, ચેતનરૂપ રહ્યા કરે છે. તે ભાવ આપણી ઉપર, ને આપણે ન કલ્પી શકીએ એવે કોક ઠેકાણે, વસે છે એવું માત્ર નથી, તે આપણા હંદ્યમાં પણ છે. એવા ભાવનો જો સતત અંતઃસ્થપણે રહ્યા કરીને ઉપયોગ કર્યા કરવામાં આવે તો અણધાર્યા ફેરફારો જરૂર થઈ શકે છે. એવી સર્વ શક્યતાઓ છે. વિશ્વના વિકાસકર્મમાં જે જે વિકાસ પામતું જતું હોય છે તે કંઈ એકલું નવું જ નથી હોતું. તે કોઈ ને કોઈ જૂનામાંથી જ રૂપાંતર પામ્યા કરેલું હોય છે. તેમ છતાં કોઈ પણ વસ્તુનો વિકાસ થતાં થતાં એનું રૂપાંતર એવું થઈ જાય છે કે જાણે તદ્દન નવીન ન હોય ! એવું પણ બને છે; કારણ કે અંતઃસ્થ, હંદ્યમાંનો, ભગવાનનો ભાવ એ કંઈ ચોક્કસ નિયંત્રિત ઘટમાળ રૂપે નથી હોતો. એ પરમ મંગળકારી શક્તિ તો અનંત ચેતનવાળી ને સતત વિકાસશીલ રહ્યાં કરતી હોય છે.

પ્રારંભના સિદ્ધાંતનો વિચાર કરીને જે પુરુષાર્થને છોડી દેવાની વાત કરે છે તે કાં તો બ્રમજામાં છે કે કાં તો કાયર છે. આપણે સર્વ કંઈ કરવાને શક્તિમાન છીએ.

(‘જીવનસંદેશ’, આ.ર, પૃ. ૨૦૭-૦૮)

\*

\*

## પ્રારબ્ધ અને આત્મશક્તિ

(અનુષ્ટુપ)

પાછલા કર્મ-સંસ્કારો પ્રારબ્ધ તે ભલે ગણો,  
દોષ દેવો કશો એને યોગ્ય માનવીને ન તો;  
વળાંકો આપણા સર્વે કર્મનું પરિણામ છે,  
છતાં તે બાંધી ના લે છે ક્યાંયે આપણને કશો.

પ્રત્યેક કર્મને જાણો પાછલી સ્થિતિનું ખરું,  
—આવ્યા વિના ન રહે એવું પરિણામ પિછાનવું.

કારણો જે રહે તે સૌ થવા પ્રત્યક્ષ ત્યાં મથે,  
કિંતુ તે કારણો પોતે પૂરાં ના શક્તિમાન છે.

માની જો લઈએ એમ ‘કર્મથી જ બધું બને’,  
સ્વતંત્ર ના થવાનું તો નિશ્ચે કોઈ કદીય તે.

ચેતના અંતરે ગૂઢ વિશ્વની ઘટના મહીં,  
પ્રભાવ પાડતી હોત પોતાનો જો નહીં કદી,  
તો તો સૌ પાછલાં કર્મ ને આ સૌ જીવને થતાં,  
કર્મની ઘટમાળેથી પામવી મુક્તિ શક્ય ના.

માનવી કિંતુ ના યંત્ર કર્મની ઘટના તણું,  
જીવન માનવીનું છે કર્મથી બળવાન શું !

કર્મનો કાયદો એક સત્તાધીશ સ્વતંત્ર જો,  
કર્મ ઓળંગવા એવાં કોઈ કાળે બને ન તો.

કિંતુ માનવમાં આત્મા જેવું તત્ત્વ સદા વસે,

સૌથી સર્વોપરી એ તો, રહે તાબે ન કોઈને.

વિશ્વની પ્રકૃતિનાં જે બળો કામે રહ્યાં દીસે,  
ઈશ્વરી ચેતનાને તે પ્રાગટ્ય કરવા મથે.

(‘જીવનપગલે’, આ.૧, પૃ. ૧૦૪, ૧૦૬)

\*

\*

### ‘આજ’ ને ‘કાલ’

(અનુષ્ઠાન)

‘આજ’માં તો સમાયેલાં ભૂત ને ભાવિ બેઉયે,  
ધરી ભવિષ્યનો ઘ્યાલ ચેતે ભૂતથી, તે જીતે.

‘આજ’માં શક્યતા પૂરી જન્મ દેવા ભવિષ્યને,  
‘આજ’ જે જીવી જાણે છે, તેવા જીવનને રળે.

સ્વતંત્ર ‘કાલ’થી કોઈ માનવી ના જીવી શકે,  
‘કાલ’ને વાળવા કેરી શક્યતા ‘આજ’માં દીસે.

આવતી કાલનાં સ્વખાં આજમાં જે ખડાં કરે,  
એને ભવિષ્ય પોતાનું ભવિષ્ય ના પઢી રહે.

ઓગાળી નાખતા ભૂત જેઓ આજથી જીવને,  
ભવિષ્ય આજમાં તેનું ભળી સૌ જતું લાગશે.

આજમાં કાલનું રૂપ પ્રત્યક્ષ જે પિછાનતો,  
આજમાં આવતી કાલ જન્માવી તે શકે ખરો.

(‘જીવનપગલે’, આ.૩, પૃ. ૬૯-૭૦)

વર्तमाने રહ્યું ભૂત, ભવिष्य વर्तमानમાં,  
ગ્રણે એવાં ભળેલાં કે કેમ કો જાણી તે શકે ?

(‘જીવનપગલે’, આ.૧, પૃ. ૧૮)

આજનું મૂલ્ય જે આંકે પોતે જીવનથી ખરું,  
મૂલ્યાંકનો બધાં તેનાં આજથી ફેરવાય શું !

(‘જીવનપગલે’, આ.૧, પૃ. ૧૯)

આજ તે એકલી આજ સ્વતંત્ર કોઈ રીત ના,  
છતાં સ્વતંત્રતા માટે પ્રેરણા પ્રેરતી સદા.

(‘જીવનપગલે’, આ.૧, પૃ. ૧૯)

કાલ  
ભૂત ને આવતી કાલ બેનો સુમેળ આજમાં,  
કરે વિવેકશક્તિથી, જીવને તે કરે કુલ્યાં.  
રખ્યા.

(‘જીવનપગલે’, આ.૧, પૃ. ૧૯)

\*

\*

### પ્રેમ

પ્રેમનું સામ્રાજ્ય સારા વિશ્વ ઉપર આવી રહેલું છે. તે સચરાચર બધે છે. પ્રેમથી જ એકબીજાં સંકળાઈ રહેલાં છે, જડ પદાર્થોમાં તે આકર્ષણના નામે ઓળખાય છે; જીવંત પ્રાણીઓમાં વિષયવાસના અને ઉચ્ચતર સ્વરૂપમાં પ્રેમ તરીકે પ્રવર્તે છે. માનવીમાં પશુત્વનાં અવશેષ અને પ્રભુત્વનાં બીજ રહેલાં છે.

પોતાના સર્વપણાની ને સ્વાર્પણાની બાબતમાં પ્રેમ જેટલો મૌન રહે છે તેટલો જ નિરભિમાની રહે છે. અહંકાર-મદ અને

પ્રેમ એ બે વચ્ચે કદી મેળ ખાઈ શકે નહિ. પ્રેમ અને મોહને પણ તેજતિમિર જેવો સંબંધ છે. જેટલે અંશે મોહ તેટલે અંશે પ્રેમનો અભાવ. મોહ આંધળો છે, પ્રેમ અસંખ્ય આંખવાળો છે. એમાં વિસ્તાર પણ છે અને ઉંડાણ પણ છે. એને સમુદ્ર કરતાં વોમની ઉપમા વધુ બંધબેસતી છે.

(‘જીવનસંદેશ’, આ.૨, પૃ. ૧૭૬ થી ૧૮૨)

\* \* \*

પ્રેમ એટલે જ્ઞાન. પૂર્ણ પ્રેમ અને પૂર્ણ જ્ઞાન એ તો પર્યાયવાચક શબ્દો થઈ રહે છે. આંતર્શુદ્ધિને માટે કદાચ ઉત્તમમાં ઉત્તમ સાધન પ્રેમની ઉપાસના છે. ભગવાનના આનંદ-ભાવનું જીવનમાં વ્યક્ત થવું ને તે અનુભવમાં આવવું, એટલે કે તે પ્રમાણે સચ્ચાચરપણે અનુભવવું, તે સ્વરૂપ તે પ્રેમ. વ્યક્તિ વિના એવા ભાવનું અસ્તિત્વ સંભવતું નથી. એટલે આપણામાં ભગવાનના ભાવનો અનુભવ કરનાર ને કરાવનાર તે પ્રેમ. વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના તથા વ્યષિ સમષિ વચ્ચેના દૈત અને અદૈત બન્નેને ઓળખાવનાર જે તત્ત્વ તે પણ પ્રેમ. પ્રેમમાં ભાવ છે, ગતિ છે, સ્થિતિ છે ને તે હૃદયમાંના એક બિંદુમાં મળે છે.

(‘જીવનસંદેશ’, આ.૨, પૃ. ૧૬૮)

\* \* \*

પ્રેમની ગરમી ધગધગતા અભિન કરતાંયે વધુ છે અને તેની શીતલતા મલયાનિલ કરતાં પણ વધારે શીતપ્રદ છે. પ્રેમનું સ્વરૂપ સૌભ્ય પણ છે ને રૌદ્ર પણ છે. બન્ને સ્થિતિમાં તે કલ્યાણકારી છે. પ્રેમની પોષણકળા સૂક્ષ્મ, અતિ સૂક્ષ્મ છે. સર્જનકળા એટલી સૂક્ષ્મ નથી, તેથી તે પરખાય તેવી છે, પણ તે પરખવા એકાગ્ર ને ડેંડ્રિત થયેલી જ્ઞાનભક્તિનો ઉપયોગ કરવો રહે છે. પ્રેમથી થતો નાશ એ ઉત્તમ પ્રકારનું જીવનનું રચનાત્મક પાસું છે; આમ

પ્રેમ સર્જક છે, પોષક છે અને વિનાશક પણ છે. પ્રેમની વર્ષા, ઉભા, ગરમી, શીતળતા, સૌભ્યતા, કુદ્રતા, હૂંફ, આશા, સહાનુભૂતિ, પ્રેરણા એ બધાં સૂક્ષ્મ પ્રકારનાં આંદોલનો છે; એ બધાંને પ્રીછવા માટે હૈયામાં પ્રેમ જોઈએ છે.

(‘જીવનસોપાન’, આ.૩, પૃ. ૭૮-૮૦)

\* \* \*

પ્રેમને અજીઠો પ્રેમ ખપતો નથી, તેને તો કશુંયે અજીહું ખપતું નથી. એને તો ખપે હૃદયનું શુદ્ધ પ્રેમભક્તિભર્યું પૂર્ણ સમર્પણ; એથી જરાયે ઓછું નહિ. પ્રેમ રસ્તામાં રેઢો નથી પડ્યો.

(‘જીવનપ્રવેશ’, આ.૧, પૃ. ૧૧)

\* \* \*

પ્રેમના વ્યવહારમાં સંપૂર્ણ કરુણાદાદિ જ વરસતી હોય છે, એ કરુણાના હાઈને ભલે આપણે ન પરખી શકીએ કે ન સમજ શકીએ પણ તેથી તેનું અસ્તિત્વ કંઈ મટી જતું નથી હોતું.

\* \* \*

સાચ્યો પ્રેમ હક્ક માંગતો નથી; પ્રેમ તો ફના થવામાં પોતાની ફેલ સમજે છે. પ્રેમનું સામ્રાજ્ય તો હૃદય પર છે. પ્રેમને ઉપરચોટિયા ભાવ કે લાગણી સાથે કશી નિસબત નથી. પ્રેમમાં પોતાને ભૂલી જઈને જેના પર પ્રેમ છે એનામય બની જવાનું રહે છે. પ્રેમમાં માગણીને, આશાને, અપેક્ષાને, બદલાને કશાને સ્થાન નથી. પ્રેમ તો પોતાને ન્યોછાવર કરવાનું જ સમજતો હોય છે. પ્રેમનું પ્રત્યક્ષ લક્ષણ આકર્ષણ છે. પ્રેમ એટલે સ્વજનની ગુલામી. પ્રેમમાં તો ત્યાગ, બલિદાન ને સર્વસ્વનું સમર્પણ આવી જાય છે. પોતાના અસ્તિત્વને મિટાવી દેવાપણું તેમાં રહેલું છે. પ્રેમમાં ગેરસમજૂતીઓ નથી, ઓછું આવવાપણું નથી, અભિમાન નથી. પ્રેમ—ભાવાત્મક પ્રેમ—જ્યાં જ્યાં પ્રગટે છે ત્યાં ત્યાં નંદનવન

પ્રગટાવે છે; લાળા પ્રગટાવતો નથી. પ્રેમમાં તપ છે, કષ છે, મુશ્કેલી છે; પરંતુ તે બધું સહેવામાં કલેશ, કંકાસ કે સંતાપ નથી જાગતાં, પ્રેમમાં કશું ઘટવાપણું નથી.

(‘જીવનપગથી’, આ.૩, પૃ. ૬૩)

\* \* \*

પ્રેમના સર્જનને અંત નથી. તે તો સદાય ઉન્નતગામી રહે છે. તેની દાખિ નીચી નથી. તે દાખિ નીચી કરે છે તે ઉપર તારવવાને કાજે. પ્રેમ નીચે ઊતરે છે ખરો, પણ ઊંચે લેવાને કાજે. પ્રેમ મથામણ કરાવે છે, પણ તેની તેવી મથામણમાં તે જીવને સાચું સમજાવવા મથતો હોય છે. પ્રેમને સમજવા પ્રેમમાં ભળી જવું જોઈએ. તે સદાય જાગ્રત છે; સહજ પ્રયત્નશીલ છે. પ્રેમ સૌથી મુક્ત હોવા છતાં પાછો સૌથી વધુ બદ્ધ પણ છે.

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૧૦૩)

### પ્રેમ, જીવન-સાધના

જીવતાં જીવતાં જેઓ પ્રેમને કાજ વિશ્વમાં,  
સર્વપર્ણ કરે ભાવે, શકે તે ભળી પ્રેમમાં.

સ્વીકારાઈ શકાતો ના અમસ્તો પ્રેમ કોઈથી,  
પ્રેમની ભૂખ તો કેવી વધે છે આપતાં ઊંડી !

\* \* \*

‘પ્રેમ તો આંધળો’, એવું લોક તો બોલતાં દીઠાં,  
જોનાર પ્રેમના જેવો કિંતુ ક્યાંય ન વિશ્વમાં;  
આંધળો પ્રેમ તો મોહ જેમાં લોક રમી રહ્યાં,  
ગણો છે તેથી પોતાના જેવો તે પ્રેમને સદા.

(‘પુનિત પ્રેમગાથા’, આ.૨, પૃ. ૧૮૪)

સંકળાયેલ રે' સૌમાં પ્રેમ પોતાની રીતથી,  
છતાં તે તેમના જેવો કોઈ રીતે બને નહીં.

\* \* \*

વિશ્વ ને સર્વ સંબંધ પ્રેમ કેળવવા મળ્યાં,  
એ રીતે જોઈ જે વર્તે, જીવને તત્ત્વ મ્હાલતાં.

શો સચરાચરે પ્રેમ સર્વમાં સૂક્ષ્મ તે રહ્યો !  
એવા પ્રેમની સાથે, સૌ સંબંધ આપણો ખરો.

(‘પુનિત પ્રેમગાથા’, આ.ર, પૃ. ૧૯૫)

પ્રેમથી વિશ્વ જન્મે છે, પોખાતું વિશ્વ પ્રેમમાં,  
પ્રેમથી મૃત્યુ પામે છે; એવી શી પ્રેમની લીલા !

\* \* \*

પ્રેમની દણ્ણ ને વૃત્તિ કેવી અનંતગામિની !  
એક તોયે બધાં સાથે ભળેલી શી રહ્યાં કરી !

ઘૂંઘટો એકથી એક કેવા અનંત જાતના !  
ખસેડાઈ જતાં તેને, થાયે દર્શન પ્રેમનાં.

લોહચુંબક ખેંચે છે લોઢાને, તેમ પ્રેમ તો;  
—પોતાનું તત્ત્વ સૌમાંથી લાગે શો ખેંચતો હંદે.

સંતાકૂકડી તો પ્રેમ જીવને શી રમ્યાં કરે !  
ખોળી જે કાઢતો, એને પ્રેમ તાળી દીધાં કરે.

(‘પુનિત પ્રેમગાથા’, આ.ર, પૃ. ૧૯૭-૮૮, ૨૦૦-૦૪)

તાબેદારી સ્વીકારે છે પ્રેમ તો કોઈની નહીં,  
પોતાનો કોઈને પ્રેમ તાબેદાર કરે નહીં.

સ્વતંત્ર પ્રેમ એવો શો બક્ષે સ્વતંત્રતા બધી,  
ભુલાવામાં પડે છે સૌ તેથી અજ્ઞાન માનવી.

સંપૂર્ણ સાત્ત્વિકી બુદ્ધિ પ્રેમની આંખ જાણવી,  
એવી આંખ થતાં જેની, મળે છે દણ્ણ પ્રેમની.

પ્રેમ છૂપા મહીં છૂપો રહે કેવો ! જાણાય ના,  
જુએ તે જ મથે એને પ્રાદુર્ભાવ કરાવવા.

પ્રેમને આળપંપાળ કોઈ વાતે કશી નથી,  
આળપંપાળ આરોપે છતાં પોતાની માનવી.

સ્વતંત્ર પ્રેમની શક્તિ અવિચિન્નપણે વસે,  
શકે પેસી ગમે ત્યાંયે પ્રેમ, જો ધારણા હદે.

\* \* \*

સ્વતંત્ર રૂપ એકેયે પ્રેમનું કોઈએ નથી,  
પોતાના જેવું માને સૌ પ્રેમનું રૂપ ચિત્તથી.

('જીવનપાથેય', આ.૩, પૃ. ૫૪)

માનવી ! કોરી બુદ્ધિથી પિછાની પ્રેમ ના શકો,  
ભાવ, જ્ઞાન, વિના યોગ પ્રેમ ના મેળવી શકો.

ભક્તિ વિના કશાનુંયે ના કોઈ હાઈ પામતું,  
ભક્તિ તેથી અનિવાર્ય પ્રેમને પામવા પૂરું.

('પુનિત પ્રેમગાથા', આ.૨, પૃ. ૨૦૬, ૨૧૮)

## પ્રેમ-સમર્પણ

(અનુષ્ટુપ)

હૃથાનો પ્રેમ કેં વાંદ્ધા બીજાની તો ધરે નહીં,  
સર્વભાવથી પોતાનું કરી દે ત્યાં સમર્પણ.

પ્રેમ સૌ આપવું જાણો; મહાલે તે આપવા વિષે,  
સર્વસ્વ ત્યજવા કાજે સમર્થ પ્રેમ શો બને !

આપતાં પ્રેમ ના થાકે, પોતાના ભાવથી કરી,  
પ્રસન્ન રાખવા માગે પોતાના મિયને ચછી.

સહેવું પ્રેમને કાજે એને તે વેઠ ના ગણો,  
પ્રેમના ભાવથી ધન્ય કર્યા જીવન તે કરે.

પ્રેમીમાં પ્રેમનો ભાવ જે ઉત્કૃષ્ટ હુદે ધરે,  
કલ્યાણ સાધશે એવાં સર્વ જીવ તણું જગો.

\* \* \*

## અહૈતુકી જ્ઞાન-ભક્તિ

(અનુષ્ટુપ)

આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી ભક્તના તે પ્રકાર છે,  
આધે કેં તે બધાથીયે પેલી પાર જવાનું છે.

ત્રણો આ જાતના ભક્તો માગ્યાં કેંક કરે ઊંદું,  
આપણો માગવાનું ના પ્રભુની પાસથી કશું.

પ્રેમયે માગવાનો ના; આપણો ઉરમાં ઊંડો,  
—પોતાને કાજ ઉદ્ભાવી, એને આખ્યાં કરો બધો.

શ્રદ્ધા જે ચેતનાવાળી કરીને જીવતી હશે,  
જ્ઞાનવાળી કરી બુદ્ધિ સંશયો, સર્વ ટાળજો.

જે રચનાત્મક,  
જ્ઞાનવાળી થયેલી છે બુદ્ધિ જે રસાત્મક,  
ક્યાંયે એને કશી વાતે પડે છે ગુંચ ના ઊર.

(‘પુનિત પ્રેમગાથા’, આ.ર, પૃ. ૧૫૦-૧૫૧)

\* \* \*

### દુંદ્રાતીત પ્રેમ

(અનુષ્ઠાન)

સર્વ દુંદ્રાદિ વૃત્તિથી પાર પ્રેમ વસે ખરે,  
દુંદ્રાદિ વૃત્તિનો પ્રેમ યોગ્યતા પ્રેમમાં ન તે.

દુંદ્રાદિ વૃત્તિમાં સાચો પ્રેમ ના પરખાય છે,  
પ્રેમ પારખવા પાર દુંદ્રાદિથી થવું પડે.

(‘પુનિત પ્રેમગાથા’, આ.ર, પૃ. ૨૧૮)

દુંદ્રના ચોકઠામાં તો પ્રેમની ભાવના કદી,  
બેસી ના તે શકે યોગ્ય પૂરી કોઈ રીતે કરી.

\* \* \*

પ્રકૃતિ અંતરે તોય કામ જે ચેતના કરે,  
કારક પ્રેમની શક્તિ ત્યાંયે તે જાણવી હશે.

ભૂમિકા-ચોકકું જેવું તેવા સૌ ઘાટ તે ધરે,  
અતિરિક્તપણે તેથી પ્રેમનો ભાવ ઓર છે.

ભલેને હો ગમે તેવી ભૂમિકા, પ્રેમભાવ ત્યાં,  
—રહી સર્વાત્મરે ગૂઢ ભાગ તે ભજવે સદા.

(‘પુનિત પ્રેમગાથા’, આ.ર, પૃ. ૨૧૯)

વस्तु-तत्त्व જ એનું એ સદાકાળ રહ્યાં કરે,  
રૂપ ને સ્થાનમાં ફેર જ્યાં ત્યાંથી શા થયા કરે !

### પ્રેમ-સંબંધ કોની સાથે ?

(મંદાકાન્તા)

જે કોનાથી મન દિલ થતું ઉર્ધ્વગામી સદા રે',  
જે કોનાથી જગતજનની દાઢિ સૌ લુપ્ત થાયે;  
જે કોનાથી મનહદ્યમાં સત્ત્વનો ભાવ જાગે,  
તેની સાથે હદ્ય કરીને પ્રેમ-સંબંધ સાધો.

જેથી જેથી પ્રભુ-પ્રીતિ વધે ભાવથી ભીનું હૈયું,  
જેથી જેથી સમજણ વધી થાય હૈયું વિશાળું;  
જેથી જેથી મન તણી જતી સાંકડી સર્વ વૃત્તિ,  
તેની સાથે હદ્ય કરીને ભાવ-સંબંધ રાખો.

જે કોનાથી નિજ જીવનના કોયડા ઉકલે છે,  
જે કોનાથી મન-હદ્યની ગુંચ સૌ ઉકલે છે;  
જે કોનાથી મન પડી રહી વૃત્તિઓ સૌ જડે છે;  
તે સંગાથે હદ્ય કરીને પ્રેમની ગાંઠ બાંધો.

(‘પુનિત પ્રેમગાથા’, આ.૨, પૃ. ૩૦-૩૧)

\*

\*

જે કોનાથી મન-હદ્યમાં એકતાને પમાયે,  
જે કોનાથી મન-હદ્યમાં પ્રેરણા મેળવાયે;  
જે કોનાથી નિજ જીવન સૌ સાર્થ થાતું જણાયે,  
તેની સાથે હદ્ય કરીને પ્રેમ-સંબંધ રાખો.

જે કોનાથી મન તણી બધી સ્વાર્થવૃત્તિ ઘટે છે,  
જે કોનાથી હદ્ય તણી સૌ ભાવના કેળવાયે;

જે કોનાથી નિજ મન તણા તાંતણા ફેરવાયે,  
તેની સાથે હદ્ય ચહીને પ્રેમ-સંબંધ રાખો.

જે કોનાથી સહુથી પરનું જાણવાનું મળે છે,  
જે કોનાથી સ્વરૂપ નિજનું ભાગવાનું બને છે;  
જે કોનાથી મન મતિ બધાં ઠામ રે'તાં શીખે છે,  
તેની સાથે મન હદ્યથી પ્રેમ-સંબંધ જોડો.

જે કોનાથી ઉર સરળતા આપમેળે વધે છે,  
જે કોનાથી મન, ચિત્ત, મતિ ભાવનામાં રમે છે;  
જે કોનાથી પ્રભુમય થવામાં બધો પ્રેમ જાગે,  
તેની સાથે મન હદ્યથી પ્રેમ-સંબંધ રાખો.

\* \* \*

જે કોનાથી સમજણ પડે 'રાગ-આસક્તિ' તે શું !  
જે કોનાથી સમજણ પડે 'વૃત્તિ' ને 'ભાવના' શું !  
જે કોનાથી સમજણ પડે 'પ્રાણ' ને 'પ્રેરણા' શું !  
તે સંગાથે હદ્ય ભરીને પ્રેમ-સંબંધ રાખો.

('પુનિત પ્રેમગાથા', આ.૨, પૃ. ૩૧)

\* \* \*

## ગૂઢતા

(અનુષ્ટુપ)

માનવી-રૂપ છે ગૂઢ, ગૂઢ છે મન માનવી,  
તેથીયે માનવી-શક્તિ ગૂઢમાં ગૂઢ શી ખરી !

ગૂઢતાની મહત્ત્વ શી ! ગૂઢતા મન ખેંચતું,  
જેનામાં ગૂઢતા જાણી ત્યાં મેળે મન પ્રેરતું.

ગૂઢતાને શકે જાણી કેવી રીતે જગે જન !

ગૂઢને જાણવા જાતાં બને ગૂઢ વધુ ગૂઢ.

જાણવા ગૂઢને એવી રીત શી ગ્રહવી રહી !

અનાદિ કાળથી પૂરું ઉકેલી કો શક્યું નહીં.

માનવી-દિલનું ગૂઢ એના સર્વ સ્વરૂપમાં,

વિચારે, ભાવના, કર્મ એથી તો ફેરવાય શાં !

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૧૮)

\*

\*

### પ્રેમ-પથ-નિર્દેશ

(અનુષ્ઠાપ)

થયો પ્રેમ હશે સાચો યોગ્યતા સૌ રખાવશે,

સત્ય, વિવેક, મર્યાદા આપોઆપ જગાવશે.

પ્રેમ તો આપણો ધર્મ સ્પષ્ટ રીતે બતાવશે,  
કેટલું અન્યમાં રે'વું, કેટલું નિજ પ્રેમીમાં.

મોહ ને કામના સ્વાર્થ, પ્રેમનાં તે સ્વરૂપ ના,  
વિકૃત પ્રેમનું એ તો અંગ છે, જાણજો ભલા !

ભલે પતંગિયું દીવે મોહના પાશથી પડે,  
આપણે જંતુ ના તેવાં, આપણે માનવી છીએ.

શ્રેય છે આપણું ક્યાં તે, પ્રેમની સત્ય ભાવના,  
—બતાવ્યા વિશ ના રે'શે, જીવને રત જો હશું.

બલિદાન અને ત્યાગ અર્પણ સર્વ જાતનું,  
પ્રેમ તો માંગી લે છે, તે નિરપેક્ષ પ્રકારનું.

પ્રેમ તો યજ્ઞની જ્વાળા સર્વ ભર્ત્મ કરાવશે,  
શુદ્ધ કંચન તે હૈયે જીવને સૌ બનાવશે.

પ્રેમની ભાવના દિવ્ય કોણ તે સમજ શકે ?  
દિલ તો માનવી કેરાં કેવાં નાનકડાં જગે !

મહત્વ કેં જ પોતાને પ્રેમી ના આપશે કદા,  
મહત્વ પ્રેમને પોતે આખ્યાં સૌ કરશે સદા.

(‘પુનિત પ્રેમગાથા’, આ.૨, પૃ. ૩૬ થી ૩૮)

લેવાનું પ્રેમ ના જાણે આખ્યાં સૌ કરવું ચહે,  
અભેદે સંકળાવાને પ્રેમ સાધન-ભાવ છે.

\* \* \*

કરાવે પ્રેમ તો મુક્ત; જેવું જેનું સ્વરૂપ હો,  
ચોંટ્યો જેવા મહીં તેવી દાઢિ વૃત્તિ બનાવતો.

(‘પુનિત પ્રેમગાથા’, આ.૨, પૃ. ૪૭)

\* \* \*

### પ્રેરણા

(અનુષ્ઠાપ)

પ્રેરણા આત્મ-શક્તિની શક્યતા બતલાવતી,  
કશો આધાર કે મૂળ પ્રેરણાને મળે નહિ.

સાત્ત્વિક શુદ્ધ બુદ્ધિ સૌ સંપૂર્ણ તે થતાં પૂરી,  
તેવી બુદ્ધિ મહીં ત્યારે સૂક્ષ્મતા દિવ્ય સાંપદે;

તેવી બુદ્ધિ છતાં ના કે પ્રેરણાનું સ્વરૂપ છે,  
‘આત્મ-પ્રભાવની છાયા’ પ્રેરણા, જાણવી હશે.

સાધના વિકસે જ્યારે પ્રેરણાને અનુસરો,  
સ્થૂળ ને સૂક્ષ્મ અંગોનાં થાય ત્યારે રૂપાંતરો.

ઈંડ્રિયો, ચિત્ત ને પ્રાણથી થતા જે અનુભવો,  
દૂંહથી મુક્ત તેમાંથી થવાતાં પ્રેરણા મળે.

સ્વતંત્ર પ્રેરણાનું છે અંગ બીજાં બધાં થકી,  
સ્વભાવ આત્મનો એ છે, ઈંડ્રિય આત્મની સહી.

ઉદ્ભવસ્થાન બુદ્ધિનું મસ્તકે જાણતા બધા,  
હૈયું એ પ્રેરણાનું છે, મૂળ ઉદ્ભવ સ્થાન ત્યાં.

થતું જ્યાં ચિત્ત નિર્જામ અહં નિર્ભૂળ સૌ થયે,  
સંસ્કાર-લય પૂરો જ્યાં, પ્રેરણા જન્મશે હશે.

સ્વયંભૂ પ્રેરણા પોતે સ્વયંપ્રકાશી પ્રેરણા,  
પ્રેરણા-શક્તિથી મૂળ ઓળખાશે જ સર્વનાં.

ઈંડ્રિયો, બુદ્ધિ ને પ્રાણ એ સૌની શક્તિ જે બધી,  
સૂક્ષ્મમાં સૂક્ષ્મ તે હોય પ્રેરણા-તત્ત્વથી વસી.

સાધક સાધના માંછે જેમ જેમ ઊંડો જશે,  
ત્યારે પ્રેરણાતત્ત્વ એને અંતર ઝીલશે.

થાય સાધકને જ્યારે પ્રેરણાના અનુભવો,  
સાધના-વર્તને એણે વાપર્યા કરવાં ઘટે.

વિના સંબંધ વિચાર વિના કે જ પ્રયોજન.  
ઉદ્ભવે ખ્યાલ જે વેળા આચરી જોવું તે હદે.

એથી લાભ થતો જો કે આવે અનુભવે પૂરો,  
જાગૃતિ રાખીને પૂરી આચરવા ન ચૂકજો.

(‘જીવનપગલે’, આ.૧, પૃ. ૧૦૨-૦૩)

\* \* \*

કોઈક ધન્ય વેળાએ હૈયે જે લાગતું ખરું,  
કર્મ તે ભાવના પ્રેરી વર્તતાં, પામશો નવું;

ભાવની યોગ્ય જો કર્મ થાય તો પ્રેરણા ગણો,  
નહીં તો બ્રમણા જાણી મિથ્યા તે સૌ પ્રમાણજો.

એકાંગી શુદ્ધતા જેમાં રહે કેંદ્રિત ઉરમાં,  
બ્રહ્મારથી વૃત્તિઓ આવે તે પરે હુમલો થવા.

બીજાં માનવીઓને તો પોતાથી વૃત્તિ ઉઠશે,  
એણે તો એટલે ઉંદું પોતાનું મૂળ શોધવું.

(‘પુનિત પ્રેમગાથા’, આ.૨, પૃ. ૮૪)

‘કર્મમાં યજ્ઞ, ને યજ્ઞે વસેલા પ્રભુ,’ તો કહ્યું;  
કર્મનું હાઈ તેથી તો પ્રભુનું તત્ત્વ જાણવું.

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૧૫)

\* \* \*

### આત્મનિષ

(અનુષ્ટુપ)

જોયા વિના જુએ પોતે સાંભળ્યા વિણ સાંભળે,  
ચાલ્યા વિના પગે ચાલે, સુંધ્યા વિના સુંધ્યા કરે.

ચાખે છે તે વિના ચાખ્યા, વિચારે બુદ્ધિના વિના,  
પ્રવૃત્તિ માંઠી પ્રેરાયા સંસ્કારો વિષા તે કરે.

પ્રેરણાથી જ પ્રવૃત્તિ આઠે ખોર પળે પળે,  
—કરે જે યોગ્ય, સંપૂર્ણ જાણવો આત્મનિષ તે.

(‘જીવનપગલે’, આ.૧, પૃ. ૧૦૩)

\*

\*

### ફનાગીરી

(ગઝલ)

જગત પરનું બધું ચોક્કસ અનામત રાખીને જે જે,  
પ્રભુમાં જે થવા ચાહે, બધાં તે વર્થ ફાંફાં છે.

‘અમારું સર્વ દુનિયાનું અમારું રે,’ અમારું હો,  
પ્રભુ જો એમ મળતો હો, અમોને તો મીઠો લાગે.

તમારા પાદને હાથ પૂરા બાંધેલ રાખીને,  
પછી તરવાનું શીખવાની બધી ઈચ્છા નકામી છે;  
તમારી આંખ પાટાથી તમે બાંધી પછી ઈચ્છો,  
જવા પંથે અગાડી ત્યાં જશો કેવી રીતે બાપુ ?

તમારી જંખના જેમાં, તમારો પ્રેમ જેમાં છે,  
બધું રાખી સલામત તે પ્રભુ ચાહ્યાનું નિરર્થક છે.  
બધું જે તે કંઈ લો છો પૂરી કિંમત દઈ તેની,  
પ્રભુને એકલો લેવા વિના કિંમત બધાં ઈચ્છે.

ફના કરવાની જો હિંમત, ફના થાવાનું જો સાહસ,  
તમારામાં પૂરાં હો તો પ્રભુપંથે જરૂર આવો.

(‘જીવનપાથેય’, આ.૩, પૃ. ૮૦)

જગતમાં પ્રેમને માટે ફના થાવું ફના થાવું,  
જીવન એવા ફના થાવા થકી નિશ્ચય પ્રગટવાનું.

ફના થાવા મહીં જેને હદ્ય આનંદ પ્રગટે છે, +  
અને આનંદ એવાથી જીવનમાં પ્રાણ પ્રકટે છે; =  
સમર્પણ, ત્યાગ, બલિદાન જીવન કેદે થવા જેને,  
ઉમળકાભેર તૈયારી, જીવનને મેળવે તે તે.

(‘જીવનપગલે’, આ.૧, પૃ. ૬૪-૬૫)

\*

\*

### ‘ખંડું એનું બાકી છે’

(ગઝલ)

જીવનમાં સર્વ કર્તવ્યો ગમ્યાં તે તે કરેલાં છે,  
જીવનમાં સર્વ વ્યવહારો ગમ્યાં તે તે કરેલા છે;  
જીવનમાં સર્વ સંબંધો ગમ્યા તે તે કરેલા છે,  
હતું કરવાનું જે એક જ ખરું, તે કર્મ બાકી છે.

બધી એકાદશી પાળી, બધાં પ્રત આચર્યા કીધાં,  
બધા આચાર-વિચાર પૂરી સંભાળથી પાળ્યા;  
જઈ દેવાલયે દર્શન કર્યા કીધાં સમેસમયે,  
ઇતાં લગની ન લાગી જો, ગણો સર્વસ્વ બાકી છે.

જીવનનો માર્ગ મમતાનો પૂરા આગ્રહ થકી પાળ્યો,  
ધર્યો જ્યાં રાગ ત્યાં માન્યો પૂરો શો પ્રેમ હૈયાનો !  
અને એમાં શું ગાળે જે ખંડું જીવતર કમાણીનું,  
—ન જાણો તે, હજુ જીવન-કમાણી સર્વ બાકી છે !

---

+ ફોરે છે. = જન્મે છે.

ભલે વિદ્વાન પંકાયા, કવિ મશાહૂર હો લેખક,  
મહા હો છો કળાકાર, ભલે સંગીત-નિષ્ણાત;  
ભલે ચોસઠ કળા જાણી, છતાં જીવન તણી સાચી,  
—કળા જો જાણી ના તો તો, બધું એનું જ બાકી છે.

કથાઓ સંભળાવી છે, પ્રવચનો કેંક કીધાં છે,  
બધાં શાસ્ત્રો ઉકેલીને જગતને બોધ દીધો છે;  
પરંતુ જો જગતના સૌ કુંડાળાથી ન છૂટ્યા છે,  
ધુરંધર છો ગણાતા હો, છતાં સૌ એનું બાકી છે.

(‘પ્રજામ-પ્રલાપ’, આ.ર, પૃ. ૧૪૨)

\* \* \*

### બહેનો સાથેનો સંબંધ-વર્તોવ

બહેનો તરફનું આપણું દણ્ણિબંદુ ખૂબ જ લાગણીવાળું  
(જેમાંથી કઠોરતા અને રુક્ષતા નીકળી ગયેલી હોય) હોવું  
જોઈશે. તેમ જ તેમને માટે માન, આદર ને પૂજ્યભાવની  
લાગણી આપણામાં ખૂબ વિકસવી જોઈશે. તે સિવાય  
આપણામાં રહેલી વિકાર-વાસના મૂળથી નાશ નહિ પામે.  
પુરુષોએ પોતાની જતને સર્વોપરી માની લઈને જગતભરમાં  
વાસનાને વધુ પોષી છે ને સ્ત્રીઓને પણ તેવી બનાવી મૂકી છે.

(‘જીવનપગથી’, આ.ર, પૃ. ૧૦૮)

\* \* \*

બહેનો સાથેનો ભાવ ખૂબ નિર્મળ થવા દઈ તેમાં હૃદયના  
પ્રેમભાવનો વિકાસ કર્યા કરશો. સાધકે હૃદયના ભાવથી  
નિઃસંકોચપણે બહેનો સાથે વર્તવાનું છે. મોટા ભાગના લોકોમાં  
એક જાતની ફડક અને ભડક આ બાબતમાં જોઈછે. એક જાતની  
અભડાઈ જવાની સૂક્ષ્મ પ્રકારની ભીતિની લાગણી તેઓ

અનુભવતા હોય છે. તેવી લાગણી હોવામાં અને સેવવામાં જો કે વજૂદ રહેલું છે, પણ અસલ આપણી પ્રાચીન સંસ્કૃતિમાં તો આ અંગેનું વલાશ તદ્દન જુદા પ્રકારનું હતું; કિંતુ સંસ્કૃતિનું પતન થતાં પાછલા ગાળામાં આવા આદર્શને માર્ગે જનાર સાધક માટે ફડક નિયમો સૂચવાયેલા છે; તે પણ યોગ્ય હતું. વળી આજના કાળમાં જ્યાં સ્વચ્છં પ્રવર્તે છે, ત્યાં વિશેષ યોગ્ય પણ હોય. તેમ છતાં વેગળા રહેવાથી અથવા તો ફડક અને ભડક રાખવાથી સાધક તે વૃત્તિથી મુક્ત થઈ જઈ શકે એમ માનવું તે અજ્ઞાન છે. એવી દૂર ને દૂર રહેવાની એક જાતની સૂક્ષ્મ પ્રકારની લાગણીનું જો તટસ્થતાયુક્ત પૃથક્કરણ કરીશું, તો તેમાંથી જીવનથી ભાગી જવાની, ભય સેવીને ભાગી જવાની, વૃત્તિ દેખાશે. આપણે તો જીવનનો સ્વીકાર કર્યો છે. આપણે જ્ઞાનભાનપૂર્વક જીવનમાં જે કંઈ એવા બહેનો સાથેના પ્રસંગ મળે, જે કંઈ સંજોગ ઊભા થાય, પ્રાપ્ત પ્રવૃત્તિ અનુસાર જે કોઈના સંબંધમાં આવવાનું બને, તેનાથી દૂર આવા કોઈ ભય સેવીને ભાગી જવાનું ન હોય. આમ લખવામાં કોઈ પણ રીતે અસંયમ સૂચવ્યો નથી. સર્વ પ્રકારના ભય ને સંકોચથી, બીજાઓએ કે આપણે ઉપજાવેલા ને બાંધેલા ને સમજેલા નિષેધોથી પણ જ્ઞાનભક્તિપૂર્વક મુક્ત થવાનું છે. આ બધું પૂરી જગૃતિથી હેતુના તથા જીવનધ્યેયના જ્ઞાનભાન સાથે આપણે કરવાનું છે. બહેનોના અંતરના આશીર્વાદ મળે, તો તે જીવનમાં ઘણા સહાયક થઈ પડે છે. જીવનમાં શુદ્ધ પ્રેમભાવનો વિકાસ એકાગ્ર ને કેંદ્રિત થાય તે જોવાનું છે.

(‘જીવનસંશોધન’, આ.૧, પૃ. ૧૦-૧૧)

\* \* \*

બહેનો સાથેના વર્તિવ અંગે ‘ભાઈ ! ઊંડા પાણીમાં ઊતરવામાં સાર નથી’, એ જાતની વ્યવહારુ દુન્યવી સલાહ

આપણે સાંભળીએ છીએ. વાદ બાંધીને જેમ ખેતરના અનાજની રક્ષા કરવામાં આવે છે, તે પ્રમાણે, સંસારવહેવારની નીતિને જેમ તેમ કરીને જાળવવા માટે ઉપરનું કથન યોગ્ય છે. આપણે તો એ યાદ રાખવાનું છે કે જેનો કર્મમાં ખરેખરો જીવતો ભાવ રહેતો હશે, તેને કશા પ્રકારના સંકોચ અને ભયની લાગણી ઉદ્ભવતી નથી. જેને જીવનની સાધના યથાયોગ્યપણે કરવાની છે, તેણે તો સર્વથી પ્રથમ અભયભાવના કેળવવાની છે. ભય અનેક પ્રકારના હોય છે. ભયમાં અનેક પ્રકારના સંકોચો પણ રહેલા છે.

(‘જીવનસંશોધન’, આ.૧, પૃ. ૧૪૦-૧૪૧)

\* \* \*

બહેનોથી ભયના માર્યા આભડછેટ રાખવાની નથી તે હકીકત યથાર્થ હોવા છતાં, સાથે સાથે તેમના જાઝ પરિચયમાં અમથુંઅમથું આવવાનું પ્રગટે તેને તો કાળજીપૂર્વક સમજી-સમજીને ત્યજવાનું છે. વધારે જરૂર તો તેમના યોગ્ય સંસર્ગ વડે દિલમાં જીવપ્રકારની વૃત્તિઓની મુક્તિ મળે તેવો ભાવ રાખવાની છે.

(‘જીવનસંશોધન’, આ.૧, પૃ. ૨૭૪)

\* \* \*

બહેનો સાથેનો સંબંધ ને સંપર્કની પાછળ ભાવનું જ્ઞાન રાખીને, સંબંધનો હેતુ સમજીને, જો વર્તવાનું બની શકે તો કોઈ પણ પ્રકારનું અનિષ્ટ જન્મવાનો સંભવ નથી. એમની ત્યાગભાવના, ધીરજ, સહિષ્ણુતા, કોમળતા, સર્વર્પણશક્તિ આદિ બધા ગુણો આપણે જાગૃતિ રાખીને હેતુપૂર્વક કેળવવાના છે. આવા બધા ગુણભાવનું ઉદ્વીપન બહેનોની સાથેના સંબંધથી શક્ય બની શકે છે.

(‘જીવનસંશોધન’, આ.૧, પૃ. ૧૫૨-૧૫૩)

\* \* \*

## બહેનોને ચરણો

(અનુષ્ટુપ)

ઓઢવા-ફેરવાનુંયે જતને ઢાંકવા મળ્યું,  
તેમાંથી મમતા મૂકી જે આવે, ફેરવું બધું.

વ્યવસ્થા તે છતાં સૌમાં કળા-સૌંદર્યશ્રી ભરી !  
જીવને રાખવાની છે ચેતના પ્રાણ વાપરી.

પ્રકૃતિમાં કશું ક્યાંયે યદ્વાતદ્વા \*કશે ન છે,  
યદ્વાતદ્વાપણું તેમ રાખવાનું ન આપણે.

ઘરકામ હુદે શક્તિ મળ્યું જન્માવવા ગણો,  
જેટલું કરશો સારું તેટલી શક્તિ પામશો.

કળા-સૌંદર્યનો ભાવ કામથી જન્મતો હુદે,  
પ્રભુપ્રીત્યર્થ જો કામ થાય, ચેતન નીપજે.

મર્દનું ચઢિયાતું છે કામ એવું નહિ ગણો,  
સૌ સૌનું કામ છે શ્રેષ્ઠ, તેના વિકાસ અર્થ સૌ.

પ્રકૃતિજન્ય હો કામ જે સ્વાભાવિક સ્ત્રી તણું,  
તે કામે ઉન્નતિ એની થશે એમ પ્રમાણવું.

પોતાની પ્રકૃતિથી જો ભિન્ન કામે પડાપડી,  
—કરે જે, તે બગાડે છે કામ પ્રકૃતિનું વળી.

મુગ્ધતાભર્યું સૌંદર્ય, મુગ્ધ કોમળતા કૂળી;  
મર્દના મહેનતુ કામે સ્ત્રીની ત્યાં ઓગળી જતી.

\* ખરે

તત્વ આકર્ષનારું જે સ્ત્રીમાં પ્રકૃતિનું રહ્યું,  
તે તત્વનો થતો નાશ સ્ત્રીના પુરુષ \*કામશું.

પોતપોતા તણું કામ સૌ કાજે ઈછ, શ્રેષ્ઠ છે,  
પોતાના કામમાં શ્રેય રહેલું સૌનું તે જગે.

ના કામ હલકું કોનું, ઉંચું ના કામ કોઈનું,  
નાનું મોટું નથી કોઈ, સૌ તે એક પ્રમાણનું.

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૧૧૮-૧૯)

\*

\*

(ગઝલ)

રહે અજવાળતાં કેવાં તમારાં ઠામ-વાસણ સૌ !  
ભલાં ! અજવાળવું અંતર પછી ભૂત્યાં કરો છો શું !  
ખૂણેખાંચર થકી કાઢો બધો કચરો પડેલો જે,  
ભલાં ! અંતર તણો કચરો ભૂલો છો કાઢવો શાને ?

ઉંચે આડે અને અવળે કરો જાળાં બધાં સાફ,  
હદ્ય બાંઝેલ બાવાં કાં પછી તે ના કરો સ્વચ્છ !  
શરીરને નિત્ય નવરાવો પહેરો સ્વચ્છ શાં કપડાં !  
હદ્ય નવરાવવા કેરો ભલા ! કાં ઘ્યાલ રાખો ના ?

જરૂર બંખેરતાં રહેવું ભરેલું હોય જે અંતર,  
રહેવું સર્વ ઠાલવતાં કશું ન સંઘરો તલભર.

કરી કરી જંખના કેં કેં વહાવ્યાં અશ્વુ એ કાજે,  
વહાવ્યાં અશ્વુ શાને ના પ્રભુની જંખના માટે ?

\* કામ સાથે

ખૂબી એ આપણી કેવી ! નવાઈ તે પમાડે છે,  
પ્રભુને પ્રાર્થના કે તે વળાવે અંતરે અમને.

(‘પ્રણામ-પ્રલાપ’, આ.૨, પૃ. ૧૩૨-૩૩)

\* \* \*

(વસંતતિલકા)

કલ્યાણદીપ જીવને પ્રગટાવીને તું,  
બહેની થજે જીવનપંથ ઉજળનારી;  
જે જે મળ્યાં પથ કરે સહુને નવાજી,  
આનંદ રેલવતી બહેન સદા રહેજે.

\* \* \*

જે કેં અનેકવિધનું તુજને મળે સૌ,  
ખોટું, ખરું ગ્રહી વિવેકથી યોગ્ય લેજે;  
સંસાર એ જીવનને વિકસાવવાને—  
થૈ પ્રાપ્ત યોગ્ય ભૂમિકા પ્રભુની કૃપાએ.

(‘પુનિત પ્રેમગાથા’, આ.૨, પૃ. ૭૪)

\* \* \*

### બુદ્ધિ

જીવ કદી કેવળ બુદ્ધિથી દોરાતો નથી. પોતાનાં મંત્ર્યો  
અને વર્તનને, બુદ્ધિ અનુસાર નહિ પણ પોતાના આંતરસત્ત્વ  
પ્રમાણે બહારના અનુભવો જીલીને ઘડે છે. આંતરસત્ત્વ એટલે  
મન, પ્રાણ, બુદ્ધિ, લાગણી, પૂર્વ કર્મો, વાતાવરણ, અંગત  
સંજોગોની છાપ વગેરે. બુદ્ધિ તો તેને કેવળ યોગ્ય, ન્યાયયુક્ત  
કેરવી આપે છે. બુદ્ધિ પોતે જ આ બધાંને રંગતી ને તેમનાથી  
રંગાતી હોવાથી અર્ધશુદ્ધ છે; તેથી બુદ્ધિ ઉપર જ મદાર રાખનારા

સત્યથી એટલા જ વેગળા રહે છે, જેટલા મંદબુદ્ધિ અને અંધશ્રદ્ધાળુઓ. વળી એવાઓ સદાય સંશયગ્રસ્ત ને તેથી સત્ત્વહીન રહેવાનો પણ પૂરો સંભવ છે.

(‘જીવનપ્રેરણા’, આ.૩, પૃ. ૬-૭)

\* \* \*

ભગવદ્ભાવ પ્રત્યે ખુલ્લા થવા માટે બુદ્ધિની ભૂમિકાનો ઉપયોગ કરવાને બદલે હૃદયતત્ત્વનો ઉપયોગ કરવામાં આવે તો તે વધુ જલદી પરિણામ લાવે છે. આને માટે આપણી ઉત્કટ જિજ્ઞાસુવૃત્તિ સતત જાગ્રત રહેવી જોઈએ. આવી વૃત્તિનું કેન્દ્રસ્થાન આપણું મન ન હોવું જોઈએ તેમ બુદ્ધિ પણ નહિ, પરંતુ તે વૃત્તિ હૃદયના ઊંડાણમાંથી ઉદ્ભબવેલી હોવી ઘટે. બુદ્ધિના કરતાં હૃદય આ બાબતમાં વધુ સરળતાથી પરિણામ લાવે છે. બુદ્ધિનું સ્થાન મગજ અને એની ઉપર છે; જ્યારે ભાવનું સ્થાન (અંત:કરણનું સ્થાન) હૃદય છે.

(‘જીવનપગથી’, આ.૩, પૃ. ૮)

\* \* \*

મન નકામું નથી, બુદ્ધિ નકામી નથી; પરંતુ જેઓ ભારે બુદ્ધિવાળા હશે અને સાથે સાથે જો આગ્રહી વૃત્તિવાળા હશે તો તેમને સત્ય પોતાની રીતે ઘડી શકવાનું નથી.

\* \* \*

બુદ્ધિમાં જ્ઞાનપૂર્વકની જાગૃતિ જ્યારે પ્રગટે છે, ત્યારે જીવનમાં ઊપજતા અનેક જાતના પ્રશ્નોના ઉકેલને તે તરત સુઝાડી દે છે. અનિને અડકતાં જેમ ગરમી લાગે છે તેમ બુદ્ધિમાં પ્રગટેલી જાગૃતિ તેવી રીતે કામ આપતી હોય છે. બુદ્ધિમાં યોગ્ય જાગૃતિ

જીવનવિકાસ પરત્વેની જ્યારથી પ્રાપ્ત થતી હોય છે, ત્યારથી એની શુદ્ધિ થવાની શરૂઆત થતી હોય છે.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૧૬૬-૬૭)

\*

\*

મનબુદ્ધિથી પ્રાણ કે અહ્મુ પર કાબૂ લાવી ન શકાય. તેવી રીતે આણેલો કાબૂ જીવતો નથી હોઈ શકતો. મનબુદ્ધિની સમજણથી કે નિશ્ચયથી પ્રાણ પર સારો, ટકી શકે એવો જીવતો, ચેતનમય સંયમ પ્રગટી શક્યો નથી. તે કાળે તો એનાથી પરની જે શક્તિ છે, તે દ્વારા જ તે યોગ્ય રીતે સાધી શકાય.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૩૫૨)

\*

\*

મન જેવું વિચારે તેવું સમજાય. મન વિચારે છે ચિત્તમાંના પડેલા સંસ્કારોને આધારે; પરંતુ પાછો ચેતવવાને (પ્રકાશિત) બુદ્ધિરૂપી ચોકીદાર આપણને ભગવાને આપેલો છે. એવી બુદ્ધિમાં શક્તિ તથા તેજ છે. બુદ્ધિ વડે જેનું તેનું જ્ઞાન જન્મી શકે છે. જીવનમાં જે જે કુંઈ સમજણો છે, તે બુદ્ધિના પ્રકાશથી પ્રગટેલી છે. આપણા આધારમાં ચેતનનું કોઈ નજીકમાં નજીક અંગ હોય તો તે બુદ્ધિ છે. જે પ્રકારનું વલણ જાગે તેમાં તેમાં મનાદિકરણ દૂબી જતાં હોય છે. પરંતુ સાધકની વિવેકદિષ્ટુક્ત બુદ્ધિ પોતાનો યોગ્ય ધર્મ બતાવ્યા વિના રહી શકશે નહિ. જે બુદ્ધિમાં સત્ત-અસત્તનો સંપૂર્ણ વિવેક પ્રગટેલો છે, તે બુદ્ધિ તો અંતરની આંખ છે.

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૨૧૨-૧૩)

\*

\*

સાધનાના ઉત્તરોત્તર ને ઉચ્ચ ક્ષેત્રમાં એક કક્ષા એવી પ્રગટે છે કે જ્યાં બુદ્ધિ દેખી શકતી નથી, તેમ ઇતાં ત્યાં પણ તે જ્યારે

ઉપદેશ આપવા મંડી પડે છે, ત્યારે આફિત ઊભી થાય છે.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૨૮૧)

\*

\*

બુદ્ધિમાં સમતા અને નિર્મળતા પ્રાપ્ત થવાં એ તો ઘણું ઘણું દોઘણું છે, જ્યાં સુધી તે નિર્મળ થઈ નથી, અનેક પ્રકારના પૂર્વગ્રહોથી ભરેલી છે, ત્યાં સુધી પોતાના ‘અંતરના અવાજ’ને માન આપવાની વાતો વાહિયાત છે. વળી જેઓ એમ ગર્વ લેતા હોય છે કે ‘અમે તો અંધશ્રદ્ધાથી કે ગાડરિયા પ્રવાહ પ્રમાણે ચાલતા નથી,’ એ લોકો ભૂલી જાય છે કે જ્યાં સુધી બુદ્ધિમાં અનેક પ્રકારનાં મળ ને આવરણો છે, ત્યાં સુધી એવી બુદ્ધિની દોરવણી હંમેશ સાચી હોઈ શકતી નથી. એવા પ્રકારની બુદ્ધિનો નિર્ણય તે સાચો નિર્ણય છે એમ પૂરેપૂરું કદી માની ન લેવાય.

(‘જીવનસંશોધન’, આ.૧, પૃ. ૪૨-૪૩)

\*

\*

### બુદ્ધિ

(અનુષ્ટુપ)

આપણા ચિત્ત-સંસ્કારો બુદ્ધિ કર્મનુસારિણી,  
ભજવે ભાગ હેતુને ફીંટાવવા, ઘડી ઘડી.

પૂર્વગ્રહો રહેલા છે સંસ્કાર-બુદ્ધિમાં ઘણા,  
એનાથી જે જણાયેલું, હોવા ના સત્ય સંભવે.

એવું જે સત્ય-મિશ્રિત જણાયે, એથી તોય તે,  
ભૂલાવે નાંખનારું છે જાણજો કદી થૈ પડે.

સંસ્કાર બુદ્ધિનું જોશ હેતુની શુદ્ધતા વિષે,  
ઘટે વાપરવાં તેથી ત્યાં ઘડી-ઘડી ચેતીને.

સત્યનું અંગ એકાદું બુદ્ધિથી જાણી કો શકે,  
સમગ્ર સત્ય બુદ્ધિથી શકે જાણી ન કોઈયે.

બુદ્ધિનું સમજેલું તે સાવ ઉપરચોટિયું,  
કશા પ્રાણ નથી એમાં જેથી આગળ કું ધપો.

તર્ક-વિતર્ક કે ચર્ચા શાખની સૌ પરંપરા,  
એકલી બુદ્ધિના શુષ્ણ સાધને તે મપાય ના.

કિંતુ નિરુપયોગી ના એવુંયે બુદ્ધિનું કશું,  
બુદ્ધિયે ના નકામી, જો એને પાંસરી રાખશું.

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૨૭, ૮૨, ૧૨૨, ૧૫૧)

\* \* \*

(શિખરિષી-મંદાકાન્તા)

ન રંગાયે બુદ્ધિ જહીં સુધી ખરા ભક્તિના રંગથી તે,  
ન માને આવે તે મદદ ખપમાં પૂરી પિછાનવાને;

કર્ય કોરી બુદ્ધિ થડી જનનીની ખાલી વાતો, ન પામે,  
રહ્યો ખાંડા-ધારે પથ મરજીવા શૂર જે ભક્ત પામે.

(‘શ્રીગંગાચરણે’, આ.૧, પૃ. ૨૩)

\* \* \*

ભગવાનનું દર્શન, તેનો અનુભવ અને સાક્ષાત્કાર  
એટલે શું ?

ભગવાનનું દર્શન એટલે અમુક કાલ્યનિક ભાવ એટલે કે  
મનની કોઈ કલ્યના નથી. સંસ્કારપરંપરાગત જામેલી આપણામાં  
એ બાબતની જે એક પ્રકારની ભાવનાછે તે પણ તે નથી. શાસ્ત્રોમાં  
વર્ણવેલી દર્શનની સ્થિતિ પણ એક પ્રકારની મર્યાદાછે. ભગવાનના  
ભાવનું આપણામાં પ્રત્યક્ષ થવું એનો અર્થ એછે કે એના ભાવની

અંદર રહેલાં તત્ત્વો—જેમ કે એનું સચરાચરપણું, એની અનંત અમર્યાદ શક્તિ, અનેક પ્રકારના ગુણોની ને ગુણોથી પરની શક્તિ, એનું સવિકલ્પપણું ને નિર્વિકલ્પપણું વગેરે આપણામાં પ્રત્યક્ષ અનુભવરૂપે પ્રગટ થાય, ત્યારે એનાં દર્શન થયાં ગણાય. ભગવાને જે આ સૂચિ રચી છે તેની પાછળ કોઈ ગૂઠ હેતુ હશે જ—છે; એ હેતુને પાર પાડવામાં પ્રત્યેક જીવ સંકળાયેલો છે. આપણાને આત્માની સ્થિતિનું ભાન થતાં તે હેતુનું સ્પષ્ટ દર્શન થાય છે ને એમ આપણો એના યંત્ર બનીએ છીએ. પળેપળ એવી ભાગવત સ્થિતિમાં નિરહંકારપણે ને અભેદભાવે રહેવાયાં કરાય અને પળેપળ તેવાં ભાગવતી કાર્ય થયાં કરે એનું નામ ભગવાનનું દર્શન.

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૩૪)

\*

\*

શ્રીભગવાનના અનુભવ માટે અમુક શરતો પૂરી કરવી પડતી હોયછે. તેમાંની કેટલીક નીચે પ્રમાણે હોઈ શકેછે :- શ્રીભગવાનના અસ્તિત્વનો હૃદયથી જ્ઞાનભક્તિપૂર્વકનો નિશ્ચય, ‘સર્વરૂપ ભગવાન એ મારો આત્મા છે,’ એવી ઊંડી અંતરની જ્ઞાનપૂર્વકની સમજ, સર્વરૂપ ભગવાન જ છે એવો હૃદયમાં હૃદયથી જ્ઞાનભક્તિ-પૂર્વકનો સ્વીકાર, પોતાની જાતની સંપૂર્ણ ઓળખ, એને સ્વકર્મથી સંતોષવા એ જ એની પાકી સમજ; આવું આપણે શ્રદ્ધાથી રોજ ને રોજ નિશ્ચયાત્મક બુદ્ધિથી, હૃદયથી હૃદયમાં તે બધું કેળવતા રહીએ, અને તે બધું ઊંદું ને ઊંદું સમજથી ઉતારીને તેનો અનુભવ કર્યા કરીએ, તો આપણે શ્રીભગવાનના છીએ અને એ આપણો છે એવા તત્ત્વનો અનુભવ થશે જ થશે.

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૪૫)

\*

\*

સાક્ષાત્કાર એટલે શું ? એ તમારો પ્રશ્ન ઠીક છે.

માનવીના જીવનમાં જે અવ્યક્ત ઈશ્વરનું સ્વરૂપ છે, તેને એકાગ્ર ને કેંદ્રિત સાધનાના ભાવ વડે છતું કરીને, એને કિયાના પ્રવાહસ્વરૂપમાં એની કૃપાથી વહેતું મૂકવાનું કરવું તેનું નામ સાક્ષાત્કાર. આપણામાં જે અવ્યક્ત પ્રભુમય જીવન છે, તેને પ્રેમભક્તિજ્ઞાનપૂર્વકની ચેતનયુક્ત જ્ઞાગૃતિમય સાધનાના પળેપળના અભ્યાસ વડે, જીવનમાં પ્રત્યક્ષ કામ કરતું અનુભવવું તે છે સાક્ષાત્કાર.                    ('જીવનમંથન', આ.૨, પૃ. ૩૪૨-૪૩)

\*

\*

આપણામાં પણ પ્રભુની શક્તિ જ કાર્ય તો કરી રહેલી છે, પરંતુ આપણને તેનું સાચું, પૂરું જ્ઞાનભાન પ્રગટેલું નથી. આપણે તો પ્રકૃતિની રીતે ને સ્વભાવે જેમાં તેમાં પ્રેરાતાં હોઈએ છીએ. આપણે જીવપ્રકૃતિમાં છીએ; જ્યારે સાક્ષાત્કાર પામેલો આત્મા તો પ્રકૃતિનો સાક્ષી, અનુમત્તા, ભર્તા ને ભોક્તા બનેલો હોય છે. એવું તે પોતાની સકળ પ્રકારની પ્રકૃતિમાં સહજભાવે અનુભવ્યા કરે છે. એમ કરતાં કરતાં, થતાં થતાં તે માત્ર તેટલો જ છે તેવું પણ નથી. વળી તે પોતે પ્રકૃતિનો ઈશ્વર પણ છે એવું પણ તેના અનુભવમાં એની કૃપાથી તેને જ્ઞાન પ્રગટે છે. તેવી વેળાથી તે અનુભવવનું સત્ય કંઈ માત્ર એક ઠેકાણો જ પડી રહ્યાં કરતું હોતું નથી, પણ વિસ્તાર પામીને સમાચિને સ્પર્શતું હોય છે.

સાક્ષાત્કાર પામેલા એવા મુક્તાત્માની પ્રકૃતિ કંઈ ઊડી જતી નથી હોતી; તે રહેતી હોય છે, ને કામ પણ આપતી હોય છે, પણ સામાન્ય માનવીમાં તે (પ્રકૃતિ) શેઠ બનીને પ્રવર્તે છે;

જ્યારે સાક્ષાત્કાર પામેલામાં શેઠ તરીકે નહિ, પણ ચેતનના એક  
જ્ઞાનપૂર્વકના કરણ તરીકે પ્રકૃતિ રહે છે.

(‘જીવનપોકાર’, આ.ર, પૃ. ૩૪૩-૪૪)

\*

\*

## ભગવદ્ભાવ જન્મેલો જીવને જાણવો તદા

(અનુષ્ટુપ)

પ્રભુના ભાવમાં જેને ધારણા ઉર બેસતાં,  
પ્રકૃતિના બધા તેને આવશે ખેલ લક્ષમાં.

પ્રકૃતિ પછવાડેનું ચૈતન્ય સ્પર્શ ત્યાં થશે,  
સર્વમાંથી પ્રભુભાવ હુદે નીતરતો સુદૂરે.

મૂળ સ્વરૂપ જે રીતે છાયા ઉપરથી સૂઝે,  
તેમ પ્રકૃતિમાંથીયે મૂળભાવ જર્યી જશે.

પ્રકૃતિ પ્રકૃતિ ત્યારે એને અનુભવે ન રે’,  
રૂપાન્તરે સહુ પામ્યું એવું દર્શન ત્યાં થશે.

(‘જીવનપગલે’, આ.૧, પૃ. ૬૮-૬૯)

પોતાનામાં ‘યમુનાની ગતિ’ ઊંધી થયેલ તે,  
નરી આંખે નિહાળીને ધન્ય ત્યારે હુદે થશે.

વિષયો ઈન્દ્રિયોના સૌ ઈન્દ્રિયોની રીતે કદી,  
—નહીં આચરશે એવો; તે દણ્ણિ લુપ્ત ત્યાં થતી.

ઔંદ્રિય વિષયોમાં તે પરોવાયેલ લાગશે,  
કર્મના કારકે એનો આશરો ગ્રહવો પડે.

ઇન્દ્રિયોથી બધું કામ લીધાં તે કરશે, છતાં,  
—ગુલામ ઇન્દ્રિયોનો ના એવો તો બનશે કદા.

ઇન્દ્રિયો વશ એવાને રહેવાની સદા પૂરી,  
ઇચ્છા પોતાની જેવી હો, દોરવાયે જ તેમ સૌ.

માયા ને પ્રકૃતિ નોખાં દેખાશે નવ એહેને,  
બન્નેનું રૂપ પોતામાં રહેલું સ્પષ્ટ લાગશે.

જીવતીજાગતી ત્યારે સાધના જીવને થશે,  
'ભક્તિ, જ્ઞાન અને કર્મ, ધ્યાન'-સુમેળ જામશે.

સર્વ કેં જાતનાં ત્યારે અશાંતિ-કારણો ભલે,  
—આવતાં, ત્યાં રહે શાંતિ આપોઆપ ખરી હશે.

ભાગવા પ્રાપ્ત-કર્મોથી ત્યારે વૃત્તિ થશે નહીં,  
કંટાળો કેં કશાથીયે આવશે ના હશે જરી.

વિશ્વના વ્યવહારો સૌ, પ્રભુની રચના-લીલા,  
અનુભવે જણાશે તે સંધાતાં લક્ષ એમ ત્યાં.

('કર્મગાથા', આ. ૧, પૃ. ૧૨, ૧૩, ૩૪)

\*

\*

પ્રભુનો પ્રેમ જાગેલો અંતમુખી રખાવશે,  
અંતર્દૃષ્ટિ કરાવીને હૈયેથી વરતાવશે.

પ્રત્યેક પરિસ્થિતિનો હેતુ-ધર્મ સ્હુરાવશે,  
સ્હુરાવી બેસી રે'શે ના, વર્તાવ્યા કરશે હશે.

પ્રભુનો પ્રેમ હૈયામાં સમગ્ર ને સળંગ રે';  
સંકળાયેલ રે' છે શો ! જેમ સુવાસ પુષ્પ પે.

કાણમાં અજિન છૂપો રે', તેલ છૂપું તલે રહ્યું,  
ભાવ તેવો હદે ગૂઢ જગતાં સ્પર્શશે બધું.

નવી દષ્ટિ, નવી વૃત્તિ સર્વસામાન્યતા વિષે,  
—આપણે ઉર જન્મે છે, તેવો ભાવ થતાં હદે.

યોગ્યાયોગ્યપણું જે તે સર્વ વાતો તણું હદે,  
—વિના વિચાર જન્મે છે તે વેળા આપણા વિષે.

સંકળાયેલ પ્રારબ્ધે જ્યાં જ્યાંયે હશું આપણે,  
એકસામટું સૌ સાથે ત્યાં ત્યાં તે સંકળાવશે.

એકલું સંકળાવે ના, હેતુયે સ્પષ્ટ ભાસશે,  
પ્રભુનો ભાવ જે તેમાં આપણો ત્યાં રખાવશે.

બંધાતા ત્યાં રહીએ, ના બંધાયેલ છતાં દીસો;  
પાણીમાં હો છતાં કેવા જાણે હો તરતા તમો;  
મધ્યમાં જેમ રે'તા હો સર્વમાંયે છતાં પૂરા,  
આપ નોખા તરેલા હો, લાગ્યા એવું કરે સદા.

પ્રકૃતિ-ખેલમાં કેવી વસે છે પ્રભુની લીલા !  
દર્શન એનું તે વેળા હૈયે મેળે જશે થયાં.

સર્વના ગૂઢમાં કેવું લીલા-સૌંદર્ય ભાળશો !  
માધુર્યયુક્ત ભાવોમાં કેવા તલ્લીન ત્યાં થશો.

કશું વિચારી-વિચારી વર્તવાનું ન ત્યાં બને,  
પ્રસંગ યોગ્ય વર્તવ તેવાનો તો થયાં જશે.

‘શક્યતા કેટલી શેમાં કેવી કેવી રહ્યાં કરે,’  
એવાને ભાળ લાગે છે હૈથે સ્પર્શ થતાં ખરે.

સંજોગોની પ્રમાણે સૌ પોતાનામાં થયા જશે,  
કું પ્રત્યાધાત-આધાતો, નિરાળો તે છતાં રહે !

સર્વજ્ઞપણું આવેલું કરે અનુભવ્યાં હદે,  
છતાં ના જાણતો હોય સજ્ઞાન મૂઢ તો રહે.

સ્થળ ને કાળનો ભેદ તેવા ભાવે નહીં રહે,  
પ્રત્યક્ષપણું કેવું તે પ્રીધશે સચરાચરે.

પ્રત્યક્ષ સૂર્યના જેવો પ્રભાવ આપમાં થતો,  
દીવા જેવું નિહાળી તે રમે છે આપમાં પૂરો.

થવાતાં યંત્ર શક્તિનું, શક્તિ પ્રત્યક્ષ ત્યાં થશે,  
વહેવાનો ચીલો ત્યારે પોતાનો બતલાવશે.

છતાં શક્તિથી પોતે તો જુદો ના લાગશે હદે,  
વર્તશે એની સંગાથે, ભજેલાં એકમેક રે’.

પોતાના વૃહેણની દિશા તણી ચિંતા ન ઉદ્ભવે,  
‘આજ’માં ‘કાલ’ તે જુઓ, ‘કાલ’માં ‘આજ’ નીરખે.

અનેકમાં પ્રવર્ત્તલો પોતે રે’તો હદે છતાં,  
-એકનો એક શો રે’છે ! એકના એક ભાવમાં.

સર્વ મેળ પ્રસંગોનો મેળે એવા મહીં બને,  
પરિસ્થિતિની મર્યાદા એવો ભાવે કળી શકે.

અનેક માણકા જેમ માળારુપે ભલે રહ્યા,  
કિંતુ તે સર્વમાં દોરો રહે શો, તેમ ભાવમાં.

કાળ ને સ્થળને તેવો સાધનો નિજનાં કરે,  
ઉપયોગ થવો જેવો તેમનો ઘટતો કરે.

બંધાયેલો ન રહે છે તે કોઈ વાતે કશા થકી,  
કણાઈ ના શકે એવો પૂરો તે સર્વ ભાવથી.

(‘જીવનપગલે’, આ.૧, પૃ. ૮૩ થી ૮૭)

સાત્ત્વિક પ્રેમનો ભાવ હુદે ઉંડો જતાં જતાં,  
ભાવસૌંદર્ય શક્તિનાં થાય દર્શન ત્યાં રૂડાં.

જ્યાં જ્યાંયે લાગવા માંડે મુગ્ધ સૌંદર્ય જીવને,  
જાગેલી ભાવના જાણી ત્યારે ભાવ લહો હુદે.

(‘પુનિત પ્રેમગાથા’, આ.૨, પૃ. ૮૫)

આવું સૌ સર્વ વાતે જ્યાં આવે અનુભવ હુદે,  
ભગવદ્ભાવ જન્મેલો જીવને જાણવો ખરે.

\*

\*

ભગવાનના ભાવની છતા થવાની તદ્દન શરૂઆતનો  
**અનુભવ**

ભગવાનનો ભાવ જ્યારે સાધકમાં (સાધનાની અમુક  
કક્ષામાં) જરાતરા પણ જાગવા માંડે છે, ત્યારે મન દ્વારા, બુદ્ધિ  
દ્વારા, દીદ્રિયો દ્વારા, હદ્ય દ્વારા એમ અનેક રીતે વ્યક્ત થવાને  
સહજ રીતે તૈયાર થાય છે. આ ભાવ અત્યંત સૂક્ષ્મમાં સૂક્ષ્મ,  
કોમળમાં કોમળ ને ભીષણમાં ભીષણ પણ છે. જ્યારે તે આંખ  
દ્વારા વ્યક્ત થતો હશે, ત્યારે જ્યાં ત્યાં આપણને સૌંદર્યનાં દર્શન  
થયાં કરશે. ગમે તેવામાં પણ અતિ સુંદરતાનાં દર્શન થશે ને તેમાં

અનહંદ આનંદ પણ હશે. કોઈક વાર ભયંકર થથરાવી મૂકે તેવાં દશ્યો પણ જોઈ શકીશું. કાન દ્વારા એવું તો મધુર સંગીત અને દિવ્ય નાદના સૂર આપણા કાને અથડાયાં કરશે-ક્યાંયે કશું તેવું નહિ હોય તો પણ. જ્ઞાન ગમે તેવા ખોરાકમાંથી ઉત્તમોત્તમ પ્રકારનો સ્વાદ અનુભવશે. ચામડી એટલી તો કોમળ અને દિલને ગલીપચી થાય એવી સૂક્ષ્મપણે મધુરમધુર લાગશે ને તેમાંથી કુમળા-કુમળા સ્પર્શનો એવો આનંદ જામે, કે તેવા સ્પર્શનો ઘ્યાલ કોઈ પણ પાર્થિવ ચીજથી ન આવી શકે. તેવું જ બીજી ઈદ્રિયો વિષે. સૂક્ષ્મ ભાવ તે તે દ્વારા વ્યક્ત થતો હોવાથી ને બહાર ચેતનરૂપે તે ભાવ હોવાથી વ્યક્ત થતો ભાવ તે ભાવને પકડે છે અને જે ઈદ્રિય દ્વારા વ્યક્ત થાય છે, તે ઈદ્રિયના સ્વભાવનું પ્રકૃતિમાં જે મૂળ છે, તે મૂળ પ્રમાણે તેનો આપણને અનુભવ થાય છે.

આ અનુભવોમાં એટલો તો આનંદ રહેલો છે કે તેનાથી અલગતા અનુભવવી લગભગ અશક્ય જેવું બને છે. સાધકના ખરા સંયમની કસોટી ત્યાં છે. ઘણા સાધકો ત્યાં અટકી પડે છે. તેઓ એમ માની લે છે કે હવે પોતાનું ઈતિકર્તવ્ય આવી રહ્યું, કારણ કે તેને દિવ્ય આનંદ મળતો હોવાથી તેમાં તે ગરકાવ થઈ રહે છે. ભગવાનનો જાગેલો ભાવ આમ એ આનંદને ભોગવ્યાં કરવાથી એક દિવસ અલોપ થઈ જાય છે.

(‘જીવનપરાગથી’, આ.ર, પૃ. ૧૫૨-૫૩)

\*

\*

## ભાવનું મહત્ત્વ

(ગઝલ)

સ્વજનની યાદ-ઉર્મિ જે હૃદય અમ શક્તિ રૂપે છે,  
સ્વજનને મૂર્તિમાં ઘડવા હૃદય-આધાર ભાવ જ છે.

સ્વજન શાં ભાવના-રૂપે સમાયે ભાવમાં જ્યાં તે,  
શરીર બે સ્થૂળ છો જુદાં, ભળે શાં એકરસભાવે !

પરસ્પર તો ઠરે છે જ્યાં હદ્ય-રસ-ભાવ એકાગ્રે,  
પૂરો કેંદ્રિત તે ઠરતાં ઉભય શાં એક લાગે છે !

(‘જીવનસંદેશ’, આ.૨, પૃ. ૮૩)

\*

\*

(અનુષ્ટુપ)

સગુણ ઈશનું રૂપ ભાવ પ્રત્યક્ષ જાણશો,  
જીવવું ભાવને કાજે પ્રત્યેક પળ તોળશો.

ભક્તિભાવ વિના કાર્ય થવા દેવું કદી ન તે,  
નહીં તો ભાવને કર્મ વૃથા તે કરી નાંખશો.

ભાવને જીવવા કાજે કર્મનો આશરો ગ્રહો,  
મહત્ત્વ ભાવને આપો કર્મમાં લક્ષ રાખી સૌ.

પ્રભુનો ભાવ જે રીતે જાગે તે રીતને ગ્રહો,  
ભૂમિકા યોગ્ય તે કાજે રચાવા સર્વ કેં કરો.

ભૂમિકા તે રચાવાને યોગ્ય ભાવ ધર્યા કરો,  
ભાવ વિના કશું કાર્ય પ્રભુનું ના થશે ખરું.

ભાવ તે ભક્તિનું મૂળ ખરું પ્રત્યક્ષ જાણવું,  
જ્ઞાનના ભાવથી ભાવ જન્મે, તો યોગ્ય સૌ થવું;  
ને ભાવ રાખવા માટે કર્મ તો કરવાં પડે,  
તેથી સૌ કર્મમાં ભાવ જ્ઞાને પરોવવો ઘટે.

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૮૮, ૧૦૭)

\*

\*

પ્રભુને કામમાં જે તે જીવતો રાખવા હશે,

### પ્રાણવાળો

અભ્યાસ ભાવનાનો સૌ ઊંડો કેળવવો ઘટે.

જીવતા-જગતા એવા વિના અભ્યાસ કોઈને  
—પ્રભુ-કૃપા તણો લાભ એમ ને એમ ના મળે.

ભાવ કેળવવા ઊંડો જીવતો-જગતો હશે,  
મળેલું ગુણ-સામર્થ્ય વાપર્યા કરવું ઘટે.

(‘જીવનસંદેશ’, આ.૨, પૃ. ૭૬-૭૭)

\*

\*

(માલિની)

ઉર મહી પ્રગટેલો ભાવ પ્રત્યક્ષ કર્મ-  
જરૂર સ્ફુરવશે તે ભાન પોતાનું સર્વે;  
કશું ન ચસકવા દે આમથી તેમ ક્યાંયે,  
નદી-જળ જ્યમ વહેછે મધ્ય, તેવું વહાવે.

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૮૮)

\*

\*

### ભાવ-સર્વસ્વ

(ગઝલ)

જગતમાં ભાવ જેનો છે, બધાં કિંમત પૂછે એની,  
જરૂર પડતાં ખરીદી લૈ બનાવે વસ્તુ તે નિજની.

ન જેનો ભાવ છે કાંઈ ન એને કોઈ પૂછે છે,  
જરૂરી હોય છો ભારે છતાં ચગદાય તે ચરણો.

દરે છે ભાવ જેનો જ્યાં બધું અંકાય ત્યારે તે,  
જગત વ્યવહાર શો ચાલે બધે ગણના કરી ‘ભાવે !

નહે સૌ ભાવની તોલે જીવન સૌ ભાવ-સર્વસ્વ,  
ગરીબની ‘ભાવ’ મૂડી છે, ગરીબનું સાચું તે સર્વ.

હંદ્યના ‘ભાવ’ પર મારે ભૂમિકા ચાલવા કાજે,  
જગતમાં ક્યાંય હો ઠરવા મને તો ઠામ, ‘ભાવ’ જ છે.

કૃપાથી ‘ભાવ’ તે દેજો છૂટે હાથે દીધાં કરજો,  
દઈ વળતર પ્રભુ પૂરો અતુલો આપશે પાછો.

(‘જીવનસંદેશ’, આ.૨, પૃ. ૩૧)

\*

\*

### સ્વજન-ભાવ

(ગુજલ)

સ્વજનનો પ્રેમ હૈયાનો રહે હૈયા વિષે ન્યારો,  
સ્વજનને ખોળિયું ના છે પરંતુ ભાવમૂર્તિ શો !

સ્વજનને દિલ મળવામાં શરીર તો સ્થૂળ રૂપે છે,  
પરંતુ તાર હૈયાના મિલવવા ભાવ રૂપે તે.

સ્વજન તો દિલનો ભાવ બઢવવાને દઢવવાને,  
જીવનમાંના જીવન કાજે પ્રસાદીરૂપ મળિયું છે.

(‘જીવનસંદેશ’, આ.૨, પૃ. ૧૧૭)

\*

\*

(અનુષ્ટુપ)

ખોળિયાં બે જુદાં હોય કિંતુ જ્યાં ભાવ એક રહે,  
એ રીતે જે જીવે તેવાં સાચાં પ્રેમી બની શકે.

(‘જીવનસંદેશ’, આ.૨, પૃ. ૩૧)

\*

\*

## ભૂલો, સાધનામાં

આ માર્ગમાં આપણાથી ભૂલો પણ થાય છે; પરંતુ તે પણ અર્થસૂચક જ હોય છે. ભૂલથી કદી હતાશ થઈ જવાનું નથી. ભૂલની પાછળ રહેલી પ્રામાણિકતા આપણને નવું દસ્તિબિંદુ ચીંધીને જોરદાર પ્રોત્સાહન આપે છે. બીજા પ્રયોગોમાં એક વાર ભૂલ થઈ કે બસ; પ્રયોગ તેટલા વખત પૂરતો તો નકામો જવાનો. જ્યારે આમાં તો આપણા યજની અખંડતા તૂટતી નથી, દિલની નિશ્ચિંતતા તૂટતી નથી કે પ્રસન્નતા ઘટતી નથી.

(‘જીવનપગથી’, આ.ડ, પૃ. ૫૦-૫૧)

\*

\*

જેટલી જાગૃતિ વિશેષ તેટલી ભૂલો આપોઆપ અટકશે. ભૂલ થાય પણ એને વિષે કંઈ હાયવોય ન કરીએ. ભૂલોમાંથી તો ઊલટી મદદ મળવી જોઈએ. આપણી ભૂલ આપણે પોતે જ જેતાં શીખવી. આપણાથી થતી ભૂલોમાંથી આપણને સત્યનો રસ્તો સૂજવાનો છે,—જો થતી ભૂલોનું યથાર્થ ભાન થયાં કે રહ્યાં કરતું હશે તો.

\*

\*

## મન

મન એ એક મુખ્ય કરણ છે, ને નહિ કે સર્વ કંઈ. એ એની મેળે પલટાઈ જઈ શકતું નથી. તેને પલટાવ્યા વિના છૂટકો પણ નથી. એટલા કાજે જ સાધનાની જરૂર છે. તેને પલટાવવા માટે પ્રેમભક્તિપૂર્વકનું એકધારું નામસ્મરણ એ એક મુખ્ય સાધન છે. બીજું સાધન રોજનાં થતાં કર્મોમાં પ્રભુની ધારણા. ત્રીજું સાધન મળતા સર્વ પ્રસંગોમાં સાત્ત્વિક ગુણોના વિકાસની કેળવણી. એમ જુદાં જુદાં સાધનોનો આશ્રય લઈને મનને પલટાવવાનું આવશ્યક છે.

મનને મારવાનું છે ખરું, પણ એવી રીતે કે એમાંથી ખરો  
પાક ઉત્પન્ન થાય. મનને સાચી રીતે સજ્જવન કરવાનું છે.

(‘જીવનપ્રેરણા’, આ.૩, પૃ. ૬૮)

(‘જીવનપગથી’, આ.૩, પૃ. ૨૮)

\*

\*

કેટલીક વાર જે ન કરવાનું હોય એટલે કે ન ગમતું હોય  
તે જ કરવાનું રાખવું. એથી પણ મનના સાંધા ઢીલા પડી શકે છે;  
પરંતુ તેવા કર્મની પાછળ હેતુનો ખ્યાલ રહેવો જોઈશે.

મન જેમ દુદ્રિયોનો સરદાર છે, એની સાથે સાથે એ જાતે  
પાછું બીજાં કશાનું પરિણામ કે તાબેદાર પણ છે. આપણી  
વૃત્તિઓનાં વલણ, સંસ્કારો, પ્રવૃત્તિ, વાતાવરણ આદિ પ્રમાણે  
મનનું વલણ રહ્યાં કરે છે; અને એ પણ કંઈ સર્વસત્તાધીશ નથી.  
એના કરતાં પણ વિશેષ શક્તિશાળી ભગવાનની પરાશક્તિ  
આપણામાં રહેલી છે.

મનને આપણું મિત્ર બનાવવાનું છે. એ તો કંઈ કંઈ ખેલ  
કરશે બુદ્ધિની મદદ લઈને ઊંધુંચું સમજાવીને આપણને ઊંચે  
જવામાં કંઈ કંઈ મુશ્કેલીઓ આણશે, ત્યારે આપણને ખ્યાલ  
રહેવો જોઈશે કે મનની સમજણો તે કંઈ સર્વસત્ય, આખરી સત્ય  
કે સર્વશ્રેષ્ઠ નથી.

મનને શાંત, નીરવ કરવા માટે તેની સર્વ પ્રકારની  
કિયાઓથી અલગ થવાની જાગૃતિ રાખો. તટસ્થતાપૂર્વક સાક્ષીવત્ત  
રહી તેને નીરખવાનું કર્યા કરો. જે જે કંઈ નકારાત્મક તેમાં ઉઠે  
તેને ફેંકી દો; તેનો ઈન્કાર કરો. મનમાં ઉઠતા વિચારોની સાંકળ  
ન જોડો. એને આવા તપથી સ્થિર કરવાનું છે.

(‘જીવનપગથી’, આ.૩, પૃ. ૧૭)

(‘જીવનસોપાન’, આ.૧, પૃ. ૧૪૮)

\*

\*

## સુખદુઃખની ઉત્પત્તિ—મન (અનુષ્ટુપ)

આપણે આપણું દુઃખ વિચારીશું ન જો કશું,  
કોઈએ કરશે ઓછું કદી ના દુઃખ આપણું.

આપણે આપણી જાતે નિર્મિતા સર્વ રીતના,  
પોતે સંહારનારા છે પોતાને સર્વ વાતમાં;  
બચાવનાર પોતાનાં પોતે છે એકલાં હદે,  
તે વિના કોઈ બીજું ના આવે ઉગારવા જગે.

આપણાથી જ જન્મે છે સુખ ને દુઃખ જીવને,  
સ્વતંત્ર સુખ ને દુઃખ આપણા વિશે ના કશે.

આપણી માન્યતા રીતે સુખદુઃખાદિ માનીએ,  
માન્યતાથી પછી ખાલી શાને તે કંઈ વ્યાખોરીએ ?

સુખ-આધાર બીજામાં જે કોઈ શોધવા જશે,  
સુખ બીજાં થકી એને કદી ના મળવાનું છે.

અખંડ સુખ સૌ વાતે પોતા વિના તે ન મળે,  
પોતામાં રાચશે ઊંડાં સુખ તે સર્વ મેળવે.

દુઃખી કરાવનારું હો કોઈ આપણને જગે,  
પોતે દુઃખી કરાવે છે પોતાની જતને હદે.

સ્વભાવ આપણો જેવો તે પ્રમાણે થશે બધું,  
સ્વભાવની પ્રમાણે સૌ સારું ને માહું લાગતું.

જેનો સ્વભાવ પોતામાં પોતાનું સર્વ ન્યાળતો,  
કોઈ વાતે કશું દુઃખ એને તો નવ લાગતું.

સ્વભાવ જીવને કેવાં ઊભાં કરતૂકો કરે,  
થાય છે વશ જે, એને દુઃખ-દુઃખ બધે દીસે.

જેવાં માનીશું પોતાને તેવાં થઈશું જીવને,  
ગમે તેવાં થતાં તેથી રહેવું સ્વસ્થ આપણે.

લગાડવા કશું ઓછું આવે જો કોઈ જીવને,  
એને ના પેસવા દેવું આપણામાં કશી રીતે.

એવો અભ્યાસ ખંતીલો જીવને જે દઢ થશે,  
દુઃખ કોઈ રીતે એને જરીકે ના સત્તાવશે.

સંજોગો જીવને છો ને અનુકૂળ બધા મળે,  
છતાં લગાડશે દુઃખ જો સ્વભાવ ન યોગ્ય છે.

સ્વભાવની પરે તેથી સુખદુઃખાદિ સર્વનો,  
સૌ આધાર રહેલો છે સૌનું મૂળ સ્વભાવ શો !

થવા રૂપાંતરે તેથી જે કોઈ સ્વભાવને મથે,  
તેવું સુખી થવાનું છે જેમાં તેમાં બધાં વિષે.

બ્રહ્માયે દુઃખી એવાને કરી ના શકશે કશે,  
દુઃખની પાર તો એવો સચ્ચિદાનંદ પામશે.

\* \* \*

દુઃખ-દુઃખ કરી જાતે પોતાને દુઃખી માનશે,  
પ્રભુ સાક્ષાત્ એવાંને બનાવી ના સુખી શકે.

('જીવનપાથેય', આ.૩, પૃ. ૫૧ થી ૫૩)

જે જે ઊપજેલું છે બીજાંથી ના બનેલ છે,  
થવા ઉત્પન્ન તે સૌયે નિમિત આપણે છીએ.

આપણે આપણું જે તે સર્વ ભોગવીએ છીએ,  
બીજાને દોષ ત્યાં દેતાં માનવી ભૂલમાં પડે.

દબાશે દુઃખથી જેઓ દુઃખ એને દબાવશે,  
—દબાવીને ભુલાવી દે સુખના સૌ પ્રસંગને.

(‘જીવનપાથોય’, આ.ર, પૃ. ૫૩)

\* \* \*

### માયાના ખેલની અંતરમાં પ્રભુ

(અનુષ્ટુપ)

માયા પ્રપંચી શા ખેલે દાવ ગૂઢ હરાવવા !  
પોતાનો કાબૂ ના જાય, એવા ખેલ કરે બધા.

યુક્તિ-પ્રયુક્તિ માયાની મુશ્કેલ જાણવી બધી,  
કિંતુ હો એય કેંદ્રિત હૈયે, તે ચેતશે નકી.

રહ્યો શો ખેલી માયાથી ઈશ્વર ગૂઢ વિશ્વમાં !  
પ્રપંચ-વર્તી માયામાં મૂળ એનાં રહ્યાં બધાં.

કર્મ ના સર્વ કેં એને, કર્મથી પર તે રહ્યો,  
કર્મથી પામવા જે કો એને જાય, પમાય ના.

માયામાં ગૂઢ સંતાઈ જણાવા દે ન નિજને,  
સંતાવામાં મજા એને અનોખી લાગતી દીસે.

અનેક રૂપ તે લે છે નોખાં એકબીજાં થકી,  
પરસ્પરે વિરોધી શાં ! બુદ્ધિગમ્ય ન તે કદી.

માયા-આવરણે કેવા ખેલ પોતે રમ્યાં કરે,  
માયાને ભેદીને જેઓ જુએ, તે ખેલ નીરખે.

પ્રપંચી ખેલ એના છે, એના સર્વ પ્રપંચમાં-  
અંતરે ચેતના ખેલે અનોખી રીતથી સદા.

દેખાતું ઉલટું કેવું કારમું કારમું જગે !  
વિકાસ વિશ્વને એમાં માયા કરાવતી ખરે.

એવા પ્રપંચી માયાના ખેલમાં ચેતના રમે,  
વેધક શોધવા દષ્ટિ ત્યાં જેની, તત્ત્વ મેળવે.

અસંબદ્ધપણું લાગે માયાથી એનું શું ઘણું !  
છતાં એવા બધામાં જે એને ગ્રીછે, જુએ પ્રભુ.

ના માયા સત્તુ અસત્તુ પોતે, માયા કેરા સ્વરૂપમાં,  
મથે જે ખોળવા એને, મેળવે ઈશ-ચેતના.

(‘જીવનપગલે’, આ.ડ, પૃ. ૮૮-૧૦૦)

\*

\*

(અનુષ્ટુપ)

જશોદા માતને કૃષ્ણ ખેલ કેવા જુદા જુદા,  
—પોતે બતાવતા ! તોયે તે મહત્ત્વ ભૂલી જતાં.

માયાના ધૂંઘટેથી તે લપટાયેલ શો રહે !  
માયાના અંતરે એને જોવાને જે મથે, જુએ.

માયાનો ખેલ મૂકીને પોતે છાનો ઉભો રહી,  
સર્વના ખેલ તે દેખે પોતે નોખો તરી રહી.

એવા સૌ જીવને ખેલ પ્રભુના જે નિહાળશે,  
પ્રભુ પ્રત્યક્ષ એવાને થતાં વાર ના લાગશે.

(‘જીવનપાથેય’, આ.ડ, પૃ. ૧૪૫)

\*

\*

(શિખરિષ્ણી-મંદાકાન્તા)

પ્રભુની માયાની પકડથી થવું મુક્ત ના સહેલ વાત,  
ધરીને માયામાં મન-મતિ કદી ના બનો એથી મુક્ત;  
ઇતાં માયામાં એ જગપતિ છૂપો; એહને ના નકારી;  
રહેલી માયામાં ગૂઢ પ્રભુ તણી છાંય જોવાનું શીખો.

પ્રભુ વિના બીજું કંઈ પણ નથી છો ભલે વિશ્વ દેખો,  
સકંચામાં એના હંદ બની જતાં, દેખશો એવું સૌ તે;  
બધી રીતે એનાં સ્વજન બનીને જો હૃદે ધારણા, તો,  
તમે લાગશો\*

—બધાંમાંયે એને નીરખી શકશો, જો પ્રભુને વર્યા હો  
તો.

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૧૪૫-૪૬)

\*

\*

(અનુષ્ટુપ)

વિશ્વની રચના ખાલી એમ ને એમ ના હશે,  
એનામાં ખોળવાનું જે રાખે ઈશ,  
એમાંથી ખોળતો રે’ જે પ્રભુને, હંદે જીવે.  
પ્રપંચી રૂપ માયાનું એમાંયે ખેલ ઈશના,  
ઈશરે ત્યાં રમે કેવો ! જણાશે આપમેળ ત્યાં  
પ્રભુ પોતે રમે કેવો અનોખી રીતથી સદા !

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૧૪૮, ૧૫૧)

\* વળગશો

## માંગલ્ય પ્રેમ

(શાર્દૂલવિકીડિત)

ખેલ્યાં ગૂઢ રહી રમે જગતમાં જે સ્થૂળ ને સૂક્ષ્મમાં,  
આકર્ષે જીવ જીવ પ્રેમ-રસથી એકાત્મભાવે થવા;  
અનું પ્રેમ-સ્વરૂપ એક સહુને જે સંકળાવી રહ્યું,  
એવો પ્રેમ ઉંડો પરસ્પર દ્રવી ફેલાવજો મંગળ.

જેવાં પુરુષ-પ્રકૃતિ હળી મળી વિશે હંમેશાં રમે,  
દેખીતી મૂળ પ્રકૃતિ જ રમતી, પુરુષ રે' અંતરે;  
બન્ને એકબીજાં પરે ત્યમ છતાં આવંબીને વર્તતાં,  
તે આદર્શ અનુભવો જીવનમાં ને માણજો મંગળ.

જ્ઞાની પ્રેમશ્રી જેહને સમજતાં તે પ્રેમના ભાવને,  
સાકારી રૂપ આપવા જીવનમાં છે લગ્નનો હેતુ તે;  
વ્યાચિથી જ સમાચિમાં જીવનને ઉદ્ભાવવા લગ્ન છે,  
—એ હેતુ ધરી લક્ષ મંગળ તમે વર્તાવજો જીવને.

જે જે સર્વ પરિસ્થિતિ જગ મળે તે સૌ વિકાસાર્થ છે,  
એ રીતે ઉપયોગ શક્તિ કરીને ત્યાં સાધજો તત્ત્વ તે;  
ન મૂલ્યાંકન આંકશો જીવનના પાર્થિવ સૌ માપથી,  
એ તો ઈશ-પ્રસાદી પ્રેમ ગણજો પ્રત્યક્ષ તેવું જીવી.

પાખ્યાં જીવન ના નિરર્થકપણો તે ઘ્યાલમાં રાખજો,  
પોતાને ન મહત્વ આપી સધણું બીજાંનુંયે ધારજો;  
જે જે એકલવાયું જીવન જીવે તે જીવને શી મજા !  
ત્યાગે જીવન-પુર્ણ આપ વિકસે એવાં બની મુંકજો.

જે જે સર્વ મણ્યાં કરે જીવનમાં ના ભોગવો એકલું,  
બીજાંને સમભાગી સાથ કરતાં રે'જે તમે પ્રેમ શું !  
ઉંચી સંસ્કૃતિ જન્મથી નવ મળે એ તો જીવ્યાથી મળે,  
એવું ઉન્નતગામી જીવન તમે જીવી કરો મંગલ.

જુદું જુદું રૂપાંતરે પરિણામે શું તત્ત્વ તે પ્રેમનું,  
સાધી પ્રેમ શકે પૂરો સકળ તે આદર્શનો, લગ્નથી;  
ઓજસ્વી રૂપ પ્રેમનું જીવનમાં ઉદ્ભાવવા લગ્ન છે,  
એ તો જીવન-સાધના ગૂઢ અને શી ભવ્ય ને રમ્ય તે !

કેવું પ્રેમ-સ્વરૂપ દિવ્ય રસીલું શું મુખ્યરૂપે રસ્યું !  
ઉંડો ભેદ ન પારખે ત્યમ છતાં સૌ કો રસાયે જતું;  
લીલા પ્રેમ કરે આણુ-આણુ મહીઁ શા શા રચે ખેલ ત્યાં,  
એવા પ્રેમ વડે તમો ઉભયનું થાઓ સદા મંગલ.

(‘વિધિ-વિધાન’, આ.૨, પૃ. ૫૮-૫૯)

\* \* \*

### પ્રેમની અનંતતા

(અનુષ્ટુપ)

ગમેયે તેટલો છો ને પ્રેમ વ્યક્ત કરી શકો,  
પ્રેમની તે પરાકાણા કોઈ ના ખોંચી ત્યાં શકો.

ગૂઢતા પ્રેમની એ જ એની ખૂબી અનેરી શું !  
થવાતાં વ્યક્ત તે પૂરો થશે રૂપ અવ્યક્તનું.

મર્યાદા પ્રેમની છેલ્લી દર્શાવીશું ભલે છતાં,  
અધૂરી તોયે રે'વાની પ્રેમની ભાવવ્યક્તતા.

મર્યાદા પ્રેમની કોઈ આંકી ના જીવને શકે,  
અનંત રૂપ એનું છે, લેણદેણ થકી વધે.

(‘પુનિત પ્રેમગાથા’, આ.૨, પૃ. ૪૬)

પૂરો સંપૂર્ણ ના એનો ભાવ આવી શકે હદે,  
બેખ્યાતી-બેહદી એ તો, આપતાં આપતાં વધે.

\* \* \*

### મુક્તાત્મા—અને તેનાં દુર્ગમ ગૂઢ વર્તનો

પોતાના સત્ત્વનો ઝટ ઓળખી શકાય એવો આવિભાવ  
મુક્તાત્માઓ સાધારણ રીતે થવા દેતા નથી. આથી શરૂશરુના  
સાધકને, જિજ્ઞાસુને તથા આધ્યાત્મિક પથથી અણજાણ એવા  
જીવોને, મૂંજવણ અને ગુંચવાડો થતાં હોય છે. કેટલાકની  
શ્રદ્ધા આથી હાલી જાય છે યા ઉઠી જાય છે. પોતાનાં સંકુચિત,  
વિકૃત અને કુલ્લક માનસને માપે અને દંડે સંતોને માપવા  
જતાં તેમનાં કેટલાંક વર્તનો તેમને અગમ્ય અને કદીક કદીક  
તો નિંધ પણ લાગે છે. તેમનાં આવાં કાર્યોનો ગૂઢ પણ  
કલ્યાણકારી હેતુ એવાઓની સમક્ષ ખુલ્લો કરીને તેમને  
સમજાવવામાં આવે, તો પણ તેઓ તે હેતુઓની કદર કરી  
શકતા નથી હોતા. તેઓના મનમાં એમ થાય છે કે જાણી  
જોઈને સંતો શા માટે આમ વર્તતા હશે ? શા માટે પોતાને  
વિષે ગેરસમજૂત થવા દેતા હશે ?

(‘જીવનસંદેશ’, આ.૨, પૃ. ૧૬૨)

\* \* \*

સૌથી પ્રથમ તો એ સમજ લેવાની જરૂર છે કે મુક્ત  
આત્માનું જો કે સામાન્ય માનવી જેવું હલનચલન જણાય છે,  
પરંતુ તે છે તેની પ્રકૃતિનો સ્વામી, આત્મનિષ. જ્યારે સામાન્ય  
માનવી તો પ્રકૃતિનો દાસ છે, ગુણોથી પ્રેરાઈને તેની બધી કિયા

થાય છે. એટલે બન્નેની બહિરૂ કિયાઓની દેખીતી રીતની સમાનતા પાછળ ધરમૂળનો, પાયાનો, તાત્ત્વિક તફાવત આવી રહેલો છે. સાધારણપણે સમાજમાં એવી સમજણ પ્રવર્તલી હોય છે કે મુક્ત એટલે સામાન્ય માનવી કરતાં કંઈક તદ્દન ભિન્ન પ્રકારનો માનવી, કે જેની સ્થૂળ કિયાઓ પણ સામાન્ય માનવી કરતાં જુદી જ હોય. પણ આ સમજણ યોગ્ય નથી. જીવનમુક્તમાં પ્રકૃતિ, હંડિયો, ગુણ, ભાવના, લાગણી, ઉર્મિ નાશ પામી જાય છે એવું નથી હોતું;—શરીર છે ત્યાં સુધી તે બધું હોયાં કરવાનું, પણ એ આ બધાનો સ્વામી બની રહેલો છે. એ વર્ત છે પરિસ્થિતિના માલિકની રીતે;—જડ યંત્રવત્ તે દોરવાતો હોતો નથી. તેમનાં તેમનાં કાર્યક્ષેત્ર પ્રકૃતિને વશ નથી હોતાં એટલું જ. તેવાં તેવાં કાર્યક્ષેત્રમાં જ્યારે તે બધાં પ્રેરાય છે, ત્યારે એને એનાં જ્ઞાન-હેતુની જીવંત સજ્ઞાત ધારણા રહ્યાં કરતી હોય છે.

મુક્ત-આત્માને કર્મ આવશ્યક નથી હોતાં. એ કર્મ કરે છે ખરો, પણ તે પ્રભુપ્રેરિત હોય છે માટે. પ્રભુના આદેશની સમજણ કહો કે આત્માના સહજજ્ઞાનના કોઈ અકળ એવા સહજ હેતુથી કહો, તે રીતે તેનું તેવા કાર્યમાં પ્રેરાતું જવું બનતું હોય છે. તે અમુક જ કાર્યોમાં પ્રેરાશે, અમુક જ કાર્યો કરશે એવું પણ નથી. તે પૂર્ણ ગૃહસ્થાશ્રમી હોઈ શકે છે, તેમ જ સહજ મેળે સંપૂર્ણ સંન્યાસી પણ હોય, દેશસેવક પણ હોય ને આંતરરાષ્ટ્રીય સેવક પણ હોય. તે જેમ પોતાની પ્રજાનો હોય તેમ સમાચિનો પણ હોય;—એનામાં સમદાચિ હૃદયથી જ સહજ હોય છે. એને કંઈ તેવું કે તેવા થવાપણું નથી. ત્યાં વિચાર પણ નથી ને સંકલ્પ પણ નથી. જેવી જેવી એને જીવનમાં પરિસ્થિતિ મળ્યાં કરતી જાય તેમ તેમ તે ઉપર વહુન કર્યા કરે છે. તે રાજ્યોનું સંચાલન, શાસન કરનાર રાજી પણ

હોય ને અદનામાં અદનો દાસ, સેવક પણ હોય. અત્યંત પ્રવૃત્તિશીલ અને સમસ્ત જગતમાં ભ્રમણ કરનારો પણ હોય ને નિવૃત્તિપરાયણ બનીને જગતના એક એકાંત ખૂણામાં બેસી રહેનારો પણ હોય. એને કોઈ એક દષ્ટિ, વૃત્તિ ને વલણ નથી હોતાં. તે ફરતોયે હોય સ્થિર પણ; ને બન્નેમાંથી એક પણ ન હોય ને બન્ને સાથે પણ હોય. તે એક કાર્ય કરતો કરતો અનેક કર્મમાં પ્રવર્તતો રહ્યાં કરે છે ને કશું જ નથી કરતો હોતો, તોપણ તે ખરા સાચા ભાવમાં સહજપણે પ્રવૃત્ત રહેલો હોય છે; એને કશામાં પ્રવેશવું પડતું નથી, કારણ કે એ પ્રત્યેકના સહજ સ્વભાવરુપે છે. તે જેમ એક છે તેમ અનંત પણ હોઈ શકે ને તેમ છતાં સંપૂર્ણ શૂન્ય પણ થઈ શકે. એ કર્મ છે, કર્મના અંતરમાં છે, કર્મના આદિમાં છે, ને તે કર્મ જ એનામાં છે. તે કાળ છે ને કાળ તેનામાં છે ને તેથી પણ તે પર છે.

(‘જીવનસંદેશ’, આ.ર, પૃ. ૨૦૫)

\* \* \*

જીવનમુક્ત દુંદથી પર હોવા છતાં એને હર્ષ, શોક, લાગણી આદિ નથી હોતું એમ નહિ. એવી એવી વૃત્તિઓ ઉદ્ભવતાં તે તેનો ભોગ થઈ પડતો નથી, પણ ત્યાં એને કેવી રીતે, ક્યાં કેટલા પ્રમાણમાં પરોવવી એ બધાનું જ્ઞાન રહ્યાં કરે છે. જ્યાં સુધી શરીર છે, સમાજમાં છે, ત્યાં લગી પ્રારબ્ધ કર્માનુસાર કર્મ ભોગવવાનાં હોય તેમાં કે આદેશકાર્ય હોય તેમાં કે સમાચિત્રપ્રકાર્ય હોય તેમાં, પોતે જ તેનો સ્વામી છે, જન્મદાતા છે ને ભોક્તા પણ છે; ને તે છતાં પણ પાછો તે ક્યાંય નોખો છે. તે ભાવયુક્ત રહી ત્યાં ત્યાં પ્રવર્તતો હોય છે. તેને પોતાને ઐહિક દષ્ટિએ કશું વિકાસ પામવાનું બાકી નથી રહેતું, પરંતુ પરબ્રહ્મભાવમાં તો વિકાસ સહજમેળે તે પામ્યા કરતો હોય છે.

(‘જીવનસંદેશ’, આ.ર, પૃ. ૨૦૫-૦૬)

\* \* \*

સાધારણપણે સમજની જુદી જુદી સમજણ જીવનમુક્ત અંગે કંઈક એવી હોય છે કે તેણે પોતાના જીવનની જરૂરિયાતો ઓછામાં ઓછી કરી નાંખી હોય; દલિતો અને ગરીબો માટે તેને અત્યંત ‘દ્યા’ હોય ને તેમને માટે સેવાકાર્ય પણ કરતો હોય; સમસ્ત માનવસમુદ્દાય માટે દ્યાનો સાગર જ હોય અને માનવજાતના ઉદ્ધાર માટે જ તે મથે; તે મૌન પાળતો હોય કે ઓછામાં ઓછું બોલતો હોય; તેનો ચહેરો શાંત, ગંભીર હોય અને તેની સમીપ પહોંચતાં જ તેની ભવ્યતાની અથવા સાધુતાની છાપ પડે એમ હોય; વગેરે વગેરે. જો તે ખડખડાટ હસતો માલૂમ પડ્યો કે કોઈ સાધારણ પ્રવૃત્તિમાં મશગૂલ થતો દેખાયો, દુન્યવી વિષયોમાં રસ ધારણ કરતો અને તેથી ‘કુલ્લક’ બાબતો વિષે છૂટથી વાતો કરતો જણાયો તો, બસ ખલાસ. તે ગમે તેવો મહાન હોય તોપણ લોકોની નજરે તો એ બહુ બહુ તો પોતાની ભારે શક્તિ અને બુદ્ધિથી તેમના ઉપર પ્રભાવ ને સત્તા બેસાડનાર ને પોતા તરફ બધાંને આકર્ષનાર છતાં આખરે તો એ પણ ‘દુન્યવી’, એટલે પાર્થિવ ભૂમિકામાં વિહરનારો જ લાગશે.

લોકોની આવી સમજણ પ્રવર્ત્ત તેમાં તેમનો પણ શો દોષ ? જીવનમુક્તની વિશિષ્ટતા કંઈ સ્થૂળ આંખોથી દેખાય એવા સ્થૂળ નેત્રમાં નહિ, પણ મન કે હૃદયના સૂક્ષ્મ પ્રદેશમાં રહેલી છે ને તે જોવા માટે તો સૂક્ષ્મ દસ્તિ જોઈએ. તેના કપાળે કંઈ ‘લેબલ’ ચિઠી ચોંટાદેલી હોતી નથી કે એવી કોઈ બાધ્ય નિશાની કે ચિહ્ન હોતું નથી કે તેને તેના સાચા સ્વરૂપમાં જાણી શકાય. કશાનેય પણ બરાબર જાણવા ને તેનું હાઈ પિછાણવા જરૂર રહે છે, કદરભક્તિભર્યા, ભાવુક, સપ્રેમ, અત્યાસપૂર્ણ અનુશીલન, પરિશીલનની.

મુક્તાત્મામાં માનવીની દ્યા નહિ પણ હિવ્ય અનુંપા ભરી  
પડેલી છે. એ નિષ્ઠુર નથી, દ્યાહીન નથી. જગતનાં દુઃખો-  
સંઘર્ષો અને ઉલ્કાપાતો વચ્ચે પણ એ નિશ્વલ રહેતો જણાય છે  
તેનું કારણ એ છે કે એને અનુભવ છે કે વસ્તુમાત્ર પોતપોતાની  
નિયતિને અનુસરે છે ને તેથી વસ્તુમાત્રની ઉત્કાંતિ બહારની  
દ્યલગીરી વિના—પોતાની મેળે—થવા દેવાનું તે યોગ્ય ગણે  
છે. તેથી તે નિશ્વેષ પણ રહે છે કે દેખાય છે. વળી તેની માત્ર  
સૂક્ષ્મ અને મૂક અનુંપા બીજાંઓની દોડધામ અને ધાંધલિયા  
પ્રવૃત્તિઓ કરતાં ક્યાંયે વધુ અસરકારક અને સક્રિય છે. તેનો તેને  
એકલાને જ અનુભવ છે. કાળથી થતાં પરિવર્તનો તેને અસ્વસ્થ  
કરી શકતાં નથી, કારણ કે તે કાળચકની ગતિને પારખતો હોય  
છે. આમ તે જ્યારે કાળને પારખે છે, ત્યારે તે તેનાં કારણો  
શોધવા નથી બેસતો. વિસંવાદી ઘટનાઓમાં પણ એ સંવાદ જોઈ  
શકે છે, અનુભવી શકે છે. એને ‘હું’ જેવું કશું નથી, તેથી તેને  
કશામાં રાગ નથી. વિધિની કૃતિઓ એને હલમલાવી શકતી  
નથી. એ કોઈ જાતની યોજના ઘડતો નથી. એના વિચારવર્તનમાં  
કોઈ જાતની ન્યૂનતા નથી, તેથી નૈતિક સિદ્ધાન્તોની કે આલંબનની  
એને જરૂર રહેતી નથી. એને કશું ભૂલી જવાપણુંયે નથી ને યાદ  
રાખવાપણું પણ નથી. પ્રકૃતિ ને પુરુષનું તે એકીકરણ છે. એ  
કશાનો માલિક નથી અને બધાંનો માલિક છે. એ કોઈનું અનુકરણ  
કરતો નથી, કેમ કે અનુકરણથી સમયોચિત વર્તન થાય નહિ.  
એને બીજા કોઈ સાથે સરખાવી શકાય નહિ, એવો એ અનુપમેય  
ને અનોખો છે. તે અત્યંત ગતિમાન હોવા છતાં—યા તે કારણો  
જ—ખૂબ સ્થિર છે, પેલા ભમરડાની જેમ.

ટૂકમાં, એ માનવી બ્યક્ઝિટ હોવા છતાં માનવી બ્યક્ઝિટ  
નથી, પરંતુ તે જે વિરોધાભાસી ગુણોનું વર્ણન આપણે પ્રભુ વિષે

કરીએ છીએ તે પરમ તત્ત્વનો શરીરધારી આવિભાવ છે.

(‘જીવનસંદેશ’, આ.૨, પૃ. ૩૨૩ થી ૩૩૨)

\* \* \*

મુક્તાત્માનો કાયદો બધો અંતરનો હોય છે. એને નિયમ હોય છે પણ ખરા ને નથી પણ હોતા; તેથી ત્યાં માત્ર નર્ધુ માનવીના અજ્ઞાન જેવું સ્વચ્છંદ પ્રવર્તે છે, એમ માનવાની ભૂલમાં પડવાનું નથી. એને તો જે તે બધું દીવા જેવું સપદ્ધ દેખાતું હોય છે, તેથી એને સ્થળ, કાળ, મર્યાદાની સમજણ રહે છે, ને પ્રત્યેકના ઉદ્ય, સ્થિતિ અને લયના ભાવની પણ સહજપણે નિમિત્ત થવાતાં-પ્રગટ્યાં કરે છે, જેમ આરસીમાં કેંક સામે આવતાં દેખાય છે તેમ. એટલે તે જાણે હાલતોચાલતો ન હોય તેમ વર્તે છે. તેના પેટનું પાણી પણ ન હાલતું હોય અને હાલતું હોય તો એટલા વેગવાળું હોય કે તેની લાગણી, ભાવના-તે વેળાની-કોઈ પણ માનવીની લાગણી, ભાવનાની સાથે સરખાવી શકાય તેવી હોતી નથી. એ કશામાંથીયે ચલિત થતો નથી, ને ચલિત થાય છે તો તેની સહજ-ગતિમાં; એટલે એની સ્વયંભૂ ગતિમાં ચલિત થતો હોય છે. તે કદ્દી મૂંજાયેલો હોતો નથી. તેવી રીતનો દેખાય કે આપણને લાગે, પણ તેની ભૂમિકા તો તદ્દન શાંત પ્રકારની હોય છે; તટસ્થ રહેવાની જીવતી કળા તેને સાંપડી ગઈ હોય છે, એટલે તેનામાં તો આનંદ સદાય પ્રવર્તતો હોય છે. (‘જીવનપ્રેરણા’, આ.૩, પૃ. ૧૯-૨૦)

\* \* \*

મુક્તાવસ્થા પ્રાપ્ત થયા બાદ તેવા આત્મામાં સામસામા જણાતા એવા ગુણોનું પ્રાગટ્ય થતું તે અનુભવી શકે છે; જેમ કે કૃપા અને અવકૃપા, દ્વારાણુતા અને કઠોરતા, પરવા અને બેપરવાપણું, ગુણ અને અવગુણ; આમ તેવો તે પોતે કોઈ પણ

સંસારી જીવ કરતાં પ્રેમ-ભાવના ગુણમાં સર્વથી શ્રેષ્ઠ થતો જાય  
અને તે સાથે સાથે અપ્રેમના પ્રદેશમાં પણ રહી શકતો પોતાને  
અનુભવી શકે છે. એવાનું પણ ચોક્કસ કશું ધોરણ કે માપ રહી  
શકતું હોતું નથી. એવો પછી કોઈ ચોકઠામાં પણ રહી શકતો  
હોતો નથી. ('જીવનપ્રેરણા', આ.૩, પૃ. ૧૨૫-૨૬)

\* \* \*

મુક્તાવસ્થા એટલે સ્વચ્છંદતા નથી. આપણી માનુષી Whims-મનના તુકા કે તરંગો-પ્રમાણે તેમાં ચાલવાનું નથી હોતું. લખલૂટ ખર્ચ કરતો હોવા છતાં, વૈભવવિલાસ ભોગવતો હોવા છતાં, યા ધેર ધેર રખડતો ને ભીખ માંગતો હોવા છતાં, બૈરાં-છોકરાંવાળો હોવા છતાં તેમ જ વેપાર જેડતો હોવા છતાં, ટૂંકમાં ગમે તે ક્ષેત્રમાં ગમે તે પ્રકારે તે હોવા છતાં, તે મુક્ત હોઈ શકે છે. મુક્તાવસ્થામાં જેમ સ્વૈરાચાર કે વિહાર નથી તેમ તેમાં કશાં બંધન પણ નથી. તેમાં આમ જ વર્તાય એમ પણ નથી. કારણ મુક્તને એવા કશા વિધિનિર્ધેદ નથી. સામાન્ય રીતે એ જે કરતો હશે તે આપણી સમજમાં નહિ આવે અથવા ન યે આવે, કારણ કે એની સમજ અને આપણી સમજમાં ફેર હોય છે.

\* \* \*

જીવ જ્યારે ચેતનમાં નિષા પામે છે, ત્યારે એનામાં રહેલો પુરુષ જાગ્રત બની જાય છે. પુરુષના આધાર વડે જ એની અનુમતિથી પછી પ્રકૃતિ બધાં કામ કરતી હોય છે. પુરુષ નિર્ણય છે ખરો અને તદ્દન પાછળ રહે છે, પરંતુ ચેતનની દશામાં તે સભાન અને પૂરેપૂરો જાગ્રત બને છે. તેનામાં તે વેળા સાક્ષીપણું, ભર્તાપણું તથા સમતા, તાટસ્થ્ય આદિ ગુણો જીવતા થયેલા છે, એટલું જ નહિ પરંતુ તે તે રીતે કામ કરતા થઈ ગયેલા હોય છે; એટલે પ્રકૃતિ અને તેના ત્રણ ગુણો અને ઈદ્રિયો પોતપોતાના

વિષયમાં જેમ પ્રવર્તતી હોય તેની સાથે તે ઓતપ્રોત નથી, પરંતુ સાક્ષીરૂપે રહે છે. પોતાની સંમતિની મહોર ક્યાં આપવી અને ક્યાં ન આપવી તેનું તેને શાન મળેલું છે.

\* \* \*

મુક્ત દશાને પામેલા આત્માઓ આપણા વિષે કદી ગેરસમજૂત કરતા હોતા નથી. આપણે જ એમના વિષે ગેરસમજૂત કરતાં હોઈએ છીએ. જો કોઈ ગેરસમજૂત કરે એવા હોય તો એને જીવનમુક્તનું લેબલ ન લગાડી શકાય. આપણે ઊભાં રહેલાં છીએ દુંદ્ધની ભૂમિકા પર અને એ જો સાચા સંત હોય તો તેઓમાં દુંદ્ધ હોવા છતાં દુંદ્ધની ભૂમિકામાં તેઓ ઊભેલા નથી. આપણાં સમજણ, માપ, ધોરણ એ બધાં બહુ બહુ તો નૈતિક ધોરણ પર અવલંબેલાં હોય છે. ભેદમાં અભેદ હજુ આપણે અનુભવી શક્યાં નથી. જગત તો અભેદમાં ભેદ જુએ છે, જ્યારે તે લોકોનું તેવું કશું હોતું નથી; પરંતુ તેનો અર્થ એવો નથી કે એ લોકો અનૈતિક છે. તેઓ જીવનની પરમ આદર્શ સ્થિતિમાં પહોંચવાને માટે જીવનની તેવી તેવી સ્થિતિઓમાંથી પસાર થઈ ગયેલા હોય છે; જેમ હોડીમાં બેસીને નદી પાર કર્યા બાદ હોડીને સાથે રાખવાની જરાકે જરૂર રહેતી નથી, તેવી રીતે તેવા લોકો સાધનનો ભાર ગળે વળગાડીને ફર્યા કરતા હોતા નથી. એવા લોકોને આપણાં માપ, સમજ, ગણતરી કે કલ્પનાથી માપવાનું કરવું એ જ આપણું અજ્ઞાન છે. સંત આપણને કદી ગેરસમજૂત ન કરે. એ તો ભૂલેલાનો જેટલો છે તેટલો કોઈનોય નથી—જો પેલો તેમનો થવાને હૃદયથી ખરેખરું ઝંખતો હોય તો.

(‘જીવનપ્રવેશ’, આ.૧, પૃ. ૧૨૦-૧૧)

\* \* \*

જીવનમુક્ત થતાં એને કર્મ નથી હોતાં એમ તો નથી. જેમ બ્રહ્મ નિર્જિય હોવા છતાં પાછો કિયમાણ પણ છે, તેમ જીવનમુક્ત

કર્મ કરતો હોવા છતાં તેમાં નિષ્ઠિયપણે રહી શકવા તે પ્રકારનાં શક્તિ, જ્ઞાન, ભાવવાળો તે પ્રગટેલો પણ હોય છે; એટલે એને કર્મ નથી એમ ભલે કહી શકાય.

આત્યંતિક અનુભવ ક્યાં જઈને વિરમે છે એમ નિશ્ચયાત્મકપણે કહી શકતું નથી. તે કારણથી પણ જ્ઞાનયુક્ત ચેતનાપ્રેરક તટસ્થતાની અત્યંત જરૂર રહે છે. એવાને (મુક્તને) લાગણી, વૃત્તિ, વિચાર, ભાવના વગેરે નથી થતાં એમ તો નથી, પણ એ એને આવવા દે છે. એ તો જેના તેના નિમિત્તસંપર્કથી તેવું તેવું ઉદ્ભવે છે ને એનો જ્ઞાનપૂર્વક ઉપયોગ કરવાની કણા એવાને પ્રાપ્ત થયેલી હોય છે.

(‘જીવનપ્રવેશ’, આ.૧, પૃ. ૧૭૦-૭૧)

\* \* \*

મુક્તાવસ્થા પ્રાપ્ત થતાં એક એવી અવસ્થા બની રહે છે કે જેમાં પ્રાકૃતિક ઈચ્છા, આશા, કામના, અહમ્ વગેરેને ઉત્પન્ન થવા દીધા વિના, પોતે એકાગ્ર ને કેન્દ્રિતપણે પ્રભુભાવમાં સતત એકધારો રમી રહેલો હોય છે. તેવાને શ્રીભગવાન જે કંઈ અનુભવ કરાવે, તે સ્વીકારી તેનો રસ ભોગવવાની આંતરિક કણા તેના હૃદયમાં જાગેલી હોય છે. એમાં સ્થૂળ પ્રાણ કશો પણ ભાગ ભજવતો હોતો નથી. સ્થૂળ-પ્રાણ, સૂક્ષ્મ-પ્રાણ, ને કારણ-પ્રાણ કરતાંયે સાધના થતાં થતાં એ ત્રાણ પ્રકારના કરતાં એક એવા પ્રકારના પ્રાણનું જન્મવું થતું હોય છે કે તેથી તે પછી સર્વ જે તે કંઈના ભોગના સામર્થ્યની સંપૂર્ણ શક્તિ ને સર્વ પ્રકારના મૂળનો રસ ગ્રહણ કરી, સ્વીકારી, એનો ભોગ કરવાની શક્તિ તેનામાં પ્રગટતી જતી તે અનુભવી શકે છે.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૩૧)

\* \* \*

કોઈ જ્ઞાની કે અનુભવી ભગવાનનો પ્રેમી ભક્ત જગત  
સાથેના વ્યવહારમાં તો જગતના સામાન્ય માનવી જેવો જ લાગ્યા  
કરવાનો. એની દ્વંદ્વાદિક વૃત્તિ જેમ કે કામ, કોધ, લોભ, મોહ,  
મદ, મત્સર વગેરે તેના મૂળ સ્વરૂપે તેનામાં નહિ હોય; પરંતુ  
તેવા પ્રકારની રૂપાંતરિત ભાવના તેના જીવનમાં પ્રગટેલી રહે છે  
ખરી. પહેલાં જેમ જીવદશાની પ્રકૃતિની વૃત્તિઓ તે વેળા બીજા  
જીવોની સાથે ઉપભોગમાં, ખપમાં આવતી હતી, તેમ હવે તે તે  
વૃત્તિની પેલી રૂપાંતરિત થયેલી ભાવના ભાગવત હેતુ અર્થે બીજા  
જીવના જીવન પરત્વે ઉપયોગમાં પ્રવર્તે છે. વિષ, ઝેર આમ તો  
પ્રાણનાશક છે; પરંતુ યોગ્ય રીતે મારેલું ઝેર દવા તરીકે ઘણું જ  
પ્રાણવાળું ને જીવન ઉગારનારું નીવડે છે. તેવી રીતે જીવપ્રકારની  
વૃત્તિઓનું રૂપાંતરિત થયેલું સ્વરૂપ ઉપયોગમાં આવી શકે છે;  
પરંતુ બીજાં માનવીઓને એની એવી કશી ગતાગમ પડી શકે  
નહિ. બધાં માણસો તેવાને યોગ્ય રીતે સમજી શકે એ પણ શક્કય  
નથી. એવાને સમજનાર માત્ર ગણ્યાંગાંક્યા હોવાના.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૨૬૯-૭૦)

\*

\*

એવાઓ તો કોઈ પરમ આખરના સત્ય વડે પોતાનું જીવન  
નિયત કરતા હોય છે. આવા ઉચ્ચ જીવનની સાચી અસર પામવા  
માટે કે તેને સમજવા માટે સ્થળ પુરાવા હોઈ શકે નહિ. એ તો  
એવાના જીવનમાં જિજ્ઞાસાભાવે પ્રેમભક્તિથી જે દૂબવા માંગતો  
હોય ને પોતાની પ્રકૃતિના થરોને સમજી સમજીને, મથીમથીને  
યાહોમ થઈ જઈને પલટાવવા માગતો હોય, એવા કોઈક જીવને  
એમાં કંઈક સમજ પડવાની. બાકીનાંને તો તેની કશી ગતાગમ  
પડવાની નથી, તે જાણજો. (‘જીવનમંથન’, આ.ર, પૃ. ૨૭૩)

\*

\*

એવું બને છે ખરું, કે જેની આશા, ઈચ્છા નિર્મળ થઈ ગઈ  
 છે ને અહ્મૃથી મુક્ત બનેલો છે તેવો મુક્ત આત્મા અને જેની  
 હજુ આશા, ઈચ્છા, વાસના, અહ્મૃ આદિ પ્રવર્તમાન છે તે  
 બન્ને એક જ બાધ્ય પરિસ્થિતિમાંથી, પ્રસંગમાંથી, પસાર થતા  
 હોય, ત્યારે કોઈ ગ્રીજાને તો તેમની આંતરિક પરિસ્થિતિમાં કશો  
 ફરક ન લાગે. પરંતુ તે બન્નેને પ્રસંગ, સ્થિતિ એક જ હોવા  
 છતાં દિલમાં દિલથી જે ભાવ જાગે છે, સુઝે છે, તે પ્રસંગનું જે  
 Reaction—અંતરમાંની પ્રતિકૂતિ—એમના સત્ત્વમાં જાગે છે  
 તેમાં આસમાનજમીનનો ફરક હોય છે.

(‘જીવનસંશોધન’, આ.ર, પૃ. ૧૮૫)

\* \* \*

### મુક્તનો અંતરંગ સ્વભાવ

(અનુષ્ટુપ)

અકર્મ કર્મમાં એને કર્મ અકર્મ લાગશે,  
 નિરાગ્રહી નિરાસક્ત એવો સર્વ પ્રવર્તશે.

સૌ કું આનંદના ભાવો એવાનામાં વધ્યાં કરે,  
 પ્રત્યેકમાં પછી તેવો સમાધાનપણો રહે.

ઉપાધિ સૌ ઉપાધિ ના એવાને લાગશે હદે,  
 પ્રસન્નતા તણી માત્રા એની ઓછી ન ત્યાં થશે.

જે જે પ્રવૃત્તિમાં પેસે ગમે તેવી ભલે હશે,  
 છતાં આનંદ તેમાંયે એનો તો સરખો હશે.

છો ગમે તેટલું જાણું કામ હો, તોય ભાર કું,  
 એને ના લાગશે ત્યારે-તે લીન ભાવમાં રહે.

આદું કે અવળું કેંયે એવાને નવ લાગતું,  
યથાર્થતા બધાં કર્મ જ્ઞાનભાવે ઊજ્યાં જતી,  
પ્રેરાયેલી ભલેને હો પ્રકૃતિ ગુણ-ભાવથી,  
કારક મૂળનો ભાવ પ્રિધાયા ત્યાં જશે નકી.  
એને તે વેળ કેં યત્નો કદી ન કરવા પડે,  
નદીનાં વ્લેણની પેઢે ભાવમાં તે વહ્યાં કરે.

(‘જીવનપગલે’, આ.૧, પૃ. ૬૮ થી ૭૦)

### ગુલામ

વાહક તે પ્રભુનો છે, પોતાનો શેઠ તે છતાં,  
ભાવ પ્રત્યક્ષ એવો તે ઓળખતો હશે સદા.  
ચળાવી ન શકે કોઈ એવાને કોઈ વાતથી,  
પ્રીણી પ્રીણી છતાં હેતુ, રહે એવો નિરાગ્રહી.

(‘જીવનપગલે’, આ.૧, પૃ. ૧૪)

પોતાનાથી થતું જે સૌ કર્યા તે કરશે બધું,  
કર્મ તેવાં મહીં જ્ઞાન, જાગૃતિ રાખતો સહુ.  
હેતુનો ઘ્યાલ હૈયામાં જીવતોજાગતો ધરે,  
ભૂલે છે ના કદી એને જે તે કર્મ બધાં વિષે.  
પોતાની જાતને નોખી જે તે સૌ કર્મથી ગણે,  
ના કશું અડવા દે તે નિઃસ્પૃહી એવું વર્તશે.  
તદાકાર છતાં એવો જે તે સાથ રહ્યાં કરે,  
સહાનુભૂતિ રાખીને સમભાવ ધરી હુદે.

તોયે તે કોઈની પૂછે છેડાતો નથી કશો,  
છેડાતો જણાયો હો, ત્યાંયે હેતુ હશે ઊંડો.

(‘જીવનપગલે’, આ. ૧, પૃ. ૨૦)

શા સ્વભાવે કરાયેલાં બીજાનાં કર્મ તો હશો,  
-જણાયા વિશ ના રે’ છે તે, જો દે લક્ષ તે વિષે.

કર્મની ગૂઢતા એને લાગશે ના, છતાં પૂરો,  
અજાણ્યો તે રહે એવો ને કશું નથી બોલતો.

કર્મ-નિર્માણની વેળા કર્મના પરિણામને,  
હોય ના જાણતો એવો વર્તતો જગમાં રહે.

એને ના માનવાનું છે ‘આ’ કે ‘પેલું’ કશુંય તે,  
‘આ’ અને ‘પેલું’ ના જુદું; પરિવર્તન માત્ર તે.

બીજાનું રૂપ જેવું હો તેનીયે સાથ એકતા,  
સહાનુભૂતિ રાખીને તેવો તો વર્તશે સદા.

ક્યાંક ઊંઘો, છતો ક્યાંક, કશે તે આંદું વર્તશે,  
એવાનાં સર્વ કર્માં હેતુ ન્યારો રહ્યા કરે.

સર્વને એક રીતે તે ભાસશે એકરૂપ ના,  
કોને વિકૃત રૂપે ને કોને સીધો જણાય ત્યાં.

એને જે માપવા જાય, એની કસોટી જે કરે,  
મોડા વ્લેલા પડે હેઠા, ચોળતા હાથ તે રહે.

પેલાને તો કશું ના છે પોતાનામાં રમ્યાં કરે,  
બધું બાધ્યાંતરે એ તો પ્રતિબિંબ સમું જુએ.

બે આંખો રાખી પોતામાં ત્રીજથી જેલ નીરખે,  
એને ખોવાનું ના ક્યાંયે, પ્રાપ્તિ-આશ ન ક્યાંયછે.

જે તે સંબંધીઓ સાથે વર્તશે તે જુદો જુદો,  
નૈસર્જિકપણે એવો પોતા જેવો પ્રવર્તતો;  
છતાં એનું બધું ઉંધું, એવો સરળ વર્તને,  
જેવી જેની હશે વૃત્તિ, તેને તે તેમ લાગશે.

ઠેકાણું કોઈ વાતે ના, ઠેકાણું સહુ વાતમાં,  
વિરોધાભાસી ગુણોનો એવાનો મેળ લાગતો.

બંધાયેલો અને મુક્ત, રાગી-વિરાગી લાગશે,  
છતાં એવો ન છે એ તો, એનો ભાવ વિરાટ છે.

ભાવના જુદી જુદીમાં જેવું વર્તન બાળનું,  
સ્વાભાવિકપણું એનું તે ઉચ્છૃંખલ લાગતું.

એની તે વૃત્તિ ના એક, એક શી લાગતી ભલે,  
બધે રોકાયેલો રે' તે, વિચરે ભાવથી બધે,

એક બાજુ વહે ક્યારે, બીજી બાજુ વળી સ્થિર,  
ત્રીજી બાજુ જુએ જુદું, જુદો જુદો છતાં નથી.

લક્ષણો ક્ષેત્ર ને દિશા એનાં ના એકદેશીય,  
એવાને માનવી-માપે માપી કેમ શકાય રે ?

માનવી-બુદ્ધિનામાં તો એની પ્રવૃત્તિ ના ઠસે,  
એની પ્રવૃત્તિ, નિવૃત્તિ બેમાં ભેદ ન છે કશે.

એના કર્તવ્યમાં છે ના કાંઈ કર્તવ્ય એક શું,  
કશું જ્યાં એ કરે ના, ત્યાં તોય તે કરતો ધણું.

એની વાળી મહીં કેંક ભેદ જુદા જુદા રહે,  
એમાંથી મર્મ કોઈયે પૂરો ખોળી નહીં શકે.

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૧૫, ૧૮, ૩૫, ૪૧, ૪૨, ૪૩)

પક્ષાપક્ષી ન ક્યાંયે છે એને કોના વિષે કશી,  
જે પક્ષાપક્ષી માને છે એના જ ઉર તે વસી.

\* \* \*

આરસી સામને આવી જે કો ઊભું જરી રહે,  
પ્રતિબિંબ છતાં ત્યાંયે પડી એવાનું ત્યાં જશે;  
પરવા છાંયની સાથે આરસીને કશી ન તે.

થયાં ત્યાં સૌ કરે જે તે એવાની આસપાસ કેં,  
એનામાં આપમેળે તે આવીને લુપ્ત થાય છે.

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૪૩)

હુદે નિશ્ચિંતતા એની ડો’ળાશે કોઈ રીત ના,  
પોતાના ભાવને યોગ્ય રહે તે લીન આપમાં.

એક જેવો ન તે રે’શે છતાં એક રહ્યાં જશે,  
એનું એકપણું એવું દોહ્યલું પરખાવું તે.

જે જેવા હોય તે સાથે તાદાત્મ્ય તેમ રાખશો,  
એનો સ્વભાવ ના એક, વૃત્તિવાળો અનેક તે.

કોઈને કેં કહે તેથી, એને એવો ન જાણવો,  
નિરાળો તે રહી સૌથી પોતાનામાં રહે વધ્યો.

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૪૩, ૮૯, ૧૧૩)

\* \* \*

## મોહ

યોગ્ય જીવનનું ભાન જાગવા નવ મોહ દે,  
કેવો તે જરૂરી રાખે ! છુટાવા નવ દે અરે !

મોહ જીવનનો ધર્મ સૂજવા નવ દે ખરો,  
એના એ જ વિચારોના કુંડળામાં ભમાવતો.

શુભ સંસ્કાર પામેલાં એવાં માનવી હો ભલે,  
કિંતુ શાં મોહના પાશે જકડાયાં રહ્યાં કરે !

(‘પુનિત પ્રેમગાથા’, આ.૨, પૃ. ૪૧)

પોતે બંધાઈ રે’વું ને બીજાને બાંધી રાખવો,  
પ્રેમ તો નામ ના એનું; એ તો મોહ ગણો ઘણો.

પ્રેમ ને મોહની વચ્ચે ભેદ કેવો અનંત છે !  
મોહ ને પ્રેમ ના એક, જુદાં જુદાં સ્વરૂપ તે !

મોહના સ્પર્શ જાહુથી માનવી ત્યાગ સૌ કરે,  
એવા ત્યાગે ભલીવાર જીવને ના કશો મળો.

મોહથી ત્યાગ જે થાય ઊલટો જીવને ઘણો,  
-બંધાવ્યાં તે કરેછે શો ! ત્યાગ તે ‘ત્યાગ’ ના ગણો.

પ્રેમનો માટીનો દેહ મોહને જાણવો ખરે !  
બનાવે આંધળુંભીત એ તો જીવનને અરે !

મોહ તો માત્ર બાંધે છે પાટા આંખ પરે પૂરા,  
તણાયા જાય શા લોક મોહના વ્હેણમાં ખરા !

એવાને કોઈ જો આવે સત્ય હૈયે સુજાડવા,  
એને તે સત્ય ના લાગે એવો મોહ-પ્રભાવ ત્યાં.

શક્તિ હોવા છતાં, મોહ શક્તિ શી હરી લે બધી !

હરી લે બુદ્ધિની સાન, અદ્ભુત મોહની ગતિ.

(‘પુનિત પ્રેમગાથા’, આ.૨, પૃ. ૪૧, ૪૨, ૧૬૦, ૧૬૨)

\*

### યુદ્ધની અનિવાર્યતા

સારુંયે જીવન—સમગ્ર વિશ્વ—યુદ્ધથી જ જીવતું રહે છે, એટલું જ નહિ પરંતુ યુદ્ધથી તે ઘડાય છે અને યુદ્ધથી તે વિકાસ પામે છે. યુદ્ધના કારણો એની જૂની વિચારસરણી, જૂની ઘરેડ, જૂનાં માપો, જૂનાં મૂલ્યાંકનો, જૂની ટેવો અને બીજી એવી અનેક પ્રકારની ધારણાઓ, માન્યતાઓ ને જીવનની લઢણો—એ બધાંને સખ્ત આધાત લાગે છે; પરિણામે કંઈક નવા તત્ત્વને—જે જીવનમાં પ્રવેશવા કાજે જરૂરનું હોય છે તેને—પ્રવેશવા માટેની ભૂમિકા પણ યુદ્ધથી જ રચાય છે.

યુદ્ધના પ્રકાર અનેક જાતના છે. તે સ્થૂળ અને સૂક્ષ્મ પણ હોઈ શકે છે. પ્રત્યેક ભૂમિકામાં યુદ્ધનાં સ્વરૂપ પણ જુદાં જુદાં રહેવાનાં. યુદ્ધની સ્થિતિમાં મુકાયા વિના માનવ-મનમાં કદી પણ મંથન જાગતું નથી, ને મંથન વિના ઊંઠું વિચારવાને તકલીફ પણ લેતું નથી. યુદ્ધ સલામત દશાને દેશવટો આપીને સાધકને જીવનવિકાસને જરૂરી એવી નવી નવી પરિસ્થિતિમાં ધક્કેલી દે છે.

યુદ્ધ એટલે માત્ર સ્થૂળ હિંસા એવું કશું નથી. યુદ્ધથી એકલું ખંડન જ નથી થતું, મંડન પણ થાય છે. માનવીની બુદ્ધિના કેન્દ્રો પણ જુદી જુદી જાતનાં યુદ્ધ જાગે છે. જુદી જુદી કામના, આશા, લાલસા ને વાસનાનાં પણ યુદ્ધ જાગ્યાં કરે છે. એક ઈચ્છા ઉદ્ભબવી તો તેની સામેની બીજી ઉદ્ભબવીને અથડામણ ઊભી કરાવે છે.

માનવી ઈચ્છે કે ન ઈચ્છે તોપણ આવાં યુદ્ધોમાં તેને ઘસડાવું પડે જ છે; અને અનેક પ્રકારનાં હંદ્રોનાં યુદ્ધ દ્વારા સૃષ્ટિમાં ભગવાનનો દિવ્ય સૂક્ષ્મ હેતુ સધાયો જતો હોય છે.

માનવીને પોતાનાં સ્વજનો જેવાં માની લીધેલાં મંતવ્યો, સમજણો, ટેવો, આગ્રહો, અભિપ્રાયો, ગમા-આશગમા, રુચિ-અરુચિ તેમ જ પ્રાણની કામનાઓ, લાલસાઓ, વાસનાઓ અને પડેલા સંસ્કારો-આવાં બધાં સ્વજનોને હણવા—સંહાર કરવા—તેનું મન તૈયાર હોતું નથી, કે તૈયાર થતું નથી. માનવીના જીવન-કાળમાં એક પરિસ્થિતિ ઉત્પન્ન થતાં જે સ્વર્ધર્મ લાગે છે, તે જ સ્વર્ધર્મ' બીજી પરિસ્થિતિમાં અર્ધર્મયા પરર્ધર્મપણ લાગવા માંડે છે.

પોતાના શરીરને જે માનવી જીવરૂપ જ માને છે, જેનો તે રાગી બની જાય છે, જેનામય જે થઈ જાય છે, તેને પણ છોડવું પડે છે, ત્યારે વાસના એનો કેડો મૂકતી નથી; ત્યાં પણ એના કર્મે તો યુદ્ધ જ લખાયેલું છે. આમ આદિથી તે અંત સુધી માનવીના જીવનમાં ઉત્તરોત્તર યુદ્ધના આકાર ને પ્રકાર બદલાતા રહીને સતત યુદ્ધમાં તેને ઘસડાવું જ પડતું હોય છે.

(‘જીવનસંગ્રામ’, આ.પ, પૃ. ૧ થી ૩૬)

\* \* \*

### યુદ્ધ, અનિવાર્ય (અનુષ્ટુપ)

યુદ્ધ તો છે અનિવાર્ય, યુદ્ધ જીવનમાં બધે;  
યુદ્ધને જે નકારે છે, નકારે તત્ત્વ જીવને.

વિશ્વમાંયે જીવે જે તે યુદ્ધ આપ્યાં કરી ખરે,  
વિના યુદ્ધ કદી જીવ કશામાંયે ન પાંગરે.

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૧૮૧)

વस्तु મેળવવા કાજે મસ્તી ઉદ્ભવવી ઘટે,  
યુદ્ધ-મસ્તી વિના કોઈ ના વસ્તુ મેળવી શકે.

(‘પુનિત પ્રેમગાથા’, આ.૨, પૃ. ૭૭)

ધ્યેયને પામવા કાજે ધરે જે આશ જીવવા,  
જિંદગીને ઘડે તેવા, છેફાં તો માનવી બીજાં.

જીવનધ્યેયના માર્ગ યુદ્ધમાં જે ખપી જશે,  
પોતાને ધન્ય માને તે; એવા ભાવ જીલી શકે.

(‘પુનિત પ્રેમગાથા’, આ.૨, પૃ. ૭૭)

\*

\*

(જૂલાણા)

તે જ શૂરવીર કો એકલો જરૂરશે,  
મંથને ઝેર ત્યાં છો નીકળતાં,  
પૂરું પચવી જશો ઝેર એવું ધણું,  
તો જ તે તત્ત્વ અમૃત પામો.

મથવું એ જીવન-આનંદ પ્રગટાવવા,  
એમ ગણીને જ જે યુદ્ધ ખેલે,  
મૃત્યુ એને કરી શું શકે ત્યાં ભલા ?  
મૃત્યુ ગળી ત્યાં જશે આપમેળે.

યુદ્ધ અનિવાર્ય છે જીવનના પંથમાં,  
સહેવું તે સકળને ભાગ આવે,  
પણ જરૂર્યાં કર્યે જીતશે તે ખરે,  
આખરે વિજય-વરમાળ હેરે.

(‘જીવનપગલે’, આ.૧, પૃ. ૫૩)

\*

\*

## લગ્ન-ભાવનાનો હેતુ યાને યુગમભાવના

બે જીવોનું જોડાણ, અહેતુકપણે કદી પણ થવું શક્ય નથી. એ બે જીવોનો સંબંધ અનેક જરૂર-જરૂરમાંતરોમાં કોઈ ને કોઈ રીતે-એક યા બીજા રૂપે-ચાલુ રહ્યાં કરેલો હોય છે. એક વાર દિલથી લગ્નથી જોડાયેલા બે જીવોનો સંબંધ કદી છૂટી શકતો હોતો નથી.

('જીવનસંદેશ', આ.૨, પૃ. ૬૪)

\*

\*

લગ્નભાવના માત્ર એકલા ભોગવિલાસ માટે નથી. એ તો તપશ્ચર્યા માટે છે. સમાજનું, દેશનું, પિતૃઓનું, ઋષિઓનું ઋણ અદા કરવા માટેનું એ ઉત્તમ સાધન છે. હદ્યથી શુદ્ધ સાત્ત્વિક ભાવના કેળવીને આત્માના સ્વરૂપમાં એકબીજાને ઓળખીને જે જગતને ચરણે એકાદ બુદ્ધ ભગવાન, એકાદ ઈશુ ભગવાન, એકાદ શંકરાચાર્ય કે એકાદ જ્ઞાનદેવની ભેટ ધરશે, તેણે જગતની મોટી સેવા કરી લેખાશે. લગ્ન એવી પ્રજોત્પત્તિ માટે છે.

('જીવનસંદેશ', આ.૨, પૃ. ૬૫)

\*

\*

બે જીવોના લગ્નસંબંધથી તે જીવોસમાજના જીવન સાથે ભાગ લઈ રહેલા છે. માનવીના સંબંધો ને ભાવના એ લગ્નજીવનમાંથી કેળવાતી જતી સ્થિતિ પરથી બંધાતા જતાં હોય છે.

લગ્નની ઉત્તમ ભાવનાનો વિચ્છેદ થવો કદી શક્ય નથી. એની પાછળ કર્મસંબંધ રહેલો છે.

('જીવનસંદેશ', આ.૨, પૃ. ૬૬, ૬૮)

\*

\*

લગ્નસંબંધ એ પવિત્ર ભાવના છે. એ ભાવના એટલે તો પુરુષ-પ્રકૃતિનો હદ્યથી સુભેણ સાધીને પરમ ચેતનને જાણવું, સમજવું ને અનુભવવું.

('જીવનસંદેશ', આ.૨, પૃ. ૭૨)

\*

\*

આપણા લગ્નનો આદર્શ હૃદય-હૃદયથી જોડાવાનો ને એક થવાનો છે; પરંતુ તે સ્થૂળ રીતે ન હોય, ‘જોડાવું’ એટલે બંધનમાં પડવું એવો અર્થ ત્યાં નથી. (‘જીવનમંથન’, આ.ર, પૃ. ૧૧૧)

\*

\*

સામાન્ય માનવી માટે લગ્ન એ જરૂરી વસ્તુ છે. તે મર્યાદાની પણ જરૂર છે. જેમ જેમ તેમાં ભાવનાનું તત્ત્વ ઉમેરાતું જાય તેમ તેમ લગ્નની ભાવના ઊર્ધ્વ થતી જાય છે. આપણે તો પાર્થિવ તત્ત્વથી પર થવાનું છે, તે એને અવગાણીને, એના પરત્વે તિરસ્કાર સેવીને બની શકવાનું નથી, એમ કરવાથી એનાં મૂળ પલટાઈ શકવાનાં નથી. એ તો એનું દુપાંતર કરવાથી તે સાધી શકાશે. આમ પાર્થિવ લગ્નની સાથે આપણે જાજી લેવાદેવા ન હોવી ઘટે. હૃદય હૃદયની એકતા સધાય અને તેમાંથી ભાવના પ્રગટે અને એ ભાવનાથી કરી આપણા જીવનનાં દષ્ટિ, વૃત્તિ અને વલણ ઊર્ધ્વગામી બને તે રીતે સાધનામાં લગ્નજીવનનો ઉપયોગ છે. એનાથી બીજી રીતે સાધનામાં એને સ્થાન નથી.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૧૧૧-૧૨)

\*

\*

પોતાની સાથે જોડાયેલા જીવની જે કોઈ જીવ અવગાણના કરે છે, તે સમાજની પણ તે દ્વારા અવગાણના કરી રહેલો છે. ભલેને એ બે જીવ એક સમાન કલ્યાના ન હોય; તેથી શું થઈ ગયું? શું બેમાંથી ઊંચા પ્રકારના જીવે પોતાની હાર કબૂલવી? એમ કરવા જતાં તો તે વધુ ને વધુ નબળાઈ વહોરી લેવાનો છે. નબળાઈનો સામનો નબળાઈ વધારીને નહિ, પણ વધારે સબળા થઈને કરવાનો હોય. જીવે જો જીવનવિકાસ સાધવો હોય તો પ્રત્યેક પરિસ્થિતિ પર જીત મેળવવી ઘટે ને એમાંથી જીવંત શક્તિ

જન્માવવી જોઈએ. એવી લગ્નની ભાવનાનો વિચ્છેદ થવો કદી શક્ય નથી. એની પાછળ તો કર્મસંબંધ રહેલો છે.

પ્રત્યેક જીવ શિવ થઈ શકે છે એવો દઢ આત્મવિશ્વાસ આપણામાં જાગવા દો. એવું શિવપણું જો જીવમાં ન હોત તો જીવકોટિમાં તે અવતરી જ ન શક્યો હોત. કોઈ જીવ ક્યારે શિવ થઈ શકશે તેના સમયની મર્યાદા ન આંકી શકાય; પરંતુ તેથી કરીને તે જીવ પોતાનો જીવસ્વભાવ બદલી શકવાનો જ નથી એમ માની લેવું તે યથાર્થ નથી. એની અવધિની કોને ખબર? આવતી કાલે પણ બદલાય. અજામીલ, ગીધ, વ્યાસ, વાલ્મીકિ, સૂરદાસ (બિલ્વમંગળ) વગેરેની દેખીતી પ્રકૃતિની પાછળ કોઈ ગૂઢ અગમ્ય દૈવી સંસ્કારો પડી રહેલા હતા જ. એ સંસ્કારો કોઈ જીવમાં ક્યારે ઊગ્ણી કે ફૂટી નીકળશે તે કોણ કહી શકે? આથી જ કોઈ પણ જીવની જીવપ્રકૃતિને ઘ્યાલમાં આણવી તે નિરર્થક છે, એટલું જ નહિ પણ સાધકને માટે ભાવનાના વિકાસમાં તે બાધક છે.

(‘જીવનસંદેશ’, આ.૨, પૃ. ૬૮-૬૯)

\*

\*

પતિપત્નીનો સંબંધ પણ અંતે તો શા માટે છે? તેનો અંતિમ હેતુ શો છે? વ્યાષ્ટિમાંથી સમાષ્ટિમાં પ્રગટી તન્મય તદાકાર થઈ એક જીવંત ચેતના-પ્રવાહરૂપ થવાને માટે લગ્નનો સંબંધ છે. જીવનમાં સુષુપ્ત પડી રહેલી વાસનાઓ સંપૂર્ણપણે દિવ્ય રૂપાંતર પામી જાય, દિવ્ય ચેતનાશક્તિમાં પરિણામ પામે, તેવા હેતુને માટે લગ્નસંબંધ છે.

(‘જીવનસંશોધન’, આ.૨, પૃ. ૮૪)

\*

\*

## નવદંપતીને

(શાર્દૂલવિકીડિત)

આજે એક બન્યાં તમે જીવનમાં ‘પત્ની’ ‘પતિ’ ભાવથી,  
યાત્રા જીવનના સદા પથ વિષે રે’જો ઘણા પ્રેમથી;  
છે આ વિશ્વ સમસ્ત એક બનવા, એ કાજ સંસાર છે,  
એ હેતુ તણું જ્ઞાન, ભાન જીવતું રાખી જીવો જીવને.

સાચા પ્રેમ તણો થતાં ઉદ્ય ત્યાં તૂટે દીવાલો બધી,  
પામો જીવન-એકતા; સકળમાં રે’ જોવું તે ભાવથી;  
સદ્ગ્રાવે કરી જીવતાં જીવનનો લહાવો કંઈ ઓર છે !  
એવું જીવન ગાળતા જગતમાં, તે ધન્ય જીવો ખરે !

એ પ્રાણાર્પણ તો થવું સહજ છે, કિંતુ પૂરું ભાવથી,  
હૈયાંથી મન એકમેક જીવવું એ દોહાલું કર્મથી;  
સર્વ અંતરના પટો હઠી જઈ એકાત્મભાવે થવું,  
—એ તો કેવળ સાધના થકી બને; એ જીવવું દોહાલું.

સૌ સામાન્ય પથે બધાં જગ-જનો ચાલ્યાં કરે તે મહીં,  
—શો પુરુષાર્થ રહ્યો મહા ? રસ કશો તે જીવને શો વળી?  
જેમાં મૌલિકતા નથી, જીવન તે મિથ્યા જીવું જાણવું,  
જેમાં છે બલિદાન, યજા-તપ છે, એ જીવું, જીવું ભલું.

બન્ને એકબીજાની કાજ જીવને હોમાવું છાજો ભલું,  
બન્ને એકબીજાની સાથ રહીને પંથે ધપો વેગીલું;  
બન્ને એકબીજ વિષે હદ્યમાં એકાત્મભાવે ચહો,  
એવી સર્વ કમાણી જે કંઈ કરો, અર્પો પ્રભુપાદશ્રી.

બન્ને જીવન ધેયમાં રત થઈ એ પંથમાં જીવતાં,  
—સહેવાનું કંઈ આવતાં, તપ ગણી તે તે સ્વીકારો સદા;  
કોઈ કોઈથી ઊંચું નીચું નવ છે, જે જે મળે સર્વ તે,  
—પોતાના જ વિકાસ કાજ મળિયું, તે ગ્રહો જીવને.

જે જે સર્વ થયાં કરે, જીવનનો જો હેતુ ત્યાં ભાગશો,  
તો મિથ્યા નવ તે જશો, પણ નવું તે જીવને પામશો;  
જ્યાં જ્યાં વિઘ્ન, કૃપા ત્યાહી પ્રભુ તણી માની, સદા જીવતાં,  
આપોઆપ થયાં જશો જીવનનું કલ્યાણ ત્યારે ભલાં !

(‘જીવનસંદેશ’, આ.૨, પૃ. ૧૦૦ થી ૧૦૨)

જે જે સર્વ થયાં કરે, પ્રભુ તણો જે હાથ ત્યાં નીરખે,  
એને તે સહુ પ્રેરણાત્મક બને ને જીવને તે વધે;  
ને મેળાપ થવો પરસ્પર જગે બે વ્યક્તિનો વ્યર્થ ના,  
‘એ તો સર્વ વિકાસ-યોગ્ય રચના’ એ જાણી મ્હાણો કૃપા.

(‘જીવનસંદેશ’, આ.૨, પૃ. ૧૦૨)

### બહેનો પ્રત્યેનું વલણ

(અનુષ્ટુપ)

આદર-ભક્તિનો ભાવ માતા, બહેનો પ્રતિ ઊડો,  
—જગાડ્યાં કરવો હૈયે આર્ત ને આર્ક્ર પ્રેમથી;  
સ્ત્રીઓ તો વિશ્વની માતા; તુચ્છતાપાત્ર તે નથી;  
એમને તુચ્છકાર્યથી આપણું બગડે નકી.

માનવીએ બનાવીને પોતાની લાલસા તણી,  
—એને ભોગ, ગુલામીને વિશ્વમાં નોતર્યા કરી.

જ્યાં સુધી માનવીનામાં પવિત્ર ભાવના ઊડી,  
—જગશે ના સ્ત્રીઓ પ્રત્યે, માનવી પશુ ત્યાં સુધી.

વિશ્વનું કોત્ર તો સ્ત્રીઓ; એને જે ભાવના મહીં  
—ઉંચે યથાવતો, સેવા કરે અમૃત્ય વિશ્વની.

(‘જીવનસંદેશ’, આ.૪, પૃ. ૧૮૮)

\* \* \*

### લક્ષ્મી (ધન) તરફની દણ્ણિ

ધનની ગણતરી કર્યી કરવાની નથી. એ જેટલું આ માર્ગમાં સારું છે, તેટલું જ સારું એનો અયોગ્યપણે ઉપયોગ, વ્યવહાર ન થાય તે જોવાનું કામ છે. ધનના સંગ્રહની હૂંફનો કદી વિચાર સરખો પણ ન આવવા દેવો. તો એમ થાય કે, ‘એમ હોય તો ધન પાસે રાખવું જ શું કામ ? હોય તો એનો વિચાર આવે ને ?’ પણ આ વિચાર બરાબર નથી. જેમ દેહ, ઈંડ્રિયો આદિ આપણામાંનું તત્ત્વ વિકસાવવાની ભૂમિકા માટે મળેલાં છે અને એ ભૂમિકા પૂરતાં તો એ વાસ્તવિક અને જરૂરનાં છે, તેવી રીતે ધન તરફ આપણી દણ્ણિ હોવી ઘટે. વળી જેમ કોઈને સ્વાદનું ભાન જ ન હોય ને ગોતા જેવું ખાય એમાં કશી મહત્ત્વા નથી, પણ જેને સ્વાદની પરખ હોય તેમ છતાં જો એ પ્રસંગ પડું એવું કરે તો તેમાં યથાર્થતા ગણાય, તેવી જ રીતે ધન પ્રતિ આપણે જેવું ઘટે. પૈસો ન હોય ને પોતે પોતાને બિખારી સમજે એમાં તે શી નવાઈ ? પરંતુ પાસે નાણાં હોય તેમ છતાં પોતાને બિખારી સમજે ને એવું નમ્ર વર્તન રાખ્યાં કરે, તો લાભ જરૂર થાય.

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૪)

\* \* \*

પૈસાદાર લોકોના પૈસાએ જગતમાં ધણો અનર્થ ઉપજાવ્યો છે. અણાઘડ લોકો એ શક્તિને આજે સંગ્રહીને બેઠા છે. એના સહૃપયોગની કળા તેઓ જાણતા નથી. તેઓ તો ભોગવિલાસમાં ઝૂબેલા છે. ધન એ તો એક સમર્થ શક્તિ છે. એનું પાસે હોવાપણું

ખોટું નથી. એના પ્રતિની આપણી વિચારસરણી, એને દિવ્ય હથિયાર, સાધન તરીકે વાપરવાની કળા, એના ઉપયોગની જ્ઞાનપૂર્વકની સમજણ આપણને હૃદયથી પૂરાં સમજાયાં નથી. તેથી આ બધો ગુંચવાડો ઊભો થાય છે.

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૨૩૦)

\*

\*

કાંચન તરફની શ્રીરામકૃષ્ણ પરમહંસની જે નફરત હતી તેવું વલણ ને તેવા જ સ્વરૂપે લક્ષ્મી પ્રતિની દસ્તિ, અનાસક્તિ દરેક સત્પુરુષમાં પ્રગટવી જોઈએ એવું કશું નથી; એટલું જ નહિ પણ કથામાંથી ઊઠી જવાને બદલે પૂરેપૂરા ઠંડે કલેજે પોતાના મહેલને બળવા દેવાની જનક રાજના જેવી, તે જ સ્વરૂપે, અનાસક્તિ વ્યક્ત થવી જોઈએ એમ પણ આગ્રહ કે સમજણ ન રાખી શકાય. કાળે કાળે ને સૌ સૌની ઢબે રીતો જુદી હોવાની. અનાસક્તિ વ્યક્ત થવાના પ્રકારો અમુક જ હોય અને અમુક રીતે જ તે વ્યક્ત થાય તો તે સાચું અને બાકીનું બધું ખોટું એવી માન્યતા કે સમજણ યથાર્થ નથી. ધનનો પરિગ્રહ ન સેવીને, બીજાને સુપરત કરી દઈને કે દાનમાં વાપરી નાંખીને અકિંચન થઈ રહેવાને સ્થાને તેનો અત્યંત વ્યવસ્થિત હિસાબ રાખીને ધનનો યોગ્ય ઉપયોગ સાધનાના વિકાસાર્થે ને પ્રભુના હેતુ અર્થે સમર્પણભાવે થાય એવી જ્ઞાનયુક્ત જીગૃતિ રાખીને પણ સાધક ધન પરત્વે સંપૂર્ણ અનાસક્તિ રાખી શકે છે, યા કેળવી શકે છે.

(‘જીવનસંશોધન’, આ.૧, પૃ. ૨૪૧)

\*

\*

જીવન શું પૈસાદારને જ વરેલું હશેકે? જે જીવનમાં ભાવનાની કદર નથી, ભાવનાનું મૂલ્ય નથી, ભાવનાનો મર્મ જે જીવન સમજતું નથી, તેવા જીવનને શું કરવાનું? જો જીવને જીવનની

સમજણ ને દાખિ જ ન હોય તો પૈસાનો સંગ્રહ શા ઉપયોગનો? જીવનવિકાસને અર્થે તો એવા બધાનો હેતુ ને ઉપયોગ છે. જો એનાથી જીવન ઘડાતું ન હોય ને ઊલટું જકડાતું જતું લાગતું હોય તો એ પૈસાને શું કરવાના? એવા પૈસા આપણા વહાલામાં વહાલા સ્વજનના શબ જેવાછે. પૈસાનું આવી રીતનું ને આટલું બધું મહત્વ જીવનમાં વિકૃતિ પ્રગટાવે છે. જીવનસંસ્કૃતિની તેજસ્વિતા ઘટતાં પરિણામ તો એવું જ આવે ને?

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૨૩૧)

\*

\*

### વાતાવરણની અસર

આપણી આસપાસ એક બે નહિ પણ અનેક પ્રકારનાં બિન્ન બિન્ન વાતાવરણ છવાયેલાં, ફરી વળેલાં હોય છે. આની જાણ સામાન્ય જીવને હોઈ શકતી નથી. જીવને વાતાવરણ હલાવી મૂકે છે ને તેના બણે એક ચા બીજા પ્રકારે તે ઘડાય છે. સાધકનું કર્તવ્ય અનિષ્ટ સૂક્ષ્મ વાતાવરણમાંથી ઊગરી જવાનું હોય અને તે માટે એક રસ્તો કંઈ પણ પારમાર્થિક, એટલે કે પ્રભુના, સતત વિચારમાં કે તેવા ભાવ સાથે કોઈ કાર્યમાં સતત સખત મંડ્યા રહેવાનો છે. મનને સતત સાત્ત્વિક રીતે પ્રવૃત્તિશીલ રાખવાથી આપણી ઉપર બીજા વાતાવરણની અસર થતી નથી. ‘સાત્ત્વિક રીતે પ્રવૃત્તિશીલ’ એટલે એવી પ્રવૃત્તિ કે જેમાં મનને આસક્ત થવાપણું રહેલું ન હોય, એ પ્રવૃત્તિ સ્થૂળ કાર્યની હોય તો તેમાં પણ સતત ભગવદ્ભાવ રહેવો જોઈએ ને તે પણ સમર્પણભાવે.

આધારનાં કરણોમાં મન સૌથી વધુ સૂક્ષ્મ કરણ હોઈ તેને વાતાવરણ તરત સ્પર્શ છે ને હલાવી શકે છે. ઈન્દ્રિયસ્પર્શોથી ઉદ્ભવતા સ્થૂળ વાતાવરણમાં મન પછિડાય છે, તેના કરતાં સૂક્ષ્મ વાતાવરણમાં તો તે વધુ અફળાય છે. સત્સંગ ને દુર્જનસંગ એ

બેઠુને લીધે થતા મન પરના આધાતો એ આંચકા વધુ અસરકારક હોઈ અનુકમે મનને તે વધુ લાભ કે હાનિ પહોંચાડે છે. મન ઈન્દ્રિયો કરતાં વધુ શક્તિશાળી છે. ગમે તેટલા ઉગ્ર સંયમથી બધી ઈન્દ્રિયોને પોતપોતાના વિષયમાંથી જેંચી લીધી હોય, તેમ છતાં મનથી તે તે ઈન્દ્રિયોના વિષયના સેવનનો વિચાર થતાં પેલા સંયમથી ઊભું કરેલું વાતાવરણ ક્યાંયે નિરર્થક ને મિથ્યા થઈ જતું હોય છે. (‘જીવનસંદેશ’, આ.૪, પૃ. ૨૧૬-૧૭)

\*

\*

જીવનવિકાસના માર્ગમાં ગુણોની વિશુદ્ધિ જેટલી આવશ્યક છે, તેથી કદાચ અનેકગણી વધારે વિશુદ્ધિ આવા વાતાવરણની સાધક માટે છે. પોતાના રાહબર પ્રત્યે અશ્રદ્ધા કે અસદ્ધભાવનું મનનું કે એવા કશાનું એક પણ મોજું-લહરી-ન થાય એ જોવાનું કામ તેને માટે વધુ આવશ્યક બની જાય છે. આવી દસ્તિ અને શુદ્ધિ સારા વાતાવરણથી સર્જ શકાય છે. સારું વાતાવરણ ઊભું કરવા માટે ખરાબનો સામનો કરવા કરતાં સારાનું બળ વધારવાનો પ્રયત્ન કરવો એ વધારે સહેલો ઉપાય છે. બળવાન આત્મા પોતાનામાંથી વાતાવરણ સર્જવે છે. એવા આત્માને બીજું વાતાવરણ અસર કરી શકતું નથી.

ગમે તેવા ખરાબ વાતાવરણની અસર તળે આપણે હોઈએ પણ પ્રભુકૃપાથી જો કોઈક ધન્ય ક્ષણોમાં શુભ, સારા સંસ્કારનાં મોજાં આપણાને સ્પર્શી જતાં લાગે ને એને પકડી લઈએ એવી કળા હસ્તગત થઈ જાય, તો આપણે આપણામાં નવું જીવન સર્જવી શકીએ છીએ. અસદ્ધ વાતાવરણમાં પડેલા હોવા છતાં કોઈ સંસ્કાર-બળે આપણું જો સત્સંગમાં બળવાનું બન્યું તો લાભ થવા પૂરતો સંભવ છે. થોડાક સમયને માટે જૂનું વાતાવરણ આપણી સામે રહેશે ને એનું ગુંજન ને અસર આપણા પર રહ્યાં

કરશે; પરંતુ જો પેલા, બીજા, સદ્વાતાવરણનું બેંચાણ વધુ હશે અને જો આપણે હદ્યના ભાવભર્યા સ્મરણ સાથે જૂના વાતાવરણમાંથી દિલને હઠાવવાનું નક્કી કર્યું હશે, તો નવા સદ્વાતાવરણને જમતાં વાર નહીં લાગે.

(‘જીવનસંદેશ’, આ.૨, પૃ. ૨૩૨, ૨૩૪-૩૫)

\* \* \*

### વાણીનો સંયમ

વાણી ઉપરનો જાગ્રત કાબૂ સાધકે કેળવવાનો રહે છે. વાણીથી વેડફાઈ જતી શક્તિનો સદુપયોગ નામસ્મરણમાં કરવાનો હોય. વાણી કે વચનની પણ શક્તિ હોય છે. જો સ્થૂળ ધનને આપણે ગમે તેમ વેડફિ દેતા નથી, તો વાણીધનને કેમ વેડફિ દઈ શકાય? વચનમાં તો દરિદ્રતા જ શોભે. વાણી ઉચ્ચારણમાં કંજૂસ બનવાનું છે.

કોઈને વણમાગી શિખામણ કે બોધનાં વચન કથવાં નહિ. વણ-ઈચ્છયું ક્યાંય કશે માથું મારવું નહિ.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૨૩)

\* \* \*

ઓછામાં ઓછું બોલવામાં ઘણા લાભ છે. હેતુપૂર્વકની મધુર વાણી, ને તે પણ જ્ઞાનપૂર્વકની સદ્ભાવયુક્ત, જ્યારે ઉચ્ચારાય છે, ત્યારે તેવી વાણીમાં પ્રાણ પ્રગટેલા હોય છે. વાણી કંઈકને જન્માવેછે, કંઈકનું રક્ષણ કરેછે ને કરાવેછે; કંઈકને મૃત્યુ પમાડે છે. વાણી એ જેમ સમર્થ શક્તિરૂપે છે, તેમ તેનું—વાણીનું—અવ્યક્ત સ્વરૂપ અંતર્મુખપણું તે મૌન છે.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૨૩, ૨૪)

\* \* \*

હદ્યથી બોલાતી વાણી એટલે પશ્યંતિ વાણી, ગળાથી

બોલાતી વાણી તે મધ્યમા, ને જીભથી બોલાતી વાણી તે વૈખરી અને એ બધાથીયે જે વાણી પર છે તે પરા વાણી. આપણે બધાં તો હજુ વૈખરી વાણીની દશામાં છીએ.

(‘જવનપોકાર’, આ.૪, પૃ. ૧૭૨)

\*

\*

જેટલું ઓછામાં ઓછું બોલાય તેટલું ઉત્તમ છે. અઠવાડિયાના એક બે દિન મૌન લેવાય તો ઉત્તમ. મૌન લેવું તે બેળેબેળે નહિ. (‘જવનપોકાર’, આ.૪, પૃ. ૨૯૮)

\*

\*

સાધક વાતોના રસમાં તણાયા કરે તે ઈષ્ટ નથી. વાતોનો રસ ઝેરી રસ છે. ક્યાં, કેટલું, શું ને કેવું બોલવું તેનો સૂક્ષ્મ વિવેક કેળવવો જોઈએ.

\*

\*

### વિઘ્નો-મુશ્કેલીઓ

આપણી મુશ્કેલીઓ આપણને વેગ આપતી થઈ જવી જોઈએ. મુશ્કેલીઓ છૂપા વેશમાં આશીર્વાદ સમાન છે. જેમ વાડ કૂદવાની હોય છે, ત્યારે જરા પાછળ હઠીને દોડીને કૂદવાની રહે છે, તેમ એવી પીછેહઠ આપણી ગતિને જોશ આપે છે, અથવા શરતના ઘોડાઓને કેળવવાને વચ્ચે વચ્ચે Hurdles—લાકડાની વાડો—મૂકવામાં આવે છે તેમ આપણું પણ છે. પ્રત્યેક વિઘ્ન પ્રભુ આપણા હિત માટે અથવા તો આપણને સ્પષ્ટ ભાન કરાવવા, સચેતન બનાવવા, કે આપણે ક્યાં છીએ અને કઈ દિશામાં જતા હતા તે બતાવવા માટે મોકલે છે. સાધક એવાં વિઘ્નોમાંથી, મુશ્કેલીઓમાંથી જે હેતુ ને અર્થ તારવે છે, તેના ઉપરથી તો તેની કક્ષા કે વૃત્તિ પરખાઈ આવે છે. વળી વિઘ્નની પાર થવાતાં પરમ પ્રભુની કૃપાળું દસ્તિનાં દર્શન થાય છે ને એનામાં વધુ ને વધુ

વિશ્વાસ-શ્રદ્ધા દેઢ થતાં જાય છે; આ કંઈ જેવો તેવો લાભ નથી. એ દસ્તિએ જોતાં વિઘ્ન એ વિઘ્ન નથી દેખાતાં ને નથી રહેતાં, જીલટાં શ્રેયસ્કર છે એમ અનુભવાય છે.

(‘જીવનસંશોધન’, આ.૨, પૃ. ૩૩)

\*

\*

### વિઘ્ન

(અનુષ્ટુપ)

વિઘ્ન ના સાંપડ્યું કોને ? બતાવો એક તો જગો;  
પામશે વિઘ્નથી લાભ વિઘ્નને જે વધાવશે.

વિઘ્નથી જીવને કો દી દબાઈ ના જવું કશું,  
પ્રેમથી સામનો એનો જે કરે, પામશે નવું.

જીવનધ્યેય પોતાનું દષે જે નિત્ય રાખીને,  
—ધ્યેય ફળાવવા સામે જગ્યામે વિઘ્ન, તે જીવે.

\*

\*

### વિચારો

માનવી જેવા વિચારોનું સેવન કરતો હોય છે, તેવા વિચારોનાં આંદોલનો, મોજાં, સ્વાભાવિક રીતે જ એની આજુબાજુના વાતાવરણમાં પ્રસરતાં હોય છે. એવાં મોજાનું દીર્ઘકાળ ટકવું કે દૂર સુધી જવું ને ગાઢી કે હળવી અસર ઉપજાવવી તે તેની પાછળની સંકલ્પશક્તિ ઉપર અવલંબે છે.

વિચાર એ પણ એક આંતરિક કર્મ છે. જેમ સ્થૂળ કર્મના સંસ્કાર નિશ્ચિત છે, તેમ આંતરિક સૂક્ષ્મ કર્મોના એટલે કે વિચારોના સંસ્કાર પણ નિશ્ચિત છે. આથી જેમ સ્થૂળ કર્મની યોગ્યતાની કાળજી જીવ રાખે, તેમ સૂક્ષ્મ કર્મોની એટલે કે વિચારોની યોગ્યતાની પણ કાળજી સાધકે અવશ્ય જાગૃતિપૂર્વક

રાખવાની રહે છે. વિચારો આપણને ઘડતા હોય છે. આપણું સ્થૂળ આચરણ માત્ર સારું હોય તે પૂરતું નથી.

જે કંઈ વિચારો આપણને ઉઠે તેનો યોગ્ય નિકાલ કરીને પાછા ખાલી કે શાંત થતા રહેવાનો જાગ્રત પ્રયત્ન કરવો ને મનમાં ઉકરડો કર્યા ન કરવો. વિચારોનાં કુંડાળાં ન કર્યા કરવાં, તેના વમળોમાં ઝૂબી ન જવું.

(‘જીવનપગથી’, આ.૩, પૃ. ૫, ૧૧, ૨૩)

\* \* \*

કર્મના સંસ્કારોને લીધે જે જે વિચારો ઉઠે તેના અંકોડા આપણે જોડવાના નથી. વિચારોની સાંકળ ન જોડ્યાં કરવી; તો જ તેનું જોર ને અસર ઘટાડી શકાશે. સાધનામાં આ એક મહત્વની કિયા છે. વિચારપરંપરાને સફળતાથી અટકાવવાની કિયા કરતાં રહીશું, તેટલે અંશે ચિત્તના સંસ્કારોની અસર આપોઆપ ભૂસાઈ જવાની છે. ત્યાર પછી જ આપણે કોરી પાટી (સ્લેટ) જેવા થઈ શકવાના.

(‘જીવનપગથી’, આ.૩, પૃ. ૧૧૧)

\* \* \*

આપણે બીજા વિષે અસદુ વિચારો કરીએ છીએ તો આપણે પોતાનામાં તો તેનાં બીજ વાવીએ જ છીએ, પણ સામાનામાં પણ તેવી ભાવના ઉપજાવીએ છીએ.

વિચારોને પણ સમર્પણ કરી દેવાના છે. વિચારો ન થાય એ ઉત્તમ છે; પણ કોઈ તામસ કે જડતાભરી પ્રકૃતિવાળાને વિચાર નહિ થાય, તો તે વળી પાછું સારું નથી. જેનામાં રજસ પ્રકૃતિ છે, તેનામાં તો વિચારો થવાના જ. સત્તવગુણપ્રધાન પ્રકૃતિવાળાને વિચારમાં સ્થિરપણું હશે, તોલન નહિ હોય, યદ્વાતદ્વાપણું નહિ હોય. (‘જીવનપગથી’, આ.૩, પૃ. ૧૮૭)

\* \* \*

નવી પરિસ્થિતિની છાયા એક વાર સમજાઈ જાય પછીથી કઈ એના આપણે વિચારો કર્યા કરવાના નથી. વિચારો ન તો એ પરિસ્થિતિ વિષે કરવાના છે કે ન તો તેની આગળપાછળના બનાવો કે સંજોગો વિષે. ('જીવનપરાગ', આ.ડ, પૃ. ૧૮૮)

\*

\*

નામસ્મરણનો જેટલો વધુ જોક રોજની પ્રત્યેક હિલચાલ વેળા અપાતો રહેશે તેટલા પ્રમાણમાં વિચારોનું ને તેના બળનું ઘટી જવું શક્ય બનશે. આ પ્રયોગ અજમાવી જોવા જેવો છે ખરો.

\*

\*

### વિવેકશક્તિ

પ્રભુ આપણી પાસેથી જે જાતની દિવ્ય જીવનની અપેક્ષા રાખે છે, તેવું જીવન પ્રાપ્ત કરવા માટે વિવેકશક્તિ અનિવાર્ય છે. બુદ્ધિની આ શક્તિનો યોગ્ય રીતે વિકાસ થયો હોય અને તેનો સદ્ગુપ્યોગ કરવાની જ્ઞાનપૂર્વકની ટેવ પડી હોય તો એથી સત્યની સૂજ પડતી જાય છે; તથા કઈ બાબતને કેટલું મહત્વ આપવું તેની પણ સમજણ પડે છે. આવી સમજણ વિના યથાયોગ્ય જીવન અશક્ય છે.

જીવ ચતુર હોય, હોશિયાર હોય, પણ એનામાં ડહાપણ—જ્ઞાન—ન પણ હોય. સાચા જ્ઞાનનું એક મુખ્ય લક્ષણ વિવેક છે. વિવેક વિનાનું જ્ઞાન અસંભવિત છે. વિવેક વિનાની લાગણી હાનિકારક છે. વિવેકશક્તિ ન હોય તો જીવનનો કોઈ હેતુ, કોઈ કારણ કે ધ્યેય રહેતું નથી.

વિવેકયુક્ત મનોદશા ને વર્તન માટે જે તટસ્થતાની આવશ્યકતા છે, તે તટસ્થતા અનાસક્તિ વગર અસંભવિત છે. તટસ્થતા અને અનાસક્તિ લગભગ પર્યાયવાચક શર્બ્દો છે, છતાં તેમાં બેદ છે. તટસ્થતાને એક રીતે અનાસક્તિનું પરિણામ પણ

## ગણી શકાય.

મનુષ્યમાં અંતર્ગત રહેલા પરમાત્મતત્વનો પૂર્ણ આવિષ્કાર થવામાં લાગણીનું આવરણ અવરોધકર્તા છે, પણ કદાચ વિશેષ અવરોધ તો બુદ્ધિનું આવરણ કરે છે. બુદ્ધિની પકડ લાગણીની પકડ કરતાં વધુ મજબૂત, આગ્રહી અને દીર્ઘકાળ પર્યત ટકનારી નીવડે છે. (‘જીવનસંદેશ’, આ.ર, પૃ. ૧૪૩ થી ૧૪૭)

\* \* \*

સાધકના મનમાં ઉઠતાં અનેક જાતનાં બુદ્ધિનાં, મનનાં, લાગણીનાં, પ્રાણતત્વનાં આદિ બળો તેને પરસ્પર વિરુદ્ધ દિશાએ ઘસડી જવા મથે છે, ત્યારે તેનું સમતોલપણું સાચવનાર આ વિવેકશક્તિ છે. તેને તો તે આંધળાને લાકડી સમાન થઈ પડે છે. દંભ અને આત્મવંચના કરનાર જીવમાં આ શક્તિ વિકસી શકે નહિ. પ્રત્યેક વિચાર, લાગણી, ભાવ, વર્તન આદિનું સત્યના જેવી કઠોરતાથી અને ન્યાયના જેવા નિર્દ્દ્ય નિષ્પક્ષપાતથી નિરીક્ષણ કરાવનાર સૂક્ષ્મદર્શક યંત્રની ગરજ વિવેકશક્તિ પૂરી પાડે છે. જીવનના મહાન કોયડાઓ વખતે જ નહિ, પરંતુ રોજબરોજના નાના નાના પ્રસંગોએ પણ આ શક્તિનો ઉપયોગ યોગયોગ્ય જીવન જીવવા માટે કરવો રહે છે. આમ થતાં આ ગુણને લીધે આપણા થનારા રૂપાંતરમાં સહાય મળતી હોય છે.

(‘જીવનસંદેશ’, આ.ર, પૃ. ૧૪૮-૧૪૯)

\* \* \*

## વિશ્વમાં અલિપ્ત વિશ્વેશર

(અનુષ્ટુપ)

શરીર આપણું લૂલું ભલે સાધન પાંગળું,  
કિંતુ કેવું જરૂરી તે ધર્મને પામવા ઉંસું !

વિશ્વ તેવી રીતે જાણો ઈશનું તે શરીર છે,  
શો અવ્યક્ત રહે નાથ સંતાપેલો મહીં બધે !

સંકળાયેલ છે પોતે છતાં તે રચના મહીં,  
અને એનાથીયે નોખો પોતે પાછો રહે કહીં.

વિશ્વમાં જ્ઞાન મૂકેલું વિશેશરે કૃપા કરી,  
કિંતુ બુદ્ધિ ભીલેલી ના તેથી તે પામતાં નથી.

વાયુ આકાશને કેવો ગૂઢ સંબંધ હોય છે !  
વાયુના ગુણદોષોનો સ્પર્શ આકાશને ન છે.

વાયુથી સાવ જુદું હો એમ આકાશ તો રહે,  
વાયુ જ્યાં નથી ત્યાંયે તે આકાશ વિઘમાન છે.

પ્રભુ એવો રહે વિશ્વે છતાં તેથી અલિપ્ત છે,  
છતાં સંબંધ પાસેનો ગાઢ ને ગૂઢ ત્યાં રહે.

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૧૩૮, ૧૪૮)

\*

\*

સ્વરૂપ પ્રેમનું વ્યક્ત વિશ્વની આ લીલા બધી,  
નચાવે પ્રેમ શું સૌને અગમ્ય કોઈ રીતથી !

એક પોતે રહ્યો કેવો છતાં રૂપ અનંત તે,  
ઉપજાવ્યાં કરે સૌને અંતર સંકળાઈને.

ગૂઢ અનંતતા કેરું શું રહ્યું બીજ એકમાં !  
‘અનંત’ ‘એક’ તો ભેગાં શાં રહે સ્નિગ્ધ પ્રેમમાં !

(‘જીવનપગલે’, આ.૧, પૃ. ૮૧)

\*

\*

## વैરाग्य અને સંન્યસ્ત

વैરाग्य એટલે સંસારવ્યવહાર પરત્વેની ઉદાસીનતા અથવા બેપરવાપણું એવી સમજણ સાચી નથી. જે જે કાળે, જે પ્રાપ્ત ધર્મ કર્તવ્ય હોય, તેનો યોગ્ય રચનાત્મકભાવે સ્વીકાર કરી, તેનું પાલન કરવામાં સાચા વैરાગ્યનો કદ્દી વિરોધ ન હોઈ શકે. ઉદાસીનતા વિષે પણ ગેરસમજ પ્રવર્તે છે. જે કંઈ આંતરસત્ત્વની રસવૃત્તિને હાનિ પહોંચાડી શકે તેવું હોય, તે પરત્વેની જ્ઞાનપૂર્વકની જાગ્રત ઉદાસીનતા સહજમેળે પ્રગટ્યાં કરે તે ઉદાસીનતા રચનાત્મક જીવનને વિકાસક ગાણાય.

સાચા વैરાગ્યની ભાવનાદશામાં સમતા, શાંતિ, ધીરજ, તાટસ્થ્ય આદિ સાત્ત્વિક ગુણો પ્રવર્તતા હોય છે. પરિગ્રહ કે અપરિગ્રહ એકેમાં તેવી ભાવનાદશાવાળો અટવાઈ પડતો નથી. જેને તેને તેની યથાર્થતામાં સ્વીકારવાને તે તત્પર રહે છે. જ્યાં પરિગ્રહની યોગ્ય જરૂર હોય તો તેને ઉપયોગભાવે જ્ઞાનપૂર્વક સ્વીકારતાં તેને વાંધો નથી હોતો. ઉપયોગના અર્થમાં જરૂર ન હોય તો તેનો ખાલી પરિગ્રહ કરવાનો શોખ પણ તેને હોતો નથી. જ્યાં જ્યાં આત્મસમર્પણની પ્રગટપણે જરૂર ઊભી થતાં ત્યાં ત્યાં તે તેમ કરવાને ઉધત રહે છે, ને જરૂર વિના અમથો અમથો ત્યાગ કરવાને તે ઉતાવળિયો પણ બનતો નથી હોતો. વैરાગ્યની સાચી ભાવનામાં તો જેમાં તેમાં સહજપણું પ્રગટેલું રહે છે; તેમાં કશા વિધિનિષેધોને સ્થાન હોતું નથી, કંઈ કશાથી છાલી ઊઠવાપણું નથી, કે ભાગી છૂટવાપણું નથી.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૩૭ થી ૩૮)

\*

\*

વैરાગ્યની પ્રણાલિકાના સંસ્કારમાં સંસાર અસાર ને મિથ્યા

છે એવી ભાવના જે પ્રવર્ત્ત છે, તે યોગ્ય નથી. સંસાર તો જેને  
શીખવું છે, તેને માટે પ્રત્યક્ષ ગુરુ છે, તે મિથ્યા ન હોઈ શકે.

(‘જીવનસંદેશ’, આ.ર, પૃ. ૨૦૨)

\*

\*

વૈરાગ્યને અને જીવનને પ્રાપ્ત થયેલા ધર્મ કર્તવ્યને ક્યાંયે  
વિરોધ નથી.

જે જાતનું નિભ જીવન આપણે જીવી રહ્યા હોઈએ તેમાંથી  
ઉપરામવૃત્તિ જાગે, તે પ્રતિ અરુચિ જાગે તો આવા પ્રકારના  
વલણને એક પ્રકારનો વૈરાગ્ય ગણી શકાય.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૨૮૮)

\*

\*

શાસ્ત્રોમાં વર્ણવાયેલો સંન્યસ્તનો ધર્મ ને હમણાં  
સાધારણપણે આચરાતો સંન્યાસીનો ધર્મ, એ બંનેના પ્રકારમાં  
આસમાનજમીનનો ફરક છે. ગીતાનો સંન્યાસ તે વૃત્તિનો સંન્યાસ  
છે. ગીતાનો ધર્મ મળેલી પરિસ્થિતિ અને મળેલા ધર્મથી  
ભાગવાની સ્પષ્ટ ના પાડે છે. તેને તે કાયરતા ગણે છે. જે  
કંટાળીને, ગ્રાસીને ભાગે, તે ધર્મના હદ્યને પામી શકતો નથી.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૩૬૭)

\*

\*

કોઈ પણ બાબતની આપણાને આસક્તિ ન રહે, રાગ ન  
રહે, મન કોઈ વાતમાં ચોંટી ન રહે, પ્રાણ કશાની કામના ન કરે  
એનું નામ વૈરાગ્ય. વૈરાગ્ય એટલે શ્રીભગવાનના ચરણકમળે  
હદ્યના સંપૂર્ણ ભાવે આસક્તિ.

સકળ કર્મ કરવા છતાં એમાં પૂરેપૂરી સંન્યાસવૃત્તિ એટલે  
સર્વ કર્મનો પૂરો સંન્યાસ. વ્યુત્પત્તિ પ્રમાણે તો એનો અર્થ એમ

થાય કે ‘સારી રીતે, સંપૂર્ણપણે, યોગ્ય રીતે ‘ડિપોઝિટ’ કરવું અથવા મૂકી દેવું તે’; એનો સીધો સાદો અર્થ તો એ કે બધાં કર્મો ભગવાનને સમર્પણ કર્યા કરવાં, એનું નામ સંન્યાસ. પેઢીનો મુનીમ લાખો કમાય અને લાખો ગુમાવે તે બધાનો હવાલો તો એ પેઢીને સોંપી દે છે.      (‘જીવનમંથન’, આ.ર, પૃ. ૩૦, ૪૨)

\*

\*

### વૃત્તિઓ

વૃત્તિ એટલે ગતિ. જો આપણાને સાચી વૃત્તિ—ગમે તે પ્રકારની તે હો—જાગી હશે તો તે ગતિ કરાવશે જ. એવી ગતિ જગે તો સમજવું કે વૃત્તિ જાગીછે. બાકી તો માત્ર સામાન્ય લહરી—વૃત્તિની લહરી—આવીને પસાર થઈ ગઈ એમ પ્રમાણવું.

પ્રભુએ આપણાને અનેક વિધવિધ પ્રકારની વૃત્તિઓ બક્ષી છે. તે બધીયનો દિવ્ય હેતુ છે. વૃત્તિની પાછળનો જ્ઞાનપૂર્વકનો હેતુ માનવી જો ગ્રીધી શકે તો કુદરતની એ તો એક મોટી ભેટ છે, એવું એને જ્ઞાન થાય.

આપણી વૃત્તિઓને, આપણે કેન્દ્રિત કરવાની રહે છે. જો તે વેરવિખેરપણે વહેંચાયેલી દશામાં પ્રવર્તશે તો તેનું બળ ઘટી જશે. તે પોતે જ આપણાને મદદરૂપ બને તેમ અંતે તેમનું નિયમન થઈ જવું રહે છે. આપણે તેના નચાવ્યા નાચવાનું મૂકી દેવું પડશે.

\*

\*

આપણી સર્વ વૃત્તિઓનો જીવનમાં સમન્વય કરવો પડશે. ભલેને એ બધી વૃત્તિઓ આમથી તેમ સ્વચ્છંદપણે પ્રવર્તતી હોય તોપણ જો એકાઉ કોઈ એવી ભાવનામાં ખૂબ દફનપણે ને તેના ઉત્કટપણામાં જામી ગયેલા થતા જઈશું, તો આપોઆપ બીજી વૃત્તિઓનું જોશ નરમ પડી જવાનું જ છે. જ્યારે આપણે અત્યંત કોધ ભરાયેલા હોઈએ છીએ, ત્યારે બીજી વૃત્તિઓ શાંત થઈ

ગઈ હોય છે ને કોધની વૃત્તિ જ મોખરે તરવરીને આપણો કબજો  
લઈ લેતી હોય છે; અથવા તો કોઈ ભારે ગુંચવાળા કોકડામાં  
તેને ઉકેલવાને માટે ખૂબ એકાગ્ર થયેલા હોઈએ છીએ, ત્યારે  
પણ એક વૃત્તિ મોખરે રહે છે. એટલે જો આપણે બીજી વૃત્તિઓને  
મોળી કરવી હશે, તેમનું સ્વચ્છંદીપણું મિટાવવું હશે તો સાધકે  
તેના ધ્યેયની ભાવનામાં ખૂબ ઉત્કટભાવે વળયાં રહેવું જોઈશે.  
તે વિના ધ્યેયની પ્રાપ્તિ થવી શક્ય નથી.

(‘જીવનપગથી’, આ.ડ, પૃ. ૧૦૧)

\* \* \*

### વૃત્તિનો ઉપયોગ

(અનુષ્ટુપ)

વૃત્તિથી આવરાતો જે વૃત્તિથી કેમ ઊગરે ?  
એવાને તો વિના વૃત્તિ બીજું તે કેમ સૂજશે ?

વૃત્તિ કેરા વળાંકોમાં કેવી શી લહરી ઊઠે !  
પોતે ત્યાં મહાલતો કેવું એનાથી પરખાય તે.

ઉઠતી સર્વ વૃત્તિઓ ‘પોતે કેવા’ જણાવશે,  
તેથી જે વૃત્તિને પૂરી બેસે સાચવી, તે જીવે.

વૃત્તિથી જે લહેરાય, તે સંકોચાય વૃત્તિથી,  
વૃત્તિને શક્તિ માની જે કામ લે, જીવતો નકી.

બને વૃત્તિ તણો દાસ વૃત્તિમાં જે તણાય તે,  
બુડાડે વૃત્તિ એને તો ઊંચે તે આવવા ન હે.

વૃત્તિથી હીર ખોવાય, જીવન-નૂર વૃત્તિ શું !  
વૃત્તિથી સૌ કમાવાય, સાચું હો હીર આપણું.

વृत्ति સાંભળજો\* તેથી ચગી ના વृત્તિથી જશો,  
વृત્તિને કામમાં લેજો લાભ મેળવશો પૂરો.

(‘જીવનપાથેય’, આ.૩, પૃ. ૧૨૫-૨૬)

\*

\*

(મંદાકાન્તા)

વृત્તિઓ તો કંઈક ઉઠતી ભોરમાં ઝાકળે શું !  
એનાં બિંદુ પ્રથમ કિરણો લુખ થાતાં દીસે સૌ.

\*

\*

વृત્તિઓ જે મન મહીં થતી તે કરી સૌ નિહાયા,  
-ક્યાં ક્યાં એનું અવળુંસવળું પારખી લેવું ત્યાં ત્યાં;  
જ્યાં જ્યાં એની અવળી ગતિ ત્યાં ના જવું એની પૂઠે,  
એવી રીતે રહી નીરખતાં, કામ ત્યો એની સાથે.

\*

\*

મિનારાઓ લાખો જગજન ચણો વૃત્તિઓ લૂલીથી તે;  
સમો આવે ત્યારે કડકભૂસ થૈ તે મિનારા પડે છે.

(‘પુનિત પ્રેમગાથા’, આ.૨, પૃ. ૧૪૪, ૧૪૮)

\*

\*

વ્યક્ત-અવ્યક્ત

(જૂલાણા)

વ્યક્ત-અવ્યક્તના ભેદ વાણી તણા, સત્ય હકીકતરૂપે તે ન જુદા,  
ભેદ-અભેદના ભાવમાં ફેર છે, તત્ત્વરૂપે કશો ફેર ત્યાં ના.

સચ્ચિદાનંદની જે સ્થિતિમાં રહે, વ્યક્ત એને કહી તે શકાયે,  
એ થકી પારની જે અનુભવ-દશા, વ્યક્ત કો’થી કરી ના શકાયે.

---

\* સંભાળજો

મન અને ઈન્દ્રિયો, ચિત્ત ને પ્રાણથી, હદ્ય-આધારથી જે જણાયે, વ્યક્ત એ સમજવું, વ્યક્ત સૌભાવ એ, હદ્યના ભાવથી તે જણાયે.

ભાવનાનું ઘનીભૂત થવું એ જ છે, ચિત્તના ક્ષેત્રની સીમ માંહે, કલ્પના ચિત્ત-વ્યાપારનો ભાગ છે, કલ્પનાતીત છે ભાવ રસ તે.

વ્યક્ત તેથી ખરે ! ચિત્તથી પર વસે, જાણજો વ્યક્ત તો ભાવરસ તે, વ્યક્તનું રૂપ તે તે છે કશું ના કશો, ભાવશું એકલા તત્ત્વરૂપે.

તે મનેન્દ્રિય પરે, ચિત્ત વૃત્તિ પરે, લાગણી ભાવનાથી પરે છે, વ્યક્ત તે ભાવથી અનુભવે આવશો, લક્ષથી અલખ માંહે જવાશો.

વૃત્તિ તો લહરી છે, ભાવના રૂપમાં, ફેરવાવી ભરો પ્રાણ એમાં, ચેતનારૂપ એ આપ બનશો તદા, ચેતનાને કરો શક્તિરૂપે.

શક્તિનું હદ્ય તે વ્યક્તનો ભાવ છે, ત્યાં બધા ખેલ ને રમત ખેલે, કલ્પનાતીત છતાં કલ્પનાગમ્ય છે તેથી તે પકડમાં આવી શકશો.

જે થયો સ્થિર પ્રજ્ઞા વિષે ભક્ત તે, વ્યક્ત સૌ ભાવ કેરા પ્રદેશે, જે ગુણાતીતની છે દશા વર્ણવી તે અવ્યક્તે જરા કંઈ પ્રવેશે.

બ્રહ્મ, પરબ્રહ્મ, પરમાત્મ ભાવે હદે વ્યક્તના ભાવમાં તે રહ્યો છે, પરમ પુરુષોત્તમે જે દશા પામશે તે અવ્યક્તે જશે ભાવ પર થૈ. સૂક્ષ્મથીયે ખરે સૂક્ષ્મ તે ભેદ છે વ્યક્ત અવ્યક્તના કોઈક જાણો, મૂર્ખ અજ્ઞાનીના યત્ન ત્યાં વર્થ છે ના કશું ત્યાં ગજું રાંકનું છે.

(‘જીવનપાથેય’, આ.૩, પૃ. ૧૫૪ થી ૧૫૬)

\* \* \*

### વ્યાષ્ટિમાં સમાષ્ટિનો ઉકેલ

જીવનની સાધના એ કંઈ જીવનથી નોખાપણે નથી. સમગ્ર જીવનને જીવવાના કોઈ એક કાળથી જેમ નોખું પાડી શકતું

નથી, અથવા તો જીવનના કોઈ એક પાસાને કે જીવનના કોઈ એક Mood-(ભાવતરંગ-ઉત્કટ લાગડી ભરેલી વિવશતા)-ને તેના તેના સમગ્રપણામાંથી તદ્દન અલગપણે આપણે છૂટો પાડી શકતા નથી, તેમ સાધનાનું પણ સમજવાનું છે. ‘જગત સાથે આપણે શી લેવાદેવા છે ? જગત જગતનું ફોડી લેશે’ એવી માન્યતા ભરેલી છે. પ્રત્યેક વ્યક્તિ જગત સાથે સંકળાયેલી જ છે, કોઈ કોઈનાથી વાસ્તવિકપણે જુદું થઈ શકતું જ નથી— જો કે જ્યાં સુધી જીવનની સાધનામાંથી એક પ્રકારની સમાધાનવૃત્તિ ન ઊગી હોય, ત્યાં લગી આપણે સાધનાર્થે એકાંતમાં કું એકાગ્રપણામાં કું એકાંગીપણામાં ભલે તન્મય રહ્યાં કરીએ તે સમજાય તેવું છે; (ત્યારે પણ જે જે વખતે જે પરિસ્થિતિ ઊઠે એને નકારી તો શકાય જ નહિ) જગત આપણાથી જુદું છે એમ કલ્યાંબું, માનવું કે સમજવું તે યોગ્ય પણ નથી. આપણે જગતમાં છીએ ને જગતમાંના એક છીએ તે પણ જ્યાલમાં રહેવું ઘટે છે. જગતના અનેક પ્રશ્નો અને સમસ્યાઓ પોતપોતાનો ઉકેલ માગી રહેલાં છે. તેનો ઉકેલ આણવાને આપણે અધીરાં ન બનીએ; સ્વસ્થતા, ધીરજ રાખીએ; પણ કદીયે એની ઉપેક્ષા તો ન જ કરીએ. આપણા પોતાના જ જીવનમાં અનેક પ્રકારના પ્રશ્નો અને સમસ્યાઓ અણઉકલ્યાં રહેલાં છે. જેટલા પ્રમાણમાં જ્ઞાનભક્તિયોગપૂર્વક અનુનિરાકરણ આપણે કરી શકીશું તેટલા પ્રમાણમાં જગતના પ્રશ્નો પણ હલ કરવાની ચાવી આપણને મળતી રહેવાની છે; એટલે કે જગતના પ્રશ્નો પણ તેટલા પ્રમાણમાં હલ થતા આવ્યા સમજવાના છે. જે પોતાના જ જીવનને પૂરું સમજ શક્યો નથી, સમગ્રપણામાં અનુભવી શક્યો નથી, તેવો જીવ જગતની સમસ્યાઓનો ઉકેલ કદી પણ કરી શકે નહિ.

(‘જીવનસંદેશ’, આ.૪, પૃ. ૨૮૭-૮૮)

\*

\*

## શક્તિનાં રમકડાં

(શિખરિષ્ણી-મંદાકંતા)

ઘડાયે છે, જે જે નિજ જીવનમાં દુઃખને શીર્ષ વૃહોરે,  
ઘડાયે છે, જે જે અવર જનને કારણે યજ્ઞ માંડે;  
ઘડાયે છે, જે જે નિજ જીવનને પ્રેમભાવે સમર્પે,  
ઘડાયે છે, જે જે નિજ જીવનને ભેટ માની જ વર્તે.

ઘડાયે છે, જે જે નિજ જીવનમાં ટોચ આદર્શ રાખે,  
ઘડાયે છે, જે જે નિજ જીવનને લક્ષ્યવેધી બનાવે;  
ઘડાયે છે, જે જે નિજ જીવનના હેતુ કાજે જવે છે,  
ઘડાયે છે, જે જે સતત નિજનો ભાવ એમાં ધરે છે.

જનો જેને સેવા અવર જનની માનતા તે મહીંયે,  
—કંઈ રાગ-દ્વેષો તહીં પડી રહ્યા કોણ જાણી શકે તે ?  
મહત્વાકંક્ષાએ નિજ હદ્યની શુદ્ધતાથી ભરેલી,  
—પડેલા સેવામાં નિજ જીવનના તત્ત્વનું શ્રેય પામે.

ખરો સેવાર્થી તે નિજ મન સદા જે ઉકેલ્યાં કરે છે,  
થરો કેવા કેવા મન મહીં ભર્યા, તે સદા જે નિહાળે;  
નિહાયાથી એવું કંઈ નહિ વળે ખાલી જો તે નિહાળે,  
ઘડાશે એવો જે વિરલ વીરલો યુદ્ધ તે સાથ માંડે.

નથી સેવા પોતે નિજ પટ મહીં એકદેશીય ક્યાંયે,  
રહ્યાં સેવામાંયે વિવિધ રીતનાં લક્ષ્ણો, ક્ષેત્ર, દિશા;  
ખરી સેવા એ તો નિજ જીવનને સર્વતોમુખી રાખે,  
રૂધી ના રાખે કો નિજ જીવનની એક બાજુ મહીં તે.

કરે સેવા પોતે અવર જનની તે જ જે સત્ય માને,  
થતી સેવા કેવી નિજ જીવનની તે ન તેઓ તપાસે;  
વરેલા છે જેઓ નિજ જીવનમાં સત્યને કોઈ રીતે,  
તહીં તેઓ સત્યે નિજ જીવનમાં સર્વ અંગો તપાસે.

કરે છે સેવા જે નિજ જીવનમાં માત્ર સેવાની કાજે,  
નથી કોઈ વાંધા અવર પણ કેં એક સેવા વિના ત્યાં;  
કદી જો તે સેવા પણ નવ કરે સર્વઅંગી વિકાસ,  
રહેલી ત્યાં ખામી કહીં પણ કંઈ જાણી લેવી ઘટે જ.

(‘જીવનપગલે’, આ.૧, પૃ. ૩૯-૪૦)

(મંદાકાન્તા)

‘પોતે જે જે કંઈક કરતા તે જ છે માત્ર સાચું’,  
તે વિનાનું અવર કંઈ જે સત્યની ખામીવાળું;  
‘પોતા વિના ભ્રમિત મતિનાં જે બીજાં ચાલનારાં’,  
સેવાભાવી કંઈ કંઈ દીઠા માન્યતા એવી વાળા.

જેણે સાચું નિજ જીવનનું કાર્ય જે ઉર્ધ્વગામી-  
માન્યું; તેમાં નિજ જીવનનું સર્વ કાંઈ સમર્થું;  
છોને ફાવે કંઈ પણ ભલે ક્ષેત્ર તે હો ગમે તે,  
સેવા એવો પણ જગતની એની રીતે કરે છે.

જેનાથી કેં જગત પરનાં સર્વ સામાન્ય એવાં,  
જેઓ જેઓ નિજ જીવનમાં કેંક સામર્થ્ય પામ્યાં;  
એવી શક્તિ ગૂઢ, સકળને જે રમાડી રહી જ્યાં,  
તે શક્તિનાં સહુ રમકડાં આપણે તો બિચારાં.

(‘જીવનપગલે’, આ.૧, પૃ. ૪૧)

\*

\*

## શરીરનું મહત્ત્વ

શરીર તો આપણું ભારે રક્ષણકર્તા છે. આપણી આસપાસના વાયુમંડળમાં વાસનાથી ભરેલાં સૂક્ષ્મ તત્ત્વો એટલાં બધાં છે કે, જો આપણને ભગવાને શરીર ન આપ્યું હોત તો તે બધાં આપણામાં પ્રવેશીને આપણને તેમનું એક મૂઢ છથિયાર બનાવી દઈને પોતાની વાસનાઓ સંતોષીને આપણું અધઃપતન કરાવત. આપણું શરીર પાર્થિવ તત્ત્વનું છે, ઘન છે; જ્યારે પેલાં અનિષ્ટ તત્ત્વો વાયુરૂપ-પ્રવાહી, બદલાતા આકારવાળાં હોઈ આપણા શરીરના સ્થૂળ તત્ત્વ સાથે અથડાઈને નિષ્ફળપણે પાછાં ફરે છે. આપણને કામ કે કોધની જોરદાર વાસના થાય છે, ત્યારે તેમને રોકીને શરીર આપણું રક્ષણહાર થઈ પડે છે; જો આમ ન બનતું હોત તો કોણ જાણે આપણે આપણું જ કેટલુંયે નુકસાન કરી બેસત !

(‘જીવનપગથી’, આ.ડ, પૃ. ૧૪૪)

\* \* \*

સાધનાની શક્યતા શરીરને, માનવદેહને આભારી છે એટલે તો ખુદ દેવો પણ માનવદેહ વાંછિતા હોય છે. મુક્તિ માનવદેહમાં જ શક્ય છે.

\* \* \*

શરીરને જાણી જોઈને કષ્ટવાનું ન હોય તેમ તેનાં લાલનપાલન કરવાનાં પણ ન હોય. મધ્યમ માર્ગ સારો.

\* \* \*

### માનવદેહ

(અનુષ્ટુપ)

માળખું માનવીનું જે મળ્યું તે ગ્રભુની કૃપા,  
હું તો માન્યાં કરી હૈયે એને શી કરું વંદના !

જીવન માનવી કેરું શ્રેષ્ઠ સૌ યોનિની મહી,  
જીવન માનવી વિના મુક્તિ કો જીવને નથી.

મનખાદેહ સદ્ગ્રાઘે મળેલો ચેતવા હદે,  
કૃપા રાખી ઉંડો ઘ્યાલ યાચું તે જીવજો હદે.

(‘જીવનપાથેય’, આ.૩, પૃ. ૬)

‘માનવી જિંદગી કેવી પ્રભુની લેટ !’ જાણીને,  
એને સર્જવીને પૂરી સાર્થ તે કરજો પદે.

જીવન સાધવા કાજે કર્મ જેવું મહત્વનું,  
આત્માની સાધના કાજે જરૂરી તેવું ખોળિયું.

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૧૫૭, ૧૬૨)

પ્રેમની સાધના દિવ્ય માનવી જ કરી શકે,  
યોનિમાં બીજી કોઈએ થવી શક્ય ન તે દીસે.

દુર્લભ માનવી જન્મ તેથી તો જગમાં ગણ્યો,  
કૃપાથી એવું પામેલાં; એને શું રોળી નાખવો ?

(‘પુનિત પ્રેમગાથા’, આ.૨, પૃ. ૪૭)

સર્વ પ્રતિકૃતિઓમાં માનવીની પ્રતિકૃતિ,  
સર્વ રીતે પૂરી શ્રેષ્ઠ જાણવી પ્રભુની કૃતિ.

ઓળંગી સર્વ મર્યાદા અમર્યાદપણા વિષે,  
જીવન માનવી કેરું ધન્ય પ્રવેશતાં થશે.

પ્રભુનો પ્રેમ લેવાને જન્મેલાં આપણે છીએ,  
તે વિના કો બીજો હેતુ છે ના જીવનનો ખરે;

નિષા જેને પૂરેપૂરી એવી બેઠેલી છે હુદે,  
માનવી જન્મની શી તે યથાર્થતા પિછાનશે !

માનવી જીવને માત્ર સૌ વિકાસ થવા તણી,  
—શક્યતાઓ ભરેલી છે ધન્યતા તેથી એની શી !

(‘જીવનપગલે’, આ.૧, પૃ. ૧૦૧, ૧૦૩)

\* \* \*

### શ્રેષ્ઠ માનવ-યોનિ ને પ્રભુકૃપા

(અનુષ્ટુપ)

યોનિમાં વિશ્વની સર્વ માનવી-યોનિ શ્રેષ્ઠ છે,  
તે વિના શક્યતા બીજે ઈશને પામવા ન છે.

જીવન માનવીનું તે એવું દિવ્ય પવિત્ર હા !  
બિચારો માનવી કિંતુ ગ્રીધે એનું મહત્ત્વ ના.

ઘરેઝે માનવી કેવું જીવે નિર્માલ્ય જીવને,  
છૂટા હાથે પ્રભુએ તો માનવીને દીધું દીસે.

શી કૃપાળુ પ્રસાદી એ મળી માનવી જીવને !  
કિંતુ પામરતામાં શાં સર્વયાં તો માનવી કરે !

તોયે પ્રભુ દયા લાવી માનવીને જગાડતો,  
આધાતો કેંક અપીને જીવ-ને તે મથાવતો.

માનવીને ઉંડી રીતે પ્રભુ ચેતાવવા કરે,  
ગૂઢ યુક્તિ-પ્રયુક્તિથી કલ્પનામાં ન જે ચઢે.

કારમાં યુદ્ધ પ્રેરાવી, કારમા રોગ આપીને,  
કારમો કાળ જન્માવી એને જગાડવા કરે.

બેળે બેળે ઘણાં ઉંડાં મંથનો, દુઃખ પ્રેરીને,  
વિચારો જગવી મૂકે માનવીમાં ઉંહું હદે.

શ્રદ્ધા પ્રેરવવા હૈયે જીવતી માનવી હદે,  
કરતૂકો પ્રભુ કેંક એવાં એવાં કર્યા કરે,  
પ્રભુનો હેતુ તે કિંતુ ઊરો ના માનવી દિલે,  
ધક્કેલી દે પ્રભુને તે; છતાં તે તો કૃપા કરે.

(‘જીવનપાથેય’, આ.ડ, પૃ. ૧૪૬-૧૪૭)

\*

\*

### શરણભાવ

શરણ એટલે ગુલામી નથી. એવો વિચાર તે અજ્ઞાન છે. જ્ઞાનપૂર્વક પૂર્ણપણે જે આધીન થવાનું સ્વીકારે છે, એને અનેક પ્રકારના લાભો સહેજે મળે છે. મનની ટેવોને પલટાવવામાં શરણાગતિ મોટી મદદ કરે છે. મનના આગ્રહો પણ છૂટે છે. પોતાની સમજણા, ગણતરી, પોતાનું માપ, સુખ, પોતાનો અહંકાર, પોતાની બુદ્ધિ—આ બધુંયે, જો સાચી રીતે શરણે જવાય યાને આધીન થવાપણું સ્વીકારે તો, આપોઆપ ગળી જાય; અને એ સ્થિતિમાંથી જો આપણે પસાર થઈ શકીએ તો આપણને જે આધ્યાત્મિક લાભ થાય એની ગણના તો સારી દુનિયાની સમગ્ર ભિલકતથી પણ થઈ શકે તેમ નથી. આધીન થવાપણામાં તો જીવનવિકાસ છે. આત્માનું સુખ શરણે ગયા વિના મળવું કદી શક્ય નથી.

આવી શરણાગતિ એકાએક ને આપોઆપ સાધકને કદી સાંપડી શકતી નથી. તે માટે પ્રયત્નપૂર્વક પ્રયાસ કરવો પડે છે. આની તાલીમ સંસારવ્યવહારક્ષેત્રે વડીલોના કહ્યામાં રહેવાથી મળી રહે છે. જો ત્યાં આપણને આધીન રહેવાની ટેવ જ્ઞાનયુક્તપણે

સાંપડી હશે તો તે પછી આધ્યાત્મિક ક્ષેત્રે પણ કાર્યસાધક થયા વિના નહિ રહે. વડીલોને આધીન જે રહી શકેલો છે, તેને ગુરુનું આજ્ઞાપાલન સહજપણે શક્ય બને છે. આવું આધીન થવાપણું જે કરવાનું છે તે પોતાના વિકાસાર્થે, જીવનયજ્ઞાર્થે ને નહિ કે કોઈને ખુશ કરવા. વળી જો શરણે જવાની ભાવના કેળવવામાં, ચાખવામાં ને તેમ વર્તવામાં દુભાયેલા દિલે, કંટાળાભરી રીતે, નાધૂટકાની રીતે, હારીને કે નિરાશ, દુઃખી થઈને તેમ કરવાનું બન્યું તો આપણને તે ઉલટાં કચરાવાનું બનશે; હળવાં ફૂલ જેવાં નહિ રહી શકીએ. સામાનું કહ્યું કરવામાં કેટલા પ્રમાણમાં ઉત્સાસ, ઉમંગ ટકે છે, ને ઉત્કટતાવાળી મનોભાવનાથી ને કેવા હેતુથી તે કરીએ છીએ તે જોવાનું રહેશે.

(‘જીવનપાથેય’, આ.ડ, પૃ. ૪૨-૪૩)

\*

\*

મેંદી સારી પેઠે કઠણ પથ્થર પર વટાઈ-વટાઈને સાવ એકરસ લોંદા જેવી બની જાય છે, ત્યારે તે ચરણસ્પર્શ થવાને ને રંગ નિપજાવવાને યોગ્ય ઠરે છે. પારો અજિનમાં પૂરેપૂરો પરિપક્વ થતાં એની ભસ્મ ભારે ગુણકારી નીવડે છે. સોનું ભડીમાંના સખત તાપમાં ભસ્મ બનતાં તેનો ગુણ શરીરમાં શક્તિ પ્રગટાવવાનો બને છે; એવી રીતે જે સાધકને જીવનસાધના કરવી છે, તેણે તો શરણાગતિની ભાવના કેળવીને પોતાની જાતને, અહમ્ને ટાળી દઈને માટીના લોંદા જેવા થઈ આકાર પામવાને યોગ્ય સ્થિતિ પ્રાપ્ત કરવા માટે પોતાના માની લીધેલા સ્વતંત્રતાના ખોટા ઘ્યાલો ખંખેરી નાંખીને પૂર્ણ આધીનપણામાં પ્રગટવું પડશે. ને તો જ તેનું ખરું સત્ત્વ પ્રકાશી ઊંઠશે ને પોતે પરિપક્વ બનીને પછી બીજાંને ઉપયોગમાં સાચી

રીતે આવવાને લાયક બની રહ્યો હશે.

(‘જીવનસોપાન’, આ.ગ્ર. ૫૧૮-૩૦)

\* \* \*

### શ્રેષ્ઠ ખલાસીને ભરોસે

(ગઝલ)

વહેવા દો, વહેવા દો, પવન પૂરપાટ વહેવા દો,  
હદ્યના સ્નેહનો ભાવ-પવન પૂરપાટ વહેવા દો.

સહુ દોરો મૂકો છૂટા કરી ખુલ્લા બધા સઢ દો,  
મૂકી દો નાવડી જૂકવી ખલાસીને ભરોસે સૌ.

ભલે તોઝાની હો દરિયો ભલે વા સર્વ ઝૂંકાતાં,  
ભલે પછડાતી હો નૌકા, છતાં અમને નથી ચિંતા.

અમારો જે ખલાસી છે સમુદ્રો સર્વ ખેડેલો,  
સમુદ્રોનોય રાજી છે, અમે નિશ્ચિંત તેથી તો.

હશે નિશ્ચય ઊંડો એવો હદ્ય જેને થયેલો તે,  
કશે ના તે અટકવાનો, નહીં તે ક્યાંય અટવાશે.

(‘જીવનસંદેશ’, આ.ગ્ર. ૫૧૯)

\* \* \*

### સાચો શરણભાવ

(વસંતતિલકા)

વિદ્યા નથી, બળ નથી, નથી દામ હામ,  
એવા ઢળ્યા-શરણની પ્રભુ ! લાજ રાખ.

જાણીબૂજુ જડ રહે બળ સર્વ છોડી,  
—પોતે પૂરો હદ્ય નિર્બળ તે બનીને,

—જો આશરો પ્રભુ તણો સહુ વાતમાં લે,  
એને પ્રભુ કદીય છોડી ન દે કહીયે.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૧૪૮)

\*

\*

### શંકા

જે કંઈ શંકા થાય તે જરૂર લખજો. એને મનમાં ભરી રાખવાથી ફાયદો નહિ થાય. ઉલટું આ માર્ગો તો તેથી નુકસાન છે. શંકાનું બુદ્ધિથી નિવારણ શક્ય હોય તો કરી લેવું સારું. મનમાં ઉંઘી સમજણ ભરી પડી હોય ત્યાં સુધી તે સાચી શ્રદ્ધા ઊપજવા નહિ દે. શંકાની વૃત્તિ સત્યને પકડવા માટે છે, જાણવા માટે છે, અનુભવવા માટે છે, અને તે સાધકની પ્રવૃત્તિમાં ઠીક ઠીક ઘણા લંબા સમય સુધી ટકી રહેતી હોય છે. તે વૃત્તિમાં આમ તો કશું પણ ખોટું ન ગણાય. પરંતુ તેનો અતિરેક થતાં નુકસાન પણ કરી બેસે છે. (‘જીવનમંથન’, આ.ર, પૃ. ૨૩૩-૩૪)

\*

\*

શંકાનું બીજ તો સાધનાની ઊંચી સ્થિતિમાં પ્રગટેલા સાધકના મનમાં પણ ટક્કા કરે છે. એને પોષણ મળી જાય એવી રીતે ન વર્તવું જોઈએ. સંશય ઉઠે ત્યારે સાધકે પૂરી તટસ્થતા જીવતી-જાગતી રાખવાની છે. સંદેહના વિષયનો બારીકાઈથી અભ્યાસ કરવો, તેનું મૂળ પકડાય તો પકડવું. તેનાથી પ્રેરાઈને નિર્ણય ન કરી લેવો. તેવા વિચારની પરંપરા ન જાગ્યા કરે તેની સાવચેતી રાખી શકાય તો તે પણ ઉત્તમ. શંકા અને સંશયને લીધે જો તે પ્રકારના વિચારો જાગ્યા કર્યા, તો તેને ટેકો આપવાપણું થયું ગણાય, અને એથી એનું જીવન પણ લંબાવાનું. શંકા અને સંશયનાં જોશ, વેગ ને ગતિ ઘટે તેમ આપણે વર્તવું.

કેટલીક વખત શંકા આપણને કંઈક સાચું બતાવવાને માટે

પણ પ્રગટેછે. તે વેળાએ શાંતિ, સમતા, તટસ્થતા આદિ પ્રગટેલાં રહ્યાં કરે તો તેમાં ભેરવાઈ પડવાનું ન બને, શંકાના વિષયના બજે બાજુના વિચાર સમતુલાથી તટસ્થભાવે કરી શકાય—જો તટસ્થતા રહી શકે એવી ત્યારે શક્તિ હોય તો.

(‘જીવનમંથન’, આ.ર, પૃ. ૨૩૫, ૨૩૬, ૨૭૦)

\* \* \*

### શંકા-સમાધાન

(અનુષ્ટુપ)

શંકા જે મનમાં જાગે તેનો સૌ તોલ પૂરતો,  
—ચારે બાજુ તણો ઊંડો સાધકે કરવો રહ્યો.

જેવો ખ્યાલ ઊઠે તેના જેવું જીવનમાં કશું,  
—પેલાના સ્વાર્થરૂપે કેં રહ્યું શું ? તે વિચારવું.

જો ના તેવું જરે તેમાં તો બુદ્ધિ તણી વકતા,  
ઉંઘું તે જોવડાવે છે, માનવાપણું એવું ત્યાં.

શંકા ઊઠ્યા પ્રમાણે તો હેતુ શા કાજ ત્યાં હશે ?  
ઘટે વિચારવું પૂરું તે વેળા આપણે હંદે.

કેવા પ્રકારનો વિશે માનવી એવું તે કરે ?  
બુદ્ધિ કામે લગાડીને તોળવું સર્વ બાજુએ.

એવા પ્રપંચવર્તીનાં લક્ષણો જીવને કદી,  
પરખાયાં વિના ના રે’ કોઈ ને કોઈ રીતથી.

પૂર્વજીવનની છાયા એવાની કેવી છે બધી,  
તેનાથી તોલ તો પૂરો તેનો આવી શકે સહી.

માનીએ તેથી કેં બીજું હોવા સંભવ હોય છે,  
ન મનાય છતાં તેમાં ઊંઠું ધારી ન બેસવું.

સારગ્રાહી થવા સારુ ખુલ્લું પૂરું રહ્યાં જવું,  
સાત્ત્વિક નપ્રતા હૈયે ધારી સૌ, પ્રેમ રાખવો.

નમેલું એક બાજુનું પલ્લું જો રાખવું ચહો,  
સત્ય બાજુ નમેલું તે રહેતું હો, ભલે રહો.

સત્યની શક્યતાઓ સૌ સત્ય પાસે ભલે રહે,  
સત્યને પામવા સૌથી મથો ઘેલાં જ આપણો.  
ઘેલાં મથવું આપણો.

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૧૨૧-૨૩-૨૪-૨૫-૨૭)

\*

### સમર્પણ

સાધનામાર્ગમાં સમર્પણ એક ઉત્તમ પ્રકારનું સરળ, સહજ સાધન છે. પ્રત્યેક કર્મ, વિચાર, વૃત્તિ, લાગણી, ભાવના, ભાવ, પ્રાણનો આવેશ, આવેગ, કામના, આશા-તૃષ્ણા, લોલુપતા, અહમ્ ને બુદ્ધિના જડ આગ્રહો, મનના ગમા-અશગમાઓ ને સમજણો આદિ સાધકે સકળ કંઈ જાગૃતિ રાખી રાખીને શ્રીભગવાનને ચરણે પ્રેમભક્તિપૂર્વક સમર્પણ કર્યા કરવાનાં છે. આવું સમર્પણ કંઈ એકદમ થઈ જઈ શકતું હોતું નથી. એ તો ધીમે ધીમે કમશા: થયાં જવાનું,—અલબત્ત સાધક તે અંગેની જગ્રત તકેદારી રાખે તો. શરૂમાં તો પોતે પોતાને સમર્પણ કર્યા કરવાનું છે.

(‘જીવનસોપાન’, આ.૩, પૃ. ૧૮૩)

\*

સમર્પણની ભાવનાનો સ્થૂળ અર્થ આપણે છોડવો ધર્ટે.  
સમર્પણની ભાવનાનો વિસ્તૃત અર્થ તો એ છે કે જે તે કંઈ બધું

મગવાનનું જ છે. તે તે બધું એની રીતે, એની ભાવનાવાળા જીવનમાં, અને એવા જીવનને વધુ ને વધુ દિવ્ય જીવનમાં પ્રગટાવવાને માટે, ને તે બધાંનો જ્ઞાનભક્તિપૂર્વકનો ઉપયોગ તેવી તેવી ભાવના, દસ્તિ ને વર્તનથી થયા જાય અને પાછું તે પણ એને જ બધું સોંપાયા કરાય એનું નામ સમર્પણા. સ્થૂળ (ધન વગેરે) બધું આપી દીધા પછી પણ આપણાથી, સમર્પણભાવે વર્તન ન બન્યાં કરતું હોય તો એવું સ્થૂળ આપેલું અર્થ વિનાનું ગણાય. માત્ર સ્થૂળ સમર્પણનો કશો અર્થ ન હોય. સ્થૂળનું સમર્પણ સૂક્ષ્મ પ્રગટાવવા કાજે છે. તેમ જ ઘરેડથી પણ કશું સમર્પણ ન થવું ઘટે. સમર્પણની પાછળનો ભાવ, હેતુ જીવતો રહેવો ઘટે. ('જીવનમંથન', આ.૨, પૃ. ૩૪૦-૪૧)

\* \* \*

આવાં થતાં રહેલાં કર્મ પણ, અધૂરાં હોવા છતાં, અયોગ્ય હોવા છતાં, ભક્તિપૂર્વક, પ્રભુને તે તે બધું, સારું ને નરસું સમર્પણ કરશો. આવો લાંબા ગાળાનો સદ્ગ્રાવથી સેવેલો સજ્ઞાન અભ્યાસ જેમ જેમ વધતો જશે તેમ તેમ અહંકાર ઓગળતો જવાનો છે.

\* \* \*

સ્થૂળના અર્પણ કરતાં સૂક્ષ્મનું અર્પણ થવું ઘણું ઘણું કઠણ છે. ભલે સ્થૂળ અને સૂક્ષ્મનું બન્નેનું સમર્પણ પ્રભુને કરશો, પણ સાચું ને વધુ ઉપયોગી ને આવશ્યક સમર્પણ તો મનાદિ કરણોના પ્રાકૃતિક ધર્મોનું છે. મનના સંકલ્પવિકલ્પનું, પ્રાણના પ્રાકૃતિક ધર્મો :- આશા, ઈચ્છા, તૃષ્ણા, લોલુપતા, કામ, મદ, મોહ આદિનું, બુદ્ધિની દલીલ અને તર્કવિતર્કનું, અહમ્મના હુંપણાનું ને ચિત્તના સંસ્કારના પ્રકારનું—આવું બધું જે જ્ઞાનભક્તિપુરુક્ત સમર્પણ બને છે, તે પ્રકારના સમર્પણથી જીવનનો સાચો ને

સંગીન વિકાસ થતો આવે છે. ('જીવનમંથન', આ.ર, પૃ. ૧૮૮)  
('જીવનસંશોધન', આ.ર, પૃ. ૨૪૨)

\*

\*

### સમર્પણ

(અનુષ્ટુપ)

એને સમર્પતાં એવું આઠે કોઠે હદે થશે,  
ભાવ, આનંદ, એવાનું તે સમર્પવું યોગ્ય છે.

બેનેબેને સમર્પેલું સમર્પેલું ગાણાય ના,  
એવા સમર્પવામાંથી ફળે જીવન ના કદા.

કર્મયે કરવાનું તે પ્રભુના ભાવ કાજ સૌ,  
બીજો ઘ્યાલ રહેને ત્યાં ના પેસી કો ઘટે જવો.

એવું કર્મ કશું બીજું જે જે કેં કરતાં જ હો,  
એને કાજે કરીને સૌ સમર્યાં તે બધું કરો.

બુદ્ધિથી માત્ર કે'વું તે, કે તેવું મન બોલવું,  
—કામ ના આપશે યોગ્ય, એવું અર્પેલું આપણું;  
જેના સમર્પણે પૂરી ભાવના ઉરની ઊરી  
—તદાકારપણે છે ત્યાં અર્પેલું યોગ્ય તે ચહી.

('કર્મગાથા', આ.૧, પૃ. ૮૦, ૨૧૪)

સમર્યાંની કસોટી કે આપ્યાં કેડે કશું હદે,  
આગલા પાછલા એના વિચારો જન્મશે ન કેં.

('પુનિત પ્રેમગાથા', આ.ર, પૃ. ૧૨૮)

\*

\*

(શાર્દૂલવિકીડિત)

સાચું એક જ તે સમર્પણ થયું, જેના વડે જીવને,  
શક્તિ ઉદ્ભવતી અનુભવી શકો, એ માપ અનું હટે;  
જેણે જીવનસાધના પથ વિષે છે જંપલાવ્યું ખરે,  
અનાં આવરણો થતાં અલગ રે', જાગે અનુભૂતિ એ.

જે જે સર્વ કર્યા કરે સધળું તે પોતાની કાજે કરે,  
પોતાનો જ વિકાસ-ભાવ ધરીને એ કર્મ જે તે કરે;  
તે જે જે કરતો રહે પ્રભુ-પદે ભાવે ધર્યા શો કરે !  
એવા યજ્ઞ-સમર્પણો રસ થતાં, તે જીવનું સત્ય છે.

(‘જીવનસંદેશ’, આ.ર, પૃ. ૧૦૦-૧૦૧)

\* \* \*

### સમર્પણયજ્ઞ, જાણે અજાણે પણ

સમર્પણયજ્ઞ આ જગતમાં જાણે અજાણે સતત ચાલી જ  
રહેલો છે. એક પળ પણ તે અટકતો નથી. એકબીજાનું ઘસાયા  
વિના આ સંસારમાં નભી શકતું નથી. પ્રત્યેક માનવીનું જીવન  
યજ્ઞરૂપે ચાલી રહેલું છે; માત્ર તે તે જીવને એનું જીવતુંજાગતું  
જ્ઞાનભાન હોતું નથી. પરાણે પણ ત્યાગ કુદરત દરેક પાસે કરાવી  
જ રહેલી છે. પ્રત્યેક માનવી એકબીજા સાથે જકડાયેલ, સંકળાયેલ  
હોવાથી કોઈ પણ કોઈનાથી ભિન્ન નથી; પરંતુ આ બધું થતું  
હોય છે અજ્ઞાન, અંધકારદશામાં. આપણે તો સારું કે નરસું જે  
કંઈ થાય તેની પાછળ જીવનવિકાસની ભાવના પ્રેરાવવાની છે.  
સમર્પણયજ્ઞમાંથી ઉત્કટ મંથન જાગે તે વાત સાચી, પરંતુ  
ઉહોળામજા ન જાગે. ઉહોળામજા જાગે છે તે તો અજ્ઞાનભરી  
સ્થિતિમાંથી. હેતુપૂર્વકનો સમર્પણયજ્ઞ આપણાં અંદરનાં કરણોને  
તેમના પ્રકૃતિધર્મમાંથી મુક્તિ અપાવે છે, જ્યારે જીવપ્રકારનું

ધસાવું કે આપવું આપણને વધારે જકડાવે છે.

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૮૮)

\*

\*

સમર્પણ થયાં જવાનો જો માનવીનો પ્રાકૃતિક સ્વભાવ જ છે ને વિશ્વજીવનનું તે એક અંગ છે, તો પછી આપણે આપણા સંસારયજ્ઞમાં જે હોમાવાનું આવે છે, તેમાં જ્ઞાનભક્તિપૂર્વકનાં તટસ્થતા, સમતા, ધીરજ, શાંતિ, સહનશીલતા, હાર્દિક ઉદારતા, અપાર પ્રેમભાવ ને ત્યાગ-સમર્પણની ભાવના જો કેળવ્યાં કરીશું તો તેવી તપશ્ચયાના ભાવે જ્ઞાનપૂર્વકનું જે આપણું હોમાવાનું બનશે એનાથી કરી જીવન ઉન્નત થયાં જવાનું છે, તે નક્કી જાણશો.

(‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૮૦)

\*

\*

ત્યાગ-યજ્ઞ-સમર્પણ, પ્રકૃતિજ્ઞન્ય

(અનુષ્ઠાપ)

જીવને નિત્ય ને નિત્ય ત્યાગ-યજ્ઞ-સમર્પણ,  
સ્વભાવે, પ્રકૃતિથી, શા કરે આપ્યાં બધા જીવ !

વિકાસ પ્રકૃતિજ્ઞન્ય એમ સૌનો થયાં કરે,  
વિકાસ પ્રકૃતિજ્ઞન્ય થકી ના જ્ઞાન ઉદ્ભબે.

ભાવના, જ્ઞાન છે જેનાં ત્યાગ-યજ્ઞ-સમર્પણે,  
હેતુ જીવનનો તેમાં લાગે, તે બદલાય છે.

જીવન આપતાં રે'જો ત્યાગ-યજ્ઞ-સમર્પણે,  
ભાવના જ્ઞાનથી યુક્ત, તો રૂપાંતર પામશો.

(‘જીવનસંદેશ’, આ.૨, પૃ. ૧૦૩)

\*

\*

માનવી મોહના પાશે ત્યાગ ભારે કરી શકે,  
એમ તો ત્યાગથી વિશ્વ ચાલ્યાં સર્વ કરે ખરે.

ગુણ એ પ્રકૃતિજ્ઞ કરાવે ત્યાગ સર્વને,  
જીવન માનવી કેરું એમ તો ત્યાગથી ટકે.

ધ્યાનાંએ પ્રાણ આપ્યા છે પ્રેમના મોહ પાછળે,  
નકામું જાય ના તેથે, તેવા પ્રકૃતિમાં વધે.

વિકાસ પ્રકૃતિ કેરો થયાં કરે જ ત્યાગથી,  
અજ્ઞાનતાભર્યો ત્યાગ કિંતુ શા પ્રાણ પ્રેરશે ?

(‘જીવનપગલે’, આ.૧, પૃ. ૮૮)

દેખીતા જડમાં ગૂઢ ચેતનાશક્તિ, પ્રકૃતિ,  
ફેરફારો કરાવીને તે વિકાસ સધાવતી.

કિંતુ અજ્ઞાનવર્તી સૌ તે વિકાસ થતો રહે,  
સર્વ જાણ્યેઅજાણ્યે તે પ્રકૃતિ-વશ ત્યાં રહે.

(‘કર્મગાથા’, આ.૩, પૃ. ૧૬૦)

\* \* \*

### સદ્ધભાવની કેળવણી

સંસારવ્યવહારવર્તનમાં ઘણા ઉત્તમ ગુણોની કેળવણી  
સાંપડવાની તકો આપણાને મળે છે,—માત્ર આપણું મુખ ને દાખિ  
તથા વૃત્તિ તે પરત્વે જ્ઞાનપૂર્વકનાં વળી ગયેલાં હોવાં જોઈશે.  
સદ્ધભાવની તાલીમ આપણાને આ ક્ષેત્રે વિપુલ પ્રમાણમાં સાંપડી  
શકે છે, કારણ કે અનેક જણાને મળવા કરવાનું, હળવાભળવાનું  
ને અનેક બિન્ન બિન્ન પ્રસંગો ત્યાં આવી મળે છે. આવી વેળા

વાણી એ આપણા હૃદયના ભાવનું પ્રતીક બની રહેતી હોય છે. ઉચ્ચારાતી વાણીમાંથી સદ્ગ્રાવની તાલીમ પ્રતિ સાધકનું કેટલું ને કેવા પ્રકારનું આંતરિક લક્ષ રહેલું છે તે તે સહેજે સમજ શકશે. સદ્ગ્રાવ કેળવવાની અગત્ય જો સાધકના દિલમાં ઠરી ને છસી ગઈ હોય, તો તેના મુખેથી કદી બીજાં વિષે ઘસાતું નહિ બોલાય કે નકારાત્મક નહિ ઉચ્ચારાય. જેમ જેમ આ કેળવણીની શરૂઆત થઈ ગઈ હોય, તેમ તેમ તે તે રીતે થોડું થોડું આચરવાનું બનતાં એ અભ્યાસ પરત્વેનો મહત્વનો ઝોક તે જીવનો જરૂર વધતો જાય; કારણ કે તેવા જ્ઞાનાત્મક સદ્ગ્રાવપાલનથી આપણને મનમાં પ્રસન્નતા, શાંતિ, સરળતા, આનંદ આદિની ભૂમિકા જીવતી રહ્યાં કરે છે. એવા અભ્યાસથી અથડામણ, સંઘર્ષ, ગેરસમજૂતી, કલેશ, સંતાપ આદિ ઉપજતાં નથી ને તે તે બધાં જીવોની શુભેચ્છા, સહાનુભૂતિ, પ્રેમભાવ આપણા પરત્વે સહજમેળે વધ્યાં કરતો હોય છે ને એવા જ્ઞાનપૂર્વકના જીવતા અભ્યાસથી કરી આપણે એક એવું સજીવન ચેતનવંતુ સર્જનાત્મક વાતાવરણ ખુદ આપણામાં—અને બહારના વાતાવરણમાં પણ—પ્રગટાવતા રહીએ છીએ કે જે વાતાવરણ આપણા આધારનું કવચ બની જતું હોય છે, ને ઢાલ પણ.

આપણે જ્યારે સાંભળતાં હોઈએ, બોલતાં હોઈએ, વિચારતાં હોઈએ, વ્યવહારમાં સંપર્ક સાધતાં કે વર્તતા હોઈએ—આ બધું થતું રહેવાની પળ તે પહેલાં અને તે વેળા આપણે ઘણાં ઘણાં સાવધાન રહેવાની જરૂર છે. જીવકક્ષાના નકારાત્મકપણાને જીવનમાં નિર્માણ નથી જ થવા દેવું એવો મક્કમ નિર્ધાર જે જીવે કરેલો છે, તેવો જીવ કંઈ પણ કશો નકારાત્મક આવિભાવ અંતરમાં કે બહિરૂપણે થતાં સફાળો ચોંકી ઊઠશે. એવાં નકારાત્મક

મોજાંનો વિસ્તાર કરવાનું કાર્ય તેનું ન હોય. જગતમાં પૂરતાથીએ અધિક પ્રમાણમાં આવાં નકારાત્મક મોજાંઓ પ્રસરી રહેલાં ને રહેતાં હોય છે જ. પરિણામે જગતમાં કલેશો, સંઘર્ષો, વિભવાદો, વેરજેર આદિ પ્રસરતાં રહેલાં છે. આ બધામાંથી સાધક ઊગરી જવાનું કરશે, કારણ કે તે તો અભેદની ઉપાસના કરવા પ્રવૃત્ત થયો છે ને ? ને આ અભેદ ઉપાસનાનો પાયો સદ્ધભાવ—સર્વ પ્રતિનો સદ્ધભાવ—છે. સદ્ધભાવનું બીજ નહિ હોય તો ભાવ ક્યાંથી થવાનો ? ને ભાવ નહિ ત્યાં અભેદ કેવો?

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૧૯, ૨૦, ૨૧)

\* \* \*

આપણને ગમે તેવા અસંખ્ય અન્યાયો થયા હોય, ગંદી ગાળો ખાવી પડી હોય, ધુતકારાયાં હોઈએ, ધક્કેલાઈ જવાનું બન્યું હોય, ગમે તેવું ભારેમાં ભારે આપણું અહિત કોઈથી થયું હોય તોપણ, તેવા સંજોગોમાં પણ, સાધકને જો સદ્ધભાવ ને સમતા જીવનવિકાસાર્થે જાળવવાની હોય તો સંસારબ્યવહારના સાધારણ પ્રસંગો વેળા તો કેટલો બધો વિશેષ પ્રમાણમાં સદ્ધભાવ કેળવવાનો હોય ! આપણાથી કોઈનું યે નકારાત્મક—પછી ભલેને તે યથાર્થ અને સાચું હોય તોપણ—વિચારાશે નહિ, બોલાશે નહિ, સાંભળી શકાશે નહિ. એવું વિચારવું, બોલવું અને સાંભળવું આપણને જ હાનિકારક છે, કારણ કે એક તો તેવા સંસ્કાર આપણે આપણામાં ઉપજાવીશું અને સ્થૂળ રીતે પણ જગતમાં આપણું અહિત થવાનું.

\* \* \*

### સલામત સ્થિતિ

સલામત સ્થિતિ એટલે સ્થિતિચુસ્તતા અને એ સ્થિતિચુસ્તતા એટલે જ્યાં જેમ હોઈએ એમાં જ સંતોષ અને પરિણામે વિકાસની

કુકાવટ અને અંતે પતન. આથી કંઈ પણ કશે—બહિરૂપણે કે આંતરિકપણે—સલામત સ્થિતિ થઈ જાય, તો તે ઉલટાવતા રહેવું સાધકને માટે ઘણું જરૂરી છે. સલામત સ્થિતિમાં જે જીવને પડી રહેવું રૂચે છે, તે કદ્દી સાધના કરી શકવાનો નથી. સલામત સ્થિતિ જ્યાં શોધવાની વૃત્તિ થઈ કે તે જીવપણામાં ફસડાવાનો.

જ્યાં કોઈ પણ પગથિયે સંતોષ લેવાયો કે પતનનાં મૂળ એમાં રહ્યાં સમજવાં. આ નિયમ વષ્ટિ તેમ જ સમષ્ટિ ઉભયને એક્સરખી રીતે લાગુ પડે છે. પ્રત્યેક સ્થિતિ આપણી અપૂર્જિતાની સૂચક હોઈ તેનું જીવંત સ્પષ્ટ ભાન આપણને રહે તથા એક પ્રકારની દૈવી અસંતોષની પ્રચંડ જ્વાળા અંતરમાં સતત ભભૂકૃતી રહેવા સાથે ખૂબ ધીરજ પણ હોવી જોઈશે.

પ્રત્યેક પરિસ્થિતિ ચલ છે. અચલ તો એક સનાતન પ્રભુ જ છે. મન જ્યાં સલામતીની લાગણી ક્યાંયે પ્રવતર્વે ત્યાં તુરત તેનો પ્રચંડ સામનો કરીને તેવા મનના પ્રવાહને રોકવો ઘટે. સલામતીમાં રહેવાની ટેવ પડતાં તમસનું જોર આપણા પર ચઢી વાગવાનું.

એક સ્થિતિમાં જે સત્ય જણાય અને પકડી રહીએ તો એનાથી ઉપરનું સત્ય બાકી રહી જાય; ને અધૂરા કે એક જ બાજુના સત્યને વળગી રહેવાનું બન્યાં ન કરે માટે પણ કશામાંયે સલામતી રાખવાની નથી.

સલામત સ્થિતિ ભોગવતાં એક પ્રકારનો જડ સંતોષ આપણને રહેવાનો; ને તે કારણે તેવી સ્થિતિમાંથી કોઈ અજ્ઞાત-Unknown સ્થિતિ ભૂસકા મારવાનું સાહસ, હિંમત, બળ, જોશ, ઉત્સાહ આદિ એવું કશું પણ આપણામાં નહિ આવી શકે.

(‘જીવનસંદેશ’, આ.૨, પૃ. ૮૦-૮૧)

\*

\*

‘સાધુ તો ચલતા ભલા’ એમ જે કહેવાય છે તેમાં ‘ચલતા’નો સ્થૂળ અર્થ ન કરતાં સૂક્ષ્મ અર્થ કરીએ ને એ સૂક્ષ્મ અર્થ વધુ યોગ્ય છે—તો સતત વિકાસ સાધ્યા કરવો એ સાધકનો ધર્મ થઈ પડે છે. સલામતી સરી જતાં મથામણ તો સાંપડવાની જ; પરંતુ તેના વિના અમૃત પણ ન પમાય. મથામણ સાધક જીવનને જરૂરી છે—પોતાની અંદર જ માત્ર મથામણ નહિ પરંતુ બહારના સંયોગો સાથે પણ.

(‘જીવનસંદેશ’, આ.૨, પૃ. ૮૨)

\*

\*

અમુક દશા થતાં સાધક પોતાનામાં પોતાનું થતું મરણ ને જીવન સમજી શકવાની ભૂમિકામાં પ્રગટે, ત્યારે તે પરત્વે પણ એનું લક્ષ ન રહેતાં, પ્રત્યેક સ્થિતિમાં ફેરફાર થતો જવાનો છે, એમ સમજને ક્યાંયે એણે સલામતી ભોગવવાની હોય નહિ; ને એણે એકમાંથી બીજામાં ને બીજી અવસ્થામાંથી ત્રીજીમાં એમ ગયા જ કરવાનું છે. ક્યાંયે ભેરવાઈ પડવાનું નથી. એમ જતાં જતાં ને સર્વ કંઈ પરત્વે તટસ્થ રહેવાયાં જતાં આપણે ભાવની ઉત્તરોત્તર ઉત્તમ કક્ષામાં પ્રગટતા જઈએ છીએ.

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૩૩૫)

\*

\*

### સલામતી અને ફેરફારો

(અનુષ્ટુપ)

આજની સ્થિતિમાં માને પૂરી જે કો સલામતી,  
—એનો વિકાસ ના થાયે, ત્યાંનો ત્યાં તે રહે પડી.

નુંવાં  
કોઈ મૂલ્યાંકનોમાંયે બંધાઈ ના જવું વળી,  
ત્યાંયે નિરાગ્રહી રે'વું, સત્ય તો પર સર્વથી.

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૭૧, ૧૫૩)

\*

\*

(શિખરિણી-મંદાકાન્તા)

સમાયેલો હેતુ આણુ પણ વિષે કોઈ ને કોઈ રીતે,  
—થતો રે'તો વ્યક્ત કંઈ કંઈ નવા ફેરફારે થઈ તે;

જુઓ જે જે વિશે પરિણિત થતું લાગતું રે' સદાયે,  
ન એવી ને એવી સ્થિતિ મહીં પડી કોઈ રે' છે કદીયે.

(‘જીવનપગલે’, આ.૧, પૃ. ૧)

\*

\*

(અનુષ્ટુપ)

ફેરફારો વિના પામ્યા કો વિકાસ ન પામતું,  
વધાવે ફેરફારો જે શાન-ભાવે, વધ્યા જતું;  
ફેરફારો થતા રે' છે સર્વના નિત્ય જીવને,  
કિંતુ ત્યાં શાન ને હેતુ રાખે જે જીવતાં, રળે.

(‘જીવનપગલે’, આ.૧, પૃ. ૧૦)

\*

\*

ફેર જ્યાં ત્યાં થતો હોતો વિશ્વમાં નિરખાય છે,  
સૌમાં ફેર થવાનો છે  
અનાદિ કાળથી એ તો, વિશ્વ એક રૂપે ન રે'

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૧૮)

\*

\*

સંઘર્ષણી આવશ્યકતા

(જૂલાણા)

કાણ ચંદન તાણું તે ઘસાતાં કરી,  
મધુર સુવાસ પ્રગટ્યાં કરે છે.

મારીનાં વાસણોયે નિભાડા તણા  
 અજ્ઞિના તાપથી પક્વ થાયે;  
 હદ્યમંથન થકી યુદ્ધ જગ્યા વિના,  
 માનવી તો કદી ના ઘડાયે.  
 જીવનમાં એવી તો તક ઘણી સાંપડે,  
 માનવી મૂર્ખ શી ખોઈ બેસે !

(‘જીવનપગલે’, આ.૩, પૃ. ૪૪)

\* \* \*

### સહેવાની સાધના

(અનુષ્ટુપ)

સૌ સહ્યાં કરવામાં તે પ્રભુનું જ્ઞાન-ભાવથી,  
 જીવવાની પરાકાષ્ઠા પમાશે આપણા થકી.

સહ્યા વિના ઘડાયું ના કોઈએ ક્યાંય વિશ્વમાં,  
 ઘડવાની તમના જો સહો પ્રેમથી સૌ ભલા.

(‘જીવનપગલે’, આ.૧, પૃ. ૫૦)

\* \* \*

(માલિની)

હદ્ય હદ્ય જગે પ્રેમનો ભાવ પૂરો,  
 કશું પણ સહવામાં સહેવું લાગે ન ત્યાં તો.

(શિખરિણી-મંદાકાન્તા)

ન હો સહેવાનું જો કંઈ પણ કશું, સર્વ તો મીહું લાગે,  
 સહ્યા કેડે ભાગ્યે કંઈક જનમાં મૂળ મીઠાશ રે' છે;  
 જરા વા વાયાથી ઊડી જતું દીસે જેમ રૂ આકડાનું,  
 સહ્યા વિનાનું સૌ ત્યમ મધુર હો, તોય લુખ્યું નકામું.

સહેવાનું કોને જગત થયું ના ? એક એવું બતાવો,  
સહેવું ઉમંગે ઊગી નીકળતું ભાવના રાખી જો હો;  
જો જ્યાં જ્યાં જુઓ કશુંય બનતું ના સહ્યા સૌ વિના કે,  
સહેવાનું એ તો જગત-જીવનો આદિનો કાયદો છે.

ગમે છે જે કર્મો સહન કરવું આકરું ત્યાં ન લાગે,  
થતું સહેવાનું ત્યાં નજર મહીં તે આવવું ના લગારે;  
સહેવાનો હેતુ સમજથી રહે જેહને લક્ષ પૂરો,  
સહેવામાં એવા જીવન વિકસે એવું તે ધન્ય સહેવું.

(‘જીવનપગલે’, આ.૧, પૃ. ૪૮, ૫૪)

\*

\*

(અનુષ્ઠાપ)

‘સહેવું’ પ્રેમની એ તો અમોલી ભવ્ય ભેટ છે,  
એને જે કો નકારે છે પ્રેમી ના તે બની શકે.

(‘પુનિત પ્રેમગાથા’, આ.૨, પૃ. ૩૬)

\*

\*

### સંત્સંગનો સ્પર્શ

મનમાં કોઈ પણ વૃત્તિ ઊઠતાં તે સ્થગિત કે સ્થિતિયુસ્ત  
નથી રહી શકતી. વૃત્તિ એટલે જ ગતિ. તો સદ્ભાવ કે સદ્વસ્તુ  
પરત્વેની વૃત્તિ કે ભાવના સ્થગિત કેમ કરીને રહી શકે ? પણ  
ઉપરની બન્ને પ્રકારની વૃત્તિમાં ફરક છે. એક તો છે પ્રકૃતિથી  
જન્મેલી વૃત્તિ. બીજી વૃત્તિ (સદ્ભાવ કે સદ્વસ્તુ પરત્વેની) પણ  
જો માત્ર તેવી જ હોય ને શુશાત્મક ભૂમિકા પરથી સેવાયાં જશે  
ને તે પણ એકમાત્ર વૃત્તિની નજરે—તો એમાંથી જીવને તાત્કાલિક  
તત્ત્વલાભ થઈ શકે નહિં. સંત્સંગ આદિ ભાવનામાંથી કિયાત્મક  
શક્તિનો પ્રવાહ ન જન્મી શકે તો માનવીએ વિચારવું રહ્યું.

ઉપરછલ્લી બુદ્ધિ વડે સત્સંગની પ્રવૃત્તિમાં જીવ જે રસ લે છે, તેનું કારણ એના અંતરનો સૂક્ષ્મ અનુરાગ એ વલાશ પ્રતિ રહેલો છે તે છે; પણ એ સૂક્ષ્મ અનુરાગને જીવનમાં, ને જીવનના સર્વ ક્ષેત્રમાં સર્વવ્યાપી, સર્વભક્તી ચેતનાત્મક સ્વરૂપે બનાવવાની કળા હસ્તગત કરવાનું સદ્ભાગ્ય તો જેને ખરા જીવનની ધગધગતી ભૂખ લાગે છે એવા જ પામી શકે છે.

(‘જીવનસંદેશ’, આ. ૨, પૃ. ૫૮-૫૯)

\*

\*

સદ્ભાવની ભૂમિકા હોવી એ એક વસ્તુ છે ને એને જીવનના પરિણામ કે પરિપાકમાં કામ કરાવતી જોવી તે બીજી વાત છે.

તો આ સત્સંગની ભાવના સાચી કે ખોટી ? જો તે સાચી હોય તો ખામી આપણી કે સત્સંગની ?

જેમ રૂપા ઉપર સોનાનો ઢોળ ચઢે, પણ વપરાશમાં આવતાં તે ઢોળ ઉતરી જાય છે એવી રીતે સત્સંગનો પાસ તો લાગે, પણ પાછાં માનવી સંસારમાં પડીને એનું સેવન-ચિંત્વન ભાવનાના સ્વરૂપમાં ચાલુ રાખી શકતાં નથી. પરિણામે, આવેલા કે ચઢેલા ભાવનો સ્પર્શ તદ્દન મોળો પડી જાય છે. અને પેલો માનવી ખાલી ને ખાલી રહી ગયો હોય એમ લાગે છે.

તો શું સત્સંગનો સ્પર્શ પણ મોળો પડી જાય ? શું એ નક્કર વસ્તુ નથી ? જવાબ એ છે કે સંસ્કાર પડવા એ એક વાત છે અને તે સંસ્કાર તેના ચાલુ જીવનમાં સક્રિય થઈ રહે તે બીજી વાત છે. સત્સંગનો સ્પર્શ—એટલે કે તેના ચાલુ જીવનમાં પરિવર્તનકારક અસર—એ કંઈ એક બાજુના બળનું પરિણામ ન હોઈ શકે; સામા જીવે પણ પોતા તરફનું બળ દાખવવું જોઈએ. સત્સંગના સ્પર્શની કિંમત એને મન જીવનનાં બીજાં બધાં ક્ષેત્રો કરતાં હજાર

ગણી વધુ અંકાયેલી હોવી જોઈશે. તો સ્પર્શની અસર પ્રત્યક્ષ સવેળા થઈ શકે. ('જીવનસંદેશ', આ.૨, પૃ. ૫૮ થી ૬૧)

\*

સત્સંગની ભાવના જીવે કેવી અને કયા પ્રકારે સેવવી એના વિષેનું સત્સંગીઓનું પરંપરાનું ગતાનુગતિકનું જે વલાણ છે, તે જીવનવિકાસમાં જાળું કામમાં આવી શકતું નથી. સત્સંગના સેવનની ભાવના સમાજમાં જે છે, તે એક સારી વસ્તુ છે, પરંતુ જો જીવ સત્સંગની ભાવનાને સેવવાની સાથે સાથે સંસારની ઘટમાળમાં જ સતત વિચાર્યા કરવાનું રાખે તો એવો કરેલો સત્સંગ અંતરમાં માત્ર તે પ્રકારના સંસ્કારરૂપે જ પડ્યો રહે છે.

('જીવનપ્રવેશ', આ.૧, પૃ. ૧૫૩)

\*

### સંતસમાગમ

સંતોને માત્ર જાણ્યાથી કે તેમની સાથે માત્ર ઉપરછલ્લી રીતે રહેવાથી જીવનું કશું દળદર ફીટી શકતું નથી. તેમની સાથેના સમાગમ વેળા એમના પરત્વે આપણાં મન, બુદ્ધિ, પ્રાણ, ચિત્ત, અહ્મુને હૃદય કેવી જાતની જીવતી ભાવનાવાળાં હોય છે, તેના પર તેમના સમાગમના લાભનું સંગીન પરિણામ રહે છે.

સંતાત્માનો પરિચય જો ભાવના ને ધારણાથી, હૃદયની પ્રેમભક્તિથી કેળવાયાં કરાય તો જીવનમાંના સર્વ ક્ષેત્રોનાં કર્મોમાંથી જીવપ્રકારનાં રાગદ્વેષ, માન, મમતા, લોભ, મોહ, ક્રીતિ, અહંકાર આદિ ઘટતાં જતાં આપણને લાગશે; ને તો જ તેવો સમાગમ ખપનો. ('જીવનપ્રેરણા', આ.૩, પૃ. ૫૧-૫૨)

\*

સંતસમાગમ વેળા સંતના હૃદયપ્રદેશે ને કોક વાર તેમનાં નયનકમળમાં સાધકથી પોતાની ભાવના સ્થિર રાખવાનું બને,

ને તેવી વેળા મનની પ્રાર્થના થયા કરે કે, ‘હે પ્રભો ! દીનાનાથ ! દીનબંધો ! દીનદયાળ ! હૃપાળુ ભગવાન ! હૃપા કરો ! અમને જગતા, ચેતતા કરો, ને રાગદ્વિષથી દૂર થવાય, નિર્મળ થવા હદ્યમાં ચેતનાત્મક જગૃતિ પ્રેરાવો. અમે આંધળા છીએ, તેથી દેખતા થવા માટે અંતરની આંખ આપો.’ એવી એવી પ્રાર્થના કર્યા કરવાનું બને તો તેને અવશ્ય લાભ થાય.

જે જે ઉચ્ચ આત્માઓનો સત્સંગ થાય કે મળે તેમાં તેમાં ને તેમનામાં સાધકે પોતાના સદ્ગુરુની ભાવના-ધારણા મનહદ્યથી દ્વારવાનું કર્યા કરવું. તેવી તેવી વ્યક્તિ એ તો સદ્ગુરુની જ જીવતી પ્રેરણાનું પરિપક્વ પરિણામ કે ફળ છે એમ દ્વારવાનું, જેથી એનું રહસ્ય અને મહત્ત્વ પણ જણાવા લાગશે.

(‘જીવનપ્રેરણા’, આ.૩, પૃ. ૮૨-૮૩)

\*

\*

સંતસમાગમ કદી એળે જઈ શકતો નથી. જેમ જીવનના બીજા સંસ્કારો-સંસારવ્યવહારક્ષેત્રમાં થયેલા કર્માના સંસ્કારો-દરેકના ચિત્તમાં પડ્યા જ કરે છે, તેમ સંતપુરુષ સાથેના સંપર્કના સંસ્કારો પણ સમાગમ કરનાર જીવના ચિત્તમાં જરૂર પડવાના ને એવા સંસ્કારોનો ઉદ્ય કોઈક વેળા તો જરૂર થવાનો. પરંતુ પેલા જીવના હાલના તબક્કે એના કર્મપ્રારબ્ધના ઉદ્ય-વર્તમાન સંસ્કારોનું જોર ધાણું હોય છે, ને તે તેમાં અજ્ઞાનપણે દોરવાયાં કરે છે, એટલે સંતના જીવન સાથેના પેલા સંસ્કારો એમ ને એમ એના ચિત્તમાં પડી રહે છે. પણ જો આપણે જીવંત પુરુષાર્થ કરવા લાગીએ તો પેલા સંતના પડી રહેલા સંસ્કારો આપણને જરૂર પ્રેરક તત્ત્વરૂપે મદદ કરશે. કર્મ-પ્રારબ્ધના વહેણમાં ગમે તેટલો તણાતો જીવ પણ સંતસમાગમથી જરૂર કેંક ને કેંક તો પામવાનો છે.

એક બાજુથી જીવ ચાલુ જીવનમાં કર્મ-પ્રારથ્યને કારણે ઘસડાયાં કરાતો હોઈ, નવા ને નવા રાગદ્વેષાત્મક જીવપ્રકારના સંસ્કારો દઢ થયે જ જવાના ને તેવા સંસારી સંસ્કારોનું જોર પેલા સંતસમાગમના નવા સંસ્કારો પર ફરી વળી તેને દબાવી દેવા પ્રયત્ન પણ કરે તેવો પૂરો સંભવ છે. પરંતુ સંતસમાગમના સંસ્કારો નવા હોવા છતાં તેના બળમાં અને શક્તિમાં પેલા સંસ્કારો કરતાં વધુ બળવાન હોય છે. વળી એવો જીવાત્મા પણ કોઈ સંતના-મુક્તાત્માના સંપર્કમાં આવ્યો હોય તો તે પણ તેના યોગાનુયોગ કર્મનું પરિણામ છે. એટલે કોઈ ને કોઈ ગૂઢ રીતે પણ એ સમાગમની થોડી ઘણી લાયકાત તો એણે મેળવી જ છે. આમ પૂર્વના અનુકૂળ સંસ્કારોને પરિણામે જો એને સંતસમાગમનું ફળ મળ્યું તો એ સમાગમ એને વિશેષ ફળદાયી પણ થાય. એવો જીવ ભલેને દેખીતી રીતે જૂની ઘરેડામાં ચાલ્યાં કરતો હોય તોપણ તેના મનના ઊંડા થરોમાં આછી આછી પણ, થોડી ઘણી પણ, હિલયાલ આવા સંપર્કને કારણે થયાં જ કરશે. વળી જેમ જૂના સંસ્કારો તેના જીવનમાં કિયમાણ થતા રહેશે તેમ આ નવા સંસ્કારો પણ ઓછાવતા અંશે સાથે સાથે કિયમાણ થવાના અને જો સંતનો સંપર્ક ગાઢો થતો આવ્યો તો વિશેષ ને વિશેષ આ નવા જોરદાર સંસ્કારો પડ્યે જવાના ને તે જીવનમાં વ્યક્ત થયા વિના નહિ રહેવાના.

(‘જીવનસંદેશ’, આ.૪, પૃ. ૮૩-૮૪)

\*

\*

ગમે તેવી આસક્તિથી આવરાયેલો સંસારી જીવ ગમે તેવા આસક્તિના પ્રયોજને મુક્તાત્મા પ્રતિ આકર્ષય તોપણ મુક્તાત્મા, જાતે આસક્તિરહિત હોવાથી તેનાથી પેલા જીવમાં પડતા સંસ્કારો આસક્તિ વિનાના જ હોય છે અને એ કારણે બળવતર હોય છે. મુક્તાત્માનું પોતાનું જીવન એટલું તો મહાન, પ્રભર, તેજસ્વિત

ને ઓજસથી ભરેલું—ભગવાનની શક્તિથી સભર—હોય છે કે સંસારી માનવીનું આકર્ષણ તેના પ્રતિ થતાં મુક્તાત્મા પેલાની સંસાર તરફની આસક્તિનું જોર ઘટાડી દેશે અને સમય આવતાં પોતાના સંસ્કારોનો ઉદ્ય કરાવશે.

(‘જીવનસંદેશ’, આ.૪, પૃ. ૮૫)

\*

\*

સંતસમાગમ માત્ર ઉપરછલ્લી ખંજવાળની લાગણીથી ન થવો ઘટે; પણ શાહીચૂસ જેમ શાહી ચૂસી લે છે એવી હંદયની જિજ્ઞાસાભરી ભૂમિકા ને મૂદુતાભરી ભાવના સાથે જો તે થાય તો ફળદાયી જરૂર નીવડે. (‘જીવનપાથેય’, આ.૩, પૃ. ૧૨૨)

\*

\*

**સંતોની—એકબીજાની—સરખામણીમાં ન પડવું**

આધ્યાત્મિક માર્ગની દણિએ કોણ આગળ અને કોણ પાછળ છે, એ યોગ્યપણે જોવું તે આપણા જેવા જીવદશાવાળા માટે અશક્ય નહિ તો અતિ મુશ્કેલ છે. કંઈ નહિ તો આપણા પોતાના શ્રેયાર્થ એવા વિચારો ન થવા દેવા. શંકરાચાર્ય ચઢે કે બુદ્ધ, ઈશુ પ્રિસ્ત ચઢે કે શ્રીકૃષ્ણ કે શ્રીરામ ચઢે; અથવા તો ચાલુ કાળના મુક્તાત્માઓમાં કોણ કોનાથી ચઢે, અથવા કોણ કઈ કક્ષાએ પહોંચેલા છે એવી બધી બાબતોની ચર્ચા કરવી, ઝોડની જેમ મતાગ્રહ દાખવવો વગેરે આપણનું નર્દૂ અજ્ઞાન કહેવાય. પોતાને યોગ્ય અને પસંદ પડતા પરમપુરુષને કે સદ્પુરુષને જે તે કોઈ સવિશેષ પોતા પૂરતા ગણે કે માને તે તેને માટે યોગ્ય પણ છે, પણ જ્યારે તે પોતાની માન્યતા કે સમજણ બધા યા બીજા ઉપર લાદવાનો આગ્રહ કે પ્રયત્ન કરે ત્યારે તે કેવળ હાસ્યાસ્પદ ઠરે છે.

કોઈનુંયે આંતરસત્ત્વ કરી કક્ષાએ પહોંચ્યું છે એ જ જાણવું આપણા માટે જો કઠિન છે તો વળી સમર્થોના આંતરસત્ત્વને જાણવું અને સમજવું એ તો ઓર અત્યંત અશક્ય નહિ તો દુષ્કર તો છે જ. બાળકને જ્યાં હજુ ચાલવાના માંડ સાંસા છે, ત્યાં એને દોડાવવાની વાતો કરવી એના જેવું એ છે. સાધારણપણે, કોઈનીયે સરખામણી ન થાય તે ઉત્તમ છે. સરખામણી કરવામાં અન્યાય એક યા બીજા પક્ષને થઈ જવા પૂરતો સંભવ છે. આપણે તો શક્તિનાં પૂર જ્યાં જ્યાં વહેતાં હોય, ત્યાં ત્યાંથી તરસ્યા થઈ ચાંગળું પાણી પીવાની વૃત્તિ દાખબ્યાં કરીએ.

(‘જીવનદર્શન’, આ.ર, પૃ. ૧૧૦-૧૧)

\* \* \*

## સંસાર, પાઠશાળા યાને પ્રયોગભૂમિ

સંસાર મિથ્યા નથી. આમેયે માનવી એને મિથ્યા માનતો હોતો નથી. જો સાચેસાચ હૃદયથી તેમ માનતો થઈ ગયો હોય તો તે ક્ષાણવાર પણ સંસારને વળગી રહી ન શકે. એટલે જે સંસાર આપણને આવી મળ્યો છે, તેનો આધાર લઈને ભાવના કેળવવાની છે. જેમ વૈજ્ઞાનિક નાનકડા પાયા ઉપર કંઈક કશાની શોધ માટે પ્રયોગ કર્યા કરતો હોય છે ને તેમાં ફળીભૂત થતાં તે જ પ્રયોગ પછી વિસ્તારદશાને પામે છે, તેવી રીતે જીવનના પ્રયોગનું ક્ષેત્ર આપણો સંસાર છે. એ સંસારમાં સમતા, તાટસ્થ્ય, ધીરજ, સહનશીલતા, ઉદારતા, માનસિક વિશાળતા, અપાર પ્રેમભાવ આદિ સાત્ત્વિક ગુણો કેળવવાનો અને તે સાથે સાથે, તેમ છતાં પાછું નિરાસકત થતાં જવાનો ને નિર્મળત્વ કેળવવાનો આપણે જીવતો જ્ઞાનભક્તિપૂર્વક પ્રયત્ન કરીએ તો તે ક્ષેત્ર આપણા જીવનને યોગ્ય રીતે કેળવવાને મળેલું હોય છે અને જીવને ધન્ય તથા કૃતકૃત્યપણામાં નિપજ્ઞવવાને તે મળેલું છે; એના વિના

સંસારનો બીજો હોઈ ઉદેશ ના હોઈ શકે. સંસારનો ત્યાગ જરૂરી ન હોય પણ ત્યાં ત્યાગ-ભાવના કેળવવાની છે, એવી સમજણા, જ્ઞાન અને અનુભવ થયાં કરશે.

(‘જીવનપ્રેરણા’, આ.ડ, પૃ. ૧૩૨)

\*

\*

જે જે જીવોનો સંબંધ મળેલો છે, તેમની સાથે હૃદયનો સાચો સદ્ગ્યાવ જ્ઞાનપૂર્વક કેળવાય અને સુમેળની ભાવના હૃદયમાં પ્રગટે ને એનાથી કરીને આપણું જીવન જે ઘડાય છે, તે પણ એક પ્રકારની સાધના ને ભક્તિ જ છે. સંસારવહેવારથી અલગ પડી જઈને જે સાધના થાય છે તે ખોટું છે એમ પણ નથી, પરંતુ સંસારમાં ઘડાવાની અનેક તકો સંસારવહેવારના સંબંધોમાં અનેક પ્રકારના ઊભા થતાં સંજોગોમાં અને આડાઅવળા પ્રસંગોએ કરીને મળે છે. આપણા મનને, વિચારને, વૃત્તિને, લાગણીને, ભાવનાને, પ્રાણનાં વલણોને, અહંકૃ આદિને જે આધાત પ્રત્યાધાતો થાય છે, તેનાથી કરી સમતા, શાંતિ, તાટસ્થ્ય, ધીરજ, સહિષ્ણુતા અને સહનશક્તિ, ઉદારતા અને માનસિક વિશાળતા વગેરે ગુણો કેળવવાની જે જ્ઞાનયુક્ત સમજણ પ્રગટે છે અને વિવેકનું સાચું જ્ઞાન ત્યાં જે પ્રાપ્ત થાય છે એ એની વિશેષતા છે. અલબત્ત આ બધામાં હેતુનો જીવતો ભાવપૂર્વકનો ઘ્યાલ રહેવો જોઈશે.

\*

\*

આ સકળ સંસાર પ્રભુનું જ વ્યક્ત સ્વરૂપ છે, લીલા છે. તે જીવને તરાવવાને કાજે રચાયેલો છે. સંસારથી કંટાળી જઈ કે ત્રાસી જઈને જે જીવ સાધના કરવા ચાહે છે તે સાધારણતઃ સાધનામાં પણ પોતાનું દળદર ફેરી શકતો નથી. તેની જીવપ્રકૃતિ ત્યાં પણ તેવી જ રીતે વર્તવાની. સંસારમાં રહેવાનું છે ખરું પણ

જગીને, ચેતતા રહીને, હૃદયથી સાધનાને જ મહત્ત્વ આખ્યાં કરીને, પ્રાર્થના કર્યા કરતા રહીને. સંસારમાં મળેલા જીવો આપણને જ્ઞાનભાવમાં પ્રેરાવવા કાજે સાધનરૂપ છે.

\*

\*

### સંયમ

સાધકને મન સંયમ એટલે પોતાના જીવનનું પૂર્ણ રક્ષણ કરવા યોજાયેલી આચારની દીવાલ. સંયમમાં પોતાની જાત પ્રત્યે કઠોરમાં કઠોર થઈ શકાય છે, પરંતુ તે સાથે સાથે એવી દીવાલ કોઈ પણ જીવ પરતે તિરસ્કાર કે અવગાણના કરનારી નહિ હોય. સાચો સંયમ અંતરમાં સમાઈને રહે છે તે સાથે સાથે ત્યાં રહીને અંતરમાંથી બળ પ્રગટાવીને જીવનના પ્રત્યેક આચારવિચારની ચોકી પણ તે કરે છે. સાચો સંયમી પોતાના જીવનના બાધ્ય આચારમાં એના આંતરિક સંયમની છાપ સરખી પણ નહિ પડવા હે. નજીકની વ્યક્તિનેથે પોતાના અંતરના સંયમનો ધ્વનિ નહિ સાંભળવા હે.

(‘જીવનપ્રવેશ’, આ.ર, પૃ. ૨૬૪-૬૫)

\*

\*

સંયમમાં ક્યાંયે શુષ્ણતા નથી, કઠોરતા પણ નથી, જેને સંયમ શુષ્ણ ને કઠોર લાગે છે, તેઓ સંયમના હેતુને ને તેની ભાવનાને તેના યથાર્થપણામાં સમજેલા નથી. સાધનાપંથે અનેક પ્રકારના સંયમ જીવનમાં પ્રગટાવવાના રહે છે. સંયમ અને દમન એ બેમાં ઘણાં ફેર છે. દમન એટલે કરણોને રૂધવાં. તેમાં બુદ્ધિ, પ્રાણ આદિ કુંઠિત બની જાય. દમન જીવનને હેરનું હેર રાખે છે. કદીય સમૂળગું તો કચરી પણ નાખે છે, જ્યારે સંયમથી તો જીવન નવપલ્લવિત બને છે, વિકાસની

અનેક શક્યતાઓ ઉદ્ભવે છે.

(‘જીવનપોકાર’, આ.૪, પૃ. ૩૬૮)

\* \* \*

### સાચો સંયમ

સાચવ્યાં જે કરેલો હો, ખંતે સંયમ જીવને,  
એનાથીયે રહે મેળે, ખરો સંયમ એ જ છે.

સાચવેલો ધણા દી'નો તૂટી સંયમ જ્યાં પડે,  
કેવો નિશ્ચય પોતાનો મીણ શો પીગળી જશે !

એવો સંયમ આવે ના જીવને ખપમાં ખરો,

જીવી  
શકે ટકી ખરી વેળા તેવો સંયમ યોગ્ય તો.

તેથી સંયમ-પ્રાપ્તિના પ્રયાસે ભાવના હંદે,  
ભર્યાં તે કરવી ઉંડી, પ્રભુમાં ચિત્ત ધારીને.

એવી રીતે પ્રયાસોનું સર્વ સ્થૂળપણું જશે,  
અને શક્તિ તણો એમાં ત્યારે જન્મ ખરો થશે.

જીવને કામ લેવાનું બને ત્યારે સહેજ સૌ,  
—નૈસર્જિકપણે, ને તે જીવને ગ્રાણ પ્રેરતું.

નદીના ઉધ્વર વહેણે શું જવાનું આકરું પડે !  
એ કાજે પરસેવાનો શ્રમ શો પાડવો રહે !

(‘કર્મગાથા’, આ.૩, પૃ. ૬૮-૬૯)

\* \* \*

ઉધ્વરગામી થવા વૂતી હૈયૈ સંયમ-ભાવમાં,  
—કળા જે પામવા ચાહે તે તે તેમ મથે સદા.

ઉર્ધ્વમાં ઉર્ધ્વ ચૈતન્ય-શક્તિભાવ પ્રતિ દશા,  
—જીવને સૌ થવા કાજે, તેવો સંયમ યોગ્ય ત્યાં.

એક તે જાતનો તેવો કોઈ સંયમ ત્યાં ન છે,  
ભૂમિકા જેવી જેવી હો જુદો સંયમ તેમ છે.

માનવી એક જે માને ભાવ સંયમનો હૃદે,  
બીજાના જીવને તેથી જુદો સંયમ તે બને.  
જેમ જીવનનો ઊંચો ભાવ હોય ખરેખરો,  
—હૈયે સંયમનો તેવો વલ્યાં મૂળ કરે જરો.

સામાન્ય માનવી જેને માને સંયમ જીવનો,  
તેના ભાવ થકી ક્યાંયે જુદો સંયમ તે ખરે !

જેમ જેમ થવાતું રે' ઉચ્ચ ઉર્ધ્વ દશા વિષે,  
મર્યાદા સંયમે ત્યાં ત્યાં મેળે ઓગળતી જશે.

બુદ્ધિની તર્કશક્તિથી પામી સંયમ ના શકો,  
બુદ્ધિને છેતરી વૃત્તિ ભોગવી ભોગ લે સહુ.

ભોગેચ્છા-વૃત્તિ તો સૂક્ષ્મ પોતાના વૃહેણમાં જતાં,  
કુળવેલો ન હો કાબૂ બુદ્ધિ આપે શું કામ ત્યાં ?

કાબૂ મેળવવા કાજે સાધનાની જરૂર છે,  
તાટસ્થે વૃત્તિઓ સાથે ખેલવું યુદ્ધ જીવને.

(‘કર્મગાથા’, આ. ૧, પૃ. ૮૮, ૬૦)

\*

\*

## ઉપયોગ, સર્વ કંઈનો

(અનુષ્ટુપ)

નકામો કોઈ વિચાર નકામી ઊર્ભિ તે કશી,  
નકામું સ્થૂળનેયે તે વેડજી દેવું ના કદી.

ઉપયોગ બધાનોયે ભાવયોગ્ય કર્યા કરી,  
પોતે જન્માવવાનું છે હૈયે જીવનને ફરી.

જે વિકાસ થતો હોય એનાથી માપ કાઢવું,  
સૌનોયે તે વિકાસાર્થે ઉપયોગ કર્યા જવું.

(‘કર્મગાથા’, આ. ૧, પૃ. ૮૨, ૮૩)

## સંઘર્ષણોની આવશ્યકતા

અથડામણ, સંઘર્ષણ વિના અજિની પ્રગટતો નથી, વીજળી ઉત્પન્ન થતી નથી; ટિપાયા વિના આકાર ઘડાતો નથી, તેમ જીવનવિકાસ પણ અનેક જાતનાં સંઘર્ષણોથી થતો રહે છે. નવસર્જન થવાવા સારુ દ્વૈત આવશ્યક બને છે, તથા ઉત્કટ લાગણીની ને એકાગ્ર કેન્દ્રિતતાની પણ જરૂર રહે છે. પૃથ્વી અને સૂર્યના પ્રખર તાપના સંઘર્ષણથી કે ધરતી ને વરસાદના મેળાપથી સર્જન થાય છે. જેમ બીજાં નવસર્જન પરસ્પર વિરોધી દેખાતી ગુણશક્તિઓનાં સંઘર્ષણથી થાય છે, તેમ જીવનમાં પણ નવસર્જન માટે સંઘર્ષણ જરૂરી બની રહે છે. જીવનમાં વિરોધાભાસી લાગણીઓના, વિચારોના, વૃત્તિના, સંસ્કારોના, જગતના પ્રવાહોના આધાત-પ્રત્યાધાતો એવાં એવાં અનેક સંઘર્ષણો ઊભાં થતાં હોય છે. આવાં સંઘર્ષણો જ્ઞાનના હેતુ માટે સ્વીકારાયેલાં હોય છે તો જીવનને ઉપકારક નીવડે છે, કલ્યાણપ્રદ બને છે. જેમ ધરતી એવાં સંઘર્ષણોથી નવાં લીલાં વખ્તો પરિધાન કરે છે અને જગતની જડ અને ચેતન સૃષ્ટિમાં નવજીવન પાંગરે છે,

તેવી રીતે જીવનમાં આંતરિક સંઘર્ષણો પણ નવી સૃષ્ટિ જન્માવશે ને આપણાને એકલાને જ નહિ, પણ આપણી આસપાસ સર્વત્ર નવજીવનની પરિમલ પ્રસરાવી બીજાંને પણ શ્રેયસ્કર થઈ પડશે.

જ્યાં સુધી આપણામાં ઘર્ષણો નહિ જાગે ને એનું ઉત્કટ ભાન નહિ લાધે, ત્યાં સુધી જીવનની કટોકટીની પળો આવવાની નથી. જીવનને યોગ્ય પથે વાળવાને ને કેળવવાને માટે એવી પળો ઘણી જરૂરની છે. જીવનવિકાસની કેળવણી અર્થે તેવાં સંઘર્ષણોના સ્વીકારનો હેતુ છે.

(‘જીવનસંશોધન’, આ.૨, પૃ. ૨૮-૨૯)

\*

\*

### સંતાનો પ્રતિનો મા-બાપનો ધર્મ

પુત્રને ઉત્તમ ગુણવાળો બનાવવા માટે મારા આશીર્વાદની જરૂર હોય નહિ. એ આશીર્વાદ તો તમો, માતાઓ જ આપી શકો. એ એનું જીવન સાર્થક કરે એવો બનાવવાનું તમે ધારો તો જરૂર બનાવી શકો; એ શક્તિ, પ્રાણ, શ્રદ્ધા, ભાવ એ બધું જ બહેનોમાં છે જ. માત્ર એના ઉપયોગનું ક્ષેત્ર જુદું હોય છે. એ સ્થળાંતર થતાં બધી શક્તિ જન્મશે. સંતાનને પ્રેમભાવથી છેરો. એની આગળ ભગવાનની વાતો કરો, નામધૂન સંભળાવો, સ્તનપાન કરાવતી વેળા તમે ખૂબ શાંત ને પ્રેમભાવવાળાં બની એકાગ્રચિતે ભગવાનનું નામસ્મરણ કરતાં રહો. જેથી એ બધો ભાવ એનામાં ઉત્તરે, પણ પ્રથમ તમારા દિલમાં એ તમના પ્રગટવી જોઈએ, કે મારે એને એવો બનાવવો છે.

\*

\*

તમારા પુત્ર વિશે તમે મા-બાપ કોઈ પણ પ્રકારની આસક્તિ, ઈચ્છા મનમાં પણ સેવશો નહિ. જે બાળકો ઉપર તેમનાં મા-બાપોની એવી રાગાસક્ત તીવ્ર ઈચ્છાઓના હુમલા

થયેલા છે, તેઓ ઘણી વાર મા-બાપોની ઈચ્છાથી વિરુદ્ધના જ નીવડેલા છે. એટલે એને જેવા થવું હશે તેવો થશે.

(‘જીવનપગથી’, આ.૩, પૃ. ૧૦૮)

\*

\*

સંતાનને આપણી રીતે નહિ પરંતુ તેની રીતે, તે શોભે એમ એને પાસાં પાડવાનું કામ ભગવાને આપણને સોંપેલું છે. એને ઓપ ચઢવવાનું કાર્ય યોગ્ય રીતે નહિ કરી શકીએ, તો આપણો ધર્મ આપણે ચૂક્યા ગણાઈશું. એને ઘડવાનું કામ આપણા (મા-બાપના) જીવનવિકાસ માટેછે. એ કર્મ કરવામાં આસક્તિ, મોહ, મમતા, રાગ, આદિ આપણને મુદ્દલે ન હોવાં ઘટે. જેટલો મોહ, રાગ અને મમતા તેટલી જ જકડામણ વિશેષ અને મુક્ત થવું અશક્ય. જો મુક્તિને માર્ગ જવું હોય તો આ બધાંમાંથી દુટાય તેમ પ્રવર્તવું.

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૧૦૩)

\*

\*

જગતમાં જેમ બીજાં બધાંનું સાધકે પ્રેમથી સહી લેવાનું રહે છે તેમ આપણાં ફરજંદોનું પણ સમજપૂર્વક ગળી જવામાં આપણી (મા-બાપોની) યોગ્યતા છે. છોકરાં\* યોગ્ય રીતે ન વર્તે તો તેનું પરિણામ તેઓ પોતે જ ભોગવવાનાં છે, તે જાણજો. પ્રેમ-ભાવે, તપશ્ચર્યાભાવે સહેવું ને ઉદાર દિલ રાખીને તેમને સમજાવટ કર્યા કરવી એ જ તેમને યોગ્ય સમજણમાં ને વર્તનમાં લાવવાનો માર્ગ છે. ન સમજે તો આપણું માનભંગ થાય છે, એમ પણ ન માનવું ઘટે. ‘તો પછી આપણું સ્થાન ક્યાં’ એમ મન આપણને પૂછે; તો આપણું સ્થાન આપણામાં જ રહેલું છે. કશાથી ત્રાસવાનું ન હોય. બુદ્ધિથી શક્ય હોય તો તેટલો, હદ્યપૂર્વકની યોગ્ય

\* મોટી ઉમરનાં, પુખ્ત વયનાં.

ભાવનાથી, એનો ઉકેલ થવા કાજે જે કંઈ યોગ્ય હોય તે કરવું  
ને સંતોષ માનવો. (‘જીવનપ્રેરણા’, આ.૧, પૃ. ૮૪-૮૫)

\*

\*

### સાધનામાં રસ ક્યારે પડે ?

૧. જીવનમાં જેને આપણે સૌથી મહત્વનો ગ્રશ્મ ગણતા  
હોઈશું એમાં રસ પડશે.

૨. જેને માટે પ્રયત્ન થયા કરતો હશે, એને માટે લાગણી,  
પ્રેમ હશે તોપણ રસ પડશે.

૩. જે મેળવવું હશે એની ઉત્કટ જિજ્ઞાસા ને તમના પ્રગટી  
હશે તો એની તીવ્ર ભૂખ જાગશે, ને રસ પડશે.

૪. ‘ગરજ’ જાગી હશે તો રસ પડશે; અમુક વસ્તુ કર્યે જ  
છૂટકો છે એવો દઢ મરણિયો નિર્ધાર કર્યો હોય, કે જે ન થાય તો  
જીવ્યું નકામું બને તો રસ પડે.

૫. જેનું સતત ચિંતવન થયાં કરતું હશે એવામાં રસ પડશે.

૬. જીવનધ્યેયની પ્રતીતિ થઈ ગઈ હોય, ને એના વિના  
જીવનમાં બીજા કશામાં રસ ન જામે તો રસ પડે.

૭. ઐહિક પુરુષાર્થના પરિણામે મળેલાં તમામ પ્રકારનાં  
હુન્યવી સુખ, સગવડ હોવા છતાં એ બધાંથી દિલમાં ચેન ન હોય  
ને હદ્ય અંદરથી હજી કશાક ઓરને ઝંખતું થયું હોય તો રસ  
પડે.

આવાં આવાં કારણોથી સાધનામાં રસ પડવા સંભવ છે.  
ભલેને આપણાને શરૂશરૂમાં રસ ન પણ કદાચ જામે, યા શરૂમાં  
રસ પડીને પછીથી મંદ ગતિ થઈ જાય. તોપણ, જીવનનું હવે  
શેષ કાર્ય આ જ હોઈ શકે છે, એવો દઢ નિર્ધાર જો પ્રગટાવી  
શક્યા હોઈશું ને એક યા બીજા સાધનને વળગી રહીને જ્ઞાનપૂર્વક

પ્રેમભક્તિથી કશુંક ને કશુંક કર્યાં કરતાં રહીશું તો કોક દિન  
એમાંથી વેગ જન્મી જવાનો છે.

(‘જીવનપગથી’, આ.ડ, પૃ. ૫૬-૫૭)

\*

### સાધના અનિવાર્ય

પ્રભુની દિવ્ય શક્તિ તે વિશ્વમાં સચરાચરે,  
હજારો રીતથી વ્યક્ત પોતે કેવી થયાં કરે !

જાડમાં જાડરૂપે તે, પાણીમાં પાણીરૂપ તે,  
ચેતના-મર્મની રીતે આવિભવ રૂપે ઠરે.

સર્વના મૂળમાં જોતાં ચૈતન્ય-શક્તિ વાસ છે,  
વૈજ્ઞાનિકો કહે એવું પ્રયોગે, સિદ્ધ તે કરે.

‘જો તે હો સત્ય તો કેમ એને જોઈ શકાય ના ?’  
પ્રશ્ન એ ઉઠતો સૌને; વચ્ચે વિક્ષેપ ક્યાંક ત્યાં.

ઈન્દ્રિયો, મન ને ચિત્ત, અહંકાર તણા રૂપે,  
ભેળવાયેલી તે ભેગી જુદી કેમ કરી જુઓ ?

ઈન્દ્રિયો, મન ને ચિત્ત બુદ્ધિ પ્રાણ વળી બીજાં,  
અહંકારાદિથી નોખું થવાનું રહ્યું ત્યાં સદા.

તે બધાંથી થયા વિના પૂરેપૂરું જુદું હદે,  
આત્માની દિવ્ય શક્તિ ના પમાયે અન્ય કો રીતાં.

પ્રચંડ સાધના ઉગ્ર તે કાજે કરવી પડે,  
તે વિના એ નથી શક્ય ઉપાયે કોઈ રીતિએ.

લાખો વાર કંઈ બોધ સાંભળ્યાં કરશો ભલે,  
જશો કોટિય વારે છો સંતનાય સમાગમે.

શાસ્ત્ર પારાયણો ઊંડાં ને અભ્યાસ કરો કર્યા,  
તોયે ના પમાવાનું વિના કેં સાધના કર્યા.

સાધનામાત્ર ઉપાય એકલો એક ત્યાં ખરો,  
શક્તિને પામવા કેરો, ફાંફાં બીજાં બધાં ગણો.

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૪૪)

\*

\*

### એકાંતિક સાધનાની જરૂર, શરૂમાં, શા માટે ?

જીવનનો સાધક તો જ્યાં ત્યાંથી સદ્ગ્રાવનાની પિછાણ ને  
કદર કર્યા વિના રહી શકતો નથી. જેનું તેનું યોગ્ય મૂલ્યાંકન તે  
યથાભાવે કરતો રહેછે. કોઈ પણ સદ્ગ્રાવના હાઈને તે અનુભવ્યા  
વિના રહી શકતો નથી, તેથી તે જીવનની સકળ સદ્ગ્રાવના  
મૂળમાં છે. તેની ભાવના જેમ એકાગ્ર અને કેન્દ્રિત તેના લક્ષ્ય  
પરત્વે રહ્યાં કરેછે તેમ તે પાછી સર્વતોમુખી થવાને પણ એકધારી  
મંડ્યા કરતી હોય છે. તેની દાખિને એકમાં એકાગ્ર કેન્દ્રિતપણે  
થવાવાનું જે થાય છે તે તો વિસ્તાર પામવાપણાની દશા ગ્રાપ્ત  
કરવાને માટે. તેનું એકમાં જે પુરાઈ રહેવાપણું એક કાળ પૂરતું  
બન્યાં કરે છે તે તો જ્વાળામુખીની જેમ બહાર ફૂટી નીકળતાં  
પહેલાં તેના અંદરના ભૂગર્ભમાં ઘણા સમય પહેલાંથી બહાર  
ફાટવાની કિયા-પ્રકિયા સતત ચાલતી રહેલી હોય છે તેના જેવી,  
અથવા તો માખણ મેળવવા માટે, દૂધને દહીં કરવા સારુ તેને  
થોડો સમય હલાવ્યા વિના એકાંત સ્થળે રાખવાની જરૂર રહે છે  
તેના જેવી આ પૂર્વતૈયારી છે. આવા પ્રકારની પૂર્વતૈયારીરૂપ  
સાધનામાં એકાગ્ર ને કેન્દ્રિત થવાની સાધકને કામચલાઉ

આવશ્યકતા નીપજે છે. તેથી તે સમાજથી વેગળો, અટૂલો ને એકલો પડી જાય છે, એમ માનવું તે યોગ્ય નથી. વૈજ્ઞાનિક જેમ પોતાની શોધના પ્રયોગના મનન-ચિંતવનમાં એકાગ્ર રહીને, તે કાળના તબક્કા પૂરતું એકાડી જીવન જીવીને બધા પ્રકારના જીવન પરતે દસ્તિ દોડાવતો નથી હોતો,—ને આને જગત યોગ્ય પણ ગણે છે—તેમ સાધકનું પણ થતું હોય છે.

જેણે જેણે કંઈક મેળવવું છે, તેણે તે મેળવવાના પ્રયત્નમાં એકાગ્ર ને કેન્દ્રિત થયા વિના ચાલતું હોતું નથી. જેણે જે જે પ્રવૃત્તિ જીવનધ્યેયને વિકસાવવાને હાથમાં લીધી હોય છે, તેમાં તેણે એકચિત થવું જ પડે છે. આ હકીકત જીવનનાં સર્વ ક્ષેત્રોને લાગુ પડે છે. લડાઈના જોશને જીવતું ને થનગનતું રાખવા તે ગાળામાં સમગ્ર પ્રજાની દસ્તિને એકમાત્ર મુક્તિ ને વિજયના મુદ્દા પર જેમ એકાગ્ર ને કેન્દ્રિત રાખવામાં આવે છે,—ને તે કાળ પૂરતું જેમ બીજા કશા પરતે ઝાંઝું મહત્ત્વ અપાતું નથી,—તેમ જીવનમાં સાધના પરત્વેના વલણને સમજવાનું હોય છે.

આવો સાધક અકર્મણ્ય છે એમ પણ કદી નહિ ગણી શકાય. જીવનમાં ઉદ્ભવતાં રાગદ્વેષાદિક પ્રકૃતિનાં વલણોથી દોરવાઈ ન જતાં શાંતિ, સમતા, તાટસ્થ કેળવવાને જાગૃતિપૂર્વક મથ્યાં કરવું, ને જીવન પરત્વેના સકળ વર્તનભાવમાં સત્ત્વગુણને પ્રગટાવવાને એકધારું જ્ઞાનપૂર્વક મથ્યે જવું,—એને શું કર્મ નહિ ગણાય કે ? ને તેવું કર્મ પણ પ્રભુપ્રીત્યર્થે, પ્રભુભાવે ને જ્ઞાનભક્તિપૂર્વક શ્રીભગવાનના ચરણકમળે સમર્પણભાવે થયાં કરે—આ બધું કંઈ જેવું તેવું કર્મ નથી. સંસારના કર્મથી સાધનામય જીવનનું કર્મ નિરાળું છે. સંસારનું કર્મ સ્થૂળ હોઈ દેખી શકાય છે; સાધના-કર્મ સૂક્ષ્મ હોઈ દેખી શકતું નથી.

\*

\*

## સાધકનું સ્વજન પ્રત્યેનું વલણ

કોઈ આપણું સ્વજન આપણી સાથે જગડવાનું કરે, કલેશ, સંતાપ કે કંકાસ કરે ને તેથી જો આપણે લેવાઈ નહિ જઈએ કે આવરાઈ નહિ જઈએ, તો એનાં એ હથિયાર ભોંઠાં પડવાનાં છે; પરંતુ જો આપણે એથી કરીને ખીજવાયા, ચિહ્નાયા કે કોષે ભરાયા તો એ જીવનાં તે હથિયાર વધારે ધારવાળાં થવાનાં. એટલે એવી સ્થિતિમાં તો પ્રબુકૃપાથી આપણે વધારે સરળ, શાંત, ધીરજવાળા, સમતાવાળા ને પ્રેમભાવી બનીને વધારે સહનશીલતા કેળવ્યાં કરવાની છે. આપણા સત્ત્વગુણને કેળવવા, ખીલવવા માટે તથા આપણામાંની બિજવાટની, અકળામણની, કોષની વૃત્તિને સબૂરી પકડવવાની કસોટી, તકરૂપે તે કૃપાતક મળેલી છે, એમ હદ્યમાં માનીને આપણે ત્યારે વર્તવાનું છે. વળી, ત્યારે આપણું હદ્ય પ્રેમભાવની ખૂબ ભીનાશવાળું, કુમળાશવાળું, સહાનુભૂતિવાળું ને સામા જીવની અંદરનું જે જે સારું હોય તેની કદર કરવાની તત્પરતાભરી ભાવનાવાળું હોવું જોઈએ. આવે સમયે આવી જાગૃતિ આપણામાં પૂરેપૂરી જાગેલી હોવી જોઈશે.

જીવન આવા પ્રકારની અથડામણોથી ઘડાય છે. જે જીવનમાં કદી એવી અથડામણો, યુદ્ધો, ગૂંચો, મુશ્કેલીઓ, ઉપાધિઓ આવી નથી, તે જીવનમાં નક્કરતા કેમ કરીને આવી શકવાની છે? ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં પણ આપણી માનસિક સ્થિતિ પૂર્ણ સમતાવાળી, શાંતિવાળી, ધીરજવાળી રહી શકે, તેવા પ્રકારના શિક્ષણ કાજે ઈશ્વરે કૃપા કરીને તેવા સંજોગો આપણા માટે ઊભા કર્યા છે, તેવી જાગૃતિ ત્યારે હોવી જોઈશે.

સામા જીવની પ્રકૃતિનાં ગમે તેવાં દર્શન થાય, તોયે આપણી પ્રેમભાવનામાં તો બિલકુલ ફરક ન પડવો જોઈએ,—બલ્કે તે વધ્યાં કરવી ઘટે; તો જ જગતના ગમે તેવાની સાથે આપણે સમતાયુક્ત વર્તન રાખી શકવાને સમર્થ નીવડીશું; તો જ પાપીમાં પાપી ને દુષ્ટમાં દુષ્ટ જીવને પણ આપણે ચાહી શકીશું.

આપણો દોષ થયો હોય તો લાખ વાર માઝી માણી લઈએ. એમ કરવામાં ક્યાંયે સંકોચ ન સેવીએ.

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૭૫ થી ૭૭)

\* \* \*

જો કોઈ જીવની પ્રકૃતિ સામાને નમાવવા કે ઘસડવા એની છેલ્લી હદ સુધી જતી અનુભવાય તો એ તો આપણી પોતાની કસોટી છે અને આપણી કક્ષા કે દશા કેવી થઈ છે તે જાણવા માટેની એક પારાશીશી છે. તેવા સમયે સામા તરફ સહેજ પણ અવહેલના કે તિરસ્કાર થયાં યા પ્રેમભાવ અને સદ્ગ્રાવ ઓછો થવા પામે તો તો આપણું પતન થયું સમજવું. સેવાનો પ્રસંગ સાંપડ્યે પ્રેમભાવે એની સેવા પણ કરીએ, પરંતુ જ્યાં આપણે નમવું ન ઘટે ત્યાં તો ન જ નમીએ. એના આત્માને જરૂર વંદીએ, નમીએ, પરંતુ એની પ્રકૃતિને કે એના સ્વભાવને તો નહિ જ. કોઈની પણ પ્રકૃતિને કે સ્વભાવને નભ્યા કે આપણે નીચે ઉત્તર્યા સમજવું. ધ્યેયની બાબતમાં ને આદર્શ પરત્વે તો મક્કમ જ રહેવાનું હોય.

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૭૯, ૮૦)

\* \* \*

સાધકના જીવનમાં એવો પણ સમય આવે છે કે જ્યારે આપણાં પોતાનાં આપણાને નીચે બેંચી પાડવા મથેછે. તે ‘માર’નાં મોટામાં મોટાં હથિયાર પણ બને છે, કારણ કે એમના પરત્વે આપણાને બીજાં બધાં કરતાં વધુ પ્રેમ જામેલો હોય છે. પરંતુ એવી

જે કૃપાતક મળે છે, તે જો સાધક ખરેખરો જગ્રત રહેલો હોય છે તો આંખ ઉધાડનારી બની શકે છે. આથી એવાં પરત્વે આપણને રાગ, ભમતા, આસક્તિ, મોહ આદિ જે હશે, તે તેમની તેમની સાચી પ્રકૃતિનાં દર્શન થતાં કપૂરની જેમ આપણામાંથી ઊરી જશે. સાધકના જીવનમાં નરી શુષ્ણતા પણ ન હોવી જોઈએ. તે તો સદાય કોમળમાં કોમળ બનેલો હશે. તે સાથે તેના ધ્યેય પરત્વેની તેની મક્કમતા વજ કરતાંથી કઠણ હશે. જીવનમાં કારુણ્ય, ઉદારતા, વિશાળતા, પ્રેમ વગેરેને સ્થાન છે, પરંતુ તે બધાં વાપરવાનાં છે ધ્યેયને ખાતર,——અસત્ય કે પ્રકૃતિના નીચલા થરોને અપનાવવા ખાતર નહિ. ઊંધા સમજાઈશું, ઘાતકી લાગ્યાં કરીશું, એવું એવું બનવાનો સંભવ લાગે તોપણ ધ્યેયને યોગ્ય એવા સમતાભર્યા પ્રેમના ભાવયુક્ત અડગ વર્તનથી સામાને જીવનની સાચી સમજ ને ઉચ્ચ બાજુ દર્શાવી શકવાના છીએ. એક વખત સામી વ્યક્તિને આપણી મક્કમતાનો જ્યાલ જાગ્રી ગયેથી ને આપણને ચસાવવું અશક્ય છે તેવું તેને લાગતાં આખરે પોતાનો તંત તે મૂકી પણ દે.

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૮૧-૮૨)

\*

\*

### જીવન-સાથી પ્રત્યેનો ધર્મ

(અનુષ્ટુપ)

યોગ-માર્ગ જવું જો હો એનાથી અન્ય રીતમાં,  
—તમને કો જવા પ્રેરે, ‘ના’ કહો દઢતાથી ત્યાં.

દુભાતાં દિલ બીજાંનું એવું કું કરવા જતાં,  
પ્રેમ ઊંડો હુદે ધારી એવાંને સમજાવવાં.

સાથીનો સાથ લેવાને સાથ દેવાં કહ્યાં કરી,  
આપણે તો રહેવાનું સ્વ-માર્ગ દફ્તા ધરી.

એકની એક વાતે તે જાણું ત્યાં નહિ ચૂંથવું,  
-સ્પષ્ટ કે'વાનું જે હોયે તે કહી શાંત ત્યાં થવું.

બીજું તો માગતું રે'શે એની રીતે ચલાવવા,  
આપણે ડગવું ના ત્યાં રે'વું મક્કમ ત્યાં સદા.

(‘જીવનપાથેય’, આ.૩, પૃ. ૧૧૯-૨૦)

\* \* \*

જેને જે જોઈતું હોય લેવા ઘો તેમને બધું,  
નિઃસ્પૃહી આપણે રે'વું ભાગ આવેલ તે કરી.

સંડોવાઈ જવાનું ના કશામાં થાય આપણું,  
એ રીતે વર્તવાનું છે સ્વસ્થ શાંતપણે પૂરું.

પરિણામ તણી ચિંતા રાખી કર્મ ન કેં કરો,  
આવેલ કર્મના ભાવે વર્તી નિશ્ચિંતતા ધરો.

આપણું કરવાનામાં સર્વસ્વ પ્રાણ આપણે,  
—રાખીશું જો પૂરેપૂરો, યોગ્ય તો જીવવું બને.

ખોડખાંપણ બીજાંની આપણે કાઢવી નહિ,  
જે જે કેં આપણું વાઙું સુધાર્યો કરવું મથી.

લેવાની સૌ બીજામાંથી સારું તે ટેવ પાડવી,  
એવો અભ્યાસ ખંતેથી કરી શુદ્ધિ વધારવી.

(‘જીવનપગલે’, આ.૧, પૃ. ૨૩-૨૪)

\* \* \*

## સાધક અને સંસારી સંબંધો

(અનુષ્ટુપ)

સંસાર પ્રભુ-પ્રાકટ્ય લીલારૂપ ગણી હૃદે,  
પ્રભુભાવે પરોવાઈ તેમાં રે'વાનું આપણે.

કેળવ્યાં કરવાનો છે એવો અભ્યાસ જીવતો,  
વિના અભ્યાસ જે જીવે જીવવાનું નકામું તો.

સંસારી સર્વ સંબંધો સંસારી સુખ કાજ ના,  
પ્રેમ ઉદ્ભાવવા એ તો મળેલાં સૌ નિમિત્ત ત્યાં.

સદ્ગુરૂભાવના વધે હૈયે એ રીતે વર્તવું ઘટે,  
જીવન તેમની સાથે સંકળાવાનું એ રીતે.

સગાંવહાલાં બધાંથી જો હૈયાનો પ્રેમ ના વધે,  
-જાણવું ‘આપણી રીત હશે ના યોગ્ય વર્તને.’

વધારે ઓછું કો વહાલું આપણે ગણવાનું ના,  
સમભાવ હૃદ રાખી વર્તવું શ્રેય-અર્થ ત્યાં.

ઊંખ ના કોઈને માટે રે'વો હૈયે ઘટે કદી,  
કોઈનું સારું ને ખોટું સંઘરી રાખવું નહીં.

એક વાર કહી દેવું કોને કે'વાનું આવતાં,  
માનવાનું હશે જો તે માનશે આપમેળ ત્યાં.

ગોદાટી કદીયે કોની કેડે પડી ન કેં કરો,  
લીધેલા કામમાં પૂરી ગોદાટી કરવી ચહો.

પોતાના કામનો ખ્યાલ જેને પૂરેપૂરો ન રે'  
એવો તે ખ્યાલ બીજાંમાં કેવી રીતે ઉગાડશે ?

પોતાનામાં ઉગાડી જે શકે તત્ત્વ પૂરું હદે,  
તેનામાં પ્રગટે શક્તિ તેને હક્ક બધા મળે.

(‘જીવનપરાગ’, આ.૧, પૃ. ૨૧, ૨૨, ૨૫)

\*

\*

### સાધકનો ઘર-નોકર પ્રત્યેનો વર્તાવ

પોતાના જીવનને સાધનામાં સાંગોપાંગ વાણી લેવા ઈચ્છિતા સાધકે ઘર-નોકર પરત્વે સંપૂર્ણ ભાઈચારાની ભાવના રાખવી જોઈશે. નોકરના ભાગે આવેલું કામ નોકર કરે એટલે તે હલકો થઈ જઈ શકતો નથી, તેમ જ કોઈ લખપતિ કે કરોડાધિપતિ પોતાને ભાગે આવેલું કામ કરતો હોય, તેથી તે ઊંચા દરજાનો થઈ જતો નથી. કામના પ્રકારને લઈને ઊંચા નીચાના બેદ કદી હોઈ શકે નહિ. સાધકને એવા બેદ કલ્યાનામાંયે ન હોવા ઘટે.

અંતરમાં અને બહાર, ઉપર ને નીચે, બધે જે ભગવાનનો ભાવ સચ્ચાચરપણે પ્રસરેલો છે, તેને જીવનમાં અનુભવરૂપે હદ્યથી પ્રામાણિકપણે ઉતારવા મથનાર તે સાધક. એવો સાધક પોતાના નોકર અને કુટુંબીઓ વચ્ચે સદ્ગ્લાવની રૂએ કે ભાવનાની રૂએ કશો ફરક નહિ જુએ. તે માંદો પડતાં અગર તેની કોઈ એવી અગવડભરી સ્થિતિનો ઘ્યાલ આવતાં પોતાના કુટુંબીજન જેવી, તેની મર્યાદાની સ્થિતિનો વિવેક રાખીને, તેની યોગ્ય સેવા કરવાનું ને તેના ઉપયોગમાં આવવાનું ચૂકશે નહિ. તેની પાસેથી ગજા ઉપરાંતનું કામ કદી લેવાય નહિ. નોકરને કામ કેટલા કલાક અને કેટલા વાગ્યા સુધી પહોંચે છે, તેનું જીવતું ભાન રખાવું જોઈએ. કામને લીધે તેને મોડે સુધી રાત્રે જાગ્યા કરવું તો પડતું નથી ને ! તે પણ જોવાવું ઘટે છે. તેની જમવાની ને રહેવા કરવાની સગવડ, તેના જીવનની મર્યાદા અનુસાર, જોવાયાં જશે. કોઈ પણ યોગ્ય કારણસર આપણે ત્યાંથી તેને

જવાનું બને તો બીજાને ત્યાં ગમે તેવા સંજોગોમાં યશસ્વીપણે તે પોતાનું કામ કરી શકે એવી કેળવણી ને તાલીમ પણ આપણે ત્યાં એને મળી હોવી જોઈએ.

નોકર સાથે સાધક કદી પણ અસત્ય નહિ બને અને હરેક પ્રસંગમાં વાણીમાં મીઠાશ જાળવશે. નોકર એટલે તેને નવરો રખાય જ નહિ અને સતત દિવસભર કામ એક પછી બીજું એમ બતાવ્યાં કરવું જોઈએ, એ તો ઘણી હલકટ મનોવૃત્તિ છે. નોકર પણ માનવી છે. તેને પણ લાગણીઓ હોય છે. એને પણ આરામની જરૂર હોય. વળી, કેટલેક ઠેકાણે તો ઘરનાં મુખ્ય માણસો ન સૂઅએ, ત્યાં સુધી નોકરથી સૂવાનું બનતું નથી. તેવે ઠેકાણે પોતે વિચાર કરીને નોકરને પણ ઓછામાં ઓછી રીતે કલાક ઊંઘ મળવી જોઈએ, એવો વિચાર સમજદાર જીવ કર્યા વિના નહિ રહે. નોકરનું શરીર માંદું હોય તે વેળા તેને કામ ન કરવા દેતાં તેને આરામ, દવા અને આપણી હુંફ મળે તેવી સગવડ, મોકળાશ ને સહદ્યતા જો આપણે દાખવી શકીએ તો નોકરને આપણા વિષે સદ્ભાવ રાખવામાં સહાયરૂપ થઈ શકાશે. એવું કરવું એ આપણો ધર્મ પણ છે. નોકરની શક્તિની મર્યાદા જોઈને તેનાથી આસાનીથી થઈ શકે તેટલું જ કામ કરાવવું જોઈએ. નોકર ગરજનો માર્યો આપણે ત્યાં કામ ભલે કરશો, પરંતુ તેની પ્રત્યે જો આપણો વર્તાવ સખત અને કઠોર હશે તો તેના દિવમાં આપણા પ્રતિ સદ્ભાવ કે પ્રેમ કદી નહિ જાગે. આપણે પોતે તેની તેવી સ્થિતિમાં હોઈએ તો આપણાને કેવું લાગે તે આપણે વિચારવું.

સાધકનું નોકરની સાથેનું વર્તન પ્રેમભાવભર્યું હોવું ઘટે છે. સાધક એમ કદી ન માને કે તેની સાથે તેવું વર્તન રાખવાથી નોકર ચઢી વાગશે કે ‘ફાટી’ જશે; તેની સાથે સાથે નોકરનું અયોગ્ય વર્તન થતાં તેને તેમાંથી વારવાનું કરવાને પણ નહિ

શૂકે. સાધકના હદ્યનો સહજ પ્રેમભાવ ને તેની સાથેનું એવું નૈસર્જિક વર્તન નોકરના દિલમાં કોઈ અનેરો ભાવ પેદા કર્યા વિના નહિ રહે. નોકર એ નોકર નથી પણ કુટુંબનું જ અંગ છે એવો ભાવ હદ્યમાં સ્હુરવો ઘટે. નોકરને બને ત્યાં સુધી વજૂદવાળું યોગ્ય કારણ વિના આપણે કાઢી ન મૂકવો. તે પોતાની મેળે જવાનું કરે તો જુદી વાત છે.

નોકર પરત્વે સાધક સંપૂર્ણ વિશ્વાસ રાખે ખરો, પરંતુ પોતાના એવા વિશ્વાસભર્યા વલણથી જો નોકર પોતાના સ્વભાવ પ્રમાણે આડેઅવળે પ્રેરાતો હોય, તો તે બાબતમાં તેને સમજીવવાનો અને જરૂર પડતાં અટકાવવાનો પણ સાધકનો ધર્મ બને છે. પોતાની વિશ્વાસની લાગણીને લઈને પેલાનું અકલ્યાણ થવા દેવાનું નિભિત તે નહિ બની શકે. તેમ જ જાણી જોઈને નોકરને બેદરકાર થવા નહિ દે; સાથે સાથે ખોટી રીતે તેને ધોંચપરોણા પણ નહિ કરે.

વર્ષમાં એક મહિનાની ચઢતે પગારે હક્કની રજા અને જો તે ન ભોગવે તો તેનું જુદું વળતર અને મહિનામાં ચાર દિન છૂટ્ટી તેને મળવી જોઈએ. નોકર પોતે કુટુંબીજન જેવો થઈને સમજીને તે છૂટ્ટી ન ભોગવે તો તેનું પણ જુદું વળતર દેવાનું હોય. વર્ષના અંતે એકાદ મહિનાનો પગાર બક્ષિસરૂપે આપી શકાવાની શક્યતા હોય તો તેમ પણ વિચારાય.

આખરે સાધક તો નોકરને નોકર તરીકે ન સમજતાં તેને આવી મળેલું સ્વજન લેખશે, ને એવી ભાવના રાખશે. જ્ઞાનપૂર્વક ભાવનાથી પ્રેરાયેલા સદ્ગ્રાવનો કોઈ ગેરલાભ લઈ જશે એવી ભીતિ સાધકે સેવવાની ન હોય. પોતાનો ધર્મ તેના પરત્વે સર્વ પ્રકારે યોગ્ય પ્રકારના વર્તનમાં પરિણામે એ જોવામાં સાધકનો સંતોષ સમાયેલો હોય.

(‘જીવનસંદેશ’, આ.૨, પૃ. ૨૧૬ થી ૨૨૧)

અહીં ‘નોકર’ એ એક માત્ર ઘર-નોકર જ સમજવાનું નથી; પરંતુ એકથી વધુ નોકર હોય તો તેમ તથા રસોઈ કરનાર મહારાજ, આયા, ગુમાસ્તા, કારીગર, શોફર, માળી, ચોકિયાત, મદદનીશ, મંત્રી આદિ સર્વ પ્રકારની વ્યક્તિઓને સંકળાયેલી ગણવાનું છે, ને તેઓ તેઓ પરતેનો પૃથક પૃથક ધર્મ સાધકે યથાયોગ્યપણે ભાવપૂર્વક પોતાના હદ્યનો ભાવ વિકસાવવાને માટે જ જાણો તે બધું ભગવાને સાધનરૂપે બક્ષ્યું હોય તેમ સહદ્યી વલણ રાખીને તેવી બધી પ્રભુ-ભેટને નવાજવાનું હોય.

\* \* \*

### સાધકોનું માંહોમાંહેનું વર્તન

સાધકોના સૂત્રધાર એક જ ગુરુ જ્યાં હોય છે ત્યાં, ને તેમ છતાં પણ, સાધકોનાં પરસ્પર વર્તનમાં ઘણી વાર તેમને છાજે નહિ એવું વર્તન થતું જોવામાં આવે છે. ખરું જોતાં તો સાધકો એટલે ગુરુરૂપી વિરાટ શરીરનાં જુદાં જુદાં અંગો. જેમ માનવીશરીરનાં દરેક અંગનાં નામ, કામ અને પ્રકાર જુદા જુદા હોય છે તેવું જ ગુરુના વિરાટ શરીરનાં આ અંગો વિષે છે.

જ્યારે કોઈ જીવ સાધકદશામાં આવે છે, ત્યારે તેના સ્વભાવનાં સારાં તત્ત્વો અને અનિષ્ટ તત્ત્વો બન્ને જે અત્યાર સુધી સાધકમાં ઉડી પડી રહેલાં હતાં એ ઉપર તરી આવે છે, બહાર વ્યક્ત થાય છે. તેમાં નિભન તત્ત્વોના હુમલા ઝટ થાય છે. તેમનું વ્યક્ત થવાપણું વેગથી અને ઝડપથી બને છે, અને એ સવિશેષપણે જોર પર આવતા જણાય છે. ઈર્ધ્વા, અસૂયા ‘હું’પણું, કોધ, મત્સર, અયોગ્ય સ્પર્ધા, ગુરુ ઉપર પોતાની માલિકીની વૃત્તિ, બીજાંના ભોગે પોતાનું સારાપણું દાખવવાની અને દેખાડવાની વૃત્તિ, પોતાને વધુ મહત્ત્વ મળ્યાં કરે તેવી ગોઠવણી આદિ જીવપ્રકારની નિભન વૃત્તિઓ એકદમ જોરથી

હુમલો કરે છે. ઘણાં વરસથી વહેતી કોઈ નીકમાં કે ખાળકુંડીમાં નીચે કચરો પડી રહેતો હોય અને તેની ઉપર ઉપરથી પાણી વહી જતું હોય તો તે પાણી પ્રમાણમાં સ્વચ્છ હોય છે; પણ જ્યાં નીક સાફ કરવાની, ખોતરવાની શરૂઆત થાય છે, ત્યારે તે પાણી ઉલદું વધુ બદબોવાણું, મેલું ને ડહોળાયેલું બને છે. તેવું જ કંઈક સાધકના જીવન વિષે બને છે.

આવી વેળાએ ઘણી વાર સાધક તેના નીચલા થરના જોરથી વહેવા માંડેલા પ્રવાહમાં તણાઈ પણ જાય છે—જો કે પછી જગૃતિમાં આવતાં તેને તેનું ભાન પણ થાય છે અને સાધકોમાં કદી કદી માંહોમાંદે હુંસાતુંસી, ખેંચતાણ અને ઝગડા પણ થતા હોય છે. આથી આવા સાધકો ઘણા નીચલા દરજજાના છે એવું માનવા તરફ સંસારી લોકો દોરાય છે, પરંતુ વાસ્તવિકપણે તે માન્યતા અધારિત છે.

સાધકમાં અને સંસારીમાં એક મોટો ફેર છે. એની બધી વિકૃતિઓ છતાં સાધક ભગવાન તરફ અભિમુખ થોડેઘણે અંશે પણ હોય છે; એટલે કાળજીમે તે પોતાના સ્વભાવને વધુ ને વધુ ઊંડી રીતે પારખતો જતો હોય છે અને નીચલા થરના વહનના પટને છોડતો જતો હોય છે, એટલે કે તે સ્વભાવવશ થવાનું ઓછું ને ઓછું કરતો જાય છે. એટલે આવા સાધકો વચ્ચે અંતે તો એક દિન સુમેળ જાગ્યા ને જામ્યા વિના રહેવાનો નથી. એટલે તે જેમ જેમ જાગતો જશે, અને તેનો જેમ જેમ કિયાત્મક ઉપયોગ થતો જશે, તેમ તેમ નવી આવેલી કે ખીલેલી શક્તિ જ આપોઆપ બધામાં સુમેળ પ્રસરાવશે.

પ્રકૃતિના ગમે તેવા પ્રબળ હુમલાઓ આવે તોપણ સાધકે જગૃતિપૂર્વક તેમનો સામનો કરીને બીજાં સાથે અધારિત વર્તાવ ન થઈ બેસે તે જોવાનું રહેશે. એણે પોતાના વર્તનને પ્રત્યેક પળે

સમજવા માંડવું પડશે અને તે ક્યાં ખોટું છે એનો પૂરૈપૂરો જ્યાલ એનામાં જગવો જોઈશે. સાધકે પોતાની જાતને બરાબર ઓળખી લીધી હશે, તો હંમેશાં તેની દસ્તિ, વૃત્તિ અને વલણ એના પ્રત્યેક પ્રસંગમાં, વિચારમાં, વાણીમાં ને વર્તનમાં પોતાની ભૂલ ક્યાં છે એ જ જોવા પ્રતિ તેનું લક્ષ રહેશે. પોતાને થયેલા કે થતા કોઈ પણ આધાત વિષે કે અન્યાયી દેખાતા વર્તન વિષે જે કોઈ સાધક સામાનો દોષ જોશે અથવા શોધવાનું કરશે તે કાં તો ખરેખરો સાધક નથી કે કાં તો તે પ્રસંગ પૂરતો કોઈ ભારે ભ્રમણામાં પડેલો જીવ છે.

ગુરુ પ્રત્યેક સાધક સાથે તેની તે તે કાળની જરૂરિયાત, સંજોગો, પરિસ્થિતિ આદિ જોઈને વર્તતો હોય છે; તેમાં કોઈ પ્રકારની અંગત પક્ષાપક્ષી કે ગાણતરીઓ-Considerations-ગુરુને હોતી નથી; તોપણ સાધકો કેટલીક વાર પોતાના અહમુના ને પ્રાણના પ્રેરાવ્યા ગુરુના વર્તાવ ઉપર મનમાં ટીકા કરવા, ન્યાય તોળવા બેસી જાય છે. આમાં સાધક પોતાની જાતને, ગુરુને અને સંકળાયેલ સાધકને એમ ગ્રાણેને અન્યાય કરે છે. સાધકને જ્યારે આવાં વલણો ઊઠે ત્યારે તેણે સવિશેષ જાગૃતિ રાખીને તેમાંથી તરત દૂર થઈ જવાનો મક્કમ પ્રયત્ન કરવો ઘટે છે.

(‘જીવનસંદેશ’, આ.૨, પૃ. ૨૧૦-૨૧૫)

\*

\*

જે જે સાધકો જે એકસાથે સંકળાયેલા હોય, તેઓ અરસપરસે મળવાનું થતાં પોતાના અનુભવોની આપલે કરે, કઈ કઈ રીતો ગ્રહણ કરવાથી સાધનાપથે સરળતા સાંપડી છે તે બધાંનો વિનિમય કરે ને એકબીજાના ઉત્કર્ષમાં પ્રીતિ ધરાવી, ઊલટ દાખવી, સંઘબળનો એ રીતે લાભ ઉઠાવે તે ઈચ્છવા યોગ્ય છે.

\*

\*

## સાધના-રહસ્ય

(અનુષ્ટુપ)

સંઘરેલા જૂના ખ્યાલો, જૂની જે કલ્યાણ બધી,  
જૂનાં ગાંઠતરી મૂલ્યો છોડી સૌ, ધારવું મથી.

જૂનાં તે ધોરણો આવ્યા વિના રે'શે કદાપિ ના,  
કિંતુ ત્યારે થવાનું ના તાબે તે વૃત્તિને જરા.

માપવાનું કદી રાખો કોઈને નહિ આપણો,  
લેવાનું પારખું છોડો, સોંપો તે સર્વ ઈશને.

મપાઈ જાય જે કોઈ ચિત્તમાં તે ન રાખવું,  
વહી જવા જ ધો એને ચોંટાડી ચિત્ત ભાવ શું.

સારાખોટા બધા ખ્યાલો રાખવાના ન આપણો,  
પ્રભુને તે સમર્પણે રહ્યાં ખાલી કરો હદે.

કોઈની વાતમાં મેળે ધ્યાન ના રાખવાનું છે,  
દોરે જે કોઈ કું લક્ષ તાટસ્થ્ય ધારવું હદે.

પ્રભુના ભાવનું લક્ષ જીવતુંજગતું કરો,  
એની પાછળ હોમાઈ જવાનું બધુંયે ચહો.

પ્રત્યક્ષ જીવને એને કર્યા વિના હદે કશે,  
ઠરીને જંપી ના કેમે બેસી રે'વાનું આપણો.

પરોવાઈ જશે ત્યારે અનેક તૂતમાં ખરે,  
આપણું ચિત્ત એવું કે શકીશું જાણી ના હદે.

જે કાંઈ કરતાં હો ત્યાં સ્પષ્ટ લક્ષ વિધાનનું,  
આપણો રાખવું યોગ્ય તણાયા વિશ ઊર્ભિથી.

જ્ઞાન, ભક્તિ, ઊંડું ધ્યાન, યોગના લક્ષ્યચિત્તથી,  
જેમાં તેમાં પ્રવેશાવું આપણે રાખવું મથી.

ભાવ હૈયા તણો જ્યારે પ્રત્યક્ષ જન્મતાં હદે,  
—પાકેલી ભૂમિકા ત્યારે આપણી જાણવી ઘટે.

(‘જીવનપગલે’, આ.૧, પૃ. ૨૧-૨૩)

\* \* \*

પ્રભુના માર્ગમાં જે જે અંતરાયરૂપે બને,  
ખરા હૈયાથી એનો સૌ ત્યાં ઈન્કાર થવો ઘટે.

કિંતુ તેવું થવાવામાં જ્ઞાનપૂર્વક તે કરો,  
કર્યું ના કર્યું બાકી તો મિથ્યા તે સર્વ જાણજો.

પ્રભુનો વેશ કું ખોટો અવિદ્યા અંધકાર તે,  
-લઈ આવે કંઈ વેળા, તે વેળા ચેતવું હદે.

સ્વીકાર કરવા કાજે સ્થિરતા મનની કરો,  
ચેતના જાગૃતિ રાખી પ્રકૃતિથી ન કું કરો.

કર્યા સૌ જે કરો છો તે કરો છો પ્રભુ કાજ સૌ,  
—ઉંડી ઉંડી હદે લક્ષે જીવતી ધારણા ધરો.

સમર્પણ કરી દેવી જાતને સર્વ ભાવથી,  
જે જે આપે પ્રભુ એને સ્વીકારી લેવું હર્ષથી.

થઈ દુઃખિત કે ધૂપો ત્યાં વિરોધ કર્યા કરી,  
બેળે બેળે સ્વીકારાતાં એનો અર્થ સરે નહીં.

આપણા કર્મમાં વ્યક્તિ ગમે તેવી નઠારી હો,  
નિરસત, કલ્પના, ઘ્યાલ તે સાથે આપણે ન કો.

સંસારમાં બધી રીતે પ્રભુ-ભાવ પરોવજો,  
સંસારી ભાવના રાખી સંસારે નહિ વર્તશો.

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૧૦૦, ૧૦૧, ૧૦૩, ૧૬૮, ૧૭૯)

\*

\*

સ્પૃહી રૂહેવા છતાં પોતે થવા વર્તવું નિઃસ્પૃહી,  
કદી આશા, કશી ઈચ્છા, હૈયામાં રાખવાં નહીં.

પુરુષાર્થ તણી માત્રા નિત્ય નિત્ય વધારવી,  
કૃપા, પ્રેમ પ્રભુ કેરાં માગતાં રે'વું ઉરથી.

ભૂત-ભવિષ્યના જાઝા વિચારો, કરવા ન કેં,  
આપમેળે સરે જેમ સરવા દેવું પ્રેમથી.

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૨ થી ૪)

\*

\*

સર્વ પ્રવૃત્તિના કર્મ સ્વભાવે વશ ના થવું,  
અહંતા છોડતા રે'વું કર્મ થૈ જ્ઞાનયુક્ત શું.

અનાસક્ત રીતે કર્મ પ્રવેશાવાનું રાખવું,  
હૈયે સદ્ગ્રાહ રાખીને પ્રભુને તે સમર્પવું.

ડો'ળાઈ ના જવું ક્યાંયે પોતે સ્થિર રહ્યાં કરી,  
રહી અંતર્મુખે જોવાં કર્મનાં મૂળ ચિત્તથી.

કર્મ સંબંધથી જેનો સંબંધ જીવને મળ્યો,  
તુચ્છકારી હુદે એને કોઈ કાળે ન નાખવો.

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૨૦)

\*

\*

સત્ય મેળવવા જોણે હૈયે હામ ભીડી હશે,  
બંધાશે તે કશામાં ના, પોતાને ઓળખ્યાં જશે.

યે તે  
કોઈના સ્થૂળને કોઈ દી બેસી ના પકડી રહો,  
સૂક્ષ્મની ચેતના-શક્તિ ઉઘત ગ્રહવા મથો.

માનવી પ્રકૃતિની જે નીચલી ભૂમિકા તણી  
—લઈ જનારી વૃત્તિઓ જીવને વાળવી રહી.

જે જે કરણ આંદું હો શક્તિ કેન્દ્રિત ત્યાં કરી,  
વાળવું પ્રભુભાવે તે, ચેતના વાપર્યા કરી.  
કર્મના હાઈમાં ભાવ નીતર્યા જે ન કેં કરે,  
મિથ્યા તે કર્મ; શેં પ્રાણ ત્યાં પછી પ્રગટી શકે !

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૮૪, ૮૫, ૮૬, ૧૦૭)

બીજા કોઈ તણા દોષો ન જોવા આપણે કદી,  
સાધી સુમેળ પોતાનો જે તે પોતે જીવો મથી.

છોડી પંચાત બીજાંની એક વાર પ્રભુ તણું,  
—પૂરું યંત્ર બની જાઓ, જોવાશે પછી સૌ ખરું.

સ્થિરતા, શાંતિ, આનંદ ને તાટસ્થ્ય બધાં થકી,  
—રાખવાને જરૂરી તે મૌન છે યોગ્ય ચિત્તથી.

ચિંતા, ઉદ્દેગ, કંટાળો, શોક, મત્સર, કોધ ને,  
-કામ-રાગાદિ ઠેકાણે રાખવા મૌન સાર્થ છે.

મોજાં વિચારનાં જે જે આવે તે સાથ નિઃસ્પૃહી,  
—જાણે નિર્લેપ બેઠેલા તમે હો એમ વર્તવું.

આદિ, મધ્ય અને અંતે જ્ઞાન-ભાવે કિયા કરી,  
પછી સમર્પવી પ્રેમે; કશું પાસે ન રાખવું.

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૧૦૮, ૧૧૭, ૧૨૮-૨૯-૩૧-૩૩)

આહારે ભાવના રાખી તે યોગ્ય પ્રાર્થના કરો,  
મળમૂત્ર જવા કાળે યોગ્ય તે ભાવના ધરો;  
‘પ્રત્યેક વ્યવહારેયે એવો ભાવ હદે ધરી,  
—જે તે સૌ કરવાનું છે’, હૈયે તે રાખજો સ્મરી.

ખુલ્લા થાઓ પ્રભુ પ્રત્યે, આપણાં સર્વ કર્મને  
—પ્રભુ દોરવણી નીચે મૂકી ધો પ્રાર્થિને હદે.

ઉન્મુખતા પ્રભુ પ્રત્યે પ્રેમભાવથી રાખજો,  
એવા પ્રયત્નની ધારા વહેતી અખંડ જાળવો.

પૂરું મરી મથો જાતે સર્વ યત્ન કર્યા કરી,  
પૂરી ચેતનતા રાખી કૃપા-સહાય ચહો પછી,

વર્તને, વાણી ને કર્મ આપણાથી બીજા મહીં,  
—થશે શું શું ? વિચારી તે આપણે વર્તવું રહ્યું.

---

પ્રભુનું નામ લેવાનું સદાકાળ ચહ્યાં કરો,  
સાથ એનો રખે ચૂકો એટલી તો કૃપા કરો.  
એકેય પળ માટે ના સાથ એનો કદી ચૂકો.

પોતાનામાં પ્રભુ જેઓ હદે ઉદ્ભાવવા ચહે,  
પ્રભુ હોય બધાનામાં જાણી તેમ હદે ચહો.

(‘જીવનપરાગલે’, આ.૧, પૃ. ૨૮ થી ૩૬)

\*

\*

દુઃખ એ તો પ્રસાદી છે પ્રભુના ઘરની મળી,  
સ્વીકારી વ્હાલથી જે લે ધન્ય તે તો થશે નકી.

પ્રભુની સહાય લૈ-લૈને આગળે આપણે જવું,  
પ્રભુની સહાય વિના તે શું કરી શકીશું કશું ?

માર્ગયાં કરો કૃપા એની ગદ્દગદ ભાવ વડે કરી,  
કૃપાના ભાવને યત્ને ઉતાર્યા કરવો ચહી.

(‘જીવનપગલે’, આ.૧, પૃ. ૫૫, ૬૭)

વિવેક જ્ઞાન સાથેનો ડિયામાં સૌ ધરાવીને,  
પ્રત્યેક ઘટનામાં એ પ્રભુનો હાથ ભાળવો.

\* \* \*

ત્યાગ અને બલિદાન થતાં સર્વ સમર્પણ,  
ભાવયુક્ત પૂરું જ્ઞાન રહેવું ઘટતું ઉર.

(‘જીવનપગલે’, આ.૧, પૃ. ૮૮)

યાંત્રિક વ્યવહારોમાં ભાવ કુંઠિત તો રહે,  
ત્યાં ઘટમાળમાં પૂરા બંધાતાં મુક્તિ ના મળે.

(‘જીવનપગલે’, આ.૧, પૃ. ૧૦૮)

સાક્ષાત્કાર કરી એનો શકો જીવન આ વિષે,  
એવી પ્રતીતિથી યોગસાધના કરવી હદે.

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૧૦૩)

\* \* \*

### સાક્ષીભાવ

આપણા વિચારો, લાગણીઓ, ભાવના, રસ, પ્રવૃત્તિ  
સંબંધ, વ્યાવહારિક ક્ષેત્રો—એવા અનેક પ્રસંગોમાં સાક્ષીભાવ

એટલે તેમાં અલગપણું તો રાખવાનું છે જ; પરંતુ તે અલગપણું તદ્દન શુષ્ક અલિપ્તપણાનું પણ ન હોવું ધટે; કારણ કે આપણે સાધનામાં આપણું રૂપાંતર કરવાનું ધ્યેય રાખ્યું છે; અથવા તો તે આવરણો છે ને તેની પર થઈને જે સ્થિતિમાં આપણે સતત પ્રેમભાવથી, રસથી સ્થિત રહ્યાં કરી શકીએ અને તેમ છતાં જે કંઈ કર્યા કરીએ તે, તે સ્થિતિને અનુરૂપ થયે જાય એવી સ્થિતિ ઉપજવવાની છે. સાક્ષીભાવની સાથે ને તેમાં આપણે એટલા પ્રમાણમાં રસ લેવો જોઈશે કે તે રસના સ્નિગ્ધપણાને લીધે આપણે તેને આપણા વેગમાં સાથે ભળવાને મથાવી શકીએ. તે તે સાથે જો Indifferent-ઉપેક્ષા ભાવે બેદરકાર-રહ્યાં કરીએ, તેમને કંઈ ગણકારીએ નહિ કે ધ્યાન ન આપીએ તો જે બધું થયાં કરશે, પરિણામશે, ને તેમાંથી જે ગતિ જન્મશે એ આપણાને મદદ કરનારી નહિ હોય.

આમ, આપણે જે જે સંબંધમાં, પ્રસંગમાં પ્રગાઠીએ તેમાં ભળી કે ભેળવાઈ જવાનું કે તણાઈ જવાનું તો ન જ બનવું જોઈએ, પણ તે તે સાથે એવી રીતે રસ લેવાનો હોય કે જેથી તે તે યોગ્યપણે વર્ત્યા કરે, બન્યાં કરે ને આપણાને સરળતા રહે. આપણા જીવસ્વભાવને ઝીણવટથી ઉથલાવ્યાં નહિ કરીએ અને નિરીક્ષણ તે બધાંનું નહિ થયાં કરે, તો એ બધું તેની જૂની ટેવોના પટમાં વહ્યાં કરવાનું ને આપણો સાક્ષીભાવ ક્યાંયે તણાઈ જવાનો, ને તેનું ભાન પણ ન જાગે એવો પૂરો સંભવ છે. સાક્ષીભાવ સાથે વિવેકવૃત્તિ પણ રાખવાની હોય જ.

આને એક સાધારણ નિયમ ગણીને આપણે બીજાં બધાં સાથે વર્તવાનું છે, પણ તેમ વર્તવા જતાં પાછી આગ્રહવૃત્તિ ન આવી જાય, એવો આસક્તિભર્યો રસ ન લેવાઈ જાય કે જેમાં આગ્રહવૃત્તિથી આપણે તણાઈએ, એ પણ જોવાનું રહેશે.

આગ્રહવૃત્તિ પણ હોઈ શકે છે, રાખી શકાય છે, —જો તે સાથે સાથે જ આપણે તટસ્થતા રાખી શકતા હોઈએ તો. આગ્રહ અને અનાગ્રહ કે તટસ્થતા એનો સંવાદ, સુમેળ કેમ જમે એ વળી જુદ્ધો સવાલ છે. પરંતુ એવી તટસ્થતા સાથેની આગ્રહવૃત્તિમાં પણ સામાના હિતનો જ સવાલ મુખ્યપણે આપણામાં ભાગ ભજવી રહ્યો હોવો જોઈએ. આ બધાં સાથે સમતોલપણું પણ જાળવાનું હોય જ.

(‘જવનસંદેશ’, આ.ર, પૃ. ૨૨૨ થી ૨૨૪)

\*

\*

### સાચું સુખ

(અનુષ્ઠાપ)

સુખને ખોળવા જેઓ શોધે બહિરૂ, ન મેળવે,  
સુખને અંતરે જેઓ શોધે તે સુખ મેળવે.

સુખ બીજાં તણા કોઈ આધારે ના મળી શકે,  
સુખ એવું મળેલું જે ના લાંબી વાર તે ટકે.

સુખની કલ્પના જેવી આપણા અંતરે હશે,  
સુખ તે રીતથી કોઈ કદીયે પામી ના શકે;  
સુખનો સર્વ આધાર પોતાની ઉપરે રહે,  
મેળવે સુખ પોતાથી તે સાચું સુખ મેળવે.

બીજાંની પાસથી જેઓ સુખ મેળવવા ચહે,  
કોઈ કાળે કદીયે તે મેળવી સુખ ના શકે.

બીજાંઓથી મળેલું જે સુખ તે બ્રાંતિકારી છે,  
એવા સુખે દિલાસો જે માને, તે જન મૂઢ છે.

સાચા સુખ તણી ઊંડી માન્યતા આપણી બધી,  
—મિથ્યા સર્વ, ખરા પાયા ઉપરે તે રહી નથી;

સુખનો મૂળ પાયો જે પોતાના અંતરે રહે,  
અંતરે વૃત્તિ વાળીને જે જીવે સુખ મેળવે.

પોતાના મનથી દુઃખી પોતાને માનીયે છીએ,  
દુઃખી તો કરનારું કો વિના પોતા ન કોઈ છે.

‘સર્વ જે તે થયાં જાય, તેનું ઉદ્ભવસ્થાન તે,  
—પોતાનામાં રહ્યું છે સૌ’, જાણતાં સુખ નીપજે.  
ખાલી નિમિત્ત બીજું તો આપણા જીવને ચઢ્યું,  
કર્મ-નિમિત્ત બીજું જે પોતામાંનું જ જાણવું.  
જાણી જે એમ પોતાને બીજાંને દેખતી પળે,  
વૃત્તિ-આવેગને રોકે પોતાને પ્રીધશે ખરે.

પોતાને લાગતું હો જે તેવી રીતે બધાંયને,  
—લાગે એવો કશો ક્યાંયે કાયદો વિશ્વમાં ન છે.

સુખ જીવનનું સાચું કેવી રીતે કહીં વરસ્યું,  
બાપડા માનવીએ તે જાણવા ના કશું કર્યું.

વંધ્યાના પુત્રની પેઠે સુખની કલ્પના ધરી,  
—માનવી અથડાયે શાં ! સુખની કામના ચહી.

સુખની કામના કેરો ક્યાંયે પાર દીસે નહીં,  
એક આવી બીજી ઊભી થાય તત્કાળ આપથી.

સંદા કાળ ટકે એવું સુખ શોધે ન માનવી,  
સુખના પડછાયામાં મથે શાં મરી માનવી !

(‘જીવનપાથેય’, આ.૩, પૃ. ૬૮ થી ૭૩)

સુખના પડછાયા શું કેંક છો મેળવે કદી,  
તૃષ્ણા એથી છિપાવાની એવાની કોઈ દી નથી.

નાનાં નાનાં સુખોથી જે ધરાયાં કરતાં રહે,  
આનંદ સુખનો કેવો તેવાં શું ઓળખી શકે ?

ક્ષણિક સુખના લોભે માનવી શાં સર્જયાં કરે !  
એના એ જ કૂંડાળે તે ગોળ ગોળ ફર્યા કરે.

ગમે તે સ્થિતિમાં છો હો, સ્મર્યા ત્યાંયે પ્રભુ કરે,  
જીવવાનું પ્રભુ કાજે જે રાખે, સુખ મેળવે.

(‘પુનિત પ્રેમગાથા’, આ.ર, પૃ. ૧૨૫-૨૭)

\*

\*

### સુમેળ

(અનુષ્ટુપ)

વિરોધાભાસી પ્રવૃત્તિ જીવને તો મળ્યાં કરે,  
તેમાં સુમેળ જે સાધે, જીવન-ક્ષેણમાં વળે.

એકબીજાથી જુદી હો એવી પ્રવૃત્તિ જીવને,  
સદા ઉદ્ભવતી રે’શે, છતાં ત્યાંયે સુમેળ છે.

એવાં સુમેળનાં મૂળ પ્રવૃત્તિ-હૃદ ઊતરી,  
—જુએ જે, ક્ષેણ વાળી તે શકે જીવન-તત્ત્વમાં.

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૧૪૭)

\*

\*

જામતાં જામતાં પ્રેમ જીવને સૌ અભેદતા,  
—પ્રેમથી પ્રેમમાં પૂરી કરે લાધ્યાં અનંતમાં.

જુદું જુદું ભલે લાગે વિશ્વમાં સર્વ કોઈનું,  
સુમેળ જરણું સૂક્ષ્મ કિંતુ ત્યાં શું છૃપાયલું !

\*

\*

જો જોવા હોય કે દોષ, પોતાના નીરખ્યાં કરો,  
દોષ સુધારશો સૌ તો થશે મેળ બધે પૂરો.

(‘પુનિત પ્રેમગાથા’, આ.ર, પૃ. ૧૬૭)

\*

\*

(ગઝલ)

વિસંવાદે જગતના જે રહ્યો અંતર્દ્ર સુસંવાદ,  
હદ્ય તે પ્રીણી, તે ભાવે જીવે, તેવા પ્રભુ પામે.

જીવનના એક પાસામાં જીવનનાં સર્વ પાસાંને,  
—કરવવા ભાવ સુમેળ ચહી મથતો, પ્રભુ પામે.

(‘પ્રણામ-પ્રલાપ’, આ.ર, પૃ. ૪૨-૪૩)

(અનુષ્ટુપ)

વિસંવાદ ભલેને હો અંતરે શો સુમેળ વે !

એકલો જો વિસંવાદ હોત, તે ના ટક્યું હતે.

(‘જીવનપગલો’, આ.૧, પૃ. ૧૦૩)

### શ્રીજીવનની મહત્ત્વ

બહેનો સામાન્યપણે એમના અંતર્ગત સ્વભાવથી જ  
ભાવનાશીલ અને શ્રદ્ધા-વિશ્વાસ રાખનારી હોયછે. મોટા ભાગની  
શ્રીઓની સહનશીલતા પુરુષોના કરતાં ચઢી જાય તેમ છે, ને  
તેઓ સહન પણ વધુ કરે છે. રોજિંદા વ્યવહારમાં શ્રદ્ધા રાખીને  
એ વર્તે છે. એમનું કાર્યક્ષેત્ર જ શ્રદ્ધા, વિશ્વાસ ને સમર્પણના પાયા  
પર રહેલું છે,—ભલે તેનું તેમને જ્ઞાન ન હોય. શ્રીઓ પુરુષોના  
જેટલી વધુ સંખ્યામાં ભલે ભક્ત, જ્ઞાની કે તપસ્વી તરીકે નીપજ્યાં  
ન કરી હોય અને જ્યાતિમાં ન આવી હોય; તેઓ ભલે આધ્યાત્મિક  
ક્ષેત્રમાં પુરુષોના પ્રમાણમાં સંખ્યાની દાસ્તિએ આગળ ન આવી

હોય પરંતુ એવા પુરુષોની માતા તો તેઓ જ છે. માતામાં શક્તિ અને સંસ્કાર હતા તો તે પુરુષોમાં આવ્યા. જો આધ્યાત્મિક ભાવના તેમની રોગરગમાં ન હોત તો પુરુષોમાં તે આવી ન શકી હોત. એમના હાડમાં જ ત્યાગ, શ્રદ્ધા, વિશ્વાસ, ભક્તિ, સમર્પણશક્તિ આદિ દૈવી ઉચ્ચ ગુણો રહેલા છે. તેઓનું યુગોના યુગોથી એક જ સંકુચિત ને મર્યાદિત કાર્યક્ષેત્ર રહ્યું હોવાથી તેમના તેવા ગુણો બહાર કરી શક્યા નથી. તે ઉપરાંત તે તે કાળના સમાજની તેઓ અંગેની સમજણા, વલાણ આદિ અંગે પણ તેમનું તેવું બની રહ્યું છે. ખીઓમાં જે નૈસર્જિક શક્તિ અને ગુણો રહેલા છે, એ કેળવવા અને ખીલવવા માટેની તક, સગવડ, અનુકૂળતા, ઉત્તેજન, સહાય જે જે સમાજ તેમને આપે છે, ત્યાં આ ગુણો એના અનેકગણા પ્રમાણમાં ઝટ વધી શકે છે.

ખીઓ કોઈ પણ કાળમાં સંસારવિરક્ત દશામાં પુરુષો કરતાં વધુ પ્રમાણમાં કે તેટલા પ્રમાણમાં પણ નહિ હોઈ શકે; કારણ કે એ એના જન્મહેતુના ક્ષેત્રની બહારની હકીકત છે. એ એના ક્ષેત્રમાં ઉન્ત ઉત્તરોત્તર થયાં કરશે ને એનો વિસ્તાર પણ કર્યા કરશે— જો તેને પૂરતી સાનુકૂળતાઓ કરી આપવામાં આવે તો—એ ખરું; પણ એનું પાયાનું સાત્ત્વિક કાર્ય તો પ્રજાની સત્ત્વશુદ્ધિ સાચવી રાખવાનું છે, એટલું જ નહિ પણ તેમાં કાળે કાળે તેજસ્વિતા, પ્રાણ પ્રગટાવવાનું કામ પણ એનું જ છે. પ્રજાના આત્માનું એ હૃદય છે. પ્રજાના જીવનની જે કંઈ શક્તિ છે, તેનું મૂળ તેનામાં છે. સારીયે પ્રજાનું ચણતર ને ઘડતર મુખ્યત્વે તેના હાથમાં છે. એનામાં દેખાતા રાગદ્રોષ, સંકુચિતતા, મમતા એ બધું એનું ક્ષેત્ર એક તો સાંકું ને વાતાવરણ એવું હોય છે ને એની એ જ અસરમાં રહ્યાં કરવાનું હોવાથી એનું માનસ એવું થતું રહે છે. પુરુષો થોડા ઘણા પણ પ્રમાણમાં વધુ વિચારશીલ અને ઓછા સંકુચિત માનસવાળા જે

જાણાય છે, તે તેમના કાર્યક્ષેત્રના વિશાળપણાને આભારી છે,— ને નહિ કે જ્ઞાનશીલપણાને લીધે છે. બહેનો સંસારવ્યવહારમાં અશજાણપણે કેટલોયે ત્યાગ કરી રહેલી છે. તેમનામાં હૃદયતત્ત્વ વધુ વિકસિત હોઈને તેઓ ખરી રીતે આધ્યાત્મિક માર્ગ માટે વધુ યોગ્ય અને પ્રમાણમાં ઝડપી પ્રગતિ કરી શકે તેમ છે, પરંતુ તેમ બન્યું નથી. એનું કારણ એના ક્ષેત્રની બહાર ડોક્યું કરવાની તેને તક ઓછી સાંપડી છે, એની દુનિયા સાંકડી છે, ને એનું કાર્યક્ષેત્ર પ્રાધાન્યપણે સંસાર અને જગત છે. નવસર્જનની કિયા ફલિત થવા માટેના જે ગુણોની આવશ્યકતા છે, તે ગુણો કુદરતે ખીમાં મૂકેલા છે. સૂચિનું પાલન, પોષણ પણ આ ગુણોને આભારી છે.

(‘જીવનપાથેય’, આ.ડ, પૃ. ૮૮ થી ૧૦૩)

\* \* \*

### સ્મૃતિ

આપણને થતા અનુભવોને, સંસ્કારોને ઠસાવવામાં અને ફરી જગત કરીને એક અનુભવને કે સંસ્કારને બીજા સાથે સાંકળી આપનાર સ્મૃતિ છે. એમ અનુભવોની પરંપરાથી માનવજીતનો વિકાસ જે શક્ય થયો છે, તેમાં સ્મૃતિનો મોટો ફાળો છે. સંસ્કારોને સંગ્રહી રાખવાની કિયામાં પણ સ્મૃતિ આડકતરી મદદ કરે છે. જો કે સંસ્કારોનો સંગ્રહ કરવાનું કામ ખરી રીતે ચિત્તની ગ્રહણશક્તિ કરે છે. સ્મૃતિ એને ફરી જગાડવાનું કાર્ય કરે છે. સ્મૃતિ સાધક અને બાધક બધા જ સંસ્કારોને પ્રાણવાન કરી શકે છે, એટલે સાધકે કેટલાકને પોષવાનાછે ને બીજાને વારવાનાછે. હાનિકારક સંસ્કારોને સ્મૃતિની મદદથી ઊંડા જતા અટકાવવાની અથવા પડેલા સંસ્કારોને તાજી થતા અટકાવવાની ટેવ મનને પડી શકે છે; અલબ્ધત મનને આ રીતે ટેવ પડાવવામાં ઘણી જગત અને કઠિન સાધના કરવાની રહે છે. આવી પડેલી ટેવથી જુદી જતના

સંસ્કારો જગાડવાની શક્તિ મેળવવી એ સાધનાનું એક અંગ છે.

સાધારણ માન્યતા મુજબ તો સંત સંસારમાં રહેતો હોય તો પણ જગત તરફ—‘માયાવી’ દુનિયા તરફ—તદ્દન બેદ્ધિકરાઈની વૃત્તિ રાખતો હોવો જોઈએ. આવા વિચારથી જાણેઅજાણે દોરવાઈને ઘણા સાધકો એવી અને તેના પરિણામે વિસ્મૃતિની વૃત્તિ સેવે છે. આમ કરવું નુકસાનકારક છે. જો આપણે સંતમાં ભગવાનની સર્વશક્તિમત્તાનો તથા સર્વજ્ઞતાનો ગુણ આરોપતા હોઈએ તો સંત પોતાના જીવનપથમાં આવતી પ્રત્યેક બાબતમાં પૂર્ણત્વ પામેલો હોવો જોઈએ. એટલે જેટલો તે ભગવાનના રસમાં તરબોળ હોય તેવો જ ભગવાનના આવિભાવરૂપ આ જગતનાં એને લગતાં કાર્યોમાં પ્રવીણ અને ખબરદાર હોવો જોઈએ. આમ એનામાં એકાગ્રતા અને અનેકાવધાનતાના ગુણો સાથે સાથે હોવા જોઈએ. સાધકે પણ આ જ દિશામાં પ્રયત્ન આ અંગે કરવાનો છે. જગતની બાબતો પ્રતિ બેપરવાઈ અને વિસ્મૃતિ રાખ્યે પાલવી ન શકે. સાધકના ભૂલકણાપણાથી બીજાને ત્રાસ ઉપજે કે અગવડમાં મુકાવું પડે તો તેવું કર્મ તેને જરૂર નડવાનું. આથી ઝીણાં ઝીણાં દેખાતાં, નજીવાં દેખાતાં, ‘સ્થૂળ’ દેખાતાં કર્મો તરફ પણ સાધકની ચકોર દાટિ હોવી જોઈશે. આ દાટિ સ્મૃતિશક્તિની સહાયથી સાંપડી શકે છે. વળી પોતાના મનની પ્રત્યેક કિયા, લાગણી, ભાવના, વિચાર વગેરે બાબતમાં સ્મૃતિશક્તિનો ઉપયોગ—યોગ્ય ઉપયોગ—કરી કરીને તે બધાંનું યોગ્ય રૂપાંતર કરાવવું રહે છે અને સૌથી ઉત્તમ સ્મૃતિ અથવા સાધકની સ્મૃતિના વિકાસનું છેલ્લું પગથિયું તો અલબત્ત સતત-નિરંતર-સહૈવ ભગવદ્સ્મૃતિ ને ભગવદ્ભાવમાં રહેવાનો પડી ગયેલો સહજસ્વભાવ, તે છે.

અંતમાં, સાધકને સ્મૃતિ રાખવા માટે મહેનત નથી કરવી પડતી. આપોઆપ કયે વખતે શું કરવાનું છે, તેની સ્મૃતિ

અંતઃકરણમાંથી જ ઉઠે છે. એવા સાધકને તો એક દિલ્લિએ જોઈએ તો સ્મૃતિનો—એટલે યોગ્ય સમયે યોગ્ય જાતની સ્મૃતિનો—સ્વભાવ જ થઈ પડે છે. તેમાં અને અંતઃસ્હુરણમાં પછી કશો ફેર નથી રહેતો. પણ તે તો સાધક જ્યારે સર્વવ્યાપી ચૈતન્યશક્તિ એટલે કે ભગવાનનું ઘણું શુદ્ધ, રૂપાંતરિત યંત્ર બની જાય ત્યારે.

આમ સ્મૃતિ એ સાધન પણ છે ને સિદ્ધિ પણ છે. જ્યારે સ્મૃતિ ભગવતી ચૈતનાસ્વરૂપ થાય છે ત્યારે એ સિદ્ધિ છે. ભગવાન ગીતામાં કહે છે કે ‘નારી સ્વરૂપોમાં (એક સ્વરૂપ) સ્મૃતિ ધું,’ તેનો અર્થ આવો કેંક હશે.

(‘જીવનસંદેશ’, આ.ર, પૃ. ૩૧૫ થી ૩૨૨)

\* \* \*

### શ્રદ્ધા

શ્રદ્ધા જીવનસાધનાને આવશ્યક પુરુષાર્થના અભ્યાસમાં નડતી મુશ્કેલીઓમાં આપણને ટકાવી રાખે છે, ધ્રુવ તારાની જેમ આપણી નજર સામે રહી આપણને યોગ્ય દિશાસૂચન કરીને ધ્યેયથી વિમુખ થતાં અટકાવે છે; અને અંતે આપણા સત્ત્વને સંપૂર્ણપણે જાગ્રત કરી, એને પરિપૂર્ણ સ્થિતિ પ્રાપ્ત કરાવી, દિવ્ય જ્ઞાનજ્યોતિનાં દર્શન કરાવે છે.

(‘જીવનસંદેશ’, આ.ર, પૃ. ૧૨૦)

\* \* \*

શ્રદ્ધા હોય છે અને વધતી જાય છે એનાં પણ લક્ષણો છે. જે કુંઈ પણ કશામાં આપણો પ્રવેશ કર્યો તેથી બીજી રીતનું વિચારતાં મન અટકવા માંડશે ને તેનું દ્વિધાપણું ઓછું થતું જશે, મનમાં નિરાશાને કે હારને ક્યાંયે સ્થાન નહિ હોય; ‘પલમાં તોલા પલમાં માસા’ની સ્થિતિ નહિ હોય. આવું બધું અનુભવાય તો

સમજવું કે શ્રદ્ધા હવે દૂધપણે જામતી જાય છે. બાકી શ્રદ્ધા એકદમ શરૂ શરૂમાં જામી જવી તે કંઈ સહેલું નથી.

\* \* \*

શ્રદ્ધાથી જીવનનું વાસ્તવિકપણું પ્રગટતું હોય છે, એ કંઈ નકારાત્મક લક્ષણ નથી. જીવનમાં તે પ્રેરણા અને બળ ઉપજાવે છે. સાધનાપથમાં શ્રદ્ધા એ પરમ સાધન છે. શ્રદ્ધા પામવા માટે પણ મહેનત લેવી પડતી હોય છે. શ્રદ્ધા જ્ઞાનાત્મકપણે હોવી ઘટે છે. અંધશ્રદ્ધા આ માર્ગમાં કામ નહિ આવી શકે. શ્રદ્ધાને દૃઢ થવા માટે પણ પાયો મજબૂત હોવો જોઈશે.

\* \* \*

સાધકની લક્ષ્યવૃત્તિ દ્વિધાપણે કામ કરતી રહે તો તે જીવનવિકાસને માટે ખતરનાક છે. અથાગ ને અતાગ શ્રમ, તપ પ્રેમપૂર્વક કર્યા વિના પરમભાવને પામવાના અનુભવની ઈચ્છાને સેવ્યા કરવી તે શ્રદ્ધાનું સાચું સ્વરૂપ નથી; એ તો જડ શ્રદ્ધા પણ ન કહેવાય; એ તો માત્ર શેખચલ્લીના વિચાર ગણાય. જેની શ્રદ્ધામાં ગ્રાણ પ્રગટેલા નથી, એવાની શ્રદ્ધા જીવનવિકાસના કર્મમાં ખપ લાગતી નથી. હૃદયપૂર્વકની ભાવનાથી થતા જતા પુરુષાર્થમાં કાળે કરીને સમજણ ને અનુભવ પ્રગટવા માંડે છે. એવી સમજણ અને અનુભવની પરંપરામાંથી પ્રગટતી શ્રદ્ધાના બળે તેના જીવનધ્યેયમાં તેને એક પ્રકારનું આત્મબળ પ્રગટે છે અને એવા આત્મબળના આધાર વડે અનુભવની શ્રેષ્ઠતામાં પ્રવેશીને, શ્રદ્ધાને ભાવમાં પરિણિત કરાવીને, તેવા ભાવથી હૃદયમાં તત્ત્વને પછી પ્રીણી શકે છે.

કોઈના પરની શ્રદ્ધા એટલે તેના સર્વ પ્રમાણમાં વિચારરહિત મૂઢપણે જે થયા કરે, યંત્રની જેમ જે થયા કરે, તે શ્રદ્ધા નથી પરંતુ તે તો જડતાભર્યું અજ્ઞાન છે. એને શ્રદ્ધા ન કહી શકાય.

શ્રદ્ધા એટલે તો અંતરૂદૃષ્ટિ. અંધશ્રદ્ધા કરતાં તો શ્રદ્ધા ન હોય  
તેવી સ્થિતિ સારી. (‘જીવનમંથન’, આ.૨, પૃ. ૩૫૩)

\*

\*

જ્ઞાનાત્મક શ્રદ્ધા કદી આંધળી હોઈ શકતી નથી. સાચી શ્રદ્ધા આંધળી ન હોય, ને અંધશ્રદ્ધા તે સાચી શ્રદ્ધા નથી.

શ્રદ્ધાના ગ્રાણ પ્રકાર છે. તામસિક, રાજસિક અને સાત્ત્વિક. આદર્શ શ્રદ્ધા એનાથી પણ આગળની વાત છે. આદર્શ શ્રદ્ધા તો એવાને મળતાંની સાથે એક ક્ષાળમાં જ દિલ આપોઆપ એવાનામાં ચોંટી જાય ને પછી કદી તેવા પરતે કોઈ જતના સંકલ્પવિકલ્પ ઉઠે નહિ; તેનું નામ આદર્શ શ્રદ્ધા.

સાધનાના ક્ષેત્રમાં જીવનહેતુને ફળાવવાને અર્થે ભાવનાનો જે એકધારો અત્યાસ પ્રગટ્યા કરે છે, તેથી કરીને જે શ્રદ્ધા એકનિષ્ઠામાંથી શક્તિસ્વરૂપે પ્રગટે છે, તે કંઈ બધું એકદમ ઓચિંતું બની જતું નથી. (‘જીવનસંશોધન’, આ.૧, પૃ. ૨૮૫)

\*

\*

### શ્રદ્ધા-વિશ્વાસ, પ્રભુમાં

(અનુષ્ટુપ)

કોણ વર્ષાવવા જાય વર્ષાને ? કોણ ઝતુઓ,  
—લાવ્યાં કરે જુદી જુદી ? કોણ સૂર્ય ઉગાડતું ?

સંધ્યા, ઉપા બનાવે કો ? પક્ષીને કણ કો ધરે ?  
દેવા જાય કીડીને કો ? ને સ્તને દૂધ કો ભરે ?

વનસ્પતિ ઉગાડે ને રોપે બી કોણ એમનું ?  
પક્ષીઓ ના કરે ચિંતા; સૌ એની મેળ ચાલતું.

વૃહેવડાવે નદી કોણ ? ચલાવે કોણ વાયુને ?  
તારા અદ્વર કો રાખે ? ધારે છે કોણ પૃથ્વીને ?

પ્રકૃતિનું બધું કાર્ય કરવા કોણ જાય છે ?  
નિયંત્રિત રહે વિશ્વ આખુંયે તે કઈ રીતે ?

અનંત કાળથી વિશ્વ ચાલ્યાં જ કરતું દીસે,  
એની સંભાળ લેનારું બેઠેલું કોક તો હશે.

પ્રભુમાં સર્વ આધાર શ્રદ્ધા, વિશ્વાસ જીવતાં,  
—જેને બેઠાં હશે ઊંડાં તેવા નિર્ભય રે' સદા.

આપણે આપણા ભાવે રમવાનું ચહ્યાં કરો,  
એ જ મહત્વનું કાર્ય આપણું સૌ ગણ્યાં કરો.

ફુંટાતાં આદું એમાંથી ચેતવાનું હૃદે ચહો,  
સ્થિરભાવ ટકે એવું વર્તવાનું કર્યા કરો.

સર્વશ્રેષ્ઠ પ્રભુ જાણી એને મહત્વ આપજો,  
જ તે કાર્ય મહીં એનો ઊંડો ખ્યાલ ધરાવજો.

(‘જીવનપગલે’, આ.૩, પૃ. ૪-૫)

\* \* \*

### સ્વખાં અને સ્વખનમાં સાધના

આપણે જ્યારે ઊંઘમાં હોઈએ છીએ, ત્યારે સ્વખનમાં આપણી  
વાસનાના જોરે આપણે અનેક એવા પ્રસંગો અનુભવીએ છીએ કે  
તેનો જાણે આપણને પ્રત્યક્ષ અનુભવ થતો હોય ! ત્યારે આપણે  
સાંભળીએ છીએ, જોઈએ છીએ, સુંધીએ છીએ, ચાખીએ છીએ,  
સ્પર્શીએ છીએ, એટલું જ નહિ પરંતુ હાથ-પગ અને બીજી તમામ  
કર્મન્દ્રિયોનો ઉપયોગ પણ કરતા હોઈએ છીએ. આ બધી  
કર્મન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો ત્યારે સ્થૂળપણે તો જાણે નિશ્ચેષ  
હોય છે; પરંતુ એ બધી ઈન્દ્રિયોની અંદર રહેલો પ્રકૃતિનો જે  
સ્વભાવ છે, તે એમાંથી ખેંચાઈને સૂક્ષ્મતમ પ્રાણતત્ત્વમાં રહે છે

અને પેલી સ્થૂળ પાર્થિવ ઈન્દ્રિયો તો ઉંઘમાં જ પડેલી હોય છે; અને ઉંઘમાં હોવા છતાં બીજી બધી ઈન્દ્રિયો અને કરણો તેના સૂક્ષ્મ સ્વરૂપે હોયાં કરે છે.

સાધારણ રીતે તો આ બધી ઈન્દ્રિયોની વાસના ઉંઘ વેળાના સ્વખમાં, એમાંથી સ્થૂળતા નીકળી ગયેલી હોવાના કારણે વધુ જોરદાર બને છે અને તે વાસના ભોગવવામાં આપણે તદાકાર બનીએ છીએ; પરિણામે વાસના પોતાનાં મૂળ ઉંડા ઘાલે છે. આવી વેળા જો આપણે જાગૃતિ રાખી શકીએ અને ઈન્દ્રિયોની વાસનામાં ભાગ લેતા અટકી જઈ શકીએ તો સાધનામાં ઘણી મદદ મળે. (‘જીવનપરાગથી’, આ.ડ, પૃ. ૧૪૬-૧૪૭)

\*

\*

આપણી દસે ઈન્દ્રિયો, મન, પ્રાણ, ચિત્ત, બુદ્ધિ, ભાવના-લાગણી આદિ સકળ કંઈ ઉંઘમાં આમ તો નિશ્ચેષ પડેલાં હોવા છતાં તેઓ જાણે અતિ સૂક્ષ્મમાં સૂક્ષ્મ એવા પ્રાણતત્ત્વમાં સમાઈ જતાં હોય છે. ફરીથી જન્મ લેવાની વેળા એ બધું તેની સાથે જાય કે હોય અને તે કેવી રીતે, તે આમાંથી સમજ શકાશે.

સ્વખમાં જે જે અનુભવો થઈ રહેલા હોય તેમાંથી અલગ થવા માટે ‘આ બધું મારાથી અલગ છે’ એવી જાગૃતિ રહેવી કે રાખવી જોઈએ.

આપણું મન આમ તો ઉંઘતું કહેલું છે—પરંતુ તે ખરી રીતે ત્યારે પણ સૂક્ષ્મપણે સક્રિય હોય છે—એટલે આમ ઉંઘતું હોવાથી આપણે સ્વખાં જોઈએ છીએ. સ્વખાં દરમિયાન સ્વખાંના ભાગ તરીકે મન કદીક વિચાર કરી જાય છે તે વળી જુદી વાત છે. (‘જીવનપરાગથી’, આ.ડ, પૃ. ૧૪૭)

સૂક્ષ્મ હંમેશાં સ્થૂળ કરતાં વધુ બળવાન હોય છે, વેગવાન પણ હોય છે; જેમ પૃથ્વી એટલે માટી કરતાં પાણી અને સ્થૂળ

પાણી કરતાં પવન વધુ ચેતનવાળો છે તેમ. આથી દિવસની સ્થૂળ જાગૃતિની સ્થિતિમાં આપણે જે કદી ન કરીએ (કારણ કે આધારનાં કરણો ત્યારે ચોકીદારરૂપે હોય છે) તે વસ્તુ આપણે સ્વખનમાં કરીએ છીએ. આથી આપણી સાચી પરખ ઘણી વાર સ્વખનમાં જણાઈ આવે છે—જોકે હુમેશ તે તેની કસોટી ન ગણી શકાય, કારણ કે સ્વખનમાં ભેળસેળપણું પણ ઘણું હોય છે. ખીચડા જેવું ને ઉડજૂદિયાપણું પણ તેમાં હોય છે.

\*

\*

સ્વખની આપણે ખબર પડે છે, એ બતાવી આપે છે કે જે ઈદ્રિયો દ્વારા જે જ્ઞાન ત્યારે પામીએ છીએ, એની પાછળ દિવસના ભાગમાં જ્ઞાન પમાડનાર જે ચેતના છે તે તો ત્યારે સૂતેલી હોય છે, પણ બીજી કોઈક એવી ચેતના ત્યારે જીવતીજાગતી હોય છે, કે જેનાથી આપણાને આ બધાંની સમજણ પડે છે. ચેતનાના ગ્રાણ પ્રકારો છે. ઉપરની, વચ્ચેલી અને છેક અંતરની સપાટીની. આપણાને સતત કેવાં સ્વખનાં આવે છે, એના ઉપરથી આપણામાં કયા પ્રકારની ચેતના કામ કરી રહેલી છે તે સમજાય છે. રોજબરોજના વ્યવસાયોનાં કે વ્યવહારનાં સ્વખનાં જો આવતાં હોય તો એ માત્ર આપણું સ્થૂળપણું બતાવે છે, તથા તે ઉપરાંત એ સ્થૂળપણું આપણામાં ઉત્તરતું જાય છે, આપણે એમાં રસ લઈએ છીએ ને તે વૃત્તિમાં સપડાતા જઈએ છીએ એમ બતાવે છે. વળી, વિષયનાં સ્વખનાં, લાલસાનાં, કીર્તિનાં કે એવાં સ્વખનાં આપણા વાસનાદેહનાં છે એટલે કે વૃત્તિઓ આપણા પ્રાણમાં ઊંડી પેઠેલી છે એમ સમજાય છે. વળી, એવાં સ્વખનાં બંધ થતાં જાય (જો કે તદ્દન ૪૩ માણસને તો એવાં સ્વખનાં નથી આવતાં) તો એમ પણ જાણી શકાય કે આપણે છેક ઉપરની સપાટી પરની ચેતનાના પડથી આપણે અલગ પડતા જોઈએ છીએ.

સ્વખાંને આપણે સર્વિશે, નક્કરપણે, જેમ ફેંકી દેવાનાં નથી તેમ સર્વિશે, નક્કરપણે મહત્વ પણ આપવાનું નથી; છતાં એમાંથી દિશાસૂચન મળી શકે છે ખરું.

સ્વખાંનો પૂરેપૂરો અર્થ આપણાને સમજાતો નથી એનું કારણ એ છે કે એની પાછળની જે ચેતનાથી આપણાને જ્ઞાન થતું હોય છે એ ચેતનાની આપણાને સમજણ પડેલી હોતી નથી; અને એની પાછળના રહેલા સર્વંગપણામાંનો એકાદ નાનકડો ભાગ જ આપણાને દેખા દે છે; એટલે એના સમગ્ર સર્વંગપણાની સમજણ કેવી રીતે પડી શકે ?

આધુનિક માનસશાસ્ત્રીઓ જણાવે છે કે સ્વખાંની પાછળ કંઈક રચના રહેલી છે અને એનાં પણ કારણો હોય છે, ને તેમાં ઘણી વાર તથ્યાંશ હોય છે, એટલે આપણે સ્વખાંને નકામાં પણ ગણવાં નહિ, તેમ જ એનો અર્થ કે રહસ્ય આપોઆપ સહજપણે ન સમજાઈ જાય તો એની પાછળ માથાઝોડ પણ ન કરવી.

સાધારણપણે માનવીનાં મોટા ભાગનાં સ્વખાં ભેળસેળવાળાં અને ઢંગધડા વિનાનાં હોય છે. કોઈ એક જ પ્રકારનાં ને અમુક જ વિષયનાં સ્વખાં આવતાં હોય તો તે ઉપરનાં સ્વખાં કરતાં તદ્દન જુદા પ્રકારનાં ગણાય. તે માનવીનું મન તે એક પ્રકારમાં પરોવાયેલું હોવાનું સમજ શકાય.

સ્વખાં દ્વારા ઘણાંને કંઈક કંઈક ઉકેલો ને સૂજ મળી જતાં જાણ્યાં છે. સ્વખ કેટલીક વાર સાંકેતિક પણ હોય છે.

(‘જીવનપરાગી’, આ.ડ, પૃ. ૨૨૧-૨૨-૨૩)

\* \* \*

સાધનાની દશાની જગ્રત સ્થિતિમાં આપણામાં પ્રવર્તતા સાત્ત્વિક ગુણો; જેમ કે વિવેક, તાટસ્થ્ય, શાંતિ, સમતા, પ્રસન્નતા,

નિરાગ્રહીપણું, અક્ષુભ્યતા આદિ જ્યારે સ્વખાંમાં પણ એવા જીવતા ને ઉપયોગમાં પ્રવર્તી શકે એવા પ્રગટેલા હોય, ત્યારે જ તેવા ગુણો શક્તિસ્વરૂપ બની આપણા આધારમાં જીવતા બની ગયેલા છે એમ જાણવું. વળી સ્વખાંમાં જે જે વૃત્તિઓ ભોગવવાનું બને તે સ્વખાંસંસ્કાર દિવસની જગ્રત-પ્રવૃત્ત દશામાંના કર્મના સંસ્કાર કરતાં ઘણા વધુ બંધનકર્તા છે. સ્વખાંમાં ચેતનયુક્ત જગૃતિ હોવી અને ત્યારે તાટસ્થ્ય જગ્યવવું એ સાધનાની ઘણી ઊંચી કક્ષાની વાત ગણાય.      ('જીવનપોકાર', આ.૪, પૃ. ૧૦૪)

\*

\*

કેટલાક જીવને સ્વખ વેળા પોતાને સ્વખ આવ્યું છે એવો ખ્યાલ જાગે છે ખરો, પણ તેથી કંઈ તેઓ સ્વખ સાથે ભળી ગયેલા નથી એમ ન ગણાય. વૃત્તિ, વિચાર આદિને ત્યારે તેઓ ભોગવે છે ને તેમાં પૂરા એકરસ થયેલા હોય છે.

('જીવનપોકાર', આ.૪, પૃ. ૧૦૫)

\*

\*

જે જીવે ઉત્કટતાથી ને એકધારા પ્રચંડ વેગથી સાધનામાં જંપલાવ્યું છે, એવાને સાધનામાં આગળ જતાં જતાં એનાં સ્વખાંનો પ્રકાર જીવદશાવાળાનાં સ્વખાંના પ્રકાર કરતાં તદ્દન જુદી જતનો બની જતો હોય છે; તથા જીવનની અને સાધનાની જુદી જુદી કક્ષાઓમાં સ્વખનો પ્રકાર પણ અવનવી રીતે બદલાતો રહે છે.

કેટલાક સાધકને તેના સદ્ગુરુ તરફથી સ્વખ દ્વારા પણ અનુભવવાનું અને જાણવાનું મળી શકતું હોય છે. સૂક્ષ્મ દોષોનું તીવ્રતમ ભાન ત્યારે જાગી શકે છે.

('જીવનપોકાર', આ.૪, પૃ. ૧૦૫-૦૬)

\*

\*

સ્વખમાં જે જે કંઈ થાય, વિચાર આવે કે કદીક કોઈનું

‘દર્શન’ થાય તેના પર જાંગો મદાર બાંધવાનો નથી કે હુલાઈ પણ જવાનું નથી. તેવી હકીકતને ઘણું વધારે મહત્વ પણ આપનારા કેટલાક જીવ હોય છે; પણ તે ભ્રમણામાં પડેલા પ્રમાણવું. સાચી રીતે જે આપણો કરવાનું છે, તે કર્યા કરીશું અને તેમાં જો આપણું દિલ પ્રગટાવી શકીશું તો આખરે તો એવી સ્થિતિ થવાની છે કે જેમાં સ્વખને સ્થાન જ નથી. એવી સ્થિતિમાં સ્વખાં પ્રગટી શકતાં નથી.

‘સ્વખનમાં અમુક અમુક ‘દર્શન’ થયાં ને આમ બન્યું ને તેમ બન્યું’—એ એ રીતે કંઈક રાજી થતા કેટલાક જીવને જાણ્યા છે. ‘સ્વખનમાં સદ્ગુરુની પર પ્રેમ ઊભરાયો,’ એવું પણ કહેનારા સાંભળ્યા છે. પણ અત્યા ! જાગ્રતમાં તો તેની મદદ લેવાને દિલનો ઉમળકો તને પૂરો પ્રગટ્યો નથી અને તું સ્વખની શીદને વાત કરે છે ? (‘જીવનસંદેશ’, આ.ર, પૃ. ૨૫૧)

\*

\*

જેમ દિવસની જાગ્રત-પ્રવૃત્ત દશામાં આપણાને ઊઠતા વિચારોની આસક્તિમાં આપણો ન રહીએ, અને તેને પરિણામે ઊઠેલા વિચારમાં આપણું મન ન પરોવીએ અને રસ લેતા બંધ થઈએ, તો જ ધ્યાનમાં ઊઠતા એક એક વિચાર સાથે તેના આનુષંખીક બીજા વિચારને સંકળાઈ જતાં અટકાવી શકીએ છીએ; તેવું જ ઊંઘમાં સ્વખાં વિષેનું પણ છે. સાધક જેમ જેમ દિવસની પ્રવૃત્ત દશામાં નિરાસક્ત બનતો જાય છે, નિરાગ્રહી બનતો જાય છે, તેમ તેમ તેના વિચારોની સાંકળ જોડાતી બંધ થાય છે. જે સંપૂર્ણ નિરાસક્ત બને છે તેને વિચારો કરી કરીને કર્મમાં પ્રવેશવાનું બનતું નથી. તેમ છતાં તેવાને પણ પ્રારબ્ધ રહેલું હોય છે. એવો ઉચ્ચાત્મા સાધક ચિત્તમાં પડી રહેલા પ્રારબ્ધના સંસ્કારોને સ્વખનમાં પણ સુદૂરાવી સુદૂરાવીને અથવા

એ સંસ્કારો પોતાના સ્વભાવ પ્રમાણે સ્વભમાં ઉઠે ત્યારે સ્વભમાં પણ તે પ્રતિ જાગ્રતપણે તટસ્થ રહીને, તેમાં રસ ન લઈને, તે સંસ્કારોને આપોઆપ ખપાવી દઈને તેમના પટ પ્રમાણેનો આકાર લેતા અટકાવે છે. એવી રીતે આપોઆપ સ્વભમાં જે સંસ્કારો ઉઠે છે, તેના વલાણ કે વહેણમાં પોતે જાગૃતિભર્યો તટસ્થભાવ રાખ્યા કરતો હોવાથી તે સંસ્કારો તેનામાં નવું કર્મબંધન ઉભું કરતા નથી. આમ જ્યારે જ્યારે વિચારો કે સંસ્કારો આપણને સ્પર્શ કર્યા વિના આપોઆપ વહી જતા હોય, ત્યારે ત્યારે આપણે તેટલા પ્રમાણમાં ખાલી થતા જઈશું. ઉપર જણાવેલી સ્થિતિનો સાધક એવી રીતે ચિત્તમાં પડેલા બધા સંસ્કારોને ખાલી કરી નાંખે છે. પોતાના પ્રારબ્ધને ભોગવી નાખવાનો આ પણ એક રસ્તો છે; પણ આ એક જ રસ્તો છે એમ માનવાનું નથી.

(‘જીવનસંદેશ’, આ.૪, પૃ. ૭૮)

\*

\*

જેણે જીવનની સાધનાની શરૂઆત કરી છે, એવા સાધકથી ઊંઘમાં ઉઠતા સંસ્કારોમાં પોતાનું મન ન જાય એવી હૃદયની જાગૃતિ રાખી શકાતી નથી. આથી સાધક દિવસના સર્વ વ્યવહારમાં કર્મો કરતો રહેવાછતાં જો તેમાં આસક્તિ રાખ્યા વિના નહિ ભેળાવાનો ચેતનાયુક્ત જાગૃતિભર્યો પ્રયાસ કર્યા કરશે તો ને તેમાં જેટલા અંશે સફળ થશે તેટલા અંશે રાતના ઊંઘમાંનાં સ્વભાંમાં તેમ જ તે સમયના સંસ્કારોમાં અલગપણે રહી શકવાને તે સમર્થ નીવડી શકશે. વળી ઊંઘની જરૂર શરીરને છે. ‘પ્રાણ’ અથવા તો એવું જે સૂક્ષ્મ તત્ત્વ અંદર રહેલું છે અને જેને આપણે કર્મનું પ્રેરક તત્ત્વ કહીએ છીએ, તે તો ઊંઘનું હોતું નથી. એટલે ઊંઘમાં આપણે સચેતન રહીએ એવી ઊંઘની સ્થિતિ સાધકની થવી જરૂરી છે. આને માટે

સાધક સૂતાં પહેલાં ને દિવસ દરમિયાન પણ ખૂબ ઉત્કટ જંખના પૂર્વક  
ભાવનાથી હૃદયના ઊંડાણમાંથી પ્રેરાઈને એકભાવે પ્રાર્થના કરશે.  
એમ તો પ્રત્યેક કર્મના અંતરમાં એના હૃદયનો પ્રાર્થનાભાવ  
આગળ જતાં પ્રત્યક્ષ જીવતો બન્યા કરવાનો છે. એવું થતાં સાધક  
કર્મનાં નવાં બંધનમાંથી ઊગરી જવાની શક્યતાવાળો બની રહે છે.

(‘જીવનસંદેશ’, આ.૪, પૃ. ૮૦-૮૧)

\* \* \*

### સ્વખનમાં સાધના

(અનુષ્ઠુપ)

ઉંઘમાં જાતનું ભાન રહે આપણને ન ત્યાં,  
—ઇતાંયે કરતા રો'છો કર્મ ત્યાંય અજાણતાં.

ભોગવો ભોગ સ્વખનાંમાં લીધાં ત્યાં રસ જે કરો,  
જગ્રત સ્થિતિનો ભોગ એનાથી હળવો ખરો.

સ્થળ ને કાળ મર્યાદા સ્વખનની સૂચિમાં ઘટે,  
દશા જગ્રતમાં બન્ને, તેથી વિક્ષેપ ત્યાં નહે.

તેથી ઉંઘ મહીં હૈયે પૂરા જે ચેતતા રહે,  
સાક્ષીભાવ હૃદ રાખી અલિપ્તપણું કેળવે.

(‘કર્મગાથા’, આ.૧, પૃ. ૧૪૮)

\* \* \*

સ્વખનમાં વિકાર નિવારવા રાત્રે સૂતી વેળાની પ્રાર્થના  
‘સ્વખાં વિષે વિકારોની સૂક્ષ્મતા પજવે મને  
નિવારીને પ્રભો ! તેને દિવ્ય રૂપે કરો હૃદે.’

(‘જીવનમંથન’, આ.૨, પૃ. ૧૧)

॥ હરિઃॐ ॥

## સૂચિ

અકળામણ છે, ૧૦૨, ૧૦૪, ૩૩૮	અન્યાયનો સ્વીકાર વિકાસાર્થે ૧૧૨ અન્યાય પ્રતિ સદ્ગ્રાવ ૧૩૩, ૧૩૫
આણગમતી વ્યક્તિને, સ્વવિકાસાર્થે, ખૂબ ચાહો ૨૨૩	અપમાન, અન્યાય સજ્જાન સહેવાં ૭૮, ૨૫૮
અથડામણનો અર્થ ૭૬	અપમાનને અમૃત ને માનને ઝેર માનો ૧૮૮
અધિકાર નહિ પણ કૃપાપાત્ર ૨૦૩	અપરિગ્રહ ૫૦
અધીરાઈ અને ધીરજનો સમન્વય ૭૨, ૧૮૧	અબળા સાચી કોણ ? ૨૨૫
અનિષ્ટોનો સ્વીકાર અને સામનો ૧૭૫	અભય ૧૮૨
અનુભવ ૮૮, ૧૪૨, ૨૧૧	અભિપ્રાય ઝટ ન આપો ૮૩, ૧૫૯, ૧૯૦, ૨૬૭
અનુભવનું કથન ૧૦૩, ૨૨૨	અભ્યાસ સાથે ભાવનું ઉદ્વીપન ૮૬
અનુભવ ચેતનનો ક્યારે થાય ? ૧૫૫, ૨૬૫	અભ્યાસની આવશ્યકતા ૮૬, ૨૫૨
અનુભવ માથા પરથી વહી જશે ૬૨, ૨૬૬	અભ્યાસ એટલે શું ? ૨૨૧
અનુભવ સ્વીકારમાં સપ્રમાણતા જાળવો ૨૦૧	અભ્યાસ અને વૈરાગ્ય ૮, ૧૪, ૧૧૩
અનુભવ ક્યારે આવે ? ૫૮, ૨૬૫	અમૃત ઝેર સમું; ઝેર અમૃત સમું ૭૮
અન્યથા વિચારોનો સામનો ૧૮	અલ્પતાઓ, ઈચ્છવા યોગ્ય ૮૪
અન્યથાપણું પ્રગટવું વિધાતક છે. ૨૩૨	અવતારના દેહધારણનો હેતુ ૨૧૫
અન્યાયનો મુકાબલો ૭૮, ૧૦૮, ૨૫૮	અવિશ્વાસના મૂળમાંયે વિશ્વાસ ૮૨
અન્યાયને સ્પર્શવા ન દો ૧૦૮, ૧૧૨	અશ્વા ૨૧૩
	અશ્વ, હદ્યનાં (કાવ્ય) ૨૬૮
	અસહિષ્ણુતા, અનુદારતા ૧૭૩, ૨૦૮

અસંતોષ અને અકળામણ ૪૮	'આજ'ના યોગ્ય પાલનમાં 'કાલ'
અસંતોષ (જીવનવિકાસક)ની જીવાળા ભરપૂર સુખમાં પણ ૧૬૫	સચવાય છે ૪ ૨૨૬, ૨૪૪, ૨૬૨ આત્મલક્ષી દણ્ણિ સાથે સાથે સર્વલક્ષી પણ ૬૦
અહંકાર ૧૦, ૨૭૧	આત્મનિવેદન ૧૦૬, ૨૭૮, ૨૭૯
અહ્મુ ફિટકારાતાં રાજી થાવ ૮૦, ૧૪૩	આત્મવિશ્વાસ ૨૪૧
અહ્મુ મુક્તિનું એક લક્ષણ ૮૩	આદરભાવ, હદ્યનો, જીવન પલટાવે ૬૭
અહ્મુ ઓગાળવાની રીતો ૧૮૪	આદરભાવના પ્રમાણમાં શ્રદ્ધા- વિશ્વાસ ૨૦૮
અહ્મુના પ્રકાર ૮૩, ૧૩૬	આદર્શની અમર્યાદિતા ૮૮
અહ્મુ પ્રેરિત વિધાતક વિશિષ્ટ વ્યક્તિત્વવૃત્તિ એટલે અભિમન્યુનો ચકાવો ૨૩૫ અંતર્મુખતાની ૪૩૨ ૨૫, ૩૬, ૩૭, ૫૫, ૮૫, ૨૦૮	આનંદ, પ્રસન્નતા સર્વ સંજોગોમાં ૨૦૪
અંતઃકરણશુદ્ધિ ૮૪	આનંદ સાચો ૧૧૫
અંતર્યામિત્વપણું અને આત્મનિવેદન ૧૩૪	આપવાનું યજ્ઞ-ભાવે ૧૩૧
આગ્રહ એટલે અહ્મુ ૨૧૪	આશા-અપેક્ષા ન રાખો ૬
આગ્રહ ઉત્તમ વસ્તુનો પણ નહિ ૧૩૦, ૨૧૪	આશ્વાસન લેવાની કળા ૧૪૪
આગ્રહો ન સેવીએ ૪૭, ૬૦, ૨૧૪	આસક્તિ, ભગવાનનાં ચરણમાં ૭૭
આધાત-પ્રત્યાધાત ૧૪૧, ૧૭૪ ૨૭૨	આસક્તિ વિષે સમજણા ૩૫૮
આધાતની સાધનામાં ૪૩૨ ૨૭૬ 'આજ'માં ગઈ કાલ ને આવતી કાલ ૪૮, ૪૧૬	આહાર અને સાધના ૨૭૮, ૨૮૦ અંતર્સત્ત્વ કેવું છે? અને કેવું થયાં જ્ઞય છે તે મૂલ્યાંકનની પારાશીશી છે ૨૧૩, ૨૩૩
	ઈન્કાર, યંત્રવત્ ૧૬
	ઈન્કાર સાચો ૨૧૨
	ઈંદ્રજિત ૨૪૪

ઈન્ડ્રિયોને જીતવાનો ઉપાય ૧૩૧	કદર, બીજાના સદ્ગુણની ૨૧૭
ઈન્ડ્રિયોનો અધિકાતા મન ૧૮૩	કદર ભાવના સહદ્યતાથી ૬, ૩૨,
ઈષ-અનિષ્ટ, જુઓ ‘સાંસું નરસું’	૨૦૨, ૨૦૩, ૨૧૭
‘ઈશ્વર સર્વ કંઈ કરાવે છે’ની	કદરની અપેક્ષા ન સેવો ૧૧૩
ભ્રમણા ૨૮૩, ૨૮૫	કરકસર ૪૫, ૫૦
ઉત્સાહ ૧૬	કર્મ સાધન છે, સાથ્ય નહિ ૨૫૦
ઉદાર માનસ ૨૮૮	કર્મમાં ભગવાનના ભાવની દણિ
ઉપયોગ સર્વ કંઈનો ૫૩૮	૬૩, ૧૩૮
ઉપયોગ એ જ્ઞાન છે ૧૨૪	કર્મ અને આગળપાછળની
ઉપયોગ અને ઉપભોગ ૧૨૯	વિચારણા ૨, ૧૬૭
ઉથલપાથલ, આવશ્યક ૪૩	કર્મ-મહિમા ૨૪૮ થી ૨૫૦, ૨૬૧
ગીર્ભિનો ઉપયોગ ૧, ૨, ૭, ૫૮,	૨૮૭, ૨૮૮
૮૧, ૨૨૪, ૨૮૧	કર્મ, ભાવથી પ્રેરાયેલાં ૨, ૩૩,
ગીર્ભિમાં રૂબી ના જવું ૬૫	૧૦૬, ૧૩૧, ૧૪૪, ૧૫૦,
ગોંધ અને ભાવ ૧૮૪	૧૫૬, ૨૧૩, ૨૩૦, ૨૫૧
ગોંધ-નિદ્રા ૨૮૨ થી ૨૮૫	કર્મનું મૂલ્યાંકન ભાવની નજરે ૨૧,
એક (કાવ્ય) ૨૮૧	૨૭, ૪૩, ૧૦૦, ૧૦૨,
એકનું અનેકત્વ, કુદરતનું સહજ-	૧૦૪, ૧૦૫, ૨૦૨, ૨૮૮
ધોરણ છે ૧૮૮, ૨૨૩	કર્મમાં શ્રદ્ધા અને ભાવ ૨૮
એકાગ્ર ને કેદ્રિત, એકમાં જ ૧૦,	કર્મમાં રૂબી ના જવું ૮૪
૪૭, ૨૨૬	કર્મનું મહત્વ ૫
એકાગ્રતા, અંતરમાં અને ભાવ્ય	કર્મમાં હેતુનો જીવંત ઘ્યાલ ૨,
કર્મોમાં પણ ૨૫૫	૧૪૪, ૨૦૨
એકાશ્રય, સાધનામાં ૨૮૨	કર્મ કર્મઠની જેમ ઘરેડથી નથી
ઓછું આવી જવાપણું ૧૮૨	કરવાનાં ૧૭૮
કઠિનાઈઓને તપની ભાવનાથી	કર્મના સંસ્કાર ૨૬
સેવો ૧૪	કર્મ યજા-ભાવે ૨૨૯, ૩૦૦,
કરુણા, પ્રથમ પોતા ૫૨ ૨૩૩	૩૦૪

કર્મ અને અહ્મુ ૪૩	કામવૃત્તિનો સહૃપયોગ કરો ૪૩
કર્મમાં રહેલા અંતર્ગતભાવ સાથે, ને નહિ કે કર્મના પરિણામ સાથે	કુંદુંબ, સંયુક્તના લાભ ૭૩
નિશ્ચબત હોવી ઘટે ૧૫૯	કુંઠલવૃત્તિ ૧૦૮
કર્મનો અમલ તરત કરો ૬૨	કૃતજ્ઞભાવ કેળવો ૧૬૬, ૨૦૮
કર્મની અસર સમાચિત પણ ૧૨૦	કૃપા, પ્રભુની સર્વ પરિસ્થિતિમાં ૧૨૦
કર્મમાં બીજાંને રસ લેતાં કરવાની રીત ૫	કૃપાનું સ્વતંત્ર અસ્તિત્વ ૧૪૫
કર્મો, રાગદ્વેષ ઘટાડવા માટે ૧૫૯	કાંતિ આપણી અંદર, બહાર ૫૫
કર્મો (જીવદશાનાં)નાં પ્રેરક બળો ૮૩	ક્ષેત્ર ગમે તે હો, જીવનવિકાસ માટે તે બાધક નથી ૨૪૬, ૩૦૫
કર્મનો અંત આણવાની અધીરાઈ ૧૮૧	ખુલ્લા થવું એટલે ? ૨૦૧
કર્મ-સાધનાના મુદ્દાઓ ૧૧૮, ૧૧૯, ૨૮૫, ૨૮૬	ખુલ્લા થવા વિષે ૧૮
કર્મો(પ્રાપ્ત)માંથી ભાગવું તે તમોગુણ છે ૨૨૩	ખોરાકનું નહિ પણ તમન્નાનું સાધનાપંથે મહત્વ છે ૧૬૩, ૨૮૦
કર્મો કર્યા કરવામાં સાધનાની યથાર્થતા ૨૫૩	ગમા-આણગમા દૂર કરો ૫૭
કલ્યાણભાવના સર્વ પ્રતિ ૨૦૪	ગણતરી, ભાવની ઊણપ સૂચવે છે ૨૧૨
કસોટી, જીવનવિકાસ કાજે જરૂરી ૩૩, ૧૩૮, ૩૦૬, ૩૦૭	ગર્વ પ્રગટવી ઘટે, ગુરુની, પ્રભુપથની ૧૩૮, ૧૫૦, ૨૦૩
કળણમાં અને પ્રાર્થનાભાવ ૭૮	ગરીબાઈનો સાધનામાં ઉપયોગ ૧૨૦
કળાઓમાં જીવનકળાશ્રેષ્ઠ છે ૧૮૫	ગંગામાતાને ઉદેશીને ચેતન અંગે દ્વિઅર્થી શ્લોકો ૩૦૮
કળા સાચી ૨૨૦	ગીતા-શ્લોકો ૨૩૪
કળાકારના સર્જનને ને તેના સ્થૂળ જીવન-આચારને સંકળાવાય નહિ ૧૮૮	ગુણગ્રાહકતા ૨૦૨
	ગુણ અને તેની શક્તિ અવિભિન્ન ૪૧૮

ગુણ-સાત્ત્વિક, કેળવો ૧૮  
 ગુણનો અતિરેક અવગુણમાં  
     પરિણમે ૪૦  
 ગુણપ્રાપ્તિની સાધના ઉપર નહિ  
     પરંતુ આંતરિક જગૃતિ અને  
     પ્રભુભાવ ઉપર ઝોક દો ૮૭,  
     ૧૫૫, ૨૧૮, ૩૧૫, ૩૧૬  
 ગુણોની રમત ૩૧૩-૩૧૪  
 ગુણોની કક્ષા સત્ત્વ, ૨૪૪, તમસ  
     ૧૭, ૩૧૧  
 ગુરુ-વચન-પાલન ૧૫, ૧૫૧  
 ગુરુદક્ષિણા, સાચી ૨૪૭  
 ગુરુથી થતું સાધકનું જીવન-ઘડતર  
     તેરથ થી ૩૩૩  
 ગુરુ અને સાધકના સંબંધો વિષે ૬,  
     ૧૦, ૧૧, ૧૨, ૧૪, ૨૧,  
     ૨૪, ૩૮, ૩૯, ૪૦, ૭૧,  
     ૮૫, ૮૬, ૮૭, ૧૨૫, ૧૩૭,  
     ૧૩૮, ૧૩૯, ૧૫૮, ૧૮૩,  
     ૨૦૧, ૨૦૬, ૨૦૮, ૨૨૪,  
     ૨૨૬, ૩૨૧ થી ૩૪૪  
 ગુરુ આપણા પોતા વિના બીજો કોઈ  
     નથી; તે સર્વમાં વ્યાપેલો છે  
     ૩૨, ૧૦૪  
 ગુરુ પણ સાધનરૂપ છે ૮૮, ૧૦૪,  
     ૨૨૮, ૨૪૦  
 ગુરુ એટલે તેનો દેહ નહિ ૮૭,  
     ૨૨૫, ૨૩૧, ૩૧૮

ગુરુપૂર્ણિમા દિન ઉજવવાની સાચી  
     રીત ૧૩  
 ગુરુની સ્થૂળ નિકટા ૧૦૧  
 ગુરુની સાચી ભક્તિ કરી ૧૩૭  
 ગુરુદમ ૩૮  
 ગુરુમંત્ર લેવો તે પૂરતું નથી ૧૨૪  
 ગુરુ સાથેની એકતાનો અર્થ ૨૩૧  
 ગુરુને સમજણના ચોકઠાથી નહિ  
     સમજ શકાય ૧૫૨  
 ગુરુની બહિરૂ પૂજા, માત્ર, પૂરતી  
     નથી ૧૫૪  
 ગુરુ વિના પણ જ્ઞાન-પ્રાપ્તિ શક્ય  
     ૧૬૩  
 ગુરુ બધું કરી દેશો, એ ભમણા છે  
     ૨૦૭  
 ગુરુની આવશ્યકતા ૩૧૭  
 ગૂઢતા ૪૨૬  
 ઘડપણમાં ગોવિંદ-ગુણ ગાવા દુષ્કર  
     ૨૦૭  
 ઘૃણાનો પ્રતિકાર પ્રેમથી ૨૬૦  
 ઘર્ષણ, વિકાસનું સાધન ૧૦૭  
 ચણચણાટી ૭૫, ૧૧૫  
 ચમત્કાર ૮૮, ૧૬૫, ૩૪૪, ૩૪૫  
 ચમત્કાર સાચો, પ્રકૃતિનું રૂપાંતર  
     ૨૨૮  
 ચરણ-પૂજા માહાત્મ્ય ૧૭૭  
 ચર્ચાથી મતાગ્રહ વધે ૪૫

ચર્ચા એટલે સૂક્ષ્મ અનુદારતા અને  
 અહેંકાર ૧૮૮, ૨૩૫  
 ચાહવાનો, નિરપેક્ષપણે, ધર્મ  
 ૧૫૮, ૧૬૯-૧૭૦  
 ચિત્તશુદ્ધિની આવશ્યકતા ૧૦૯  
 ચિંતા અને ચિંતન ૧૦૦  
 ચીલે ચાલવું છોડો ૨૫૮  
 ચીવટાઈ અને ચીકળાશ ૪૫  
 ચેતનને વ્યક્ત કરવા માટે પ્રકૃતિનાં  
     વલણોને ચેતનાભિમુખ કરો  
     ૨૧૯  
 ચેતનનાં જુદાં જુદાં રૂપો ૮૯  
 ચેતનની અચેતનમાં અભિવ્યક્તિ  
     ૨૦૦  
 ચૈતન્ય, કર્માં મૂળમાં ૩૪૫  
 ચોકસાઈ અને ચીકળાશ ૪૫  
 છેતરનાર જ છેતરાય છે ૧૫૯  
 જગત ૩૫  
 જગત એટલે ફેરફાર ૧૩૧  
 જગતસુધારણા અને જાતસુધારણા  
     ૮૮  
 જગતનો સ્વીકાર ૫૦, ૧૨૧,  
     ૧૬૨  
 જગતમાં સર્વ કંઈ સહેતુક છે ૪૨  
 જગતમાં આધ્યાત્મિક કસરતશાળા  
     ૧૬૦  
 જગતની સમસ્યાઓના ઉકેલની  
     અણસમજ ૧૮૫

જગતમાં જનાર્દન રહેલા છે; જનતા  
     કંઈ જનાર્દન નથી ૧૪૪  
 જન્મ-મૃત્યુના રાસ ઉપર  
 જન્મદિનનું માહાત્મ્ય ૩૬  
 જપ, જુઓ નામસ્મરણ  
 જપ, બહિરૂ અને આંતરિક ૧૦૫,  
     ૩૪૭  
 જપ એટલે શું? ૧૧૬, ૩૪૭,  
 જપ, અજપાજપ ૨૩૦, ૩૪૭  
 જપ ક્યો ઉત્તમ? ૩૪૮  
 જગૃતિ ૧૭, ૪૮, ૬૮, ૨૧૯  
 જિજ્ઞાસા અને પુરુષાર્થ ૫૧  
 જીવન, ચૈતન્યશક્તિનો આવિભવ  
     ૧૭૭  
 જીવનધર્મ અને સાધના ૨૯, ૩૭  
 જીવનઘડતર ક્યારે થાય? ૮૫  
 જીવનભેટનો ઉપયોગ ૫૭  
 જીવન-પટ સણંગ વાળાટ છે ૮૮,  
     ૧૦૩, ૧૧૦ ૧૭૧, ૨૪૭  
 જીવનસંગ્રામનો રસિયોસાધક ૧૧૪  
 જીવન (આધ્યાત્મિક) સર્વતોમુખી  
     ૬૨, ૬૯  
 જીવનવિકાસ ૧૨, ૮૭  
 જીવન વેડફાતાં, અરેરાટી ૧૩૩  
 જીવનપણાના ગ્રણ અવરોધો ૮૮  
 જીવન-કાવ્ય ૩૦૮, ૩૫૪, ૩૫૬  
 જીવન-સોદો (કાવ્ય) ૩૫૫

જીવન વ્યાપ્તિ, પ્રમુખમાં (કાવ્ય)	તીર્થયાત્રા-દર્શન, લાભ ઉદ્દેશ થી
૩૫૬	૩૬૮
જોબનિયે જીવનસિદ્ધિ ૩૫૮	તીર્થ સાચું ૩૭૦
જ્ઞાન, ધ્યાન, કર્મનો સમન્વય	તીવ્રતા અને વલવલાટ ૪૮
૨૩૮, ૨૫૮, ૩૬૨	ત્યાગ, અજ્ઞાનમૂલકદશાનો ૭૦
જ્ઞાનતંતુઓને શાંત રાખો ૧૬૦	ત્યાગ નહિ પણ સમર્પણ ૨૫૫
જ્ઞાનનો વિકાસ અનંત છે ૭૨	ત્યાગ અને ભોગ, પ્રેમભક્તિ-
જ્ઞાની-અજ્ઞાનીનું ભોગવવું ૩૮,	જ્ઞાનયોગની ભૂમિકાવાળા
૧૨૪	૧૪૮, ૩૭૦, ૩૭૧
જ્ઞાની-અજ્ઞાની વચ્ચેનો તફાવત	ત્રાટક ૩૭૧ થી ૩૭૫
૧૪૮, ૩૬૦, ૩૬૧	દત્તાત્રેય ૧૬૮
જ્ઞાનેન્દ્રિયો, આસક્તિ ૩૫૮	દ્યા, કરુણા ૧૮૦
જંખના ૩૬૩	દ્યા, જીવભાવે એટલે અહંકાર
જંપલાવવું, સ્વતંત્રપણે ૬૭	૧૨૫, ૧૩૮
જેર પણ સદૃપ્યોગી કળાથી	દુંભ ૩૭૫
અમૃતસમ બને ૨૨૪	દંપતીને (મંગળાષ્ક) ૪૮૫,
દોકણી, જાતને સતત કરો પણ	૪૮૬
તકનો લાભ લો ૨૫૪-૨૫૮	દાનવૃત્તિ અને કરુણા ૩૭૬
તટસ્થતા, અનાસક્તિનું પરિણામ	દાન અને કલ્યાણભાવના ૧૨૩,
૨૭, ૨૪૧	૧૯૪, ૩૭૬
તપમાંથી ગુણશક્તિ અને જ્ઞાન ૭૨	દાન અને લક્ષ્મીનું ભમત્વ ૧૮૪
તપસ ૩૧૧-૩૧૨	દાનથી સંકુચિતતા દૂર થવી ઘટે પણ,
તમન્નાની જરૂર ૧૧, ૫૫, ૬૭	૧૨૩
તમન્ના અને સંજોગશૂખલા ૩૬૪	કુઃખમાં સુખ ૧૧૧, ૨૪૫
તાટસ્થ અને મન ૮, ૬૬, ૩૬૫	કુઃખનો મહિમા ૧૪૨, ૨૫૦,
તાલાવેલી, દૂબી જવા માટે નહિ	૨૬૨, ૩૭૮
૧૮૩	કુઃખ સહન જ્ઞાનપૂર્વક,
તિરસ્કાર, ઊલટું કળણમાં ખૂંપાવે	તપશ્વર્યાભાવે ૮૪
૧૫૦	

દાણની વિશાળતા ૨૪	ધ્યાન નાડી-ધબકારા ૩૮૮
દાણિભેદ કોઈનોય ન કરવો ૬૭, ૨૩૮	ધ્યાનના જુદા જુદા હેતુઓ ૩૮૬, ૩૮૭
દાણાંત, બીજાંને તેમ વર્તવા ન પણ પ્રેરે ૪૦	નકામું જગતમાં કશું નથી ૨૪૦, ૨૪૧
દેશાભિમાનમાં સૂક્ષ્મ અહ્મૃ ૨૪૪	નકારાત્મકનો પ્રસાર ન કરો ૧૨૬, ૧૨૭, ૧૩૩
દોષ ચિંધનાર ઉપકારક છે ૧૧૩	નકારાત્મક વલણ સામે સામાના ઉત્તમ પાસાની યાદ ૧૩૨
દોષ (સ્વ) દર્શન ૭૮, ૩૮૧	નબળાઈઓ, બીજાંની, પરત્વે જ્ઞાનયુક્ત તટસ્થતા ૨૦૬
દોષનું મનન-ચિંતવન ન થાય ૮૫	નમનનો હેતુ ૧૭૭
દોષમાંથી લાભ ઉઠાવવો ૧૧૧	નમતા ૧૧, ૧૫, ૨૨, ૩૮, ૪૭, ૭૦, ૮૪, ૮૮ ૧૫૨, ૨૦૦
દોષ સ્વીકાર, તેનાથી પર થવા કાજે ૭૭, ૧૦૦, ૧૫૩, ૧૬૮, ૧૮૧, ૩૭૮-૮૦- ૮૧	નમતા સંતોની ૪૭, ૨૦૦
દોષ-નિવારણ અને પ્રભુભાવ- પ્રાપ્તિ માટે પુરુષાર્થ ૧૬૮	નમતાના સ્વાગમાં અહંતા નામસ્મરણ જુઓ જ્ય (પણ) ૩૨, ૩૪, ૬૮, ૮૬, ૧૨૫, ૨૨૩, ૩૦૮, ૩૫૧, ૩૮૮ થી ૩૬૦
દ્વંદ્વો, દરેક યુગમાં, જગતમાં હોવાનાં ૧૬૦, ૧૮૫	નામસ્મરણ, તાવ વેળા ૭
દૈતનું રહસ્ય, પ્રેમમાં ૧૮૭	સ્મરણ માત્ર, કર્યે નહિ ચાલે ૧૭, ૨૪, ૩૨
ધન, સાચું, પ્રકૃતિનું રૂપાંતર ૧૭૮	સ્મરણ માત્ર ઘરેઝની રીતે પણ અખંડ થતાં થોડુંક તો ફળ આપે ૩૮, ૩૪૭
ધર્મ, પરિસ્થિતિનો, પ્રતિકાળ બદલાય છે ૧૬૮, ૧૮૫	નામી કરતાં નામ ચઢે ૩૭
ધર્મ (પ્રાપ્ત), તરછોડ્યે ધર્મ ન મળે ૨૫૧ થી ૨૫૪	નારીજીવન, જુઓ સ્ગીજીવન નિઃસંગ-ભાવના કેળવો ૫૬,
ધિક્કાર પ્રેમનું ઉલટું પાસું ૨૪૩	
ધૂંધવાવું અને ભડકો થવું ૫૮	
ધ્યાન ૨૩, ૨૩૮, ૩૮૩	
ધ્યાન અને આસન ૩૮૪, ૩૮૫	

૨૦૮, ૨૨૧  
 નિર્ણય, હાર્ડિક સ્વીકારનું માપ  
     ૨૩૩  
 નિદ્રા ૨૮૨ થી ૨૮૫  
 નિરાશા, પ્રાણના પ્રાકૃતિક  
     સ્વભાવની ૭૫  
 નિરાશા સાધનાપથે ૩૮૧ થી  
     ૩૮૨  
 નિરાગ્રહીપણું, ૧૫, ૧૮૪  
 નિરાગ્રહીપણું પ્રકૃતિપ્રેરિત,  
     વિકાસક નથી ૧૫  
 નિર્ધન (અધ્યાત્મપથે)નો અર્થ  
     ૨૨૫  
 'નિર્બળ કે બળ રામ'નો અર્થ ૮૨,  
     ૨૩૪  
 નિંદા-રસમાંથી બચો ૧૨૬  
 નિકટવર્તીપણું, સ્થૂળપણે ૧૮૦  
 નીતિ, સદાચાર, એકલાં પૂરતાં નથી  
     ૮૭, ૮૬, ૨૩૩  
 નીરવતાની આવશ્યકતા ૮, ૧૨૮  
 ન્યાય, અન્યાય તો રહેવાના ૯  
     ૧૩૫  
 ન્યાય તોળવા ન બેસો ૮૮  
 પતન વેળા પણ જાગૃતિ ૮૩, ૧૦૪  
 પતિ-પત્નીનો સંબંધ વાસનાના  
     ઉધ્વાકરણ માટે ૬૫  
 પત્નીની અવગણના અને દાન  
     ૨૪૦

પત્રલેખનકળા ૪, ૧૨૧, ૧૬૬  
 પત્રવ્યવહાર, સાધનરૂપે ૩૮૪  
 પરિસ્થિતિનો ધર્મ બજાવવો ૬૭,  
     ૮૧  
 પરિસ્થિતિ, વિરોધી, પણ સહાયક  
     બની શકે છે ૧૨, ૩૧, ૬૪,  
     ૭૮, ૮૨, ૮૩, ૧૫૮  
 પરિસ્થિતિનો સ્વીકાર, વિકાસાર્થે  
     ૧૪૫, ૧૬૧, ૧૬૪, ૩૮૬  
 પસ્તાવો, સાચો ૭૨  
 પાપીના તરિત ઉદ્યની શક્યતા  
     ૧૬૫  
 પુનરાવર્તનની આધ્યાત્મિકપથમાં  
     અનિવાર્યતા ૨૨૧  
 પુનર્જન્મ વહેલો, મોડો, થવાનો  
     આધાર ૨૪૭  
 પુનર્જન્મમાં નર કે નારી જાતિ ?  
     ૨૪૭  
 પુનર્જન્મના પ્રકારનો આધાર  
     વર્તમાન ૩૫૨ ૮૩  
 પુરુષ-પ્રકૃતિ ૭૪  
 પુરુષાર્થ-કૃપા ૮૫, ૮૬, ૩૮૮ થી  
     ૪૦૧  
 પુરુષાર્થ અને પ્રારબ્ધ ૪૨, ૨૪૪,  
     ૪૧૩, ૪૧૪  
 પુરુષાર્થ આધ્યાત્મિક, સદા  
     લાભકારક ૮૩  
 પુરુષાર્થ ક્યારે ફળે ? ૮૪, ૮૬

પુરુષાર્થનો અહંકાર ત્યાજ્ય ૮૨	પ્રભુને ખાતર ૯ પ્રભુ ૧૫૩
પુરુષાર્થની (પ્રયત્નની)	પ્રભુ વિષેના સર્વ કાલ્યનિક ખ્યાલો
આવશ્યકતા ૮, ૧૧, ૧૮, ૪૩, ૫૧, ૫૨, ૫૫, ૫૮, ૬૧, ૬૨, ૬૨, ૧૧૮, ૧૩૨, ૨૩૩, ૨૬૨	ઇઓડો ૧૬૩, ૨૫૩ 'પ્રભુ બધું જ કરાવેછે ને કરાવશે'ની ભ્રમણા ૧૮૧
પૂજા, અર્ચન-આચાર ૩૮૭	પ્રભુ-સ્મરણ-ખ્યાલ ખોવાયેલી કીમતી વસ્તુના જેવો ૨૧૧
પૃથક્કરણ (સ્વ)ની જરૂર ૭, ૨૧૩	પ્રભુ ઉપર આધાર કોણ રાખી શકે ?
પૃથક્કરણ વેળાયે પણ નામસ્મરણ ૨૦૫	૨૨૫
પ્રકૃતિ-રૂપાંતર (પૂર્ણ) સમય માંગી લે છે ૧૭૦	પ્રભુ-કોપમાંયે કરુણા ૨૬૨
પ્રકૃતિવશ પ્રવૃત્તિ ૮૩	પ્રભુ-સ્મરણમાં ભસ્ત ૭૪
પ્રકૃતિના પ્રેરાવ્યા ન પ્રવર્તીએ ૪૮, ૪૦૪ થી ૪૦૮	પ્રભુ-પ્રાપ્તિનો હેતુ ૧૦
પ્રકૃતિનો પ્રકૃતિમાં વિકાસ ૧૧૭	પ્રવૃત્તિઓનું (અન્યની) યોગ્ય મૂલ્યાંકન ૧૮૭
પ્રકૃતિ દ્વંદ્વની રમતમાં ૧૪૭	પ્રસન્નચિત્તતા ૮, ૧૭૮, ૨૬૦
પ્રકૃતિની નકારાત્મક વસ્તુઓની સામે સાત્ત્વિક રચનાત્મક ભાવનાઓ ઉપર ઝોક દો ૧૮૭	પ્રસંગ-ગુરુ આરસીરૂપ છે ૭૮, ૧૦૮, ૩૮૬, ૩૩૮૭
પ્રકૃતિના માયાવી હુમલા ૨૪૪	પ્રસંગ ઘડતરની એરણ ૨૦૮
પ્રકૃતિને પ્રકૃતિરૂપે ઓળખો ૪૦૪	પ્રાણની મન ઉપર અસર ૧૨૮
પ્રગતિ કે પીછેહઠ ? ૧૮૨	પ્રારથ્ય-પુરુષાર્થ ૪૨, ૧૮૫
પ્રચાર કશાનોયે ન કરો ૧૬૭, ૧૮૫	પ્રાર્થના ૮૭, ૨૧૦
પ્રભુને જેમાં ને તેમાં મહત્વ દો ૧૪૬	પ્રાર્થના કોઈના જેવા થવાની કરવાની ના હોય
	પ્રાર્થનાભાવે પ્રવૃત્તિઓ ૪૧૨
	પ્રાર્થના એક પ્રકારનું ધ્યાન ૨૧૩, ૨૩૮
	પ્રાર્થનાની ઉપયોગિતા ૧૨૨, ૧૩૫

પ્રાર્થના	પળેપળ	હદ્યથી	કુલમાંની સુવાસ અને સાધક ૧૩૦
જીવનપત્રમાં	વણાઈ જવી		બચાવ ન કરો ૧૦૮
જોઈએ	૧૫૫		બહેનોને ચરણે (કાવ્ય) ૪૩૬
પ્રેમની કઠણાશ	અને કુમળાશ		બહેનો પ્રત્યેનું વલણ ૪૮૬
૧૪૮, ૧૮૨,	૪૧૭		બહેનો સાથેનો નિર્મળ ભાવસંબંધ
પ્રેમસંબંધ	કોની સાથે બાંધશો ?		પ્રેરણાપ્રદ છે ૨૨૧, ૪૩૩
૪૨૫			બાધ્યાચાર કેવળ પૂરતો નથી ૧૫૪,
પ્રેમમહિમા	૨૬૪, ૨૮૫, ૪૧૭ થી		૧૭૭
૪૧૮, ૪૨૩-૪૨૪			બાળકુંઠેર અંગે ૧૫૭
પ્રેમની અનંતતા	૪૮, ૪૬૨		બુદ્ધિ ૪૩૮ થી ૪૪૨
પ્રેમનાં લક્ષણો	૬૦, ૧૬૬, ૧૮૨,		બુદ્ધિ અને અનુભવની જરૂર ૮૮,
૨૪૪			૨૩૩
પ્રેમને કાળ-સ્થળની મર્યાદાનથી	૬૧		બુદ્ધિમાં આસક્તિ ઉમેરાતાં અસમતા
પ્રેમની ભાવનામાં	એક પક્ષ	૮૩,	૮૫
૧૯૭			બુદ્ધિનું કોરાપણું અને હદ્યતા ૩૪,
પ્રેમ, સંસારી	૮૪		૮૫, ૮૮, ૪૪૦
પ્રેમ, ભક્તિથી	પણ શ્રેષ્ઠ	૮૧	બુદ્ધિ અને લાગણી ૨૪૧
પ્રેમ સમજવા	સ્વભૂમિકા રચવી		બુદ્ધિ અને શ્રદ્ધા ૪૭
જોઈશે	૧૭૦		બુદ્ધિ-સંસ્કારગતથી થતા નિર્ણયો
પ્રેમ સ્વયંભૂ	અને નિરાલમ્બ	૧૭૫,	પૂર્ણ સત્ય નથી ૧૭૧
૨૨૬, ૪૧૭-૪૧૯			બુદ્ધિમાં હદ્ય ભળતાં સતેજતા ૮૫
પ્રેમનું	અવતરણ, આરોહણ કરાવવા		બુદ્ધિમાં શંકા ૪૨
૧૭૮			બુદ્ધિની શુદ્ધિ ૮, ૮૫, ૧૯૪,
પ્રેમમાં	શરતી ‘સોદો’ નથી	૨૨૩	૨૪૧, ૨૪૨, ૪૩૮, ૪૪૦
પ્રેમમાં	પક્ષાપક્ષી નથી	૨૪૪	બેહદનો આનંદ (કાવ્ય) ૩૬૧
ફકીરી	એટલે શું ?	૧૩૯	બ્રહ્મચર્યપાલન ૨૨
ફનાગીરી	૪૩૧		બ્રહ્મચર્યપાલન સિદ્ધ ક્યારે ? ૨૧૮
ફંકાઓના	પ્રકારો	૧૪૩	બ્રહ્મા-વિષ્ણુ-મહેશ ૨૩૮, ૨૪૯

ભક્ત અને પરિસ્થિતિનો સ્વીકાર  
 ૭૦  
 ભક્તિ એટલે શું ૧૪૪  
 ભક્તિની ૪૩૨ ૫૮  
 ભક્તિ અને બુદ્ધિની સૂક્ષ્મતા ૭૦  
 ભક્તિ પ્રેમશૌર્યઅંકિત જોઈશે ૧૫૨  
 ભગવાન-જુઓ પ્રભુ ભગવાનની  
 ચેતનાશક્તિ સર્વત્ર ૨૪૦,  
 ૨૪૬  
 ભગવાનનાં દર્શન ૬૨, ૨૨૭,  
 ૪૪૨, ૪૫૦  
 ભગવાનના એની શરતોએ જ  
 થવાય ૬૧  
 ભગવાન કે માયા, બેમાંથી એક  
 ૬૨  
 ભગવાનનાં નામો પાછળ ભક્તોનો  
 અનુભવ ૧૭૨  
 ભગવાનના ભાવને લિંગભેદ કે  
 કાળ નથી ૧૮૬  
 'ભજતે' નો ખરો અર્થ ૨૩૪  
 ભાવના, કબીરવડ જેવી ફાલી શકે  
 ૫૮  
 ભાવનું બળ ૧૨૬, ૧૨૮, ૨૬૫  
 ભાવ અને વિચાર ૨૭  
 ભાવની ધૂનમાં હોવાનું પ્રમાણ  
 ૨૩૨  
 ભાવાવસ્થા વેળા ઘેયની જગૃતિ  
 ૨૨૨

ભાવના પ્રગટેલી રહેવાની ૪૩૨  
 ૨૪, ૨૮, ૪૫, ૭૬, ૧૭૨  
 ભાવના-સાચી-નું પ્રમાણ ૧૨૩  
 ભાવનાનું ગ્રાબલ્ય ૨૬, ૪૫૦ થી  
 ૪૫૩  
 ભાવનાનું સાતય ૨૬, ૭૪  
 ભાવના જેવી, તેવી સિદ્ધિ ૪૨  
 ભાવનાની ઉર્મિ ૭૫  
 ભાવનામય જીવન, સાચું જીવન  
 ૮૪  
 ભૂતો, આપણાં જ જન્માવેલાં ૫૯  
 ભૂમિકા, સર્વ કંઈ આવી મળવાની  
 આપણામાં છે ૩૦, ૩૬, ૭૨,  
 ૮૦, ૧૦૩, ૧૮૦, ૨૩૮,  
 ૩૮૨  
 ભૂમિકાની તૈયારી, સર્જણ થવા માટે  
 ૪૩રી ૬૮, ૧૪૮-૧૫૦,  
 ૨૫૬  
 ભૂલ ૫૨, ૫૩  
 ભૂલ, પોતાની મેળે જ શોધો ૪૫૪  
 ભૂલનો પણ સદૃષ્યોગ ૧૪, ૨૫,  
 ૪૫૪  
 ભૂલાં પડેલાંની વધુ કાળજી ૧૧૪  
 ભેદને અભેદમાં પ્રગટાવો ૮૩,  
 ૧૦૪, ૧૮૩  
 ભોંઠ્ય પોતે વહોરવી ૧૦૮, ૧૧૨  
 મક્કમતા ૧૮  
 મદ્દનો ઉપયોગ પ્રકૃતિ અનુસાર

જ થવાનો ૧૮૧, ૧૮૨  
 મન અને દબાણ ર  
 મનની દ્વિધાસ્થિતિ વેળાએ ૧૧૩  
 મનની સમજણો છોડો ૧૪૨  
 મનની, બુદ્ધિની મર્યાદા ૧૪૭  
 મનને નીરવ કરવાની રીત ૧૮૭  
 મન અને સાધક ૧, ૨, ૧૮, ૨૭,  
     ૩૪, ૪૫, ૪૭, ૬૬, ૭૬,  
     ૧૧૭, ૪૫૪  
 મનની ભૂમિકા પરનું કર્મ ૪૨  
 મનોમંથન, યોગ્ય-અયોગ્ય ૧૦૦  
 મહત્વ, બીજાંને વધુ આપો ૭૧  
 મહત્વાકંશાનાં લક્ષણો ૧૫૧  
 મંથન જરૂરી છે ૨૬, ૩૩, ૫૨,  
     ૭૧  
 માતૃજ્ઞણ અને માતૃભાવના ૧૮૨-  
     ૧૮૩  
 માન-આદર, ઘરેડ્યુક્ટ ૨૮  
 માનસિક કષ્ટ, શ્રમની તાલીમ  
     જરૂરી ૧૭૮  
 માનસિક ઉદારતા ૨૮૮  
 માન્યતાઓ-મહાગાંઠો, છોડવી  
     જોઈશે ૨૫, ૨૬, ૪૬, ૫૭  
 માંગલ્યપ્રેમ (કાવ્ય) ૪૬૧  
 મીરાં ૧૫૪, ૧૫૬  
 માયાખેલની અંતરમાં પ્રભુ ૪૫૮  
 મુક્તની કરણમાંથી મુક્તિ ૮  
 મુક્તને ક્યારે સમજ શકાય ? ૮૪

મુક્ત અને સાચ્ચિક હુંકાર ૮૭  
 મુક્તનાં લક્ષણો ૧૦૪, ૧૮૮,  
     ૧૯૪, ૨૧૫, ૨૪૨, ૨૬૨,  
     ૩૨૦, ૩૫૩, ૩૭૭, ૪૩૦,  
     ૪૬૩ થી ૪૭૭  
 મુક્તનાં ગૂઢ વર્તનો ૪૬૩ થી ૪૭૭  
 મુક્ત અને તેની વિચિત્રતાઓ  
     ૧૪૬  
 ‘મુક્તને સર્વ કાંઈનું સંપૂર્ણ જ્ઞાન  
     હોય’, એ ભ્રમ ૨૦૮  
 મુક્તાત્માઓની વાણીમાં તિન્નતા  
     શાથી ? ૨૨૨  
 મુક્તિ એટલે શું ? ૫૧, ૧૮૪  
 મુક્તિ, સિદ્ધિ-પ્રાપ્તિ અને તેનો  
     કાર્યક્ષેત્રે સફળ ઉપયોગ એ બે  
     જુદી હકીકતો છે ૨૦૧  
 મુશ્કેલીઓ, વિઘ્નો, વિકાસાર્થે મળે  
     છે ૨૧૭, ૪૮૨-૪૮૩  
 મૂઢ્યતા, એ જ્ઞાનની આડે પડદો છે  
     ૨૪૭  
 મૂળ, સર્વ કાંઈ જે આપણાને મળે છે,  
     તેનું, આપણામાં છે. (જુઓ  
     ‘ભૂમિકા’)  
 મૃત્યુ ૧૬૬, ૧૭૨  
 મૃત્યુ અને જીવન ૧૭૧, ૧૭૨  
 મૃત્યુજ્ઞના રાસ (કાવ્ય) ૩૫૨  
 મેંદીની જેમ વટાઈને લોંદા જેવા  
     બનીએ ત્યારે રંગ પ્રગટે ૧૪૧  
 મૌન-એકાંતનો મોંઘામૂલો ગાળો

૩૮, ૨૨૮, ૨૬૦	૨૧૬
મौन-એકાંત લેવાનો હેતુ ૯૦, ૧૧૭	૨૪૪ ત૧૩
મौન-એકાંતની આવશ્યકતા ૧૮૩	રજોગુણ, સત્ત્વિક ભૂમિકા પરનો ૮૭
મौનની જરૂર ૧૨૨	રસ, સામાને આપણા કામમાં લેતા કરવાની કળા ૧૮૮
મौન અને વાણી ૫૧	રસજી-દાસ્તિ, શક્તિ, સાધનામાંથી ખીલે ૨૦
મौન સાચું ઈન્ડ્રિયોનું ૧૨૨, ૨૩૨, ૨૪૮, ૨૬૦	રાગ-આસક્તિ, સંત સાથે ૭૯
યથાસ્થાને સર્વ કાંઈ ઉપયોગી છે ૨૪૧	રાગ-આસક્તિ સદ્ગુરુમાં ૧૨
યમેવૈષ: વૃષ્ણ તે તેન લભ્ય: ૧૮૦	રામ-રાવણા ૨૪૪
યાત્રા એ સહેલગાહ નથી ૩૩, ૩૬૮, ૩૬૯	રામકૃષ્ણ પરમહંસદેવ ૧૮૦, ૪૮૮
યાત્રા આશ્રમોની ૩૬૭	રુદ્ધન, મૂઢ્યતાભર્યું, જીવનવિધાતક ૨૪૬
યુદ્ધ એટલે ખંડન અને મંડન બન્ને ૨૩૭, ૪૭૮	રૂપના જુદા જુદા ગ્રકારો ૧૮૭
યુદ્ધની અનિવાર્યતા ૬૭, ૧૦૬, ૪૭૯, ૪૮૦	લક્ષ્ણશોથી જીવનવિકાસને માપો ૭૨
યુદ્ધ-ક્ષેત્રે, શૂરવીરની વાહવાહ અને સાધકનું અજ્ઞાતપણું ૨૪૨	લક્ષ્મીની ફોરમ અને દુર્ગાંધ ૨૮
યુદ્ધ, પળેપળ, સજાગ ને મથતા માટે છે ૧૫૧, ૨૩૭	લક્ષ્મીના વ્યવહાર વિષે ૧૫૮, ૧૮૦, ૧૮૪
યુદ્ધમાં હાર પણ જીત માટે છે ૧૮૬	લક્ષ્મી પ્રતિની દાસ્તિ ૪૮૭ થી ૪૮૮
યુવાની, જીવનનો સર્વશ્રેષ્ઠ કાળ ૧૭૯, ૨૦૭	લગની-રસ ૩૮
યોગાનુયોગ અને દિવ્ય સાંકળ ૧૬૯	લગન-ભાવનાનો હેતુ ૪૮૨ થી ૪૮૬
યોગો, સર્વ પ્રકારનો, ઓતપ્રોત છે	લાગણી, જુઓ ઊર્ભિ લાગણીઓ પોચી રૂ જેવી ઘડી ન શકે ૭૩

૮૨, ૧૪૮  
 લાચારી ૭૦  
 વજાદારી ને પ્રમાણિકતા ૬૧  
 વડીલો ને સંતાનો ઉદ  
 વડીલો પ્રતિ સદ્ગ્રાવ હરકોઈ  
 સંજોગમાં ૧૩૮  
 વર્તમાનમાં ભૂત, ભવિષ્ય ૧૦૮  
 વાણીના માલિક બનો ૧૮૨  
 વાણીનો સંયમ ૪૮૧, ૪૮૨  
 વાણીમાં વિવેક ૧૧૨  
 વાતાવરણની અસર ૪૮૮, ૪૮૯  
 વાચન, ભાવનાના વિકાસાર્થે ૧૬૮  
 વાચનમાંથી, જીવનધ્યેયને અનુકૂળ  
 હાઈ પકડવું ૨૩૫  
 વાંધા-વચકા અહંકુનું કારણ છે ૨૫૫  
 વિકાસ(આધ્યાત્મિક)નો અંત નથી  
 ૪૧  
 વિકાસ આંતરિક અને બદલાતી  
 જતી જીવનદિષ્ટ ૧૮૯  
 વિકાસ એક ક્ષેત્રનો બીજા ક્ષેત્રમાં  
 ઉપયોગી ૪૭  
 વિઘ્નો, જુઓ મુશ્કેલી  
 વિચારો ૪૮૩ થી ૪૮૫  
 વિચારો આંતરિક કર્મ છે ૪૮૩  
 વિચારો અને ત્રિગુણ ૬૫-૬૬  
 વિચારો(રાગદ્વેષવાળા)નાં માઠાં  
 પરિણામ પોતામાં ને સમાચિમાં  
 ૨૦, ૪૮, ૬૬

વિચારો, વાણી અને વર્તનનો મેળ  
 ૨૦, ૨૪  
 વિચારોની પરંપરાને રોકો ૫૮,  
 ૬૬, ૭૧, ૧૬૨, ૨૨૭,  
 ૫૦૧  
 વિચારોની વાતાવરણ પર અસર  
 ૫૧, ૫૩, ૬૬, ૪૮૩, ૪૮૪  
 વિજાતીય સંબંધો, ભાવનાની દિષ્ટાએ  
 ૬૩, ૮૦  
 વિજન્સ ૨૧૭  
 નાશમાં પણ રચનાત્મકપણું ૮૧  
 વિવિધતામાં એકતા ૨૫૫  
 વિવેકદિશાક્રિયા ૬૬, ૬૮, ૧૭૧,  
 ૨૪૨, ૪૮૫  
 વિશ્વમાં અલિપ્ત વિશેશ્ચર ૪૮૬  
 વિષય-વાસના (જાતીય) અને સાધક  
 ૭, ૨૨  
 વિસંવાદમાં સંવાદ ૩૪, ૮૧  
 વૃત્તિ ૬૮, ૭૪, ૫૦૦ થી ૫૦૨  
 વૃત્તિનાં મૂળ શોધો ૧૭૮  
 વૃત્તિ એટલે ગતિ ૨૬, ૩૨, ૪૩,  
 ૫૦૦  
 વૃત્તિ-વિચાર ઉપરથી કક્ષાની  
 સમજણ ૮૨  
 વિચારનું સ્વચ્છંદીપણું ૪  
 વૃત્તિનો સદૃપ્યોગ કરી લો ૧૧,  
 ૭૪, ૧૭૮, ૫૦૦, ૫૦૧

વૈરાગ્ય અને પ્રાપ્ત ધર્મ-કર્તવ્યો  
 ૧૪૪, ૪૮૮  
 વૈરાગ્ય એટલે જગત મિથ્યા નહિએ  
 ૧૬૪, ૪૮૮  
 વૈરાગ્ય અને સંન્યસ્ત ૪૮૮-૪૮૯  
 વ્યક્તિ-અવ્યક્ત (કાવ્ય) ૮૦,  
 ૫૦૨  
 વ્યક્તિની ઉશ્રતિમાં સમાચિની  
 ઉશ્રતિ ૨૦૫, ૨૪૨  
 વ્યક્તિ-સ્વાતંત્ર્ય અને સ્વચ્છંદતા  
 ૧૩૬  
 વ્યવસ્થા-ગેરવ્યવસ્થા ૪૬, ૨૫૭  
 વ્યવસ્થા અને ઘરેડ ૧૩૩  
 વ્યાકુળતા પ્રગટવી જોઈશે ૪૧  
 પ્રતભંગ ૧૦૩  
 શક્તિનાં રમકડાં (કાવ્ય) ૫૦૫  
 શબ્દરી ૨૨૬  
 શરણભાવ ૩૮, ૫૧૦ થી ૫૧૧  
 શરણાગતિ(પ્રભુની)ની અમણા ૧૦  
 શરણાગતિની તાલીમ ૧૬૬,  
 ૨૧૭  
 શરણાગતિનો ભાર પ્રભુ ક્યારે લે ?  
 ૧૦  
 શરણાગતિ અને પ્રકૃતિનું દિવ્ય  
 રૂપાંતર ૬૮, ૭૭  
 શરણાગતિ વડીલોની ૭૩  
 શરણાગતિ એટલે ગુલામી નથી

૧૮૫  
 શરીરની સંભાળ અને આળપંપાળ  
 ૮૧, ૨૦૧  
 શરીરનું પણ દિવ્ય રૂપાંતર ૨૪૫  
 શરીરનું મહત્વ ૫૦૭ થી ૫૧૦  
 શંકા ૫૧૩, ૫૧૪  
 'શાંભુમેળા'ભર્યા વાતાવરણનો પણ  
 સ્વીકાર ૧૬૦  
 શારીરિક કષ, શ્રમની તાલીમ,  
 જરૂરી ૧૭૮  
 શારીરિક ચેતના અને વાતાવરણની  
 અસર ૧૭૫  
 શાખો ૪૭  
 શાખાર્થ કાળે કાળે બદલાય ૧૧૮  
 શુદ્ધિ, આંતર-બાધ્ય ૨૭, ૧૦૫  
 શુદ્ધિ-અશુદ્ધિની વ્યાખ્યા ૮૬  
 શૂન્ય ૨૮૧  
 શૂન્યતા ૧૭૩, ૧૭૭, ૨૧૭  
 શ્રદ્ધા ૧૦, ૨૧, ૨૫, ૬૩, ૮૧,  
 ૧૦૩, ૨૦૫, ૫૭૦, ૫૭૨  
 શ્રદ્ધા, અંધ ૭, ૧૭૮  
 શ્રદ્ધા જેવી, તેવી સિદ્ધિ ૩૫  
 શ્રદ્ધા નગદ નાશું ૮૧  
 સગડગ ૫, ૩૭૪  
 સત્ત્વગુણ ૩, ૩૧૧ થી ૩૧૪  
 સત્યનાં અનેક પાસાં ૧૬૧  
 સત્યનાં કથનમાંયે વિવેક રાખો  
 ૧૧૨

सत्यनो अनुभव २४, ४७	समर्पण सर्व कंठनुं, प्रभुने ८, ३८
सत्यनुं स्वरूप काणे काणे बदलाय ११८, १६८	समर्पण एकदम शरुमां पूर्णपणे थઈ जवुं शक्य नथी १४
सत्यनी सापेक्षता १८३, १८४	समर्पण साचुं ७८
सत्संगनो स्पर्श पर७ थी पर८	समर्पणयश्च जाण्येअजाण्ये १७८,
सत्संगसेवनना प्रकारो ११७	५१८-५१८
सत्संगनो महिमा २२४	समय-उपयोग-जंखना, विकासार्थे १८१
सद्गुण, सर्व दोईना जोवा ४०,	सरभामणी करवाथी अन्याय करीशुं १८८
सदाचार अने साधक १७२	सरभामणी कशानीये करवी अठीक १९८
सद्गुणनुं पण अभिमान होय छे २२८	सर्जनप्रवृत्ति, संहारप्रवृत्ति द्वारा पण १७४
सद्भाव ११, १५, २८, ६८, ७८, ८१, १०५, १०६, १८८, २०४, २३२	सलामत स्थिति पर२ थी पर४
सद्भावनो संतोष १५६	सलाह-सूचनो देवा कूदी न पडवुं ११०
सद्भावनानो विस्तार, ज्ञवननां सर्व क्षेत्रोमां ३१	सहन करवामां चण्यचणाटी न थवी धटे ११५
सद्भाव सहित अयोग्य वलणानो सामनो १५८	सहानुभूति राखो पण संडेवावुं नहि २५८
सद्भावनी केणवाणी १५४, ५२० थी पर२	सहिष्णुता २५, २७
समज्ञना जुदा जुदा प्रकारो ७५, ८८	सहीसलामतीनी वृत्ति छोडो २०८
समज्ञनुं चोकहुं १०५	सहेवानी साधना पर६, पर७
समज्ञ स्वयं उगे ते ठीक ६२	संकल्पबण ८
समता ८६, १३७	संकल्पबण शुद्धि ५३
समन्वय उपज्ञवो जरुरी ५८	संकुचित भानस ५७
समर्पण ५१५ थी ५१८	संकांतिकाण ४३

संकोचना प्रकार ८२, ४३३  
 संकोचो फगावी દો ४६, ५८  
 संघबद्धપણું જરૂરી ૨૩૭  
 સંગ્રામો, સંઘર્ષણો, જીવનવિકાસાર્થે  
     ૨૯, ૩૦, ૨૧૦, ૫૩૮,  
 સંજોગો, સર્વ, જીવનસાફલ્ય માટે  
     ૧૧૭  
 સંતસમાગમ ક્યારે ફળે ? ૩૨,  
     ૨૪૫, ૨૫૭, ૫૨૭, ૫૨૮  
     થી ૫૩૨  
 સંતાનો પ્રતિનો માબાપનો ધર્મ  
     ૫૩૮  
 સંતોની સરખામણી ના કરો ૩૩,  
     ૫૩૨  
 સંતોષ, ઉરદૌબલ્યજન્ય, વિધાતક  
     ૨૫૦  
 સંતોષ, બ્રાહ્મક ૮૮  
 સંન્યાસ સાચો, વૃત્તિનો ૧૪૭  
 સંબંધ, પ્રત્યેક, વિકાસાર્થે ૫૫  
 સંબંધોનો હેતુ, ભાવનાના  
     વિકાસાર્થે ૨૨૧  
 સંયમ પણ થી ૫૩૭  
 ‘સંયમ’ના ઉપદેશ (જીવનધ્યે  
     રહિતવાળાને)ની વ્યર્थતા  
     ૨૧૦  
 સંયમની વ્યાખ્યા ૧૨૨  
 સંયમ અને દમન ૧૪૮  
 સંવાદિતા, વિસંવાદિતાના

મૂળમાંયે ૩૪, ૧૮૫  
 સંસારમાં વૃદ્ધાવનનો અનુભવ ૭૬,  
     ૧૧૧, ૨૫૪  
 સંસારને આપણે વળગેલા છીએ  
     ૩૦  
 સંસાર છોડવો તે મિથ્યા છે ૩૦,  
     ૩૪, ૩૫  
 સંસાર પાઠશાળાછે ૨૮, ૩૫, ૬૮,  
     ૧૮૧, ૨૫૪, ૫૩૩ થી ૫૩૫  
 સંસાર, શક્તિના વિકાસાર્થે,  
     જ્ઞાનના અનુભવાર્થે ૩૦, ૬૪,  
     ૧૪૬  
 સંસાર ભગવાનનો વ્યક્ત ભાવ ૩૧  
 સંસાર અને પ્રાપ્ત ધર્મો ૧૪૭  
 સંસારી અને સાધક, બજેનાં કાર્યોનો  
     બાધ્ય પ્રકાર એક હશે છતાં તેની  
     પાછળના ભાવમાં પાયાનો  
     તફાવત ૨૩૦  
 સંસ્કાર-પ્રેમ-ભાવની શ્રેષ્ઠીઓ ૮૫  
 સંસ્કૃતિ આગવી, પ્રત્યેક સમાજની  
     ૨૦૬  
 સાકાર-પૂજાસંસ્કાર ચિરંજિવ છે,  
     ૨૨૬, ૨૨૭  
 સાક્ષાત્કાર એટલે શું ? ૪૪૪,  
     ૪૪૮  
 સાક્ષીભાવ ૭૧, ૨૧૬, ૫૬૧  
 સાતત્ય, એકના એક કર્મમાં  
     ભાવનાથી ૨૧૫

સાત્ત્વિક જીવનની આવશ્યકતા 34, 38  
 સાદ પ્રભુને પાડો ૧૦૧  
 સાધક અને નવા સંબંધો ૧  
 સાધક સાધનાની શરૂમાં વાચન ૧  
 સાધક અને પ્રકૃતિના હુમલા ૧૦૭  
 સાધક જીવનનાં લક્ષણો ૧૦૭,  
     ૨૪૪, ૨૪૫, ૨૪૬  
 સાધકની ઘેલછા અને ધૂન ૩૭  
 સાધકને સૂચનો ૧૦, ૧૧, ૧૩,  
     ૧૬, ૧૮, ૧૯, ૨૦, ૨૮,  
     ૩૭, ૭૧, ૧૬૬, ૧૬૭  
 સાધકનું સ્વજન પ્રતિનું વલણ પ૪૫  
     થી ૫૪૮  
 સાધક અને સમાજસુધારો ૨૩,  
     ૨૦૫  
 સાધકને કશાસાથે વિરોધનથી ૧૫૮  
 સાધક અને જગત ૧૩  
 સાધક અને ધર-નોકર ૫૫૦ થી  
     ૫૫૩  
 સાધક ૩૭, ૩૮, ૫૦  
 સાધકોનું માંહોમાંહેનું વર્તન ૫૫૩  
 સાધના ૧, ૪૫, ૨૩૬, ૫૪૧ થી  
     ૫૪૩  
 સાધનામાર્ગની ફિલેહની ચાવી  
     ૧૦, ૨૧૨  
 સાધનામાર્ગની કઠિનાઈઓ ૪૫,  
     ૧૮૨, ૨૦૭

સાધનામાર્ગ અંગે ઉપયોગી સૂચનો  
     ૨, ૩, ૧૨૭, ૧૨૮  
 સાધના કર્યી કરવામાં ૪  
     આત્મપ્રસંગતા ૧૧૮  
 સાધનાપથના પ્રકાર અનંત છે ૨૨૭  
 સાધના શાનમૂલક અને જીવંત  
     ભાવનાવાળી કરવી જોઈશે ૧૨,  
     ૧૩  
 સાધના કરવાની જરૂરે ૮, ૧૭, ૩૩,  
     ૮૭, ૮૮, ૫૪૨  
 સાધના ઘરેડથી ન થવી ઘટે ૫, ૨૩,  
     ૧૨૫  
 સાધનામાં રસ જગવવા વિષે ૫,  
     ૫૪૧  
 સાધના પણ ભગવાન જ કરાવશે,  
     એ બ્રમજા છે ૧૨  
 સાધનાનું હદ્ય, ભાવ ૧૩, ૮૬,  
     ૮૮-૯૦, ૨૦૨ ૨૩૮  
 સાધના એટલે શું? ૬૮, ૭૭, ૮૮-  
     ૯૦, ૨૦૨, ૨૩૮  
 સાધના અને વ્યવહારુ પ્રમાણ ૭૩  
 સાધનાની યથાર્થતાની પારાશીશી-  
     પ્રકૃતિનું રૂપાંતર ૨૦૨  
 સાધના કોઈ પણ ક્ષેત્રે શક્ય ૨૦૫,  
     ૨૪૬  
 સાધના અખંડપણે ૨૧૨, ૨૨૮  
 સાધના, એકાંતિકની શરૂમાં જરૂર  
     ૫૪૩

સાધનામાં આગળનો તબક્કો ૨૨  
 સાધના મુફ્તિસ પોખાકમાં,  
     નમ્રતાની તાલીમરૂપે ૨૧૦  
 સાધનામાં રસ ક્યારે પડે ? ૫૪૧  
 સાધનાનું રહસ્ય (કાવ્ય) પપહ થી  
     ૫૬૧  
 ‘સાધુ તો ચલતા ભલા’ ૧૬૧  
 સામાજિક ધરેડને તોડનારાઓ મૃતિ  
     સાધકનો વર્તાવ ૧૧૪  
 સારું-નરસું બને પ્રેરણાપ્રદ ૮૫,  
     ૧૧૧, ૩૦૩, ૩૦૪  
 સારું-નરસું પ્રતિ સદ્ગ્રાવ ૧૫૦

સારું-નરસું પ્રત્યેક પ્રવૃત્તિમાં અને  
     પ્રકૃતિમાં ૩૦૪  
 સાહિત્ય, ભાવનાને પ્રેરાવવા ૧૨૩  
 સાહિત્યનું મૂલ્યાંકન ભાવ-રહસ્ય  
     ઉપરથી ૨૩૩  
 સાંપ્રદાયિકતા એ ધર્મ નથી ૧૪૮,  
     ૧૪૯  
 સિદ્ધિઓ ૧૬૫  
 સુખદુઃખ, મન પર અવલંબે છે ૩૭,  
     ૪૫૬  
 સુખ, સાચું શેમાં ? ૧૮૬, ૫૬૩  
 સુમેળ (કાવ્ય) ૫૬૫

॥ હરિ:અં ॥

## સ્મરણભાવના

(હરિગીત)

પ્રિય નામને ઉરમાં સ્મર્યાં કરશું અમે બહુ પ્રેમથી,  
પ્રિય નામને ઉરમાં સ્મર્યાં કરશું અમે બહુ રીતથી;  
પ્રિય નામને ઉરમાં સ્મર્યાં કરશું અમે બહુ ખંતથી,  
તુજ નામનો પ્રભુ તંત જરી ના છોડશું હરગિજ કદી.... ૧

જીવન તણા અતિશય કઠણ દારુણ જંજાવાતમાં,  
કે સહુ દિશે સૂજે નહિ એવા જીવન અંધારમાં,  
જીવન તણી ચઢતી અને પડતી મહીં પળપળ સદા,  
તુજ નામનું પ્રિય સ્મરણ તે સાથી રહો મન-હૃદયમાં.... ૨

સંસારનાં કર્તવ્યમાં, વ્યવહારીઓની સાથમાં,  
સહુ કામમાં, ખાતાં, પીતાં, ઊઠતાં અને વળી બોલતાં;  
જે જે કંઈ કરતાં, બધાંની સાથ વર્તતાં સદા,  
તુજ નામનું પ્રિય સ્મરણ તે સાથી રહો મન-હૃદયમાં.... ૩

મુશ્કેલીમાં નડતી અમોને ને ઉપાધિમાં જગે,  
જઘડા અને કંકાસમાં, દિલમાં થતાં સહુ દર્દમાં;  
દિલની અમુંજણમાં અને આવી પડેલી ગૂંચમાં,  
તુજ નામનું પ્રિય સ્મરણ તે સાથી રહો મન-હૃદયમાં.... ૪

મનના વિચારોમાં અને મનની બધીયે વૃત્તિમાં,  
મન વાસનામાં, પાપમાં, ચિત્તના બધા સંસ્કારમાં;  
મનની રમત ને ગમતમાં, મનના રમણ ને વલણમાં,  
તુજ નામનું પ્રિય સ્મરણ તે સાથી રહો મન-હૃદયમાં.... ૫

અમ શરીરથી બનતી કિયામાં, ઈદ્રિયોના વિષયમાં,  
અમ શરીર કેરા રોમરોમે, હૃદય કેરા લોહીમાં;  
રગ રગ મહીં, નખશિખ મહીં, ને શરીરના નવ દ્વારમાં,  
તુજ નામનું પ્રિય સ્મરણ તે સાથી રહો મન-હૃદયમાં.... ૬

ખટ રસ તણા સહુ સ્વાદમાં, મીઠી મીઠી બધી વાસમાં,  
ઉર ચેતનામાં, બુદ્ધિમાં, ચિત્ત પ્રેરણા મહીં, પ્રાણમાં;  
અમ લાગળીમાં, ભાવનામાં, પ્રેમમાં, રસમાં બધા,  
તુજ નામનું પ્રિય સ્મરણ તે સાથી રહો મનહદ્યમાં.... ૭

આધાર સૌ નિજનો સદા માની ઉપર જે ધારતું,  
માને અતિશય વૃદ્ધાલથી જ્યમ બાલું પોકારતું;  
વિખૂટું પડેલું મારીથી હરપળ કરે શું આરડચાં !  
તેવી રીતે તુજ નામ પ્રભુ ! તારું સ્મરાજો તાનમાં.... ૮

જીવન તણા સહુ ભંગમાં, જીવન તણા સૌ રંગમાં,  
જીવન તણા એ અટપટા આડા ઊભા સૌ તારમાં,  
મારી ગમે તેવી ભલે હો સર્વ જીવન-ભાતમાં,  
રસીલું વણાયાં ત્યાં કરો પ્રિય નામ તારું ભાવમાં.... ૯

સંબંધીઓ ને સ્વજનની સહુ વાતમાં ને ચીતમાં,  
સંસારના વ્યવહારમાં ને જે થતાં સહુ કાર્યમાં;  
પત્ની અને પરિવારમાં છોને પરોવાયેલ હો,  
તે તે દશા માંછે પ્રભો ! તુજ નામ પ્રિય હૈયે વસો.... ૧૦

પ્રિય નામ - સૂર્ય ઊર્યા થકી ઝીટે જીવન-અંધાર સૌ,  
એવું કૃપાથી જીવનમાં અમને ફૂલવજો, ફળવજો,  
ચાનક અમોને લાગજો તુજ દિવ્ય જે પ્રિય નામની,  
પ્રગટી રહો અમ જીવન તે છાયા રૂપે તુજ પ્રેમની.... ૧૧

સારાય જીવન-પટ તણા તાણા અને વાણા વિશે,  
ભીજાયેલા હો રગરગે તુજ પ્રેમથી રંગાયેલા;  
તુજ નામના પ્રિય સ્મરણના ઠોકે સદા ઠોકાયેલા,  
એવું પ્રભુ-પદ હો સમર્પિત આ જીવન, હો તુજ કૃપા... ૧૨

તુજ નામનો મહિમા ઋષિઓ કેંક ભક્ત કવિ કથે,  
હું તો બિચારું રાંકડું તે શું કથી કથીને કથે ?  
જ્યમ સૂર્ય આગળ આગિયો, દરિયા કને ખાબોચિયું.

હીરા કને જ્યમ કાચ એવો સાવ હું નાદાન છું.... ૧૩  
'શ્રીગંગાચરણો', આ. ૧, પૃ. ૨૮ થી ૩૨

- મોટા

## સાધનામહ

૧. મુખથી કે મનમાં જાગૃતપણે જ્ય, સાથે સાથે હદ્યપ્રદેશે ધ્યાન તથા ચેતનના ચિંતન સહ ભાવાત્મક ભાવનું રટણ.
૨. પ્રત્યેક પળે સતત સમર્પણ, સારું તેમ જ નરસું-બંનેનું.
૩. સાક્ષીભાવ, જાગૃતિ; વિચારોની સાંકળ ન જોડો.
૪. બને તેટલું વધુ વાચિક અને માનસિક મૌન રાખો, કેળવો; અને ખૂબખૂબ શરણભાવ જીવનમાં ચેતનાપૂર્વકની જાગૃતિથી કેળવ્યાં કરો.
૫. આગ્રહો—પ્રભુચિંતન સિવાયના સર્વ આગ્રહો છોડો, નમ્રતા કેળવો; શૂન્ય થવાનું ધ્યેય રાખો.
૬. ખૂબ ભાવપૂર્વક હદ્યસ્થ રહીને આર્દ્ર અને આર્તભાવથી પ્રાર્થના કરો; ભગવાનને સર્વ સુખદુઃખ જાગ્રાવતા રહો; તેની સાથે આત્મનિવેદન દ્વારા અંગત ખૂબ ગાઢો સંબંધ બાંધો; મનમાં કશુંયે ઘોળાવા ન દો. ખાલી રહો.
૭. આવી પડતાં કામો પ્રભુનાં સમજો; જરાયે કચવાટ વિના ખૂબ પ્રેમપૂર્વક તે કરો. પ્રત્યેક પ્રસંગ-બનાવ આપણા કલ્યાણ અર્થે જ છે અને પ્રત્યેક પ્રવૃત્તિ આપણા પોતાના જ વિકાસાર્થે થવી ધટે. પ્રત્યેક પ્રસંગ પાછળ પ્રભુનો ગૂઢ, શુભ સંકેત રહેલો છે.
૮. આત્મલક્ષી-અંતર્મુખી થાઓ, માત્ર પોતાની દુનિયામાં વસો. જાણી-જોઈને જાતને સંડોવાવા દો નહિ.
૯. પર (પારકાંની) સેવા પ્રભુની સેવા સમજો; સેવા લેનાર, સેવા દેનાર ઉપર, સેવા કરવાની તક આપીને ઉપકાર કરે છે. રામે આખ્યું છે ને રામને દઈએછીએ, ત્યાં ‘મારું’ ‘મારું’ ક્યાં રહ્યું? તારું આ જગતમાં છે શું?
૧૦. પ્રત્યેક કાર્ય, પ્રત્યેક વાતચીત, વ્યવહાર આપણા ધ્યેયને વેગ આપે એવા ખાસ હેતુસર, હેતુનું લક્ષ જીવંત રાખીને કરવાં. વાંચતી-લખતી વખતે ને પ્રત્યેક કર્મ કરતી પળે ભાવની સ્મરણ-ધારણાનો અભ્યાસ કેળવ્યાં કરો.
૧૧. વૃત્તિનું મૂળ શોધો, તેનું પૃથક્કરણ કરો. તેમાં ભેળવાયા વિના તેને તટસ્થતાપૂર્વક અને સ્વસ્થતાપૂર્વક નિહાળો.
૧૨. પ્રભુની પ્રત્યેક કળા, સૌદર્ય, રમ્યતા, વિશુદ્ધતા આદિ પ્રસાદીઓમાં

રહેલા ભાવનું, તેને તેને અનુરૂપ ભાવનું, આપણામાં ત્યારે અવતરણ થવા પ્રાર્થના કરવી.

૧૩. ઉર્ભિ, આવેશ ને લાગણીને એમ ને એમ વહી જવાન દો, તેમ જ તેમાં બેળવાઈ પણ ન જાઓ. તેનો સાધનામાં ઉપયોગ કરો, તાટસ્થ્ય કેળવો.

૧૪. જમતી વખતે અને પાણી પીતી વખતે જીવનમાં ચેતનશક્તિના અવતરણ-ભાવની પ્રાર્થના કરવી; શૌચ, પેશાબ આદિ કિયાઓ સમયે વિકારો, નબળાઈઓ ઈત્યાદિની વિસર્જનભાવની પ્રાર્થના કરવી.

૧૫. સ્થૂળનો ઘ્યાલ ત્યજને સૂક્ષ્મ તત્ત્વને નજર સામે રાખો. વૃત્તિની શુદ્ધિ કરો, ભાવની વૃદ્ધિ કરો.

૧૬. પ્રભુ સચરાચર છે. ‘આત્મવત् સર્વભૂતેષુ’ની ભાવના કેળવો.

૧૭. પ્રત્યેક વ્યક્તિ અને વસ્તુની ઉજળી બાજુ જુઓ. કોઈનાય કાળ ન થાઓ; કશાય ઉપર ઝટ અભિપ્રાય ન આપો; વાદવિવાદ ના કરો; પોતાનો આગ્રહ ના રાખો; બીજાઓમાં શુભ હેતુઓનું આરોપણ કરો; માનસિક અને સાર્વત્રિક ઉદારતા જીવનમાં પ્રગટાવો; ખૂબ પ્રેમભાવ કેળવો; પ્રકૃતિનું રૂપાંતર કરવાનું છે, તે લક્ષ્યમાં રાખીને પ્રકૃતિવશ થતાં કર્માની ઉપરવટ વર્તો; ફળની આસક્તિ છોડો; પોતાને થતા અન્યાયો, આવી પડતાં દુઃખો આદિનું મૂળ પોતામાં જ છે એમ દઢાવો; ગુરુમાં પ્રેમભક્તિભાવ દઢતર કર્યા કરો; અભીષ્ટા, ઈન્કાર અને સમર્પણનો ત્રિવેણીસંગમ ઉદ્ભબવાવો; સદ્ય પ્રસન્નતા પ્રવર્તાવો; કૃપા અને પુરુષાર્થના યુગલને જીવનમાં ઉતારો; પ્રત્યેક કર્મના આદિ, મધ્ય અને અંતમાં પ્રભુની સ્મૃતિ પ્રગટાવો; મન નિઃસ્પંદ કરો; રાગદ્વેષ નિર્મૂળ કરવા જાગૃતિ રાખો; થયેલા આધ્યાત્મિક અનુભવો પ્રત્યક્ષ રોજિંદા વ્યવહારમાં જીવતા કરો; ક્યાંયે કશામાંથી ભાગવાનું ના હોય; યદ્યચ્છા જે આવી મળે તે પ્રભુપ્રસાદી ગણીને તેને વધાવી લો; ક્યાંયે કોઈની સરખામણી ના કરો; અનુકૂળ- પ્રતિકૂળ પરિસ્થિતિ એ મનની ભ્રમણા છે; જીવનસાધના સારુ સર્વ કંઈ સાનુકૂળ જ હોય છે; પ્રભુમય—તેના મૂક યંત્ર—થવાની જ બસ એક ઉતેજના હવે જીવનમાં રાખો.

૧૮. કર્મમાં, કર્મનું મહત્ત્વ નથી, પરંતુ જીવનના ભાવનું સતત એકધારું, જીવનું ચિંતન રહ્યાં કરે એ સવિશેષપણે મહત્ત્વનું છે. તેવો જીવતો અભ્યાસ કર્મ કરતી પળે કેળવવો.

- મોટા

॥ હરિઃઊં ॥

## આરતી

ॐ શરણચરણ લેજો, પ્રભુ શરણચરણ લેજો,  
પતિત ઉગારી લેજો (૨) કર ગ્રહી ઉર લેજો. ... ઓં શરણ.

મનવાણીના ભાવો, કર્મ વિષે ઉતરો, પ્રભુ (૨)  
મન, વાણી ને દિલને (૨) કૃપાથી એક કરો. ... ઓં શરણ.

સર્વ મળેલાં સાથે, દિલ સદ્ગ્રાવ ઉગો, પ્રભુ (૨)  
છો અપમાન થયાં હો (૨) ત્યાંયે ભાવ બઢો. ... ઓં શરણ.

નિભ પ્રકારની વૃત્તિ, ઉર્ધ્વગમન કરવા, પ્રભુ (૨)  
પ્રભુકૃપાથી મથાજો (૨) ચરણશરણ ગ્રહવા. ... ઓં શરણ.

મનના સકળ વિચારો, પ્રાણતણી વૃત્તિ, પ્રભુ (૨)  
બુદ્ધિતણી સૌ શંકા (૨) ચરણકમળ ગળજો. ... ઓં શરણ.

દિલમાં કંઈક ભર્યું હો, તે થકી બીજું ઉલટું, પ્રભુ (૨)  
કદી પણ મુજથી ન બનજો (૨) એવી મતિ દેજો. ... ઓં શરણ.

જ્યાં જ્યાં ગુણ ને ભાવ, દિલ ત્યાં મુજ ઠરજો, પ્રભુ (૨)  
ગુણ ને ભાવની ભક્તિ (૨) દિલ મુજ સંચરજો. ... ઓં શરણ.

મન, મતિ, પ્રાણ પ્રભુ ! તુજ ભાવ થકી ગળજો, પ્રભુ (૨)  
દિલમાં તુજ ભક્તિની (૨) છોળો ઉછળજો. ... ઓં શરણ.

-શ્રીમોટા

॥ હરિ:ઊ ॥

## પૂજ્ય શ્રીમોટાના જીવનની મહિત્વની તવારીખ

જન્મ : તા. ૪-૬-૧૮૮૮, ભાડરવા વદ ચોથ, સંવત ૧૯૫૪

સ્થળ : સાવલી, જિ. વડોદરા, નામ : ચુનીલાલ,

માતા : સુરજભા, પિતા : આશારામ, અટક : ભાવસાર.

૧૯૧૬ : પિતાનું અવસાન.

૧૯૦૫ થી ૧૯૧૮ : તૂટક અભ્યાસ-સાથે આકરી મજૂરી.

૧૯૧૯ : મેટ્રિક પાસ.

૧૯૧૯-૨૦ : વડોદરા કોલેજમાં.

તા. ૬-૪-૧૯૨૧ : કોલેજ ત્યાગ.

૧૯૨૧ : ગુજરાત વિદ્યાપીઠ.

૧૯૨૧ : વિદ્યાપીઠનો ત્યાગ. હરિજન સેવાનો આરંભ.

૧૯૨૨ : ફેફદુના રોગથી કંટાળીને ગરુડેશ્વરની ભેખડ ઉપરથી આત્મહત્યાનો પ્રયાસ, દૈવી બચાવ, ‘હરિ:ઊ’ જપથી રોગ મટાડવાનો સફળ પ્રયોગ.

૧૯૨૩ : ‘તુજ ચરણો’ તથા ‘મનને’ની રચના.

૧૯૨૩ : વસંતપંચમીએ પૂ. શ્રીબાળયોગીજી દ્વારા દીક્ષા. શ્રીકેશવાનંદ ધૂળીવાળા દાદાનાં દર્શને - સાંઈઝેડા ગયા. રાત્રે સ્મશાનમાં સાધના અને દિવસભર પ્રભુપ્રીત્યર્થે હરિજન સેવા.

૧૯૨૬ : લગ્ન-હસ્તમેળાપ વખતે સમાચિનો અનુભવ.

૧૯૨૭ : હરિજન આશ્રમ, બોદાલમાં સર્પદંશ-પરિણામે ‘હરિ:ઊ’ જપ અંદ થયો.

૧૯૨૮ : ‘તુજ ચરણો’ ની પ્રથમ આવૃત્તિનું પ્રકાશન.

૧૯૨૮ : પહેલી ડિમાલય યાત્રા.

૧૯૨૮ : સાકોરીના પૂ. શ્રીઉપાસની બાબાનું નાયાદમાં આગમન, એમના આદેશ મુજબ સાકોરી જવું-ત્યાં મળમૂત્રની પથારીમાં સાત દિવસ.

૧૯૩૦ : મનની નીરવતાનો સાક્ષાત્કાર.

૧૯૩૦ થી ’૩૨ દરમિયાન સાબરમતી, વીસાપુર, નાસિક અને યરવડા જેલમાં. હેતુ-દેશસેવાનો નહિ, સાધનાનો. સખત પરિશ્રમ અને લાઠીમાર દરમિયાન પ્રભુસ્મરણ-મૌન. વિદ્યાર્થીઓને સમજાવવા વીસાપુર જેલમાં સરળ ગુજરાતી ભાષામાં શ્રીમદ્ ભગવદ્ગીતા ‘જીવનગીતા’ લખી.

૧૯૩૪ : સગુજા બ્રહ્મનો સાક્ષાત્કાર.

૧૯૭૪થી ૧૯૭૮ દરમિયાન હિમાલયમાં અઘોરી બાવા પાસે જવાનું બન્યું, ધૂવાધારના ધોખની પાછળની ગુફામાં સાધના. ચૈત્ર માસમાં ૨૧ છાણાંની ૬૩ ધૂણી ધ્યાની નર્મદાકિનારે ખુલ્લામાં શિલા ઉપર નજીબેસીને સાધના, શિરડીના સાંદીબાબાનું પ્રત્યક્ષ દર્શન-આદેશ-સાધનાના અંતિમ તબક્કાનું માર્ગદર્શન.

૧૯૭૯ : તા. ૨૮-૩-૧૯૭૯ : રામનવમી, સંવત : ૧૯૮૫ કાશીમાં નિર્ગૃહ બ્રહ્મનો સાક્ષાત્કાર. હરિજન સેવક સંઘમાંથી રાજીનામું. ‘મનને’ની પ્રથમ આવૃત્તિનું પ્રકાશન.

૧૯૮૦ : (તા. ૮-૮-૧૯૮૦) વિમાનમાર્ગ અમદાવાદથી કરાંચી જવાનો ગૂઠ હુકમ.

૧૯૮૧ : માતાનું અવસાન.

૧૯૮૨ : હરિજન સેવક સંઘમાંથી છૂટા થયેલા, છતાં હરિજન કન્યાછાત્રાલય માટે મુંબઈમાં ફાળો ઉઘરાવ્યો. બે વખત સખત પોલીસમાર-દેહાતીત અવસ્થાના પુરાવા.

૧૯૮૩ : ૨૪, ફેબ્રુઆરીમાં ગાંધીજીના પેશાબના જેરી જંતુઓનું પોતાના પેશાબમાં દર્શન. નૈમિત્તિક તાદાત્મ્યનો અનુભવ.

૧૯૮૪ : હિમાલયની યાત્રા-અદ્ભુત અનુભવો.

૧૯૮૬ : હરિજન આશ્રમ, અમદાવાદ મીરાંકુટિરમાં મૌનએકાંતનો આરંભ.

૧૯૮૦ : દક્ષિણ ભારતના કુંભકોણમ્ભૂમાં કાવેરી નદીને કિનારે હરિઃઊં આશ્રમની સ્થાપના.

૧૯૮૪ થી સુરત કુરુક્ષેત્ર સ્મશાનની ધર્મશાળામાં મૌનએકાંતનો આરંભ.

૧૯૮૫ : (તા. ૨૮-૪-૧૯૮૫) નાદિયાદ, શેઢીનદીને કિનારે હરિઃઊં આશ્રમની સ્થાપના.

૧૯૮૬ : (તા. ૨૩-૪-૧૯૮૬) સુરત, કુરુક્ષેત્રમાં હરિઃઊં આશ્રમની સ્થાપના.

૧૯૮૨ થી ૧૯૭૫ : શરીરના અનેક રોગો-સતત પ્રવાસ સાથે ઉદ્યોગ-અનુભવ ગ્રંથોનું લેખન-પ્રકાશન.

૧૯૭૬ : ફાજલપુર-મહી નદીના કિનારે શ્રી રમણભાઈ અમીનના ફાર્મ હાઉસમાં તા. ૨૩-૭-૧૯૭૬ના રોજ માત્ર છ જણાની હાજરીમાં આનંદપૂર્વક દેહત્યાગ. પોતાનું ‘ઈટ-ચૂનાનું સ્મારક ન કરવાનો આદેશ’ અને આ નિમિત્ત મળેલી રકમનો ઉપયોગ દૂર ગુજરાતનાં પણત ગામોમાં પ્રાથમિક શાળાના ઓરડાઓ બંધાવવાના લોકફાળામાં કરવાની સૂચના.

॥ હરિઃઊં ॥

## પૂજય શ્રીમાટોનાં પુરુતકા

૧. મનાને (પદ્ય)	૨૨. જીવનપોકર (પત્રો)	૪૪. જીવનસૌરેખ (પદ્ય)	૬૭. કર્મિઓપસના (પદ્ય)
૨. તુજ ચરણે (પદ્ય)	૨૩. આતપોકર (પ્રાથના)	૪૫. જીવનસરણે સાધના (પદ્ય)	૬૮. મૌનએકાંતની કૃપીએ (પ્રવચન)
૩. ફિદ્યપોકર (પદ્ય)	૨૪. હરિજન સંતો (ગદ્ય-પદ્ય)	૪૬. જીવનરંગત (પદ્ય)	૬૯. મૌનમંહિરનું લરિદાર (પ્રવચન)
૪. જીવનપગલે (પદ્ય)	૨૫. Life's Struggle (જીવનસત્ત્વામાંનો અનુવાદ)	૪૭. જીવનમથામજુ (પદ્ય)	૭૦. મૌનમહિરનો મર્મ (પ્રવચન)
૫. શ્રીગંગાંગણે (પદ્ય)	૨૬. જીવનપાઠક (પત્રો)	૪૮. કૃપા (પદ્ય)	૭૧. મૌનમંહિરિમાં પ્રાયુ (પ્રવચન)
૬. કેશવયરણકર્મો (પદ્ય)	૨૭. જીવનમંધન (પત્રો)	૪૯. સ્વાર્થ (પદ્ય)	૭૨. મૌનમંહિરિમાં માણગુતીલા(પ્રવચન)
૭. કર્મબિદ્ધા (પદ્ય)	૨૮. નાર્મદાપદ્દ (પદ્ય)	૫૦. શીસદગ્દુકુ (પદ્ય)	૭૩. રોષ-વિશોષ (સત્સંગ)
૮. પ્રજાયમલાપ (પદ્ય)	૨૯. જીવનસર્વધન (પત્રો)	૫૧. જીવનકથની (પદ્ય)	૭૪. જન્મ-પુનર્જન્મ (સત્સંગ)
૯. પુનિત પ્રેમગાંધી (પદ્ય)	૩૦. જીવનદર્શન (પત્રો)	૫૨. પ્રેમ (પદ્ય)	૭૫. તદ્દુપ-સર્વરૂપ (સત્સંગ)
૧૦. જીવનસત્ત્વામ (પત્રો)	૩૧. અભ્યાસિને (પદ્ય)	૫૩. જીવનસર્વધન (પદ્ય)	૭૬. અન્ત્રા-એકશ્રાતા (સત્સંગ)
૧૧. જીવનસર્વદીશ (પત્રો)	૩૨. જીવનસર્વદાશ (સત્સંગ)	૫૪. મોહ (પદ્ય)	૭૭. જીવાજુ (સત્સંગ)
૧૨. જીવનપાઠેય (પત્રો)	૩૩. જીજાસા (પદ્ય)	૫૫. જુઘાવિમર્શ (પદ્ય)	૭૮. અન્ત્રા-સમન્વય (સત્સંગ)
૧૩. AT THY LOTUS FEET (તુજ ચરણેનો અનુવાદ)	૩૪. જીવનાલક (પદ્ય)	૫૬. જીવનપુરાંડી (પદ્ય)	૭૯. ગ્રંથાલક્ષણ (સત્સંગ)
૧૪. જીવનપ્રથમા (પત્રો)	૩૫. જીવનાલાદિ (પદ્ય)	૫૭. જીવનાલાદિ (પદ્ય)	૮૦. એકીકરણ-સમીકરણ (સત્સંગ)
૧૫. TO THE MIND (મનનેનો અનુવાદ)	૩૬. જીવનસરણ (પદ્ય)	૫૮. જીવનાલાદિર (પદ્ય)	૮૧. પગલે પગલે પ્રકાશ (પત્રો)
૧૬. જીવનપુરાંડી (પત્રો)	૩૭. શક્તા (પદ્ય)	૫૯. જીવનધારતર (પદ્ય)	૮૨. કંસ્ટરની સામે (પત્રો)
૧૭. જીવનપગલથી (પત્રો)	૩૮. ભાવ (પદ્ય)	૬૦. ભાવકણિકા (પદ્ય)	૮૩. ધનનો ધોગ
૧૮. જીવનમંધાજુ (પત્રો)	૩૯. જીવનરસાયથી (પદ્ય)	૬૧. ભાવરેણુ (પદ્ય)	૮૪. મુક્તાસાનો પ્રેમસ્પર્શ (પત્રો)
૧૯. જીવનપગલથી (પત્રો)	૪૦. નિમિતા (પદ્ય)	૬૨. ભાવરોતી (પદ્ય)	૮૫. સંતરહદ્દય (પત્રો)
૨૦. જીવનપ્રથમા (પત્રો)	૪૧. રાગદ્વિષ (પદ્ય)	૬૩. ભાવપુષ્પ (પદ્ય)	૮૬. સમય સાથે સમાધાન (પત્રો)
૨૧. જીવનપગલથી (પદ્ય)	૪૨. જીવનપ્રથમાલાદ (પદ્ય)	૬૪. ભાવાલા (પદ્ય)	૮૭. ઉપરાંત ઉપરાંતો પુસ્તકોમથી થૈપેલાં ૧૫ સંકલનો.
૨૨. જીવનપોકર (પત્રો)	૪૩. જીવનગાતી (ગદ્ય-પદ્ય)	૬૫. જીવનપ્રથમાલ (પદ્ય)	૮૮. જીવનપરાગ (પદ્ય)

## માનવદેહ

(અનુષ્ટુપ)

માળખું માનવીનું જે મળ્યું તે પ્રભુની કૃપા,  
માનવીદેહને તો કો ગુમાવો ના કદી વૃથા.  
મનખાદેહ સદ્ગ્રામ્યે મળેલો ચેતવા હદે,  
કૃપા રાખી ઉંડો ઘ્યાલ યાચ્યું તે જીવજો હદે.  
‘માનવી જિંદગી કેવી પ્રભુની ભેટ !’ જાણીને,  
એને સર્જીવીને પૂરી સાર્થ તે કરજો પદે.  
પ્રભુનો પ્રેમ લેવાને જન્મેલાં આપણે છીએ,  
તે વિના કો બીજો હેતુ છે ના જીવનનો ખરે.  
નિષ્ઠા જેને પૂરેપૂરી એવી બેઠેલી છે હદે,  
માનવી જન્મની શી તે યથાર્થતા પિણાનશે.  
માનવી દેહથી માત્ર સૌ વિકાસ થવાતણી  
-શક્યતાઓ ભરેલી છે ધન્યતા એથી એની શી !

- શ્રીમોટા

‘જીવનપરાગ’, બીજી આ., પૃ. ૪૨૬